

Y F

BOT

I TA

are than is required growth of your hair. When use of Kuntaline leads you than usual, to your mirror, and the once-thin hair grown to g profusion and radiant with life, you ask yourself why you did not, before, use this fragrant restorer KUNTALINE, which has b demand by people of finement. Once you use other hair oils lose their char

Put up in following odours:—

Sweet, Lily, Rose, Jasmin,
Lotus, Violet, Bouquet.

A PROOF OF PURITY.

lytical Certificate from Dr. Sir P. C. Ray, K. T., the pre-eminent Chemist of India—

have put to careful analysis a sample of K by Mr. H Bose and I have f oil in a highly refined state and perfectly lkali, metal or other injurious ingredients Alcohol. It is likewise very agreeab onfidently recommend it as a really good

ked by—

Swadeshi Co-operative Stores Ltd. Bombay & Poo.
Guzrat Stores, Girgam Back Road, Bombay.
Sind Swadeshi Stores Ltd., Karachi.
Shri Krishna Stores Co. Ltd., Fort, Bombay.

WHOLESALE AGENTS EVERYWHERE.

ટુંક વખતમાં

જરથોસ્તી કોમમાં

જાહેર થયલી

મલબારીજ સુખડની દુકાન

ફેરેદુન અને બરજોર.

આતશબેહેરામોની સાંમે

ધોબીતલાવ—ન

હમારી દુકાને નવસારીની કસ્તીઓ, નારા, નાહાનાં
તા, ચાંદીના તથા જરમણ સીલવરનાં વાસણો
મલશે.

HONGKONG & SHANGHAI BANKING CORPORATION.

હોંગકોંગ એન્ડ શેંગાહી બેંકીંગ કોરપોરેશન.

હાંગકાંગમાં સ્થાપેલી.

ભરાયલી થાપણ	ડાલર	૧૫,૦૦૦,૦૦૦
માલેકોની જોખમદારી	”	૧૫,૦૦૦,૦૦૦
સીલવર રીઝરવ ફંડ	”	૨૧,૦૦૦,૦૦૦
ગોલ્ડ રીઝરવ ફંડ	પાઉંડ	૧,૫૦૦,૦૦૦

ડાયરેકટરોની કોરટ અને હેડ ઓફીસ—હોંગકોંગ.

એન. જે. સ્ટેબ—વડો મેનેજર.

શાખાઓ અને આડતો.

એમોય	હરબીન	મલાકા	શેંગાઈ
બેંગકોક	હોંગકોંગ	મનીલા	સીંગાપોર
બટેવયા	હોંગકયું	નાગાસાકી	સુરબાયા
મુંબઈ	ઈપોહ	નયુયોરક	ટીનટસીન
કલકતા	જોહોર	પેકીંગ	સીંગટાઉ
કંતાન	કોબે	પીનાંગ	વલાદી વોસતોક
કોલંબો	કુઆલા લમપુર	રંગુન	યોકોહામાં
કુચાઉ	લંડન	શેઈગાન	ઈલોઈલો
હેનકાઉ	લાયનસ	સાન ફ્રાનસીસ્કો	

મુંબઇની આડત.

ચાલુ હીસાબપર દરરોજની બાકી ઉપર દર વરસે જો રૂ.૧,૦૦૦ ની અંદર ન હોય અને રૂ. ૧,૦૦,૦૦૦ થી વધારે નહીં હોય તો સેંકડે બે ટકાનું વ્યાજ આપવામાં આવે છે, પણ જો દર ૭ માસે વ્યાજ રૂ ૫) જેટલું નહીં હોય ત્યારે તે અપાતું નથી.

બાંધી ડીપાઝીટો બાર માસ સુધીની જુદી જુદી મુદત માટે લેવાય છે જે વીષેની શરતો અરજ કીધાથી જણાવવામાં આવશે.

સધર જામીનગીરીપર નાણાં ધીરવામાં આવે છે અને બીલો ખરીદવામાં આવે છે તથા દરેક જાતનું સરાફી તેમજ વટાવને લગતું કામકાજ થાય છે.

યુરોપ, હીંદુસ્તાન, આસ્ટ્રેલીઆ, અમેરીકા, ચીન અને જાપાનના મુખ્ય વેપારના મથકો ઉપર તથા લંડનના દરાફતો આપવામાં આવે છે.

સી. એચ. વીલસન,

એજન્ટ.

૪૦, ચરચગેટ સ્ટ્રીટ—**મુંબઇ.**

શ્રી સરકાર ગાયકવાડના આશ્રા હેઠલ સ્થપાયલી અને શ્રી મહારાજા સાહેબની મોટી મદદ ધરાવતી

ધી બેંક ઓફ બરોડા લીમીટેડ.

વડોદરા રાજ્યના બેંકર્સ.

(સને ૧૮૯૭ ના બરોડા કંપનીના એક્ટ ત્રીજા પ્રમાણે રજીસ્ટર થયલી)

હેડ **ઓફીસ**—માંડવી પાસે, **વડોદરા.**

બ્રાંચીઝઃ—અમદાવાદ, નવસારી, મહેસાણા, સુરત, અને મુંબઇ.

કુલ્લે થાપણ	રૂ.	૬૦,૦૦,૦૦૦
ભરાયલી થાપણ	રૂ.	૨૦,૦૦,૦૦૦
રીઝરવ ફંડ	રૂ.	૧૨,૫૦,૦૦૦

ડીરેકટરો.

(૧) ઓ૦ મી૦ લલ્લુભાઇ શામળદાસ, સી૦ આઇ૦ ઇ૦ ચેરમેન.

(૨) માધવજી દામોદર ઠાકરસી.

(૩) રા૦ રા૦ ભાસ્કરરાવ વીઠલદાસ મહેતા, એડવોકેટ, હાઇ કોર્ટ, મુંબઈ.

(૪) રાજરતન શેઠ મગનભાઇ પી૦ હરીભકતી નગરશેઠ (વડોદરા.)

(૫) શેઠ મગનલાલ હરગોવીંદદાસ કાંટાવાળા, વડોદરા મહારાજા મીલ્સના એજન્ટ.

(૬) શેઠ મણીલાલ રેવાદાસ (વડનગર.)

(૭) રા૦ બા૦ ગુનાજીરાવ રાજબા નીંબાલકર, વડોદરા.

(૮) રા૦ રા૦ રાવજી રઘુનાથ શીરગાવકર. નાયબ સુબા, વડોદરા રાજ્ય.

(૯) રા૦ રા૦ એ. એન. દાતાર, એકાઉન્ટન્ટ જનરલ, વડોદરા રાજ્ય.

ચાલુ ડીપાઝીટ ખાતાંઓ—રૂ૩૦૦ થી ૧૦૦૦૦૦)ની દરરોજની શીલક ઉપર દર વરસે દર સેંકડે બે ટકાનું વયાજ આપવામાં આવે છે અને તેથી વધુ રકમ ઉપર ખાસ જુદી ગોઠવણ કરવામાં આવશે. અરધા વરસનું રૂપયા ત્રણથી ઓછું વયાજ થતું હશે તો તે આપવામાં આવશે નહીં.

બાંધી મુદતનાં ડીપાઝીટ ખાતાં.—બાર મહીનાની બાંધી મુદતની અને તેથી વધારે અને ઓછી મુદતની ડીપાઝીટ માટેના ભાવ અરજ કરવાથી જણાવવામાં આવશે.

સેવીંગસ બેંક.—આ બેંકમાં સેવીંગસ બેંકનાં ખાતાં ઉઘાડવામાં આવે છે અને તે ઉપર દર વરસે દર સેંકડે ચાર ટકા બ્યાજ આપવામાં આવે છે, એક વરસમાં રૂ ૧૦૦૦) વયાજ સીવાય ને એકંદરે રૂ. ૫૦૦૦) સુધી દરેક ખાતાંમાં છેલ્લાજ વરસના વયાજ સીવાય રાખવામાં આવે છે. એક કરતાં વધારે નામો ઉપર ખાતાં ઉઘાડી શકાય છે; પરંતુ એક નામ ઉપર એકથી વધારે ખાતાં ઉઘાડી શકાતાં નથી.

લોનસ વીગેરે.—હુંડી અને એવાંજ બીજાં કીમતી કાગળયાં ઉપર, સધ્ધર જામીનગીરી ઉપર તથા વયાજબી રકમની મીલકત કબજામાં રાખી ખાસ ઠરાવેલા ભાવે તથા શરતે બેંક નાણાં ધીરે છે. ઘરાકોના સ્ટોકસ, શેરો, જામીનગીરીનાં કાગળયાં, ઘરેણાં, ઝવેરાત વીગેરે કીમતી તથા જોખમી ચીજો સહીસલામત રાખવાનું, પ્રોમીશરી નોટો, ડીબેનચરસ, સ્ટોકસ શેરો વીગેરે વયાજ આપતાં કાગળં ઉપરનું વયાજ ઉઘરાવી આપવાનું તથા ગવરમેન્ટ પેપર અને બધી જાતના શેર, સ્ટોક ડીબેનચરસ ને તેવીજ જાતનાં કાગળયાં વેચી તથા ખરીદી આપવાનું કામ બેંક કરે છે.

સી૦ ઇ૦ રેનડલ, જનરલ મેનેજર.

THE IMPERIAL BANK OF PERSIA.

ધી ઇમપીરીયલ બેંક ઓફ પરશીયા.

(લંડનમાં બાદશાહી સનદની રૂએ સ્થપાયલી)

થાપણ પુરેપુરી ભરાયલી	પાઉંડ	૬૫૦,૦૦૦
(પાઉંડ ૪૦,૦૦,૦૦૦ સુધી વધારવાની સતા સાથે)		
અનામત ફંડ	,,	૨૨૦,૦૦૦
સનદની રૂએ માલેકોની અનામત જવાબદારી	,,	૧,૦૦૦,૦૦૦

વડી ઓફીસ--૨૪, અબચરચ લેન, લંડન ઇ. સી.

ઇરાનમાં વડી ઓફીસ-તેહેરાન.

મુંબઇ એજંસી-૬૨, એસપલેનેડ રોડ.

ઇરાન અને મેસોપોટેમીયામાં શાખાઓ અને એજંસીઓ.

આહવાઝ	હંમેદાન	મોહામેરાહ
બગદાદ	ઇસફાહાન	નશારાતાબાદ (સીસતાન)
બસરાહ	કાઝવીન	રેસ્રત
બીરજંદ	કેરમાન	શીરાઝ
બંદરઆબાસ	કેરમાનશાહ	સુલતાનાબાદ
બુશાયર	મશહદ	તાબ્રીઝ
		યઝદ

બાંધી મુદતની ડીપોઝીટો એક વરસ માટે સવીકારવામાં આવે છે અને તે ઉપર દર વરસે સેંકડે ૫ ટકાનું વયાજ આપવામાં આવે છે.

ઓછી મુદતો માટે પણ **બાંધી મુદતની ડીપોઝીટો** સવીકારવામાં આવે છે અને પસંદ કરેલા ગ્રાહકો માટે ચાલુ હીસાબો ખોલવામાં આવે છે જેની શરતો અરજી કરવેથી જાણી શકાશે.

ડરાફટસ આપવામાં આવે છે અને બીજો ઉપર જણાવેલી સઘળી જગાએ ખરીદવામાં અથવા એકઠાં કરવામાં આવે છે.

સામાનય બેંકીંગ અને એક્ષચેંજ કામકાજ કરવામાં આવે છે.

ઇ. સી. ડોલટન,
એજંટ.

HOLLOWAY'S PILLS & OINTMENT

નીચલી દવાઓ સોના જેવી કીંમતી છે.

હૉલૉવેની ગોળી તથા મલમ.

આ સર્વે ઉપયોગી દવાઓ

હીંદુસ્થાનના દરેક રહીશોએ પોતાના ઘરમાં સાચવી રાખવી જોઇએ

હોલોવેની ગોળીઓ

લોહીને સ્વચ્છ કરે છે, શરીરની નબળાઈ દુર કરી કઉવત આપે છે અને **લીવર તથા મળ ઉપર** ધીમેથી પણ અસરકારક રીતે ગુણ કરે છે. એ ગોળી લીધાથી ખોરાક ખાવાની રૂચી થાયછે તેમજ લોહી શરીરમાં સારી રીતે ફરે છે અને આખા શરીરને તાકાત તથા જોર આપે છે. નબળાઇને લીધે માથાનો દુખાવો, શરીરનું ધ્રુજવું અને બીજી સાધારણ નબળાઇ **આ પ્રખ્યાત ગોળી** સેવાથી તદન જતી રહે છે. વળી સ્ત્રીઓના **તમામ દરદો** જેવા કે ચામડીના ડાઘો, ફોડકી, ગુમડાં વીગેરે સરવે ફરીયાદો—બીજી કોઇબી ઘરઘતુ દવાઓ કરતાં આ ગોળી ઘણી સરસ રીતે નાબુદ કરી નાખે છે અને એના જેવી બીજી અકસીર દવા કોઇ નથી.

હોલોવેનો મલમ

આખી દુનીયામાં સરવે ઠેકાણે પ્રખ્યાતી પામેલો છે. દરેક જાતનાં ગુમડાં, ચાંદાં અને જખમ બીજા કોઇ મલમ કરતાં આ મલમ ઘણી સારી રીતે રૂઝવી નાખે છે. અદ્ભુત રીતે શરીરની અંદર પેસી **ગળાંના અને છાતીના તમામ** દરદો **તેમજ** ઉધરસ, હાંફણ, દંમ વીગેરે નાબુદ **કરે છે,** ગળાંનો કાકડો સાફ કરે છે અને છાતીના અંદરના ગુમડાં તથા રગોનું ફુલવું એ સરવેને બેસાડી દઈ સાજા કરી નાખે છે. વળી સંધીવા તથા સાંધાનું ઝલાઇ જવાથી થતી અતિ પીડા નાબુદ કરી દે છે.

ગોળી અને મલમ

નં० ૧૧૩ સાઉથ વરક સ્ટ્રીટ, લંડન ખાતે બનાવવામાં આવે છે.

દરેક સુધરેલા શહેરમાં દવા વેચનારની દુકાનેથી ઉપલી દવાઓ મળશે

દવા વાપરવાની સુચના દરેક ભાષામાં છાપેલી દવાની સાથે મલશે.

ખરીદદારોએ શીશી અને ડબી ઉપરના લેબલ તપાસીને લેવા કે તે ઉપર **૧૧૩ સાઉથ વર્ક સ્ટ્રીટ (છેલ્લુ ૨૬૩-સ્ટ્રેન્ડ) લંડન** એ પ્રમાણે ઠેકાણું લખેલું નહી હોય તો તે બીજી જાતની છે એમ સમજવું.

સ્ત્રીઓને શકતી આપનારી દવા.

એલટ્રીસ કોર્ડીયલ રીઓ.

આ દવા સ્ત્રીઓને લાગુ પડતાં સર્વે દરદોને દફે કરવાની અદભુત શકતી ધરાવે છે. પેડું અને તેના તમામ અવયવો ઉપર તે લેવાથી પુશકલ શકતી આપે છે તેથી સ્ત્રીઓને એ દવા સઘળા રોગો ઉપર પછી તે રોગ **ડીસમેનોરેયા, મેનેરેયા, લુકોરીયા, અમોનોરીયા,** કે પછી સ્ત્રીઓને લગતું કોઈબી દરદ હોય તે માટે ઘણીજ ઉપયોગી માલમ પડી છે.

જોબનનાં વેશમાં આવતી છોકરીઓ તેમજ ગરભવંતી સ્ત્રીઓને તેઓનું ગયલું બળ અને કમીથતું તાકતપણું આ દવા લેવાથી જલદીથી પાછું આવે છે.

એલટ્રીસ કોર્ડીયલ રીઓ—તમામ મળમુત્રના બાંધાને મજબુત કરે છે તેથી ગરભ અધુરે જતો અટકે છે. જે સ્ત્રીઓ કમરના દુખાવાથી અથવા એવા બીજા દરદથી પીડાતી હોય અથવા સાંધાના સોજાની ફરીયાદ કરતી હોય તો તેઓને એ દવા જરૂર આપવી જોઇએ. આ દવા મુખ્ય કરી સ્ત્રીઓને લાગુ પડતાં દરદો સાજા કરવા માટે જાણીતી છે તેથી ઘણાખરા તબીબો તેની ભલામણ કરે છે.

જે કુવારીકાઓ ૧૧ વરસથી ૧૮ વરસની હોય કે જે વખતમાં તેઓ કુવારીકા અવસ્થા-માંથી સ્ત્રીની અવસ્થામા જાય છે તેઓને **એલટ્રીસ કોરડીયલ રીઓ** ખાસ ઉપયોગી છે કારણકે એ વાપરવાથી સ્ત્રીને પુશકળ તાકાત તથા શકતી આપે છે.

દવા લેવાની રીત—ખોરાક ખાવાની અને બીછાને જવાના વખત વચ્ચે એક ચમચો દીવસમાં ત્રણ વખત લેવી.

નર્વ તોનીક.

નર્વસનેસ, ઉંઘ નહી આવતી હોય તો તે માટે, આંકણી, અને આળસાઇ તથા નબળાઈ માટે સીલેરીના જે શકતી આપનારી દવા છે તે ખાવા પછી અને સુવા જવા પહેલાં દીવસમાં ત્રણ વખત એક ચમચામાં લેવી તેમજ દારૂના વ્યશનમાં પડેલાઓએ આરામ કરવા માટે આ દવા એક મજબુત ઉપાય છે.

નર્વસ સીસ્તમ માટે આ એક ઉત્તમ શકતી આપનારી દવા તરીકે સીલેરીના લગભગ ૪૦ વરસથી જાણીતી થયલીછે.


કેમીસ્ટો, ડ્રગીસ્ટો, અને હંડીઆમાં દવા વેચનારાઓ
એલટ્રીસ કોર્ડીયલ રીયો અને સીલેરીના મોટા જથામાં રાખે છે.

આ દવાઓ ઘણીજ ઉપયોગી માલમ પડવાથી તેની નકલો ઘણી થઇ છે અને આ કંપનીએજ બનાવેલી ખરી દવા છે એમ દવાની શીશી ઉપર **રીયો કેમીકલ કંપનીના** નામની લેબલ લગાડેલી છે તે જોઇ તેની પ્રથમ ખાત્રી કરી લેવી.

નમુનો અને એ સંબંધી જોઇતી વધુ વીગત માટે નીચે જણાવેલી કંપનીને લખો.

રીયો કેમીકલ કંપની,
૭૯, બેરો સ્ટ્રીટ, ન્યુ યોર્ક સીટી–યુ. એસ. એ.
Rio Chemical Co.,
79, Barrow St., New York city, U. S. A.

"MALTINE" WITH COD LIVER OIL.



The healing and special dietetic values of cod liver oil are too well known to need recapitulation. Suffice it to say that it has a peculiar and effectual action on nutrition and is particularly valuable in consumption and other wasting conditions of the body.

There are, however, many objections to plain cod liver oil. It is very indigestible, and its characteristic odour and flavour render it unpalatable to a large number of people.

In "**Maltine**" however, these difficulties are overcome by a scientific and high grade combination of the oil with "**Maltine**"

The objectionable taste is quite masked by the pleasant nutty flavour of "**Maltine,**" and the oil is so broken up in the process of amalgamation that it at once becomes easily digestible, and readily assimilable, so that it is completely absorbed by the system.

This preparation gives all the advantages of malt with the additional benefits of the oil, and is of untold, unility in all cases of malnutrition and incipient rickets.

"The Oil is intimately blended with the Malt, and fulfil all the conditions of perfect digestion. 'Maltine' is an excel'ens Medium for the Oil, besides aiding materially in i s digestiont It has the additional merit of converting it into an elegant and palatable preparation."—. *Medical Press and Circular*

LADY ANNE MURRAY, Loch Carron, Ross-shire. Writes : "I have found it so wonderfully effective amongst the poor up here, and have three or four bad cases who are simply kept alive on it.

Influence of Fat in Rickets. Rickets is a disease mainly produced by the deficiency of fat (with phosphates) in the diet.

Weakly, rickety children are cured by the use of foods suitable to the condition and "**Maltine**" with Cod Liver Oil is a thoroughly reliable preparation and its use will be attended with the happiest results.

"**Maltine**" and "**Maltines**" with **Cod Liver Oil** are prepared only by

THE MALTINE MANUFACTURING Co., Ltd.

183, ACTON VALE, LONDON, W.

કોડલીવર ઓઇલ સાથનું મોલટાઇન.

કોડલીવર ઓઈલ ખોરાક તરીકે લીધાથી તેના ફાયદા અને ગુણો એટલા બધા જાણીતા છે કે તેનું વરણ કરવાની કાંઈ જરૂર નથી અને માટે એટલુંજ કહેવું બસ થશે કે તે નબળા બાંધા ઉપર ચમતકારીક રીતે ગુણ કરી શરીરમાં લોહી તથા માસ વધારે છે તેમજ શરીરની લકડી જતી હાલત અને ખહીના રોગ ઉપર વીશેસ કરીને ઘણુંજ કીંમતી છે. સાદુ કોડલીવર ઓઈલ અમથુંજ લેવાથી જલદીથી પાચન થઇ શકતું નથી તેમજ તેનો વાસ અને સવાદ ઘણા લોકોને નહીં પસંદ પડે તેવો છે. મોલટાઇન સાથે કોડલીવર ઓઈલને રસાયણ શાસ્રીની રીત પરમાણે ઘણી સરસ રીતે ભેળી દેવાથી ઉપર કહેલી ખામીઓ દુર થઈ શકે છે. મોલટાઇનમાં કોડલીવર ઓઇલ ભેલવાથી તેનો અણગમતો સ્વાદ બદલાઈ જાય તે સ્વાદીસત બને છે તેમજ તે એટલું બધું મલી જાય છે કે તે લીધાથી તરતજ પાચન થઇ શકે છે. આ બનાવટ ી ખુદ મોલટાઈનના ફાયદા મલે છે તેમજ તેની સાથે વળી કોડલીવરના ફાયદા પણ માલમ પડે છે. જ્યારે બદહજમી અને શરૂઆતની બ્યાધીઓમાં ઘણુંજ ઉપયોગી છે

"કોડલીવર ને મોલટાઇન સાથે ઘણી સરસ રીતે ભેલી દીધેલું છે જેથી તે સંપુરણ રીતે પાચન થઈ શકે છે. વળી કોડલીવરને માટે મોલટાઇન એક સઉથી સરસ સાધન છે અને તે પાચન કરાવવામાં મદદ કરે છે તેમજ તેનામાં વીસેશ ગુણ એ છે કે તે કોડલીવરને સવાદીસ્ટ બનાવે છે." મેડીકલ પરેસ અને સરક્યુલર.

લેડી એની મરે કહે છે કે ..." તે ગરીબ વરગમાં, ઘણું વીચીત્ર રીતે અસરકારક મને માલમ પડ્યું છે અને ત્રણ ચાર ગંભીર દરદીઓને તો તેના ઉપરજ માત્ર જીવાડવામાં આવ્યા છે."

રીકેટમાં ચીકાસની અસર—રીકેટ એક જાતનો વ્યાધી છે કે જે મુખ્યત્વે કરીને ખોરાકની અંદર ચીકાસના કમીપણાથી ઉતપન થાય છે. નબળાં અને રીકીસ્ટ છોકરાંઓની તંદરોસતીને અનુસરતો ખોરાક આપવાથી તેઓ તદન સારાં થયાં છે, અને તે કોડલીવર ઓઇલ સાથનું મેલવેલું મોલટાઇન આપવાથી તેનું પરીણામ ઘણુંજ સારૂં આવે છે.

મોલટાઇન અને કોડલીવર ઓઇલ સાથનું મોલટાઇન ફકત લંડનની

ધી મોલટાઇન મેન્યુફેક્ચરીંગ કંપની લીમીટેડ બનાવે છે.

૧૮૩, એક્ટન વેલી,—**લંડન, ડબલ્યુ.**

Telegraphic Regd. Address:— "Umrigar, Bombay"

Office- Telephone No. 398
House Telephone No. 273

D. R. Umrigar Sons & Co.,

NO. 3, APOLLO STREET, FORT, BOMBAY.

ESTABLISHED in the Year 1885.

Sole Agents in whole of India for the Patent
Corona Carpinches Blue Picking Bands & Double Tanned Belting.

REGISTERED TRADE MARK "PRAKKE" FOR D. R. UMRIGAR SONS & CO.

Also Sole Agents For Naaml Venn the world-renowned Manufacturer of Patent Buffalo Pickers, Sole Agents to The Woollen Cloth Mfg. Co. Manufacturers of Sizing flannel, Roller & clearer cloths, and Textile Leather Beltings and many others.

Largest Importers & Contractors of Brown casing & Blue facing Papers & Straw boards for supply to Bombay & Mofussil Mills.

The Largest and Cheapest Depot of Cotton Mills & Gin Factory Stores-Supplies of requisite for Ginning Factories & Cotton Mills' Stores of description, viz: Bobbins Skewers, Egyptians & American Cotton banding, such as:—Rim, Scroll, Tubular, Mule spindle &c. also beltings of best maker, Roller skins, Ring travellers by (Eadie Brothers) China Clay, Farina, French chalk, Chloride of Zinc, Magnesia, Brown Casing Paper, Blue Facing Paper, Straw-Boards & Cut Brown Paper &c.

Indents for any of the Mill stores will be forwarded to England for execution on Most, advantageous terms and at moderate commission. Up country orders carefully & promptly executed. Samples and Prices on application.

Our carpinches picking bands are best of their kind in quality and durability & these last double the time than the Ordinary oak-tanned bands. A trial order solicited.

This is the only Firm where you can get cheap & good stores of all kinds for Cotton Mill & Gin Factory.

મેસરસ દી૦ આર૦ ઉમરીગર સન્સ અને કુંપની,

૩, એપોલો સ્ટ્રીટ, કોટ, મુંબઇ, તેલીફોન નંબર ૩૯૮.

સુતર મીલોના, જીનીંગ ફેક્ટરીઓના, પરેસોના તથા રેલવેનો સ્ટોર પુરો પાડવાને સસતામાં સસતી હમારી દુકાન છે.

હમારે ત્યાં સઘળો માલ ખુદ કારખાનાવાલાઓ તરફથી પરબારો આવવાથી ઘરાકોને ભાવમાં કીફાયત પડવા સાથ સારો માલ મલી શકશે.

બહારગામનાં વેપારીઓના તથા ઘરાકોના કામકાજને લગતા ઓરડરો તરતજ બજાવવામાં આવશે. મીલને લગતો જે સ્ટોરનો ઓરડર વીલાયતથી મંગાવવાને આપશે તે ઉપર પુરતું ધ્યાન આપી ઘણા ઓછા ભાવે તથા કમીશને મંગાવી આપશું.

હમારે ત્યાં હંમેશાં તઇયાર બધી જાતના વીલશન તથા દીકશન બ્રધરસના બાબીનસો, ઇજીપશીયન અને અમેરીકન બેનડીગો, રોલર સ્કીનો, ઘણાજ ઉંચા મેકરના ચામડાના પટાઓ, સાઇઝીંગને લગતો માલ જેવો કે કલોરાઇડ ઓફ મેગનેશીયા, મીયુરેટીક ઓફ જીંક, ફરીના, બ્રાઉન કેસીંગ પેપર, બલુ ફેનસી પેપર વગેરે હમેશાં તઇયાર મલે છે.

હમારા પેટંટ કારપીનચીસ, પીકીંગ બેનડસો, મુંબઇની મીલોમાં ઘણુંજ વખણાએલ છે કારણકે તે ઘણાજ તકાઉ અને મજબુત છે અને વજનમાં ઘણાજ હલકા છે અને દરેક લેનથ ઉપર હમારો રેજીસ્ટરડ ટ્રેડમારક "**પરેકી**" **ફોર દી૦ આર૦ ઉમરીગર સનસની કું.** કરી મારવામાં આવે છે.

મુંબઇ વરતમાન પરેસમાં વેચાતી ચોપડીઓ.

ઠેકાણું—શેઠ નાદીરશાહ વકીલના ઘરમાં, ચોકઠર રોડ, ફોર્ટ રોડ, —મુંબઈ.

શેહેનશાહી જરથોસતીઓને બંદગી કરવાની પાક કેતાબો.

ખોરદેહ અવસતા—☞ આ જાતના નવા મરોડદાર કાલા અક્ષરે અવસતાના જુદાં જુદાં પદો પાડીને બંદગી પઢવાની સગવડ થાય તેવી રીતે ગોઠવી આ કેતાબ છાપેલી છે, એમાં બધી ન્યાએશો, પતેતો, દુવાઓ અને યશતો, એમાં હોરમજદ, અરદીબેહસ્ત, ખોરદાદ, આવાં, નાહની સરોસ, રાતની મોટી સરોસ, હોમ, વનંત, બેહરામ યસત છે. આ કેતાબ કપડામાં બાંધી તે ઉપર અશો જરથોસ્તની સુંદર સબી સુનાં રૂપામાં એમબોસ કીધી છે—કીમત રૂ. ૧) પોસ્ટેજ દોઢ આનો.

ખોરદેહ અવસતા—☞ આ જાતના ઘણા મોટા ખુલા કાલા અક્ષરે અને અશલ ઉચ્ચારે છાપેલી બધી નયાયસો, પતેતો, દુવાઓ અને દસ યસતો તેમાઃ—હોરમજદ, મોટી હપતન, અરદીબેહસત, ખોરદાદ, આવાં, નાહની સરોસ, રાતની મોટી સરોસ, હોમ, વનંત, અને બેહરાંમ યસત છે. તે સાથે આ કેતાબ કપડાંમાં બાંધી તે ઉપર અશો જરથોસતની સુંદર સબી સુનાં રૂપામાં એમબોસ કીધી છે—કીમત રૂ. ૦॥,—પોસટેજ દોઢ આનો.

ખોરદેહ અવસતા—☞ આ જાતના નવા મરોડદાર કાલા અક્ષરે છાપેલી બધી નયાસો, પતેતો, દુવાઓ અને ઉપર જણાવવા મુજબ દશ યશતો છે અને સોભઈતી બાઇન્ડીંગ કરવામાં આવી છે. રૂ. ૮॥—પોસ્ટેજ દોઢ આનો.

ખોરદેહ અવસતા—☞ આ જાતના નવા મરોડદાર કાલા અક્ષરે અને અશલ ઉચારે છાપેલી બધી નયાસો, પતેતો, દુવાઓ અને પાંચ યશતો તેમાં:— હોરમજદ, અરદીબેસત, બેહેરાંમ અને બેઉ સરોસ છે.—પતલાં પુઠાંની કીમત રૂ૦ા-, જાડાં પુઠાંની રૂ૦ા=; પોસ્ટેજ એક આનો. આ અવસતાની ચોપડી ગજવામાં રહી શકે તેટલી નાહલાં કદની છે.

મુકતાદના દીવશોમાં ભણવાના ફરામરોદના હા તથા ગાથાના હાની ચોપડી—કીમત ત્રણ આના,—પોશટેજ અરધો આનો.

જુદી ફરવરદીન યશત—(ફરોખશી) કીમત ત્રણ આણા; પોશટેજ અરધો આનો.

જુદી આવાં યશત—જાડાં પુઠાની કીમત ત્રણ આના તથા પતલાં પુઠાની કીમત બે આના,—પોસ્ટેજ અરધો આનો.

ઝોરાસ્ટ્રીયન કેલેંડરમાં આવેલી જુદી જુદી બાબદોનું સાંકલયું.

	સફે.
મજદેજરદી અને ૧૨૮૮ ના સાલનો ઈનતેખાબ—પારસીઓએ કરેલી સખાવત	૧—૪૪
કોમણાનું ધરમખાતું	૪૫–૬૦
નવાં ધરમનાં મકાનો	૬૧–૬૪
જરથોસતીઓને મલેલા નવા ખેતાબો	૬૫
જરથોસતીઓને મલેલા ઓધા-નેમણુંકો વ૦ ...	૬૬–૬૮
જરથોસતીઓએ લીધેલી કેળવણી, પરીક્ષા તથા તેમાં મેલવેલાં ઈનામ–સ્કાલરસીપો વ૦ ...	૬૯—૭૦
પરચુટણ બનાવોની વીગત	૭૧–૭૩
ગએ વરસે થયલાં જાણીતાં જરથોસ્તીઓનાં મરણ.	૭૩–૭૬
જરથોસતીઓનાં બારે માસના કોઠા તેમાં આખાં વરશની તારીખ, વાર, તેહવારો તથા ચોકસ બનેલા બનાવોની નોંધ...	૭૭—૮૮
જરથોસતીઓએ સ્થાપેલાં આતશબેહેરામો ...	૮૯
જરથોસતીઓએ સ્થાપેલી દરેહમેહરો તથા આતશ દાદગાઓ...	૮૯-૧૦૦
જરથોસતીઓએ બંધાવેલાં દુખમાંઓ... ...	૧૦૧–૧૦૩
જરથોસતીઓએ બંધાવેલી ધરમશાળાઓ ...	૧૦૪–૧૦૬
જરથોસ્તીઓએ બંધાવેલાં જાહેર ઉપકારનાં મકાનો	૧૦૭-૧૧૦
જરથોસતીઓએ સ્થાપેલાં ધરમનાં દવાખાનાં...	૧૧૧–૧૧૪
જરથોસતીઓએ સ્થાપેલાં ધરમનાં કેલવણીખાતાં..	૧૧૪–૧૧૭
જરથોસ્તીઓએ સ્થાપેલાં પુસ્તકખાંના ...	૧૧૮
સર નાઈટ, બારોનેટનો માનવંત ખેતાબ મલેલા જરથોસ્તીઓ	૧૧૯–૧૨૧
સર નાઈટનો નામીઓ ખેતાબ મલેલા જરથોસ્તીઓ	૧૨૨–૧૨૪
સી. એસ. આઈ. યાને કમપેનીયન ઓફ ધી સ્ટાર ઓફ ઈંડયા...	૧૨૫
સી. આઈ. ઈ. યાને કમપેનીયન ઓફ ધી ઈંડીયન એમપાયર	૧૨૫
નામદાર બ્રીટીશ સરકાર તરફથી જરથોસ્તીઓને મળેલા ખેતાબો	૧૨૬–૧૨૭
જુદા જુદા રાજ્યો તરફથી જરથોસ્તીઓને મલેલા ખેતાબો	૧૨૮–૧૩૦
ખાન બાહાદુરનો ખેતાબ મલેલા જરથોશતીઓ	૧૩૧
જરથોસતી જસટીસ ઓફ ધી પીસ યાને સુલેહના અમલદારો	૧૩૨–૧૩૩
જરથોસતી શેરીફો	૧૩૪
મુંબઈની યુનીવરસીટીના જરથોસતી ફેલો ...	૧૩૪
જરથોસતી કાઊનસીલરો	૧૩૫
પારસી મેત્રીમોન્યલ કોરટોના ડેલીગેટો	૧૩૬
મુંબઈની મયુનીસીપાલ કોરપોરેશનના તથા સ્ટેનડીંગ કમીટીના અને ઈમપરૂવમેન્ટ ટ્રસ્ટના જરથોસતી મેમબરો	૧૩૭
જરથોસ્તી સોલીસીટરો	૧૩૭–૧૩૮
જરથોસ્તી બેરીસ્ટરો	૧૩૯–૧૪૦
મુંબઈની પારસી પંચાયતના ધરમ ખાતાંને લગતી જાણવાજોગ વીગતો	૧૪૧–૧૪૮
કલકતાની જરથોસતી અનજુમનનાં ધરમનાં ફંડોની વીગત	૧૪૯–૧૫૧
ચીનના જરથોસતી અંનજુમનના ધરમના ફંડોની વીગત	૧૫૨–૧૫૪
જરથોસ્થીઓએ સ્થાપેલાં ધરમના ફંડો ...	૧૫૫
પોસ્ટખાતાંને લગતી જાણવાજોગ વીગતો ...	૧૫૬–૧૫૮
હીંદુસ્તાનનાં એક શેહરથી બીજે શેહર મોકલવા માટેના વીજલીક તારને લગતી વીગતો ...	૧૫૯
યુરોપમાં ચાલતી લડાઈના સંબંધમાં પારસીઓએ આપેલી મદદને લગતી વીગતો	૧૬૦–૧૬૧
જાહેર ખબરો (આગલની)	૧–૪૯
જાહેર ખબરો (પાછલની)	૧–૪૬

ગયા વરસનો ઇનતેખાબ,

યાને

યઝદેજરદી સને ૧૨૮૮ ના સાલમાં બનેલા જરથોસ્તીઓને લગતા જાણવાજોગ બનાવો.

સખાવત.

આ વરસે સામાન્ય સખાવતનો આંકડો લગભગ સવા તેપન લાખનો, ઉઠમણાની છપાયલી રકમ દશ લાખ એકત્રીશ હજારની, ધરમનાં મકાનોની કીંમત સુમારે ગણતાં લગભગ ચાર લાખ રૂપીઆ મળી આ વરસની કુલે સખાવત સાડી સરસત લાખ રૂપીઆની થવા ગઇ છે.

ઉપર જણાવેલી રકમ આ વરસની છપાયલી સખાવતની છે પણ તેમાં એક સખાવત થવામાંથી તથા ઉઠમણામાં જણાવેલી રકમમાંથી બીજા ફંડોમાં અપાયલી, ધરમના મકાનોવાલી રકમ જે આગલાં વરશોમાં સખાવતોમાં ગણાઇ ચુકેલી, વીગેરેની રકમ સુમારે સાડા બાર લાખની બાદ થવા જેવી છે, તે બાદ કરીએ તો લગભગ રૂપીયા પંચાવન લાખ જેટલો આંકડો આ વરસની સખાવતનો થવા જાય છે, એમાં પીટીટ હાસપીટલને ભાડાના મલેલા ૩૫૮૧૩૩૦ આવી જાય છે.

અતરેના જાણીતા શ્રીમંત શેહેરી અને વેપારી શેઠ અરદેશર સોરાબજી ફરામજી પટેલ બી. એ. ૫૨ વરસની વયે રોજ ૨૪ મો દીન યઝદ માહ ૧૦ મો દેહ દાદાર સને ૧૨૮૮ યઝદેજરદી, તા૦ ૧ લી જુલાઈ ૧૯૧૯ ને દીને પેરીસ મધે બેહેસતનશીન થયા હતા. મરહુમ શેઠ અરદેશરની લાંબો વખત થયા તબીયત નરમ ચાલ્યા કરવાથી તબીયતના સુધારા માટે મરણની એક માસ અગાઉ યુરોપની મુશાફરીએ ગયા હતા. એવણ ઉપર પેરીસ ખાતે લકવાના કાટીલ દરદે હલ્લો કરવાથી ત્યાં એવણનું મરણ નીપજ્યું હતું. શેઠ અરદેશરનો જનમ કદમી રોજ ૧૪ મો ગોસ યઝદ, માહ ૪ થો તીર સને ૧૨૩૭ યઝદેજરદી, તા૦ ૪ થી જાનેવારી ૧૮૬૮ ને દીવસે મુંબઇમાં થયો હતો. એવણે ૧૮૯૧ માં બી. એ. ની પરીક્ષા પસાર કરવા પછી એવણ પોતાના મરહુમ બાવા શેઠ સોરાબજીની પેહેડીમાં એક ભાગયા તરીકે જોડાયા હતા. શેઠ અરદેશરના બાવા શેઠ સોરાબજી ઘણા કુનેહબાજ મોટા વેપારી હતા અને એવણનું વેપારી ફરમ "ફરામજી સનસની કંપની"ને નામે લગભગ ૯૦ વરસ થયા આપણા શહેરમાં જાણીતું છે. શેઠ અરદેશરે પોતાના બાવાની વેપારી પેહેડીપરથી ૧૯૦૯ માં છુટા પડીને પોતાના મરહુમ ભાઇ શેઠ ખરશેદજી સોરાબજી પટેલ સાથે "ક. એંડ એ. એસ. ફરામજી" ને નામે લંડન તથા પેરીસ ખાતે મોતીનો તેમજ ચીન સાથે મોતી, ચાહ, રેશમ અને અતરેના ગામઠી સુતરનો બોહલા પાયા ઉપર વેપાર ચલાવવા માંડયો હતો. ૧૯૧૨ માં શેઠ ખરશેદજીના મરણ પછી શેઠ અરદેશર પોતે એખલા ધંધો કરતા હતા. મરહુમના વડા ભાઇ શેઠ બાપુજી સોરાબજી પટેલ જેવણ પોતાના પીતાની જાણીતી પેહેડી "ફરામજી સનસની કંપની"ના માલેક છે એવણે હજી સુધી પોતાનું બીઝનેસ કરવાનું ચાલુ રાખ્યું છે. મરહુમ શેઠ અરદેશર પોતા પાછલ લખો રૂપ્યાની મોટી દોલત મેલી ગયા છે અને પોતાના વીલમાં અગીયારથી બાર લાખ રૂપયાની બાદશાહી રકમ સખાવતના કામમાં વાપરવા ત્રસ્ટીઓને ફરમાવી ગયા છે કે લાયક પારસી જવાનોને હરેક ધંધાની ઉંચી કેલવણી માટે યુરોપ તથા અમેરીકા ખાતે

મોકલાવવા. એ ઉપરાંત સ્કુલ યા કોલેજની ફી આપવા તથા હાસપીટલો, સુવાવડખાનાને તેમજ ગરીબ જરથોસતીઓને પગાર વગેરેની મદદ કરવા બોહોલી સતા આપવામાં આવી છે. શેઠ અરદેશરના વીલના એકઝીકયુટરો અને ત્રસ્ટીઓ તરીકે નીચલા ચાર ગ્રહસથોને નેમવામાં આવયા છેઃ—શેઠ બેરામજી નવરોજી ગામડીયા, શેઠ ખરશેદજી ધનજીભાઇ શરાફ સોલીસીટર, શેઠ દીનશાહ ખરશેદજી દાજી સોલીસીટર અને શેઠ ધનજીશાહ બાપુજી દેશાઇ (રંગુનવાલા). મરહુમ શેઠ અરદેશરના ભાઇ બેહેસતનશીન શેઠ ખરશેદજી સોરાબજી પટેલ બી. એ. ની આશરે ત્રણ લાખ રૂપ્યાની નાદર રકમ સખાવતમાં ૧૯૧૩ ના સાલથી આપવામાં આવી છે અને તેના વીયાજમાંથી પણ ઉપર મુજબ ઉપયોગ કરવામાં આવે છે. આ મુજબ બેઉ ભાઇઓ તરફથી પંદર લાખ રૂપ્યાની બાદશાહી રકમ સખાવતમાં આપવામાં આવેલી છે.

કરાંચીના જાણીતા સખાવતી શેહેરી ઓનરેબલ શેઠ જાહાંગીર હો. કોઠારી, ઓ. બી. ઇ.એ હંમેશ મુજબ આ વરસે પોતાના સખી દીલશુરડા મુજબ સખાવતમાં પોણાપાંચ લાખ રૂપ્યાની નાદર રકમ આપી હતી. શેઠ જાહાંગીરજીએ કરાંચી ખાતે કલીફ્તનના દરીયા કીનારા ઉપર ફરવા હરવા સુંદર જગા બનાવા માટે લગભગ પોણાબે લાખ રૂપયાની કીમતની ઇસટેટ અને રેહેવાનો મોટો બંગલો ગયે વરસે મ્યુનીસીપાલીટીને ભેટ આપયો હતો તેથી એ જગાને "જાહાંગીર કોઠારી પેરેડ કલીફ્ટન" એવું નામ આપવામાં આવ્યું છે. એનો પાયો નાખવાની ક્રીયા તા૦ ૧૦ મી ફેબરવારી ૧૯૧૯ ને દીને મુંબઇના નામદાર ગવરનર અને લેડી લોઇડે કરી હતી. એ વખતે નામદાર ગવરનરે શેઠ કોઠારીને આવી કીમતી સખાવત માટે મુબારકબાદી આપી ઉપકાર માન્યો હતો. એ પછી એવણે ૧૯૧૯ ના આગસ્ટ માસમાં પેરેડથી વોટર સાઇડ સુધી એક સુંદર પથરનો ડકકો અથવા પુલ બાંધી દરીએ કીનારે એક પેવીલીઅન ઉભો કરવા માટે લગભગ ત્રણ લાખ રૂપયાની નાદર રકમ એવી સરતે આપી છે કે એ ડકાને નામદાર લેડી લોઇડનું નામ આપવું અને એનો પાયો નાખવાની ક્રીયા એ નામદારને હાથે કરવામાં આવશે. કરાંચીના જાહાંગીર બાગમાં જરથોસતીઓ સારૂ લગન તથા નવજોત વગેરેની ક્રીયા કરવા માટે એક કુસાદે હોલ તથા શોભાયમાન ગેલેરી જેમાં લગભગ ૫૦૦ બેઠકનો સમાવેશ થઇ શકે તે માટે ૨૩૭૦૦૦ આપયા છે તેથી એ હોલ બાંધવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ઓમબે પ્રેસીડંનસી વોર અને રીલીફ ફંડની સીંધની શાખાના તથા લશકરને આવકાર આપવાના ફંડના અને કીંગ એડવરડ મેમોરીયલ ફંડનાં ઓનરરી સેકરેટરી અને ત્રઝર તરીકે એ ત્રણ ફંડોને લગતો લગભગ અરધો લાખ રૂપયા જેટલી મોટી રકમનો ખરચ કરયો હતો. એ બધો ખરચ એવણે પોતાની ગીરોથી આપયો છે, તેમજ ફરાનસ તથા મેસોપોટેમીયા વગેરે ઠેકાણેથી લડાઇ પરથી ગયા જાનેવારીમાં કરાંચી ખાતે પાછા ફરેલા બ્રીટીશ તથા હીંદી અમલદારો અને સીપાહોને આવકાર આપવાના ફંડમાં રૂ૨૫૦૦૦ ભરીયા હતા. કરાંચી ખાતે સઘળી કોમની છોકરીઓની સ્કુલનું મકાન બાંધવા માટે રૂ૨૫૦૦૦ ની રકમ આપી છે. એવો સાહેબ સંકટ સમયે હંમેશા સારી મદદ આપતા રહયા છે તેમ ૧૯૧૮ ના નવેમબરથી આવેલા ભયકર ઇનફ્લ્યુએનઝા વગેરેના ઉપદ્રવ દરમયાન જરથોસતીઓને સારી મદદ આપી ગરીબ કુટુંબોમાં અનાજ, ગરમ તથા સુતરાઉ કપડાં વગેરે પોતાની ગીરોથી હજારો રૂપયાની કીંમતના વહેંચી આપવા ઉપરાંત પારસી રીલીફ કમીટી હસ્તક જરથોસતીઓ માટે ઉઘાડવામાં આવેલી હાસપીટલનો સઘલો ખરચ મહીનાઓ સુધી એવો શેઠ તરફથી કરવામાં આવયો હતો. એવણે બીજા ધરમ ખાતાઓ તથા ફંડોમાં સારી રકમો ભરી હતી.

અતરેના જાણીતા સખી શેઠયા અને મોટા શેર દલાલ સર શાપુરજી બરજોરજી ભરૂચાએ આ વરસે પોતાના સખી દીલશુરડા મુજબ જુદા જુદા ફંડો તેમજ ધરમખાતાઓને અને ગરીબોને નાણાની સારી મદદ કરવા ઉપરાંત નીચલા ધરમખાતાઓમાં લગભગ સવાત્રણ લાખની નાદર રકમ બક્ષેસ આપી છે. વળી એવો શેઠ પારસી કોલેની સથાપવાનાજ શુભ ઇરાદાથી લખે

રૂપયાની બાદશાહી રકમ સખાવતમાં આપવાનો ઇરાદો રાખે છે જે એ સખી શેઠયા માટે ઘણુ માન ભરેલું છે. હીંદુસ્તાનમાં પડેલા સખત દુકાળને લીધે સર શાપુરજીએ કાઠયાવાડના દુકાળ સંકટ નીવારણ ફંડમાં ઘાસ માટે રૂ૫૦૦૦૦, અનાજ માટે રૂ૨૫૦૦૦, કપડાની ખરીદી માટે રૂ૨૫૦૦૦ અને મુંબઈના દુકાળ સંકટ નીવારણ ફંડમાં રૂ૨૫૦૦૦ મલી સવા લાખ રૂપયાની રકમ તેમજ બીજા જુદાં જુદાં દુકાળને લગતાં ફંડોમાં નાણાની નાખલી મોહટી રકમો ભરી હતી. એવો શેઠે પુણાની સરદાર દસ્તુર નોશીરવાન ગરલસ સ્કુલનું એક વધુ નવું મકાન બાંધવા માટે રૂ૪૦૦૦૦, બાઇ આવાંબાઇ ફરામજી પીટીટ પારસી ગરલસ આરફનેજને લગતી જમીન ઉપર એક કોટેજ બાંધવા રૂ૩૫૦૦૦, જરથોસ્તી બાળકોને નીશાળમા ધરમની નીતીની તથા ઈતીહાસની કેળવણી માટે જશન કમીટી હસતક ઉઘાડેલા ફંડમાં રૂ૨૫૦૦૦, નવી પુણા કાલેજની લાયબરેરીના મકાન માટે રૂ૨૦૦૦૦, ભરૂચના સુનાબાઇ દલાલ સુવાવડખાનામાં આઇસોલેશન વોરડ બાંધવા માટે રૂ૧૫૦૦૦, મુંબઇની પારસી પંચાયત હસતકના ફંડોમાં ખાતું પાડવા માટે રૂ૧૪૦૦૦, વાંદરેના બાઇ શીરીનબાઇ કામાના કોનવેલેસ્ટના બીલડીંગ ફંડમાં રૂ૧૦૦૦૦ના ૫ાા ટકાનાં વોર બોંડ, જરથોસ્તી છોકરીઓની નીશાળ મંડળીના એનડાઉમેંટ ફંડમાં રૂ૭૪૦૦ ની ૩ાા ટકાની લોન, સુરતના બાઇ ગુલબાઇ મહેતા મેટરનીટી હાસપીટાલમાં રૂ૫૦૦૦, સુરતના શેઠ મોરારભાઇ વીજભુખણદાસ સ્ત્રી છોકરાંની આસપીટાલમાં એક બીછાના માટે રૂ૩૫૦૦ અને સુરતના લેડી વીલીંગડન અશકતાશ્રમમાં રૂ૩૦૦૦ આપ્યા હતા.

લેડી પીરોજબાઇ શાપુરજી ભરૂચાએ મુંબઇના પારસી પંચાયત હસ્તકના સ્થાનોને અવલમંજલ પોહચાડવાના તથા સગડીમાં ભણતર ચાલુ રાખવાના ફંડમાં રૂ૪૦૦૦ તથા બીજા સખાવતી ખાતાઓમાં સારી રકમ ભરી હતી.

કરાંચીના જાણીતા શેહેરી ને વેપારી શેઠ અરદેશર હોરમજી મામાએ કરાંચી ખાતે ગયે વરસથી ચાલુ થયલી મામા પારસી ગર્લસ સ્કુલ માટે રૂ૩૦૦૦૦૦ તેમજ કરાંચીની શેઠ હીરજીભાઈ બહેરાનાની દરેમહેરમાં હોલ વિગેરે બાંધવા માટે રૂ૨૫૦૦૦ ની નાદર રકમ આપી હતી. એ ઉપરાંત એવો શેઠે કરાંચીમાં જરથોસ્તીઓ સારૂ વગર નફે અનાજ વગેરે વેચવા માટે દુકાન ખોલવા રૂ૧૦૦૦૦, કરાંચીની લેડી ડફરીન હોસ્પીટાલના ફંડમાં રૂ૧૦૦૦૦, મુંબઇની અપંગો માટેની વિકટોરીઆ મેમોરીઅલ સ્કુલમાં તાલીમ લેતા અપંગ હીંદી સોલજરોના લાભ અરથે રૂ૧૦૦૦૦, સેન્ટ ડન્સ્ટનનાં ઇગ્લાંડ મધેના અંપગ સેલર અને સોલજરોનાં હોમમાં રૂ૫૦૦૦, કરાંચીની આરમી વેલકમ ફંડમાં રૂ૫૦૦૦, મુંબઇની શેઠ સોરાબજી બંગાલીની સ્કુલના નીભાવ ફંડમાં રૂ૫૦૦૦, મુંબઇની જરથોસ્તી જશન કમીટીના ધરમ તથા નીતીની કેળવણીના ફંડમાં રૂ૧૦૦૧, કરાંચીના પારસી વીરબાઇજી સ્કુલના ફંડમાં રૂ૫૦૦૦ આપયા હતા. એવણે કેટલીક નાની મહોટી રકમો કરાંચી તથા મુંબઇ ખાતે સ્પોટરસ તથા કેલવણીના ઉતેજન અરથે તેમજ બીજા પરચુટણ ધરમ ખાતાઓ તથા ફંડોમાં ભરી છે.

બાઈ રતનબાઈ એદલજી બામજીએ પોતાનો નવસારી લુનસીકુઇ તરફનો બંગલો અને તે સાથે રૂ૧૦૦૦૦૦ ની નાદર રકમ મુંબઇના પારસી પંચાયતના ટ્રસ્ટીઓના સ્વાધીનમાં આપયાં છે કે એ બંગલાનો સેનેટેરીઅમ તરીકે ઉપયોગ કરવો અને રૂપીઆ એક લાખની રકમમાંથી રૂ૫૦૦૦૦ નાહાના બલોકો બાંધવા માટે વાપરવા અને બાકીના રૂ૫૦૦૦૦ સેનીટેરીયમનાં નીભાવ માટે અનામત રાખવા. એવણે ધરમપોરના ખહીના દરદીઓ માટેના કીંગ એડવરડ સેનેટરીયમમાં દરદીઓ સાથે જતા ખેશીઓના ઉતારા માટે રૂ૫૦૦૦ ના ખરચે એક ગેસ્ટ હાઉસ બંધાવી તેમાં જોઇતાં ફરનીચર વીગેરે સઘળી જરૂરયાતો પુરી પાડી તેનું નામ "અદલ ગેસ્ટ હાઉસ" રાખયું છે. ધરમપોરના રેલવે સ્ટેશનની સામેજ એ સેનેટેરીયમ આવેલું છે અને તયાંથી ૭ માઇલને છેટે કસાવલી ખાતે હડખાં કુતરાંએ કરડેલા આસામીઓ સાથે જનારાઓને માટેબી આ મકાન ઉપયોગી થઇ પડશે.

મુંબઇના જાણીતા શેહેરી સર દોરાબ જમશેદજી તાતાએ વારસીક રૂ૧૦૦૦૦૦ની નાદર રકમ આપવા કબુલવાથી મુંબઇના ઉતર ભાગમાં એક જંતુ વીદયાં માટેની લેબોરેટરી અને કીંગ એડવરડ મેમોરીયલ હોસપીટાલ તેમજ તેના સંબંધમાં ગરમ મુલકના વઇદાંનું શીક્ષણ આપનારી એક સ્કુલ ઉભી કરી તેને નીભાવવાનું મુંબઇની મ્યુનીસીપલ કોરપોરેશને પોતાને માથે લીધું છે અને તે માટે જમીન તથા નાણાં કીંગ એડવરડ મેમોરીયલ કમીટીએ આપ્યા છે. આ માટે રૂપયા એક લાખની વારસીક રકમ એક પોસટ ગ્રેડયુએટ સ્કુલ ઓફ ટ્રોપીકલ મેડીસીનને નીભાવવાને માટે આપવાની માંગણી સર દોરાબ તાતાએ કરી હતી તે સરકારે સ્વીકારી છે. સર દોરાબ તાતાની યોજનાનો મુખ્ય ભાગ એ છે કે હોસ્પીટાલમાંના દરદીઓને તપાસને લગતાં તેમજ દરદ સારૂ કરવાને લગતા શીક્ષણ આપવા માટે એક પ્રોફેસરની નેમણુક કરવી અને ૫૦ બીછાણા તે પ્રોફેસરના આંકોશ હેઠળ મુકવાં તેથી તે બીછાણાઓવાળા દરદીઓની ઘટતી સારવાર માટે તે પ્રોફેસર જોખમદાર રહેશે.

અતરેના જાણીતા શેહેરી મરહુમ સર રતન જમશેદજી તાતાના વીધવા લેડી નવાઝબાઇ તાતાએ પારસીઓ માટે હવા ખાવાનાં સ્થળે એક કોનવેલેસંટ હોમની યોજના માટે પોતાનો એક કીંમતી બંગલો અને તેના નીભાવ માટે એક લાખ રૂપીઆની રકમ આપવા જણાવ્યું છે.

સખીવજુદ બાઇ હમાબાઇ જે. કે. મહેતાએ આ વરસે કરેલી રૂ૪૪૩૯૮ ની સખાવતની વીગતઃ—ગરીબ જરથોસતીઓનું પોષણ કરવા, મરણ ખરચ કરવા, વીમાના ફાળો ભરવા તથા દવાદારૂ વીગેરે કામ સારૂ આપયા રૂ૨૬૧૫૦, ગ્રાંટરોડનાં ધરમાદા દવાખાના માટે થએલા ખરચના રૂ૪૮૭૨, ગરીબ જરથોસતીઓને સકુલ ફી તથા ચોપડીઓ વીગેરેના આપેલા રૂ૧૦૦૨૦, સસતા અનાજની દુકાન ફંડમાં રૂ૨૦૦, જે. જે. હોસપીટાલ નર્સીંગ ફંડમાં રૂ૩૦૦, સુરત શેહેરના ગામડામાં તાવથી પીડાતા ગરીબોના ફંડમાં રૂ૩૦૦, માથેરાન ફેમીન ફંડમાં રૂ૧૦૦, પુણાના જોઇન્ટ મીશન ક્રેશ પંચ હાઉસમાં રૂ૧૦૦, જરથોસતી સ્ત્રી મંડળ ફંડમાં રૂ૧૦૧, સેન્ટ એન્થની ઇન્સટીટયુશન કેનેરાને રૂ૩૦, સેન્ટ જોશફ ફાઉન્ડલીંગ હોમને રૂ૨૫, અને નારગોલની સ્કુલ તથા હાસપીટાલમાં રૂ૨૦૦.

બાઇ હમાબાઇ જે. કે. મહેતા (મીસ હમાબાઇ ફરામજી પીટીટ) અને સર દીનશાહ માણેકજી પીટીટ બીજા બારોનેટ તે બાઇજી આવાંબાઈ ફરામજી પીટીટના ત્રસટીઓએ આ વરસે સખાવતમાં ગરીબ જરથોસતીઓને સદરો પેહરાવવા તથા બીજી ધરમની ક્રીયાઓ કરાવવાના કામ માટે રૂ૮૩૫ આપયા હતા.

અંતરેના જાણીતા શેહેરી અને સખી શેઠયા શેઠ જહાંગીર બમનજી પીટીટે આ વરસે કરેલી રૂ૩૨૦૦૦ ની સખાવતની વીગતઃ—મરહુમ શેઠ બમનજી દીનશાહ પીટીટની યાદમાં બમનજી દીનશાહ પીટીટ પારસી જનરલ હાસપીટલનાં નીભાવ ફંડમાં રૂ૧૦૦૦૦, મરહુમ બાઇ હમાબાઈ ફરામજી કામાની યાદમાં બમનજી દી. પીટીટ પારસી જનરલ હાસપીટલનાં નીભાવ ફંડમાં રૂ૧૦૦૦, બોમ્બે પ્રેસીડનસી ફેમીન રીલીફ ફંડમાં રૂ૧૦૦૦, પંજાબ રીલીફ ફંડમાં રૂ૧૦૦૦, દેશમાં રાજદવારી તેમજ જાહેર સવાલોના સંબંધમાં પ્રજામત ખીલવવા માટેના ફંડમાં રૂ૭૫૦, ઇનફલુએનઝાની બીમારી વખતે મુંબઇનાં ગરીબ જરથોસતીઓને મુફત દવા વીગેરે આપવાનાં ફંડમાં રૂ૫૦૦, ઇનફલુએનઝાની બીમારી વખતે ગરીબ મુફલેસોને મુફત દવા વીગેરે આપવાનાં ફંડમાં રૂ૫૦૦, ગરીબ જરથોસતીઓને સસતો અનાજ આપવા પારસી પંચાયતે ખોલેલા ફંડમાં રૂ૫૦૦, પરચુટન નાનાં મોટાં લડાઇના સંબંધમાં ખોલેલાં ફંડોમાં રૂ૫૦૦, મોડરેટ કોનફરન્સનાં ફંડમાં રૂ૫૦૦, મરહુમ શેઠ બમનજી દીનશાહ પીટીટની યાદમાં સુરતની પારસી છોકરાઓની આરફનેજનાં ફંડમાં રૂ૫૦૦, મરહુમ શેઠ દાદાભાઈ નવરોજીની યાદગારીનાં ફંડમાં રૂ૫૦૦, સર

વીલીઅમ વેડરબરનની યાદગીરી રાખવાનાં ફંડમાં રૂ૫૦૦, લોરડ વીલીંગદનની યાદગીરી રાખવાનાં ફંડમાં રૂ૫૦૦,લેડી વીલીંગદન મેમોરીયલ ફંડમાં રૂ૨૫૦, યંગ મેન્સ હીંદુ એસોસીએશનનાં ફંડમાં રૂ૨૦૦, નવસારીમાં એક જાહેર રસતો બાંધવાનાં ફંડમાં રૂ૨૦૦, દુકાળ તથા મોંઘવારીના સબબે મુંબઇ તેમજ દેશાવરનાં જરથોસ્તીઓને મદદ કરવાનાં પરચુટન ફંડોમાં રૂ૨૦૦, દુકાળ તથા મોંઘવારીનાં સબબે મુંબઇ તેમજ દેશાવરના સઘલા વરગનાં ગરીબોને મદદ કરવાનાં ફંડોમાં રૂ૨૦૦, ગીરગામ (ડી. વોરડ)નાં ગરીબ તથા મધયમ વરગનાં જરથોસતીઓને સસતો અનાજ આપવાનાં ફંડમાં રૂ૧૫૦, લેડી વીલીંગદન વીમેન્સ હોસ્ટોલનાં ફંડમાં રૂ૧૫૦, જરથોસ્તીઓમાં મુદ્દલ ભાવે અનાજ વેંહેંચવા માટે એક ખાસ નાનો ઓરડો બાંધવાનાં ફંડમાં રૂ૧૦૦, માથેરાન તથા આસપાસનાં ગામડાઓનાં ગરીબોને સસતો અનાજ આપવાનાં ફંડમાં રૂ૧૦૦, કોલાબા દીસત્રીકટમાં ઇનફ્લુએનઝાની બીમારી વખતે મદદ આપવાનાં ફંડમાં રૂ૧૦૦, રોયલ સીલવર વેડીંગ ફંડમાં રૂ૧૦૦, જરથોસ્તી દીનની ખોલ કરનારી મંડલીનાં ફંડમાં રૂ૧૦૦, ઇન્ડીઅન ઇન્ડસ્ત્રીયલ એકઝીબીશનનાં ખરચનાં ફંડમાં રૂ૧૦૦, સેન્ટ ઝેવીઅરસ કોલેજ તથા સ્કુલની ગોલ્ડન જુબીલી ઉજવવાનાં ફંડમાં રૂ૧૦૦, મ્યુનીસીપલ કારપોરેશન હોલમાં સર ફીરોઝશાહ મહેતાની ઓઇલ પેનટીંગની સબી મુકવાનાં ફંડમાં રૂ૫૦, સર ઇબરાહીમ રહીમતુલા પોરટરેટ ફંડમાં રૂ૫૦, એન્ટી-ટયુબરકયુલોસીસ લીગનાં સંબંધમાં ખોલવામાં આવેલા ડા॰ ટરનર ટેસટીમોનીઅલ ફંડમાં રૂ૫૦, પ્રોફેસર સ્કોટની યાદગીરીનાં ફંડમાં રૂ૫૦, પ્રોફેસર બેનની યાદગીરીનાં ફંડમાં રૂ૫૦, મહાબલેશ્વરનાં જરથોસ્તીઓની આરામગાહનાં ફંડમાં રૂ૫૦, હીન્દુ વીદોઝ હોમનાં ફંડમાં રૂ૫૦, સુરતના જરથોસ્તીઓને ઇનફ્લુએનઝાની બીમારી વખતે મદદ કરવાનાં ફંડમાં રૂ૫૦, સુરતના જરથોસ્તીઓને મોંઘવારીના વખતમાં સસતો અનાજ આપવાનાં ફંડમાં રૂ૫૦, સતારા તથા આસપાસના ગામડાંઓના દુકાલીઆંઓને તથા ઢોરોને મદદ કરવાના ફંડમા રૂ૫૦, સેનત્રલ પ્રોવીનસીસમાં પેનદ્રા ખાતેના દુકાલીઆઓને મદદ કરવાના ફંડમાં રૂ૫૦, માહબલેશ્વર તથા આસપાસના ગામડાંઓના ગરીબોને મુફત અનાજ તથા કાપડ આપવાના ફંડમાં રૂ૫૦, મુંબઇના આરટ એકઝીબીશનમાં ઇનામ આપવાના ફંડમાં રૂ૫૦, સેન્ટ ઝેવીઅરસ કોલેજ "ટેનીસ દબલશ"નાં ફંડમાં રૂ૫૦, પરચુટન ફંડોમાં રૂ૫૦૦૦, ગરીબાઇ, નવજોત, લગણ વીગેરે માટે મદદ તરીકે આપેલા રૂ૪૦૦૦, અને કેલવણી, હુન્નર, ઉદ્યોગ વીગેરે માટે મદદ તરીકે આપેલા રૂ૨૦૦૦.

અતરેના જાણીતા સખી શેહેરી શેઠ રૂસતમજી બેરામજી જીજીભાઇએ આપણા શેહેરમાં ગરીબ નાવારેસ બાળકોના રક્ષણ માટે એક આશ્રમ ગ્રહ સ્થાપવા માટે રૂ૫૦૦૦૦ ની નાદર રકમ બાળકોના રક્ષણ માટે સ્થાપવામાં આવેલી સોસાયટીને આપી છે. આ રકમમાંથી બાળકો માટે એક 'હોમ' દાદર તરફ બાંધીને 'ધી બેરામજી જીજીભાઇ હોમ ફોર ચીલડરન' નામ આપવામાં આવશે. શેઠ રૂસતમજીની સખાવત વખાણને લાયક છે કારણ કે આથી મુંબઇના ભીખારીઓની પીડા દુર થઇ આ આશ્રામગ્રહની મોટી ખીલવણી થવાની વકી રહેશે તેમજ રખડતાં અને ભીખારી બાળકોને આ હોમમાં રક્ષણ તથા કેળવણી મળશે.

કવેતાના જાણીતા શેહેરી અને વેપારી ખા॰ બા॰ બરજોરજી દોરાબજી પટેલ સી. આઇ. ઇ.એ આ વરસે કરેલી રૂ૫૭૬૨૦ ની સખાવતની વીગતઃ–સુરત જીલ્લાના રાંદેરથી કુડયાણાં સુધીની પાકી સડક બાંધવા રૂ૨૦૦૦૦, કવેતા પારસી અનજુમન ફંડોમાં રૂ૨૨૦૦૦, મુંબઇ પ્રેસીડનસી ફેમીન રીલીફ ફંડમાં રૂ૭૫૦૦, ભરૂચના ફેમીન રીલીફ ફંડમાં રૂ૫૦૦, સુરત જીલ્લાના ઓલપાડના કેટલાક ગામોમાં હવાડા ભરવા તેમજ ગરીબોને અનાજ, કપડાં વીગેરે આપવા માટે રૂ૨૦૦૦, સુરત જીલ્લાની માંડવીની સ્કુલને ઇનામ આપવા રૂ૧૦૦૦, કવેતાની મીસીન ઝનાના હોસપીટલને રૂ૧૯૦૦, કવેતાની એસોસીએશનને રૂ૧૦૦૦, સકરના ફંડમાં રૂ૬૦૦, કવેતા રેડ કરોસ ફંડમાં રૂ૬૨૦ અને મુંબઇના સેંટ જોસફ હોમના નરસીંગ ફંડમાં રૂ૫૦૦. એ ઉપરાંત શેઠ બરજોરજીએ બીજા ઘણાક ફંડોમાં નાણાની સારી મદદ કીધી હતી.

અતરેના જાણીતા શેહેરી શેઠ કાવસજી જાલભાઇ શેઠે ડાકટર માસીનાની હાસ્પીટાલમાં સુવાવડખાનાનો એક અપ–ટુ–ડેટ બલોક બાંધવા રૂ૨૫૦૦૦ આપ્યા હતા. એવણે દેવલાલીમાં બહાદુરજી સેનેટરીઅમમાં બલોક બાંધવા અને જાલભાઇ શેઠ મેમોરીઅલ બીલડીંગ માટે તથા બીજા એવા ધરમ ખાતામાં મોટી રકમો આપેલી છે. એઓની સખાવત મોટે ભાગે છુપી છે અને ઘણાંક લાએક ખાતાંઓને ચાલુ મદદ કરે છે તથા ઘણાંક ગરીબ લોકો પણ સારો આશરો મેળવે છે.

મુંબઇ તથા એડનના શાહ વેપારી અને સખી શેઠયા શેઠ હોરમજી કાવશજી દીનશાહ એડનવાલા એમ. વી. ઓ. એ આ વરસે સખાવતમાં હંમેશ મુજબ પોતાના સખી દીલગુરડા મુજબ અનેક ધરમ ખાતાંઓ તથા ફંડોમાં નાણાની મોટી મદદ કરવા ઉપરાંત જરથોસતી છોકરીઓની નીશાળ મંડલીના એનડાઉમેંટ ફંડમાં વ્યાજ વાપરવા રૂ૭૦૦૦ના પોરટ કેનીગના શેરો, પારસી એસોસીએશના ખેતીવાડી ફંડમાં રૂ૫૦૦૦અને પારસી સ્કુલ કેડેટકોરના ફંડમાં રૂ૧૦૦૦ આપ્યા હતા.

અતરેના જાણીતા શેહેરી શેઠ પેસતનજી ડોશાભાઇ મારકરે ઇરાન દેશના નાવારસ ગરીબ ઈરાની જરથોસતી છોકરાઓ સારૂ ઇરાન મધે આવેલા યઝદ શેહરમાં "પેસતનજી ડોશાભાઇ મારકર ઓરફનેજ" સ્થાપવા માટે રૂ૩૦૦૦૦ ની રકમ બક્ષેશ આપી છે. એ આરફનેજના નીભાવ માટે રૂ૧૧૦૦૦ ના પાા ટકાના વોર બોંડ આપ્યા છે તેથી કુલે રૂ૪૧૦૦૦૦ ની રકમ ઓરફનેજ સ્થાપવા માટે સખાવતમાં આપી છે.

કરાંચીના જાણીતા શેહેરી ને વેપારી ખાનબહાદુર કાવશજી હોરમજી કાતરકે આ વરસે રૂ૩૫૦૦૦ સખાવતમાં આપ્યા હતા, તેમાં કરાંચીમાં દેશી લશકરો માટે રમત ગમત સારૂ મકાન બાંધવા સરકારને રૂ૧૫૦૦૦, વીરબાઇજી સ્કુલના જનરલ ફંડમાં રૂ૫૦૦૦ અને એવણના બેટા મી૦ સોરાબજીની શેહાદી કલકતાવાળા શેઠ માદનની બેટી સાથે થયાની ખુશાલીમાં રૂ૪૦૦૦ ની રકમ કરાંચીના ગુલબાઇ ન. મેહતા મેટરનીટી હોમ (સુવાવડખાના) માં આપી હતી અને કરાંચીના કલીફ્ટનમાં જાહાંગીર કોઠારી પરેડમાં એક બેંડસ્ટેંડ બાંધી આપવા રૂ૧૫૦૦૦ આપ્યા હતા.

અતરેના જાણીતા શેહેરી શેઠ ધનજીભાઇ બમનજી રૂ૩૫૦૦૦ ને ખરચે સુરત જીલ્લાના સુંવાલી ગામમાં પોતાના માત પીતાની યાદમાં છ બીછાના સાથની એક હાસપીટાલ સ્થાપવાનો વીચાર રાખે છે.

એક જરથોસતી ગ્રહસ્થે રૂ૨૫૦૦૦ ની રકમ શેઠ બેરામજી જીજીભાઇવાળી સ્કુલના ભોજન ફંડ માટે ભેટ આપી હતી.

શેઠ રૂસતમજી કુવરજી શેઠનાએ મરહુમ પીતાજી શેઠ કુવરજીની તથા મરહુમ માતાજી બાઇ કુવરબાઇની યાદમાં ઝોરાસ્ત્રીયન બીલડીંગ સોસાયટીને રૂ૨૦૦૦૦ આપ્યા કે એ સોસાયટીની પરેલની જમીન ઉપર ગરીબ જરથોસ્તીઓ માટે એક મકાન લગભગ રૂ૧૫૦૦૦ની કીમતનું બાંધી બાકીના રૂ૫૦૦૦ માંથી મરામત વગેરેનો ખરચ કરવો.

શેઠ એસ. આર. બમનજીએ જરથોસ્તી છોકરીઓની નીશાળ મંડળીને રૂ૧૦૦૦૦ આપ્યા હતા અને સર રબીનદરનાથ તાગોરને શાંતી નીકેટન ખાતેની એવણની સ્કુલમાં ટેકનીકલ ખાતું ઉભું કરી બાંધવામાં આવે છે તેમાં મદદ તરીકે દર વરસે એવણે રૂ૫૦૦૦ની રકમ આપવા કબુલ્યું છે.

શેઠ માણેકજી ખરશેદજી તારાચંદે રૂ૧૫૦૦૦ ની રકમ મુંબઇની પારસી પંચાયતને આપી હતી કે એમાંથી હાસપીટલો વગેરે ઠેકાણેના બહારથી આવતા રવાનોને મેલવા માટે સર જમશેદજી રોડ ઉપર ડુંગરવાડીની જગામાં એક બીજી વધુ બંગલી બાંધવી.

હાંગકાંગવાલા શેઠ મનચેરજી જમશેદજી પટેલે રૂ૧૫૦૦૦ ની રકમ ઓલપાડથી કુંડયાના સુધીનો રસ્તો સુધારી બાંધવા માટે આપી છે.

સીંકદરાબાદવાલા શેઠ બાપુજી એદલજી ચીનાઇ તથા બાઈ માણેકબાઇ બા. ચીનાઇએ પોતાના મરહુમ બેટા કેપટન ફીરોઝ ઇરાનમાં બેહસતનશીન થયાને છ માસ પુરા રોજ દેપાદર માહા

અસપંદાર ૧૨૮૮ ને દીને થવાથી મરહુમની યાદ કાયમ રાખવા મુંબઇની ઝોરાસ્ત્રીયન બીલડીંગ સોસાયતી હસ્તકના ગ્રાંટરોડના બાટલીવાલા વીલાઝમાનો એક વીલો રૂ૧૩૦૦૦ ની કીંમતે ખરીદી મરહુમને નામે એજ જાણીતી સોસાયટીને આપયો છે કે એનું જે ભાડું ઉપજે તેમાંથી અરધી રકમ એની મરામત વીગેરે માટે રાખી અરધી ઉપજ ગરીબ જરથોસ્તીઓને ભાડાંમાં સવલતા કરવા વાપરવી. એ વીલો મરહુમના નામથી "કેપટન ફીરોજ ચીનાઇ બીલડીંગને" નામે ઓળખાશે. અને મરહુમની છમસીને દીવસે એ મકાનમાં સાજે જશન કરવામાં આવ્યું હતું.

શેઠ નવરોજી બાપુજી તચકરાએ જરથોસતી છોકરીઓની નીશાળ મંડળીને રૂ૧૨૦૦૦ ની રકમના સેંત્રલ ઇંડીયા સ્પીનીંગ એન્ડ વીવીંગ મીલના શેર નંગ ૨૪ ભેટ આપ્યા કે તેનું બ્યાજ ગરીબ બાળકીઓને બપોરનું ભોજન, કપડાં, નીશાલની ફી, ચોપડી યા દવાદારૂ આપવાના ખરચમાં વાપરવું.

કરાંચીના જાણીતા શેહેરી ખા૦ બા૦ નશરવાનજી રૂસતમજી મહેતાએ આ વરસે કરાંચીખાતે કરેલી રૂ૭૨૦૧ની સખાવતની વીગતઃ—બાઇ ગુલબાઇ ન. મહેતા પારસી મેટરનીટી હોમના કમપાઉન્ડમાં ફુઆરો બાંધવા રૂ૨૦૦૦, લેપર એસાયલમનાં ફંડમાં રૂ૧૨૦૦, ઝોરાસ્ત્રીયન કલબને રૂ૧૦૦૦, આરમી વેલકમ ફંડમાં રૂ૧૦૦૦, ઇનફલુએનઝાના વખતમાં પારસીઓને મદદ કરવાના ફંડમાં રૂ૫૦૧, સોહરાબ કવોરટરસ પર નવો માળ ચઢાવવાના ફંડમાં રૂ૧૦૦૦ અને યંગ વીમેન્સ ક્રીસચીયન એસોસીએશનની બીલડીંગ ફંડમાં રૂ૫૦૦. એ ઉપરાંત બીજા ધરમ ખાતાઓ અને ફંડોમાં નાખલી મોટી રકમો ભરી હતી.

બીલીમોરાના જાણીતા શેહેરી શેઠ બરજોરજી નશરવાનજી મેગુસીએ પોતાના મરહુમ દીકરા દીનશાહજીના થયલા ઉઠમણામાં રૂ૪૨૮૧ ધરમખાતે આપયા હતા. એ ઉપરાંત શેઠ બરજોરજીએ દીકરા દીનશાહજીની નઇયેતે બીલીમોરાના ગરીબ જરથોસ્તીઓને સસતા ભાવે અનાજ આપવાના ફંડમાં રૂ૧૦૦૦, સુરત પારસી ઓરફનેજમાં દીનશાહજીના મરણને દીવસે દર વરસે બાજ કરી ખાણું આપવા બ્યાજ વાપડવા રૂ૧૦૦૦, મુંબઇની ચોપાટીની ધરમશાળામાં આંધલા પાગલાં જરથોસ્તીઓની પરવરસી કરવા માટે બ્યાજ વાપડવા રૂ૫૦૦, બીલીમોરાના ઝોરાસત્રીયન કલબમાં દર બહેરામ રોજે જશણનાં ભણતરમાં બહેસતી દીનશાજીનું નામ દેવા બ્યાજ વાપડવા રૂ૩૦૦ અને બીજા ફંડોમાં નાખલી મોટી રકમો ભરી હતી.

શેઠ હોરમજી માણેકજી ખજુરીએ પોતાના મરહુમ પીતાજી શેઠ માણેકજી અને માતાજી બાઈ આવાંબાઇ તથા બેહેન બાઇ દીનબાઇ પેસતનજી બરડીના પુણ માટે રૂ૫૦૦૦ની રકમ કરાંચીનાં બાઈ ગુલબાઇ મહેતા મેટરનીટી હોમમાં એક વોરડ બાંધવા આપી હતી. એ વોરડને "ખજુરીના લેબર વોરડ" નામ આપશે. વલી શેઠ હોરમજીએ કરાંચીના પારસી ઇનસ્ટીટયુટને રૂ૧૦૦૦ અને પારસી વીરબાઈજી સ્કુલને રૂ૧૦૦૦ આપ્યા કે એનું બ્યાજ દરેક જાતની રમત ગમતને ઉત્તેજન આપવાના કામમાં વાપરવું.

શેઠ ડોશાભાઇ હોરમજી કંત્રાકટરે રૂ૬૦૦૦ની રકમ કસાવલી ખાતેના હડખાં કુતરાંના ઇલાજ માટેના પાસચયુર ઇનસ્ટીટયુટમાં પારસીઓ સારૂ રહેવાનું એક જુદુ મકાન બાંધવા આપી હતી.

અતરેના જાણીતા શેહેરી શેઠ માણેકજી કાવશજી પીટીટે મહાબળેસ્વરના પારસી જીમખાનાની બાજુમાં બચ્ચાંઓ સારૂ રમત ગમત માટે એક પેવીલીયન બંધાવા રૂ૫૦૦૦ આપવા જણાવ્યું છે.

સખી વજુદ બાઇ હીરાંબાઇ જમશેદજી પીટીટ તે મરહુમ પેહેલા સર દીનશાજી માણેકજી પીટીટ બેરાનેટનાં દીકરીએ ગયા અશો ફરોહરનાં દીવસો ઉપર પોતાનાં રવાનોની નઇયતે ઝોરાસ્ત્રીઅન બીલ્ડીંગ ફંડમાં ગરીબોનાં ભાડામાં ઘટાડો કરવા રૂ૧૦૦, ગરીબ દીવાનાં જરથોસતીઓને મદદ કરવા રૂ૧૦૦, સોલજરોનાં કપડાંઓ ગરીબ જરથોસતી બાઇઓ પાસે સીવરાવવાના ફંડમાં રૂ૧૦૦, ધરમપોર કનઝમટીવ હોમમાં ગરીબ જરથોસતી દરદીઓને દવા ખોરાક વીગેરે મુફત આપવા રૂ૧૦૦, મુંબઇની જરથોસતી જશન કમીટી હસ્તક ધરમ અને નીતીની કેળવણી

આપવાના ફંડમાં રૂ૧૦૦ અને ગરીબ જરથોસતીઓને અનાજ આપવાનાં ફંડમાં રૂ૧૦૦. એ ઉપરાંત અનેક ધરમ ખાતાંઓ તેમજ સખાવતી ફંડો વગેરેમાં નાણાની સારી મદદ કરતાં રહયાં છે.

શેઠ જહાંગીર મનચેરજી માસતરે પોતાના ધણીઆણી શીરીનબાઈ તે જાનસીવાળા મરહુમ શેઠ મેરવાનજી એ. બોઇસનાં દીકરીનાં માસીસાને દીવસે નીચલા ધરમખાતાંઓમાં રૂ૫૨૦૦ આપ્યા હતાઃ—સર જમશેદજી સકુલના ભોજન ફંડમાં વયાજ વાપરવા રૂ૫૦૦, શેઠ બેહેરામજી જીજીભાઇ સકુલના ભોજન ફંડમાં વયાજ વાપરવા રૂ૫૦૦, જરથોસતી છોકરીઓની નીશાળ મંડળીને વયાજમાંથી ધરમ કેળવણીમાં હુશીયાર છોકરીને રોકડ રકમનું ઇનામ આપવા રૂ૧૦૦૦, જરથોસતી છોકરાંઓાંને ધરમ કેળવણી આપનારી મંડળીના ફંડમાં એ મંડળી હસ્તકની સ્કુલમાં શીખતા હુશયાર છોકરા તથા છોકરીઓને વયાજમાંથી રોકડ રકમનું ઇનામ આપવા રૂ૧૦૦૦, ડા૦ કેરાંવાળા હોસપીટલના વયાજમાંથી ગરીબ જરથોસતી બાઇઓને સુવાવડમાં મદદ કરવા રૂ૨૦૦૦ અને ડા૦ માસીનાની હોસપીટલમાં ગરીબ જરથોસતીઓને મદદ આપવા રૂ૨૦૦. એ ઉપરાંત મરહુમ બાઇ શીરીનબાઇની યાદમાં બીજા ખેશીઓએ રૂ૧૬૭ની રકમ ચાર ફંડોમાં આપી હતી.

મરહુમ બાઈ કોલીબાઈ તે શેઠ જમશેદજી હોરમજી મેગુસીના ધણીયાણીના પુણ માટે મરહુમનાં છોકરાઓ તથા છોકરીઓએ રૂ૬૮૦૦ ની ૫ ટકાની વેર લોન બીલીમોરાની જરથોસતી અંજુમનના ત્રસ્ટીઓને આપી કે રૂ૬૫૦૦ના વયાજમાંથી બીલીમોરાની સર જમશેદજીની તથા શેઠો ટાટાવાળી અંગ્રેજી હાઇસ્કુલ અને શેઠો ટાટાની છોકરીઓની અંગ્રેજી સ્કુલમાં ચોપડીઓ, સ્કુલ ફી અને કોલેજમાં સ્કોલરશીપો વગેરે અપાવવું તેમજ મરહુમ બાઇ કોલીબાઇના વારસીક મરણના દીવસે રૂ૩૦૦ના વ્યાજમાંથી બીલીમોરાની દરહેમેહરમાં માચી ચડાવવી.

શેઠ જમશેદજી શાપુરજી સોપારીવાલાએ પોતાના બેટા શેઠ ફરામરોજના પુણ માટે કરાંચીની વીરબાઇજી સ્કુલને રૂ૫૦૦૦ અને બીજા ફંડોમાં રૂ૧૦૦૦ની રકમ ભરી હતી.

મરહુમ બાઇ આવાબાઇ તે શેઠ અરદેશર જ. મેગુસીના ધણીયાણીના પુણ માટે મરહુમના છોકરાઓ શેઠો બરજોરજી તથા દોરાબજીએ રૂ૫૫૦૦ની ૫ ટકાની વેર લોન બીલીમોરાની જરથો-સ્તી અંજુમનના ત્રસ્ટીઓને આપી કે રૂ૪૭૦૦ના વયાજમાંથી દરશાલ બીલીમોરાની શેઠો મનચેરજી અને રતનજી ટાટાવાલી અંગ્રેજી હાઇસ્કુલના વીધ્યારથીઓ મેત્રીકમાં પસાર થવા પછી હુન્નરશાળા યાતો ટેકનીકલ કોલેજમાં જોડાય તેને સ્કોલરશીપો આપવી અને રૂ૮૦૦ના બ્યાજ-માંથી મરહુમ બાઇ આવાબાઇની દર વરસે વારસીક મરણને દીવસે બાજ વગેરે કરાવવી.

શેઠ રતનજી શાપુરજી ટાટાએ રૂ૫૦૦૦ની ૩ા ટકાની લોન બીલીમોરાની જરથોસતી અંજુ-મનના ત્રસ્ટીઓને આપી કે દર વરસે વયાજમાંથી બીલીમોરાની શેઠો મનચેરજી અને રતનજી ટાટાની અંગ્રેજી હાઈસ્કુલનો પારસી વીધાર્થી મેત્રીકયુલેશન પાસ કરી હુન્નરસાલા અથવા ટેકનીકલ કોલેજમાં દાખલ થાય તેને સ્કોલરશીપ આપવી.

શેઠ કે. આર. વાછા અને ધણીયાણીએ તા૦ ૨૭ મી સપટેમબરે પડેલી પોતાની સીલવર વેડીંગની યાદમાં ધરમખાતાઓમાં રૂ૫૦૦૧ આપ્યા હતાઃ—સર જમશેદજી સકુલના ભોજન ફંડમાં (જાથુકના બે છોકરાને ખવાડવાના) રૂ૧૫૦૦, શેઠ બેહેરામજી જીજીભાઈ સકુલના ભોજન ફંડમાં (જાથુકના બે છોકરાને ખવાડવાના) રૂ૧૫૦૦, કેશમીર મીશન હોસપીટલમાં એક બીછાનું જાથુકનું નીભાવવા રૂ૧૦૦૦, મુંબઇની સેવાસદનના ગરીબ ઘરબાર વગરના ફંડમાં રૂ૫૦૦, રાજા રાણી સાહેબના સીલવર જુબીલી ફંડમાં રૂ૧૫૧, ખેતવાડીના ગરીબ પારસીઓને સસતો અનાજ અપાવવાના ફંડમાં રૂ૧૫૦, પારસી એસોસીએશનના ગરીબ પારસીઓને સસતો અનાજ અપાવ-વાના ફંડમાં રૂ૧૦૦ અને જામે જમશેદના પારસીઓને સસતો અનાજ અપાવવાના ફંડમાં રૂ૧૦૦.

શેઠ રૂશાતમજી મ. કુકાએ સુરતની સર જમશેદજી જીજીભાઇવાળી અંગ્રેજી સ્કુલમાં શીખતા ગરીબ જરથોસતી છોકરાઓને બપોરનું ભોજન આપવા માટે રૂ૫૦૦૦ ની રકમ આપી હતી.

શેઠ ખરશેદજી ફરામજી દલાલે પોતાની દીકરી નાજાની નવજોતની ખુશાલીમાં ભરૂચના પારસી પંચાયત હસ્તકના સુવાવડખાના વીગેરેના ફંડમાં રૂ૫૦૦૦ની રકમ આપી હતી.

સુરતવાસી શેઠ રતનજી નશરવાનજી હોરમસજી લાકડાંવાળાએ રૂ૫૦૦૦ ની રકમ સુરત સારવજનીક આરટસ કોલેજ તથા નામદાર સર જમશેદજી જીજીભાઇ સુરત પારસી ઇંગલીશ સ્કુલના ગરીબ પારસી વીદયારથીઓને સ્કોલરશીપો આપવા માટે આપી છે.

પુના શહેરની ખા૦ બા૦ પેસતનજી સો. ચેરીટેબલ ડીસપેનસરીના મેટરનીટી વોરડને કાઉનટેસ ઓફ ડફરીન ફંડ તરફથી મદદ મળતી બંધ થવાથી નેપીયર સીનેમાના માલેક શેઠ એ. સી. પટેલે દર વરસે એક હજાર રૂપીઆ પાંચ વરસ સુધી આપવા જણાવ્યું છે અને પહેલાં વરસના રૂ૧૦૦૦ મોકલી આપી પારસી બાનુઓ માટે બે બીછાણાંઓની સગવડ રાખવાની શરત કરી છે.

વડોદરાવાલા શેઠ પેસતનજી ફરામજી કંત્રાકટરે પોતાના મરહુમ બાવા ખા૦ સા૦ ફરામજીની વરસીની યાદમાં વડોદરાના નસેસાલારના ફંડમાં રૂ૫૦૦૦ની ૩॥ ટકાની લોન આપી હતી, શેઠ પેશતનજીના બાવા શેઠ ફરામજી જેવણુ રોજ ૧૭–૧૧–૧૨૮૭ને દીને બેહેસતનશીન થયા હતા, તેવણુના ઉઠમણામાં ભરાયલી રકમમાંથી રૂ૧૫૦૦૦ ની ૩॥ ટકાની લોનો વડોદરાની પારસી પંચાયતના નસેસલાર ફંડમાં બ્યાજ વાપરવા એવણે આપવાથી વડોદરાની જરથોસ્તી અંજુમને શેઠ પેસતનજી કંત્રાકટરને તથા આ કામમાં મદદ કરનાર નવસારીવાલા શેઠ નાનાભાઇ બરજોરજી દેસાઇને એકેક શીયાળો એનાયત કરી હતી.

બાઇ દીનબાઇ તે મરહુમ શેઠ ફરામજી હીરજીભાઈ ચાઇના વીધવાએ બીલીમોરાની જરથોસ્તી અંજુમનના ત્રસ્ટીઓને રૂ૪૫૦૦ની ૩॥ ટકાની લોન આપી કે એનું બ્યાજ બીલીમોરાના જુદા જુદા ફંડો વગેરેમાં વાપરવું.

નાગપોરની એમપ્રેસ મીલના માજી એસીસટંટ મેનેજર મરહુમ શેઠ ડોશાભાઇ હોરમજી વાહાડયાની યાદમાં તેમના પુણ્ માટે રૂ૪૦૦૦ની રકમ મુંબઇ ખાતે ગીરગામ બેક રોડ ઉપર આવેલી પશ્ચીમ હીંદુસ્તાનમાં બાળકોનું રક્ષણ કરનારી મંડળીને (ચીલડરેનસ રેફયુજ ફંડમાં) ભેટ આપી હતી.

કરાંચીના રહીશ શેઠ ધનજીશાહ જમશેદજી જાગુસે કરાંચીના ગુલબાઇ મેટરનીટી હોમના નીભાવ ફંડમાં બ્યાજ વાપરવા રૂ૩૦૦૦ની રકમ આપી હતી.

ભરૂચના જાણીતા શેહેરી શેઠ એરચશા નવરોજી ગાંધીએ ભરૂચની પારસી પંચાયતને રૂ૨૫૦૦ની રકમ એવણના મરહુમ પીતા શેઠ નવરોજી અરદેશર કાલાગાંધીની નાઇયતે ગાહમ્બારનું ખાતું પડાવેલું છે તેમાં ઉમેરવા આપી હતી.

શેઠ નશરવાનજી હોરમજી લાકડાવાળાએ સુરતની પારસી પંચાયતને રૂ૨૫૦૦ ના ૫ ટકાના બોનડ આપ્યા કે એના બ્યાજમાંથી નસેસાલ તથા ખાંધીયાઓને તયાં લગનનો પ્રસંગ આવે તયારે લગનમાં રૂ૧૦૦ અને નવજોત વખતે રૂ૨૫ આપવા.

સુરતના એક જરથોસ્તી ગ્રહસ્થે સુરતની પારસી પંચાયતનો હજીરા મધે કેટલીક નવી ખરીદ કરેલી જમીન પેટે વાપરવા રૂ૨૫૦૦ ની રકમ આપી હતી.

બાઈ બપઇ કેખશરૂ કંત્રાકટરે કરાંચીના બાઇ ગુલબાઇ મેટરનીટી હોમમાં રૂ૨૫૦૦ આપ્યા હતા.

શેઠ રતનશાહ ફરેદુનજી જીનવાળાએ પોતાના બેટી બાઇ મોટામાંયની શેહાડીની ખુશાલીમાં રૂ૨૦૦૦ ભરૂચની હોમાવાળાની દરેહમેહરના નીભાવ માટે આપ્યા હતા.

સેનત્રલ ઇંડ્યા તરફના એક પારસી ગ્રહસ્થે રૂ૨૦૦૦ ની રકમ નાગોળની હોસ્પીટલ સારૂ રાંધણી અને કમપાઉંડરને રહેવાની જગા વગેરે બાધવાનાં ખરચ માટે આપા હતી.

શેઠ હોરમજી એદલજી આશાએ રૂ૨૦૦૦ની ૩।। ટકાની લોન બીલીમોરાની જરથોસ્તી અંજુમનના ટ્રસ્ટીઓને આપી કે રૂ૧૦૦૦ ના વ્યાજમાંથી મરહુમ બાવા શેઠ એદલજીના પુણ્ માટે બીલીમોરાની શેઠો ટાટાની અંગ્રેજી હાઇસ્કુલનો પારસી વીધાર્થી મેટ્રીક થયા પછી હુનરશાળામાં અથવા ટેકનીકલ કોલેજમાં દાખલ થાય તેને સ્કોલરશીપ આપવી અને રૂ૧૦૦૦નું વ્યાજ ગરીબ જરથોસ્તીઓને અનાજ આપવામાં વાપરવું.

શેઠ અરદેશર ભીખાજીએ સુરત જીલ્લાની માંડવીની અંગ્રેજી સ્કુલના ફંડમાં રૂ૧૦૦૧ ભેટ આપી વારસીક રૂ૬૪ ની ત્રણ સ્કોલરસીપ દર વરસે આપવામાં આવે તેટલી વધુ રકમ આપી હતી.

અતરેના જાણીતા શેહેરી શેઠ કાવસજી જાહાંગીરે મહાબલેસ્વર ખાતે ટેનીશ કોરટની બાજુમાં આશાએસ લેવા એક શેડ બાંધવા માટે રૂ૧૫૦૦ ની રકમ આપવા જણાવ્યું હતું.

અતરેના જાણીતા શેહેરી શેઠ ધનજીભાઇ બમનજી પીટીટે મહાબલેસ્વરના પારસી જીમખાનામાં બીલીયરડ ટેબલ તેની સરવે સામગ્રી સાથે રૂ૧૫૦૦ના ખરચે ભેટ આપવા જણાવ્યું હતું.

શેઠ મેરવાનજી એદલજી કાંદાવાલાએ પોતાના મરહુમ પીતાજી શેઠ એદલજી બેજનજી કાંદાવાલાને નામે કરાંચીની પારસી વીરબાઈ સ્કુલના છોકરાઓ માટે એક લાયબરેરી સારૂ રૂ૧૫૦૦ ની રકમ આપી હતી.

વલસાડના જાણીતા શેહેરી ખા૦ બા૦ કાવસજી ધનજીભાઇ ધનભુરાંએ ભરૂચ કાઠેની અગીઆરી બાધવાંના ફંડમાં રૂ૧૦૦, ભરૂચ દુકાલ ફંડમાં રૂ૨૦૦, વલશાડમાં સસતો અનાજ વેચવાને ફંડમાં રૂ૧૦૦૦ અને કાઠીઆવાડમાં ઢોરોને ઘાસનાં ફંડમાં રૂ૧૦૦ મળી રૂ૧૪૦૦ આપ્યા હતા.

શેઠ દીનશાહ મેરવાન ઇરાનીએ જામે જમશેદમાં એક વરસ સુધી દરરોજ છપાયલા રોજીંદી મનશનીના ફકરાઓ ભેગા કરીને તેનું એક પુસ્તક છપાવ્યું હતું અને એના વેચાણથી ઉપજેલી રકમમાંથી રૂ૧૦૦૦ નીચે મુજબ આપ્યા હતાઃ—ડા૦ કેરાવાલા હોસ્પીટલમાં રૂ૩૦૦, ડા૦ માસીના હોસ્પીટાલમાં રૂ૩૦૦, ગરીબ જરથોસ્તીઓને અનાજ અપાવવા જામે જમશેદ હસતકના ફંડમાં રૂ૩૦૦ અને સર જ. જી. સ્કુલના ભોજન ફંડમાં રૂ૧૦૦. ચોપડીની કીંમત એક રૂપીયો છે, પણ દરેક ચોપડીના વેચાણથી ઉપજેલા એક રૂપીયામાંથી અરધો રૂપીયો ધરમ ખાતે આપવામા આવે છે.

શેઠ મનચેરજી સોરાબજી દલાલે ભરૂચ ડીસ્ટ્રીકટ ફેમીન રીલીફ ફંડમાં રૂ૧૦૦૧ આપ્યા હતા.

અમદાવાદવાલા શેઠ પીરોશાહ બેરામજી કરાકા અને ધણીયાણી બાઇ જરબાઇએ રૂ૧૦૦૦ મઉના બાઇ મીઠીબાઇ અશો ફ્રોહર ફંડમાં વ્યાજ વાપરવા આપ્યા હતા.

વડોદરાના આબકારી કંત્રાકટર શેઠ એદલજી રૂશતમજી ફનીબંદાએ વડોદરાની ઉમરીગરવાલી દરેહમેહરમાં રૂ૬૭૫ ને ખરચે નીરંગદીન કરાવી આપી હતી.

શેઠ જમશેદજી હોરમજી મેગુસીએ બીલીમોરાની જરથોસ્તી અંજુમનના ટ્રસ્ટીઓને અગીઆરીમાં એવણના ધણીયાણી ડોલીબાઇના મુકતાદ માડવા બેડું ૧ તથા રૂ૩૧૦ આપ્યા કે એમાંથી રૂ૧૦ ચાલુ સાલના મુકતાદ માડવાનાં ખરચના લઇ રૂ૩૦૦ નું વ્યાજ મુકતાદ માંડવાના ખરચમાં વાપરવું. એ મુજબ એવણના બાવા શેઠ હોરમજીના મુકતાદ માંડવા રૂ૩૧૦, તેમજ માતાજી બાઈ મોટીબાઈના મુકતાદ માંડવા રૂ૩૧૦ આપ્યા હતા.

શેઠ જમશેદજી રૂશતમજી મેગુસીએ બીલીમોરાની અંજુમનના ટ્રસ્ટીઓને એવણના બાવા શેઠ રૂશતમજીના અગીઆરીમાં મુકતાદ માંડવા બેડું ૧ તથા રૂ૩૧૦ આપ્યા કે એમાંથી રૂ૧૦ ચાલુ સાલના મુકતાદ માંડવાનાં ખરચના લઇ રૂ૩૦૦ નું વ્યાજ મુકતાદનાં ખરચમાં લેવું. એ મુજબ એવણના માતાજી બાઇ ખરશેદબાઇના મુકતાદ માડવા માટે રૂ૩૧૦ આપ્યા હતા.

બાઇ શીરીનબાઇ જહાંગીરજી જાસનેવાલાએ માતાજી આદરબાઇ જમશેદજી તીસકરીવાળાના પુણ્ માટે રૂ૬૦૦ની ૩।। ટકાની લોન વલસાડના રૂવાનોને અવલમંજલ પહોંચાડવાના ફંડમાં વ્યાજ વાપડવા આપી હતી.

શેઠ નવરોજી લીમજીભાઇ આસાએ મરહુમ ધણીઆણી બાઇ માણેકબાઇનાં પુણ માટે રૂ૫૦૦ ની ૩ાા ટકાની લોન બીલીમોરાની જરથોસ્તી અંજુમનના ત્રસ્ટીઓને આપી કે એના વ્યાજમાંથી ગરીબ જરથોસ્તીઓના મરણનો ચાર દીવસનો ખરચ કરવો.

શેઠ જમશેદજી હોરમજી ચોથીઆએ વલસાડના ગરીબ જરથોસ્તીઓને સસતો અનાજ વેચવા દુકાન કાઢવા માટે રૂ૫૦૦ આપ્યા હતા.

બાઇ આઇમાયે પોતાના ધણી શેઠ દારાબશા પાલણજી પ્લમબરનાં પુણ માટે રાંદેરના દુખમાંનાં કમપાઉન્ડનો લોખનનો દરવાજો રૂ૫૦૦ નો ખરચ કરી મુકાવી આપયો હતો.

શેઠ મેરવાનજી મનચેરજી બનાજીએ મરહુમ બેટા ફરામરોઝના પુણ માટે પારસી સંકટ નીવારણ ફંડમાં રૂ૨૦૦, પારસી ઈમિરજનસીફોર ફંડમાં રૂ૨૦૦ અને સ્ત્રી જરથોસ્તી મંડળના અનાજ ફંડમાં રૂ૧૦૦ મલી રૂ૫૦૦ આપ્યા હતા.

બાઈ ખરશેદબાઇ કે. નરીમાને સુરતના કદમી આતશબેરામમાં સુખડ પુરૂ પાડવાના ફંડમાં રૂ૫૦૦ આપ્યા હતા.

શેઠ સોરાબજી આદરજી દલાલે પોતાની દીકરી પીરોજાની નવજોતની ખુશાલીમાં ભરૂચની પારસી પંચાયતને રૂ૫૦૦ના પાા ટકાના બોંડો વ્યાજ વાપરવા આપ્યા હતા.

મરહુમ શેઠ રતનજી પેસતનજી ભુરા રોજ ૧૫-૯-૧૨૮૫ ને દીને મુંબઇમાં બેહેસતનસીન થયલા તેવણનાં પુણ માટે મરહુમના મીત્રો તરફથી ભરાયલા રૂ૫૦૦ ની ૩ાા ટકાની લોન બીલીમોરાની જરથોસ્તી અંજુમનના ત્રસ્ટીઓને આપી કે એનું વ્યાજ ગરીબ જરથોસ્તી છોકરાંની નવજોત કરવામાં વાપરવું.

મરહુમ શેઠ જમશેદજી ન. તાતાની પંદરમાં વરસની બાજને દીને તા૦ ૧૬ મી મેને દીવસે મેસરસ તાતા સનસની ઓફીસના સ્તાફ તરફથી જશન દર વરસ મુજબ થયું હતું પણ જમણ થતું હતું તે આ વરસે મોકુફ રાખી બચેલા રૂ૪૪૧માંથી ઝોરાસ્ત્રીઅન એસોસીએશનના સસતા અનાજ ફંડમાં રૂ૨૨૦ અને પારસી પંચાએતના જરથોસ્તીઓને સસતો અનાજ આપવાનાં ફંડમાં રૂ૨૨૧ આપ્યા હતા.

બાઇ સુનાબાઇ જમશેદજી દાયલાનાં પુણ સારૂ એવણની પુંજીમાથી બીલીમોરાની અગીઆરીમાં મુકતાદ માંડવા બેડું ૧ તેમજ રૂ૩૦૦ વયાજ વાપરવા બીલીમોરાની જરથોસ્તી અંજુમનને આપ્યા હતા.

શેઠ કાવશજી જમશેદજી મેગુસીએ બીલીમોરાની અંજુમનના ત્રસ્ટીઓને એવણના ધણીયાણી બાઈ ગુલબાઇના અગીઆરીમાં મુકતાદ માંડવા બેડું ૧ તથા રૂ૩૧૦ આપ્યા કે એમાંથી રૂ૧૦ ચાલુ સાલના મુકતાદ માંડવાના ખરચનાં લઇ રૂ૩૦૦નું વ્યાજ દરસાલ મુકતાદ માંડવાના ખરચમાં લેવું.

શેઠ અરદેશરજી જમશેદજી મેગુસીએ બીલીમોરાની અંજુમનના ત્રસ્ટીઓને એવણના ધણીયાણી આવાંબાઇના અગીઆરીમાં મુકતાદ માંડવા બેડું ૧ તથા રૂ૩૧૦ આપ્યા કે એમાંથી રૂ૧૦ ચાલુ સાલના મુકતાદ માંડવાનાં ખરચનાં લઇ રૂ૩૦૦નુ વયાજ મુકતાદ માંડવાના ખરચમાં લેવું.

મરહુમ બાઇ દીનબાઇ મોટાભાઇ પેસતનજી વાસણીયાના પુણ માટે બીલીમોરાની જરથોસ્તી અંજુમનને અગીઆરીમાં મુકતાદ માંદવા માટે બેડું ૧ તથા રૂ૩૦૦ વ્યાજ વાપરવા આપ્યા હતા.

શેઠ કેરશાસ્પ જમશેદજી દસ્તુરે પોતાના પીતાજી મરહુમ ડૉ૦ જમશેદજીના માસીસાની યાદમાં ભરૂચની પારસી પંચાયતને મરહુમના પુણ માટે સ્થાપેલા ધરમ ખાતામાં રૂ૨૦૩ આપ્યા હતા.

દસ્તુર રૂસતમજી હોરમજી રાંદેરીઆએ પોતાના છોકરા શેઠ દારાબશાહનાં પુણ માટે રાંદેરના મુકતાદ ફંડમાં રૂ૧૦૦ અને શગરી ફંડમાં રૂ૧૦૦ આપયા હતા.

શેઠ સોરાબજી હોરમજી રાંદેરીઆએ પોતાની છોકરી બાઇ દોશીબાઇનાં પુણ માટે રાંદેરના શગરી ફંડમાં રૂ૧૦૦ અને ખાંધીઆ નશેશાલારનાં ફંડમાં રૂ૧૦૦ આપ્યા હતા.

શેઠ ફરામરોજ બી. મોતીવાલાએ નવશારીની યંગ ઝોરાસ્ત્રીયન ક્રીકેટ કલબને રૂ૧૨૫ ભેટ આપ્યા હતા.

એક જરથોસતીએ જરથોસતી છોકરીઓની નીશાળ મંડળીને રૂ૫૦ અને લેડી નોરથકોટ અનાથાશ્રમમાં રૂ૫૦ આપ્યા હતા.

શેઠ પીરોશાહ બેરામજી કામાએ વડોદરાના દુખમાના જનરલ ફંડમાં રૂ૧૨૫ આપ્યા હતા.

શેઠ પેસતનજી મેરવાનજી કરંજીઆએ રાજકોટ ખાતે પારસી નાધલા બાળકોને ધારમીક તેમજ પ્રાથમીક કેળવણી આપવા માટે રૂ૧૦૦ આપ્યા હતા.

મુંબઈના જાણીતા શેહેરી લેડી આઇમાય હોરમજી વાહાડયાએ રાજકોટ ખાતે સઘલી કોમોને મુફત છાસ આપનારા ખાતાને તા૦ ૬ ઠી જુલાઇથી દર રોજની રૂ૫૦ ની મદદ આપવાની લાંબો વખત સુધી ચાલુ રાખી હતી. આ ખાતામાંથી દરરોજના સવારના ૧૨૦૦ ગેલન જેટલી છાશ લગભગ અઢીથી ત્રણ હજાર કુટુંબોને પુરી પાડવામાં આવે છે. તેમજ લેડી આઇમાય તરફથી દમણના સંખ્યાબંધ દુકાળીયાઓને તા૦ ૯ મી જુલાઇથી દરરોજ કણીયારૂ પાવાનું કામ ત્યાંના જાણીતા શેહેરી પ્રોફેસર અરદેશર સોરાબજી પોસ્ટવાલાની દેખરેખ હેઠળ બે માસ સુધી ચાલુ રાખ્યું હતું.

ડા૦ જાહાંગીર કાવશજી મેહતાએ લાનોલીમાં પોતાના બંગલામાં સસતે ભાવે ગરીબોને અનાજ વેચવાની ગોઠવણ કરી રૂપ્યાનો ચાર શેર અનાજ મેલવી સાડા પાંચશેર ને હીસાબે વેચવાથી લગભગ ત્રણથી ચાર હજાર રૂપ્યાની ખોત પોતે આપવા ઉપરાંત રેલવેનુર ગાડી ભાડું વગરેનો ખરચ બી પોતાની ગીરેથી આપ્યો હતો. વીસ માઇલ દુરથી અનાજ લેવા આવતા માણસોને એવણે પોતાના કુટંબ સાથે મલીને અનાજ આપવાનું લાંબો વખત સુધી ચાલુ રાખયું હતું, તેમજ ગરીબ હાજતમંદોને કપડાંબી વેંહચી આપ્યાં હતાં.

મુંબઈના જાણીતા કંત્રાકટર શેઠ પાલનજી શાપુરજી મીસતરીએ આ સખત મોગવારીને લીધે વેસુ, ભાઠા અને ડુમસ મલી ત્રણ ગામનાં લગભગ બસો ગરીબ જરથોસતી કુટંબોને કપડાઓ વેંહચી આપી નાણાની સારી મદદ કરી હતી.

શેઠ નવરોજી છવણજી ગજડરે રૂ૩૦૦ નું અનાજ ગણદેવીના ગરીબ જરથોસતીઓને વેહચી આપ્યું હતું.

મરહુમ શેઠ ધનજીશા બરજોરજી નોશીરવાનજી વકીલની વરસીને દીવસે મરહુમની યાદમાં તેમની પુંજીમાંથી રૂ૨૦૦ સુરતના સસતા અનાજના ફંડમાં આપ્યા હતા.

શેઠ કાવસજી પેસતનજી બીલીમોરીયાએ પુણાના પારસી જીમખાનાને રૂપાનું કપ ભેટ આપ્યું છે કે બીલીયરડ હેંડીકેપ ટુરનામેંટમાં પેહલે નંબરે આવનારાને આપવું.

શેઠ નશરવાનજી હોરમજી દેબરાએ નવસારી મસેશરના આદરાનમાં પાંથરવા માટે સેટરંજીઓ તથા મોટી જાજમ ભેટ આપી હતી.

શેઠ દીનશાહ બમનજી વકીલે ભરૂચની પારસી પંચાયતને રૂવાનોને દોખમે લઇ જવા માટે એક ગાડી પોતાને ખરચે આપવા જણાવ્યું હતું.

મરહુમ શેઠ નવરોજી માણેકજી વાહાડયા સી. આઈ. ઇ. એ સ્થાપેલા સારવજનીક સખાવતના ત્રસ્ટ ફંડના ત્રસ્ટી સાહેબો તરફથી એ ત્રસ્ટના સ્થાપકની યાદ રાખવા માટે તા૦ ૨૧ મી મારચે પરેલના શેઠ નવરોજી વાહાડયાના જાંગીર બાગવાલા બંગલામાં નામદાર ગવરનર સર જયોરજ લોઇડના પ્રમુખપણા હેઠળ એક મેલાવડો કરવામાં આવ્યો હતો. જુદી જુદી શાળાના છોકરાંઓ પાસે રમત ગમતનો અખાડો કરાવી જીતનાર બાળકોને ઇનામો નામદાર લેડી લોઇડના હાથે આપવામાં આવ્યાં હતાં. મરહુમ શેઠ નવરોજી મા. વાડીઆ તા૦ ૨૧ મી જુલાઇ ૧૯૦૯ ને દીને મરણ પામયા પછી તા૦ ૧ લી આગસટ ૧૯૧૭ થી તા૦ ૩૧ મી જુલાઇ ૧૯૧૮ સુધીના નવમા વરસનો રીપોરટ સર જમશેદજીએ વાંચતાં જણાવ્યું કે આગલા આંઠ વરસમાં રૂપ્યા પચીશ લાખ

જુદા જુદા ધરમ ખાતાઓને આપ્યા હતા. રીપોરટવાળા સાલ દરમયાન મીલકતોના ભાડાંના રૂ૧૬૨૮૬૨, શેરો ઉપરની વહેંચણીના રૂ૧૨૧૮૭૧, સરકારી નોટનું વયાજ રૂ૭૪૦૨૮, પોરટ ટ્રસ્ટ બોંડનું વ્યાજ રૂ૪૨૬૮૨ અને લોન ઉપરનું વયાજ રૂ૩૩૪૫૭ મલી કુલે આવક રૂ૪૩૫૦૦૦ની થઇ હતી, જયારે રૂ૩૪૦૦૦૦ જુદા જુદા કામ માટે આપ્યા છે. આ વરસે હીંદુસ્તાનમાં પડેલા દુકાલને લીધે રૂ૫૦૦૦૦ આપ્યા છે; કેળવણી પાછળ રૂ૧૧૦૫૦૯ ની રકમ ખરચી હતી, તેમાં નીચલી મુખ્ય છેઃ—દીલ્હી, મુંબઈ, પુના, ભરૂચ અને નાશકમાં કનયા કેળવણીના જુદાં જુદાં ખાતાઓને રૂ૨૫૦૦૦, સીડનહેમ કોલેજ ઓફ કોમરસ અને ઇકોનોમીકસને (પાંચમો ફાળો) રૂ૨૦૦૦૦, ફરામજી કાવસજી ઇનસટીટયુટના નવા મકાન માટે (પહેલો ફાળો) રૂ૧૮૦૦૦, કેળવણી ખાતાંઓને માસીક ગ્રાંટોના રૂ૧૩૨૦૦, હીંદમાં ગરીબ વીદયારથીઓને માસીક ગ્રાંટના રૂ૧૧૦૭૪, છોકરાઓની કેળવણી માટે જુદાં જુદાં ખાતાંઓને રૂ૮૩૦૦, ગ્રેટ બ્રીટન મધે હીંદી વીદયારથીઓને રૂ૭૮૦૦ અને આંધળાંઓ માટેની અમેરીકન મીશન સ્કુલને રૂ૫૦૦૦; ગરીબાઇ અને સંકટ ટાળવા માટે રૂ૮૨૭૪૨ આપ્યા હતા, એમા નીચલી મુખ્ય છેઃ—પુનાની સેવાસદન મારફત રૂ૧૪૦૦૦, સરવંટસ ઓફ ઇંડીયા સોસાયટી મારફત રૂ૧૦૦૦૦, નીશાળે જતાં પારસી છોકરાંઓના ભોજન ફંડમાં રૂ૩૫૮૬, બોંબે ડીસ્ટ્રીકટ બેનીવોલંટ સોસાયટીને રૂ૧૫૦૦, દીવાના પારસી માટેના એન. એમ. પીટીટ ચેરીટી ફંડમાં રૂ૧૦૦૦ અને સાલવેશન આરમી રેસકયુ હોમને રૂ૫૦૦; હોસપીટલો અને તબીબી મદદ માટે રૂ૭૫૨૮૪ આપયા છે, તેમાં નીચલી મુખ્ય છેઃ–બોંબે પ્રેસીડનસી કીંગ એડવરડસ હોસપીટલને પાંચમો છેલ્લો ફાળો રૂ૩૦૦૦૦, ડા૦ માસીના હોસપીટલને છઠો છેલ્લો ફાળો રૂ૧૦૦૦૦, કાઉનટેસ ઓફ ડફરીન ફંડમાં રૂ૪૨૦૩, પુનાં શેહેરમાંની એન. એમ. વાડીયા હોસપીટલના વારસીક નીભાવ માટે રૂ૪૦૦૦, દેવલાલીની ડા૦ બહાદુરજી સેનીટેરીયમને રૂ૩૦૦૦, મથરાસની વીકટોરીયા ઘોશ હોસપીટાલને રૂ૩૦૦૦, સીમલામાં લેપરો માટેના મીશનને રૂ૫૦૦, લેડી વીલીંગડન મેટરનીટી હોમને રૂ૩૦૦૦, યુરોપયન રીલીફ એસોસીએશન ફંડમાં રૂ૨૦૦૦, અંધેરીની એન. જે. વાડીઆ ડીસપેનસરીને રૂ૧૫૦૦, દીલ્હીની ડા૦ શરાફની આંખની હોસપીટલમાં રૂ૧૨૦૦, જે. જે. હોસપીટલ નરસીંગ એસોસીએશનને રૂ૧૦૦૦, ગોકલદાસ તેજપાલ હોસ્પીટલ નરસીંગ એસોસીએશનને રૂ૧૦૦૦, લેપરો માટેના મીશનને (તારાપોર) રૂ૧૦૦૦, આધળાઓ માટેની ડા૦ હેનડરસનની યોજના માટે (નાશક) રૂ૧૦૦૦, મુંબઇના સેંટ જોન એમબ્યુલંસ એસોસીએશનને રૂ૮૦૦, લેપરો માટેનું મીશનને (નાશક) રૂ૫૦૦, ડા૦ મહેતાના સુવાવડખાનાને (નવસારી) રૂ૫૦૦, અને જુદાં જુદાં મથકોએ બીજી તબીબી મદદ તરીકે રૂ૪૮૮૬; માબાપ વગરના બાળકોના નીભાવ અને કેળવણીનો બીજો ફાળો જે રૂ૨૬૪૨૧નો થયો છે તેમાં પુનાની મીસીસ ડેંચીઝ ઓરફનેજને રૂ૬૦૦૦, સુરતના વનીતા વીશ્રામને રૂ૫૦૦૦, સેંટ જોસફ ફાઉનડલીંગ હોમને રૂ૫૦૦૦, માબાપ વગરના બાળકોના નીભાવ માટે વાલીઓને આપયા રૂ૩૪૪૯, જે. એન. પીટીટ ઓરફનેજને રૂ૧૬૨૦, પુના નેટીવ ઇનસ્ટીટયુશનને રૂ૧૫૦૦, બાઇ આવાંબાઇ પીટીટ ગર્લસ ઓરફનેજને રૂ૧૦૪૦, બોંબે સ્કોટીશ ઓરફનેજને રૂ૧૦૦૦, અને ચદરોનીઆ કાયસથ એડયુકેશન સોસાયટીને રૂ૧૦૦૦; સઘળી કોમની ગરીબ છોકરીઓને પરણાવી આપવા રૂ૪૨૧૦ અને પારસી છોકરાંઓની નવજોત પાછળ રૂ૩૫૦ ખરચયા છે; પરચુટણ ખાતામાં રૂ૫૬૦૯ ખરચયા છે જેમાંના રૂ૧૫૦૦ સોસીયલ સરવીસ લીગને અને રૂ૧૫૦૦ યંગ વીમેનસ ક્રીશચયન એસોસીએશનને આપ્યા હતા.

મરહુમ શેઠ નવરોજી ન. પોચાજીના ફંડના ટ્રસ્ટી ખા૦ બા૦ નશરવાનજી રૂ. મહેતાએ કરાંચીની પારસી વીરબાઇજી સ્કુલના જનરલ ફંડમાં રૂ૧૫૦૦૦ અને વીરબાઇજી સ્કુલના શીક્ષકોના વોર એલાવન્સ માટે રૂ૫૫૦ આપ્યા હતા.

શેઠ નસરવાંનજી જાહાંગીરજી વાહ્ડીઆ ચેરીટી ફંડના ત્રસ્તી ડા૦ સર ટેમુલજી ભીખાજી નરીમાંન તરફથી પારસી ફીવર હોસપીટલમાં રૂ૧૦૦૦, યંગ વીમેનસ ક્રીશચીયન એસોસીએશનના બીલડીંગ ફંડમાં રૂ૫૦૦, સોસાયટી ફૉર ધી પ્રોટેકશન ઑફ ચીલડરનના ફંડમાં રૂ૫૦૦, પારસી પંચાયેતના સસતો અનાજ આપવાનાં ફંડમાં રૂ૧૦૦૦, સ્ત્રી જરથોસ્તી મંડલને કેલવની માટે રૂ૧૨૦૦, પારસી સુવાવડખાનાંને રૂ૩૦૦૦ અને પારસીઓને પગાર આપવા તેમજ કેલવની આપવા સારૂ આપેલા રૂ૨૦૦૦ મલી રૂ૯૨૦૦ આપવામાં આવ્યા હતા.

શેઠેંગાહ્મીની જરથોસ્તી અનજુમનનાં ધરમનાં ફંડમાંથી તેના ત્રસ્ટીઓ તરફથી મુંબઇની પારસી પંચાયતના સુરત સીવાયના બીજા દેશાવરોના જરથોસ્તીઓને સસ્તો અનાજ પુરો પાડવા રૂ૧૦૦૦, સર જમશેદજી સ્કુલનાં ભોજન ફંડમાં રૂ૫૦૦, શેઠ બેરામજી જીજીભાઇ સ્કુલનાં ભોજન ફંડમા રૂ૫૦૦, પંચાયતની ફીવર હોસ્પીટલમાં રૂ૫૦૦, પંચાયતના ગરીબ માબાપ વીનાના બાળકો તથા વીધવાઓના ફંડમાં રૂ૩૦૦, ખેતવાડીના જરથોસ્તીઓને સસતો અનાજ આપવાના ફંડમાં રૂ૨૦૦, સુરતની પંચાયતના જરથોસ્તીઓને સસ્તો અનાજ આપવાના ફંડમાં રૂ૨૦૦, વાંદરેના બાઈ શીરીનબાઇ કામાના કોનવેલેસંટ હોમમાં રૂ૩૦૦, ધરમપોરના શેઠ બેરામજી મલબારીની ખહીની સેનેટરીયમમાં ફકત જરથોસ્તીઓ માટે વાપરવા રૂ૩૦૦, ડા૦ સર તેમુલજી નરીમાનના સુવાવડખાનામા રૂ૩૦૦, સ્ત્રી મંડળના સસતો અનાજ આપવાના ફંડમાં રૂ૨૦૦ મળી રૂ૪૩૦૦ આપવા ઉપરાંત બીજા ફંડોમાં સારી રકમો ભરી હતી. વલી જામે જમશેદ હસ્તકના ગરીબ જરથોસ્તીઓને મદદ કરવાના ફંડમાં ૫૦૦ ટેલ આપવામાં આવ્યા હતા.

મરહુમ શેઠ પેસતનજી એદલજી મેહતાની યાદગારી રાખવાનાં નવસારીનાં મલેશરનાં ગરીબ પારસી જરથોસતીઓને આશરો આપવાના ફંડમાં જુદાં જુદાં બાનુઓ તથા ગ્રહસ્થોએ સર અવસરે ભરેલા રૂ૬૧૫, તાતકાલીક મદદ કરવા માટે હેલપીંગ મેમબરોએ ભરેલા રૂ૨૧૫, અને ફંડના રૂ૧૦૬૦૦ ની સીકયુરીટીના વ્યાજનાં રૂ૪૧૧ મલી રૂ૧૨૪૧ ભરાયા હતા. આ કુલે ભરાયલામાં નીચલી મુખ્ય રકમો આવી જાય છે, એમાં શેઠ ધનજીશા દોરાબજી મહેતાએ બેન નાજામાય તથા બનેવી પીરોજશા દો. મહેતાનાં ઉઠમણામાં ભરાયલામાંથી રૂ૮૦, શેઠ હોરમસજી રૂશતમજી ઉમરીગરે મરહુમ બેટી આવાંબાઇ પી. મહેતાનાં પુણ માટે રૂ૫૦, શેઠ પીરોજશા નશરવાનજી મહેતાએ મરહુમ ધણીયાણી આવાંબાઇના ઉઠમણામાં ભરાયલામાંથી રૂ૧૦૧ અને શેઠ મનાજી હીરજીભાઇ કડવાએ રૂ૧૦૦ આપ્યા હતા. આ ફંડની આવકમાંથી નવસારી મલેસર ફલીઆનાં ગરીબ પારસીઓને, અનાજ કપડા, સ્કુલ ફી, લગન તથા મરણ ખરચ વીગેરે માટે મદદ આપવામાં આવે છે, તેમજ છોકરીઓને અંગ્રેજી બાશાનું ગ્નાન આપવા માટે વરગો કાઢવામાં આવયા છે તેમાં માસીક મદદ આપવામાં આવે છે અને મુકતાદ ટાંકણે હંમેશ મુજબ ગરીબોને અનાજ વહેંચવામાં આવે છે.

હોંગકોંગવાલા મરહુમ શેઠ હોરમસજી નશરવાનજી કુપરનાં પારસી ગરીબોને મદદ કરવાનાં ધરમ ખાતાંના ત્રસ્ટીઓ લેફ્ટનંટ કરનલ ડા૦ મેરવાનજી પે. ખરેગાટ, શેઠ બરજોરજી કા. કુપર અને શેઠ મેરવાનજી કા. કુપર તરફથી પારસી ગરલ્સ સ્કુલ એસોસીએશનને રૂ૮૦૦, એમબયુલનસ બ્રીગેડ પારસી ડીવીઝનને રૂ૫૦૦ અને સર જમશેદજી સ્કુલના ભોજન ફંડમાં રૂ૩૩૬ મલી રૂ૧૬૩૬ આપવામાં આવયા હતા.

મરહુમ એરવદ એદલજી બરજોરજી મુલ્લાંએ પોતાની પુંજીમાંથી રૂ૬૦૦૦૦ ની રકમ ધરમ ખાતે આપી ગયા છે, અને તેને જરથોસતી અંજુમનનું બેહતરી ફંડ નામ આપી જાહેર માટે ખુલ્લું રાખયું છે. આ ફંડમાથી નીચલા ધરમખાતાઓ વગેરેને મદદ આપવામાં આવી હતી, તેમાં મુંબઇ વીગેરેની કોલેજના ૨૨ વીદયાર્થીઓની તેમજ નવસારીની સ્કુલોના ૭૦ પારસી વીદયાર્થીઓની ફી તથા ચોપડીઓ અપાવી તે માટે કોલેજની ફીના રૂ૨૨૦૦ તથા ચોપડીના રૂ૫૦૦ અને

સ્કુલની ફીના રૂ૧૨૦૦ તથા ચોપડીના રૂ૫૦૦ આપયા હતા. મરહુમ મુલ્લાજીનાં નામનો અવસ્તં પેહલવીનો સુનાંનો ચાંદ મી૦ અરદેશર નશરવાંનજી બીલીઆને આપ્યો હતો. આ ધરમખાતું શરૂ થયા પછી મદદ મેલવી શીખેલા છોકરાઓમાંથી આ સાલે એક બી. એ., એક બી. એસ. સી. અને એક એમ. બી. બી. એસ.ની પરીક્ષામાં પાસ થયા છે. ઇનફ્લુએનઝાના હુમલા વખતે ગરીબ જરથોસતીઓને દવાદારૂ વગેરે મુફ્ત પુરૂં પાડવા રૂ૧૦૦૦, મોઘવારીનાં સબબે નવસારીમાં ગરીબ જરથોસતીઓ માટે સસતા અનાજની દુકાંન ખોલવા રૂ૧૦૦૦, તેમજ ૧૧ ગરીબ જરથોસતીઓને લગન પ્રસંગે તથા ૧૮ ને મરણ ક્રીયાનાં ખરચ માટે રૂ૭૨૦ અને બે ગરીબ જરથોસતી બાળકોની નવજોત કરી આપી હતી. આગમા સપડાયલાંઓને રૂ૩૬૦, અને મુકતાદ ટાકણે ગરીબ જરથોસતીઓમાં રૂ૮૦૦ વેહચવામાં આવ્યા હતા. નવસારીની દાયુવાલી હાસપીટલમાં ચાર બેડ નીભાવવામાં આવે છે અને મલેસરની છોકરીઓ માટેના અંગ્રેજી કલાસને રૂ૨૦૦ તેમજ ભરૂચની દસ્તુર કામદીનવાલી અગીઆરીને તથા રાજકોટની દરેહમેહરના નીભાવ ફંડમાં દર વરસે મદદ આપવામાં આવે છે. આ ધરમખાતામાં સરઅવસરે રૂ૭૭૮ ભરાયા હતા. આ ધરમખાતાંનો ડીસેમબર ૧૯૧૮ સુધીનાં છેલ્લાં ત્રણ વરસનો હીસાબ છપાવી બાહાર પાડવામાં આવ્યો છે.

જરથોસ્તી અંજુમનનાં આતશબેહેરાંમ સાહેબની ૨૨ મી સાલગ્રહને દીવસે રોજ ૩ જો માહા ૨ જો ૧૨૮૭ થી તે રોજ ૨ જો માહા ૨ જો ૧૨૮૮ સુધીનો બાર માસના વંચાયલા રીપોરટમાં જણાવવામાં આવ્યું હતું કે શેઠ જાહાંગીર ફરામજી લેનટીને આગળ ઇલેકટ્રીક લાઇટો મુકાવી હતી તેમાં હમણા રૂ૨૦૦૦ નો ખરચ કરી સુધારો વધારો કરી આપ્યો છે તેમજ શેઠ અરદેશર શાપુરજી નારીયલવાળાએ લગભગ રૂ૬૩૦૦ ના ખરચે નવા ચંદરવા બંદગીવાળા હોલમાં શીલીંગની નીચે મુકાવ્યા છે. બાજ રોજગારની ક્રીયા કરાવવા માટે ખાતા પડાવી શેઠ રૂસ્તમજી ડોશાભાઈ મારફતે રૂ૨૦૦૦ અને મરહુમ ડાકટર (લેફ્ટનંટ) દારાબશાહ રૂશતમજી ખરાશના પુણ્ય સારૂ માતાજી દીનબાઇએ રૂ૭૦૦ આપ્યા; નીભાવ ફંડમાં મરહુમ બાઇ નવાજબાઇ તે શેઠ હો. લી. ગોરખપુરવાલાનાં ધણીઆણીના પુણ્ય સારૂ શેઠ હોરમસજી લી. ગોરખપુરવાલાએ ખાતું પડાવી રૂ૫૦૦, શેઠ નાદરશાહ દારાબશાહ પતેલે મરહુમ માતાજી પીરોજમાઇના ઉઠમણામાં ભરાએલામાંથી રૂ૧૩૫, બાઈ દીનબાઇ દી. કરાણીએ મરહુમ શેઠ દીનશાજી ડો. કરાણીના ઉઠમણામાં ભરાયલામાંથી રૂ૧૦૧, શેઠ બાપુજી હોરમસજી સકલાતવાળા રૂ૧૦૧, શેઠ ખરશેદજી દાદાભાઇ ભાવનગરીએ મરહુમ બાઈ ભીખાઇજી ખ. મોદીના પુણ્ય માટે. રૂ૧૦૦, શેઠ ફરામજી હોરમશજી આલબ્લેશ તથા બાઇ માણેકબાઇ ૫. આલબ્લેસે મરહુમ બાઇ મેહેરબાઇ હો. આલબ્લેસના પુણ્ય સારૂ રૂ૧૦૦, બાઇ ધનમાય ફ. અરજાનીએ ખાવીંદ ફરામજીનાં ઉઠમણામાં ભરાએલામાંથી રૂ૧૦૦, શેઠ જમશેદજી ભીખાજી પંથકી રૂ૧૦૦ અને પરચુટણ રકમોના રૂ૨૫૭; સુધારા વધારાના ફંડમાં ધર્મની પેટીઓમાંથી રૂ૫૧૫–૨, કારોબાર મંડળીના એક શેઠે મરહુમ માતાજી કુવરબાઇની યાદમાં રૂ૫૦૦, શેઠ બાપુજી હોરમસજી સકલાતવાળા રૂ૧૦૧, શેઠ જમશેદજી ભીખાજી પંથકી રૂ૧૦૦, અને પરચુટન રકમોના રૂ૭૦; શેઠ દાદાભાઇ ન. કનતરાકટર હોલની ઓઇલપેન્ટીંગ માટે દસતુરજી મીનોચહેરજી જામાસપજી પાસેથી હોલમાં માંડેલી મુકતાદની જુદી ટેબલ તથા બેહેરાં ઉપરનો લવાજમનાં ૧૨૮૬ નાં બાકી રૂ૨૨–૮ તથા ૧૨૮૭ નાં રૂ૩૫૮–૮ મળી રૂ૩૮૧ અને ભાપણો માટેની રજાનાં તથા ઇલેકત્રીક લાઇટનાં તથા જુનો સામન વીગેરે વેચ્યો તેનાં મલી રૂ૧૫૭ મલ્યા હતા.

જરથોસ્તી અનજુમનનાં આતશબેહેરામ સાહેબના નીભાવ ફંડમાં ભરાયલા રૂ૫૦૩૦ માની મુખ્ય રકમોઃ—શેઠ નાનાભાઈ જીવનજી કંત્રાકટર રૂ૨૦૦૦, લેડી પીરોજબાઈ શા. ભરૂચાએ બાઇ નવાજબાઇ ના. ભરૂચાના પુણ્ય માટે રૂ૫૦૦, એક જરથોસ્તી રૂ૫૦૦, શેઠ ફરામજી પેસતનજી બીલીમોરીઆ રૂ૧૦૦, શેઠ જાંગીરજી ધ. કનતરાકતર રૂ૧૦૦૧, શેઠ બાપુજી હો. સકળાતવાળા રૂ૧૦૧, બાઈ ધનમાય ફ. અરજાની રૂ૧૦૦, શેઠ જમશેદજી બી. પંથકી રૂ૧૦૦, અને શેઠ પીરોજશાહ ન. પેચે ધણીઆણી બાઇજીની પુંજીમાંથી રૂ૧૦૦.

એરવદ સોરાબજી હોરમજી રાનજીની દરેહેમહેરમાં હોલ બાંધવાનાં ફંડમાં ભરાયલા રૂ૩૭૧૨ માની મુખ્ય રકમોઃ—શેઠ દાદાભાઇ દી. અપુએ મરહુમ ધણીયાણી રતનબાઇની યાદમાં રૂ૧૦૦૦, શેઠ પીરોજબાઇ શા. ભરૂચાએ મરહુમ નવાજબાઇ ના. ભરૂચાનાં ઉઠમણામાં ભરેલી રૂ૫૦૦ની લોન, શેઠ નાનાભાઇ ખરશેદજી ભરૂચાએ ધણીયાણી નવાજબાઇનાં ઉઠમણામાં ભરેલા રૂ૨૦૦, શેઠ સોરાબજી એદલજી રાનજીએ માતાજી કુંવરબાઇનાં ઉઠમણામાં ભરેલા રૂ૧૦૧, બાઇ તેહેમીના સોરાબજી રાનજીએ મરહુમ સાસુજી કુંવરબાઇનાં ઉઠમણામાં રૂ૧૦૧ અને શેઠ નશરવાનજી માણેકજી ગણદેવીયા રૂ૧૦૧.

સુરત આતશ દાદગાં ફંડમાં ભરાયલા રૂ૨૯૨૪ માની મુખ્ય રકમોઃ—બાઇ ખરશેદબાઇ નાદરશાહ ચેરીટેબલ ફંડના ત્રસ્ટીઓએ બ્યાજના રૂ૨૦૦, મરહુમ શેઠ અસપંદયાર રૂશતમ ઇરાનીની યાદમાં કુટુંબે રૂ૧૨૦, શેઠ નાદરશાહ રૂશતમજી મેહેતા રૂ૧૦૦, શેઠ ફ. બે. કલેકટર રૂ૨૦૪ અને શેઠ પી. રૂ. મેહતા રૂ૧૨૦.

ઝાહ બોરડીની દરેહમહેરના નીભાવ ફંડમાં બાઇ બા. ફ. કો. તરફથી મરહુમ શેઠ સોરાબજી ફરામજી કેમેસરીયેટવાળાના પુણ માટે રૂ૫૦૧, જરથોસ્તી રૂ૧૦૧, ૧૨૮૭ના મુકતાદ ટાંકણે ઉઘરાવેલા રૂ૧૭૧, બાઇ જરબાઈ પે. ચોકસીએ મરહુમ બાઇ ખરશેદજી પે. ચોકસીના પુણ સારૂ રૂ૧૦૦ ની લોન, શેઠ કાવસજી નાનાભાઈ સકલાતવાળા તથા બાઇ મોતીબાઇ કા. સકલાતવાળાએ મરહુમ બાવાજી તથા માતાજીના પુણ માટે રૂ૧૦૨, શેઠ મેહેરજીભાઇ રતનજી એડનવાળાએ રૂ૧૦૦ની વેરલોન આપી હતી. જયારે રૂ૧૦૦ ની અંદરની કેટલીક પરચુટણ રકમો મલી હતી.

દવીએરની દરેહમેહેરનાં નીભાવ ફંડમાં ભરાયલા રૂ૧૪૦૮—૧૨ માની મુખ્ય રકમોઃ— શેઠ રૂસતમજી અરદેશર વાડીયાએ મરહુમ બાઇ આદરજીના તથા મરહુમ બાઇ શીરીનબાઇ આદરજી વાડીયાના પુણ માટે રૂ૩૦૦, આ ફંડના નાણાંનું વીયાજ રૂ૨૭૮, મરહુમ શેઠ ખરશેદજી જ. પટેલના પુણ માટે સ્થાપેલાં ધરમખાતાંમાંથી રૂ૧૫૧, મરહુમ શેઠ કુંવરજી હોરમસજી લાકડીયાના ઉઠમણામાં ભરાયલામાંથી રૂ૧૪૩, મરહુમ શેઠ ફરામજી કા. મારકરના સ્થાપેલા ધરમખાતાંમાંથી રૂ૧૨૫, શેઠ એદલજી દા. સુખીઆ રૂ૧૦૧, અને મરહુમ બાઇ માણેકજી મોટાવરાના ઉઠમણામાં ભરાયલામાંથી રૂ૧૭૬—૮. આ ફંડમાં કુલે રૂ૧૨૮૯૮—૧૨ ભરાયા છે.

તારાપોરની દરેહમેહરના મોબેદને પગાર આપવાનાં ફંડમાં ભરાયલા રૂ૩૪૩૨—૪ માની મુખ્ય રકમોઃ—બાઇ હીરાબાઈ જ. પીટીટ રૂ૨૦૧, બાઇ બચુબાઇ મે. સો. જમશેદજી રૂ૧૦૧, શેઠ ફરામજી મનચેરજી કામાએ સ્થાપેલા આતશબેહરામના ધરમખાતામાંથી રૂ૩૦૦, શેઠો કાવશજી દીનશાહ ને બાઈઓ રૂ૧૦૦, શેઠ પેસતનજી નવરોજી કાપડયા રૂ૧૦૧, શેઠ રતનજી સોરાબજી કંત્રાકટર રૂ૧૦૧, શેઠો ગગરાટ મારકરની કં. રૂ૧૦૧, શેઠ બી. એફ. જાલનેવાલા રૂ૧૦૧, શેઠ એન. એમ. વાહાડીયાના ત્રસ્ટીઓ રૂ૫૦૦, શેઠ દીનશાહ સી. કુપર રૂ૩૫૧—૪-૦, શેઠ પાલનજી એદલજી રૂ૧૦૧ અને શેઠ એદલજી હીરજીભાઇ તારાપોરવાળાના ઉઠમણામાં ભરાયલા રૂ૧૮૩. આ ફંડમાં કુલે રૂ૧૦૦૮૧—૪—૦ ભરાયા છે.

નવસારીની વડી દરેહમેહેરને તાબેના બગરીઆ સાથના મોબેદોના ધંધાર તથા ધરમખાતાંના ફંડમાં ભરાયલા રૂ૨૫૦૦ ના બોંડ અને રૂ૧૬૩ રોકડા માની મુખ્ય રકમોઃ— શેઠ નાનાભાઇ જીવનજી કંત્રાકટરે રૂ૨૦૦૦ના બોંડ, શેઠ બમનશા જામારપજી જંબુસરવાલા રૂ૫૦૦, શેઠ પીરોજશાહ કુવરજી મીસ્રીએ રૂ૫૦૦ ની વેર લોન, બાઇ ધનમાએ ફરામજી અરજાણી રૂ૩૦૦, મરહુમ શેઠ નાનાભાઇ ધનજીભાઇ બનાજીના પુણ સારૂ રૂ૧૦૧, શેઠો મેરવાનજી નવરોજી ગોભાઇની કં. રૂ૧૦૧, શેઠ બેહેરામ ખોદાદાદ ઇરાની રૂ૧૦૧, શેઠ અરદેશર શા. નારીયલવાળાએ ધણીયાણી મેહેરબાઇ તથા માતાજી વીરબાઇજીના પુણ માટે રૂ૧૫૧, શેઠ મનચેરજી ફ. ખાને મરહુમ શેઠો દીન-

સાહજી તથા ફરામજી બી. ખાનના પુણ માટે રૂ૧૦૧, શેઠ ફરામજી ધ. કાપડયા રૂ૧૦૦ અને શેઠ કુવરજી ન. મેહતા રૂ૧૦૦. આ ફંડમાં નોટ તથા બોંડ રૂ૧૮૧૦૦ના તથા રૂ૮૨૪૦ રોકડા ભરાયા છે.

ભરૂચની કોટની કાંઠાની પુરાણી દરેમેહરનું મકાન બાંધવા માટે ઉઘાડેલાં ફંડમાં શેઠ નાનુ ન. ભરૂચા રૂ૧૦૦૧, શેઠ રૂસતમજી ડી. પટેલ રૂ૨૫૧, શેઠ અરદેશર સો. પટેલ રૂ૧૦૦, શેઠ પેસતનજી ફકીરજીએ મરહુમ બાવા ફકીરજીના પુણ માટે મકાન ખરીડવા રૂ૩૦૦ અને બીજી રકમો ભરાઇ હતી. એ ઉપરાંત બાઇ રતનબાઇ અરદેશર દસ્તુરે એ દરેહમેહરની પડોશનું એવણનું ઘર ભેટ આપ્યું હતું.

રાજકોટની દરેમહેરને મલેલા રૂ૪૭૧૩–૮ માની મુખ્ય રકમો:—બાઇ હીરાંબાઈ જ. પીટીટ તથા બાઇ બચુબાઈ મે. શો. જમશેદજી રૂ૫૦૦, શેઠ જહાંગીરશાહ કુંવરજી કાયાજી રૂ૧૦૦, શેઠ પેસ્તનજી મેહરવાનજી કરંજીઆ રૂ૧૦૦, શેઠો હોરમશજી કાવશજી દીનશાહ એડનવાલા અને બાઈઓ રૂ૧૦૦૦, શેઠ દીનશાહજી બમનજી વકીલ રૂ૫૦૦, શેઠ ન. મા. વાડીઆના ટરસટીઓ રૂ૧૫૦૦, શેઠ બેહરામશાહ કેરબાદજી ઇલાવીઆ રૂ૧૦૦, એડનના જરથોસ્તીઓ રૂ૧૩૮–૮, ભાવનગરના જરથોસતીઓ રૂ૨૧૦ અને શેઠ પેસતનજી દીનશાહજી પંડોલ રૂ૨૦૦. આ અગીયારીનું નીભાવ ફંડ પુરતું નહી હોવાથી રાજકોટના જરથોસતીઓ તરફથી દર માસે લગભગ રૂ૬૦ ભરવામાં આવે છે.

લાહોરની બાઇ આવાંબાઇ કુપરની દરેહમેહરના નીભાવ ફંડમાં ભરાયલા રૂ૬૮૪ માંની મુખ્ય રકમો:—શેઠ દીનશાહ બેરામજી મેહતાએ મરહુમ દીકરી ગુલચેહરની યાદમાં રૂ૧૦૭ તથા થોડાક વાસનો, મરહુમ શેઠ શાવકશાહ ફરામજીનાં પુણ માટે શેઠ અરદેશર જાહાંગીર બોગાએ રૂ૧૦૧ અને શેઠ બમનજી ડોશાભાઈ આલબલેસે રૂ૩૦૦ ની લોન.

દેવલાલીની બાઇ રતનબાઇ ચીનાઇની દરેહમહેરના ફંડમાં મરહુમ બાઇ દીનબાઇ ડોશાભાઇ મારકરના પુણ માટે રૂ૧૦૦ ની સાડા ત્રન ટકાની લોન અને પરચુટણ રકમો મલી કુલે રૂ૨૧૫ ભરાયા હતા.

બમનજી દીનશાહ પીટીટ પારસી જનરલ હાસપીટલનાં ફંડમાં ભરાયલા ગયા વરસના ઈતિખાબમાં છપાયલા રૂ૨૯૮૫૬૧૫ પછી આ વરસમાં એ ફંડમાં બીજા વધુ રૂ૬૧૩૬૫૮–૮–૧૦ ભરાયા હતા, તે મલી કુલે રૂ૩૫૯૯૨૭૩–૮–૧૦ નું ફંડ થયું છે તેમાં આ વરસમાં ભરાયલી નીચલી મુખ્ય રકમો:—હાસપીટલનું મકાન લશકરી સતાવાલાઓએ લીધુ તેના ભાડાની રકમમાંથી હાસપીટલને બીજી જગયાએ ખસેડવાનો ખરચ બાદ કરવા પછી રહેલી રકમ રૂ૫૮૧૩૩૦–૮–૧૦, શેઠ ધનજીશાહ હો. મેહતાએ બાઇ સુનાબાઇ બ. મેહતાના ઉઠમણામાં ભરેલા રૂ૨૫૦, શેઠો દાદાભાઇ પેસતનજીની કં. રૂ૨૫૦, શેઠો દાદાભાઇ, જાહાંગીર, કેખશરૂ, હોરમજી અને બેરામજી એમ. કોલાહએ માતાજી ગુલબાઇ મ. કોલાહની યાદમાં (નીભાવ ફંડમાં) રૂ૧૦૦૦, શેઠ હીરાજી કે. કોલાહ રૂ૧૫૦, બાઇ ડોશીબાઇ નાનાભાઇ બીમડીવાલાએ સાસુ પુતલીબાઇ હો. બીમડીવાલાના ઉઠમણામાં ભરેલા રૂ૧૦૦, બાઈ માણેકબાઈ શાપુરજી કપાવાળાના ચેરીતી ટરસ્ટના ટરસ્ટીઓ રૂ૩૨૯૩, પારસી બાનુ (નીભાવ ફંડમાં) રૂ૧૦૦૦, ડા૦ હોમી એ. ટોપલીઆ રૂ૧૦૧, બાઇ રતનબાઇ નશરવાનજી મીસ્રીએ માતાજી નવાજબાઈના ઉઠમણામાં ભરેલા રૂ૧૦૦, બાઈ બચુબાઇ મેરવાનજી બાટલીવાલાએ દીકરી રતનબાઇ રૂસતમજી પારખની યાદમાં (નીભાવ ફંડમાં) રૂ૫૦૦, હાસપીટલની પેટીમાંથી રૂ૧૩૭, શેઠો નાનુ એન. બરજોરજી, બજોરજી એન. બરજોરજી, રૂસતમજી એન. બરજોરજી અને કેપટન બમનજી એન. બરજોરજીએ માતપીતા નવરોજી બરજોરજી અને બચુબાઇ ન. બરજોરજીની યાદમાં રૂ૫૦૦૦, બાઇ કુંવરબાઇ મનચેરજી દુબાશ (નીભાવ ફંડમાં) રૂ૧૦૦૦, બાઈ અરનવાઝ એરચ એનજીનીયરે મરહુમ પીતા નશરવાનજી રૂ. ચોકસીની યાદમાં (નીભાવ ફંડમાં) રૂ૫૦૦, ડુંગરવાડીની પેટીમાંથી રૂ૨૦૨, શેઠો બાઇસની કં. રૂ૧૦૦, શેઠ સોરાબ એન. ગામડયા ને બાઇ દીના એચ. એમ. મેહતાના લગનની ખુશાલીમાં મીત્રે રૂ૧૦૧,

શેઠ પાલનજી પેસતનજી વાધલા કુપરના ઉઠમણામાં બાઇ નશરવાનજીએ ભરેલા રૂ૧૦૦
જહાંગીર શાપુરજી ગઝદરે પીતા શાપુરજી અને માતાજી રતનબાઈની યાદમાં (નીભાવ ફ
રૂ૫૫૦૦, શેઠ બેરામજી નવરોજી ગામડયાએ મરહુમ પીતાજી નવરોજીની યાદમાં (ન
ફંડમાં) રૂ૫૦૦૦ શેઠ જેહાંગીર બમનજી પીટીટે મરહુમ બાઇ હમાબાઈ ફરામજી કામા તે મ
સર દી. મા. પીટીટ પેહલા બેરોનેટના દીકરીના ઉઠમણામાં ભરેલા (નીભાવ ફંડમાં) રૂ૧૦૦૦,
ખરસેદજી દોરાબજી પાંડે અને કુટુંબે મરહુમ બાઇ હમાબાઇ ફરામજી કામાની યાદમાં (ન
ફંડમાં) રૂ૫૦૦, મરહુમ શેઠ કેખશરૂ બરજોરજી લીંબુવાલાની યાદમાં (નીભાવ ફંડ
રૂ૫૦૦, બાઇ શીરીનબાઇ કાવસજી મહેતાએ બેટા મનચેરશાહના લગનની ખુશાલીમાં
માતા આવાંબાઇની યાદમાં (નીભાવ ફંડમાં) રૂ૫૦૦ અને મરહુમ શેઠ દાદાભાઇ એ
આલબલેસના ચેરીતી ત્રસ્ટના ત્રસ્ટીઓ રૂ૩૦૯.

ડા૦ મારીનાની હાસપીટાલના ચાલુ ફંડમાં ભરાયલા રૂ૩૮૭૫૧ માની મુખ્ય રકમો:—
રૂ૧૫૧, મરહુમ માતા વીરબાઇજી અને પીતા દીનશાહજીના પુણ માટે શેઠ માણેકજી દી. મા
રૂ૧૨૫, શેઠ અરદેશર શા. નારીયલવાલા રૂ૧૦૦, રીમપથી રૂ૧૦૦, ધ. બ. તા. રૂ૧૦૦,
રૂ૧૦૦, વકીલ રૂ૧૦૧, મરહુમ શેઠ હોરમજી લોરડની યાદમાં કુટુંબે રૂ૧૦૧, જર દોલી રૂ
કલકતાના જરથોસ્તી રૂ૩૦૦, મરહુમ શેઠ ફરદુનજી પેસતનજી જાલનેવાલાની યાદમાં ધણી
પીરોજબાઈએ રૂ૧૦૦, રોજંદી મનસનીના પુસ્તકના વેચાણના ઉપજેલામાંથી શેઠ દી. મે. ઇરા
રૂ૩૦૦, જરથોસ્તી રૂ૨૦૧, મરહુમ શેઠ સોરાબજી પે. શાહના ઉઠમણામાં ભરાયલા રૂ૧૦૨, મ
માતાજી બચુબાઇ ન. બોઇસની યાદમાં રૂ૧૦૧, ભાણેજ એમી. જે. કોલાહની યાદમાં રૂ૧
મરહુમ દીકરી ચાંદનબાઈ જાહાંગીર કોલાબેવાલાની યાદમાં રૂ૧૦૧, શેઠો દાદાભાઇ પેસતન
પેઢી રૂ૨૦૦, મરહુમ બાઇ સુનાબાઇ ધનજીશાહ મેહતાના ઉઠમણામાં ભરાયલામાંથી રૂ૨
શેઠો રતનજી જાહાંગીરની કં. રૂ૫૦૧, એ ભાગયા રૂ૧૦૧, ઇનફ્લુએનઝાના દરદીઓ સારૂ ખ
રૂ૧૦૧, પી. એ. સી. રૂ૧૦૦, સોડાવાટરના કારખાનાવાલા જરથોસ્તી રૂ૫૦૦, શેઠો મેરવ
તથા હોરમજી કામાની પેઢી રૂ૨૫૦, બજાર ગેટના વેપારીઓ રૂ૫૦૧, જરથોસ્તી રૂ૫૦૦, મ
કાકાજી ફરામજી પે. વાધલા કુપરના પુણ માટે બાઇ દીનબાઇ હી. કુપરે રૂ૧૦૧, શેઠ બેરા
કરંજીયા રૂ૨૫૦, શેઠો મે. ન. ગોભાઇની પેઢી રૂ૧૨૫, દીકરો તથા દીકરી સારા થયાં તેની ખુશા
રૂ૧૫૧, મરહુમ પીતાજી હોરમજી નાનાભાઇ મીસતરીના ઉઠમણામાં દીકરા દારબશાહે રૂ૧
રેશમી કાપડની પેહેડી રૂ૧૫૧, મરહુમ શેઠ ખરશેદજી રૂશતમજી મોદીના પુણ માટે રૂ૧
જરથોસ્તી રૂ૧૨૦, મરહુમ બાઇ જરબાઇ નવરોજી ભાયાના પુણ માટે રૂ૧૦૦, તબીબ રૂ૨૦૦,
તરફથી રૂ૧૦૦૦, જરથોસ્તી રૂ૧૫૦, મરહુમ શેઠ નાનાભાઇ પેસતનજી ભરૂચાના પુણ માટે રૂ૧
મરહુમ શેઠ ખુરશેદજી ખરસેદજી રીરવાઇના ઉઠમણામાં કાકા માણેકજી તથા કાકી મેહરબા
ભરેલા રૂ૨૫૧, અથોરનાન રૂ૧૦૧, બાનુ રૂ૧૦૦, અથોરનાન રૂ૨૫૦, તબીબ રૂ૧૦૧, મરહુમ
આવાબાઇ કા. અરજાણીના ઉઠમણામાં ભરાયલા રૂ૧૦૦, જરથોસ્તી બાનું રૂ૧૨૦, માતા
યાદમાં રૂ૧૦૦, માતપીતા ફરામરોઝ તથા સુનાબાઈ ફ. જોશીની ગોલદન જુબીલીની ખુશા
દીકરી તથા જમાઇ મોબેદજી રૂ૧૦૧, મરહુમ શેઠ ફરામજી બમનજી દાવરની નઇયતે રૂ૧
અથોરનાન રૂ૧૦૦, નનામાં મોકલેલા રૂ૨૦૦, પી. રૂશતમજી પોચખાનાવાલા રૂ૧૮૦, જરથ
બાનું રૂ૧૦૦, જરથોસ્તી રૂ૧૦૦, શેઠ એમ. આર. પટેલ રૂ૧૦૦, શેઠ જાહાંગીરજી મ. મા
ધણીયાણી શીરીનબાઇની યાદમાં રૂ૨૦૦, ધણી ધણીયાણી રૂ૨૫૦, જરથોસ્તી રૂ૧૫૦,
રૂશતમજી તથા નશરવાનજી ના. બોઇસે મરહુમ બાઇ સુનાબાઇ સો. વોરડનના પુણ માટે રૂ૧
સોલીસીટર રૂ૩૦૦, મરહુમ બાઇ આઇમાય શોરાબજી પાતરાવાળાના ઉઠમણામાં ભરાયલા રૂ૧
મરહુમ બાઇ આવાંબાઇ પીરોશાહ ન. મહેતાના ઉઠમણામાં ભરાયલામાંથી રૂ૬૧૨, મરહુમ

કુપાવાળાના ધરમખાતાના ત્રસ્તીઓ રૂ૧૬૪૬-૧૨, મરહુમ શેઠ બરજોરજી પેસતનજીની યાદમાં કુટુંબે રૂ૬૪૪-૨, હાસપીટાલનાં દરદીઓ રૂ૩૨૮-૮, કોલંબોનો વેપારી રૂ૧૦૧, મરહુમ મમાવાની યાદમાં રૂ૧૦૧, લવ તરફથી રૂ૧૦૦૦, શેહેનગાહીની અંજુમનના ફંડમાંથી રૂ૫૦૦, મરહુમ શેઠ આદરજી રતનજી સુતરીયાના પુણ્ય માટે રૂ૧૦૫, મરહુમ બાઇ પુતલીબાઇ હોરમજી બીવડી-વાલાના ઉઠમણામાં ભરાયલામાંથી રૂ૨૫૨, મરહુમ ડા૦ કાવશ ખ. લાલકાકાની યાદમાં રૂ૧૨૫, શેઠ હોરમઝીયાર મહીયાર ધાટકુપરવાલા રૂ૧૦૦, મરહુમ શેઠ પાલનજી પે. વાધલા કુપરના ઉઠમણામાં ભરાયલા રૂ૩૦૦, જરથોસ્તી રૂ૩૦૦, શેઠ રસીડ જમશેદ ઇરાની રૂ૧૦૧, મરહુમ શેઠ બરજોરજી પેસતનજીની યાદમાં છોકરાઓએ રૂ૧૦૧, રેશમી કાપડના વેપારી રૂ૧૦૦૦, ભાણેજ ફરામરોજ કેખશરૂ મારકરના પુણ્ય માટે રૂશતમજી ૫. બહાદુરજીએ રૂ૧૦૦, મરહુમ શેઠ સોરાબજી હોરમજી તરફથી મરહુમ દીકરા હોરમજીના પુણ્ય માટે રૂ૨૦૧, મરહુમ બાઇ ગાય જહાંગીર ઘોડાના ઉઠમણામાં ભરાયલામાંથી રૂ૩૦૦, મરહુમ શેઠ સોરાબજી મા. શેઠનાના ધરમખાતાંનાં ત્રસ્ટીઓ રૂ૧૦૦૦, જર-થોસ્તી આરકીટેકટ રૂ૩૦૦, અશોફરોહરની યાદમાં રૂ૨૦૧, મરહુમ શેઠ ધનજીભાઇ ફ. કંત્રાકટરના પુણ્ય માટે રૂ૧૫૦, કેપટન કાવશજી ઉકરજી રૂ૨૦૦, ધાંધલ ધડબડ કીધા વગર કામનું ભલું કરનાર જરથોસ્તીએ સપટેમબર ૧૯૧૮થી આગસ્ટ ૧૯૧૯ સુધીના રૂ૬૦૦૦, મરહુમ શેઠ કાવશજી દીનશાહ એડનવાલા સી. આઇ. ઇ.ના છોકરાઓએ સપટેમબર ૧૯૧૮થી જુલાઇ ૧૯૧૯ સુધી રૂ૧૧૦૦, લાહોરના જરથોસ્તી વેપારીએ ઓગસ્ટ ૧૯૧૯થી જુલાઇ ૧૯૨૦ સુધી રૂ૩૦૦, જરથોસ્તી ગ્રહસ્થે ગજવામા દાબરો રાખી એકઠા કરેલા રૂ૧૧૪૯ અને મેડાઝ સ્ત્રીટના જરથોસ્તી ગ્રહસ્થે દાબરો રાખી એકઠા કરેલા રૂ૧૧૨.

ડા૦ માસીનાની હાસપીટલના એંડાઉમેંટ ફંડમાં ભરાયલા રૂ૫૩૩૭૩ માંની મુખ્ય રકમો:—જરથોસતી કાપડના વેપારીએ ધણીયાણીને નામે સ્થાપેલાં ફંડમાં રૂ૨૦૦ ની લોન, મરહુમ શેઠ સોરાબજી જમશેદજી ગોપીયાના વસીયતનામાના એકઝીકયુટરોએ રૂ૩૩૭-૪, દીકરી મેહરબાઇ બે. દેશાઇની યાદમાં માતાજી ગુલબાઇ ૨. કાતરક રૂ૨૦૦, મરહુમ બાવાજી ડોશાભાઇ અરદેશર દોરડીની યાદમાં દીકરા અરદેશરે રૂ૨૦૦૦ ની લોન, મરહુમ શેઠ ખરશેદજી રૂસતમજી મોદીના પુણ્ય માટે રૂ૫૦૦ ના વોર બોંડ, મરહુમ શેઠ માણેકજી રૂસતમજી મીસતરીના પુણ્ય માટે રૂ૨૫૦, મરહુમ બાઇ તેહમીના માણેકજી મીસતરીના પુણ્ય માટે રૂ૨૫૦, શેઠ સોરાબજી પેસતનજી શાહના પુણ્ય માટે જરથોસતીએ રૂ૫૦૦ની લોન, દોસ્તના દીકરાના લગનની ખુશાલીમાં રૂ૧૦૦૦, મરહુમ બાઇની યાદમાં રૂ૨૦૦, મરહુમ માતાજી બાઇજી જહાંગીરજી મરઝબાનની યાદમાં દીકરી જરબાઇએ રૂ૩૦૦, મર-હુમ બાઇ જરબાઇ નશરવાનજી મે. પટેલના પુણ્ય માટે ધણીએ રૂ૫૦૦, બેટી હીરાંબાઇએ રૂ૫૦૦ અને બેટા પીરોશાહે રૂ૫૦૦ મલી રૂ૧૫૦૦, મરહુમ શેઠ ખુર્જેસતા ખરશેદજી સીરવાઇની યાદમાં જેપાનીસ એંડ શેંગાહી સીલક પીસ ગુડસ એસોસીએશને રૂ૫૦૧, મરહુમ બાઇ ગુલબાઇ મનચેરજી કોલાના માસીસાને દીને ધણી ડા૦ મનચેરજી રૂ૧૦૦૦, દીકરા હોરમજી રૂ૫૦૦ અને વહુ શીરીનબાઇ હોરમજીએ રૂ૫૦૦ મલી રૂ૨૦૦૦ ની લોન, તથા બાઇ ગુલબાઇની યાદમાં દીકરા બેરામજી તથા વહુ તેહમીનાએ રૂ૫૦૦, મરહુમ બાઇ રતનબાઇ રૂશતમજી પારખના પુણ્ય માટે બાઇ બચુબાઇ રૂ. પારખે રૂ૫૦૦, મરહુમ શેઠ કેખશરૂ બરજોરજી લીંબુવાલાના ઉઠમણામા ભરાયલા રૂ૧૦૦૦, મર-હુમ મામા નવરોજી કાવશજી શાહેરના ઉઠમણામાં શેઠ જહાંગીર ન. ગામડયા તથા ધણીયાણી પુટલીબાઇએ રૂ૬૦૦, મરહુમ બાઇ દીનબાઇ કાવશજી બે. પટેલની યાદમાં કુટુંબે રૂ૧૦૦૦ ની લોન આપી કે આગલ પડાવેલા રૂ૩૦૦૦ ના મરહુમના ખાતામાં ઉમેરી રૂ૪૦૦૦ નું બ્યાજ વાપરવું, માતાજી સુનાબાઇની યાદમાં દીકરાએ રૂ૧૦૦૧, મરહુમ શેઠ પેસતનજી ફરામજી શરાફના પુણ્ય માટે બેટીઓએ રૂ૬૦૦૦ ના પોરટ ત્રસ્ટ બોંડ, મરહુમ બાઇ નવાજબાઇ દાદાભાઇ તે મરહુમ શેઠ જમશેદજી ફ. ફયોકના બેટીના ઉઠમણામાં ભરાયલા રૂ૧૨૦૦, મરહુમ બાઇ આવાંબાઇ મીરોશ.હુ

ન. મેહતા તે શેઠ હોરમજી રૂ. ઉમરીગરની દીકરીના ઉઠમણામાં ભરાયલામાંથી રૂ૧૦૦૦૦ બીછાનું સ્થાપવા, મરહુમ બાઇ જરબાઇ નશરવાનજી પટેલની યાદમાં સ્થાપેલા ફંડમાં રૂ૧૦૦, મરહુમ ધણી શાપુરજી સોરાબજી મીસતરીની યાદમાં બાઇ જાઇજીએ રૂ૫૦૦૦. જરથોસતી રૂ૨૦૦૦, મરહુમ શેઠ હોરમજી ધનજીભાઇ પાજનીગરાની યાદમાં દીકરા ડોશાભાઇએ રૂ૭૦૦૦, મરહુમ બાઇ રતનબાઇની યાદમાં સ્થાપેલાં ફંડમાં રૂ૧૦૦૦ ની લોન, મરહુમ ધણી અરદેશર મંચેરજી મોદીના ઉઠમણામાં ભરાયલામાંથી રૂ૨૧૦૦ ની લોન, મરહુમ બાઇ આઇમાય રૂશતમજી કંટરાકટરના ઉઠમણામાં ભરાયલા માંથી રૂ૧૦૦૦ ની લોન, મરહુમ બાઇ વીરબાઇજી શાપુરજી કાટરકની યાદમાં સ્થાપેલા ફંડમાં રૂ૧૦૦, દીકરા રૂશતમ બાપુજી સફરવાલાની યાદમાં માત પીતાએ રૂ૨૦૦, દીકરા હોમી પી. ચીચગરની યાદમાં સ્થાપેલા ફંડમાં શેઠ પીરોશાહ મે. ચીચગરે રૂ૧૦૦, મરહુમ શેઠ દીનશાહ હોરમજી ગાંધીના ઉઠમણામાં ભાઈ માણેકશાહ તથા કુટુંબે ભરેલા રૂ૧૫૦૦ ની લોન, માતા સુનાબાઇની યાદમાં દીકરાએ મરહુમને નામે સ્થાપેલાં ફંડમાં રૂ૧૦૦૦ નું બોંડ અને મરહુમ શેઠ ફરામરોજ કેખશરૂ ડો. મારકરના ઉઠમણામાં ભરાયલી રૂ૫૦૦ ની વોર લોન.

ડા૦ માસીનાની હોસપીટલના બીલડીંગ ફંડમાં મરહુમ શેઠ ફરામજી હોરમજી અરજાની જેવણુ રોજ ૩૦-૧૦-૧૨૮૭ ને દીને બેહેસતનશીન થયા તેઓના પુણ માટે ઉઠમણા મધે ભરાયલા રૂ૫૦૦૦ ની રકમ આપી છે કે એમાંથી મરહુમનાં નામનો એક બલોક બીમારો માટે અથવા હોસપીટલને લગતાં કોઇ બીજા ઉપયોગી કામ માટે હોસપીટલના કમપાઉંડમાં બાંધવો અને મરહુમના નામની તખતી મારવી અને મરહુમ દીકરી નવાજબાઇ તે શેઠ જીવાજી સો. અંકલેસરીઆના બેટીના પુણ માટે તેવણુના બાવાજીએ મરહુમના નામના સ્થાપેલા વોરડમાં વધુ રૂ૫૦૦ આપ્યા હતા.

ડા૦ માસીના હાસપીટલના આઇસોલેસન બલોકના પુરાંત ખરચ માટે ભરાયલા રૂ૩૬૪૨, માની મુખ્ય રકમો:—દીકરો અદી સારો થયો તેની ખુશાલીમાં આલાં પી. મેહતાએ રૂ૫૦૦, જરથોસતી રૂ૫૦૦, મરહુમ શેઠ ખુજેસતા ખરશેદજી સીરવાઇના ઉઠમણામાં ખેસીઓએ ભરેલા રૂ૫૦૧, તથા શેઠ ફરામજી દીનશાહ લામ અને ધણીયાણીએ ભરેલા રૂ૨૦૧, જરથોસતી રૂ૨૨૬, સીમપથી રૂ૩૦૦, શેઠ ફ. પે. મેહતા વમબાર કલબના ફંડમાંથી રૂ૫૦૦, બાનુ રૂ૧૦૧, શેઠ નાદીરશાહ હીરજી બારીયા રૂ૨૦૧ અને દીકરી રતાંમાયની લગનની ખુશાલીમાં રૂ૨૫૧.

મુંબઇની પારસી પંચાયત હસતક ઇનફ્લુએનઝાની બીમારી માટે ઉઘાડવામાં આવેલી પારસી ફીવર હોસપીટલના ફંડમાં ભરાયલા રૂ૨૬૧૯૨-૬ માની મુખ્ય રકમો:—શેઠ પીરોજશાહ રૂ. વખારીઆ રૂ૫૦૦, શેઠ કાવસજી દા. દુબાશ રૂ૨૫૦, C. H. C. રૂ૧૦૦, શેઠો મેરવાનજી એંડ સનસ રૂ૧૦૦, શેઠ ન. જાં. વહાડીઆ ચેરીટી ફંડના ત્રસ્ટી ડા૦ સર તેમુલજી ભી. નરીમાન રૂ૧૦૦૦, શેઠ ન. મા. વાડીઆના ત્રસટીઓ રૂ૨૦૦૦, B. & D. રૂ૧૦૦, H. & P. રૂ૧૦૦, શેઠો સોરાબજી પેસતનજીની કં. રૂ૧૦૦, માયજી તથા બાવાજીની યાદમાં દીકરીએ રૂ૧૦૦૦, માયજી તથા બાવાજીની યાદમાં દીકરાએ રૂ૧૦૦૦, શેઠ નશરવાનજી ર. નરીમાન રૂ૧૦૦, શેઠ જાંગીરજી બેજનજી કાંગા રૂ૧૦૦, શેઠ રૂસતમજી એસ. પાઉંવાલા રૂ૨૫૦, શેઠ કાવશાહ એસ. પાઉંવાલા રૂ૨૫૦, H. P. P. રૂ૧૦૦, મરહુમ માત પીતાને નામે બેટા એ. એસ. પાંડે રૂ૧૦૧, વેપારી રૂ૧૫૦, પારસી બોટીંગ કલબ રૂ૧૦૦, શેઠો બી. એફ. દાવરની કં. રૂ૧૦૦, શેઠ અ. હો. વાહાડયાના ચેરીટી ફંડમાંથી રૂ૫૦૦, બાવાજી તથા માતાજીની યાદમાં રૂ૧૦૦, શેઠ જાંગીર ન. ગામડયા અને બાઇ પુતલીબાઇ જા. ગામડયા રૂ૧૦૦, શેઠ ફીરોઝ ખ. શેઠના રૂ૧૦૧, શેઠ સો. મા. શેઠનાના ધરમખાતામાંથી રૂ૩૦૦, ધણીની યાદમાં રૂ૫૦૧, બાવાજી માયજી તથા ભાઇ જમશેદજીની યાદમાં રૂ૩૦૩, શેઠ કે. જે. કુપર રૂ૧૦૦, મરહુમ શેઠ ફરામજી હો. અરજાનીના પુણ માટે ધણીયાણી ધનમાય રૂ૨૦૦, શેઠ નવરોજી નશરવાનજી ભેદવાર રૂ૧૦૧, બેન જીજુબાઇની યાદમાં રૂ૧૦૦, શેઠો દીનશાજી તથા ફરામજી ભી. ખાનના છોકરાઓ રૂ૨૫૧, શેઠો ખરશેદજી બમનજીની કં. રૂ૨૫૦,

શેઠ રૂસતમજી મનચેરજી રૂ૧૦૦, શેઠ જાહાંગીર અસપંદીયાર ઇરાની રૂ૧૦૧, પારસી બાઇ રૂ૨૦૦, શેઠ મીનોચેર અ. વકીલ રૂ૧૦૦, બાઇ સુનાબાઇ મીનોચેર વકીલ રૂ૨૦૦, જરથોસતી રૂ૨૦૦, મરહુમ મમાવા સોરાબજી મા. દમણવાલાની યાદમાં દીકરા શાવકશાએ રૂ૧૦૦, શેઠ ખુશરો રૂ૧૫૦, બાનુ રૂ૧૦૦, જરથોસતી હારીસ રૂ૫૦૧, શેઠ દા. મા. વાચ્છાના ધરમખાતાના ટરસટીઓ રૂ૧૦૦, બાઇ સુનાબાઇ ધ. મેહતાના ઉઠમણામાં ભરાયલામાંથી રૂ૨૫૦, શેઠો ફરદુનજી ખ. મોદી એંડ સનસ રૂ૧૫૦, બાઇ શીરીનબાઇ દી. મોદીની યાદમાં બાઇ ડા૦ ફરામજી એ. દાવરે રૂ૧૦૦, મરહુમ શેઠ બરજોરજી પેસતનજીની યાદમાં રૂ૧૦૧, શેઠ પીરોશાહ ધ. આલબલેસના પુણ માટે ત્રસટીઓએ રૂ૨૦૧, શેઠ એદલજી ફ. આલબલેસના છોકરાઓ રૂ૨૦૧, શેઠ નવરોજી કાવશજી મેહતા રૂ૧૦૦, શેઠો મેરવાનજી ને હોરમજી મ. કામા રૂ૨૫૦, બાઇ રતનબાઈ કે. મોદીએ માતાજી મેહરબાઇ હો. આલબલેસના ઉઠમણામાં ભરેલા રૂ૧૦૦, શેઠ મેરવાનજી મ. બનાજી રૂ૨૦૦, મુરંબીઓની યાદમાં રૂ૧૦૦, જરથોસતી બાનું રૂ૧૦૦, પારસી કુટુંબમાં એકઠા થયલા રૂ૧૨૭, જરથોસતીએ દીકરા તથા દીકરી સારાં થયાં તેની ખુશાલીમાં રૂ૧૫૧, હાસપીટલની પેટીમાંથી રૂ૩૧૭, જરથોસતી ગ્રહસથ ને બાનુ રૂ૨૦૦, બાઈ તેહમીના સો. એનજીનીયરના ઉઠમણામાં ભરાયલામાંથી રૂ૨૭૫, બાઇ આવાંબાઇના પુણ માટે દીકરા સોરાબજીએ રૂ૧૦૦, મરહુમ શેઠ મનચેરશાહ હો. ચટણીવાલાના પુણ માટે માતાજી રતનબાઇએ રૂ૯૦૦, મરહુમ બાઈ બાનુબાઈ હો. ચટણીવાલાના પુણ માટે માતાજી રતનબાઈએ રૂ૯૦૦, શેહેંગાહી અનજુમનના કારોબારીઓ રૂ૧૭૫૦, રોયલ આરક ચેપટર રાઇઝીંગ સ્ટાર ઓફ ડબલ્યુ. આઇ. ના ૧૨૪ એસ. સી. રૂ૧૫૦, શેહેંગાહીની અનજુમનના ધરમ ફંડમાંથી રૂ૫૦૦, શેઠ માણેકજી કા. પીટીટ રૂ૧૦૦૦, શેઠ હોરમજી નવરોજી વેસુના રૂ૧૦૧, શેઠ હોરમજી માણેકજી મેહતા રૂ૧૦૦, મરહુમ શેઠ બાપુજી રૂશતમજી દીવેચાના પુણ માટે ભાણેજ અરદેશર જ. મીસતરીએ રૂ૧૦૧, શેઠ પા. પે. વાછલા કુપરના ઉઠમણામાં વહુ દીનબાઇ હી. કુપરે રૂ૧૦૦, મરહુમ શેઠ પોંચાજી શાપુરજી પોંચાજીની યાદમાં રૂ૧૦૦, મરહુમ માતાજી જાઇજીના પુણ માટે બાઇ પીરોજબાઇ ન. ભેદવારે રૂ૧૦૦ અને મરહુમ બાઇ હીરજીભાઈ માણેકજીશેઠનાની યાદમાં બાઈ જાઈજી ધ. શેઠનાએ રૂ૩૦૦.

ડા૦ કેરાંવાળા હાસપીટાલ ચેરીટી બોરડ ફંડમાં ભરાયલાં રૂ૮૫૬૨ માની મુખ્ય રકમો:— રોજીંદી મનસનીના પુસ્તકના વેચાણના ઉપજેલામાંથી શેઠ દી. મે. ઇરાનીએ રૂ૩૦૦, મરહુમ શેઠ પીરોશાહ દાદાભાઇ ભેદવારના પુણ માટે ધણીયાણી શીરીનબાઇએ રૂ૧૦૦૦, તથા બાઇ બેનોએ રૂ૨૫૦, દીકરી શેહરાની નવજોતની ખુશાલીમાં ૧૦૦, શેઠ જાહાંગીર મનચેરજી માસતરે ધણીયાણી શીરીનબાઇની યાદમાં રૂ૨૦૦૦ ની લોન, શેઠ ન. મા. વાહાડીયાના ત્રસ્ટીઓ રૂ૩૦૦, જરથોસ્તી રૂ૫૦૦, મરહુમ બાઇ સુનાબાઇ સોરાબજી વોરદનના પુણ માટે બેહેનોએ રૂ૧૦૦૦ની લોન, બાઇ મેહરબાઇ દીનશા અપુએ મરહુમ વહુ રતનબાઈના પુણ માટે વ્યાજ વાપરવા રૂ૫૦૦, બેન માણેકબાઇની યાદમાં બાઇ ગુલબાનુ ડોશાભાઇ સુનાવાલાએ રૂ૧૦૦, શેઠ નવરોજી બાપુજી તચકરા રૂ૧૨૦, મરહુમ શેઠ આદરજી બ. શરાફના પુણ માટે એકઝીકયુટરોએ રૂ૨૦૦, મરહુમ શેઠ એદલજી ન. દુબાશની પુંજીમાંથી રૂ૫૦૦, તથા મરહુમના મામા રૂશતમજીએ રૂ૫૦, શેઠ બનાજીના આતશબહેરામની પેટીમાંથી રૂ૨૭૩, શેઠ વાહાદયાજીના આતશબેહરામની પેટીમાંથી રૂ૨૦૫ અને બી. એ. બી. રૂ૨૦૦.

ડા૦ પારખવાલી હાસપીટલના ચેરીટી બોરડ ફંડમાં ભરાયલા રૂ૮૪૮૪ માની મુખ્ય રકમો:— મરહુમ બાઇ ધનબાઇ સોરાબજી પાતરાંવાલાના ઉઠમણામાં ભરાયલામાંથી રૂ૩૦૦૦, બુચીની વરસગાંઠની ખુશાલીમાં પારસી બાનુએ રૂ૧૦૧, દીકરા ખરશેદની યાદમાં શેઠ જાહાંગીર સો. પટેલ ને ધણીયાણીએ રૂ૧૦૧, ખેતવાડીના જરથોસ્તી કુટુંબે તથા ડા૦ ઉમરીગરે રૂ૫૦૦, મરહુમ શેઠ ખરશેદજી મે. બાલીવાલા તથા બાઇ કુવરબાઇની યાદમાં બાઇ મેહરબાઇ જ. મેહતા

શેઠ શાવકશા ખ. બાલીવાલાએ રૂ૧૦૧, ફ્રેનડસ યુનીયનના મેમબરો રૂ૫૦૦, શેઠ હોરમજી દા. એદનવાલાએ ઝોરાસ્ત્રીયન બીલડીંગના શેરનું વ્યાજ રૂ૧૬૦, શેઠ બરજોરજી પેસતનજી રૂ૪૫૩-૮, શેઠ અ. હો. વહાડયાના ત્રસ્ટીઓ રૂ૩૦૦, શેઠ ન. મા. વહાડયાના ત્રસ્તીઓ રૂ૩૦૦, શેઠો મનચેરજી બેહરામજીની કં. રૂ૬૪૫-૪ અને હોસ્પીટલની પેટીમાંથી રૂ૩૦૩-૧૨-૩.

નવસારીની રતનજી ફ. દાબુ પારસી જનરલ હાસપીટલ ફંડમાં તા૦ ૩૧ મી જુલાઇ સુધી ભરાયલા રૂ૭૯૬૪ માની મુખ્ય રકમો:—મરહુમ બાઈ ધનબાઇજી પેસુતન ર. દાબુનાં ઉઠમણામાં ભરાયલા વ્યાજ વાપરવા રૂ૧૫૦૦, બાઇ પીરોજબાઇ સો. પુનેવાલાએ મરહુમ દીકરી આઇમાયના પુણ્ય માટે વ્યાજ વાપરવા રૂ૫૦૦, શેઠ નસરવાનજી પે. વાગલા કુપરે મરહુમ ભાઇ પાલનજીના પુણ્ય માટે રૂ૫૦૦ ની લોન, મરહુમ એદલજી બ. મુલાંએ સ્થાપેલાં અંજુમન બેહેતરી ફંડનાં સેકરેટરી દેશાઇ બેરામજી મનચેરજીએ ચાર બેડ નીભાવવાનાં ખરચનાં ૧૯૧૮નાં રૂ૪૮૦, મરહુમ શેઠ રતનજી ફરામજી દાબુનાં છોકરાઓએ ધનોરી ગામની ભેટ આપેલી જમીનના ૧૯૧૯નાં ગણોતનાં રૂ૧૦૦૦, શેઠ ન. મા. વાડીઆના ત્રસ્તીઓએ સપટેમબર ૧૯૧૮થી જુલાઇ ૧૯૧૯ સુધીનાં રૂ૧૬૫૦, શેઠ રૂસતમજી જમશેદજી ધમોદીવાલા રૂ૧૦૧, શેઠ નવરોજી એ. બંધારપાડેવાલા રૂ૧૦૧, શેઠ ફરામરોજ ડોસાભાઇ મેહેતા રૂ૧૫૧, શેઠ બરજોરજી રૂસતમજી જોખી રૂ૧૦૧, શેઠ ખરશેદજી બે. સઢીઆરે મરહુમ માતાજી તથા બાવાજીને નામનાં સ્થાપેલાં બેડની અનામત રકમનાં ૧૯૧૯નાં વ્યાજનાં રૂ૧૦૫, શેઠ બરજોરજી કુંવરજી મેહોરા રૂ૧૦૧, શેઠ પેસતનજી એદલજી જોખી રૂ૧૦૧, શેઠ અરદેસર બમનજી દેસાઇ તથા બેશીઓએ બાઇ વીરબાઇજી બ. દેસાઇનાં ઉઠમણામાં ભરેલા રૂ૧૦૦, મરહુમ શેઠ સાપુરજી એ. દોરડી હા. શેઠ ના. સા. દોરડી રૂ૧૦૧, શેઠ કાવશજી પાલનજી જોખી રૂ૧૦૧, શેઠો બરજોરજી અને કુંવરજી બુવારીવાલા રૂ૧૦૧, અને શેઠ પેસતનજી બ. જોખી રૂ૧૦૧.

સુરતની રૂસતમજી ધનજીભાઇ તારાચંદ પારસી જનરલ હાસપીટલનાં ફંડમાં ભરાયલા રૂ૧૦૮૯૪ માંની મુખ્ય રકમો:—શેઠ નવરોજી બમનજી વકીલ રૂ૫૦૦, શેઠ ધનજીભાઇ ફરામજી કંટરાકટર રૂ૧૫૦૦, શેઠો નશરવાનજી અરદેશર તથા ફરામજી રૂસતમજી દલાલ રૂ૧૦૦૦, ખા૦ બા૦ બરજોરજી નો. વકીલ રૂ૨૦૨, મરહુમ શેઠ બરજોરજી મા. પટેલનાં બેશીઓ રૂ૧૦૦૦, શેઠ કા. ખ. સુનાવાલા રૂ૧૦૦, મરહુમ શેઠ દાદી પીરોજશાહ પટેલના દોસ્તો રૂ૬૦૦, શેઠ પાલણજી દા. ચવના રૂ૫૮૦૦ અને શેઠ કાવશાહ ખરશેદજી સુનાવાલા રૂ૧૦૦.

ડા૦ સર ટેમુલજી નરીમાન હસ્તકના પારસી સુવાડખાનાના ફંડમાં તા૦ ૬૨ મી આગસ્ટ સુધી ભરાયલા રૂ૬૦૪૬ માની મુખ્ય રકમો:—શેઠ જમશેદજી અરદેસર વાડીઆએ રૂ૧૫૦૦ ના ૪ ટકાના મ્યુનીશીપાલ બોંડ વ્યાજ વાપરવા, શેઠ શાવકશા પેસતનજી મા. મુંજીઆજી રૂ૧૦૦૦, શેઠ અરદેશર બરજોરજી લીમ્બુંવાળા રૂ૫૦૦, બાઇ જરબાઇ ન. વાડીઆએ ગરીબ બાઈઓના આપેલા લવાજમના રૂ૩૯૦, બાઇ શીરીનબાઇ રતનશા સીગનપોરીઆ રૂ૧૦૧, શેઠેગાંહીની જરથોસ્તી અંજુમન ફંડમાંથી રૂ૩૦૦, બાઇ બાનુબાઇ કેખશરૂ મ. શેઠ રૂ૨૦૧, બાઇ સુનાબાઈ બરજોરજી પાવરી રૂ૨૦૦, શેઠ હોરમજી માણેકજી મેહેતા રૂ૨૦૦, શેઠ સોરાબજી દા. પટેલ રૂ૧૫૧, બાઇ પીરોજબાઇ ફરામજી થુથીએ રૂ૧૦૦ ની સાડા ત્રણ ટકાની લોન, શેઠ જમશેદ ખોદાદાદ ઇરાની રૂ૩૦૧, બાઇ રતનબાઇ દો. વાડીઆની નઇયતે બેસી તરફથી રૂ૧૦૦, બાઇ જાઇજી ધનજીભાઇ શેઠના તથા બાઈ ધનબાઈ દાદાભાઇ ફરબારી રૂ૧૦૦, બાઈ આઇમાય મે. ચમારબાગવાળા રૂ૧૦૦, શેઠ રૂસ્તમજી નાનાભાઇ રાણીના રૂ૧૦૦, શેઠ મંચેરશા ફ્રસમજી ખાન રૂ૧૦૦, અને બ.ઇ નાલીબાઇ નશરવાનજી કુપર રૂ૧૦૦.

સુરતની બાઇ ગુલબાઇ નશરવાનજી મેહતા પારસી મેટરનીટી હોસ્પીટલ ફંડમાં ભરાયલા રૂ૧૯૧૬૮ માંની મુખ્ય રકમો:—શેઠ નવરોજી બમનજી વકીલ રૂ૧૦૦૦, શેઠો કાવશજી એન્ડ સન્સ રૂ૧૦૦૧, શેઠ બમનજી ફરામજી વાણીઆ રૂ૫૦૦, શેઠ ધનજીભાઈ ફરામજી કંટરાકટર રૂ૧૫૦૦,

। નશરવાનજી અરદેશરે તથા ફ્રામજી રૂસતમજી દલાલ રૂ૧૨૦૦, શેઠ નવરોજી પે. કંટ્રાકટર ૨૦૦, ખા૦ બા૦ નશરવાનજી ર. મેહતા રૂ૫૦૦૦, શેઠો માણેકશાહ તથા રૂસતમજી મંચેરજી .ફ્રામના રૂ૧૦૦૦, સર શાપુરજી બ. ભરૂચા રૂ૫૦૦૦, ખા૦ બા૦ બરજોરજી નોશરવાનજી ાલ રૂ૨૦૨, શેઠ પાલણજી ધનજીભાઇ પટેલ રૂ૧૦૦૦, શેઠ એદલજી હો. તાડીવાલા રૂ૧૦૦ અને ધનજીશાહ માણેકજી મરચંટ રૂ૧૦૦.

નવસારીના દોરાબજી ના. મેહેતા પારસી સુવાવડખાનામાં ભરાયલા રૂ૧૦૮૪૩ માંની મુખ્ય મોઃ—બાઇ દીનબાઇ દી. કરાંણીએ મરહુમ શેઠ દીનશાહજી ડો. કરાંણીના ઉઠમણામાં ભરેલા ૦૧, શેઠ રૂસતમજી મનચેરજી મોટાફ્રામે ધણીઆણી પીરોજાનાં ઉઠમણામાં ભરેલા રૂ૧૦૧, .વડ એદલજી બ. મુલ્લાંનાં ધરમખાતામાંથી એક ગરીબ બાઇની મુફ્ત સારવાર માટે વ્યાજ :રથા રૂ૩૦૦૦, સુવાવડખાનાની પેટીમાંથી રૂ૧૭૫, મરહુમ શેઠ પીરોજશાહ હો. મેહેતા તથા ાીઆણી નાજામાયના ઉઠમણામાં ભરાયલાં રૂ૬૦૦, શેઠ એન. એમ. વાડીઆના ત્રસ્તીઓ રૂ૫૦૦, કાવશજી માણેકજી રૂસ્તમજી રૂ૧૦૧, અને મરહુમ શેઠ એદલજી જમશેદજી ખોરીના એકઝીક્યુ- .એ મરહુમના નામના બે બીછાના સ્થાપવા માટે રૂ૫૦૦૦.

સુરત પાસે આવેલાં સીગનપોર ગામમાં એક ધરમનું દવાખાનું ઉઘાડવા માટેના ફંડમાં સીઓના ભરાયલા રૂ૬૩૬૦ માંની મુખ્ય રકમોઃ—શેઠો કાવશજી દીનશાહ ને બાઇઓ રૂ૫૦૦, રતનજી પેશતનજી પટેલ રૂ૧૦૦, શેઠ નાનાભાઇ ખેરામજી ઝવેરી રૂ૨૫૧, શેઠ અરદેશર પેસતનજી ઙ રૂ૧૫૧, બાઇ ધનબાઇ અ. પટેલ રૂ૧૨૫, શેઠ જમશેદજી જાહાંગીર લાલા રૂ૧૦૧, શેઠ એદલજી રજી પટેલ રૂ૫૦૧, બાઈ કુવરબાઈ એદલજી પટેલ રૂ૫૦૧, શેઠ બમનજી માણેકજી પટેલ રૂ૧૦૧, પેસતનજી કુવરજી પટેલ રૂ૧૦૧, બાઇ ગુલબાઇ દોરાબજી પટેલ રૂ૧૦૧, પાક અશો રહોની ાનુંદી માટે ફરજ તરફથી રૂ૫૦૧, જરથોસતી રૂ૫૦૧, શેઠ પીરોશાહ સોરાબજી દારૂવાલા ૨૫, મરહુમ શેઠ ખરશેદજી ર. પટેલના ઉઠમણામાં ભરાયલા રૂ૧૧૦, બાઇ પીરોજબાઇ મા. .આવાના ઉઠમણામાં ભરાયલા રૂ૩૬૨ અને શેઠ ગુસતાદજી મેરવાનજી ફકીરજીના ઉઠમણામાં ાયલા રૂ૨૨૦.

લેડી વીલીંગડન વાલી સ્કીમને લગતી હાસપીટલ ફંડમાં પારસીઓના ભરાયલા રૂ૧૫૦૦ ાી મુખ્ય રકમોઃ—શેઠ સી. એન. વાહાડીયા રૂ૧૦૦૦, અને શેઠ જે. બી. પીટીટ ને ધણીયાણી ૫૦. આ ફંડમાં બધી જ્ઞાતના મલી રૂ૧૩૯૧૮૮ ભરાયા હતા.

કીંગ જોરજ ધી ફીફ્થ એનટીટયુબર કયુલોસી લીંગના ફંડમાં પારસીઓના ભરાયલા ૯૫૦ માંની મુખ્ય રકમોઃ— શેઠ એફ. ઇ. દીનશાહ રૂ૧૦૦૦, બાઇ જરબાઇ એન. વાહાડીયા ૦૦, શેઠ ડી. એફ. બાટલીવાલા રૂ૧૦૦, પારસી બાનુ રૂ૧૦૦, શેઠ એન. એન. વાહાડયા રૂ૧૦૦ ા ડા૦ કે. પી. મોદી તથા ધણીયાણી રૂ૧૦૦.

ધરમપોરના ખડીના સેનેટરીયમને લગતુ એક કોટેજ બાંધવા માટે શેઠ એદલજી કાવશજી શેઠ- ે મરહુમ શેઠ સોરાબજી એ. શેઠનાની યાદમાં રૂ૫૦૦૦ આપ્યા છે; એ ઉપરાંત એ સેનેટરીયમના માં પારસીઓ તરફથી રૂ૩૮૫૦ ભરાયા હતા, તેમાં સઘલી કોમના દરદીઓના નીભાવ માટે ૮૦૦, જનરલ ફંડમાં પરચુંટન રકમો મલી રૂ૧૪૫૦ અને પારસી દરદીઓના નીભાવ માટે પર- ન રકમો મલી રૂ૬૦૦ ભરાયા હતા તેમાં શેઠ ડેનગાડીની જરથોસ્તી અંજુમનના રૂ૩૦૦ મુખ્ય હતા.

બાઇ શીરીનબાઇ મનચેરજી કામા હસ્તકના વાંદરેના કોનવેલેસંટ હોમના બીલડીંગ ફંડમાં ૨૪ મી આગસ્ટ સુધી ભરાયલાં રૂ૨૬૫૦૦ માં બાઇ દોશીબાઈ પેશતનજી પટેલે મરહુમ ાજી મહેરવાંનજી બે. પાલીશવાળાનાં પુણ્ય માટે રૂ૩૦૦૦, શેઠ રૂશતમજી ધનજીભાઇ પટેલ ૦૦૦, બાઇ રતનબાઇ એ. બામજીએ મરહુમ સર રતનજી જ. તાતાની યાદમાં રૂ૧૦૦૦, એક થોસ્તી રૂ૫૦૦, બાઈ માણેકબાઇ પીરોજશાહ બ. જીજીભાઈ રૂ૩૦૦, બાઈ મહેરબાઈ જીજીબાઇ

મોદી રૂ૧૦૦, મરહુમ શેઠ શોરાબજી એદલજી વાછાનાં પુણ માટે રૂ૧૦૦, બાઇ હમાબાઈ ફરાંમજી કામા રૂ૫૦૦, બાઇ જરબાઇ ન. વાહડયા રૂ૨૦૦૦, મરહુમ પીતાજી તથા માતાજીનાં પુણ માટે D. C. T. રૂ૧૦૦૦, P. S. M. રૂ૫૦૦, બાઇ જીજુબાઇ ફરાંમજી વાહડયાએ મરહુમ બાવાજી તથા માતાજીનાં પુણ માટે રૂ૫૦૦, મરહુમ ભાઇ જાંહગીરજી તથા બહેન રતનબાઇનાં પુણ માટે જરથોસ્તી બાનુંએ રૂ૧૦૦૦, શેઠ માણેકજી કાવશજી પીટીટ રૂ૫૦૦, શેઠ મહેરવાંનજી મનચેરજી કામા રૂ૨૦૦૦, શેઠ હોરમશજી મનચેરજી કામાનાં બેટાઓ રૂ૫૦૦, સર સાપુરજી બરજોરજી ભરૂચાએ રૂ૧૦૦૦ના ૫ા ટકાનાં વોર બોંડ અને બાઇ ગુલબાઇ બમનજી પીટીટ રૂ૨૦૦૦.

બાઇ શીરીનબાઇ મનચેરજી કામા હસતકના વાંદરેના કોનવોલેસંટ હોમના ફંડમાં તા૦ ૨૪ મી આગસટ સુધી બીછાનાના નીભાવ માટે મલેલા રૂ૩૦૦૦ માં બાઇ હીરાંબાઈ જમશેદજી પીટીટ મરહુમ બાવાજી સર દીનશાહ મા. પીટીટ પહેલા બેરોનેટના પુણશારૂ ૧૨ માસનાં રૂ૩૬૦, બાઇ બચુબાઇ મેહરવાનજી સોરાબજીએ મરહુમ માતાજી લેડી શાકરબાઇ દીનશાહ પીટીટના પુણસારૂ ૧૨ માસનાં રૂ૩૬૦, સર દોરાબજી જમશેદજી તાતાએ ૧૨ માસનાં રૂ૩૬૦, શેઠ મહેરવાનજી મ. કામાં તથા મરહુમ શેઠ હોરમસજી મ. કામાનાં બેટાઓએ ૧૨ માસનાં રૂ૩૬૦, મરહુમ શેઠ હોરમજી મ. કામાંના ધરમ ફંડનાં ત્રસ્તીઓએ સપટેમ્બર ૧૯૧૮ થી એપ્રીલ ૧૯૧૯ સુધી રૂ૨૪૦, "Sympathy" તરફથી ૧૨ માસના રૂ૩૬૦, એક જરથોસ્તી બાઇએ મરહુમ બાઇ હમાબાઈ ફ. કામાનાં પુણ સારૂ રૂ૩૬૦, મરહુમ બાઇ પીરોજબાઇ ધનજીભાઇ મામાના ધરમ ફંડના ત્રસ્તીઓએ ઓગસટ ૧૯૧૮ થી જાનેવારી ૧૯૧૯ સુધી એક બીછાણાનાં તથા ફેબરવારીથી જુલાઇ ૧૯૧૯ સુધી બે બીછાણાં માટે રૂ૫૪૦ અને બાઇ રતનબાઇ સો. શેઠનાંના ધણીનાં ધરમ ફંડનાં ત્રસ્તીઓએ નવેમબરથી દીસેમબર ૧૯૧૮નાં રૂ૬૦; જેનરલ ફંડમાં ભરાયલા રૂ૩૩૪૮-૫ માંની મુખ્ય રકમો:- શેઠ દોરાબજી ખરશેદજી શરાફ રૂ૫૦૦, કોલંબોનાં જરથોસ્તી વેપારી રૂ૧૦૦, બાઇ શીરીનબાઇ મનચેરજી ડો. કામા રૂ૨૬૦, મરહુમ શેઠ કેખશરૂ હોરમશજી પટેલની યાદમાં તેવોનાં એક કુટુંબીએ રૂ૨૦૦, બાઇ મેહેરબાઇ નાનાભાઇ મુશ રૂ૨૦૦, શેઠ પોહોંચાજી શાપુરજી પોહોંચાની યાદમાં રૂ૨૦૦, શેહેંગાહીની જરથોસ્તી અંજુમનના ત્રસ્તીઓ રૂ૩૦૦, મરહુમ શેઠ દીનશાહજી હો. ગાંધીના ઉઠમણામાં બેશીઓએ ભરેલા રૂ૧૦૦ અને મીસીસ એસ. બી. મેહતા રૂ૧૦૦.

બાઇ શીરીનબાઈ કામાનાં કોનવોલેશંટ હોમનાં એંડાઉમેંટ ફંડમાં વ્યાજ વાપરવાની શરતે ભરાયલા રૂ૪૦૦૦ માં શેઠ રૂસતમજી સોરાબજી કંટરાકટરે ધણીઆણી કુંવરબાઇનાં પુણ શારૂ રૂ૫૦૦ ની ૩ા ટકાની લોન, કરનલ કાવશજી હોરમસજી મીસ્ત્રીએ ધણીઆણી આવાંબાઇનાં પુણ સારૂ રૂ૫૦૦ ના ટકા ૫ નાં વોર બોંડ અને એક જરથોસ્તી ગ્રહસથે રૂ૩૦૦૦ રોકડા આપયા કે ૩ા ટકાની રૂ૪૦૦૦ ની સરકારી લોનમાં રોકવા.

બાઇ શીરીનબાઈ કામાના ઇનડશત્રીઅલ ફંડમાં શેઠ રૂશતમજી હોરમજી પાટકે બાઇ શાપુરજી હો. પાટકની યાદમાં હુનરની તથા ધર સંસારની કેળવણી આપવા માટે રૂ૧૦૦૦૦ ના વોર બાંડ ટકા ૫ ના આપ્યા હતા, આ ખાતાંની શરત એ છે કે ઉપલા બોંડનું જે વ્યાજ દર સાલ ઉપજે તેમાંથી વ્યાજનો ૯/૧૦ મો ભાગ શેઠ રૂશતમજીને તેવોની જીંદગી સુધી આપવો અને બાકીનો ૧/૧૦ મો ભાગ ઇનડસ્ત્રીઅલ ફંડનાં ચાલુ ખરચમાં વાપરવો અને એવો શેઠની હઇઆતી બાદ એવોના કરેલાં ત્રસતનાં કરાર પ્રમાણે અમલ કરવો એટલે કે બધું વ્યાજ ઉપલાં ફંડનાં ચાલુ ખરચમાં વાપરવું; એ ઉપરાંત આ ઇનડસ્ત્રીયલ ફંડમાં ચાલુ ખરચમાં મરહુમ બાઇ માણેકબાઇ જાંહગીરજી વાછાનાં ધરમ ફંડનાં ત્રસ્તીઓ શેઠ જાંહગીરજી મનચેરજી કોહલા તથા બીજાઓ તરફથી જુન ૧૯૧૮ થી દીસેમબર ૧૯૧૯ સુધીનાં અઢાર માસનાં રૂ૯૦૦ આપ્યા હતા.

દેવલાલીના દખમાં તથા ધરમ ક્રીયાના ફંડમાં ભરાયલા રૂ૨૪૮૧ માની મુખ્ય રકમો:—બાઇ દીનબાઇ જાં. શરાફ, બાઇ જરબાઇ જાં. શરાફ, શેઠ જમશેદજી જાં. શરાફ, શેઠ માણેકશાહ જાં.

શેરાહ અને બાઇ આઇમાય રૂ. ગોટલાના પુણ માટે ખેશીઓએ રૂ૧૯૦ ની લોન, મરહુમ શેઠ ધનજીભાઇ ફરામજી કંટરાકટરનાં પુણ માટે હોરમજી તથા બાનુબાઇ અને તેહમીના તરફથી રૂ૬૦૩, દેવલાલીના બંગલાવાલાઓ તથા રહીશો તરફથી રૂ૮૭૩ અને દેવલાલીમાં આવેલા વીઝીટરો તરફથી રૂ૪૮૧.

લાનોલીના દખમાં ફંડમાં ભરાયલા રૂ૪૮૨-૬ માની મુખ્ય રકમો:—શેઠ રૂસતમજી દોરાબજી દી. એડનવાલા મારફતે શેઠો કાવશજી દીનશાહ અને ભાઇઓ તરફથી દખમાંની શગડીનાં નીભાવ માટે તથા ચેરાગ મુકવા રૂ૧૨૦, મરહુમ શેઠ કેખશરૂ બ. લીંબુવાલાનાં ઉઠમણામાં ભરાયલા રૂ૫૦ અને લાનોલીનાં જરથોસ્તીઓ રૂ૨૬૭-૬.

લાનોલીના રવાનોને અવલમંજલ પોહચાડવાના ફંડમાં ભરાયલા રૂ૫૭૮ માની મુખ્ય રકમો:—શેઠ મનચેરજી પા. કનતરાકટર રૂ૫૧, મરહુમ શેઠ પાલણજી ર. કનતરાકટરનાં પુણ માટે રૂ૫૧, ન્યુ ઇગલીશ પ્રેસના માલેકો રૂ૬૦, શેઠ રૂસતમજી સોરાબજી કનતરાકટરે મરહુમ ધણીઆણી કુંવરબાઇનાં પુણ માટે રૂ૨૦૦ ની લોન અને બાઇ સનાબાઇ દી. તારાપોરવાલાએ ધણી દીનશાહજીના પુણ માટે રૂ૭૫.

રાજકોટનાં દુખમાં ફંડમાં ભરાયલા રૂ૨૬૭૮-૮ માની મુખ્ય રકમો:—શેઠ દીનશાહજી બહમનજી વકીલ રૂ૫૦૦, શેઠ ન. મા. વાડીઆના ટરસટીઓ રૂ૧૫૦૦, શેઠ પેસતનજી દીનશાહજી પંડોલ રૂ૧૦૦, એડનના જરથોસતીઓ રૂ૧૩૮-૮ અને ભાવનગરના જરથોસતીઓ રૂ૧૮૫.

રાજકોટના ફરવરદીઆન જશન ફંડમાં શેઠ બેહરામશાહ કેરબાદજી ઇરાનીઆએ બેટી મેહરબાનુંના પુણ માટે રૂ૧૨૫ અને પરચુરણ રકમો મલી કુલે રૂ૧૭૯ ભરાયા હતા.

સુરત તથા તેને લગતાં ગામોનાં રૂવાનોને અવલમંજલ પોહોંચાડવાના ફંડમાં ભરાયલા રૂ૫૦૧૪ માની મુખ્ય રકમો:—શેઠ ડોશાભાઇ હોરમજી મીસ્ત્રી રૂ૧૦૦૦, બાઇ દીનબાઇ હોરમશજી ફીલ્લાવાલા રૂ૭૦૦, શેઠો નશરવાનજી અરદેશર તથા ફરામજી રૂસતમજી દલાલ રૂ૫૦૦, શેઠ રતનજી નશરવાનજી લાકડાંવાલા રૂ૨૫૦૦ અને મરહુમ શેઠ પીરોજશાહ જાંગીરજી મશારૂવાલાના ખેશીઓ રૂ૧૦૦.

મોજે ઉમરા, વેસુ વગરે ગામોના અતરાફના દોખમાને લગતી શગડી વગરેના ખરચના ફંડમાં શેઠ જાંગીરજી જમશેદજી ચીનાઇ રૂ૭૬૨-૧૧-૮ અને મરહુમ શેઠ બેરામશાહ હોરમજશાહ પટેલના દોસ્તોએ રૂ૨૦૧ મલી કુલે રૂ૯૬૩-૧૧-૮ ભરાયા હતા.

સુરતની ભગરસાથ અંજુમનને લગતા રૂવાનોને અવલમંજલ પોહચાડવાના ફંડમાં શેઠ મેરવાનજી નાનાભાઇ મેહતાએ રૂ૧૦૦૦ ની લોન, કલકતાના જરથોસ્તીઓએ રૂ૧૯૦૦; તેમજ આરામગાહ આગળ ઝાડપાન કરવા તથા સગડીના મકાનમાં ફેરફાર કરવા માટે શેહેંગાહીના જરથોસ્તીઓ તરફથી રૂ૧૨૨૧ ભરવામાં આવ્યા હતા.

કલીકટની ધરમશાળા તથા આરામગાહના ફંડમાં ભરાયલા રૂ૧૦૦૭ માની મુખ્ય રકમો:—મરહુમ શેઠ જહાંગીર ધ. મુગાશેઠની યાદમાં બેટા રૂશતમે રૂ૨૦૦ની લોન, અને મરહુમના વીધવા મીઠીબાઇ તથા બેટીઓએ રૂ૧૦૦ની લોન, મરહુમ શેઠ માનેક જ. મુગાશેઠની યાદમાં મરહુમના બેટી શેહરા રૂશતમ મુગાશેઠે રૂ૧૦૦ની લોન, મરહુમ બાઇ રતનબાઇ મા. શેઠનાની યાદમા ધણી માણેકજી ફ. શેઠનાએ રૂ૫૦૦ના શેર બોંડ અને મરહુમ બાઇ ચાંદનબાઇ બોટની યાદમા પીતા ફરામરોજ ના. માલેગામવાલાએ રૂ૧૦૦ની લોન.

રાંદેરના અશો ફરોહરના બાજ રોજગારના ફંડમાં ભરાયલા રૂ૭૦૧ માં દશતુર રૂસતમજી હો. રાંદેરીઆએ દીકરા દારાબશાની નઇયતે રૂ૧૦૦, શેઠ અરદેશર નાનાભાઈ પશતાગીયાએ ધણીઆણી પીરોજબાઇની નઇયતે રૂ૧૦૦, બાઈ આશીબાઈ દી. પશતાગીયાએ બાઈ ભીખઇજી ર. ઓરપાડવાલાની નઇયતે રૂ૧૦૦, બાઇ સુનાબાઇ નશરવાનજી દારૂવાલાએ બાઇ નવાજબાઇ

ફરામજીની નઇયતે રૂ૧૦૦, બાઇ મેરબાઇ પા. પલમબરે છોકરા દારાબશાનાં પુણ્ય શારૂ રૂ૧૦૦, શેઠ સોરાબજી હો. રાંદેરીઆએ દીકરી દોશીબાઇની નઇયતે રૂ૧૦૦ અને શેઠ કાવશજી સો. લશકરીએ બેન જરબાઇ ફરાંમજીની નઇયતે રૂ૧૦૦.

સુરતની આરટસ કોલેજના ફંડમાં પારસીઓના ભરાયલા રૂ૩૫૯૧ માંની મુખ્ય રકમો:— નવરોજી મા. વાહાડીઆના ત્રસ્ટીઓ રૂ૩૦૦૦, શેઠ જમશેદજી રૂસતમજી રૂ૩૦૦ અને શેઠો કાવસજી ફરામજીની કં. રૂ૨૫૧.

સુરતની પારસી ઓરફનેજમાં કાયમની બાજ, ખુશાલીના ખાણા વીગેરેના ફંડમાં રૂ૪૨૫૦૦ ભરાયા હતા, તેમાં શેઠ મેરવાનજી ફરદુનજી કાપડીઆ રૂ૨૦૦૦, શેઠ ફરામજી કા. હીરાના રૂ૫૦૦, શેઠો માણેકજી પાલનજીની કં. રૂ૧૨૦૦, શેઠ સોરાબજી પે. બાલીવાલા રૂ૬૦૦૦, બાઇ જરબાઈ નશરવાનજી મેહતા રૂ૨૧૦૦, શેઠ બમનજી ફરદુનજી કોલાબેવાલા રૂ૧૦૦૦, શેઠ પેસતનજી બ. વાડીઆ રૂ૧૦૦૦, શેઠ પેસતનજી દીનશાજી ખાન રૂ૩૦૦૦, શેઠો શાવકશાહ પે. પુંજીઆજી તથા બમનજી ફ. કોલાબેવાલા તથા બાઇ મેરબાઈ જાં. દારૂવાલા તે મરહુમ શેઠ પેસતનજી મા. પુંજીઆજીના વીલના એકઝીકયુટરો તથા એકઝીકયુટ્રીક્ષે રૂ૩૧૦૦, ખા૦ બા૦ બરજોરજી નોશરવાનજી વકીલ રૂ૧૧૦૦, ખા૦ બા૦ ફરદુનજી કું. તારાપોરવાલા રૂ૧૦૦૦, શેઠ મંચેરશા સો. મેહેન્તી રૂ૧૧૦૦, શેઠ મેરવાનજી ફરદુનજી કાપડીઆ રૂ૧૦૦૦, બાઈ આવાંબાઇ ભીખાજી ખાન રૂ૧૫૦૦, શેઠો અરદેશર એ. દલાલ તથા ધનજીભાઇ ફ. કનટરાકટર તે મરહુમ શેઠ પેસતનજી ચાનજીભાઇ ગોલવાલાના એકઝીકયુટરો રૂ૧૫૦૦, શેઠ દાદાભાઈ અરદેશર પોહોંચખાનાવાલા રૂ૧૦૦૦, શેઠ રૂસતમજી નવરોજી કાપડીઆ રૂ૧૦૦૦, બાઈ પીરોજા સોરાબજી નાણાવટી રૂ૨૦૦૦, શેઠ ખરશેદજી મંચેરજી બેસાણીયા તથા છોકરાઓ રૂ૧૫૦૦, શેઠ પેસતનજી ખ. ચીનાઇ રૂ૧૧૦૦, શેઠ બરજોરજી નશરવાનજી મેંગુશી રૂ૧૦૦૦, શેઠો રૂસતમજી તથા ડોશાભાઇ કું. દુમશીઆ રૂ૨૦૦૦, શેઠ જેહાંગીર મંચેરશા દોરાબજી રૂ૧૦૦૦, શેઠ પેસતનજી મા. દમણીઆ રૂ૨૪૦૦, શેઠ કાવશજી મા. દમણીઆ રૂ૧૨૦૦ અને શેઠ હોરમજી મા. દમણીઆ રૂ૧૨૦૦; ઓરફનેજમાં બાજે કરાવી બાજેનાં ખાણાં તથા ખુશાલીનાં ખાણાં ખવડાવવા સારૂ જુદા જુદા આશામીઓ તરફથી કુલે રૂ૩૨૯૭ની રકમ ભરવામાં આવી હતી; જનરલ ફંડ, ઉંચી કેળવણી ફંડ, વીગેરેમાં ભરાયલા રૂ૧૮૪૧-૮-૧૧ માની મુખ્ય રકમો:— શેઠ નવરોજી બ. વકીલ રૂ૧૦૦૦, શેઠો મારકર ફેમીલી રૂ૨૮૦૦, શેઠો છોઇ કુકાની કં. રૂ૧૦૦૦, ખા૦ બા૦ બરજોરજી નો. વકીલ રૂ૧૧૦૨, શેઠ ફરામરોજ કેખુશરૂ પટેલે મરહુમ બાઇ ધનબાઈ કેખુશરૂ પટેલની પુંજીમાંથી રૂ૫૨૯-૮-૮, શેઠો નશરવાનજી, અરદેશર તથા ફરામજી રૂસતમજી દલાલ રૂ૫૦૦, બાઇ વીરબાઇ ન. ગાંધી રૂ૨૦૦૦, બાઈ મેરબાઇ જમશેદજી દલાલ રૂ૨૦૦, શેઠ રૂસતમજી મં. કુકા. રૂ૩૧૦૦, શેઠ મેરવાનજી ફરદુનજી કાપડીઆ રૂ૫૦૦, બંદેખોદા રૂ૧૦૦, શેઠ જાંહગીર બ. પીટીટ રૂ૫૦૦, શેઠ એદલજી કાવશજી પાલીઆ રૂ૫૦૦, સને ૧૨૮૮ નાં પપેતી ટાંકણે શેઠ રૂ. મં. કુકા હસ્તક ભરાયલા રૂ૨૭૩૭-૯-૭, શેઠ એદલજી હો. તાડીવાલા રૂ૧૦૦ અને શેઠ નશરવાનજી ફરામજી ઉધનાવાલા રૂ૧૦૦૦.

બાઈ આવાંબાઇ ફરામજી પીટીટ પારસી ગરલઝ ઓરફનેજમાં રૂ૪૮૨૧૨ ભરાયા હતા, એમાં સર શાપુરજી બી. ભરૂચાએ કોટેજ બાંધવા રૂ૩૫૦૦૦ આપ્યા; ચાલુ ફંડમાં ભરાયલા રૂ૪૬૧૨ માની મુખ્ય રકમો:—બાઇ ડોસીબાઇ પે. પટેલ રૂ૧૦૦૦, એક મીત્ર રૂ૫૦૦, એક દીલસોજ રૂ૫૦૦, એક મીત્ર રૂ૫૦૦, મરહુમ બાઈ આલાંમાય પી. મહેતાની યાદમાં શેઠ હોરમસજી મા. મહેતા અને ધણીયાણીએ રૂ૫૦૦, શેઠ કાવશજી ડી. દુબાશ રૂ૧૦૦, શેઠ અરદેશર એસ. નારીયલવાળા રૂ૧૦૦, મરહુમ બાઇ ફરામજીની યાદમાં શેઠ પાલનજી પી. વાગલા કુપરે રૂ૧૦૦, મરહુમ શેઠ રૂસતમજી એમ. દાદીના તથા ધણીયાણીની મીલકતમાંથી રૂ૧૦૧, બાઇ હીરાબાઇ જ. પીટીટ રૂ૧૦૦ અને બાઇ જરબાઇ ફકીરજી પટેલ રૂ૧૦૦; એનડાઉમેંટમાં શેઠ રૂસતમજી સો. કંત્રાકટરે

ધણીઆણી કુવરબાઇની યાદમાં રૂ૧૦૦૦ની ૩ાા ટકાની લોન, બાઇ ભીખાઇજી જમશેદજી ચીનાઇએ મરહુમ ખાવંદ જમશેદજીની યાદમાં રૂ૨૦૦૦ નાં વોર બોંડ, શેઠો જેહાંગીર અ. કામા અને જમશેદ પી. કામા તે મરહુમ શેઠ ધનજીભાઇ અ. વાડીયાના વીલના ત્રસ્ટીઓએ મરહુમ બાઇ મેહરબાઇ અ. વાડીયાની યાદમાં રૂ૩૦૦૦ ની ૩ાા ટકાની લોન અને શેઠો મનચેરજી ના. મીસ્ત્રી તથા રૂસતમજી મ. મીસ્ત્રીએ મરહુમ બાઇ હીરાંબાઇ મ. મીસ્ત્રીની યાદમાં રૂ૨૬૦૦ ની ૩ાા ટકાની લોન આપી હતી.

નામદાર સર જમશેદજી જીજીભાઇ પારસી બેનીવોલન્ટ ઇન્સ્ટીટયુશનને તા૰ ૧૩મી આગસ્ટ ૧૯૧૮ થી તા૰ ૩૧ મી જુલાઇ ૧૯૧૯ સુધીમાં મલેલી મદદની વીગતઃ—શેઠ બમનજી દાદાભાઇ બીલીમોરીઆએ મરહુમ માતાજી વીરબાઇજીના પુણ્ય સારૂ આ ધરમખાતાનાં સાધારણ ખરચમાં વાપરવા રૂ૫૦૦ની ૩ાા ટકાની નોટ, શેઠ પીરોજશા જા. મરઝબાને સને ૧૯૧૯નાં સબસ્ક્રીપ્શનનાં રૂ૨૪, મરહુમ બાઈ બાનું સોરાબજી મીસ્ત્રીની યાદમાં એક જરથોસ્તીએ રૂ૧૦૦નો મેસરસ બડહામ પાઇલ્સ ક. લીમીટેડનો શેર–૧ આપ્યો કે બ્યાજમાંથી વીધ્યારથીઓને મુફ્ત ચોપડીઓ અપાવવી, મરહુમ શેઠ મેહેરવાનજી હો. દારૂખાનાવાલાનાં પુણ્ય સારૂ મરહુમના ફુવાણસાસુ ગુલબાઇ પે. ચોકસીની પુંજીમાંથી મરહુમનાં બેહેન જરબાઇ પે. ચોકસીએ રૂ૧૦૦ ની ૩ાા ટકાની નોટ આપી કે બ્યાજમાંથી છોકરાંઓને મુફ્ત ચોપડીઓ અપાવવી; મરહુમ ખાવીંદ દીનશાજી સો. તલાટીનાં પુણ્ય સારૂ બાઇ મેહરબાઈ દી. તલાટીએ રૂ૧૦૦ની ૩ાા ટકાની નોટ આપી કે બ્યાજમાંથી મુંબઇની સ્કુલોમાં ગરીબ વીધ્યારથીઓને મુફ્ત ચોપડીઓ અપાવવી, બાઇ સુનાંબાઇ મેરવાનજી ડાકટરે રૂ૫૦૦ની ૩ાા ટકાની નોટ આપી કે બ્યાજમાંથી આ ખાતાની વલસાડની કન્યાશાળામાં ઇનામો આપવા અને શેઠ જાહાંગીર રૂ. દાદીનાએ મરહુમ અધ્યારૂ રૂસ્તમજી મે. દાદીનાં અને બાઇ હીરાબાઇની પુંજીમાંથી ગરીબ વીધ્યારથીઓને ચોપડીઓ અપાવવા રૂ૫૧.

નામદાર સર જમશેદજી જીજીભાઇની સ્કુલનાં લાચાર કમનસીબ જાતનાં છોકરાઓ તથા છોકરીઓને બપોરનાં જમાડવાને લગતા "ભોજણ ફંડ" ખાતે તા૰ ૧૩ મી આગસ્ટ ૧૯૧૮ થી ૩૧ મી જુલાઇ ૧૯૧૯ સુધી નોટો, બોંડો, લોન તથા રોકડ મલીને જુમલે રૂ૩૦૮૨૪–૮–૦ ની રકમ મલી હતી, તેમાં રોકડાં મલેલા રૂ૧૨૪૩૯–૪–૧ ની વીગતઃ— મરહુમ બાવાજીના પુણ્ય માટે શેઠ ડી. એચ. બી. રૂ૩૦૦, મરહુમ શેઠ દારાબ પા. પ્લમબરની યાદમાં શેઠ અરદેસર જ. બીલીમોરીઆએ રૂ૧૫૧, મરહુમ ધણીઆણી રતનબાઇ દા. માદનની યાદમાં શેઠ દાદાભાઈ સોરાબજી માદને રૂ૨૫૦, બજારગેટનાં જરથોસ્તી વેપારીઓએ દેહ મહીનાનું જશન કીધું તેનાં વધારાનાં રૂ૧૦૧, શેઠ ધનજીભાઈ બમનજીએ ૧૨ બચ્ચાંઓને જમાડવાનાં રૂ૫૫૦, શેઠ સોરાબજી રૂસ્તમજી સુબેદારે ૩ બચ્ચાંઓને વરસ ૧ સુધી જમાડવા રૂ૧૫૦, બાઈ ગુલબાઇ દાદાભાઈ મોતીવાલાનાં ઉઠમણામાં ભરાયેલા રૂ૧૦૧, બાઈ ધનમાયે દાદાભાઈ શેકારી તે શેઠ પેસ્તનજી બે. મીસ્તરીના છોકરીનાં લાહારમાં થએલા ઉઠમણામાં ભરાએલામાંથી રૂ૧૦૦, મરહુમ શેઠ ફરામજી હોરમસજી અરજનીના ઉઠમણામાં ભરાયેલામાંથી ધણીઆણી ધનમાએ આપેલા રૂ૧૦૦, રોજીંદી મનશનીના પુસ્તકનાં વેચાણથી ઉપજેલી રકમમાંથી શેઠ દીનશા મેરવાન ઇરાનીએ રૂ૧૦૦, કઝીન નાદરનાં લગનની ખુશાલીમાં એમી દારા દસ્તુરે રૂ૧૦૦, માતપીતાની નઇયતે રૂ૧૦૦, શેઠ ફ. રૂ. વાડીયા રૂ૧૦૦, શેઠ રૂસતમ સોરાબજી પાઉંવાલા રૂ૧૦૦, સેગાંહીની અનજુમનનાં ફંડનાં ત્રસ્તીઓ રૂ૫૦૦, જરથોસ્તી હારીસ રૂ૫૦૧, શેઠ પેસતનજી ખ. ઉમરીગરની યાદમાં મરહુમ શેઠ જાહાંગીર જા. બોગાના દીકરાઓએ રૂ૧૫૧, દીકરી સેહેરાની નવજોતની ખુશાલીમાં રૂ૧૦૦, શેઠ મનચેરજી જમશેદજી પટેલ રૂ૨૦૦, શેઠો સોરાબજી પેસતનજીની કં. રૂ૧૦૦, મરહુમ બાઈ સુનાબાઇ સોરાબજી વોરડનના પુણ્ય સારૂ મરહુમ બાઈ રતનબાઈ બ. પટેલની દીકરીઓએ રૂ૧૦૦, ખુચી મેહેરા દારાશાહની યાદમાં રૂ૩૦૦, શેઠો રૂસતમજી અને નશરવાનજી બોઇસ રૂ૧૦૦, એક જરથોસ્તી બાનુએ ૩ બાળકને ૧ વરસ જમા-

ડવા માટે રૂ૧૫૦, શેઠ ફ્રરામરોઝ સોરાબજી ખાન રૂ૧૦૦, Hermes તરફથી રૂ૧૦૦, મરહુમ પીતાજી પીરોજશા દા. બેદવારની યાદમાં બાઇ માણેકબાઈ સો. વાછાગાંધી રૂ૧૫૦, મરહુમ શેઠ બરજોરજી સોરાબજી ડૉકટરની યાદમાં તેવણુની પુંજીમાંથી રૂ૨૦૧, મરહુમ બાઇ તેહમીના સોરાબજી એન્જીનીઅરનાં ઉઠમણામાં ભરાયલામાંથી રૂ૨૭૫, મરહુમ શેઠ ફ્રરામજી પે. વાગલાકુપરની યાદમાં બેટા રૂસતમજી ફ. કુપરે રૂ૧૦૧, મરહુમ બાઈ આવાંબાઈ મેરવાનજી ભરૂચાનાં ઉઠમણામાં બેસી સર શાપુરજી બ. ભરૂચાએ ભરેલા રૂ૨૫૦, શાન્તાક્રુઝ, અંદેરી અને વરસાવાના બાનુંઓએ ડાકટર શેઠ દાદાભાઇ નવરોજીની બાજને દીને જશન કરતા વધેલી રકમનાં અરધા ફાળાના રૂ૧૦૦, કલબ મેઝેસતીકના જરથોસ્તીઓ રૂ૧૨૬, બાઇ નવાજબાઇ શા. મેહેતા રૂ૧૫૦, અને રૂ૧૦૦ની અંદરની જુદા જુદા ધણીઓ જણ ૨૭૨ તરફથી આવેલી રકમના રૂ૬૩૮૧-૪-૦; ઉપલી રોકડ રકમો ઉપરાંત નીચે જણાવેલા રૂ૧૮૩૮૫-૪-૦ ની નોટો, બોંડો, લોન ભોજન ફંડ ખાતે જાથુકની થાપણ દાખલ બ્યાજ વાપરવાની સરતે આપેલાની વીગતઃ—શેઠ કે. આર. વાછા અને ધણીઆણીએ પોતાની સીલવર વેડીંગની યાદમાં રૂ૧૫૦૦ ના ૪ ટકાના ઇમપરૂવમેંટ ટ્રસ્તના બોંડ, શેઠ રૂસ્તમજી સો. કંટકરાકટરે મરહુમ બાઇ આઈમાય તે રૂ. સો. કંટરાકટરનાં બેટીના પુણ સારૂ રૂ૧૦૦ ની ૩॥ ટકાની નોટ, મરહુમ ગુજરેલાઓની યાદમાં બાઇ જરબાઇ ફ્રરામજી કામાએ રૂ૫૦૦ ની ૩॥ ટકાની નોટ, મરહુમ શેઠ સોરાબજી પે. શાહુના ઉઠમણામાં શેઠ માણેકજી પાલનજી તથા શેઠ બમનજી ફ. વાણીઆએ સરખે હીસ્સે ભરેલી રૂ૧૦૦૦ ની ૩॥ ટકાની નોટ, શેઠ ફીરોજશાહ મેરવાનજી દલાલે રૂ૧૦૦૦ નું ૫॥ ટકાનું વોર બોન્ડ, શેઠ ખરશેદજી ન. પાંડેએ માતાજી ગુલબાઇનાં પુણ માટે આપેલા રૂ૨૫૦૦ ની ખરીદેલી રૂ૩૩૦૦ ની ૩॥ ટકાની નોટ, શેઠ જમશેદજી શાપુરજી અરાજણીઆએ મરહુમ બાઇ આઇમાએ જ. અરાજણીઆનાં પુણ સારૂ રૂ૫૦૦ નું ૪ ટકાનું બોંડ, બાઈ કુવરબાઇ અરદેશર કામાએ મરહુમ બેટા મનચેરજીની યાદમાં આપેલા રૂ૫૦૦ ની ખરીદેલી રૂ૬૦૦ ની ૩॥ ટકાની નોટ, શેઠ હોરમસજી ધનજીભાઇ મુલ્લાએ મરહુમ દીકરી ગુલબાઈનાં પુણ માટે આપેલા રૂ૫૦૧ ની ખરીદેલી રૂ૭૦૦ ની ૩॥ ટકાની નોટ, શેઠ બરજોરજી નશરવાનજી મેંગુશીએ મરહુમ દીકરા દીનશાજીનાં પુણ માટે આપેલી રૂ૫૦૦ની ૩॥ ટકાની નોટ, શેઠ હોરમસજી કાવશજી સંતોક વકીલે મરહુમ મમાવાજી જાંગીરશાહ સોરાબશાહ તાલેયારખાનની યાદમાં રૂ૨૫૦ તથા મરહુમ બાવાજી કાવશજીની યાદમાં આપેલા રૂ૨૫૦ મલી રૂ૫૦૦ ની ખરીદેલી રૂ૭૦૦ ની ૩॥ ટકાની નોટ, બાઇ શીરીનબાઇ કા. મેહેતાએ દીકરા મનચેરશાહની શેહાદીની ખુશાલીમાં મરહુમ પીતાજી એદલજી મે. દુબાશની યાદગારી રાખવા આપેલી રૂ૫૦૦ ની ૩॥ ટકાની નોટ, શેઠ જેહાંગીર મનચેરજી માસ્તરે એવનના નેકશાન બાઇ શીરીનબાઈ તે મરહુમ શેઠ મેહેરવાનજી એ. બોહશનાં દીકરીની યાદમાં આપેલી રૂ૫૦૦ ની ૩॥ ટકાની નોટ, મરહુમ શેઠ નસરવાનજી મનચેરજી ગજદરનાં પુણ માટે તેવોનાં નબીરાઓએ આપેલા રૂ૨૦૮૪-૪ નાં ખરીદેલા ટાટા આયરન એન્ડ સ્ટીલ કં.નાં ટકા૭॥ નાં પ્રેફરન્સ શેરો નંગ ૨૦ ઙ. શેઠો શાપુરજી ન. ગજદર તથા દીનશાજી દા. ગજદર, મરહુમ શેઠ નાદરશાહ હો. બેલગામવાલાનાં પુણ સારૂ રીપન કલબનાં દોસ્ત મેમબરોએ આપેલા રૂ૧૨૦૦ ની ખરીદેલી રૂ૧૭૦૦ની ૩॥ ટકાની નોટ, બાઇ ડોસીબાઈ મે. દારૂખાનાવાલાએ મરહુમ ખાવીંદ મેહેરવાંનજીનાં ઊઠમણામાં એવણે તથા છોકરાઓએ ભરેલી રકમની આપેલી રૂ૧૦૦ ની ૩॥ ટકાની નોટ, શેઠ જીજીભાઈ ડોસાભાઇ ખંબાતાએ તથા ધણીયાણી દીનબાઇએ મરહુમ બેટા જાલેજરના પુણ માટે આપેલા રૂ૧૦૧ નું ખરીદેલું રૂ૧૦૦ નું ૫॥ ટકાનું વોર બોંડ, શેંગાહીની પારસી કલબનાં ભાઈઓ તથા મીત્રોએ જમશેદી નોરોજે એકઠી કરેલી રકમના અરધા ફાલાના મોકલેલા રૂ૨૮૦-૨-૧૧ ની ખરીદેલી રૂ૪૦૦ ની ૩॥ ટકાની નોટ, મરહુમ શેઠ નાદરશા હો. બેલગામવાલાનાં પુણ સારૂ બાવા હો. ન. બેલગામવાલા તથા માતાજી દીનબાઇ તથા છોકરાઓ અને મરહુમના સસરા મનચેરસા સો. વખારીઆ તથા સાસુ કુંવરબાઇ તથા

છોકરાઓ તરફથી મ્યુનીસીપાલ સેનેતરી વરકસ લોન ટકા ૫ ની ૩૫૦૦ ની અને સરકારી વોર લોન ટકા ૫ ની ૩૫૦૦ ની અને શેઠ જમશેદ સેહેરીઆર ઇરાનીએ મરહુમ શેઠ બેજન શેહેરીઆર ઇરાનીના ઉઠમણામાં ભરાએલા ૩૫૦૧ મોકલેલા તેની ખરીદેલી ૩૭૦૦ ની ૩॥ ટકાની નોટ.

બેહેરામજી જીજીભાઇ પારસી ચેરીતેબલ ઇનસ્તીટયુશનને કુલે ૩૬૬૪૭૬-૧-૧ ની બક્ષેસ મલી હતી તેમાં એનડાઉમેન્ત ફંડમાં ભરાયલા ૩૫૦૪૮-૬ માની મુખ્ય રકમો:—બાઇ આવાંબાઇ રૂશતમજી બેરામજી જીજીભાઇએ મરહુમ મુરંમબીજી બેરામજી જીજીભાઇની યાદમાં ૩૧૦૦૦ની ૩॥ ટકાની નોટ, શેઠ પેસતનજી નશરવાનજી કેરાંવાલાએ મરહુમ માતાજી મીથીબાઈની નઈઅતે ઓગસ્ત ૧૯૧૮ થી ડીસેમબર ૧૯૧૮ સુધીના ૩૨૫૦ અને આગલ આપેલામાં ૩૧૫૨-૬ ઉમેર્યા તે મળી ૩૪૦૨-૬ આપ્યા જેથી ૩૧૦૦૦ ની ૩॥ ટકાની નોટ લેવાને બને, મરહુમ શેઠ કેખસરૂ બરજોરજી લીંબુવાલાના ઉઠમણામાં ભારાયલામાંથી ૩૧૦૦, મરહુમ બાઈ સીરીનબાઇ પેસતનજી ન. વાડીઆના પુણ સારૂ ધણી પેસતનજી ન. વાડયા તથા દીકરાઓ અને દીકરીઓ તથા અતભગના બેસીઓએ તેઓના પાછલી રાતના ઉઠમનામાં ભરેલામાંથી ૩૧૦૦૦ ની ૩॥ ટકાની નોટ, મરહુમ શેઠ ફરામજી કાવસજી કાવારાનાના ઉઠમનામાં ભરાયલામાંથી ૩૫૦૦ નો ૪ ટકાનો પોરટ ત્રસ્ત બોન્ડ, મરહુમ બાઇ નવાજબાઇ દા. સરાફ તે શેઠ જમશેદજી ફ. કથોકની દીકરીના ઉઠમણામાં ભરાયલામાંથી મરનારની પુંજીમાંથી ૩૧૦૦ની ૩॥ ટકાની નોટ, શેઠ કાવસજી દીનશાહ એડન-વાલા તથા ધણીઆણી જરબાઇના પુણ માટે છોકરાઓ શેઠો હોરમસજી, કેકોબાદ, સોરાબ અને શાવકશાહે ૩૧૦૦૦ ની ૩॥ ટકાની નોટ, મરહુમ આ૦ રૂશતમજી મે. દાદીના તથા દાકતર અને બાઇ હીરાંબાઇ રૂ. દાદીનાની પુંજીમાંથી ૩૧૦૧, મરહુમ શેઠ મેરવાનજી હોરમસજી દારૂખાનાવાલાના ઉઠમણામાં ભરાયલામાંથી મરહુમના ફુવનસાસુ જરબાઇ પે. ચોકસીએ ૩૧૦૦ ની ૩॥ ટકાની નોટ, આગલો વીધ્યારથી ૩૧૦૧ અને મરહુમ શેઠ દોરાબજી ન. લવંગીઆના પુણ માટે ધણી-આણી ગુલબાઇની પુંજીમાંથી ૩૩૦૦ ની ૩॥ ટકાની નોટ; નાનાભાઇ બેરામજી જીજીભાઇ ભોજણ ફંડમાં ભરાયલા ૩૫૫૭૮૬-૧૧-૧ માની મુખ્ય રકમો:— શેઠ સોરાબજી રૂશતમજી સુબેદાર ૩૧૫૦, બાઇ આવાંબાઇ રૂશતમજી બેરાંમજી જીજીભાઇએ મરહુમ મુરંબીજી બેરાંમજી જીજીભાઈની યાદમાં ૩૫૦૦ ની ૩॥ ટકાની નોટ, જરથોસ્તી ઓરીસ ૩૫૦૧, એક જરથોસ્તી બાનુએ મરહુમ બેહેનની યાદમાં ૩૧૦૦, મરહુમ શેઠ નશરવાનજી મે. પાંડેની યાદમાં દીકરા ખરશે-દજીએ ૩૧૦૦૦, મરહુમ બાઇ ગુલબાઇ નશરવાનજી મે. પાંડેની યાદમાં દીકરા ખરશેદજીએ ૩૧૫૦૦, શેઠ રૂશતમજી અરદેશર દુબાશ ૩૧૨૯-૦-૧૧, મરહુમ શેઠ ફરામજી હોરમસજી અરજાનીના ઉઠમણામા ભરાયલામાંથી ધનીઆણી ધનમાએ આપેલા ૩૧૦૦, શેઠ કે. આર વાચ્છા અને ધણીયાણીની સીલવર વેડીંગ તા. ૨૭-૯-૧૯૧૮ ને દીને પડી તેની યાદમાં ૩૧૫૦૦ ના ચાર ટકાના સીટી ઇમપ્રુવમેન્ત બોન્ડ, શેઠ પેસતનજી ન. કેરાંવાલાએ મરહુમ માતાજી મીથીબાઇની નઇયેતે ૫૦ છોકરા જમાડવા ઓગસ્ત ૧૯૧૮ થી એપ્રીલ ૧૯૧૯ સુધીના ૩૬૨૫-૧૨-૬, મરહુમ બાઇ આઇમાએ રૂશતમજી કનત્રાકતરના ઉઠમણામાં ભરાયલામાંથી ૩૧૦૦૦ની ૩॥ ટકાની નોટ, મરહુમ બાઇ સુનાબાઇ ફરામજી ગઝદરના ઉઠમણામાં મરહુમની પુંજી-માંથી તથા બેસાવંદોએ ભરેલા ૩૧૦૧, મરહુમ શેઠ સોરાબજી પેસતનજી સાહુના ઉઠમણામાં શેઠ માણેકજી પા. તલાટીએ ભરેલા ૩૫૦૦ ની ૩॥ ટકાની નોટ, શેઠ પીરોજશાહ મેરવાનજી દલાલે મરહુમ દીકરા જમશેદજીના પુણ માટે ૩૧૦૦૦ના ૫॥ ટકાના વોર બોંડ, શેઠો નામદાર જામાસ્પ ઇરાની તથા ફરેદુન બેરામ ઇરાની ૩૧૦૧, બાઇ ધનમાએ દાદાભાઈ શેકારીના ઉઠમણામાં બેસી-ઓએ ભરેલી રકમમાંથી ૩૧૫૦, શેઠો સોરબજી પેશતનજીની કુ. ૩૧૦૦, કઝીન નાદરના લગનની ખુશાલીમાં એમી દારાં દસતુરે ૩૧૦૦, મરહુમ માતાજી હીરાબાઇ નાનાભાઇ બેરાંમજી જીજીભાઇ તા. ૭ મી ડીસેમબર ૧૮૫૦ ને દીને બેહેસ્તનસીન થયા તેવણના પુણ માટે શેઠ રૂશતમજી બેરામજી

જીજીભાઇ અને ધણીયાણીએ રૂ૫૦૦ નો ૪ ટકાનો પોરટ ટ્રસ્ટ બોન્ડ, શેઠ જીજીભાઇ રૂશ
બેરાંમજી જીજીભાઇ અને ધણીયાણીએ રૂ૨૦૦ની ૩॥ ટકાની નોટ, બાઇ વીરબાઇજી રૂસતમ
જીજીભાઇ રૂ૧૦૦, શેઠ રૂશતમજી જમસેદજી ખરશેદજી જમશેદજી અને ધણીયાણી રૂ૧૦૦
દાદાભાઇ એન. બી. જીજીભાઇ રૂ૧૦૧, બાઈ હીરાંબાઇ રૂશતમજી બેરાંમજી જીજીભાઇએ રૂ૧
૩॥ ટકાની નોટ, શેઠ રૂશતમજી દારબશાહ દુબાશ રૂ૧૦૦ અને શેઠ પેસતનજી નશર
વાડયા તથા મરહુમ બાઇ સીરીનબાઇ પે. ન. વાડયા રૂ૧૦૧ મલી રૂ૧૩૦૨, શેઠ બેરાંમજી રૂશ
બેરાંમજી જીજીભાઇએ દીકરા જમશેદજીની પેહેલી વરસગાંઠની ખુસાલીમાં રૂ૬૦૦, શેઠ P. N
રૂ૨૦૦, મરહુમ બાઇ આવાંબાઈ મેરવાનજી માણેકજી ભરૂચાના ઉઠમણામાં સર શાપુર
ભરૂચાએ ભરેલા રૂ૨૫૦, શેઠ સાવકશાહ પે. પુજીઆજી, બાઈ મેરબાઇ જાં. દારૂવાલા અ
બામનજી ફ. કોલાબેવાલા તે મરહુમ શેઠ પેસતનજી મા. પુંજીઆજીના એકઝીકયુતરોએ શે
મા. પુજીયાજીના પુણ માટે રૂ૫૦૦ ના ૫॥ ટકાના વોર બોંડ, મરહુમ બાઈ સુનાબાઇ ધન
મેહેતાના ઉઠમણમાં ભરાયલામાંથી રૂ૨૨૫, બાઈ તેહેમીના સોરાબજી એનજીનીયરના ઉઠમ
ભરાયલામાંથી રૂ૨૭૫, બાઇ ધનબાઈજી મ. બનાજીની યાદમાં રૂ૧૦૦, બાઇ કુંવરબાઇ અ
કામાએ મરહુમ દીકરા મનચેરજીના પુણ માટે રૂ૫૦૦, મરહુમ બાઇ ગુલબાઇ હો. મુલ્લાંના પુણ
મરહુમના બાવા હોરમજીએ રૂ૫૦૧, મરહુમ શેઠ કેખસરૂ અરદેશર પટેલની યાદમાં રૂ
હોંગકોંગ, કનતાન અને મકાઉના જરથોસતીઓ તરફથી રૂ૧૩૭૫, શેઠ બરજોરજી સો. ડાક
યાદમાં એવોની પુંજીમાથી રૂ૨૦૧, "હરમીસ" રૂ૧૦૦, શેઠ જાંગીર મ. માસતરે પોતાના નો
બાઇ સીરીનબાઇ તે શેઠ મેરવાનજી બોઇસની દીકરીની યાદમાં રૂ૫૦૦ની ૩॥ ટકાની નોટ, શેઠ
રશાહ હો. બેલગામવાલાના ઉઠમણામાં બાવા હોરમસજી તથા માતાજી દીનબાઇ તથા છોકરાં
રૂ૧૦૦, શેઠ બમનશાહ જીવાજી ભરૂચાએ માતાજી બાઇજીના પુણ માટે રૂ૧૦૧, એક જરથોસ
રૂ૨૦૦ ની ૩॥ ટકાની નોટો, ભાઇઓ રૂસતમજી તથા નશરવાનજી નાનાભાઇ બોઇસ રૂ૧૦૦,
મેહેરાં દારાશાહની યાદમાં રૂ૩૦૦, મરહુમ શેઠ રતનજી દા. પાચ્છાની યાદમાં શેઠ દાદાભાઇ
વાચ્છા ચેરીતેબલ ફંડના ટ્રસતીઓએ રૂ૧૦૦ ની ૩॥ ટકાની નોટ, શેંહુંગાહીની પારસી
જમશેદી નોરોઝના દીવસે કલબના ભાઇઓ તથા મીત્રો વચ્ચે ભરાયલામાંથી અરધી ર
રૂ૨૫૦-૨-૧૧, શેઠ મનચેરજી જમશેદજી પટેલ રૂ૨૦૦, દીકરી શેહેરાંની નવજોતની ખુસા
રૂ૧૦૦, શેઠ દાદાભાઇ એ. ઇટાલીઆ લગનના ખુશબકતી ભરયા હીંગામ ઉપર એકાએક
સીક પડી પાછા સાજા થયા તેની સુકરગુજારીમા સગાવહાલા તથા દોસ્ત આશનાઓએ રૂ
મરહુમ શેઠ બેરાંમજી ફકીરજી મોર્તાબાલાના ઉઠમણામાં ભરેલા શેઠ સો. ર. કરાઇ તરફથી રૂ
એક જરથોસ્તી ઓફીસ રૂ૫૦૧, શેંહુંગાહીની જરથોસ્તી અંજુમનના ધરમના ફંડમાંથી
ઓએ રૂ૫૦૦, મરહુમ બાવાજી સર જમશેદજી જીજીભાઇ બીજા બેરોનેટની યાદમાં બેટીએ રૂ
શેઠો સોરાબજી પેસતનજીની કં. રૂ૧૦૦, કલબ ગેજેસટીકના જરથોસ્તીઓના દેહે માસના
વખતે એકઠા કરેલા રૂ૧૨૫, બેટી બુચી હોમાયની યાદમાં માતપીતાએ રૂ૧૦૨, માતાજીના
માટે રૂ૧૦૧, શેઠો ફરદુન બી. મરઝબાન ઇરાની અને નામદાર જા. ઇરાની રૂ૨૦૦, શેઠ હોર
માણેકજી મેહેતા રૂ૨૦૦, મરહુમ ભાઇ અરદેશર ફકીરજી મોગરેલીઆની યાદમાં રૂ૧૦૧, મ
શેઠ પેસતનજી ફરામજી શરાફના પુણ સારૂ બેશીઓએ રૂ૩૦૦૦ ના ૪ ટકાના પોરટ ટ્રસ્ત બ
શેઠ એમ. એચ કે. રૂ૧૦૦, મરહુમ વહુ રતનબાઈ જા. ચીનાઇની યાદમાં મરહુમ સસરા જમ
એ. ચીનાઇના સ્થાપેલા ધરમખાતાંમાંથી રૂ૧૦૦, જરથોસ્તી રૂ૨૫૦૦૦, હમારા માતાજી
બાઇ દી. એસ માદનની બાજને દીને બચ્ચાંઓએ રૂ૧૦૦, અને મરહુમ બેહેન આઈમા
પુણ માટે ભાઇ પે. કા. શે. તરફથી રૂ૨૦૦; આ ઇનસ્ટીટયુટને લગતા મી. અને મીસીસ પી.

વાડયા તીચર્સ પેનશન એન્ડ પ્રોવીડન્ત ફંડમાં ભરાયલા રૂ૫૬૪૧માંની મુખ્ય રકમોઃ-ડા. ધનજીશાહ હીરજીભાઇ પતેલે બાઇ શીરીનબાઈ પે. ન. વાડયાની નઇયતે બીલડીંગ સોસાઇટીનો રૂ૧૦૦ નો શેર એક, મરહુમ બાઇ શીરીનબાઇ પેસતનજી ન. વાડયા તા. ૧૯--૯-૧૯૧૮ ને દીને ગુજરયા તેઓના પુણ સારૂ ધણી પેસતનજી નશરવાનજી વાડયા તથા દીકરાઓ અને દીકરીઓ તથા અતલગના ખેશીઓએ તેઓના પાછલી રાતના ઉઠમણામાં ભરાયલાંમાંથી રૂ૫૦૦૦ના ૪ ટકાના સીટી ઈમપરૂવમેન્ત ત્રસ્ત બોન્ડ અને રોકડા રૂ૩૦૦ મલી રૂ૫૩૦૦.

જરથોસ્તી છોકરીઓની નીશાળ મંડળીના એનડાઉમેંટ ફંડમાં રૂ૧૪૯૩૦૦ ભરાયા હતા તેમાં, ખા૦ સા૦ રતનજી જ. દુબાશ તથા ધણીઆણી કુવરબાઇએ રૂ૭૨૦૦ની ૩II ટકાની નોટ, શેઠ શાવકશા રતનજી બ. દુબાશે મરહુમ માતાજી કુવરબાઇનાં પુણ સારૂ રૂ૭૦૦૦ના ૫II ટકાનાં વોર બોંડ, શેઠ હોરમસજી કાવસજી દી. એડનવાળાએ રૂ૬૦૦૦ના પોરટ ટ્રેનીંગના શેર, સર દોરાબજી જ. તાતાએ રૂ૭૦૦૦ની ૩II ટકાની નોટ, સર દીનશાહ મા. પીટીટે રૂ૮૨૦૦ની ૩II ટકાની નોટ, શેઠ ફરામરોઝ એ. દીનશાહે રૂ૭૧૦૦ની ૩II ટકાની નોટ, શેઠ માનેકજી કા. પીટીટે રૂ૭૭૦૦ની ૩II ટકાની નોટ, શેઠ અરદેશર સો. પટેલે રૂ૭૩૦૦ની ૩II ટકાની નોટ, સર શાપુરજી બ. ભરૂચાએ રૂ૭૪૦૦ની ૩II ટકાની નોટ, શેઠ અરદેશર હો. મામાએ રૂ૭૨૦૦ની ૩II ટકાની નોટ, શેઠ ડોસાભાઈ મા. વહાડયાએ મરહુમ ધણીઆણી રતનબાઇના પુણ માટે રૂ૭૨૦૦ની ૩II ટકાની નોટ, શેઠ બાપુજી સો. પટેલે રૂ૬૦૦૦ની ૩II ટકાની નોટ, શેઠ પેસતનજી ધ. પટેલે રૂ૫૦૦૦ની ૩II ટકાની નોટ, શેઠો જેહાંગીર તથા બેહેરામજી ફ. કરાકાએ મરહુમ પીતાજી ફરદુનજીનાં પુન સારૂ રૂ૩૦૦૦ની ૩II ટકાની નોટ, શેઠ જેહાંગીર દી. દાવરે પીતાજી સર દીનશાહ દાવરના પુન સારૂ રૂ૩૦૦૦, શેઠ પીરોજશાહ મેરવાનજી દલાલે રૂ૩૦૦૦ના ૫II ટકાના વોર બોંડ, શેઠ સોરાબજી તથા દાદાભાઇ હો. બોડે બાવાજી હોરમસજીના પુણ સારૂ રૂ૫૦૦૦ની ૩II ટકાની નોટ, મરહુમ શેઠ પેસતનજી રૂ. હકીમજીનાં પુન સારૂ કીધેલાં ખાતાંમાંથી એમના ત્રસટીઓએ રૂ૨૫૦૦ની ૩II ટકાની નોટ, બાઇ શીરીનબાઇ મ. બનાજીએ મરહુમ માતાજી ધનબાઇજી તથા મરહુમ બાઇ ખરશેદજીના પુન સારૂ રૂ૨૨૦૦ની ૩II ટકાની નોટ, શેઠ અરદેશર સાપુરજી નારીએળવાળાએ રૂ૨૧૦૦ની ૩II ટકાની નોટ, શેઠ પેસતનજી નશરવાનજી મસાણીએ મરહુમ માતાજી દીનબાઇનાં પુન સારૂ રૂ૨૧૦૦ની ૩II ટકાની નોટ, શેઠ ધનજીભાઇ બમનજીએ રૂ૧૫૦૦ની ૩II ટકાની નોટ, શેઠ રૂસતમજી સો. પાંઉવાળાએ રૂ૧૫૦૦ની ૩II ટકાની નોટ, શેઠ કાવશાહ સો. પાંઉવાળાએ રૂ૧૫૦૦ની ૩II ટકાની નોટ, શેઠ દારાશાહ બ. દુબાશે મરહુમ પીતાજી બમનજી તથા માતાજી જરબાઇનાં પુણ સારૂ રૂ૧૫૦૦ની ૩II ટકાની નોટ, શેઠ અરદેશર બ. દુબાશે મરહુમ પીતાજી તથા માતાના પુણ સારૂ રૂ૧૫૦૦ની ૩II ટકાની નોટ, શેઠ હોરમસજી મા. મેહેતાએ રૂ૧૫૦૦ની ૩II ટકાની નોટ, શેઠ બરજોરજી ફ. જોશીએ શેઠ રૂસતમજી એ. દાદાચાનજીના પુન સારૂં રૂ૧૫૦૦ની ૩II ટકાની નોટ, બાઇ ગુલબાઇ મેહેરવાનજી બોઇસે મરહુમ દીકરા પીરોશાહના પુન સારૂં રૂ૧૫૦૦ની ૩II ટકાની નોટ, બાઇ ગુલબાઇ બ. પીટીટે ધણી બહમનજીના પુન સારૂં રૂ૧૫૦૦ની ૩II ટકાની નોટ, શેઠ નવરોજી બા. તચકરાએ મરહુમ ભત્રીજા ફરામરોઝ ન. ટચકરાની યાદમા રૂ૧૫૦૦ની ૩II ટકાની નોટ, શેઠ કાવસજી જા. શેઠે રૂ૧૫૦૦ની ૩II ટકાની નોટ, શેઠ હોરમસજી ખ. ભાભા તથા બહેનોએ મરહુમ મામાજી નવરોજી જે. ગામડયાની યાદમાં રૂ૧૫૦૦ની ૩II ટકાની નોટ, શેઠ મનચેરજી પા. કંત્રાકટરે મરહુમ પીતાજી પાલનજીની યાદમાં રૂ૧૦૦૦ ની ૩II ટકાની નોટ, શેઠ એન. એમ. પટેલે રૂ૧૧૦૦ની ૩II ટકાની નોટ, શેઠ પી. એ. કાકા ચેરીટી ફંડના ત્રસ્ટીઓએ મરહુમ શેઠ પીરોશા કાકા તથા મરહુમ ધણીઆણી ડોશીબાઇને નામે ખોલેલાં ખાતાંમાં ઉમેરવા રૂ૧૦૦૦ની ૩II ટકાની નોટ, શેઠ જેહાંગીર બ. પીટીટે રૂ૧૦૦૦ની ૩II ટકાની નોટ, ખા૦ બા૦ અરદેશર દો. દેવીપરવાળાએ

રૂ૧૦૦૦ની ૩ાા ટકાની નોટ, શેઠ રૂસતમજી મ. કુકાએ રૂ૧૦૦૦ની ૫ ટકાની વોર લોન, શેઠ બીખાજી તથા મનચેરશા ૫. ખાને પીતાજી ૫રામજીની યાદમાં રૂ૧૦૦૦ની ૩ાા ટકાની નોટ, શેઠ પેસતનજી દી. ખાને મરહુમ બાવાજી દીનશાહજીની યાદમાં રૂ૧૦૦૦ની ૩ાા ટકાની નોટ, શેઠ કાવસજી દા. દુબાસે મરહુમ ધણીઆણી દીનબાઇના પુન સારૂં રૂ૧૦૦૦ની ૩ાા ટકાની નોટ, શેઠ માણેકજી પા. તલાટીએ રૂ૧૦૦૦ની ૩ાા ટકાની નોટ, શેઠ સોરાબજી રૂ. સુબેદારે મરહુમ દીકરી જરબાઇ જ. શરાફના પુન સારૂં રૂ૧૦૦૦ની ૩ાા ટકાની નોટ, બાઇ બચુબાઇ મહેરવાનજી સોરાબજી જીજીભાઇએ મરહુમ માતાજી લેડી સાકરબાઈ દી. પીટીટની યાદમાં રૂ૫૦૦ની ૩ાા ટકાની નોટ, ડા૦ બરજોરજી સો. શરાફે મરહુમ પીતાજી સોરાબજીની યાદમાં રૂ૫૦૦ની ૩ાા ટકાની નોટ, બાઇ હુમાબાઈ ૫. કામાએ રૂ૫૦૦ની ૩ાા ટકાની નોટ, શેઠ હોરમસજી બા. ગઝદરે રૂ૫૦૦ની ૩ાા ટકાની નોટ, મરહુમ શેઠ મનચેરજી કા. મરઝબાનની યાદમાં દીકરા તથા દીકરીના છોકરાંઓએ રૂ૫૦૦ની ૩ાા ટકાની નોટ, શેઠ ખરશેદજી ન. સાહેરે મરહુમ શેઠ નવરોજી જ. ગામડયાની યાદમાં તેવણના મરહુમ બેન પીરોજબાઇની પુંજીમાંથી ધરમ ખાતે આપેલી રકમમાંથી રૂ૫૦૦ની ૩ાા ટકાની નોટ, બાઇ શીરીનબાઈ ડોસાભાઇ કરાકાએ મરહુમ બાવાજી ડોસાભાઇ તથા માતાજી બીખાઇજીની યાદમાં રૂ૫૦૦ની ૩ાા ટકાની નોટ, બાઇ ધનબાઇજી જાલભાઇ શેઠે મરહુમ માતાજી આઇમાયનાં પુન સારૂં રૂ૫૦૦ની ૩ાા ટકાની નોટ, શેઠ રૂસતમજી ધ. પટેલે રૂ૫૦૦ની ૩ાા ટકાની નોટ, શેઠ નશરવાનજી દા. દાદીશેઠે રૂ૫૦૦ની ૩ાા ટકાની નોટ, લેડી માણેકબાઈ હો. મોદીએ રૂ૫૦૦ની ૩ાા ટકાની નોટ, અને શેઠ અરદેશર ૫. વકીલે રૂ૫૦૦ની ૩ાા ટકાની નોટ; એ ઉપરાંત એ મંડળીને લગભગ રૂ૮૭૦૦૦ની બક્ષેશ મલી હતી તેમા નીચલી મુખ્ય રકમો છે :— શેઠો બેહરામજી જમશેદજી તથા જેહાંગીર ન. ગામડયા તે શેઠ ન. જા. ગામડયાના ટ્રસ્ટીઓએ માણેકબાઇ ગામડયાની નિશાળના મરામત ફંડમાં રૂ૧૨૫૦૦ ની લોન, શેઠ નવરોજજી બા. ટચકસએ રૂ૧૨૦૦૦ના સેંટ્રલ મીલના પ્રેફરંસ શેરનું બ્યાજ ગરીબ વિદ્યાર્થીઓને ભોજન વગેરેમાં ખરચવા, શેઠ અરદેશર હો. વહાડયા ચેરીટી ફંડમાંથી ચાલુ ખરચમાં બ્યાજ વાપરવા રૂ૩૬૦૦, બાઈ માણેકબાઇ જે. વાચ્છા ચેરીટી ફંડના ટ્રસ્ટીઓએ એકેડમી વરગના ખરચ માટે રૂ૩૬૦૦, શેઠ દીનશાહ હોરમસજી પાત્રીએ ભાણેજ માણેક એ. એલચીદાણાના પુન માટે ચંદનવાડીની માણેકબાઇ ગામડયા નિશાળમાં ફરનીચર મુકાવવા રૂ૨૩૦૦, શેઠ પેસ્તનજી નશરવાનજી કેરાંવાલાએ શિક્ષક બાઇઓને પગારના વધારામાં આપવા (નવ માસના) રૂ૧૫૩૦ અને ગરીબ નાટવાન બાળકીઓને એગ્યુમીક્સ્ચર પાવા રૂ૭૯૦, શેઠ જમશેદજી અ. વહાડયાએ ચાલુ ખરચમાં બ્યાજ વાપરવા રૂ૧૫૦૦, શેઠ તેમુરસ રૂસ્તમજી કામાએ માતાજી નવાજબાઈના પુણ સારૂં બ્યાજ વાપરવા રૂ૧૫૦૦, શેઠ ફરામજી જમશેદજી કઠોકે મરહુમ ધણીઆણી આઇમાયના પુણ સારૂં ચાલુ ખરચમાં બ્યાજ વાપરવા રૂ૧૫૦૦, શેઠ જેહાંગીર મ. મારતરે મરહુમ ધણીઆણી શીરીનબાઇના પુણ સારૂં રોકડ રકમનાં ઈનામ આપવા બ્યાજ વાપરવા રૂ૧૦૦૦, શેઠ એદલજી ફ. દાવરે પિતાજી ફરામજીની યાદમા ચાલુ ખરચમાં બ્યાજ વાપરવા રૂ૪૫૦૦, શેઠ બેહરામજી હી. વોરડને માતાજી રતનબાઇના પુણ સારૂં ચાલુ ખરચમાં બ્યાજ વાપરવા રૂ૧૦૦૦, શેઠ સોરાબજી એદલજી વોરડને ધણીઆણી સુનાબાઇના પુણ સારૂં ચાલુ ખરચમાં બ્યાજ વાપરવા રૂ૧૦૦૦, મંડળીના સભાસદોના વારષિક લવાજમના રૂ૯૫૮, શેઠ માણેકજી પા. તલાટીએ મરહુમ શેઠ સોરાબજી પે. સાહુના પુણ સારૂં ચાલુ ખરચમાં બ્યાજ વાપરવા રૂ૫૦૦, શેઠ બાપુજી પા. લાલકાકાએ ભોજન ફંડમાં બ્યાજ વાપરવા રૂ૫૦૦, શેઠ નાનાભાઇ હોરમસજી મુસે ભોજન ફંડમાં બ્યાજ વાપરવા રૂ૫૦૦, શેઠ ફરામરોઝ દી. તારાપોરવાલા તથા બાઈ જરબાઈ ફ. તારાપોરવાલાએ મરહુમ શેઠ રૂસ્તમજી કું. મોદીની યાદમા ફ્રી સ્ટુડંટશીપમાં બ્યાજ વાપરવા સારૂં રૂ૫૦૦, શેઠ નશરવાનજી મ. કામા તથા શેઠ જમશેદજી બે. રાણાંએ મરહુમ બાઇ આવાંબાઇ બે. કામાની યાદમા ફ્રી સ્ટુડંટશીપમાં વાપરવા રૂ૮૦૦, શેઠ મેહરવાનજી મ. કામાએ

મરહુમ બાઇ હોરમસજીના પુણ્ સારૂં રૂ૫૦૦, મરહુમ શેઠ નવરોજજી જા. ગામડયાના પુણ્ સારૂં સાહેબજાદાઓએ રૂ૫૦૦૦, શેઠો રૂસ્તમજી તથા નશરવાનજી ના. બોઇસ રૂ૩૦૦૦, શેઠ શાવકશાહ બહમનજી દુબાશ રૂ૩૦૦૦, શેઠ નશરવાનજી જે. વહાડયા ચેરીટી ફંડમાંથી રૂ૩૦૦૦, શેઠ સોરાબજી રતનજી કંત્રાકટરે મરહુમ દીકરી ખુરસેદબાઇ સા. મીસ્ત્રીના પુણ્ સારૂં રૂ૧૦૦૦, બાઇ હમાબાઇ ફ. પીટીટ રૂ૧૦૦૦, બાઈ હીરાંબાઇ જ. પીટીટે મરહુમ પિતાજી સર દીનશાહ મા. પીટીટ પહેલા બારોનેટના પુણ્ સારૂં રૂ૧૦૦૦, શેઠ પીરોજશાહ મા. કાકા ચેરીટી ફંડમાંથી રૂ૧૦૦૦, શેઠ શાવકશા રતનજી દુબાશ રૂ૧૦૦૦, શેઠો એમ. એન. ગોભાઇની કં. રૂ૫૦૦, બાઇ ગુલચેહર એરચશાહ ખરેઘટે મરહુમ માતાજી ડોસીબાઇ પે. ખરેઘાટની યાદમા નીડલ વરકના ઇનામ આપવા માટે વ્યાજ વાપરવા રૂ૫૦૦, બાઇ હોમાય સોરાબજી શેઠનાએ મરહુમ ખાવીંદની યાદમાં રૂ૫૦૦ની ૩ા ટકાની નોટ ફ્રી સ્ટુડંટ શીપમાં વ્યાજ વાપરવા, મરહુમ શેઠ ન. મા. વહાડયાના ટ્રસ્ટીઓ રૂ૧૫૦૦, મરહુમ શેઠ હોરમસજી ન. કુંપરના ધરમખાતાંના ટ્રસ્ટીઓ રૂ૮૪૧ અને બીજી રૂ૫૦૦ની અંદની રકમો ભરાઈ હતી.

આંધળાઓ માટેની વીકટોરીયા મેમોરીયલ સ્કુલને પારસીઓના મલેલા રૂ૧૦૮૦ માંની મુખ્ય રકમો:—જરથોસ્તી બાનું ૧૦૦, જરથોસ્થી રૂ૧૦૦, ખોદા સારૂ કરે રૂ૧૦૦, પારસી ફંડુએ માતાજીની યાદમાં રૂ૫૦ અને સીમપથાઇઝર રૂ૫૦.

પુણાના ગરીબ વીદયારથીઓના ફંડમાં ભરાયલા રૂ૬૦૭૯ માની મુખ્ય રકમો:—જરથોસ્તી રૂ૧૦૦, શેઠ બેરામજી રૂ. બે. જીજીભાઈ રૂ૧૦૦, શેઠો કાવશજી દીનશાહ ને ભાઈઓ રૂ૧૦૦, સર હોરમજી અરદેશર વાડયા રૂ૧૦૦, કલકતાના બે જરથોસ્તીઓ રૂ૫૦૧, મરહુમ બેટા વીસતારપ જા. કાબરાજીની યાદમાં રૂ૧૦૦૦, શેઠ ન. મા. વાડયાના ટ્રસ્ટીઓ રૂ૬૦૦, મરહુમ શેઠ અરદેશર અસપંદીયાર ઇરાનીની યાદમાં દીકરા સોરાબે રૂ૧૦૦, કેપટન ફીરોઝશાહ બા. ચીનાઇની યાદમાં રૂ૨૫૦, મરહુમ શેઠ મેરવાનજી મંચેરજી મુડવેવાલાના ઉઠમણામાં ભરાયલામાથી રૂ૪૭૯, શેઠ કેકોબાદ હો. રાવ રૂ૧૦૧, મરહુમ બાઇ સુનાબાઇ સો. ભરૂચાના ઉઠમણામાં બેશીઓએ ભરેલા રૂ૧૨૦૦ વ્યાજ વાપરવા, મરહુમ બાઇ આલીબાઇ પાલનજી ફ્રેંચમેનની યાદમાં બાઇઓ અને બેનો તરફથી રૂ૭૦૦ના પાંચ ટકાના બોંડ ખરીડવા રૂ૬૬૫ અને શેઠ અદી સી. પટેલ રૂ૧૦૧.

સુરત રૂસ્તમપુરાનાં ગરીબ જરથોસ્તી વિધ્યારથીઓના મદદનાં ફંડમાં ભરાયલા રૂ૪૮૦ માની મુખ્ય રકમો:—શેઠ રૂસતમજી મંચેરજી કુકા રૂ૧૨૦ અને મોમ્બાસાનાં જરથોસ્તીઓ રૂ૨૦૯.

ગોખલે એડયુકેશન સોસાયટીનાં વરકસોપને મદદ તરીકે પારસીઓના ભરાયલા રૂ૭૫૦ માની મુખ્ય રકમો:—શેઠ બાપુજી સોરાબજી પટેલ રૂ૫૦૦, શેઠ એ. જે. બીલીમોરીઆ રૂ૫૦ અને શેઠ બી. પી. નારીએલવાળા રૂ૫૦.

મુંબઇની પારસી પંચાયતને આગસ્ટ ૧૯૧૮થી જુલાઇ ૧૯૧૯ સુધી જુદાં જુદાં ધણીઓ તરફથી રૂ૫૦૦ યા તેથી વધુ મલેલા રૂપ્યાની વીગત :—બાઈ વીરબાઈજી નશરવાનજી ગાંધીએ અવલમંજલ પહોંચાડવાનાં ફંડમાં રૂ૧૦૦૦, શેઠ પેસ્તનજી ફ. કંત્રાંકટરે ખા૦ સા૦ ફરામજી કંત્રાકટરે વડોદરાના રવાનોને અવલમંજલ પોંહચાડવાના પડાવેલા ખાતાંમાં રૂ૧૯૦૦૦, શેઠ હોરમસજી ખરશેદજી દારડાએ લાચાર જરથોસ્તીઓને પગાર આપવા રૂ૫૦૦, શેઠ સોરાબજી એદલજી વોરડને અવલમંજલ પોંચાડવાના ફંડમાં રૂ૧૦૦૦, બાઇ દીનબાઇ માણેકજી બેનેટે સગડીના ભણુતર ફંડમાં રૂ૫૦૦, બાઇ રતનબાઇ કેખશરૂ મોદીએ રૂવાનોનો ચાર દીવસનો ખરચ કરવા રૂ૫૦૦, સર શાપુરજી ભરૂચાએ ખાતું પાડવા રૂ૮૦૦૦ અને બીજા રૂ૬૦૦૦, લેડી પીરોજબાઇ શા. ભરૂચાએ અવલમંજલ પહોંચાડવાના તથા સગડીના ભણુતર ફંડમાં રૂ૪૦૦૦, બાઇ દીનબાઈ મા. બેનેટે સગડીના ભણુતર ફંડમાં રૂ૫૦૦, શેઠ નશરવાનજી જાં. વાડીયાના ટ્રસ્ટડીડના ટ્રસ્ટી ડા૦ સર ટેમુલજી નરીમાને શેઠ

ન. બનં. વાડીયાનું વડોદરા ખાતે મોબેદ પાસે ક્રીયા કરવાનું ફંડ એવે નામે ખાતું પાડવા રૂ૫૦૦૦, શેઠ દોસાભાઇ મા. વાડીયાએ દીન ચારની ક્રીયાનો ખરચ કરવા રૂ૧૦૦૦, બાઇ રતનબાઈ કેખશરૂ મોદીએ દીન ચારની ક્રીયાનો ખરચ કરવાના રૂ૫૦૦, શેઠ નસરવાનજી રૂ. ચોકસીએ બાળકોને સુદરેહ પેહરાવા રૂ૫૦૦, શેઠ રૂસ્તમજી સોરાબજી કંત્રાકતરે રવાંન ફંડ, લાચાર જરથોસ્તીઓના પગાર ફંડ અને ડુંગરની સગડીમાં ભણુતર ફંડમાં રૂ૨૦૦૦, બાઇ ધનમાય ફરામજી અરજાનીએ વીધવા ફંડ તથા નવસારીના રવાન ફંડમાં રૂ૧૪૦૦, શેઠ પેસ્તનજી મા. પુંઠઆજીના વીલનાં એકઝીકયુટરોએ અવલમંજલ પોહોંચાડવાના ફંડમાં રૂ૫૦૦, શેઠ બેજનજી હોરમસજી આલબલેસે ખાતું પડાવવા રૂ૬૦૦૦, શેઠ ખમનજી કાવસજી મોદીએ નવસારીનાં અવલમંજલ પહોંચાડવાનાં ફંડમાં રૂ૫૦૦, બાઇ ધનબાઇ પેસ્તનજી હકીમજીએ આબુરોડ ને માઉન્ટ આબુની અંજુમનના ફંડમાં વ્યાજ વાપરવા રૂ૫૦૦૦ અને દેવીયરની અંજુમન ફંડમાં વ્યાજ વાપરવા રૂ૩૦૦૦, શેઠો નવરોજી તથા હોરમજી ન. દુબાશે ચોપાટીની આંબળાં પાંગળાંની ધરમશાળામાં રૂ૩૦૦૦, શેઠ બેરામજી નવરોજી ગામડયાએ બ. દી પીટીટ હાસપીટલમાં વ્યાજ વાપરવા રૂ૫૦૦૦, બ. દી. પીટીટ જનરલ હાસ્પીટલના ઓ. સેકરેટરીએ તેઓના ખાતાં માટે રૂ૧૩૦૯૦૦, ઉદવાડાના દસ્તુરજીએ ઉદવાડા આતશબેહેરામના ફંડમાં રૂ૬૩૮, ઉદવાડા અંજુમનના દવાખાનાના સરનશીને ઉદવાડાના દવાખાનાનું ફંડનું ખાતું પાડવા રૂ૪૪૫૩--૮, ઉદવાડા તથા તેને લગતા ૧૬ ફરીઆની અંજુમનનાં કારોબારીઓએ તેમના ખાતાં માટે રૂ૫૦૦, તવડીની અંજુમનના કારોબારીઓએ તેઓના ગામનું નવું ખાતું પાડવા રૂ૬૦૦૦, સુમાલી મોરા તથા દામકા વગેરે ગામોની અંજુમનના કારોબારીઓએ પોતાના ખાતામાં રૂ૪૦૦૦, નાગપોર તથા કામટીની અંજુમનના સેકરેટરીએ પોતાના ખાતામાં રૂ૬૦૦૦, જરથોસ્તી ધરમ સંબંધી કેળવણી આપનારી મંડળીના સેકરેટરીએ પોતાના ખાતામાં રૂ૧૦૦૦, તારાપોર અંજુમન ફંડના કારોબારીઓએ તેમના ખાતાંઓમાં રૂ૭૦૦૦, વેસુની અંજુમન ફંડના કારોબારીઓએ તેમના ખાતામા રૂ૪૦૦૦, માથેરાનની પારસી આરામગાહના સરનશીને તેઓના ફંડમાં રૂ૫૦૦૦, સોલાપુરની અંજુમનના ફંડમાં સેકરેટરીએ તેઓના ખાતાંમા રૂ૫૦૦, સરોડાની અંજુમનના ફંડના કારોબારીઓએ પોતાના ખાતાંમા રૂ૨૫૦૦, આચ્છા અંજુમનના કારોબારીઓએ પોતાના ફંડમાં રૂ૫૭૫, મઉની અંજુમને તેઓના ખાતાંમાં રૂ૭૦૦, ખેરગામની અંજુમને તેઓનાં ખાતાંમા રૂ૫૦૦, વલસાડ અંજુમન ફંડના ચેરમેને તેઓનાં ખાતાંમા રૂ૧૨૦૦, જહાંબારડીની અંજુમન ફંડના કારોબારીઓએ તેઓના ખાતાંમા રૂ૨૬૦૦, નવસારીના સાંગાવાડનું ધંમબાર ફંડનું ખાતું પાડવા તેના કારોબારીઓએ રૂ૮૦૦૦ અને સુરત પારસી પંચાયતનાં સરનશીને તેઓના ખાતાંમાં રૂ૧૩૦૧૦૦.

ઇરાની જરથોસ્તી અંજુમનના ફંડામાં કુલે રૂ૧૧૫૦૪૨ ભરાયા હતા, તેમાં નીભાવ ફંડમાંની મુખ્ય રકમો:—શેઠ મેરવાન ખુશરૂ રૂ૨૦૦૦, શેઠ મેરવાન રૂસ્તમ રૂ૩૦૦૦, શેઠ શાપુર કેખશરૂ રૂ૧૦૦૦, શેઠ ખોદારાય કેખશરૂ રૂ૧૦૦૦, શેઠ પેસ્તનજી ખરસેદજી રૂ૫૦૦, શેઠ બોમાસ ખોદાદાદ રૂ૫૦૦, શેઠ ખુશરૂ રશીદ રૂ૫૦૦, શેઠ ખોદારાય મરઝબાન રૂ૫૦૦, શેઠ રશીદ જમશેદ રૂ૫૦૦૦, શેઠ ગુસ્તાસ્પ ખોદાદાદ રૂ૧૦૦૧, શેઠ બેહમરદ નોશીરવાન રૂ૧૦૦૧, શેઠ કેખશરૂ બહેરામ રૂ૫૦૦, શેઠ બહેરામ સરોશ રૂ૫૦૦, શેઠ કેખશરૂ રૂસ્તમ તરફતી રૂ૧૦૫૧, શેઠ ખોદાબક્ષ શેહેરીઆર રૂ૫૫૫, શેઠ રૂસ્તમ શાહરૂખ રૂ૫૦૦, શેઠ અરદેશીર શહેરીયાર રૂ૫૦૧, શેઠ રશીદ ખોદાદાદ રૂ૧૨૦૦, શેઠ શાપુર ફરેદુન રૂ૧૦૫૫, શેઠ બેહમરદ ખોદાદાદ એદલ રૂ૫૦૧, શેઠ હોરમજદ શેહેરીયાર રૂ૫૦૦૦, અસપંદીયાર કેખશરૂ રૂ૧૫૦૦, શેઠ દીનશા મેરવાન રૂ૧૦૦૦, શેઠ અરદેશર બેહમન રૂ૧૦૦૧, શેઠ બેહમન અરદેશીર રૂ૧૦૦૧, શેઠ મેરવાન મોંદેગાર રૂ૧૦૦૧, શેઠ મેરવાન મોંદેગાર આરેસ્તાની રૂ૫૦૧, શેઠ નામદાર જામાસ્પ રૂ૫૦૧, શેઠ પીરોજશા બેરામજી રૂ૫૦૦, શેઠ ફરેદુન બોમાસ રૂ૩૦૦, શેઠ જમશેદ નામદાર રૂ૨૦૧, શેઠ જમશેદ ખોદારાય રૂ૫૦૦૦, શેઠ ફરેદુન બેરામ રૂ૫૦૧, શેઠ બહેમન મેરવાન જમશેદ રૂ૫૦૧, શેઠ બહેરામ ખોદાદાદ રૂ૩૦૧, શેઠ ગુસ્તાસ્પ મોંદેગાર રૂ૫૦૧, શેઠ માહીયાર નોશીરવાન રૂ૫૦૧, અને શેઠ હોરમઝદીયાર રૂસ્તમ રૂ૫૦૦૦; બંદર આબાસની ધરમશાળાના

ફંડની રકમોઃ—શેઠ રશીદ જમશેદ રૂ૨૦૦૧, શેઠ રૂસ્તમ ખોદાદાદ રૂ૧૦૦૧, શેઠ બેહમરદ નાશીરવાન રૂ૧૦૦૧, શેઠ ખુદારાય મરઝબાન રૂ૫૦૧, શેઠ મેરવાન રૂસ્તમ રૂ૩૦૦૧, શેઠ કેખશરૂ રૂસ્તમ રૂ૫૦૧, શેઠ અરદેશીર શેરીયાર રૂ૧૦૦૦, શેઠ ગુસ્તાસ્પ મોંદેગાર રૂ૫૦૧, શેઠ બેરામ ખોદાદાદ રૂ૧૦૦૧, શેઠ એરચ કાવસ રૂ૫૦૧, મરહુમ શેઠ ખોદાદાદ રૂસ્તમનાં ફરઝંદો રૂ૧૦૦૧, શેઠ શાપુર ફરેદુન રૂ૧૦૦૧, શેઠ જમશેદ ખોદારામ મરઝબાન રૂ૩૦૦૩, શેઠ શેરીયાર મેરવાન રૂ૧૦૦૧, બાઇ બેહમાનત રશીદ બેરામ રૂ૧૦૦૧, શેઠ તુરકે પોલાદ રૂ૫૦૧, શેઠ જમશેદ નામદાર જમશેદ રૂ૫૦૧, શેઠ કેખશરૂ મેરવાન જમશેદ રૂ૫૦૧, શેઠ હોરમજદ શેરીયાર રૂ૧૦૦૧, શેઠ દીનશા મેરવાન શેરીયાર રૂ૫૦૧, બાઇ ગુલેસ્તાન શેરીયાર રૂસ્તમ રૂ૫૦૧ અને શેઠ અસપંદીયાર કેખશરૂ રૂ૧૦૦૧; આરફનેજ ફંડમાં ભરાયલી મુખ્ય રકમોઃ–શેઠ અસપંદીયાર રશીદ રૂ૪૦૦૦, શેઠ પેસ્તનજી ડોસાભાઇ મારકર રૂ૪૧૦૦૦, શેઠ જમશેદ ખોદારામ રૂ૩૦૦૦, શેઠ ખોદાબક્ષ ખુશરૂ રૂ૨૨૨૨, અને શેઠ સોરાબજી ડો. મારકર રૂ૧૦૦૦.

જરથોસ્તી કોમના લાભ સાચવનારી મંડળીના બીલડીંગ ફંડમાં ભરાયલા રૂ૪૫૨૬૭ માની મુખ્ય રકમો :—શેઠ રૂસ્તમજી કુવરજી શેઠના રૂ૨૦૦૦૦, શેઠ બાપુજી એ. ચીનાઈ તથા બાઇ માણેકબાઇએ બેટા કેપટન ફીરોઝની યાદમાં રૂ૧૩૦૦૦, શેઠો હોરમસજી કા. દીનશાહ તથા પાલનજી ધ. પટેલ રૂ૧૪૮૪, શેઠ ટેમુરસ્પ આર. પારખ રૂ૧૦૬૦, જામે જમશેદ મારફતે મલેલા રૂ૪૫૮૨, મરહુમ શેઠ નાદરશા હો. બેલગામવાલાના ઉઠમણામાં તેવણની પુંજીમાંથી રૂ૫૦૦, તથા ધણીઆની ડોસીબાઇએ રૂ૫૦૦, મલી રૂ૧૦૦૦ની વોર લોન, શેઠો દીનશાહ સો. વોરડન તથા પાલનજી સો. વોરડન અને બાઇ બચુબાઈ ના. તારાપોરવાલાએ મરહુમ બાઇ સુનાબાઇ સો. વોરડનના પુણને માટે રૂ૧૦૦૦ની ૩॥ ટકાની લોન, મરહુમ શેઠ સોરાબજી પે. શાહના ઉઠમણામાં ભરાયલા રૂ૫૦૦ની લોન, માતપીતાજીની નઇયતે બેટાઓએ રૂ૫૦૦, જરથોસ્તી રૂ૫૦૦, શેઠ અ. દા. દાદી રૂ૨૫૦, શેઠ મ. ન. વેવઇના રૂ૨૦૦, શેઠ વહાડયાજીના આતશબેહેરામની પેટીમાંથી રૂ૨૩૭–૬–૯, શેઠ ફરેદુન બેજનજી ચલ્લાના પુણ માટે વારેસોએ રૂ૧૦૦, શેઠ ફ. બે. ચલ્લાના વારેસોએ મરહુમ બાઇ પીરોજબાઈ ફ. ચલ્લાના પુણ માટે રૂ૧૦૦ તથા મરહુમ બાઇ મેહેરબાઇ બે. ચલ્લાના પુણ માટે રૂ૧૦૦ તથા શેઠ બેજનજી મં. ચલ્લાના પુણ માટે રૂ૧૦૦ અને શેઠ હોરમસજી ખ. અવાસ્યાના પુણ માટે રૂ૧૦૦.

જરથોસ્તી કોમના લાભ સાચવનારી મંડળીના ખેતીવાડી ફંડમાં ભરાયલા રૂ૮૪૪૩માની મુખ્ય રકમો :—શેઠ હોરમસજી કા. દીનશાહ રૂ૫૦૦૦, શેઠ અરદેશર હો. મામા રૂ૨૦૦૧ અને જામે જમશેદ મારફતે મલેલા રૂ૧૩૪૨.

જરથોસ્તી કોમના લાભ સાચવનારી મંડળીના કેળવણી ફંડમાં ભરાયલા રૂ૮૧૧૨માની મુખ્ય રકમો :— શેઠ અ. હો. વહાડયાના ટરસ્ટીઓ રૂ૩૫૦૦, બાઇ ગુલબાઇ ર. કાતરકે મરહુમ શેઠ રતનજી મે. કાતરકના પુણ માટે રૂ૧૦૦૦નો ૫॥ ટકાનો વોર બોંડ, જામે જમશેદ મારફતે મલેલા રૂ૮૬૫ શેઠ પેસ્તનજી ન. કેરાંવાલા રૂ૬૯૭, શેઠ અરદેશર બ. ગોદરેજ રૂ૫૦૦, એક દોસ્તે શેઠ સો. પે. શાહની યાદમાં રૂ૫૦૦, શેઠ નાદરશાહ સો. મુગાશેઠ રૂ૩૫૦, શેઠ ફીરોઝશાહ કુંવરજી મીસ્ત્રી રૂ૧૫૦ શેઠ માણેકજી પે. ભરૂચા રૂ૧૫૦, યોકોહામા બેંકના જરથોસ્તીઓ રૂ૧૦૦, શેઠ રૂસ્તમજી મ. કુકા રૂ૧૦૦ અને એક પારસી રૂ૧૦૦.

જરથોસ્તી કોમના લાભ સાચવનારી મંડળીના વરક કલાસ ફંડમાં ભરાયલા રૂ૩૪૭૮માં, શેઠ ન. મા. વહાડયાના ટરસ્ટીઓ રૂ૧૮૦૦, શેઠ રૂસ્તમજી સો. કંટ્રાકટરે બેટીના પુણ માટે રૂ૧૦૦૦ તથા ધણીવાણીના પુણ માટે રૂ૫૦૦ અને જામે જમશેદ મારફતે મલેલા રૂ૧૩૮; સુદલ ભાવે અનાજ વેચવાનાં શેઠ ફંડમાં જામે જમશેદ મારફતે મલેલા રૂ૨૧૪૭ અને શેઠો કાવસજી દીનશાહ તથા ભાઇઓ રૂ૫૦૦; ઇન્ડસ્ટ્રીઅલ ઇન્સ્ટીટયુટ ફંડમાં ભરાયલા રૂ૧૨૫૭માની મુખ્ય રકમો :— જામે જમશેદ મારફતે મલેલા રૂ૬૮૭ અને શેઠ રૂસ્તમજી નાદરશાહ એ. દીનશાહના પુણને માટે

રૂ૫૦૦ના વોર બોંડ; લડાઇ બેકારી ફંડમાં પરચુરન રકોમાના રૂ૧૦૧૭ ભરાયલા હતા; પીટીટ બાહેરકોટ ઇમ્પરૂવમેન્ટ લાઇબ્રેરી ફંડમાં ભરાયલા રૂ૪૪૦–૮માં જ. ન. પીટીટ લાઇબ્રેરીની રૂ૧૨૦૦૦ની જામીનગીરીનું ૧૯૧૮ નું વ્યાજ રૂ૪૦૨–૧૦ અને શેઠ ફ. દી. પીટીટે આપેલી રૂ૧૦૦૦ની લોનનું વ્યાજ રૂ૩૭–૧૪, જરથોસ્તીઓને ધંધે લગાડવાના શેઠ એદનવાલા લોન ફંડમાં ભરાયલા રૂ૪૦૬માં હમદીનોને ધંધામાં ધીરવા સારૂં રૂ૩૫૦ અને જામે જમશેદ મારફતે મલેલા રૂ૫૬; જેનરલ ફંડમાં ભરાયલા રૂ૧૪૫માં શેઠ ખ. દા. દાદી રૂ૧૦૦, અને જામે જમશેદ મારફતે મલેલા રૂ૪૫ અને હુન્નર ઉદ્યોગ ફંડમાં જામે જમશેદ મારફતે રૂ૬૧ મલ્યા હતા.

ગરીબ જરથોસ્તીઓના રહેઠાણ ફંડમાં રૂ૨૯૮૩૫ ભરાયા હતા, એમાં મરહુમ શેઠ નવરોજી જા. ગામડયાના એક્ઝીક્યુટરોએ શેઠ રૂસ્તમજી ન. ગામડયાના પુણ્ સારૂં એક મકાન બાંધવા રૂ૧૭૦૦૦; શેઠ ધનજીભાઇ એ. આલબલેશનાં ધરમનાં દવાખાણાંનાં ફંડમાં ભરાયલા રૂ૧૦૪૮માંની મુખ્ય રકમો:–બાઇ ધનમાએ ફ. અરજાંનીએ ધણી ફરાંમજીનાં પુણ્ સારૂં રૂ૧૦૦, બાઇ મોટીબાઇ ફ. આલબલેશે ધણી ફરદુનજીની યાદમાં રૂ૧૦૦, શેઠ હોરમશજી એ. આલબલેશે જમાઇ જમશેદજી અ. ચીનાઇનાં પુણ્ સારૂં રૂ૫૦૦ની ૩॥ ટકાની લોન, અને બાઇ બીખાઇજી જ. ચીનાઇએ ધણી જમશેદજીની યાદમાં રૂ૧૦૧, શેઠ ન. મા. વાહડયાના ત્રસ્તીઓએ બાઇ રતનબાઇ ફ. પાંડેની નીશાળને રૂ૧૨૦૦, અને મરહુમ શેઠ જાંહગીરજી ધ. મુગાશેઠના બેટાઓએ મમાઇજી ગુલબાઇ મ. મરઝબાંનનાં પુણ્ સારૂં ઇનાંમો આપવા રૂ૫૦૦નાં બોંડો આપ્યા હતા.

જરથોસ્તી ધરમ સંબંધી કેળવણી આપનારી અને જ્ઞાન ફેલાવનારી મંડળીને મલેલા રૂ૧૨૧૫–૪માની મુખ્ય રકમો:—શેઠ ફરામજી હો. અરજાનીનાં પુણ્ માટે બાઇ ધનમાય ફ. અરજાણીએ રૂ૧૦૦, શેઠ મેરવાનજી મ. કામા તે શેઠ ફ. મ. કામાના ધરમખાતાંના ત્રસ્ટી રૂ૧૦૦, બાઇ હીરાંબાઈ જ. પીટીટ રૂ૧૦૦, શેઠ નસરવાનજી મં. કામાના ધરમખાતાંના ત્રસ્ટીઓ રૂ૧૦૦, શેઠ ન. મા. વાડીઆના ત્રસ્ટીઓ રૂ૩૦૦, અને મરહુમ બાઇ માણેકબાઇ હો. એદનવાલાની યાદમાં શેઠ હોરમજી કા. દીનશાહે રૂ૩૫૦.

અથોરનાન મંડળના સામાન્ય ફંડમાં ભરાયલા રૂ૧૩૦૧–૧૫માની મુખ્ય રકમો:—ફંડની પેટીમાંથી રૂ૪૮૮, સેનટ્રલ બેંકનાં જરથોસ્તીઓ રૂ૧૫૪, શેઠ દીનશાહ મે. ઇરાની રૂ૧૫૧, શેઠ જાંગીરજી બી. દલાલ રૂ૧૦૧, શેઠ માનેકજી પે. ભરૂચા રૂ૧૦૧ અને શેઠ મનચેરજી પે. ખરેગાંટ રૂ૧૦૦, આ ફંડમાં કુલે રૂ૬૦૫૯–૧૦–૩ ભરાયા હતા; બોરડીંગ-સ્કુલ ફંડમાં ભરાયલા રૂ૨૪૭૭–૧૪માની મુખ્ય રકમો:—શેઠો ફરામરોઝ અને કાવસજી તથા બાઇઓ મેહરબાઇ અને આલાંમાય તરફથી મરહુમ શેઠ પેસ્તનજી ફ. સરાફની યાદમાં રૂ૭૦૦, મરહુમ માતાજી તથા પીતાજીની નઇયતે દીકરાએ રૂ૫૦૦, બાઈ ધનબાઈ ફ. અરજાણીએ શેઠ ફ. હો. અરજાણીના પુણ્ માટે રૂ૫૦૦, મરહુમ એરવદ બેહરામજી પે. કુકાની પુંજીમાંથી ઉઠમણામાં ભરાયલા રૂ૧૦૧ અને ફંડની પેટીમાંથી રૂ૩૬૪, આ ફંડમાં કુલ્લે રૂ૨૮૭૭૪–૧૪ ભરાયા છે; મરહુમ જસ્તીસ દાવરની બાજના ફંડમાં પરચુરન રકમો મલી રૂ૧૪૮–૮ ભરાયા હતા, આ ફંડમાં કુલ્લે રૂ૬૧૦–૧૩ ભરાયા છે.

મુંબઇની જરથોરતી જશન કમીટીને હોલ બાંધવા શેઠો રૂસ્તમજી તથા નશરવાનજી ના. બોઇશે આગળ આપેલા રૂ૧૫૦૦૦માં બીજા રૂ૫૦૦૦વધુ આપ્યા હતા, જરથોસ્તી ધરમ ને નીતીની કેળવણી ફંડમાં ભરાયલા રૂ૯૮૪૭માની મુખ્ય રકમો:—શેઠ જમશેદજી અ. ચીનાઈ રૂ૫૦૦૦, મરહુમ બાઇ શીરીનબાઇ લી. બાટલીબોઇની યાદમાં જરથોરતી બાનુએ રૂ૧૦૦૦, શેઠ સો. ફ. ગજદરના કુટુંબે બપાઇ સુનાંબાઇના ઉઠમણામાં ભરેલા રૂ૫૦૧, શેઠ હોરમસજી ડો. ગજદર રૂ૨૫૧, શેઠ પીરોજશાહ સો. ગજડર રૂ૫૦૧, શેઠ હોરમજી કાવસજી દીનશાહ રૂ૫૦૦, શેઠ અરદેશર હો. મામા રૂ૧૦૦૧ અને શેઠો રૂસ્તમજી તથા નશરવાંનજી ના. બોઇસ રૂ૧[illegible], એ ઉપરાંત જશન ફંડમાં પરચુરન રકમોના રૂ૨૩૪૮, દીસા પ્રાઇઝ ફંડમાં રૂ૯૭૮ અ[illegible]ીરદોસી ફંડમાં રૂ૭૪૮ ભરાયા હતા.

શેહેનશાહી જશન મંડળીને ડોનેશન તરીકે પરચુરણ રકમોના રૂ૯૭૬ મલયા હતા.

પારસી એમબ્યુલન્સ ડીવીઝન ફંડમાં ભરાયલા રૂ૭૬૧૭–૪માની મુખ્ય રકમો:—શેઠો તાતા સન્સની કં. રૂ૫૦૦, શેઠ એન. એમ. વાડયાના ત્રસ્તીઓ રૂ૫૦૦, સર દોરાબ જે. તાતા રૂ૩૦૦, શેઠ સોરાબ આર. મોદી રૂ૨૦૦ અને શેઠ અરદેશર બી. લીંબુવાલા રૂ૨૦૦.

જામે જમશેદ હસ્તકના કુનુર ખાતે હડખાં કુતરાંના એલાજ માટે જતા જરથોસ્તીઓ સારૂ બલોક બાંધવાના ફંડમાં પરચુટણ રકમોના રૂ૭૭૦ ભરાયા હતા.

જામે જમશેદ હારીસ હસ્તકના ગરીબ જરથોસ્તીઓને મદદ કરવાના ફંડમાં ભરાયલા રૂ૨૫૯૯૦માની મુખ્ય રકમો:—ફ. રૂ. બી. રૂ૨૦૦, બેલગામ ખાતે પપેતીને દહાડે જરથોસ્તીઓએ ભરેલા રૂ૫૮૧, શેઠ પીરોશાહ જમશેદજી રૂ૧૫૧, શેઠ ફ. હો. અરજાનીના ઉઠમણામાં ભરાયલામાંથી રૂ૩૦૦, મીસીસ એમ. બી. દાદાભાઇ રૂ૨૦૦, રોજીંદી મનસનીના પુસ્તકના વેચાણના ઉપજેલામાંથી શેઠ દી. મે. ઇરાનીએ રૂ૩૦૦, મરહુમ વાહાલાઓની યાદમાં રૂ૧૫૦, શેઠ જમશેદજી અ. ચીનાઇ રૂ૫૦૦ બાઇ ગુલબાઈ સોરાબજી દુબાશ રૂ૩૦૦, શેઠ પેસ્તનજી ભીખાજી દુબાશ રૂ૨૦૦, શેઠ ખુશરો રૂ૨૭૦, કોલંબોના વેપારી રૂ૩૦૦, જરથોસ્તી રૂ૩૨૦, શેઠ નવરોજી બાપુજી તચકરા રૂ૧૨૦૦, શેઠ બેરામશાહ કે. ઇલાવ્યા રૂ૫૦૦, બદરીદા રૂ૨૦૦, મરહુમ માતપીતા હોરમજી અને પીરોજબાઇની યાદમાં એફ. એચ. બોઇસે રૂ૧૦૦૧, શેહેનગાહીની અંજુમન ફંડમાંથી ૫૦૦ ટેલ તથા બીજા જરથોસ્તીઓએ ભરેલા ૬૫૬ ટેલ મલી ૧૧૫૬ ટેલના રૂ૪૦૬૩–૫–૫, બાઇ હીરાંબાઈ કુ. ઇજનેર રૂ૨૦૦, શેઠ રતનજી ન. ભેદવાર રૂ૨૭૫, જરથોસ્તી બાનુ રૂ૨૦૦, જરથોસ્તી બાઇએ માય, બાપ તથા બેટીની નઇયતે રૂ૨૦૦ અને શેઠ હોરમજી ન. બેલગામવાળા રૂ૧૫૦.

જામે જમશેદ હસ્તકના ડા૦ બહાદુરજી દેવલાલી સેનેટરીયમના બીમારોને ખાધ ખોરાકી વગેરે આપવાના ફંડમાં ભરાયલા રૂ૪૩૭૪માની મુખ્ય રકમો:— કોલંબોનો વેપારી રૂ૧૦૦, બાઇ કુંવરબાઇ રૂ. કંત્રાકટરના ઉઠમણામાં ભરાયલામાંથી રૂ૫૦૦, ખા. બા. ધનજીશાહ હો. કરાકાની યાદમાં ધણીયાણી માણેકબાઇએ રૂ૧૦૦, મરહુમ શેઠ નશરવાનજી શા. પોચાના પુણ માટે બાઇ આવાંબાઈ પોચાજી પોચાએ રૂ૧૨૦, શેઠ ફ. પે. વાધલા કુપરના ઉઠમણામાં ભરાયલા રૂ૧૦૦, માતાજીની યાદમાં રૂ૧૦૦, એ. એચ ઉદવાડયા રૂ૨૦૦, મરહુમ સાસુજી પુતલીબાઇ હો. ભીવંડીવાલાના ઉઠમણામાં વહુ ડોશીબાઇએ ભરેલા રૂ૧૦૦, શેઠ રતનજી ડો. પટેલના પુણ માટે બાઈ શીરીનબાઇ એ. ડાકટરે રૂ૧૦૮, લવ રૂ૧૦૦, બેટી જરબાઇ જા. શરાફની, બાઇ દીનબાઈ જા. શરાફની અને બાઇ આઇમાય રૂ. ગોટલાની યાદમાં રૂ૧૦૦, મરહુમ બાવાજી બરજોરજી દી. લામની યાદમાં દીકરા બાપુજીએ રૂ૧૦૦, મરહુમ શેઠ પા. પે. વાધલા કુપરના ઉઠમણામાં ભરાયલા રૂ૫૦૦, મરહુમ શેઠ સોરાબજી પે. શાહના પુણ માટે રૂ૫૦૦ની લોન, બાઇ જરબાઇ ધનજીભાઇ કંત્રાકટરે રૂ૧૦૦૧, જરથોસ્તી રૂ૧૦૧, ડા૦ જાલ જ. નાદરશાહના પુણ માટે દોસ્તો તથા વખાણનારાઓએ રૂ૧૧૫ અને કોલંબોનો વેપારી રૂ૧૦૧; આ ફંડમાં બધા મલી કુલે રૂ૩૧૧૭૪ ભરાયા છે.

જામે જમશેદ હસ્તકના ડા૦ બહાદુરજી દેવલાલી સેનેટરીયમનાં ફંડમાં પરચુટણ રકમોના મલી રૂ૧૬૭૮ ભરાયા હતા.

જામે જમશેદ હસ્તકના ન. મા. પીટીટવાલા દીવાનાઓના ફંડમાં ભરાયલા રૂ૨૧૮૫માની મુખ્ય રકમો:—શેઠ ફરદુનજી પે. જાલનેવાલાની યાદમાં ધણીયાણી પીરોજબાઇએ રૂ૧૦૦, કોલંબોનો વેપારી રૂ૧૦૦, માતાજીની યાદમાં રૂ૧૦૦, શેહેનગાહીની અંજુમનના ફંડમાંથી રૂ૩૦૦, શેઠ કાવશજી ફ. શેઠનાની યાદમાં રૂ૧૦૦ અને કોલંબોનો વેપારી રૂ૧૦૧.

પારસી પંચાયત તરફથી પગાર મેળવતા જરથોસ્તીઓના મોંઘવારીના ફંડમાં પરચુટન રકમોના રૂ૮૩૬ અને સંકટ નીવારણ ફંડમાં રૂ૪૨૮ ભરાયા હતા.

પારસી પંચાયત હસ્તકના સસ્તો અનાજ આપવાનાં ફંડમાં ભરાયલા રૂ૩૧૧૨૮માની મુખ્ય રકમો:—શેઠ પેસ્તનજી પી. ડાકટર રૂ૧૫૦, મરહુમ બાવાજી તથા માતાજીનાં પુણ માટે દીકરા જાં. સા. ગજદરે રૂ૨૦૦, સર જમશેદજી જીજીભાઇ બારોનેટ રૂ૫૦૦, સર કાવસજી જાં. બારોનેટ રૂ૧૦૦૦, શેઠ મનચેરજી પે. ખરેગાટ રૂ૫૦૦, સર હોરમસજી અ. વાડીઆ રૂ૫૦૦, શેઠ જાંહાગીર બ. પીટીટ રૂ૫૦૦, શેઠ કાવસજી જાલભાઇ શેઠ રૂ૫૦૦, ઓનરેબલ સર દીનશાહ મા. પીટીટ બારોનેટ રૂ૧૦૦૦, શેઠ કાવસજી દા. દુબાશ રૂ૫૦૦, શેઠો સોરાબજી અને કાવસજી દા. દુબાશે શેઠ મેરવાનજી મં. મુઢવેવાલાના ઉઠમણામાં ભરેલા રૂ૫૦૧, શેઠ પેસ્તનજી કાવસજી શેઠના રૂ૫૦૦, બાઇ

સુનાંબાઈ મીનોચેર વકીલ રૂ૨૦૦, મરહુમ શેઠો દીનસાજી તથા ફ્રરામજી ભી. ખાંનનાં પુણ માટે રૂ૫૦૦, જરથોસ્તી રૂ૧૫૧, શેઠો કાવસજી દીનશાહ તથા ભાઇઓ રૂ૫૦૦, શેઠ હોરમસજી પોંચાજી પોંચાની યાદમાં રૂ૨૦૦, ખાકસાર રૂ૨૦૦, જરથોસ્તી રૂ૨૦૦, શેઠો મેરવાનજી તથા હોરમસજી કામા રૂ૫૦૦, બાઇ બચુબાઇ મે. સો. જમશેદજી રૂ૧૫૧, બાઇ માણેકબાઇ પી. બ. જીજીભાઇ રૂ૨૦૦, બાઇ હીરાંબાઇ જ. પીટીટે મરહુમ બેહેન હમાબાઇ ફ. કામાની યાદમાં રૂ૩૦૦, શેઠ ધનજીભાઇ એ. આલબલેસે દીકરા પીરોજશાનાં પુંણ સારૂં કીધેલા ત્રસ્ટમાંથી રૂ૨૫૧, શેઠ એદલજી ૫. આલબલેસના છોકરાઓ રૂ૫૦૧, શેઠ પી. મા. કાકાના ધરમખાતાંના ત્રસ્ટીઓ રૂ૩૦૦. D. C. T. રૂ૨૦૦, D. D. C. રૂ૫૦૧, જરથોસ્તી રૂ૨૦૦, શેઠ ન. મા. વાડીઆ અને બાઇ મોટલીબાઇ ન. વાડીઆનાં પુંણ સારૂં શેઠ ન. મા. વાડીઆના ત્રસ્ટીઓ રૂ૫૦૦૦, મરહુમ બેન નવાજબાઇ બે. વસઇગરાનાં પુંણ માટે રૂ૫૦૧, શેઠ ન. ન. વાડીઆ ચેરીટી ફંડનાં ત્રસ્ટીઓ રૂ૧૦૦૦, શેઠ કા. સો. પાંઉવાલા રૂ૨૫૦, શેઠ રૂસ્તમ સો. પાંઉવાલા રૂ૨૫૦, શેઠ રતનજી જ. દુબાસ રૂ૨૫૧, એસ. એમ. રૂ૩૫૦, ધણી પીતાજી માતાજી તથા ભાઇજીની યાદમાં રૂ૩૦૧, એમ. એમ. બાટલીવાલાની કં. રૂ૨૦૦, બોમ્બે નેશનલ કલબના મેમ્બરો રૂ૨૦૧, શેગહાઇની અંજુમનના ધરમનાં ફંડમાંથી તથા ત્યાંના જરથોસ્તી ભાઇઓએ મલી રૂ૨૫૦૦, શેઠ ફ. કા. મારકરના ચેરીટી ત્રસ્ટના ત્રસ્ટીઓ રૂ૩૦૦, એમ. બી. કે. રૂ૨૦૦, શેઠ અ. હો. વાડીઆના ધરમખાતાંના ત્રસ્ટીઓ રૂ૫૦૦, જરથોસ્તી રૂ૨૦૦, શેઠ જમશેદજી ન. તાતાની યાદમાં રૂ૨૨૧, જરથોસ્તી આશીસ રૂ૫૦૧, Sympathisers રૂ૨૦૦ અને જરથોસ્તી રૂ૨૦૧.

ખેતવાડીના ગરીબ જરથોસ્તીઓને સસતો અનાજ આપવાના ફંડમાં ભરાયલા રૂ૩૪૬૦૮ માની મુખ્ય રકમો:—સર શાપુરજી બ. ભરૂચા રૂ૨૦૦૦, શેઠ સોરાબજી ડો. મારકર રૂ૫૦૧, શેઠો પારખ ને પરભુ રૂ૫૦૧, કુટંબ રૂ૩૦૧, શેઠ ફરામરોજ એફ. બેસાનીઆ રૂ૫૦૧, શેઠો નશરવાનજી ખ. બેસાનીઆ કં. રૂ૨૦૧, શેઠો આર. પી. શરાફ એંડ સનસ રૂ૨૦૧, શેઠો અરદેશર, તથા દારબશાહ બમનજી દુબાશ રૂ૩૦૧, શેઠ મોટાભાઇ બિ. દારૂખાનાવાળા રૂ૨૦૧, શેઠો જીવણજી જમાસજીની કં. રૂ૨૫૧, જરથોસ્તી રૂ૨૦૧, શેઠ પાલનજી શાપુરજી મીસ્ત્રી રૂ૧૫૧, શેઠ સોરાબ પી. શરાફ રૂ૫૦૧, શેઠ નવરોજી ખ. લાકડાવાલા રૂ૫૦૧, શેઠ સોરાબજી ન. ગામડીઆ રૂ૧૫૧, શેઠ દીનશાહ કું. પંડોલ રૂ૨૦૧, જરથોસ્તી રૂ૨૦૧, શેઠ ધનજીભાઇ બ. પટેલ રૂ૧૫૧, ખા. સા. રતનજી જ. દુબાશ રૂ૨૦૧, શેઠ એમ. એમ. બાટલીવાલા રૂ૨૦૦, શેઠ ન. મા. વાડયાના ત્રસ્ટીઓ રૂ૨૦૦૦, શેઠ જ. બ. પીટીટ રૂ૧૫૦, જરથોસ્તી રૂ૧૫૦, શેઠ એચ. એમ. મેહેતા રૂ૨૦૦, શેઠ કે. આર. વાચ્છા અને ધણીયાણી રૂ૧૫૦, મરહુમ શેઠ નવરોજી વ. ગોલવાળાની નઇયતે શેઠ લીમજી બ. મીસતરીએ રૂ૨૦૦૦, બાઈ હમાબાઇ ફ. પીટીટ રૂ૨૦૦, બાઈ હીરાબાઇ જ. પીટીટ રૂ૧૫૦, શેઠો કાવસજી દીનશાહ ને ભાઇઓ રૂ૫૦૦, સર કાવસજી જહાંગીર રૂ૨૦૦, શેઠ કાવશાહ સો. પાઉવાલા રૂ૧૫૦, શેઠ રૂસતમ સો. પાઉવાલા રૂ૧૫૦, બાઈ સુનાબાઇ ધનજીશાહ મેહતાના ઉઠમણામાં ભરાયલામાંથી રૂ૨૫૦, તબીબ રૂ૨૫૦, મરહુમ બાઇ નવાજબાઇ સો. મારકરના ઉઠમણામાં ભરાયલામાંથી રૂ૫૦૧, શેઠ સોરાબજી મે. કાતરક રૂ૧૫૦, મરહુમ શેઠો દીનશાહજી તથા ફરામજી ભી. ખાનના પુણ માટે રૂ૩૦૧, શેઠો કાવસજી દીનશાહ ને ભાઇઓ રૂ૭૦૦, શેઠ સોરાબજી દાદાભાઇ દુબાશ રૂ૨૦૦, પરેશીઅસ સીનેમેટોગ્રાફના માલેક શેઠ નશરવાનજી ન. એનજીનીયરે કરેલા ખેલની આવકના રૂ૭૫૦ અને પોતા તરફથી રૂ૨૫૧ મલી રૂ૧૦૦૧, અને સીનેમાંના શોમાં પારસી બાલકીઓએ પેટીમા એકઠા કરેલા રૂ૧૮૭–૪–૬, સર શાપુરજી બ. ભરૂચા રૂ૫૦૦૦, મરહુમ શેઠ હોરમજી સો. ભરૂચાના ઉઠમણામાં ભરાયલા રૂ૧૦૦૦, શેઠ પાલનજી પે. વાચ્છા કુપરની પુંજીમાંથી ઉઠમણામાં ભરેલા રૂ૫૦૦, શેંગાઇની જરથોસ્તી અંજુમન રૂ૨૦૦, સીમપથાઇઝર રૂ૨૦૦, ઈરાની ભાઇઓ રૂ૨૫૦ અને બાઇ બાંનુંબાઈ ધ. કંત્રાકટર રૂ૫૦૦.

ગરીબ જરથોસ્તીઓને મુફ્ત અનાજ આપવાના ફંડમાં ભરાયલા રૂ૧૮૫૫માની મુખ્ય રકમો:- **બાઇ શીરીનબાઈ અ. બીલીમોરીયા રૂ૧૫૦, દીકરા મીનોચેરની યાદમાં માતાજી જરબાઇ એ. ગઝદરે રૂ૧૦૦,** જરથોસ્તી બાનું રૂ૧૦૦, શેઠ દારાશા મં કાપડવાલા રૂ૧૦૧, શેઠ મંચેરજી પા. કંત્રાકટર રૂ૧૦૦, યાકોહામા બેંકના જરથોસ્તીઓ રૂ૧૦૦, બાઇ કુવરબાઇ રૂ. વાલેશની યાદમાં કે. ફ. વાલેસે રૂ૧૦૧ અને શેઠ જાંહાગીરજી જ. ચીનાઇ રૂ૧૦૦.

બીલીમોરાનાં જરથોસ્તીઓને સસતા ભાવે અનાજ આપવાના ફંડમાં ભરાયલા રૂ૫૭૬૭માની મુખ્ય રકમો :—શેઠ રતનજી શા. તાતા રૂ૧૦૦૦, શેઠ બરજોરજી ન. મેંગુસી રૂ૧૦૦૦, શેઠ ફ્રામરોજ કે. પટેલ રૂ૨૫૨, મરહુમ શેઠ કેખશરૂ હો. પટેલની નઇયતે રૂ૨૩૫, શેઠ પીરોજશાહ જી. વાંશણીઆ રૂ૨૨૫, શેઠ સોરાબજી શા. ગબા રૂ૨૦૧, શેઠ ધનજીશાહ ફું. ગબા રૂ૨૦૧, શેઠ હોરમજી એ. બીલીમોરીયા રૂ૨૦૧, શેઠ જશેદજી રૂ. મેંગુસી રૂ૨૦૧, શેઠ રતનશાહ ર. ભુરી રૂ૨૦૦, શેઠ અરદેશરજી જ. બીલીમોરીયા રૂ૨૦૦ અને શેઠ ડોસાભાઇ લી. મેંગુસી રૂ૧૫૦.

સુરતના જરથોસ્તીઓને સસ્તા ભાવે અનાજ આપવાના ફંડમાં ભરાયલા રૂ૧૨૩૬૫-૧૨ માની મુખ્ય રકમો :—એક જરથોસ્તી રૂ૧૦૦૦, શેઠ રૂસ્તમજી મ. ફુકા રૂ૨૦૦, શેઠો મંચેરજી અને રતનજી શા. તાતા રૂ૧૫૦, શેઠ એન. એમ. વાડીયાના ત્રસ્ટીઓ રૂ૨૦૦૦, શેઠ ધનજીભાઇ ૫. કંત્રાકટર રૂ૨૦૧, શેઠ સોરાબજી ડો. મારકર રૂ૨૦૨, શેઠ પેસ્તનજી ડો. મારકર રૂ૨૦૨, કરાંચીના જરથોસ્તીઓ રૂ૧૨૫૪, એરવદ ખુરશેદજી બ. મોદીનું કુટુંબ રૂ૫૦૧, જરથોસ્તી રૂ૯૨૦, શેઠો કાવસજી દીનશા અને ભાઇઓ રૂ૨૦૦, શેઠ હી. દા. મુલ્લા રૂ૨૦૦, શેઠો સોરાબજી તથા કાવસજી દા. દુબાશ રૂ૧૫૧, શેઠ ફ્રામરોઝ કે. પટેલે શેઠ કે. હો. પટેલની પુંજીમાંથી રૂ૨૫૨, ખા૦ બ૦ બરજોરજી નો. વકીલ રૂ૨૦૧, શેઠ ડોસાભાઇ હોરમજી મીસ્ત્રી રૂ૨૫૨, શેઠ મેરવાનજી મા. મીસ્ત્રી રૂ૫૦૦, શીંગહાઇની જરથોસ્તી અંજુમનના ધરમના ફંડના ત્રસ્ટીઓ રૂ૨૦૦.

મુંબઇ ઇલાકાના દુકાળ સંકટ નીવારન ફંડમાં પારસીઓના ભરાયલા રૂ૨૧૩૭૨૨માની મુખ્ય રકમો :—શેઠ એન. એમ. વાહાડયાના ત્રસ્ટીઓ રૂ૭૫૦૦૦, સર શાપુરજી બી. ભરૂચા રૂ૨૫૦૦૦, શેઠો તાતા સનસ લી. રૂ૧૦૦૦૦, બાઇ જરબાઇ એન. વાહાડયા રૂ૧૦૦૦૦, સર કાવસજી જા. બારોનેટ રૂ૭૫૦૦, શેઠ સી. એન. વાહાડયા રૂ૭૫૦૦, શેઠ આર. એન. વાહાડયા રૂ૭૫૦૦, સર. ડી. જે. તાતા રૂ૫૦૦૦, ઓ. સર દીનશાહ મા. પીટીટ રૂ૫૦૦૦, શેઠ એસ. આર. બમનજી રૂ૨૦૦૦, સર એચ. એ. વાહાડયા રૂ૧૦૦૦, શેઠ પી. સી. શેઠના રૂ૧૦૦૦, શેઠ જાહાંગીર બી. પીટીટ રૂ૧૦૦૦, શેઠ ડી. એન. વાહાડયા રૂ૧૦૦૦, શેઠ એદલજી ર. કંત્રાકટર રૂ૧૦૦૦, ડા. ડી. આર. વાહાડયા રૂ૧૦૦૦, શેઠ ડી. એફ. બાટલીવાલા રૂ૧૦૦૦, શેઠ બરજોરજી ન. કંત્રાકટર રૂ૧૦૦૦, લેડી તાતા રૂ૫૦૦, શેઠ આર. ડી. શેઠના રૂ૨૦૦૦, જરથોસ્તી હાજીશ રૂ૧૦૦૦, શેઠ જમશેદજી અરદેશર ચીનાઇ રૂ૧૫૦૦, શેઠો એચ. જે. બીલીમોરીયાની કં. રૂ૧૦૦૦, શેઠો મેરવાનજી અને હોરમજી કામા રૂ૬૦૦, શેઠ અરદેશર સો. ફ્રામજી રૂ૨૦૦૦, શેઠો સોરાબજી અને કાવસજી દા. દુબાશ રૂ૧૦૦૦, પારસી રૂ૧૦૦૦, શેઠ જે. એ. વાહાડયા રૂ૧૦૦૦, શેઠ અ. હો. વાહાડયા ચેરીટી ફંડ રૂ૧૦૦૦, સર જમશેદજી ને લેડી જીજીબાઈ રૂ૧૦૦૦, શેઠ રૂસ્તમ એસ. પઉંવાલા રૂ૫૦૦, શેઠ કાવશાહ એસ. પાઉંવાલા રૂ૫૦૦, શેઠો મેરવાનજી એન્ડ સનસ રૂ૫૦૦, શેઠ રૂસ્તમ ડી. એન. વાડયા રૂ૫૦૦, શેઠ બમનજી ધનજીભાઈ રૂ૫૦૦, શેઠ પેસ્તનજી કાવસજી શેઠના રૂ૫૦૦, શેઠ એન. એન. વાહાડયા રૂ૭૫૦૦, ખા૦ બા૦ બી. ડી. પટેલ રૂ૭૫૦૦, શેઠો બાટલીવાલા અને કરાણી રૂ૧૦૦૦, શેઠો ખરશેદજી બનાજીની કં રૂ૫૦૦, જરથોસ્તી હાજીશ રૂ૧૦૦૦, શેઠ ડી. એન. બહાદુરજી રૂ૫૦૦ અને પારસી રૂ૫૦૦; આ ફંડમાં બધી ગ્નાતના મળી કુલે રૂ૧૨૩૪૮૩૭-૧૧-૧૧ ભરાયા હતા.

મુંબઇ ઇલાકાના દુકાળ માટે બાનુઓએ ઉગાડેલા ફંડમાં પારસીઓના ભરાયલા રૂ૨૪૬૦૦ માની મુખ્ય રકમો :—લેડી જમશેદજી જીજીભાઇ રૂ૧૦૦૦, શેઠ આર. ડી. શેઠના રૂ૫૦૦, લેડી પીટીટ રૂ૧૦૦૦, લેડી જાહાંગીર રૂ૧૦૦૦, લેડી તાતા રૂ૧૦૦૦, મીસીસ જે. એલ. પાંડે રૂ૧૦૦૦, સર દોરાબ જે. તાતા રૂ૪૦૦૦, લેડી શાપુરજી બી. ભરૂચા રૂ૫૦૦૦, સર જમશેદજી જીજીભાઈ ચોથા બેરોનેટની યાદમાં રૂ૫૦૧, શેઠો કાવસજી દીનશાહ ને ભાઇઓ રૂ૫૦૦, મીસીસ જીવાજી ડી. ગાંધી રૂ૫૩૦ અને મીસ એ. જે. બીલીમોરીયા રૂ૫૦૦,

નવસારીના સંકટનીવારણ ફંડમાં ભરાયલા રૂ૧૧૪૨૭ માની મુખ્ય રકમો :—શેઠ રતનજી ફ. કાબુના છોકરાઓ રૂ૧૭૫૨, શેઠ એદલજી રૂ. ફનીબંદા રૂ૭૫૧, શેઠ મંચેરજી શાપુરજી ટાટા રૂ૨૫૧, શેઠ દીનશાહ દોરાબજી કાંગા રૂ૨૦૦, શેઠ મેરવાનજી નાનાભાઇ મેહતા રૂ૨૫૦, મરહુમ શેઠ ખરશેદજી બ. મોદીનું કુટુંબ રૂ૫૦૦, એરવદ મુલ્લા બેહતરી ફંડમાંથી રૂ૨૦૦૦, અને મલેશરની જરથોસ્તી અનજુમનના જનરલ ફંડમાંથી રૂ૧૦૦૦.

પંજાબ સંકટ નીવારણ ફંડમાં પારસીઓના ભરાયલા રૂ૨૯૩૦૦માની મુખ્ય રકમોઃ—સર દીનશાહ મા. પીટીટ રૂ૭૦૦૦, સર દોરાબ જે. તાતા રૂ૫૦૦૦, શેઠ એફ. ઇ. દીનશાહ રૂ૨૫૦૦, શેઠ જાહાંગીર બ. પીટીટ રૂ૧૦૦૦, શેઠો એચ. જે. ભાભા અને જે. એચ. ભાભા રૂ૧૦૦૦, શેઠ જે. એ. વાડયા રૂ૧૦૦૦, શેઠ નવરોજી હોરમજી બેલગામવાલા રૂ૫૦૦, શેઠ આર. બી. બમન બેહરામ રૂ૫૦૦, શેઠ એ. જે. બીલીમોરીયા રૂ૫૦૦, શેઠ આર. એસ. પાઉવાલા રૂ૫૦૦, શેઠ કે. એસ. પાઉંવાલા રૂ૫૦૦, બાઇ મીઠીબાઈ એસ. બાટલીવાલા રૂ૫૦૦, શેઠ નવરોજી બી. સકલાતવાલા રૂ૫૦૦, અને શેઠો બીલીમોરીયાની કં. રૂ૫૦૧.

કોલાબા ડીસ્ત્રીકટ દુકાળ ફંડ માટે માથેરાન ખાતે બાઇ રતનબાઇ મેં. ખરેગાટે એકઠા કરેલા રૂ૧૫૫૫, જાહાબોરડી દુકાળ ફંડમાં રૂ૩૬૯૯, અમદાવાદ દુકાળ ફંડમાં રૂ૭૫૦૦, ભરૂચના દુકાળ ફંડમાં રૂ૪૫૦૦, ખેરગામના દુકાળ ફંડમાં રૂ૬૨૧ અને રાજકોટના દુકાળ ફંડમાં રૂ૫૮૩ ભરાયા હતા. મુંબઇના જીવદયા મંડળના સંકટ નીવારણ ફંડમાં પાસીઓના રૂ૨૫૧૮, રાંજુલા ગઉ રક્ષણ ફંડમાં રૂ૭૫૦ અને ભાટીયા વોલનટીયર કોર હસ્તકના ફંડમાં રૂ૨૦૦૦ ભરાયા હતા.

ઇનફ્લુએનઝાના હુમલા વખતે મુંબઇની સોશીયલ સરવીસ લીગે ઉગાડેલા ફંડમાં પારસીઓના રૂ૭૭૫૦, બોમબે હયુમેનીટેરીયન લીગે ઉગાડેલાં ફંડમાં પારસીઓના રૂ૧૧૬૫, અને સુરતના એપેડેમીક રીલીફ ફંડમાં રૂ૧૭૬૬ ભરાયા હતા.

લડાઇમાં મલેલી ફતેહની ખુશાલીમાં તા. ૨૨ મી ને ૨૩ મી નવેમબર ૧૯૧૮ના દીને સ્કુલના બાલકો, સોલજરોને મેજબાની આપવાના ફંડમાં પારસીઓના ભરાયલા રૂ૧૦૬૭૫ માની મુખ્ય રકમો :—શેઠો તાતા સનસની કં રૂ૧૦૦૦, શર શાપુરજી બ. ભરૂચા રૂ૧૦૦૦, સર કાવસજી જાહાંગીર રૂ૧૦૦૦, શેઠ એફ. ઈ. દીનશાહ રૂ૨૫૦, શેઠ ડોસાભાઇ એમ. વાહાડયા રૂ૨૫૦, શેઠ પાલનજી એ. પલંબર રૂ૩૦૦, શેઠો સી. એન. વાડયાની કં. રૂ૧૦૦૦, શેઠો એન. એમ. વાડયા એંડ સનસ રૂ૧૦૦૦, શેઠો ખરશેદજી મનચેરજી એંડ સનસ રૂ૧૦૦૦ અને શેઠો કાવસજી દીનશાહ અને ભાઇઓ રૂ૫૦૦.

નામદાર શેહનશાહ જોરજ અને શેહનશાહ બાનુ મેરીના સીલવર વેડીંગ ફંડમાં પારસીઓના પરચુટણ રકમોના મલી રૂ૫૧૦૦ ભરાયા હતા.

શેઠ ફરદુનજી માનેકજી કાંગાના યાદગારી ફંડમાં પારસીઓના ભરાયલા રૂ૪૨૬૩૮માની મુખ્ય રકમોઃ—શેઠ હોરમસજી શાપુરજી સીરવઇ રૂ૧૮૦૦૦, શેઠો તાતા સનસની કં. રૂ૫૦૦૦, દેશાવરથી ખેરખાહો રૂ૪૫૦૧, શેઠો રૂસતમજી બમનજી દીનશાજી અને માનેકશા તથા બાઇઓ જરબાઇ તથા ખોરશેદબાઇ કાવસજી મોદી રૂ૧૫૦૦, શેઠ સોરાબજી ફ. ગજદરના છોકરાઓ રૂ૭૦૦, શેઠ અરદેશર જ. બીલીમોરયા રૂ૫૦૦, શેઠ મેરવાનજી ન. ગોભાઇ રૂ૫૦૦, શેઠ પાલનજી એ. પલમબર રૂ૫૦૧, શેઠો આદરજી મં. દલાલ તથા મનચેરશા સો. વખારીઆ રૂ૫૦૦, શેઠો દીનશા ફરદુનજી તથા ભાઇઓ રૂ૫૦૧, સર શાપુરજી બ. ભરૂચા રૂ૧૦૦૦, સર કાવસજી જેહાંગીર બારોનેટ રૂ૫૦૦, શેઠ બેજનજી ફ. માદન રૂ૫૦૧, શેઠ ધનજીશા બા. દેશાઇ રૂ૨૫૦, શેઠ પેસ્તનજી કા. શેઠના રૂ૨૫૧, શેઠ બેરામજી ન. કરંજયા રૂ૨૫૦, શેઠ કે. એ. સી. સી. રૂ૨૫૧, અથોરનાન રૂ૨૫૧ અને અથોરનાન રૂ૨૫૧ અને શેઠ ખરશેદજી મં. ભોસાનયા રૂ૨૫૧. આ ફંડમાં બધી ગ્નાતના મલી કુલે રૂ૪૮૦૨૨–૮–૫ ભરાયા છે.

મુંબઈના નામદાર માજી ગવરનર લોરડ વીલીંગડનની યાદગારી રાખવાના ફંડમાં પારસીઓના ભરાયલા રૂ૨૫૦૦૦માની મુખ્ય રકમો :—સર શાપુરજી બી. ભરૂચા રૂ૧૦૦૦૦, સર કાવસજી જાહાંગીર રૂ૫૦૦૦, શેઠ આર. ડી. શેઠના રૂ૫૦૦૦, સર નવરોજી વકીલ રૂ૨૦૦૦ અને શેઠ એફ. એમ. ગારડા રૂ૫૦૦.

ધી સેનેટરી ગુડશ એન્ડ હારડવૅર સ્ટોર.

દારાબ્રધર્સના પેટન્ટના તાલાં તેમજ કલો તેમજ સીપીગોટકોક તથા અલીગઢની જાણીતી સ્પારલીંગ પેટન્ટ લોક વર્કસના એકલા એજન્ટો.

નં. ૨૭૧-૨૭૩ નાગદેવી સ્ત્રીટ—મુંબઈ.

હમારે ત્યાં દરેક જાતનો પીટલનો તેમજ લોખંડનો સામાન તેમજ તાલાં કલો દરેક જાતના પાઇપસ, ફીટીંગસ, કોક ટાંકી તેમજ દરેક જાતનો સેનેટરીને લગતો સામાન વગેરે મોટા જથામાં રાખવામાં આવે છે અને મારકીટના ભાવે કીફાયતે આપવામાં આવશે. હમારે ત્યાં દારૂવાલા બેરાદરના શોધના ડબલ કલના તાલા તેમજ પેટી તથા કબટના દબલ કલની કલો જે દારા તરીકે ઓલખવામાં આવે છે અને તેના પેટન્ટો અમેરીકા, ઇંગલેન્ડ અને હીન્દુસતાનમાં મેળવવામાં આવ્યા છે. એ તાલાઓ હીન્દુશતાનની જાણીતી ઇંગ્લીશ ફરમ "ધી સ્પારલીંગ પેટન્ટ લોક વરકસ"માં ઘણાજ સુંદર ફીનીસવાલા તેમજ મજબુત બનાવવમાં આવે છે. એ તાલાની અંદરને અંદર એક બીજાને એકજ ચાવીથી બંધ કરે તેવી રીતના લીવરો ગોઠવવાની ખુબી હજુર સુધી કોઇએબી કાઢી નથી. જેને વાસ્તે ઇનડીયન તેક્ષતાઇલ જનરલના જાનેવારી ૧૯૧૭ના અંકમાં નીચે મુજબનો રીવ્યુ લેવામાં આવ્યો છે:—

The progress of mechanical knowledge among the criminal population has acted as a great stimulus to the inventors of locks of every kind, and the result, especially in Europe and America, has been a marvellous development of much mechanical skill and ingenuity. As the most successful thieves were often trained locksmiths, the competition between the lock-maker and the lock-breaker resembled, on a small scale, that between the makers of heavy guns and of armour plate. The illustration herewith represents a new type of lock recently invented by Mr. E. B. Daroowalla an enterprising young Parsi merchant of Bombay, in which the security of two locks is combined in one, although controlled by one key. Our illustration shews the application of the invention applied to a padlock and a door or drawer lock. The padlock has a novel feature in the bow that is split and hinged upon both sides as shewn. When closed, the halves cross each other, and the notch in the boss of the right-hand bow comes in line with the bolt beneath, that locks it. This bolt is operated by the upper tongue of the key shewn beside it. The lower tongue of the key passes through a plate that divides the lock into two parallel divisions,

Behind this plate is the second lock which acts upon the second bow when closed. The two tongues of the key, which is turned clockwise, act in succession on the two locks, beginning with the one in front. Two sets of levers aid in giving security to this lock, which is thus much more difficult to tamper with than an ordinary one. The second lock is made on the same principle with necessary modifications. The bolt is shot by one tongue of the key acting through levers and the second tongue shoots a second bolt that locks the first one.

અલીગઢની જાણીતી સ્પારલીંગ પેટન્ટ લોક વરકસના મુંબઈના એકલા એજન્ટો તરીકે અમને નેમવામાં આવ્યા છે. એ કમ્પની મીલીટરી સામાનો, દરેક જાતની પીટલની ચીજો, તાલાં તથા કલો ઈંગલીશ મેકીંગની બરોબર બનાવે છે. લગભગ આખા હીનદુસતાનની પોસત ઓફીસો, રેલવે વગેરેમાં આ તાલાંઓ ખપે છે. એ તાલાઓ મજબુતાઈમાં તેમજ સફાઈમાં ઘણા ચડયાતા છે. જેને સારૂ ગવરમેન્ટ* ઓફ ઈન્ડીયાએ દર વરશ રોયલટીની ગ્રાંટ (બખશેશ) આપે છે અને જેને વીશે રૂકીના જાણીતા કેનાલ ફાઉનડરી અને વરકશોપના સુપ્રીનટેનડન્ટ મી. ફ્રી. શાઉતર રોબરટસને કેનાલ ફેકટરીમાં તા. ૨૧ મી ડીસેમ્બર ૧૯૦૪ને દીને એ તાલાંઓ તપાસી તે વીશે રીપોરટ કીધો છે જે નીચે મુજબ છે:—

Result of the Test and Report on Mr. Sparling's Patent Lock.

Tested in Canal Foundry, on 21st December 1904.

The padlock tested was one of 3 inch size, and was well and strongly made in every respect. It is almost impossible to pick one of these locks, the levers being specially designed to prevent this, and it would take a burglar of more than ordinary skill to accomplish it. The staple of lock, too, is very strongly made and could not easily be broken or cut; I tried for three days to pick this lock and was unable to do so.

The first test was that of a direct pull on the staple of padlock, and the strain was applied by hydraulic power. A direct pull of 500 lbs. was first applied, equivalent to 2 tons per square inch of minimum sectional area of staple. The lock stood this perfectly well and was not injured in any way, externally or internally. The strain was increased gradually until a maximum of 1200 lbs. was on the lock, equivalent to 5 tons per square inch of minimum sectional area of staple On examination the padlock proved to be in perfect condition; it was not damaged in the slightest.

The next test was that of a powerful blow, and this was applied by means of a steam hammer. A blow of 25 cwts. was given, but this proved to be too much for the lock, the rivets starting and the levers and inside fitting being damaged. Even then it was impossible to withdraw the staple, and so open the padlock, *and a door would be just as safe from opening with this battered lock as with a lock in perfect condition.*

I consider this last test an excessively heavy one and expected the lock to be very badly damaged, but I still was unable to remove the staple. It speaks very highly for the lock that, although battered and damaged, it still remained locked and fast, it was not completely burst open.

I Consider this padlock one of the best I have seen on the market.

ROORKEE, (Sd.) D. SOUTER ROBERTSON,

22nd December 1904. *Superintendent Canal Foundry & Workshop.*

LIEUTENANT-GOVERNOR'S CAMP,

UNITED PROVINCES.

28th December 1906.

DEAR MR. SPARLING,

I congratulate you very sincerely on the success that you have achieved with your Patent Padlocks. It is delightful to find a man in this Province who can take **the first rank in industrial development,** I wish you all good luck.

Yours sincerely.

(SIR) J. D. LA TOUCHE,

Lieut. Governor. U. P.

નસીબની નવાઇ

અને

પૈસાની વધાઇ.

એ શું ?—

જહાંગીરજી મારો વીચાર લગન કરવાનો છે, પણ શું કરૂં મારી રાસ કોઇની સાથે મલતી નથી. હું મારો ટપકો બતાવી બતાવી હેરાન થઇ પણ શુ કરૂં કોઇએ પણ મને સાચી હકીકત કહી સંભળાવી નથી. તમે પણ ભોળા ભટાક જેવાજ રહી ગયાની ? કાંય તમે જાણી બુજી ખારામાં કાંય પડો છો ? વળી તમો પણ શુ કરો આતો નસીબની નવાઈ છે. નસીબ જાગવાનું હોય તોજ સારી વસતુ મળી શકે છે. તમે કયાં જાણુતા નથી કે

મુંબઇના પ્રખયાત જયોતીશ કૃષ્ણલાલ રમાંકાન્ત શરમા

મોતી બજાર અનંત શીવાજી દેશાઈ ટોપીવાળાની સામને પહેલે માલે રહે છે.

તેવણુ નસીબની હકીકટ તો શું પણ રૂ, અળસી, સુતર, કપુર, સોનું, ચાંદી, શેરે વગેરેના ભાવના આંકડા આના પાઇ સીકે કહાડી આપવાથી સીલવર પલેટપર સરટીફીકેટો પણ મલેલી છે, અને જનમોત્રી, ટપકા, વરસફળ જોવામાં અને બનાવવામાં હદ કીધી છે એમ લોકો કહે છે અને રાસ બહુ અજાયબીથી મેળવી આપે છે અને જનમોત્રી નહીં હોય તો હસતરેખાને ને મસતકરેખા સીવાય બી આખી જીંદગીના હાલ આબેહુબ એક પ્રશનથી કહી આપે છે.

સાચી હકીકત જાણવી હોય તોજ મળવાને તસદી લેવી.

ટેલીગ્રાફીક એડરેસ—"GEOTISHE".

ઉઠમણાનું ધરમખાતું.

ગયે વરસે જે જે મરહુમ જરથોસ્તીઓના ઉઠમણામાં તેમનાં પુણ્ય માટે ધરમ ખાતે રકમો ભરાઇ છે તેની વીગત :—

	રૂપીઆ.		રોજ–માહ
(૧)	૧૮૭૧૩	શેઠ ફરામજી હોરમજી અરજાની	૩૦–૧૦–૧૨૮૭
(૨)	૧૮૮૬	બાઇ સુનાબાઇ ફરામજી ગજદર	૨૨–૧૧–૧૨૮૭
			સને ૧૨૮૮ રોજ–માહ
	૨૦૦	શેઠ દીનશાહ લીમજીભાઈ ફુલવાડીવાલા (વલસાડ)	૬–૧
(૩)	૧૨૮૨	બાઇ સુનાબાઇ ધનજીશાહ હોરમજી મેહતા તે શેઠ એદલજી કાવસજી દલાલના બેટી	૯–૧
	૧૨૮	શેઠ મેરવાનજી નવરોજી ખજોતીઆ	૯–૧
(૪)	૬૧૦૦	બાઇ હીરાંબાઈ મનચેરજી ના. મીસતરી તથા સુમાલીવાલા આદરબમનના	૧૦–૧
	૧૯૨	ડા૦ બરજોરજી રૂશતમજી પાંતરાંવાલા (વડોદરા)	૧૩–૧
	૬૫૦	શેઠ ફરદુનજી મંચેરજી ખંભાતા (અમદાવાદ)	૧૪–૧
(૫)	૩૫૯૩	બાઇ બાનુબાઈ પાલનજી રતનજી પટેલ (સુરત)	૧૫–૧
	૯૫	બાઇ તેહમીના જામાસજી ધનજીભાઇ દારૂવાલા (ભરૂચ)	૧૯–૧
	૧૪૧	શેઠ કુવરજી આદરજી દારૂવાલા (વડોદરા)	૧૯–૧
	૩૮	શેઠ જહાંગીરજી નાનાભાઇ જહાંબોરડીવાલા (વલસાડ)	૧૯–૧
	૫૮	બાઇ વીરબાઇજી દારબજી પેસ્તનજી બચા (બીલીમોરા)	૨૧–૧
(૬)	૪૨૮૧	શેઠ દીનશાહ બરજોરજી નશરવાનજી મેગુસી–(મુંબઇમાં ગુજરેલા ને બીલીમોરામાં ઉઠમણું થયલું)	૨૨–૧
(૭)	૬૩૫	શેઠ પીરોશાહ હોરમજી મેહતા	૨૨–૧
	૫૮	બાઇ ગાયમાય દારાશાજી જામાસજી કેલાવાલા (ભરૂચ)	૨૨–૧
	૧૩૮	શેઠ જેહાંગીરજી બમનજી મીસતરી (ભરૂચ)	૨૩–૧
(૮)	૨૧૩૩	બાઈ આલાંમાય પેસતનજી દીનશાજી ડુંગાજી (ભરૂચ)	૨૩–૧
(૯)	૧૨૭૬	શેઠ એદલજી દાદાભાઇ નાગજી (બેલગામ)	૨૪–૧
	૨૪૫	શેઠ રૂશતમજી ધનજીભાઈ ગાંધી (ભરૂચ)	૨૪–૧
	૩૮	બાઇ મેરબાઇ રૂસ્તમજી સોરાબજી પીશીઆ તે શેઠ હોરમજી જીવનજી વાડીઆનાં છોકરી (બીલીમોરા)	૨૪–૧
	૧૩૦	બાઇ બચુબાઇ દારાસાજી કાવસજી મહુડાવાલા (ભરૂચ)	૨૫–૧
(૭)	૫૩૪	બાઇ નાજામાય તે શેઠ પીરોશાહ હોરમજી મેહતાના ધણીયાણી અને શેઠ દોરાબજી નાનાભાઇ મેહતાના દીકરી	૨૫–૧
(૧૦)	૧૦૨૫	બાઇ બચુબાઇ ડોશાભાઇ દાદાભાઇ મોદી તે મરહુમ શેઠ કાવશજી એદલજી શરાફના બેટી	૨૭–૧
	૧૫૫	શેઠ સોરાબજી શાપુરજી હોરમજી નગરશેઠ (મુંબઇમાં ગુજરેલા ને ભરૂચમાં ઉઠમણું થયલું)	૨૭–૧
	૧૯૨	બાઇ હીરાંબાઈ ડોસાભાઇ કરંજીઆ (અમદાવાદ)	૨૭–૧
(૧૧)	૪૫૦૦	બાઇ આઇમાય રૂશતમજી સોરાબજી કંટરાકટર	૨૮–૧
	૧૫૦	શેઠ જાંગીરજી હોરમજી રૂસ્તમજી ભટરીવાલા (બીલીમોરા) ...	૨૮–૧
	૫૦૧	શેઠ આદરજી અરદેશર વાડીઆ (અમદાવાદ)	૨–૨
	૨૮૦	બાઇ ડોશીબાઇ માણેકજી નસરવાનજી પરતાકીઆ (અમદાવાદ) ...	૨–૨
	૪૬	શેઠ જમશેદજી બહેરામજી દીવેચા (અમદાવાદ)	૨–૨
	૯૨	શેઠ હોરમજી ફરામજી કામા (ભરૂચ)	૧–૨
(૧૨)	૧૦૧૪	બાઇ બાનુબાઇ પેસ્તનજી માણેકજી પટેલ (સુરત)	૩–૨
	૩૬૭	બાઇ ડોશામાય કેખશરૂ પટેલ (ઇછાપોર)	૪–૨

૧૮૧ શેઠ મનચેરજી શેરીયાદજી બ્યાંડીવાલા (ભરૂચ) ૫–૨
૧૪૬ શેઠ દારાશાજી પીરોજશા ફોજદાર (ભરૂચ) ૫–૨
(૧૩) ૫૨૨૫ બાઇ કુવરબાઇ રૂશતમજી શોરાબજી કંટરાકટર ૫–૨
(૧૪) ૧૨૦૦ બાઇ દીનબાઇ ફરામરોજ પેસતનજી વાછાડયા, તે શેઠ ઉકરજી હોરમજી ભુજવાલાના બેટી (સુરત) ૫–૨
૧૦૪ શેઠ નાદરશા સોરાબજી દીનસાજી ઘાટીઘરા ૫–૨
૪૩ બાઇ માણેકબાઈ ધનજીશાહ પીટર (વલસાડ)... ... ... ૬–૨
(૧૫) ૧૫૨૭ શેઠ બેરામજી જમશેદજી એરચજી મોદી ૬–૨
૯૧૧ શેઠ સોરાબજી ફરામજી રૂશતમજી હોમાવાલા (ભરૂચ) ૬–૨
૬૮ શેઠ રતનજી દારબજી સુખેસવાલા (વલસાડ) ૬–૨
૩૬૦ શેઠ રૂસ્તમજી બરજોરજી જમશેદજી મેરજીનાં (બીલીમોરા) ... ૬–૨
૨૪૫ બાઇ આવાબાઇ દાદાભાઇ ધનજીભાઈ ગબા (બીલીમોરા) ... ૮–૨
૭૦ બાઇ પીરોજબાઇ એદલજી સોરાબજી મોવાસાવાલા (ગણદેવી) ... ૯–૨
૧૮૯ શેઠ બરજોરજી રૂસતમજી દારૂવાલા, બનાજી (ભરૂચ) ૯–૨
(૧૬) ૫૨૫૭ શેઠ ખરશેદજી એદલજી લાકડાંવાલા (ભરૂચ) ૧૦–૨
(૧૭) ૨૦૪૩૩ બાઇ નવાજબાઈ સોરાબજી ડોશાભાઇ મારકર... ... ... ૧૦–૨
૫૪ બાઈ આવાંબાઇ હોરમજજી શાપુરજી કલવાચવાલા (ગણદેવી) ... ૧૦–૧
૭૦ બાઇ શીરીનબાઇ જમશેદજી ઇલાવીઆ (વડોદરા) ૧૦–૨
(૧૮) ૧૦૪૦૦ બાઇ આલીબાઇ રૂશતમજી મનચેરજી મીનોચેહેર કુકા (સુરત) ... ૧૧–૨
૨૨૪ એરવડ આદરજી કાવસજી (ભરૂચ) ૧૧–૨
૫૨૩ આ૦ દીનશાહ નવરોજી સહીયાર ૧૨–૨
૬૭ શેઠ જાલેજર કુવરજી દારૂવાલા (વડોદરા) ૧૨–૨
૭૧ શેઠ સોરાબજી નવરોજી હજારી (બીલીમોરા) ૧૨–૨
૧૭૬ બાઈ ગુલબાઇ ધનજીભાઈ શાપુરજી ટાટા (બીલીમોરા) ૧૨–૨
૭૫૦ શેઠ દીનશાજી મેરવાનજી મેહતા (ભરૂચ) ૧૪–૨
૧૧૨ બાઇ તેહમીના સોરાબશા બમનશાહ કેલાંવાલા (ભરૂચ) ૧૪–૨
૬૦૬ શેઠ સોરાબજી પેસતનજી લકકા (નાગપોરમાં ગુજરેલા ને નવસારીમાં ઉઠમણું થયલું) ૧૫–૨
૭૧૮ શેઠ રૂસતમજી નાનાભાઇ મસાલાવાલા (મઉ) ૧૯–૨
(૧૯) ૧૮૮૩ બ.ઇ કુંવરબાઇ (જરબાઇ) એદલજી સોરાબજી હોરમજી રાંનજી ... ૨૧–૨
૧૧૫ શેઠ જમશેદજી સોરાબજી પનીબંદા (નવસારી) ૨૧–૨
૧૧૯ બાઇ મેહરબાઈ બમનજી ચાવડા (વલસાડ) ૨૧–૨
૧૩૪ બાઇ તેહમીના નસરવાનજી દીનસાજી ગાંધી (ભરૂચ) ૨૨–૨
૫૬૯ બાઇ સુનાબાઇ કેકોબાદ એદલજી કરકરીયા (નવસારી) ૨૪–૨
૨૨૭ બાઇ રોદાબે માણેકશા લીમજીભાઈ ખેરગામવાલા વકીલ (ખેરગામ) ૨૪–૨
૧૧૬ બાઇ પીરોજબાઇ ધનજીશાહ ફરદુનજી જીલ્લા, કાપડીયા (ભરૂચ) ... ૨૫–૨
(૨૦) ૨૯૫૫ શેઠ ગુસતાદજી બેરામજી કાંગા ૨૬–૨
૭૨ બાઇ બાનુબાઇ હોરમજી ચોથીઆ (વલસાડ) ૨૭–૨
૫૫૯ બાઇ તેહમીના ધનજીશાહ રૂસતમજી પટેલ (ભરૂચ) ૨૮–૨
૩૩ શેઠ જમશેદજી સોરાબજી નરીમાન (વલસાડ) ૨૯–૨
૮૮૪ બાઇ બચુબાઈ ખરશેદજી ખુરશીગરા (કરાંચી)... ... ... ૨૯–૨
૬૧ બ.ઇ દીનબાઈ જમશેદજી મરોલીઆ (વડોદરા)... ... ... ૩૦–૨
(૨૧) ૩૨૪૯ બાઇ આવાબાઈ મેરવાનજી ભરૂચા ૧–૩
૮૫ બાઇ બપઇ અરદેશર ભોટ (મઉ) ૧–૩
(૨૨) ૬૦૦૭ બાઈ આવાબાઇ દીનશાહ ફરામજી હોમાવાલા (ભરૂચ) ૨–૩
(૨૩) ૧૦૦૦૦૦ શેઠ મનચેરશાહ જીવણજી નવરોજી બીલ્લાડવાલા ૩–૩

૮૯ બાઇ દોલતબાઈ ધનજીશા ફરદુનજી દારૂવાલા (અમદાવાદ) ... ૪-૩
૨૪૭ શેઠ પીરોશાહ જામાસ્પજી લીંબુવાલા... ... ... ૧૩-૩
૪૦ બાઇ ખરસેદબાઈ આદરજી હોરમજી પટેલ (ડીસા) ૧૪-૩
૨૦૮ બાઇ ડોશીબાઇ ધનજીશાહ હલદવાલા (વલસાડ) ૧૫-૩
(૨૪) ૧૩૯૦ બાઈ હીરાબાઇ પાલનજી ધનજીભાઇ ભાઠેના (અમદાવાદ) ... ૧૬-૩
૨૬૧ શેઠ નવરોજી દીનશાહ દસ્તુર (ભરૂચ) ૧૭-૩
(૨૫) ૬૮૮૯ શેઠ બેરામજી ફકીરજી મોતીવાલા ૧૯-૩
(૨૬) ૪૭૦૨ શેઠ ખુર્જેસ્તા ખુરશેદજી નશરવાનજી સીરવાઇ ૨૦-૩
(૨૭) ૭૫૦૦૦ બાઇ હમાબાઇ ફરામજી રૂશતમજી કામા, તે મરહુમ સર દીનશાહ
માણેકજી પીટીટ પેહલા બારોનેટના બેટી ૩-૪
(૨૮) ૯૪૦૦ શેઠ જમશેદજી અરદેશર ચીનાઇ ૩-૪
૪૫૬ બાઇ જરબાઇ જમશેદજી ફરદુનજી શરાફ તથા કલીયાણીવાલા ... ૪-૪
(૨૯) ૩૦૯૯ બાઇ માણેકબાઇ માણેકજી જીવણજી માસતર ૫-૪
પાઉંડ ૧૫ બાઇ માણેકબાઇ ખરશેદજી ભીખાજી ઇજનેર (ડેલેગોઆબે આફ્રીકા) ૬-૪
પાઉંડ ૩૦ શેઠ પેસતનજી દોરાબજી પટેલ (ડેલેગોઆબે આફ્રીકા) ... ૭-૪
૩૫ બાઇ જીનીબાઇ દાદાભાઇ સુખડયા (વલસાડ) ૭-૪
૧૧૭ મોબેદ ડોસાભાઇ મેરવાનજી એલાવીઆ (ભરૂચ) ૮-૪
૩૦ શેઠ શાપુરજી ફરામજી ટોપીવાલા (વલસાડ) ૧૧-૪
૧૬૨ શેઠ પેસતનજી એદલજી મેડીવાલા (વડોદરા) ૧૨-૪
૨૨૮ મોબેદ સોરાબજી કોલાભાઈ પંઠકી (બીલીમોરા)... ... ... ૧૩-૪
૯૦૪ શેઠ જમશેદજી પેસતનજી મેરવાનજી... ... ... ૧૩-૪
૨૪૧ બાઇ જાઇજી દારાશાજી રતનજી કાપડીઆ (ભરૂચ) ૧૪-૪
૧૦૪ બાઇ આવાબાઇ હોરમજી જીવાજી ભુરા (બીલીમોરા) ૧૭-૪
૭૨૭ શેઠ મેરવાનજી દીનશાજી શેઠના ૧૭-૪
(૩૦) ૩૩૦૦ શેઠ રૂશતમજી પુંજીયાજી દલાલ (સુરત) ૨૧-૪
(૩૧) ૮૨૧૪ શેઠ કેખશરૂ બરજોરજી લીંબુવાલા ૨૧-૪
૫૩૩ બાઈ ડોશીબાઇ સોરાબજી હોરમજી હાડવઇદ (રાંદેર) ૨૧-૪
૯૨ શેઠ સોરાબજી ફરામજી દસ્તુર (વલસાડ) ૨૪-૪
૬૦ બાઇ બચુબાઇ ખરશેદજી મોટાભાઇ મોબેદજી (ગણદેવી)... ... ૩૦-૪
(૩૨) ૭૪૫૨૯ બાઇ પુતલીબાઈ હોરમજી માણેકજી ભીમડીવાલા ૩૦-૪
(૩૩) ૪૪૭૧ બાઇ સુનાબાઇ સોરાબજી એદલજી વોરડન ૧-૫
૬૦ બાઇ બચુબાઇ અરદેશર ફરામજી ઉનવાલા (ગણદેવી) ૩-૫
(૩૪) ૧૦૧૨ બાઇ બાનુબાઇ સોરાબજી મેહેનતી ૩-૫
(૩૫) ૩૪૮૬ બાઇ ધનબાઇ સોરાબજી પાતરાવાલા (મુંબઇમાં ગુજરેલા ને નવસારીમાં
ઉઠમણું થયલું) ૪-૫
૧૮૯ બાઇ જરબાઇ રતનજી પેસતનજી શાહ (ભરૂચ) ૬-૫
૭૪ શેઠ દાદાભાઇ માણેકજી ભુતીઆ ૮-૫
૬૫૯ શેઠ મોનોચેહર એદલજી પેસતનજી ગજડર (કલકતામાં ગુજરેલા ને
ગણદેવીમાં ઉઠમણુ થયલું) ૯-૫
૭૦૧ શેઠ એદલજી ધનજીભાઇ મીસ્ત્રી (અમદાવાદ) ૧૦-૫
૮૫૯ શેઠ હોરમજી જામાસ્પજી તાડીવાલા (ભરૂચ) ૧૦-૫
(૩૬) ૧૦૮૦૧ શેઠ ધનજીશાહ બમનજી ખાન ૧૨-૫
૧૩૮ શેઠ હોરમજી માણેકજી ભદેલીવાલા (ધોલા) ૧૩-૫
૫૦૦ એરવદ કેકોબાદ ખરશેદજી મોદી ૧૫-૫
(૩૭) ૭૮૬૩ બાઈ મેહરબાઇ સોરાબજી દાદાભાઈ દીવેચા ૧૫-૫
(૩૮) ૫૬૭૩ શેઠ મેરવાનજી મંચેરજી સુઢબેવાલા તથા ભેસાન્યા ૧૬-૫
૮૪ શેઠ દીનશાજી ધનજીભાઈ ખજોતીઆ (ગોદરા) ૧૬-૫

(૩૯) ૩૦૨૧ શેઠ નાદરશાહ હોરમજી બેલગામવાલા ૧૭-૫
(૪૦) ૨૬૫૮ બાઇ નવાજબાઇ દાદાભાઇ શરાફ તે મરહૂમ શેઠ જમશેદજી ફરામજી કહોકનાં દીકરી ૧૯-૫
(૪૧) ૧૫૦૦૦ શેઠ ફરામજી કાવશજી કાવારાના ૧૯-૫
(૪૨) ૧૬૪૩ શેઠ રૂશતમજી નશરવાનજી બમનજી મેહતા (મુંબઇમાં ગુજરેલા ને ભરૂચમાં ઉઠમણુ થયલું) ૨૧-૫
૪૫૮ બાઈ બચુબાઇ કાવશજી મેરવાનજી શેઠના (મુંબઇમાં ગુજરેલા ને ભરૂચમાં ઉઠમણુ થયલું) ૨૧-૫
૩૨૬ શેઠ સોરાબજી પાલનજી ખરશેદજી બામજી (નવસારી) ૨૬-૫
(૪૩) ૩૮૫૮ શેઠ રતનજી ડોશાભાઇ પટેલ (મઉ) ૨૭-૫
૫૦૦ શેઠ માણેકજી શાપુરજી સાગર (અનાવલ-ગણદેવી પાસે) ૨૮-૫
૧૧૧ શેઠ દારાશાજી પીરોજશા ટેમુલજી કાપડીઆ (ભરૂચ) ૧-૬
૩૫૫ શેઠ અરદેશર ફરદુન સાબરૂ (ભરૂચમાં ઉઠમણુ થયલું) ૨-૬
૧૧૭ બાઇ પીરોજબાઇ ફરામજી જીજીભાઇ મેરજી (બીલીમોરા)... ... ૫-૬
(૪૪) ૧૦૬૬૩ શેઠ ધનજીશાહ જમશેદજી માસતર (કરાંચી) ૬-૬
(૪૫) ૫૩૬૪ બાઇ ડોશીબાઈ અરદેશર બેહરાના (કરાંચી) ૭-૬
(૪૬) ૮૪૫૪ કેપટન ફીરોઝ બાપુજી એદલજી ચીનાઇ (ઉતર ઇરાનના ઝીનજાન શેહેરમાં ગુજરેલા ને સીકંદરાબાદમાં ઉઠમણુ થયલું) ૮-૬
૩૫૯ શેઠ હોરમશાહ શાપુરજી દમરી (વલસાડ) ૧૦-૬
(૪૭) ૬૧૮૩ શેઠ હોરમજી કાવશજી રતનજી ખંબાતા (ખંબાત) ૧૬-૬
૯૪ બાઇ નવાજબાઇ ખરશેદજી ભીખાજી પટેલ તવડીવાલા તે શેઠ રૂસ્તમજી બરજોરજી ડાકતરનાં છોકરી (બીલીમોરા) ૧૭-૬
૫૧ બાઈ રતનબાઈ આદરજી જમશેદજી પંડકી ૨૨-૬
૭૫૬ શેઠ નશરવાનજી અરદેશર ટંકારીવાળા (અમદાવાદ) ૨૩-૬
(૪૮) ૯૦૦૦ શેઠ પેસતનજી ફરામજી શરાફ ૨૫-૬
(૪૯) ૧૨૩૩૮ બાઇ આવાબાઇ (આલામાંય) પીરોશાહ મેહતા તે શેઠ હોરમજી રૂશતમજી ઉમરીગરના બેટી ૩૦-૬
૩૯૦ મોબેદ બેરામજી પેસતનજી કુકા (અમદાવાદમાં ગુજરેલાને સુરતમાં ઉઠમણુ થયલુ) ૧૨-૭
(૫૦) ૩૩૪૮ બાઇ માણેકબાઇ પીરોશાહ પાલનજી પટેલ (એડનમાં ગુજરેલા ને એડન તથા સીગનપોરમાં ઉઠમણુ થયલું) ૧૨-૭
(૫૧) ૧૮૩૯ બાઇ ગુલબાઇ જાહાંગીરજી પટેલ (અમદાવાદ) ૧૩-૭
૩૦૪ શેઠ માણેકશાહ મંચેરજી ડમરી (રાજકોટ) ૧૪-૭
૧૧૩ બાઇ જરબાઇ બેરામશાજી રૂસ્તમજી બરજોરજી ડાકટર (બીલીમોરા)... ૩૦-૭
(૫૨) ૧૫૫૦ શેઠ એદલજી નશરવાનજી દુબાશ ૧-૮
(૫૩) ૧૧૦૦ શેઠ અરદેશર એદલજી લાકડાંવાળા (ભરૂચ) ૨-૮
૩૩૬ બાઇ જરબાઇ દાદાભાઇ અરદેશર પોંચખાનાવાળા ૬-૮
(૫૪) ૧૪૧૫ ડા૦ જમશેદજી ફરદુનજી દસ્તુર (ભરૂચ) ૭-૮
૬૭ બાઇ ધનબાઇ પેસતનજી મનચેરજી મવડાંવાલા (ભરૂચ) ૮-૮
૧૩૭ શેઠ આદરજી એદલજી દાદીમાસ્તર ૯-૮
(૫૫) ૧૪૫૧ બાઇ આઇમાય સોરાબજી પુનેવાળા અથવા બરેલીવાલા ૧૫-૮
(૫૬) ૧૩૫૩ શેઠ ખરશેદજી જામાસપજી દારૂવાળા (ભરૂચ) ૧૫-૮
(૫૭) ૧૭૦૨ શેઠ અરદેશર મનચેરજી મોદી ૨૨-૮
૩૫૮ બાઇ ડોસીબાઇ પીરોજશા અરદેશર મહી (ભરૂચ) ૨૬-૮
(૫૮) ૧૦૦૯૭ શેઠ પેશતનજી ખરશેદજી ઉમરીગર ૨૯-૮
૨૫૪ શેઠ કાવશજી આનજીભાઇ એલાવીયા (જાલના) ૩૦-૮

૪૦૦ બાઇ પીરોજબાઇ કેરસાશપજી શાપુરજી દાદાચાનજી તે મરહુમ બા૦ બા૦ કાવશજી હોરમજી દાદાચાનજીના બેટી (નવસારી) ... ૩-૯
૭૫૦ શેઠ અરદેશર રૂશતમજી એદલજી કાટપીટીઆ (સુરત) ૩-૯
૪૯ બાઈ રતનબાઈ જામાસજી લાલા (વલસાડ) ૫-૯
(૫૯) ૨૫૩૪ બાઇ શીરીનબાઇ રૂશતમજી ભરૂચા ૯-૯
(૬૦) ૩૪૭૨૩ બાઇ બચુબાઇ ફીરોઝ કુવરજી ભરૂચા, તે કરાંચીવાલા શેઠ નાદરશાહ એદલજી દીનશાહના છોકરી ૧૬-૯
(૬૧) ૧૮૬૧ શેઠ હોરમજી નશરવાનજી વકીલ-નવાબ હોરમઝજંગબહાદુર (સીકંદરાબાદમાં ગુજરેલા ને સુરતમાં ઉઠમણુ થયલું)... ... ... ૧૬-૯
(૬૨) ૩૨૯૭ શેઠ ખુરશેદજી નોશીરવાન ચીનાઇ (સીકંદરાબાદ) ૧૬-૯
૮૩ બાઇ સુનાબાઇ અરદેશર મોદી (મીરજમાં ગુજરેલા ને કલીકટમાં ઉઠમણુ થયલું) ૧૬-૯
૫૬ શેઠ નરીમાન સોરાબજી વજીફદાર (વલસાડ) ૧૭-૯
(૬૩) ૮૦૦૧૬ શેઠ નશરવાનજી પેસતનજી ખાન ૧૭-૯
૨૫૧ શેઠ બેજનજી રૂસતમજી ફ્નીબંદા (અમદાવાદ)... ... ... ૧૭-૯
૯૩ શેઠ બમનજી મોટાભાઈ મુગટ (વલસાડ) ૧૮-૯
(૬૪) ૨૦૬૫ શેઠ ફરદુનજી કાવશજી પટેલ (મુંબઇમાં ગુજરેલા ને ભરૂચમાં ઉઠમણુ થયલું) ૨૦-૯
૧૨૫ શેઠ કાવશજી મનચેરજી વાગરેમીઆ (બીલીમોરા) ૨૨-૯
(૬૫) ૨૧૬૭ શેઠ હોરમજી સોરાબજી ભરૂચા તથા દારૂવાળા, સોલાકોટીના ... ૨૩-૯
(૬૬) ૧૧૫૬ શેઠ સોરાબજી મનચેરજી ભરૂચા તથા માહાવા ૨૩-૯
૧૨૮ બાઇ બચુબાઇ હોરમજી રતનજી મેઘોરા (બીલીમોરા) ૨૪-૯
(૬૭) ૩૭૮૯ શેઠ પાલનજી પેસતનજી વાઘલા કુપર ૨૫-૯
૪૯ બાઇ ખરશેદબાઇ દારબજી ફરામજી ટટરીઆ (બીલીમોરા) ... ૨૭-૯
(૬૮) ૧૧૧૬ શેઠ નવરોજી દોરાબજી કરંજીઆ ૨-૧૦
(૬૯) ૫૫૦૧ શેઠ કાવશજી રૂશતમજી વરીઆવા (ઇગલાંડના ઓરનમથમાં ગુજરેલા ને કરાંચીમાં ઉઠમણુ થયલું) ૩-૧૦
૫૦ બાઇ દીનબાઇ પીરોશાહ રૂ. ગાંધી તે મરહુમ શેઠ અરદેસર દોરાબજી ગાંધીના દીકરી (મુંબઇમાં ગુજરેલા ને ભરૂચમાં ઉઠમણું થયલું) ૫-૧૦
(૭૦) ૧૫૦૩ બાઇ આલાંમાય માણેકશાહ દાદાભાઇ શેઠના તે શેઠ બાપુજી હોરમજી માઇડીયર તથા દુબાશના દીકરી ૬-૧૦
૩૧૪ શેઠ બમનજી એદલજી દારૂવાલા અથવા ભરૂચા (અમદાવાદ) ... ૭-૧૦
૬૩૯ બાઇ પીરોજબાઇ મેરવાનજી દીનશાજી દાદીવાલા (અમદાવાદ) ... ૭-૧૦
૬૭ બાઇ શુનાબાઇ કોલાભાઈ ચાંપનીં (વલસાડ) ૧૨-૧૦
૪૨ શેઠ માનેકજી એદલજી સુરતીઆ (ગણદેવી) ૧૩-૧૦
૨૮૦ શેઠ કુવરજી નવરોજી કલયાણીવાળા (મુંબઇમાં ગુજરેલા ને અજમેરમાં ઉઠમાણુ થયલું) ૧૪-૧૦
૫૫ બાઈ માણેકબાઈ એદલજી લાંઈ (વલસાડ) ૧૬-૧૦
(૭૧) ૧૩૦૩ શેઠ દીનશાહ હોરમજી ગાંધી ૧૭-૧૦
(૭૨) ૨૭૬૯ શેઠ બેજન શેહેરીયાર કેખસરૂ મોરીયાબાદી, ઇરાની ૧૭-૧૦
(૭૩) ૧૬૫૯ બાઇ મોતીબાઇ કાવશજી એરચજી દેશાઇ (નવસારી) ૧૮-૧૦
૩૨૭ બાઇ મોટીબાઇ નશરવાનજી સરકારી (વલસાડ)... ... ... ૧૮-૧૦
૫૨૪ બાઈ સુનાબાઇ નવરોજી મારસલ તે શેઠ અરદેશર બમનશાજી મારશલનાં બેટી (ભરૂચ)... ... ... ૧૯-૧૦
૩૫ બાઇ હીરાબાઇ નશરવાનજી દારાબજી કાતરક (ગણદેવી) ૨૪-૧૦
૯૨ બાઇ મેરબાઇ પેસતનજી જમશેદજી વાડીઆ (બીલીમોરા) ... ૨૪-૧૦
૧૩૩ બાઈ રતનબાઇ જમશેદજી રતનજી મેઘોરા (બીલીમોરા) ૨૪-૧૦

	૭૪૦	શેઠ નસરવાનજી બેજનજી કેલાવાલાં (ભરૂચ)	૧-૧૧
	૪૨	બાઈ દીનબાઇ માણેકજી વાહાડયા (મઉ)	૨-૧૧
	૧૫૮	શેઠ જમશેદજી રતનજી દાદાભાઈ મેઘોરા (બીલીમોરા)	૨-૧૧
(ડાલર)	૩૫૩	શેઠ પેસતનજી ફરામજી તલાતી (હોંગકોંગ)	૩-૧૧
	૨૬૨	શેઠ રૂસતમજી એદલજી દારૂવાળા	૫-૧૧
	૭૬	શેઠ નશરવાનજી કુવરજી દાદાભાઇ મલેશરા (બીલીમોરા) ...	૫-૧૧
	૧૦૪	બાઇ નવાજબાઇ દાદાભાઇ કુવરજી ભુતીઆ (બીલીમોરા) ...	૬-૧૧
(૭૪)	૧૪૯૪	બાઇ ધનબાઇ પેસતનજી સુખાજી લકકા તે શેઠ પાલનજી મનાજી તલાટીના બેટી (નવસારી)	૬-૧૧
(૭૫)	૨૨૬૮	બાઇ નવાજબાઇ નાનાભાઇ બેરામજી ડાકટર તે મરહુમ શેઠ અરદેશર સોરાબજી પારખના બેટી (સુરત)	૮-૧૧
	૬૮૫	બાઇ ગાયમાય જાહાંગીર પેસતનજી ઘોંડી તે મરહુમ શેઠ કાવશજી જમાસપજી મીસતરીના છોકરી	૧૦-૧૧
	૩૮૫	શેઠ ગુસતાદજી ભીખાજી વેવાઇના (વડોદરા)	૧૯-૧૧
	૧૩૨	શેઠ ડોસાભાઇ માણેકજી અવારી (અમદાવાદ)	૨૧-૧૧
	૧૦૫	શેઠ જમશેદજી નશરવાનજી પેસતનજી વાશણીઆ (બીલીમોરા) ...	૨૨-૧૧
	૨૧૮	બાઇ પીરોજબાઇ ચાનજીભાઇ ગાંધી	૨૭-૧૧
	૩૮૦	શેઠ જાહાંગીર નશરવાનજી પાલીસવાલા	૨૯-૧૧
	૬૮	શેઠ દાદીબા હોરમજી દાદાભાઈ આટલીઆ (બીલીમોરા) ...	૩૦-૧૧
	૫૪	બાઇ સુનાબાઇ દીનશાજી ધનજીભાઇ ખર્જોતીઆ (બીલીમોરા) ...	૩-૧૨
(૭૬)	૨૦૮૪	બાઇ નવાજબાઇ કુવરજી રૂશતમજી મોદી	૫-૧૨
	૧૭૪	બાઇ ગુલબાઇ કાવશા મીરઝા તે શેઠ ફરદુનજી મંચેરજી ખંબાતાના દીકરી (અમદાવાદ)	૮-૧૨
(૭૭)	૨૧૯૩૬૯	શેઠ રૂશતમજી નવરોજી નશરવાનજી વાહાડયા	૨૩-૧૨
(૭૮)	૧૦૦૦૦૦	શેઠ ફરામજી હોરમજી બમનજી શેઠના	૨૪-૧૨

૧૦૩૧૫૨૯ કુલે રૂપયા તથા ૩૫૩ ડાલર અને ૪૫ પાઉંડ

ઉપલા કોઠામાં જણાવેલી રૂ૧૦૦૦ અને તેની ઉપર ભરાયલી રકમો કયાં કયાં ધરમ ખાતાઓમાં આપવામાં આવી છે તેની વીગત:—

(૧) મરહુમ શેઠ ફરામજી હોરમસજી અરજાની રોજ ૩૦-૧૦-૧૨૮૭ ને દીને હક થયા તેવણના પુણ સારૂં રૂ૧૮૭૧૩ ધરમ ખાતે આપયા એમાં મરહુમના પાછલા પોહરના થયલા ઉઠમણામાં ભરાયલા રૂ૧૨૧૦૪ માં કોણ કોણે ભરેલા રૂપ્યાની વીગત ય૦ સને ૧૨૮૮ ના કેલેનડરમાં પાણે ૫૫ માં (ળ) વાલી નોંધમાં છપાઈ છે; એ ઉપરાંત મરહુમના પાછલી રાતના ઉઠમણામાં મરહુમના વીધવા ધનમાએ રૂ૨૦૦૦ તથા ભાઈ કેખશરૂ અરદેશર મોદી તથા ધણીઆણી રતનબાઈએ રૂ૭૫ મળી રૂ૨૦૭૫ ભરીયા હતા તેથી કુલે રૂ૧૪૧૭૯ ભરાયા હતા તેની વયવસથા નીચે મુજબ કરવામાં આવી છે. એ રકમમાંથી રૂ૩૦૮ મરહુમના ભાઇ તથા છોકરાઓને નામે ભરાયલા તે નવસારીનાં જુદાં જુદાં ફંડોમાં આપ્યા છે, જયારે બાકી વધેલા રૂ૧૩૮૭૧ માં એક જરથોસ્તીએ રૂ૧૨૯ ઉમેરી રૂ૧૪૦૦૦ નીચલા ધરમ ખાતામાં આપીયા છે. ડા૦ માસીનાની હોસપીટલમાં રૂ૯૦૦૦, નવસારીના અવલમંજલ પોહોંચાડવાનાં ફંડમાં રૂ૫૦૦, નવસારીના કુતાર મોહોલાના ઘમબાર ફંડમાં રૂ૫૦૦, નવસારી સર કા. જા. મદરેસામાં રૂ૫૦૦, આપાબાગ કલબમાં રૂ૧૦૦, જશન કમીટીના જશન ફંડમાં રૂ૨૦૦, ગરીબ જરથોસ્તીઓને મદદ કરવાના જામે જમશેદ ફંડમાં રૂ૩૦૦, સર જ. જી. સકુલના ભોજન ફંડમાં રૂ૧૦૦, બે. જી. સકુલના ભોજન ફંડમાં રૂ૧૦૦, ધરમ સંબંધી કેળવણી આપનારી મંડળીને રૂ૧૦૦, જરથોસ્તી વીધવાઓને પગાર આપવા રૂ૫૦૦, મુંબઈના અવલમંજલ પહોંચાડવાના ફંડમાં રૂ૧૦૦, નવસારીના આંધળા પાંગળાનાં ફંડમાં રૂ૧૦૦, સર જ. જી. ઝંદ મદરેસામાં રૂ૧૦૦, ન. મા. પીટીટ દીવાનશાળામાં રૂ૧૦૦, અંજુમનનાં આતશબેહરામના નીભાવ ફંડમાં રૂ૧૦૦, આલબલેસ લેપર હોમમાં રૂ૧૦૦, ધનજીભાઈ આલબલેસની ડીસપેનસરીમાં રૂ૧૦૦, નવસારીની વડી દરેમેહેરને તાબેનાં ભગરીઆ સાધના મોબેદોનાં ગહમબારના ફંડમાં રૂ૩૦૦, હોંગકોંગ કનતાન અને મકાઉના જરથોસતીઓનાં ધરમ ફંડમાં રૂ૧૪૫, પારસી એસોસીએશનને રૂ૨૦૦ અને બાકીના રૂપ્યા પરચુટન ફંડોમાં આપયા; ઉપલા રૂ૧૪૩૦૮ ઉપરાંત મરહુમના ધણીયાણીએ રૂ૪૪૦૫ ધરમ ખાતે આપીયા તેમાં હોંગકોંગ ખાતે આપેલા રૂ૬૪૫માં બીજા રૂ૫૦૫ ઉમેરી રૂ૧૧૫૦ કરી ડાલર ૫૦૦નું ખાતું મરનારને નામનું પડાવવા મોકલી આપયા, જ. ન. પીટીટ આરફનેજમાં મરહુમનાં ગુજરવાને દીવસે બાજ અફરગાન, શીઆવ, વીગેરે કરાવી જમાડવા ખાતું પડાવા રૂ૩૧૦૦, પારસી ઈનફલુએનઝાની હોસ્પીટલમાં રૂ૨૦૦, અથોરનાન મંડળનાં બોરડીંગ સકુલ ફંડમાં રૂ૫૦૦ અને નવસારીની દાણુ હોસપીટાલમાં રૂ૧૦૦.

(૨) મરહુમ બાઈ સુનાબાઇ ફરામજી ગજદરના પુણ માટે રૂ૧૮૮૬ ધરમ ખાતે આપયા, તેમાં મરહુમ શેઠ સોરાબજી ફ. ગજદરના બેટાઓ નસરવાનજી, જાલભાઈ, પીરોજશાહ, રૂસતમજી તથા કેખશરૂ અને બેટીઓ આઈમાય તથા દીનબાઈ મલી રૂ૧૦૦૧, શેઠ હોરમસજી દોરાબજી ગજદર રૂ૫૦૧ અને બાકીના રૂપયા ખેસીઓ વગેરે તરફથી ભરાયા હતા; એ રૂ૧૮૮૬ નીચલા ધરમ ફંડોમાં આપયા છે:—જશન મંડળીના કેળવણીના ફંડમાં રૂ૭૫૧, ચીખલીની શેઠો ફરામજી તથા હોરમસજી દો. ગજદરની અગીયારીમાં રૂ૫૫૧, સર જ. જી. સકુલ ભોજન ફંડમાં રૂ૧૦૧, શેઠ બે. જી. સ્કુલ ભોજન ફંડમાં રૂ૧૦૧, ગણદેવીની અંજુમનના ફંડમાં રૂ૨૦૦ અને બાકીના રૂપયા પરચુટણ ફંડોમાં ભરયા હતા.

(૩) મરહુમ બાઈ સુનાબાઈ ધનજીસા મેહેતાના પુણ માટે રૂ૧૨૮૨ ધરમ ખાતે આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૫૦૦, મરહુમના ધણી ધનજીશાહ રૂ૫૦૦ અને બાકીની રકમ બીજા ખેસીઓ વગેરે તરફથી ભરાઈ હતી; એ રૂ૧૨૮૨ માંથી નીચલાં ફંડમાં આપયા છે:—ડા૦ માસીના હોસપીટલમાં રૂ૨૫૦, પારસી જનરલ હોસપીટલમાં રૂ૨૫૦, ફીવર હોસપીટલમાં રૂ૨૫૦ અને ખેતવાડીના પારસીઓને સસતો અનાજ આપવા રૂ૨૫૦.

[૪] મરહુમ બાઇ હીરાબાઈ મનચેરજી મીસતરીના પુણ માટે રૂ૬૧૦૦ ધરમ ખાતે આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૨૦૦૦ ની ૩॥ ટકાની લોન, તથા મરહુમના ખાવીંદ મનચેરજીએ રૂ૧૫૦૦ ની ૩॥ ટકાની લોન મલી રૂ૩૫૦૦ ની લોન જુદી કાઢી છે તેના વયાજમાંથી મરહુમના વારસીક દીવશપર પોતાના ગામ સુમાલીમાં બાજ, જશન તથા ઘટતી ક્રીયાક્રમ કરી ગામના જરથોસ્તીઓને જમન આપવું, એના તરસ્તીઓ તરીકે શેઠો મનચેરજી ના. મીસતરી, રૂશતમજી મ. મીસતરી, બરજોરજી મ. મીસતરી, શાવકશાહ મ. મીસતરી તથા હીરાજી બરજોરજી મોબેદને નેમયા છે; બાકીના રૂ૨૬૦૦ મરહુમના છોકરાઓ તથા છોકરીઓ અને વહુ તરફથી ભરાયલા બાઈ આવાબાઇ પીટીટની છોકરીઓની ઓરફનેજમાં વયાજ વાપરવા આપયા છે.

(૫) મરહુમ બાઈ બાનુબાઈ પાલણજી પટેલના પુણ માટે રૂ૩૫૯૩ આપયા, તેમાં મરહુમના ધણી ખા૦ સા૦ પાલનજીના વીલ મુજબ રૂ૧૫૦૦ આપયા, એમાંથી સુરત પારસી આરફનેજમાં રૂ૧૦૦૦ ની ૩॥ ટકાની લોન આપી કે વીયાજમાંથી દર વરસે મરહુમ બાઈ બાનુબાઈની બાજ કરી છોકરાઓને જમાડવા, પેગમબર જરથોસતના દીસાની સુરતની નયાતના ફંડમાં રૂ૧૦૦, સુરતના નસેસાલારના ફંડમાં રૂ૧૦૦, સુરત ધમબાર ફંડમાં રૂ૧૦૦, ઉમરાગામની સગડીના ફંડમાં રૂ૧૦૦ અને સુરતના શેહેનશાહી આતશબેહેરામના કાઠી ફંડમાં રૂ૧૦૦, બાઈ બાનુબાઈની પુંજીમાંથી રૂ૧૨૦૦, શેઠ નોશીરવાન પા. પટેલ રૂ૨૦૧, શેઠ કેકોબાદ પા. પટેલ રૂ૨૦૧, શેઠ બેહેરામજી પા. પટેલ રૂ૨૦૧, બાઈ રોસનદ પા. પટેલ રૂ૧૦૧ અને બાકીના રૂપયા ખેસીઓ વગેરે તરફથી ભરાયા હતા; એ રકમ કયા આપવી તે હવે પછી જાહેર થશે.

[૬] મરહુમ શેઠ દીનશાહ બરજોરજી મેહુસીના થયલા ઉઠમણા વખતે રૂ૪૨૮૧ ધરમ ખાતે આપેલા જાહેર કીધા હતા, એમાં મરહુમ શેઠ દીનશાહજીના પુણ માટે એવણના બાવા બરજોરજીએ રૂ૨૦૦૦, એના વીયાજમાંથી મરહુમ શેઠ દીનશાજીના દર વરસના બાજના દીવસે બીલીમોરાનાં આદરીઆનમાં સુખડની માંચી ચઢાવવી, તથા ગરીબ જરથોસતીઓને અનાજ અથવા કાપડ મુફત આપવું, જયારે બીજા ખેશીઓએ ભરેલા રૂ૨૮૧ બીલીમોરાના પરચુટણ ફંડોમાં આપયા હતા; એ ઉપરાંત શેઠો બરજોરજી નશરવાનજી મેહુસી તથા પીરોશાજી ન. મેહુસીએ પોતાના બાવા નસરવાનજી જેઓ રોજ ૫ મો માહર ૨ જો સને ૧૨૪૬ ને દીને બેહેસતનશીન થયા હતા તેમનાં પુણ માટે રૂ૧૦૦૦ આપયા, તેનાં વીયાજમાંથી બેહેસતનશીનનાં બાજનાં દીવસે બીલીમોરાના આદરીઆનમાં સુખડની માંચી ચડાવવી અને ગરીબ જરથોસતીઓનાં મરણની ચાર દીવસની ક્રીયા કામમાં મદદ તરીકે આપવા, તેમજ શેઠો બરજોરજી ન. મેહુસી તથા પીરોશાજી ન. મેહુસીએ માતાજી વીરબાઇજી જેઓ રોજ ૨૫ મો માહ ૧ લો સને ૧૨૭૬ ને દીને બેહેસતનસીન થયાં હતાં તેમનાં પુણ માટે રૂ૧૦૦૦ આપયા, કે તેનાં વીયાજમાંથી મરહુમ બાઈના બાજના દીવસે બીલીમોરાના આદરીઆનમાં માચી ચઢાવવી અને ગરીબ જરથોસતીના છોકરાંને સદરો પેહેરાવવાનાં ખરચમાં આપવા. ઉપલા રૂ૪૦૦૦ ના બોંડ, બીલીમોરાની જરથોસતી અનજુમનનાં ટરસ્તીઓને આપયા છે.

(૭) મરહુમ શેઠ પીરોજશાહ હોરમજી મેહેતા રોજ ૨૨–૧–૧૨૮૮ ને દીને બેહેસતનશીન થયા તેમના ઉઠમણામાં ભરાયલા રૂ૬૩૫ તથા તેવણનાં ધણીઆણી નાજામાય તે શેઠ દોરાબજી ના. મેહેતાનાં બેટી રોજ ૨૫–૧–૧૨૮૮ ને દીને બેહેસતનશીન થયાં તેવણના ઉઠમણામાં ભરાયલા રૂ૫૩૪ મળી કુલે રૂ૧૧૬૯ નીચલાં ફંડોમાં આપયા છે:– દોરાબજી ના. મેહેતા સુવાવડખાનામાં રૂ૫૦૦, અવલમંજલ પહોંચાડવાના ફંડમાં રૂ૧૩૦, મેહેતા ખાનદાનનાં ગરીબોને આશરો આપવા રૂ૨૦૦ અને બાકીના રૂપયા પરચુટણ ફંડોમાં આપયા હતા.

[૮] મરહુમ બાઈ આલાંમાય પેસતનજી ડુંગાજીના ઉઠમણામાં મરહુમના પુણ માટે ભરાયલા રૂ૨૧૩૩ ભરૂચની પારસી પંચાયતના ફંડો વગેરેમાં આપવામાં આવયા હતા.

(૯) મરહુમ શેઠ એદલજી દાદાભાઈ નાગજીના પુણ માટે રૂ૧૨૭૬ ધરમ ખાતે આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૧૦૧, મરહુમની બેટા દાદીભા તથા વહુ મહેરબાઈ રૂ૧૦૧, મરહુમના બેટા જહાંગીર તથા વહુ રૂપાંબાઈ રૂ૧૦૧, મરહુમના બેટા દીનશા તથા વહુ માણેકબાઇ રૂ૧૦૧, મરહુમના બેટા કેખશરૂ રૂ૧૦૧, મરહુમના બેટા નાદીરશા તથા વહુ ફરેની રૂ૧૦૧, ભાઈઓ રૂસતમજી તથા નશરવાનજી બાઈસ રૂ૫૦૧ અને બાકીના રૂપયા ખેશીઓ વગરે તરફથી ભરાયા હતા.

(૧૦) મરહુમ બાઈ બચુબાઈ ડોસાભાઈ મોદીનાં પુણ માટે રૂ૧૦૨૫ ધરમ ખાતે આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૩૦૦, મરહુમના ધણી ડોસાભાઈ રૂ૫૦૦, મરહુમની બેટીઓ આમી તથા તેહેમીના રૂ૨૦૦ અને ભાઈ મરહુમ ધનજીશાહ તથા ભીખાઈ જરબાઈએ રૂ૨૫. એ રૂ૧૦૨૫ જુદા જુદા પરચુટણ ફંડોમાં આપયા હતા.

(૧૧) મરહુમ બાઈ આઈમાય રૂશતમજી કંટરાકટરના પુણ માટે રૂ૪૫૦૦ ધરમ ખાતે આપયા, તેમાં મરહુમના બાવા રૂસતમજી રૂ૧૦૦૦, મરહુમના માતાજી કુવરબાઈ રૂ૧૫૦૦, મરહુમના કાકા કાવસશાહ રૂ૧૫૧, મરહુમના ભાઈ

એદલજી રૂ૧૫૧, ડા૦ ધનજીશાહ માણેકજી બાટલીવાળા રૂ૧૫૧, બાઈ દીનબાઈ કા. કંટરાકટર, રૂ૧૦૧, બાઈ આવાંબાઈ એ. કંટરાકટર રૂ૧૦૧ અને મરનારનાં બેનો રૂ૩૪૫; એ રૂ૪૫૦૦ નીચલા ધરમ ખાતામાં આપયા છે:—બેહેરામજી સકુલના ભોજન ફંડમાં રૂ૧૦૦૦, સર જમશેદજી સકુલના ભોજન ફંડમાં રૂ૧૦૦૦, પારસી એસોસીએશનના હુનર ઉદ્યોગ ફંડમાં રૂ૧૦૦૦, ડા૦ માસીના હોસપીટલમાં રૂ૧૦૦૦ અને ઉદવાડાની અંજુમનને વાપરવાની હાજતમંદ ચીજો ખરીદવા રૂ૫૦૦.

[૧૨] મરહુમ બાઈ બાનુબાઈ પેસતનજી પટેલના ઉઠમણામાં મરહુમના પુણ્ માટે રૂ૧૦૧૪ આપવામાં આપ્યા હતા.

(૧૩) મરહુમ બાઇ કુવરબાઇ રૂશતમજી કંટરાકટરના પુણ્ માટે રૂ૫૨૨૫ ધરમ ખાતે આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૨૦૦૦, મરહુમના ધણી રૂસતમજી રૂ૧૭૦૦, મરહુમનાં હેર કાવશાહ રૂ૨૫૦, મરહુમના દીકરા એદલજી રૂ૨૫૦, ડા૦ ધનજીશાહ માણેકજી બાટલીવાલા રૂ૨૫૦, બાઈ દીનબાઇ કા. કંત્રાકટર રૂ૧૨૫, બાઈ આવાંબાઇ એ. કંત્રાકટર રૂ૧૨૫, મરહુમની દીકરીઓ રૂ૫૦૦ અને શેઠ મા. ધ. પીઠાવાળા રૂ૨૫; એ રૂ૫૨૨૫ નીચલા ફંડોમાં આપયા છે:—અવલમંજલ પહોંચાડવાનાં ફંડમાં રૂ૧૦૦૦, બાઈ હમાબાઈ પીટીટ છોકરીઓની આરફનેજમાં રૂ૧૦૦૦, બાઇ શીરીનબાઈ કામા કોનવેલેસનટ હોમમાં રૂ૫૦૦, ડુંગરવાડીના ભણતર ફંડમાં રૂ૫૦૦, દેવલાલી બહાદુરજી સેનીટોરીયમમાં રૂ૫૦૦, આંધળાં, લુલાનાં ફંડમાં રૂ૫૦૦, પારસી એસોસીએશન હુનર ઉદયોગ ફંડમાં રૂ૫૦૦, ઉદવાડા અંજુમનને હાજતની ચીજો ખરીદ કરવા રૂ૫૦૦, લેનોલી તથા ખંડાલાનાં નસેસાલારનાં ફંડમાં રૂ૨૦૦ અને ડુંગરવાડી ભણતર ફંડમાં રૂ૨૫,

[૧૪] મરહુમ બાઈ દીનબાઈ ફરામરોજ પે. વાડીયાના પુણ્ માટે રૂ૧૨૦૦ ધરમ ખાતે આપયા તેમાં મરહુમના બાવીંદ ફરામરોજ પે. વાડીઆએ સુરત પારસી ઓરફનેજમાં દર વરસે મરહુમની બાજ કરાવી છોકરાઓને જમાડવા રૂ૧૦૦૦ ના ચાર ટકાના બોંડ અને બાકીના રૂપયા ખેશીઆએ ભરેલા સુરતના બે ફંડોમાં આપયા હતા.

(૧૫) મરહુમ શેઠ બેરામજી જમસેદજી મોદીના પુણ માટે રૂ૧૫૨૭ આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૩૦૦, પીતા જમશેદજી રૂ૧૫૦, માતાજી બચુબાઈ રૂ૧૫૦, ભાઈ નાદરશા રૂ૧૦૦, વીધવા આઈમાય રૂ૧૦૦, બેન આઇમાય જ. મોદી રૂ૧૦૦, એક મીત્ર રૂ૧૦૧ અને બીજાઓના ભરાયલા રૂ૧૦૦ મલી રૂ૧૧૦૧ કયાં આપવા તે હવે પછી જણાવવામાં આવશે; મરહુમ શેઠ બેજનજી પેસતનજી પીનટો હોટલવાળાએ રૂ૧૦૦ બે ફંડોમાં અને બાકીના રૂપયા ખેસીઓ વગેરેના પરચુટણ ફંડોમાં આપયા હતા.

[૧૬] મરહુમ શેઠ ખરશેદજી એદલજી લાકડાંવાલાના પુણ માટે રૂ૫૨૫૭ આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૩૨૦૦, મરહુમના ધણીઆણી ગુલબાઈ રૂ૫૦૦, દીકરી ડોસીબાઇ જે. ડુંગાજી રૂ૪૦૦, જમાઇ જેહાંગીરજી જ. ડુંગાજી રૂ૪૦૦, દીકરી દોસીબાઇનાં દીકરા એદલજી તથા દીકરીઓ કુંવરબાઈ તથા ગુલબાઈ તથા મોટાબાય રૂ૩૦૦, ભાણેજ દારાસા જ. ડુંગાજી રૂ૫૦, ભાણેજ દીનશાજી ફ. લાકડાંવાલા રૂ૫૦, અને શેઠ નસરવાનજી બેરામજી કેપટને રૂ૧૦૧ મલી રૂ૫૦૦૧ ભરૂચની પારસી પંચાયતને આપયા કે એની સો વેવસયા કરવી તે હવે પછી જણાવશે જયારે ખેશીઓ વગેરે તરફથી ભરાયલા રૂ૨૫૬ ભરૂચની પારસી પંચાયતના જુદા જુદા ફંડોમાં આપયા હતા.

(૧૭) મરહુમ બાઈ નવાજબાઇ સોરાબજી મારકરના પુણ માટે રૂ૨૦૪૩૩ ધરમ ખાતે આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૫૦૦૧, મરહુમના ધણી સોરાબજી રૂ૫૦૦૧, મરહુમના દીકરા એરચશાહ રૂ૧૦૦૧, મરહુમની દીકરી બચુબાઈ ડી. લાકડાંવાળા રૂ૧૦૧, મરહુમના જમાઈ દીનશાહજી દા. લાકડાવાળા રૂ૧૦૧, મરહુમના વહુ લીલી ન. દમરી રૂ૩૦૧, ખા૦બા૦ અરદેસર દો. મારકર રૂ૩૦૦, શેઠ રૂસ્તમજી દો. મારકર રૂ૨૦૧, શેઠ પેસતનજી દો. મારકર રૂ૨૦૦, બાઈ રતનબાઈ જ. ચીનાઈની પુંજીમાંથી રૂ૧૦૦, બાઇ આવાંબાઈ અ. મારકર રૂ૧૦૦, શેઠ નાદીરશાહ એદલજી દીનશાહ તથા કુટુંબ રૂ૫૦૧, બાઇ નવાજબાઇ હોરમસજી લોહરાવાલાં રૂ૧૦૦, બાઈ રતનબાઇ જ. ચીનાઈ રૂ૧૦૧, નવાબ સોરાબજંગ જમશેદજી ચીનાઇ તથા બાઇ ગુલબાઈ સો. ચીનાઈ રૂ૧૦૧, શેઠ જહાગીર જમસેદજી ચીનાઈ રૂ૧૦૧, શેઠ પેસતનજી ફરામજી ભગરાત રૂ૧૦૧ અને બાકીના રૂપ્યા ખેશીઓ વગરે તરફથી ભરાયા હતા. મરહુમ બાઈ નવાજબાઈના ઉઠમણા વખતે રૂ૧૪૪૩૩ ભરાયા હતા, તે પછી મરહુમના ધણી સોરાબજીએ બીજા વધુ રૂ૬૦૦૦ ઉમેરી કુલે રૂ૨૦૪૩૩ કીધા હતા. એ રૂ૨૦૪૩૩ માંથી નીચે મુજબ ધરમખાતે આપ્યા હતા:—સુરતની શેઠ ફુકાવાલી પારસી આરફનેજમાં "સોરાબજી ડોશાભાઈ મારકર આરટ અને ઈનડસટરી (ઉદયોગ હુનર)નુ ફંડ" એ નામનુ ખાતુ પાડવા મરહુમના ધણી સોરાબજીએ રૂ૧૬૦૦૦ ના પોરટ ટ્રસ્ટ બોંડો આપયા, વેસુના મરહુમ શેઠ ડોસાભાઈ સોરાબજી મારકરના તલાવ વગેરેના ફંડના ખાતામાં રૂ૧૦૧, વેસુની દરેમહેરમાં મરહુમની બાજ રોજગાર કરવા માટે વ્યાજ વાપરવા રૂ૨૦૦૦, ખેતવાડીના ગરીબ જરથોસ્તીઓને અનાજ આપવાના ફંડમાં રૂ૫૦૧ અને બાકીના રૂપ્યા બીજા પરચુટણ ફંડોમાં આપ્યા હતા.

(૧૮) મરહુમ બાઈ આલીમાઈ રૂશતમજી કુકાના પુણ માટે રૂ૧૦૪૦૦ ધરમ ખાતે આપ્યા, તેમાં મરહુમના ધણી રૂસતમજી રૂ૬૦૦૦, દીકરી બાઈજી હોરમજશાહ પેસતન જામાસ્પ રૂ૨૦૦૦, શેઠ અરદેશર કુકા રૂ૭૦૧, શેઠ દારબશાહ કુકા રૂ૬૦૧ અને બાકીના રૂપયા કુટંબીઓ વગેરે તરફથી ભરાયા હતા.

(૧૯) મરહુમ બાઈ કુવરબાઈ (જરબાઈ) એદલજી રાંનજીનાં પુણ માટે રૂ૧૮૮૩ આપ્યા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૨૫૧, મરનારની પુંજીમાંથી મરહુમનાં બેટી મેહેરબાઈનાં પુન માટે રૂ૨૫૧, મરહુમનાં બેટી સીરીનબાઈ કા. ઘાસવાળા રૂ૨૧૦, મરહુમનાં બેટી ગુલબાઈ તથા જમાઈ નાદરશા કા. કેનતીનવાળા રૂ૨૭૫, મરહુમનાં છોકરા બેરામજી રૂ૨૫૧, મરહુમનાં છોકરા સો. એ. રાનજી રૂ૨૦૧, મરહુમનાં વહુ તેહેમીનાં સો. રાનજી રૂ૧૦૧ અને ખેશીઓ વગેરે તરફથી ભરાયલા મલી રૂ૧૭૦૦ મરહુમ શેઠ સોરાબજી હો. રાનજીની અગીયારીનાં નીચલા ભાગનાં સુધારા કરવા માટે આપયા જયારે બાકીના રૂ૧૮૩ બીજા ખેસીઓ વગેરે તરફથી ભરાયા હતા.

(૨૦) મરહુમ શેઠ રૂસતમજી બેરામજી કાંગાના પુણ માટે રૂ૨૯૫૫ આપ્યા, તેમાં મરહુમનાં માતાજી બાઈજી બે. કાંગા રૂ૧૦૦૦, મરહુમનાં ભાઈઓ તથા બેહેનો રૂ૫૦૦, બાઈ ધનબાઈજી સોરાબશાહ કાંગા રૂ૧૦૦, બાઇ ઓનોબાઇ

જામાસપ દસતુર રૂ૧૦૦, સરદાર દસતુર કૈકોબાદ આદરબાદ દસતુર નોશેરવાન તથા બાઈ સુનાબાઈ રૂ૧૦૦, શેઠ જમશેદજી ખરશેદજી તારાચંદ રૂ૫૦૦, મરહુમ શેઠ ડોસાભાઇ ભી. કાંગાની પુંજીમાંથી રૂ૧૦૦ અને બાકીના રૂપયા ખેશીઓ વગેરે તરફથી ભરાયા હતા.

(૨૧) મરહુમ બાઈ આવાંબાઈ મેરવાનજી ભરૂચાના પાછલી રાતે થયલા ઉઠમણામાં એવણના પુણ માટે રૂ૩૨૪૯ ધરમ ખાતે આપ્યા, તેમા મરહુમની પુંજીમાંથી રૂ૫૦૧, સર શાપુરજી બ. ભરૂચાએ રૂ૧૦૦૦, એમાંથી પારસી દીવાનાઓના ફંડમાં રૂ૨૦૦, અવલમંજલ પોહુચાડવાનાં ફંડમાં રૂ૨૦૦, પારસી ઓરફનેજમાં રૂ૨૦૦, સર જમશેદજી સ્કુલ ભોજન ફંડમાં રૂ૨૦૦, અને શેઠ બે. જી. સ્કુલ ભોજન ફંડમાં રૂ૨૦૦, મરહુમના દીકરા ધનજીશા રૂ૨૫૧, મરહુમના વહુ પીરોજબાઈ ધ. ભરૂચા રૂ૧૦૧, મરહુમના દીકરા ફરદુનજી રૂ૧૦૧, મરહુમના દીકરા અરદેશર રૂ૨૫૧, મરહુમના વહુ પુતલીબાઇ અ. ભરૂચા રૂ૧૫૧ અને બાકીના રૂપયા ખેશીઓ વગેરે તરફથી ફંડોમાં ભરવામાં આવ્યા હતા.

[૨૨] મરહુમ બાઇ આવાબાઇ દીનશાહજી ફરામજી હમાવાલાના થયલા ઉઠમણા વખતે રૂ૬૦૦૭ ધરમ ખાતે આપયા હતા, તેમાં મરહુમ બાઈની પુંજીમાંથી ભરૂચના જરથોસતીઓને માટે સસતા અનાજની દુકાન ખોલવા રૂ૨૦૧, ભરૂચના બાઈ સુનાબાઈ દલાલના સુવાવડખાનામાં એક બીછાનું સથાપવા રૂ૨૫૦૦ ભરૂચની પારસી પંચાયતને આપયા કે એનું વીયાજ ભરૂચ તથા તેને લગતાં ગામોની ગરીબ જરથોસતી બાઈઓની મફત સુવાવડ કરવામાં વાપરવું અને ભરૂચની પારસી પંચાયતને રૂ૨૫૦૦ આપયા કે એના સાડા પાંચ ટકાના પોર્ટ બોંડો ખરીદી તેનાં વીયાજમાંથી દર વરસે મરહુમ બાઈ આવાંબાઈના ધણી દીનશાહજીના તથા એવણના માત પીતાજી અને દીકરા એરચશાહના અને મરહુમ બાઈ આવાબાઇના પોતાના તથા એવણના માતાજી ગુલબાઈના મલી છ જણાઓની બાજ રોજગાર કરવા, મરહુમની દીકરી દોસીબાઈની દીકરી માણેકબાઇના દીકરા બમનસા રૂસતમજી મેહતાએ ભરૂચની પંચાયતને રૂ૫૦૧ આપયા કે એનું વીયાજ શામા વાપરવું તે હવે પછી જણાવશે; જયારે કુટુંબીઓ વગેરે તરફથી ભરાયલા રૂ૪૦૫ ભરૂચની પંચાયતના જુદા જુદા ફંડોમાં આપયા હતા.

[૨૩] મરહુમ શેઠ મનચેરશાહ જીવણજી બીલીમોરીઆવાળાના ઉઠમણામાં રૂપયા એક લાખ મરનારની પુંજીમાંથી સખાવતમાં આપવાનું તેવણના માતાજી, બહેનો વગેરે તરફથી જાહેર કીધુ હતું. આ નાણાં કયાં આપવા તે હવે પછી જણાવવામાં આવશે.

[૨૪] મરહુમ બાઈ હીરાબાઈ પાલનજી ભાઠેનાના થયલા ઉઠમણા વખતે મરહુમના કુટુંબીઓ વગેરે તરફથી રૂ૧૩૯૦ ભરવામાં આવયા હતા.

(૨૫) મરહુમ શેઠ બેહેરામજી ફકીરજી મોતીવાળાના પુણ માટે રૂ૬૮૮૯ ધરમ ખાતે આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૨૦૦૦, મરહુમના વીધવા સુનાબાઈ રૂ૧૫૦૦, દીકરા નશરવાનજી રૂ૧૦૦૦, દીકરી શાકરબાઇ રૂ૧૦૦૦, દીકરી ધનમાય રૂ૨૫૦, માતાજી ગુલબાઈ ફ. મોતીવાળા રૂ૧૦૦, શેઠ સોરાબજી રતનજી કરાઈ રૂ૧૦૦ અને જુદા જુદા ખેસીઓ વગેરે તરફથી મલી રૂ૬૪૯૨ ભરાયા હતા, જયારે પાછલી રાતના ઉઠમણામાં રૂ૩૯૭ ભરાયલા તેમાં મરહુમની પુંજીમાંથી ભરેલા રૂ૧૦૧ મુખ્ય હતા.

[૨૬] મરહુમ શેઠ ખુર્શેદજી ખરશેદજી સીરવઈના પુણ માટે રૂ૪૭૦૨ આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૩૦૦૦, મરહુમના કાકા ડા૦ હોરમજી રૂ૫૦૦, મરહુમના કાકા માણેકજીએ રૂ૨૦૨ એમાંથી રૂ૧૫૧ ડા૦ માસીના હાસપીટલમાં તથા રૂ૫૧ તારાપોરની દરેહમેહરમાં અને મરનારના મામા હોરમજી શાપુરજી સીરવાઈએ રૂ૧૦૦૦. એ ઉપરાંત મરહુમના મીતરો વગેરે તરફથી બીજા રૂપયા ભરાયા હતા.

(૨૭) મરહુમ બાઈ હમાબાઈ ફરામજી કામા તે મરહુમ સર દીનશાહ મા. પીટીટ પેહેલા બેરોનેટના બેટીના પુણ માટે રૂ૭૫૦૦૦ આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી મરહુમનાં વીલનાં ફરમાન મુજબ મુદ્દલ અનામત રાખી વ્યાજ મોકસ શરતોએ વાપરવા રૂ૩૦૦૦૦, મરહુમનાં દીકરા દાદાભાઈ રૂ૭૫૦૦, મરહુમનાં દીકરી હીરાંબાઈ રૂ૭૫૦૦, મરહુમનાં બેન હીરાંબાઈ જમશેદજી પીટીટ રૂ૫૦૦૦, મરહુમનાં બેન માણેકબાઇ પીરોશાહ બમનજી તથા દીકરાઓ જીજીભાઈ તથા દાદાભાઈ, તથા દીકરીઓ ધનબાઈ તથા શીરીનબાઇ રૂ૩૦૦૦, મરહુમનાં બેન બચુબાઈ મેરવાનજી સોરાબજી જમશેદજી રૂ૫૦૦૦, મરહુમનાં મરનાર બેન ભીખાઈજી દાદી નસરવાનજી દાદીશેઠના દીકરાઓ ખરશેદજી તથા નશરવાનજી તથા દીકરીઓ મેહેરબાઈ તથા બચુબાઈ રૂ૫૦૦, મરહુમનાં મરનાર બેન રતનબાઇ ફરામજી હોરાબજી પાંડેનાં બેટીઓ બચુબાઈ, કુંવરબાઈ તથા મેહેરબાઈ રૂ૧૦૦૦, ઓનરેબલ સર દીનશાહ મા. પીટીટ બીજા બેરોનેટ રૂ૧૦૦૦, શેઠ માણેકજી કાવસજી પીટીટ રૂ૧૦૦૦, મરહુમ શેઠ કાવસજી દીનશાહ પીટીટનાં કુટુંબ રૂ૧૦૦૦, મરહુમ શેઠ બમનજી દીનશાજી પીટીટનાં કુટુંબે રૂ૬૦૦૦, એમાં મરહુમ શેઠ બમનજી પીટીટના વીધવા ગુલબાઈ તથા દીકરીઓ દીનમાઈ તથા માણેકબાઈ રૂ૩૦૦૦, શેઠ જાંગીરજી બ. પીટીટ રૂ૧૦૦૦, શેઠ ધનજીભાઈ બ. પીટીટ રૂ૧૦૦૦ અને શેઠ પીરોશાહ બ. પીટીટ રૂ૧૦૦૦ મલી રૂ૬૮૫૦૦; એ ઉપરાંત મરહુમનાં પાછલી રાતનાં ઉઠમણામાં મરહુમનાં દીકરા દાદાભાઈ રૂ૨૭૫૦, મરહુમનાં દીકરી હીરાંબાઈ રૂ૨૭૫૦ અને મરહુમનાં ભત્રીજી હમાબાઈ ફરામજી પીટીટે રૂ૧૦૦૦ મલી રૂ૬૫૦૦ ભરાયા હતા.

(૨૮) મરહુમ શેઠ જમશેદજી અરદેશર ચીનાઈના પુણ માટે રૂ૯૪૦૦ આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૧૦૦૦, મરહુમના માતાજી કુંવરબાઈ રૂ૧૦૦૦, મરહુમના ધણીયાણી ભીખાઈજી રૂ૩૦૦૦, મરહુમના દીકરી માણેકબાઈ તથા ધણી જાંગીરજી ભી. દલાલ રૂ૫૦૦, મરહુમના દીકરી શીરીનબાઈ તથા ધણી કેખશરૂ કા. દાવર તથા છોકરાઓ રૂ૫૦૦, મરહુમના દીકરી રતનબાઈ જ. ચીનાઇ રૂ૧૫૦, મરહુમના ભાઈ કેખસરૂ અ. ચીનાઈ રૂ૧૫૦, મરહુમના ભાઈ કાવસજી અ. ચીનાઈ તથા ધણીઆણી સુનાબાઈ રૂ૨૦૦, મરહુમના ભાઈ પીરોશાહ અ. ચીનાઈ તથા ધણીયાણી ભીખાઇજી તથા છોકરાંઓ રૂ૨૦૦, મરહુમના ભાઈ બાપુજી અ. ચીનાઈ તથા ધણીયાણી પીરોજબાઈ રૂ૫૦૦, મરહુમના બેહેન મીઠીબાઈ અ. ચીનાઈ રૂ૧૦૦, મરહુમના બેહેન ગુલબાઇ તથા ધણી ધનજીશાહ બ. ખાન રૂ૧૫૦, મરહુમ શેઠ

માણેકજી એ. આલબલેસને નામે એવણનાં ટ્રસ્ટીઓએ રૂ૧૨૫, મરહુમના સસરા હોરમસજી એ. આલબલેસ રૂ૫૦૦, બાઈ મોતીબાઈ ફ્ર. આલબલેસ રૂ૨૦૦, બાઈ શીરીનબાઇ હી. આલબલેસ તથા છોકરાંઓ રૂ૧૦૦, બાઈ રતનબાઇ કે. મોદી તથા ધણી કેખશરૂ તથા છોકરાંઓ રૂ૧૨૫, બાઇ દીનબાઈ એ. મોદી રૂ૨૦૦, બાઇ ખરશેદબાઈ હો. આલબલેસ રૂ૧૦૦, શેઠ કાવસજી ફ્ર. દાવર તથા ધણીયાણી પીરોજબાઈ રૂ૧૦૦ અને બાકીના રૂપયા ખેસીઓ વગેરે તરફથી ભરાયા હતા. એ રૂપયા ક્યાં આપવા તે હવે પછી જણાવવામાં આવશે.

(૨૯) મરહુમ બાઈ માણેકબાંઈ માણેકજી માસતરના પુણ્ માટે રૂ૩૦૯૯, ધરમ ખાતે આપ્યા તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૫૦૧, મરહુમના ખાવીંદ માણેકજી રૂ૫૦૧, મરહુમના દીકરા ધનજીશાહ તથા દીકરીઓ રૂ૫૦૧, વેવાણ જરબાઈ હો. બામબોટ રૂ૧૦૧ અને બાકીના રૂપ્યા ખેશીઓ વગેરે તરફથી ભરાયા હતા; એ રૂ૩૦૯૯ માંથી નીચલાં ધરમખાતાંમાં આપયા હતા:—કરંજ ગામમાં મરનારને નામે એક ધરમશાળા બાંધવા માટે રૂ૨૫૦૧ અલાહેદા કહાડયા છે, ઝોરાસ્ત્રીયન બીલડીંગ ફંડમાં રૂ૧૦૧ અને બીજા રૂપ્યા પરચુટણ ફંડોમાં આપ્યા હતા.

[૩૦] મરહુમ શેઠ રૂશતમજી પુંજીઆજી દલાલના પુણ્ માટે રૂ૩૩૦૦ ધરમખાતે આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૫૦૦, દીકરા નોશરવાનજી રૂ૫૦૦, દીકરા અરદેશર રૂ૫૦૦, દીકરા ફ્રરામરોજ રૂ૩૦૦, વહુ આલીબાઈ નં. દલાલે રૂ૩૦૦, વહુ ધનબાઇ અ. દલાલે રૂ૩૦૦, વહુ બચુબાઈ ફ્ર. દલાલે રૂ૧૦૦, મરહુમના દીકરા નોશરવાનજીના દીકરાઓ દોશાભાઈ, મીનોચહેર તથા દીનશા અને દીકરી દોલતબાઇ રૂ૨૦૦, મરહુમના દીકરા અરદેસરના દીકરા ફ્રરામરોજ તથા દીકરીઓ બચુબાઇ, તેહમીના, જાલુબાઈ, રતનબાઇ અને ખુરશેદબાનુ રૂ૨૦૦, મરહુમના દીકરા ફ્રરામરોજના દીકરા શાવકશા તથા દીકરીઓ આલામાઈ, રતનમાઈ, કેરબાનુ અને દોલતબાઈ રૂ૧૦૦, અને બાકીના રૂપયા બીજા ખીશીઓ વગેરે તરફથી ભરાયા હતા; એ રૂ૩૩૦૦ નીચલાં ફંડોમાં આપયા:— સુરતની ગુલબાઈ મહેતાના સુવાવડખાનામાં રૂ૧૨૦૦ આપયા કે ભાઈઓ નશરવાનજી તથા અરદેશર તથા ફ્રરામરોજ રૂસતમજી દલાલને નામનુ ખાતુ પાડી એક પારસી બાઇની સુવાવડ દર વરસે મફત કરવામાં વયાજ વાપરવુ, સુરતની પારસી જનરલ હોસપીટલમાં રૂ૧૦૦૦ ઉપર મુજબનુ ખાતુ પાડી વયાજમાં ખરચવા આપયા, સુરત પારસી ઓરફનેજમાં ઉપર મુજબની શરતે રૂ૫૦૦, હવાનને અવલમંજલ પહોંચાડવાના ફંડમાં રૂ૫૦૦, મરહુમના ધણીઆણી રતનબાઈને નામનુ ખાતુ રૂ૫૦૦ નું છે તેમાં ઉમેરી રૂ૧૦૦૦ કરવા, સુરતના શહેનશાહી આતશબેહેરામમાં રૂ૫૦ અને આદરયાન બાગે પારસામાં રૂ૫૦.

(૩૧) મરહુમ શેઠ કેખશરૂ બરજોરજી લીંબુવાલાના પુણ્ માટે રૂ૮૨૧૪ આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૫૦૦૦, મરહુમના ભાઈ અરદેશર રૂ૧૦૦૦, મરહુમના બેવા બચુબાઈ રૂ૩૦૦, મરહુમના માતાજી બચુબાઈ રૂ૨૦૦, મરહુમના દીકરા રૂસતમજી રૂ૨૦૦, મરહુમના ભોજાઈ સીરીનબાઈ અ. લીંબુવાલા રૂ૨૦૦, મરહુમના દીકરી નરગેશ રૂ૧૦૦, મરહુમના બહેન ધનબાઈજી ફ્ર. જરીવાલા રૂ૧૦૦, મરહુમના બહેન રતનબાઇ રૂસતમજી ઇજનેર રૂ૧૦૦, મરહુમના બહેન આઈમાઈ બ. લીંબુવાલા રૂ૧૦૦, મરહુમના બહેન સુનાબાઈ કેખશરૂ માસ્તર રૂ૧૦૦, મરહુમના બહેન દીનબાઈ જાંહગીરજી લીંબુવાલા રૂ૧૦૦, કાકા મરહુમ શેઠ અરદેશર રૂ. લીંબુવાલાના છોકરાઓ માણેકજી તથા જાંહગીરજી તથા બમનજી રૂ૧૨૫, બેરોનેટ ક્રીકેટ કલબના મેમ્બરો રૂ૧૦૧ અને બાકીના રૂપયા ખેશીઓ વગેરે તરફથી ભરાયા હતા. એ રૂપયા ક્યાં આપવા તે હવે પછી જણાવવામાં આવશે.

(૩૨) મરહુમ બાઈ પુતલીબાઈ હોરમજી ભીમડીવાલાના પુણ્ માટે રૂ૭૪૫૨૯ ધરમ ખાતે આપ્યા, તેમાં ખા૦ બા૦ હોરમસજી માણેકજી ભીમડીવાલા રૂ૪૩૨૦૦, મરહુમના ખેશાવંદો તથા મીતરો તરફથી રૂ૨૧૮૮, મરહુમ બાઈ પુટલીબાઇની પુંજીમાંથી રૂ૧૦૦૦ અંજુમનના આતશબહેરામના નીભાવ ફંડમાં, મરહુમ બાઈ પુટલીબાઈના દીકરા નાનાભાઇ હો. ભીમડીવાલાએ રૂ૨૫૦૦૦ ની ૩॥ ટકાની લોન આપી કે એ રકમમાંથી અરધો ભાગ કલીઆણીના તથા ભીમરડીના જરથોસ્તીઓના કોઈબી હાજતમંદ ઉપયોગી કામોમાં વાપરવો તથા બાકીની રકમ કોઈબી જરથોસ્તીઓના હાજતમંદ ફંડોમાં વાપરવી, મરહુમના વહુ તથા છોકરાંઓ તરફથી રૂ૫૦૦, એમાંથી કલ્યાણીના લાચાર જરથોસ્તીઓને પાલનપોશન કરવાના ફંડમાં રૂ૧૦૦, કલ્યાણીના જેનરલ ફંડમાં રૂ૧૦૦, ડા૦ બહાદુરજીની દેવલાલીની સેનેટેરીઅમમાં રૂ૧૦૦, બ. દી. પીટીટ હોસ્પીટલમાં રૂ૧૦૦ અને મુંબઈના લાચાર વીધવાઓના ફંડમાં રૂ૧૦૦, મરહુમના વહેવાણ એરબાઈ ફ્ર. કલ્યાણીવાળા તથા શેઠ સોરાબજી ફ્ર. કલ્યાણીવાળાએ રૂ૫૦૦, એમાંથી કલ્યાણીના જેનરલ ફંડમાં રૂ૨૦૦, કલ્યાણીના લાચાર જરથોસ્તીઓના પાલનપોશન કરવાના ફંડમાં રૂ૨૦૦ અને અમદાવાદમાં શામ કોઠાવાળા પાશાચર ફંડમાં રૂ૧૦૦, શેઠ જમશેદ બેરામશા મુનશફે રૂ૧૦૧ મુંબઈના અવલમંજલ પહોંચાડવાના ફંડમાં, મરહુમ શેઠ હોરાબજી હો. ભીમરડીવાળા તરફથી બાઈ સીરીનબાઈ હોરાબજી તથા ડા૦ પેશોતન હો. ભીમરડીવાળાએ રૂ૨૦૧ ડા૦ પારેખની હોસપીટલમાં વ્યાજ વાપરવા, શેઠ દારાબશા મા. ભીવંડીવાળા રૂ૧૦૦, શેઠ સોરાબજી મા. ભીવંડીવાળા રૂ૧૦૦, શેઠ રતનજી મા. ભીવંડીવાળા રૂ૧૦૦, માતાજી દીનબાઇ ડો. ભીવંડીવાળા રૂ૧૨૫, બાઈ નવાજબાઈ દારબસા ભીવંડીવાળા રૂ૧૦૦, શેઠ પીરોજશા ડોસાભાઈ ભીવંડીવાળા રૂ૧૦૦, બાઈ શીરીનબાઈ સોરાબજી ભીવંડીવાળા રૂ૧૦૦, બાઈ હુનાબાઈ રતનજી ભીવંડીવાળા રૂ૧૦૦, બાઈ નવાજબાઈ માણેકશાહ ભરૂચા રૂ૧૦૦ અને બાકીના રૂપ્યા ખેશીઓ વગેરે તરફથી ભરાયા હતા.

(૩૩) મરહુમ બાઈ સુનાબાઈ સોરાબજી વારડનના પુણ્ માટે રૂ૪૪૭૧ આપ્યા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૧૦૦૦ મુંબઈનાં અવલમંજલ પહોંચાડવાનાં ફંડમાં, ખાવીંદ સોરાબજીએ રૂ૧૦૦૦ જરથોસતી છોકરીઓની નીશાળ મંડળીમાં, દીકરા દીનશાહ તથા વહુ તેહમીનાંએ રૂ૫૦૦ ડા૦ કેરાવાળાની હોસ્પીટલમાં, દીકરા પાલનજી તથા ગુલબાઈએ રૂ૨૫૦ ઝોરાસ્ત્રીયન બીલડીંગ ફંડમાં, દીકરાઓ એદલજી તથા ખરશેદજીએ રૂ૪૦૦ ઝોરાસ્ત્રીયન બીલ્ડીંગ ફંડમાં, દીકરી બચુબાઈ તથા જમાઈ નાદરશાહ શા. તારાપોરવાળાએ રૂ૨૫૦ દેવલાલી બહાદુરજી સેનેટરીઅમમાં, બેહેનો બચુબાઈ જા. તારાચંદ, ચાંદનબાઈ દાદી બામજી તથા રતનબાઇ ફ્ર. હીમજીએ રૂ૧૫૦ જરથોસ્તીઓને અનાજ આપવાના ફંડમાં, મરહુમ બાઈ રતનબાઈ જ. પટેલની દીકરીઓએ રૂ૧૦૦ સર. જ. જી. સ્કુલનાં ભોજન ફંડમાં, મરહુમ શેઠ કુંવરજી તથા

શેરામજી તથા ખરશેદજી એદલજી ઉમરીગર તરફથી રૂ૧૫૦ પરચુટણ ફંડોમાં, શેઠ બરજોરજી ફ્રામરોજ જોશીએ રૂ૧૦૨ પરચુનતન ફંડોમાં, શેઠો રૂસતમજી તથા નશરવાનજી નાનાભાઈ બાઈસે રૂ૧૦૧ ડા૦ માસીનાની હોસ્પીટલમાં, બાઈ ફુલબાઈ મે. બાઈસે રૂ૧૦૧ અવલમંજલ પહોંચાડવાનાં ફંડમાં અને બાકીના રૂપયા ખેશીઓ વગેરે તરફથી ફંડોમાં ભરવામાં આવ્યા હતા.

(૩૪) મરહુમ બાઈ બાનુબાઈ સોરાબજી મેહેનતીના પુણ માટે રૂ૧૦૧૨ ધરમ ખાતે આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૧૦૦, શેઠ પીરોજશાહ સોરાબજી મેહેનટી રૂ૩૦૦, શેઠ મનચેરશાહ સો. મેહેનટી રૂ૩૦૦, તથા રૂપાંબાઈ મ. મેહેનટી રૂ૫૦ અને બાકીના રૂપયા ખેસીઓ વગેરે તરફથી ભરાયા હતા. એ રૂ૧૦૧૨ ની પાંચ ટકાની ચાર લોન સુરતની પારસી ઓરફનેજમાં વયાજ વાપરવા આપી છે.

[૩૫] મરહુમ બાઈ ધનબાઈજી સોરાબજી પાતરાંવલાના પુણ માટે ભરાયલા રૂ૩૪૮૯ ધરમખાતાંઓમાં આપવામાં આવયા હતા, તેમાં ડા. પારેખની હાસપીટલમાં બીછાનું જાલવવા માટે રૂ૩૦૦૦, નવસારીની મલેસરની ગરલસ ઈંગલીશ સ્કુલમાં એક ઈનામ આપવા રૂ૧૦૦, નવસારીની ઓટેફ્લીઓની ગરલસ ઇંગલીશ સકુલમાં એક ઈનામ આપવા રૂ૧૦૦, ડા૦ માસીનાં હાસપીટલમાં રૂ૧૦૦, અને બાકીના રૂપયા પરચુટણ ફંડોમાં આપયા હતા.

(૩૬) મરહુમ શેઠ ધનજીશાહ બમનજી ખાનના પુણ માટે રૂ૧૦૮૦૧ આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૨૦૦૦, મરહુમના વીધવા ગુલબાઈ રૂ૫૦૦, દીકરા દીનશાહજી તથા દીકરી દીનબાઈ રૂ૫૦૦, મરહુમ શેઠ બમનજી દીનશાહજી ખાનના છોકરાઓ તથા છોકરીઓ રૂ૫૦૦, કાકા પેસતનજી દીનશાહ ખાન રૂ૨૦૦૦, કાકાના દીકરા નશરવાનજી પે. ખાન તથા ધણીઆણી બાનુબાઇ રૂ૫૦૦, શેઠ ફ્રામજી પે. ખાન તથા ધણીઆણી ફ્રેની રૂ૫૦૦, શેઠો નશરવાનજી તથા ફ્રામજી પેસતનજી ખાન રૂ૧૦૦, શેઠ ભીખાજી ફ્રામજી ખાન તથા ધણીઆણી આવાંબાઈ રૂ૧૦૦૦, શેઠ મનચેરશાહ ફ્રામજી ખાન તથા ધણીઆણી શીરીનબાઈ રૂ૫૦૦, બાઇ નવાજબાઇ દીનશાહજી ખાન રૂ૧૦૦, શેઠો દીનશાહજી ભીખાજી ખાનની કં૦ રૂ૫૦૧, બાઈ તેહમીના હો. સાહેર તથા ધણી હોરમસજી ન. સાહેર રૂ૫૦૦, બાઈ કુંવરબાઈ અરદેશર ચીનાઈ રૂ૩૦૦ અને બાકીના રૂપયા ખેશીઓ વગેરે તરફથી આપયા હતા; એ રૂપયા કયાં આપવા તે હવે પછી જણાવવમાં આવશે.

(૩૭) મરહુમ બાઇ મેરબાઇ સોરાબજી દાદાભાઇ દીવેચાના પુણ માટે રૂ૭૮૬૩ આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૨૦૦૦, મરનારના મરહુમ બાવાજી તથા માતાજીની પુંજીમાંથી રૂ૨૦૦૦, મરહુમના ભાઇઓ ફ્રામજી તથા કૈકોબાદ રૂ૨૦૦૦, મરહુમના બહેન ખરશેદબાઈ રૂ૫૦૦, મરહુમના બહેન ગુલબાઈ રૂ૫૦૦, મરહુમના ભોજાઇ કુંવરબાઈ ફ્રૂ. દીવેચાએ રૂ૨૦૦ મલી રૂ૭૨૦૦ કયાં આપવા તે હવે પછી જણાવવામાં આવશે; શેઠ નાનાભાઈ દીનશાજી દીવેચાએ રૂ૩૦૦, એમાંથી પારસી ફીવર હોસ્પીટલમાં રૂ૧૦૦, પંચાયતના ગરીબોને સસતો અનાજ આપવાનાં ફંડમાં રૂ૨૦૦, મરહુમ શેઠ અરદેશર રૂ. દીવેચાની પુંજીમાંથી દીકરાઓએ રૂ૧૦૧ પંચાયતના ગરીબોને સસ્તો અનાજ આપવાનાં ફંડમાં અને બાકીના રૂપયા ખેસીઓ વગેરે તરફથી પરચુટણ ફંડોમાં આપયા હતા.

(૩૮) મરહુમ શેઠ મેરવાનજી મનચેરજી ગુદવેવાળા તથા ભેસાનીઆના પુણ માટે રૂ૫૬૭૩ આપ્યા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૨૦૦૧, દીકરા શાવકશાહ રૂ૧૦૦૧, બાઈ ગુલબાઈ શા. ગુદવેવાળા રૂ૩૦૧, શેઠ રૂસતમજી શા. ગુદવેવાળા રૂ૧૦૧, શેઠ ખોરશેદજી શા. ગુદવેવાળા રૂ૧૦૧, બાઈ પુતળાં શા. ગુદવેવાળા રૂ૧૦૧, શેઠ ખરશેદજી મનચેરજી ભેસાનીઆ રૂ૫૦૧, બાઈ કુવરબાઈ ખ. ભેસાનાઆ રૂ૨૦૧, શેઠ ફ્રરદુનજી ખ. ભેસાનીઆ રૂ૧૦૧, શેઠ પેસતનજી ખ. ભેસાનીઆ રૂ૧૦૧, શેઠ મનચેરશાહ ખ. ભેસાનીઆ રૂ૧૦૧, બાઈ હીરાંબાઈ તથા શેઠ નશરવાનજી ખ. ભેસાનીઆ રૂ૧૦૧, શેઠો સોરાબજી તથા કાવસજી દાદાભાઈ દુબાશ રૂ૫૦૧ પંચાએતના ગરીબોને અનાજ આપવાના ફંડમાં અને બાકીના રૂપયા ખેસીઓ વગેરે તરફથી ભરાયા હતા; એ રૂપયા કયા આપવા તે હવે પછી જણાવામાં આવશે.

(૩૯) મરહુમ શેઠ નાદરશા હોરમસજી બેલગામવાળાના પુણ માટે રૂ૩૦૨૧ ધરમ ખાતે આપ્યા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૫૦૦, ધણીઆણી ડોશીબાઈ રૂ૫૦૦ મળી રૂ૧૦૦૦ ઝોરાસ્ત્રીયન બીલડીંગ ફંડમાં, સસરા મનચેરશા સોરાબજી વખારીઆ તથા બાઇ કુંવરબાઈ મ. વખારીઆ તથા છોકરાઓએ રૂ૧૦૦૦, એમાંથી ભરૂચમાં પારસીઓને ધંધા રોજગારમાં લગાડવાના ફંડમાં રૂ૫૦૦ અને ઝોરાસ્ત્રીયન બીલડીંગ ફંડમાં રૂ૫૦૦, મરહુમના બાવા હોરમસજી રૂ૨૦૦, માતા દીનબાઈ રૂ૧૦૦, શેઠ હીરજીભાઈ હોરમસજી બેલગામવાળા રૂ૧૦૦, શેઠ નવરોજી હોરમસજી બેલગામવાળા રૂ૧૦૦ અને બીજાઓએ ભરેલા મલી રૂ૮૦૨ નીચે મુજબ આપ્યા હતાઃ– સર જમશેદજી સ્કુલના ભોજન ફંડમાં રૂ૫૦૦ ના ટકા ૫ નો મ્યુનીસીપલ બોંડ, ગરીબ જરથોસ્તીઓને અનાજ આપવાનાં ફંડમાં રૂ૧૦૦, બે૦ જી૦ સ્કુલના ભોજન ફંડમાં રૂ૧૦૦ અને બાકીના રૂપ્યા બે ફંડોમાં, શેઠ રૂસતમજી એદલજી પાપા તથા ધણીઆણી દીનબાઈએ રૂ૧૦૦ ગરીબોને અનાજ આપવા અથવા સર જ. સ્કુલના ભોજણ ફંડમાં, અને બાકીના રૂપ્યા ખેશીઓ વગેરે તરફથી ફંડોમાં આપ્યા હતા.

(૪૦) મરહુમ બાઈ નવાજબાઈ દાદાભાઇ શરાફનાં પુણ માટે રૂ૨૬૫૮ ધરમ ખાતે આપ્યા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૩૦૦ ની લોન એમાંથી રૂ૧૦૦ અવલમંજલ પહોંચાડવાના ફંડમાં, રૂ૧૦૦ અંજુમનનાં આતશબેહેરામના નીભાવ ફંડમાં અને રૂ૧૦૦ બે૦ જી૦ સ્કુલના નીભાવ ફંડમાં, મરહુમના ખાવીંદ દાદાભાઈએ રૂ૩૦૦ની લોન એમાંથી મરનાર બાઈ નવાજબાઈની અંજુમનનાં આતશબેહેરામમાં બાજ રોજગાર સારૂ આગમચથી આપેલી રકમમાં ઉમેરવા રૂ૧૦૦, અંજુમનનાં આતશબેહેરામમાં બાજ ધરવાના ફંડમાં રૂ૧૦૦ અને ડા૦ માસીના હોસપીટલના નીભાવ ફંડમાં રૂ૧૦૦, મરનારના મરહુમ દીકરા પીરોજશાહ તથા મરહુમ દીકરી બચુબાઈ તરફથી રૂ૧૦૦ સર જમશેદજીની સકુલના નીભાવ ફંડમાં, બાઇ બાઈમાય પીરોજશાહ શરાફ અને શેઠ ફ્રેદુન પી. શરાફે રૂ૩૦૦ વીધવાઓને આશરો આપવાના ફંડમાં, દીકરી શીરીનબાઈ ખરશેદજી દારૂવાળાએ રૂ૧૦૦ અંજુમનના આતશબેહેરામના સુધારા વધારાના ફંડમાં, દીકરી રતનબાઇ નશરવાનજી મીસ્ત્રીએ રૂ૧૦૦ ની લોન બ. દી. પીટીટ હોસપીટમાં, દીકરી પીરોજબાઈ ફ્રરામજી કુઠીએ રૂ૧૦૦ ની લોન સર તેમુલજીના સુવાવડખાનામાં, દીકરી ગુલબાઈ દાદાભાઈ શરાફે રૂ૧૦૦ ની લોન ડા૦ માસીના હાસપીટલના 'સેપટીક' ફંડમાં,

શેઠ ફરામજી જમશેદજી કયોક ૱૩૦૦, મરહુમ બાઇ આઇમાય ફ. કયોકની પુંજીમાંથી ૱૧૦૦ અને બીજાઓએ ભરેલા ૱૬૦૦ મળી ૱૧૦૦૦ ની લોન ડા૦ માસીના હાસ્પીટલના એનડાઉમેન્ટ ફંડમાં, મરહુમ બાઈ આઈમાય ફ. કયોકના પડાવેલા ખાતામાં, બાઇ ધનબાઈજી પી. પાલીસવાળાએ ૱૫૦ તથા શેઠ પીરોજશાહ ન. પાલીસવાળાએ ૱૫૦ મળી ૱૧૦૦ પારસી એસોસીએશનના બેકારી ફંડમાં, મરહુમના વેવાઈ સોરાબજી તથા ખા૦ બા૦ હોરમસજી તથા દારબશાહ તથા રતનજી માણેકજી ભીમરડીવાળાએ ૱૧૦૧ કલયાણીના જરથોસતીઓના દુ:ખ નીવારણ ફંડમાં અને બાકીના રૂપીયા બેસીઓ વગેરે તરફથી પરચુટણ ફંડમાં આપ્યા હતા.

[૪૧] મરહુમ શેઠ ફરામજી કાવસજી કાતારાગાના ઉઠમણામાં મરનારની પુંજીમાંથી તથા મરનારના ભાઈઓ તથા છોકરાઓ તરફથી ૱૧૫૦૦૦ ભરવામાં આવયા હતા.

[૪૨] મરહુમ શેઠ રૂતસમજી નશરવાનજી મહેતાના ઉઠમણામાં ભરાયલા ૱૧૬૪૩ ભરચની પારસી પંચાયત હુસ્તકના ફંડો વગેરેમાં આપવામાં આવયા હતા.

[૪૩] મરહુમ શેઠ રતનજી ડોશાભાઈ પટેલના ઉઠમણામાં ભરાયલા ૱૩૮૫૮ મઉના ફંડોમાં આપવામાં આવયા હતા.

[૪૪] મરહુમ શેઠ ધનજીશાહ જમશેદજી માસતરના ઉઠમાણામાં ૱૧૦૬૬૩ મરહુમની પુંજીમાંથી તેમજ મરહુમના કુટંબીઓ વગેરે તરફથી ભરવામાં આવયા હતા.

[૪૫] મરહુમ બાઇ ડોસીબાઇ અરદેશર બેહરાનાના ઉઠમણામાં ૱૫૩૬૪ મરહુમની પુંજીમાંથી તેમજ મરહુમના કુટંબીઓ વગેરે તરફથી ભરવામાં આપયા હતા.

(૪૬) મરહુમ કેપટન ફીરોઝ બાપુજી ચીનાઇના પુણ્ માટે ૱૮૪૫૪ ધરમ ખાતે આપયા તેમાં મરહુમની પુંજીમાંથી ૱૧૦૦૦, પીતાજી બાપુજી ૱૧૦૦૦, માતાજી માંણેકબાઈ ૱૧૦૦૦, કાકા શાપુરજી ૱૫૦૦, બાઈ સુનાબાઇ શા. ચીનાઇ ૱૩૦૦, શેઠ દારા શા. ચીનાઈ ૱૧૦૦, શેઠ રશીદ શા. ચીનાઇ ૱૧૦૦, શેઠ દોરાબજી બા. ચીનાઈ ૱૭૫૦, બાઈ ધનબાઇ શે. ચીનાઇ ૱૨૫૦, શેઠ પેસતનજી બા. ચીનાઈ ૱૩૫૦, બાઈ નાજામાય પેશતનજી ૱૬૫૦, શેઠ નાદરશાહ બા. ચીનાઇ ૱૫૦૦, બાઈ જરબાનુ ના. ચીનાઇ ૱૨૫૦, પાલક કાવસ ફીરોઝ ચીનાઈ ૱૨૦૧, બાઈ રતનબાઈ પા. ચીનાઈ ૱૩૫૦, શેઠ પાલનજી ખુરશેદજી ચીનાઈ ૱૧૫૦, બાઈ ગુલબાનુ કાવસજી થાણાવાલા ૱૨૦૦, શેઠ કાવસજી ખુ. થાણેવાળા ૱૧૦૦, શેઠ ડોસાભાઇ નોશરવાનજી ચીનાઈ ૱૧૨૫, નવાબ સોરાબ નવાઝજંગ ૱૧૨૫ અને બાકીના રૂપીયા બેસીઓ વગેરે તરફથી ભરાયા હતા.

(૪૭) મરહુમ શેઠ હોરમસજી કાવસજી ખંબાતાના પુણ્ માટે ૱૬૧૮૩ ધરમ ખાતે આપયા, તેમાં ખંબાતમાં થયલાં મરહુમના ઉઠમણામાં ૱૫૫૦૯ આપ્યા, એમાં મરહુમની પુંજીમાંથી ૱૧૦૧૨, બાવા કાવસજી ૱૩૦૦૦, માતાજી દીનબાઈ ૱૫૦૦, ધણીયાણી ગુલાંમાય ૱૫૦૦, ફુઈ ડોસીબાઈ ફું. દલાલ ૱૧૦૦, સસરા ડોસાભાઈ મા. વકીલ ૱૧૦૧ અને બાકીના રૂપ્યા બેશીઓ વગેરે તરફથી ભરાયા હતા; એ ૱૫૫૦૯ ના વયાજમાંથી મરહુમની દર વરસની બાજને દીને ખંબાતની અંજુમનને જમાડી બાકીના રૂપીયા જે વધે તે ખંબાતના ગરીબ જરથોસતીઓને અનાજ તથા કપડાં આપવાની ગોઠવણ કરી છે. મરહુમના ભરચ ખાતે થયલા ઉઠમણામાં ૱૬૭૪ ભરાયા હતા, તેમાં મરહુમની પુંજીમાંથી ૱૨૦૧, મરહુમના બાવા કાવસજી ૱૩૦૧ અને બાકીના રૂપ્યા બેશીઓ વગેરે તરફથી ભરાયા હતા; એ ૱૬૭૪ ભરચની પારસી પંચાયત હુસ્તકના જુદા જુદા ફંડોમાં આપયા હતા.

(૪૮) મરહુમ શેઠ પેસતનજી ફરામજી શરાફના પુન સાર ૱૯૦૦૦ ના પોરટ ટ્રસટ બોનડ ટકા ૪ ના આપીયા, તેમાં મરહુમની પુંજીમાથી ૱૪૦૦૦, બેટા હોરમસજી ૱૧૦૦૦, બેટા ફરામજી ૱૧૦૦૦, બેટા કાવસજી ૱૧૦૦૦, બેટી રતનબાઇ ૱૫૦૦, બેટી મેહેરબાઇ ૱૫૦૦, બેટી આવાંબાઈ ૱૫૦૦, વહુ ખોરશેદબાઈ હો. શરાફ ૱૨૫૦ અને સાળા ડોસાભાઈએ ૱૨૫૦; એ ૱૯૦૦૦ માંથી ડા૦ માશીનાની હોસપીટલમાં એનડાઉમેન્ટ ફંડમાં વીયાજ વાપરવા ૱૬૦૦૦ અને બે. જી. સ્કુલ ભોજન ફંડમાં ૱૩૦૦૦ વયાજ વપરવા આપીયા હતા.

(૪૯) મરહુમ બાઈ આવાબાઈ પીરોશાહ મેહતાના પુણ માટે ૱૧૨૩૩૮ ધરમ ખાતે આપીયા, તેમાં મરહુમની પુંજીમાંથી તથા મરહુમના ખાવીંદ પીરોજસાએ ૱૧૦૦૦૦ ડા૦ મસીનાની હાસ્પીતાલમાં મરનારને નામનુ એક બીછાનુ સ્થાપવા અને બાકીના ૱૨૩૩૮ બેશીઓ વગેરે તરફથી ભરાયલા તે નીચે મુજબ આપયાછે:- ડા૦ માસીનાની હાસ્પીતાલમાં ૱૫૮૨, બાઈ હુમાબાઇ પીટીટની છોકરીઓની ઓરફનેજમાં ૱૫૦૦, અવલમજલ પોહોચાડવાના ફંડમાં ૱૨૦૦, જરથોસ્તીઓને પગાર આપવાના ફંડમાં ૱૧૦૦, લાચાર જરથોસ્તીઓને હવા ફેરબદલ કરવા જવાના ફંડમાં ૱૧૦૦, ડા૦ પારખના સુવાવડખાનામાં ૱૧૦૦, ઈગતપુરાની માણેકબાઈ ઉમરીગરની સ્કુલમાં ૱૨૨૬, નવશારીમાં મહેતાના કુટુંબના જુદા જુદા ફંડોમાં ૱૪૨૯ અને બાકીના રૂપીયા પરચુટણ ફંડોમાં આપીયા.

[૫૦] મરહુમ બાઇ માણેકબાઈ પીરોશાજી પટેલના પુણ માટે ૱૩૩૪૮ ધરમખાતે આપયા, તેમાં મરહુમ બાઇના એડન ખાતેના ઉઠમણા વખતે ૱૨૭૫૦ ભરાયલા તેમાં મરહુમના ધણી પીરોશા ૱૧૦૦૧, મરહુમના સસરા પાલનજી ધ. પટેલ ૱૫૦૧, મરહુમના બાવા અરદેશર માંણેકજી દોતીવાલા ૱૧૦૧, મરહુમના શાસુ ગુલબાઈ પાલનજી ૱૧૦૧, મરહુમના જેઠ દોરાબજી પાલનજી તથા બાઇ ગુલબાઈ ૱૧૦૧ અને બાકીના રૂપયા બેશીઓ વગેરે તરફથી ભરાયા હતા; એ ૱૨૭૫૦માથી એડનની દરેમેહેરના ફંડમાં ૱૧૩૭૫, સુરત સુવાવડખાનામાં ૱૧૦૦૦ અને સીગનપોરના રૂવાનોને અવલમંજલ પોંચાડવાના ફંડમાં ૱૩૭૫ આપયા; જ્યારે મરહુમ બાઇના સીગનપોરમાં થયલા ઉઠમણા વખતે ૱૫૯૮ ભરાયલા તેમાં શેઠ પાલનજી ધ. પતેલ ને બાઇ ગુલબાઈ ૱૧૦૨, શેઠ એદલજી કુવરજી ને બાઈ કુવરબાઇ ૱૧૦૨ અને બાકીના રૂપયા બેશીઓ વગેરે તરફથી ભરાયા હતા; એ ૱૫૯૮ માંથી સીગનપોરના જરથોસતીઓને અનાજ આપવા ૱૫૩૫ અને સીગનપોરના અવલમંજલ પોચાડવાના ફંડમાં ૱૬૩ આપયા હતા.

[૫૧] મરહુમ બાઈ ગુલબાઈ જહાંગીરજી પટેલનાં પુણ માટે રૂ૧૮૩૯ આપયા તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૧૦૦૦ આપયા કે તેના વીયાજમાંથી બાઈ ગુલબાઈની દરવરસની બાજને દીવસે ધરમક્રીયા કરાવવી, માતાજી આમી-બાઈ જા. પટેલ રૂ૨૦૧, પીતાજી જહાંગીરજી એ. પટેલ રૂ૧૦૧, ભાઈ એરચસા રૂ૧૦૧, ભાઈ રૂસતમજી રૂ૧૦૧, ભોજાઈ તેમીના રૂ. પટેલ રૂ૧૦૧, મામાજી બેહરામજી હોરમજી નાણાવટી રૂ૧૦૧, અને બાકીના રૂપયા કુટંબીઓ તરફથી ભરાયા હતા; એ રૂ૮૩૯ કયાં આપવા તે હવે જણાવવામાં આવશે.

[૫૨] મરહુમ શેઠ એદલજી નશરવાનજી દુબાશના પુણ માટે રૂ૧૫૫૦ ધરમ ખાતે આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૧૦૦૦, એમાંથી ડા૦ કેરાવાળા હોસ્પીટલમાં રૂ૫૦૦, શેઠ બેહેરામજી સ્કુલનાં ભોજન ફંડમાં રૂ૩૦૦ અને સર જમશેદજી સ્કુલનાં ભોજન ફંડમાં રૂ૨૦૦, મરહુમનાં ધણીઆણી જરબાઈએ રૂ૧૫૦ ત્રણ ફંડોમાં, મરહુમના ભાઈ બહેનોએ રૂ૩૫૦ પરચુટણ ફંડોમાં અને મરહુમના મામા રૂસતમજી મા. દારૂવાળાએ રૂ૫૦ ડા૦ કેરાંવાળા હોસ્પીટાલમાં આપયા હતા.

[૫૩] મરહુમ શેઠ અરદેસર એદલજી લાકડાવાલાના ઉઠમણામાં મરનારની પુંજીમાંથી તથા ખેશીઓ વગેરે તરફથી ભરાયલા રૂ૧૧૦૦ ભરૂચની પારસી પંચાયતના ફંડો વગેરેમાં આપવામાં આવયા હતા.

[૫૪] મરહુમ ડા૦ જમશેદજી ફરદુનજી દસ્તુરના પુણ માટે રૂ૧૪૧૫ ધરમ ખાતે આપયા, તેમાં મરહુમની પુંજીમાથી રૂ૫૦૧, મરહુમના ધણીયાણી આવાબાઈ રૂ૧૦૧ અને ખેસીઓ વગેરે તરફથી ભરાયલા મલી રૂ૧૨૯૯ ભરૂચની પંચાયતને આપ્યા કે એવું મરહુમના નામનું ધરમાદા ખાતું પાડવું અને એમાં સરઅવસરે જે કાંઇ ભરાય તે તથા વયાજની જે ઉતપતી થાય તે એ ખાતે જમા કરવું અને રૂ૨૫૦૦ ની થાપણ થવેથી ભરૂચના સુનાબાઈ દલાલ સુવાવડખાનામાં એક બીછાનું બેહસતીની નઈઅતે સથાપવું, જયારે બાકીના રૂ૧૧૬ ભરૂચનાં ફંડોમાં આપયા હતા.

[૫૫] મરહુમ બાઈ આઈમાય સોરાબજી પુનેવાળાના પુણ માટે રૂ૧૪૫૧ ધરમ ખાતે આપ્યા, તેમાં મરહુમના માતાજી પીરોજબાઈએ રૂ૧૦૦ બાળકોને મદદ કરવાના ફંડમાં, રૂ૧૦૦ ડુંગરવાડીના ભણતર ફંડમાં, તથા રૂ૧૦૦ બે. જી. સકુલના ભોજન ફંડમાં, મરહુમના ભાઇ કાવસજી સો. પુનેવાળાએ રૂ૧૦૦ વીધવાઓને આશરો આપવાના ફંડમાં, મરહુમના મામા ફરામરોઝ શાપુરજી પુનેવાળા તથા અલીબાગવાળાએ રૂ૧૦૦ ડા૦ બાસીના હાસપીટલમાં, મરહુમના મામા જહાંગીર શા. પુનેવાળાએ રૂ૧૦૦ આંધળા લુલાંના ફંડમાં, મરહુમના માસી શીરીનબાઈ બેહેરામજી જાલનેવાળાએ રૂ૧૦૦ આંધલા લુલાનાં ફંડમાં, મરહુમના માસા બેહેરામજી ફ. જાલનેવાલાએ રૂ૧૦૦ ગરીબ ઈરાનીઓને મદદ કરવાના ફંડમાં તથા રૂ૧૦૦ લાચાર જરથોસ્તીઓને મદદ કરવાના ફંડમાં, બાઈ શેહેરાં જ. શરાફે રૂ૫૧ ડા૦ કેરાંવાળાની હાસપીટલમાં, મરહુમના માતાજી પીરોજબાઈ રૂ૨૦૦, મરહુમના ભાઈ કાવસજી રૂ૨૦૦ અને મરહુમના મમાવા શાપુરજી ના. અલીબાગવાળાએ રૂ૧૦૦ મલી રૂ૫૦૦ નવસારીની ડાબુ હોસપીટલમા વયાજ વાપરવા આપયા હતા.

[૫૬] મરહુમ શેઠ ખરશેદજી જામાસજી દારૂવાલાના ઉઠમણામાં મરનારની પુંજીમાંથી અને તેમના સગાંવહાલાંઓ વગેરે તરફથી ભરાયલા રૂ૧૩૫૩ ભરૂચની પંચાયતના ફંડો વગેરેમાં આપયા હતા.

[૫૭] મરહુમ શેઠ અરદેશર મનચેરજી મોદીના પુણ માટે રૂ૧૭૦૨ ધરમખાતે આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૩૦૦, મરહુમના વીધવા આઈમાય અને છોકરાંઓ રૂ૨૦૦, શેઠ શાવકશા જમશેદજી ચોકસી અને ધણીયાણી ભીખાઈજી તથા બેટીઓ રૂ૧૫૦, શેઠ દાદાભાઈ ડોસાભાઈ આસપલેસ રૂ૧૫૦, શેઠ એદલજી ડોસાભાઇ આસપલેસ રૂ૧૫૦, મરહુમની ઓફીસ મેશરસ સી. બેજીયાનોની કંપની રૂ૨૨૦, મરહુમની પેઢી મેશરસ ફારૂરડની કંપની બીલાંઉવાળા રૂ૩૦૦ અને બાકીના રૂપયા ખેસીઓ વગેરે તરફથી ભરાયા હતા.

[૫૮] મરહુમ શેઠ પેસતનજી ખરશેદજી ઉમરીગરના પુણ માટે ૧૦૦૯૭ આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૨૫૦૦, મરનારના બાવા મરહુમ શેઠ ખરશેદજી એ. ઉમરીગર તથા માતાજી સુનાબાઇ તરફથી રૂ૧૦૦૦, મરહુમના દીકરા કેખશરૂ રૂ૧૦૦૦, મરહુમનાં ધણીઆણી ધનબાઈ રૂ૫૦૦, મરહુમના ભાઈ દારાબશાજી રૂ૮૦૦, મરહુમના ભોજાઈ આઈમાય દા. ઉમરીગર રૂ૨૦૦, મરહુમના બેહેન શીરીનબાઈ પીરોશાજી ડાકટરે રૂ૧૨૫ ઉરણની અગીઆરીનાં નીભાવ ફંડમાં, મરનારના બેહેન રતનબાઈ પીરોશા ઉમરીગર રૂ૧૨૫, મરનારના કાકા મરહુમ શેઠ કુંવરજી એ. ઉમરીગરનાં છોકરાંઓ રૂ૧૦૦૦, મરનારના કાકા મરહુમ શેઠ બેરામજી એ. ઉમરીગરનાં છોકરાંઓ રૂ૧૦૦૦, મરનારના સાસુ મરહુમ બાઈ જાઈજી જ. ઉમરીગર રૂ૧૦૦, મરહુમના સસરા જમશેદજી રૂ. ઉમરીગર રૂ૨૦૦, મરહુમના બનેવી પીરોજશા જા. ડાકટરે રૂ૧૦૧ સુરત નાનપુરાનાં દવાખાનામાં, શેઠ ધનજીશાહ રૂસ્તમજી ઉમરીગરે રૂ૧૦૧ સુરતની આરફનેજમાં, શેઠો હોરમજી તથા એદલજી શાપુરજી ઉમરીગરની કં. રૂ૧૦૦, બાઈ ગુલબાઈ માણેકજી ડાકટર રૂ૧૦૦, મરહુમ શેઠ જાહાંગીર જામાસજી બેગાના દીકરાઓ રૂ૧૫૧, મરહુમ શેઠ અરદેશર જમશેદજી ઉમરીગરની પુંજીમાંથી રૂ૧૦૧ અને બાકીના રૂપયા ખેશીઓ વગેરે તરફથી ભરાયા હતા; એ રૂ૧૦૦૯૭ માંથી રૂ૯૭૬ જુદા જુદા ફંડોમાં આપયા, જયારે બાકીના રૂ૯૧૨૧ .કયા આપવા તે હવે પછી નકકી કરવામાં આવશે.

[૫૯] મરહુમ બાઈ શીરીનબાઈ રૂસતમજી ભરૂચાનાં પાછલી રાતનાં ઉઠમણામાં રૂ૨૫૩૪ આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૧૫૧, મરહુમનાં ધણી રૂસ્તમજી રૂ૧૫૧, સર શાપુરજી બરજોરજી ભરૂચા રૂ૧૦૦૦, મરહુમના ભાઈ અરદેશર મે. ભરૂચા રૂ૧૫૧, મરહુમના ભોજાઈ પુટલીબાઈ અ. ભરૂચા રૂ૧૫૧, અને બાકીના રૂપયા ખેસીઓ વગેરે તરફથી ભરવામાં આવ્યા હતા.

[૬૦] મરહુમ બાઇ બચુબાઈ ફીરોઝ ભરૂચાના પુણ માટે કુલે રૂ૩૪૭૨૩ ધરમખાતે આપયા, તેમાં કરાંચી ખાતે થયલા ઉઠમણામાં રૂ૨૪૨૯૮ આપયા, એમાં શેઠ નાદરશા એદલજી દીનશા રૂ૧૦૦૦૦, મરહુમ બાઈ ખરશેદબાઈ નાદરશા તરફથી રૂ૫૦૦૦, મરહુમ બાઈ બચુબાઈ ફીરોઝ ભરૂચા તરફથી રૂ૧૦૦૦, બાઈ નવાજબાઈ હોરમસજી રૂ૧૦૦૦, બાઈ ખોરશેદ હોશંગ નાદરશા રૂ૧૦૦૦, બાઈ દોસીબાઇ રૂસતમજી નાદરશાહ રૂ૧૦૦૦, શેઠો હોશંગ, મીનોચેર, ફરેદુન, અને દીનશાહ નાદરશાહે દરેકે રૂ૧૦૦૦, ડા૦ કેખશરૂ સ્પેનસર અને ધણીયાણી રૂ૩૦૧, જરથોસતી રૂ૧૦૧, બાઈ આવાંબાઈ

દો. મારકર રૂ૨૦૦, શેઠ અરદેશર દો. મારકર રૂ૧૦૦, શેઠ જહાંગીરજી હોરમજી કોઠારી રૂ૧૦૧, મરહુમ શેઠ બેરાંમજી એદલજી કલેકટર તરફથી રૂ૧૦૧ અને બાકીના રૂપયા બેસીઓ તરફથી ભરવામાં આપયા હતા; મરહુમ બાઇ બચુબાઇના મુંબઈમાં થયલા ઉઠમણામાં રૂ૮૦૭૨ આપયા, તેમાં મરહુમ બાઇ બચુબાઈની પુંજીમાંથી રૂ૨૫૦૧, મરહુમના ખાવીંદ ડા૦ ફીરોઝ રૂ૨૫૦૧, સસરા મરહુમ કુવરજી કા. ભરૂચા રૂ૫૦૦, સાસુ મેહેરબાઇ રૂ૫૦૦, મરહુમનાં નણંદ આલીબાઈ શે. વકીલ, દેર દારાશાહ કું. ભરૂચા તથા દેર અરદેશર કું. ભરૂચા રૂ૫૦૦, મરહુમના કુઇ ગુલબાઇ તથા કુવા સોરાબજી જમશેદજી ચીનાઈએ રૂ૫૦૧, (એ રૂપીઆ સીકનદરાબાદના ફંડમાં આપવામાં આવશે,) મરહુમનાં કુઇ શીરીનબાઈ રૂ. મારકર, કુવા રૂસતમજી દો. મારકર તથા બચ્ચાંઓ રૂ૩૦૧, શેઠ કેખશરૂ હોરમસજી પટેલ રૂ૫૦૧ અને બાકીના રૂપયા બેસીઓ વગેરે તરફથી ભરાયા હતા; મરહુમ બાઈ બચુબાઇના સીકનદરાબાદ ખાતે થયલા ઉઠમણામાં રૂ૧૭૦૭ આપયા તેમાં મરહુમના મમાઇ રતનબાઈ જ. ચીનાઈ રૂ૫૦૦, મરહુમના મામા તથા કુવા નવાબ સોહરાબ નવાઝજંગ બાહદુર રૂ૨૫૦, મરહુમના કુઈ તથા મામી ગુલબાઇ સો. નવાઝજંગ રૂ૨૫૦, મરહુમના મામા તથા કુવા ડા૦ હોરમસજી ચીનાઈ રૂ૧૫૦, મરહુમના કુઈ તથા મામી હીરાંબાઈ હો. ચીનાઈ રૂ૧૫૦, મરહુમનાં મામાના છોકરાંઓ રસીદ, જમશેદ તથા એદલજી હો. ચીનાઈ રૂ૧૦૫, મરહુમના મામા જહાંગીરજી ચીનાઈ રૂ૧૫૦, મરહુમના મામા રૂસતમજી ચીનાઈ રૂ૧૦૧, અને મામા રતનજી ચીનાઈ રૂ૫૧; મરહુમ બાઈ બચુબાઇના મઉ ખાતે થયલા ઉઠમણામાં રૂ૬૪૬ આપયા, તેમાં મરહુમ શેઠ કાવસજી હો. જાલનાં છોકરાંઓ રૂ૧૦૧, શેઠ રતનશાહ હો. ખેડાવાળા રૂ૧૦૧, શેઠ મેરવાનજી ફું દોતીવાળાએ રૂ૧૫૦ કાવસજી હોલ ફંડમાં અને બાકીના રૂપયા બીજાઓએ ભરીયા હતા.

[૬૧] મરહુમ શેઠ હોરમસજી નોશેરવાનજી વકીલ (નવાબ હોરમઝદજંગ બાહાદુર)ના પુણ માટે રૂ૧૮૬૧ આપયા, તેમાં મરહુમ શેઠ હોરમસજી નો. વકીલનાં કુટુંબે રૂ૧૦૦૧, મરહુમના ભાઈ ખા૦ બા૦ બરજોરજી નો. વકીલ અને કુટુંબ રૂ૨૫૧, મરહુમના ભત્રીજા નવરોજી બમનજી વકીલ અને કુટુંબ રૂ૨૫૧, મરહુમના ભાઇ દીનશાજી નો. વકીલ અને કુટુંબ રૂ૨૦૧, જ્યારે બાકીના રૂ૧૫૭ બેસીઓ વગેરે તરફથી ભરાયા હતા. એ રૂ૧૮૬૧ કયાં આપવા તે હવે પછી જણાવશે.

[૬૨] મરહુમ શેઠ ખુરશેદજી નોશેરવાનજી ચીનાઇના પુણ માટે રૂ૩૨૯૭ આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૫૦૧, દીકરા પાલનજી રૂ૧૫૧, દીકરા રતનજી રૂ૧૫૧, બાઈ રતીબાઈ પા. ચીનાઈ રૂ૧૦૧, શેઠ બાપુજી એદલજી ચીનાઈ રૂ૧૦૧, શેઠ ડોસાભાઇ નશરવાનજી ચીનાઈ રૂ૫૦૦, શેઠ પીરોજશાહ ન. ચીનાઈએ રૂ૨૫૧ બાઈ માણેકબાઈની દરેહમેહેરના ફંડમાં, ખા૦ બા૦ શાપુરજી એદલજી ચીનાઇ તથા કુટુંબ રૂ૫૦૦, બાઈ રતનબાઈ જ. ચીનાઇ રૂ૧૦૧, શેઠ સોરાબજી જ. ચીનાઈ રૂ૧૦૦ અને બાકીના રૂપયા બેસીઓ વગેરે તરફથી ભરાયા હતા.

[૬૩] મરહુમ શેઠ નશરવાનજી પેશતનજી ખાન તા૦ ૨૫ મી મેએ ૧૯૧૯ ને વાર રવેઉને દીને રાતના મુંબઈ ટાઈમ કલાક ૧–૩૦ મીનીટે પોતાની ૩૮ મી સાલગીરીને દીવસે બેહેસ્તનશીન થયા છે તેવણના પુણ માટે મરહુમની પુંજીમાંથી તથા મરનારના કુટુંબીઓ તથા બેસીઓ તથા મીતરોએ કુલે રૂ૮૦૦૧૬ નીચલી વીગતે ધરમખાતે આપયા હતા, તેમાં બેહેસતનસીન નશરવાનજીની પોતાની પુંજીમાંથી રૂ૧૦૦૦૦, ધણીઆણી બાનુબાઈ તથા દીકરીઓ રૂ૫૦૦૦, બાવા પેસતનજી દીનશાજી ખાન રૂ૨૫૦૦૦, માતાજી બેહેસતનસીન બાઈ ગુલબાઈની પુંજીમાંથી રૂ૧૦૦૦૦, સસરા ભીખાજી ફરામજી ખાન તથા સાસુ આવાંબાઇ ભી. ખાન રૂ૧૫૦૦૦, ભાઈ તથા પાલક શેઠ ફરામજી પેસતનજી ખાન તથા ધણીઆણી ફરેનીબાઈ ફ. ખાન રૂ૫૦૦૦, બેહેન તેહમીના તથા ખાવીંદ હોરમજજી નવરોજી શાહેર તથા છોકરાંઓ રૂ૧૦૦૦, મામા મનચેરજી ફરામજી ખાન તથા ધણીઆણી સીરીનબાઈ તથા છોકરાંઓ બેહેરામજી તથા ખોરશેદચેહેર રૂ૩૦૦૦, શેઠ દીનશાજી ભીખાજી ખાનની કંપની તરફથી રૂ૧૦૦૧, એમાંથી જરથોસતીઓને અવલમંજલ પુગાડવાના ફંડમાં રૂ૧૦૧, દોખમાઓવાલા ડુંગર ઉપરની સગડીમાં ભણતર ચાલુ રાખવાના ફંડમાં રૂ૫૦, મુંબઇનાં આંધળાં, પાંગળાં, તથા લાચાર જરથોસતીઓની પરવશી કરવા માટે પગાર આપવાના ફંડમાં રૂ૧૦૦, મુંબઇમાં તંગદસત હાલતમાં આવેલા જરથોસતીઓને આશારો આપવાના ફંડમાં રૂ૫૦, ગરીબ લાચાર જરથોસતી વીધવાઓને આશારો આપવાના ફંડમાં રૂ૫૦, મુંબઈના લાચાર જરથોસતીઓ ગુજરે તેઓનાં રવાનોને અવલમંજલ પોંચાડવાના તથા દીન ૪ નાં ખરચ કરવાનાં ફંડમાં રૂ૫૦, જરથોસતી માબાપને પેટે જનમેલાં બાળકોને સદરો પેહેરાવવાનાં ફંડમાં રૂ૫૦, ગરીબ લાચાર જરથોસતી છોકરીઓને પરણાવી આપવાના ફંડમાં રૂ૫૦, મુંબઈના લાચાર જરથોસતીઓને અનાજ આપવાના ફંડમાં રૂ૫૦, ગરીબ જરથોસતીઓને ધંધે લગાડવાના ફંડમાં રૂ૫૦, બાપ વીનાનાં બચ્ચાં તથા વીધવાનાં ફંડમાં રૂ૫૦, જરથોસતીઓ માટે મકાન પુરા પાડવાના ફંડમાં રૂ૫૦, જરથોસતી વીદયારથીને વીદયા અભયાસ કરવાના ફંડમાં રૂ૫૦, દીવાનશાળા મધેના ગરીબ લાચાર જરથોસતીઓની પરવસી કરવાના ફંડમાં રૂ૫૦, ગરીબ જરથોસતીઓને હવા ફેરફાર કરવા જવા માટે મદદ કરવાના ફંડમાં રૂ૫૦, પારસી સંકટ નીવારણ ફંડમાં રૂ૫૦, નાવારસ ઈરાની જરથોસતીઓના ફંડમાં રૂ૫૦, અને પારસી ફીવર હોસપીટલ ફંડમાં રૂ૫૦, કુઈની દીકરી શીરીન બાઇ બમનજી કાવશાજી રૂ૨૦૧, શેઠ દારાબશાહ બમનજી ફુઆસ તથા ધણીઆણી બાનુબાઈ રૂ૫૦૦, મરહુમ શેઠ બમનજી દીનસાજી ખાનના છોકરાઓ રૂ૩૦૧, મરહુમના મામાની દીકરી મનીજેહ તથા ડા૦ અરદેશર એરચશાહ હકીમ રૂ૩૦૧, મામાની દીકરી શીતીબાઈ તથા ખાવીંદ કેખશરૂ હોરમસજી કામા રૂ૨૦૧, મામાના દીકરી એમીબાઈ તથા ખાવીં ખરશેદજી દારાબશાહ ફુઆશ રૂ૨૦૧, ડા૦ એરચશાહ જમશેદજી હકીમ તથા ધણીઆણી શીરીનબાઈ રૂ૨૦૧. કુઈ નવાજબાઈ દીનસાહજી ખાન રૂ૧૫૧, મામાની દીકરી દીનબાઈ તથા ખાવીંદ હોરમસજી બમનજી ખાનના છોકરાઓ રૂ૧૫૧, મામાની દીકરી ધનબાઈ ભીખાજી ફરામજી ખાન રૂ૧૫૧, કાકાના દીકરા મરહુમ શેઠ ધનજીશાહ બમનજી ખાન તથા ધણીઆણી ગુલબાઇ તથા છોકરાઓ રૂ૧૦૧, બાઈ દીનબાઇ ડોસાભાઇ આલબલેસ તથા છોકરાઓ રૂ૧૦૦, શેઠ નશરવાનજી ખરશેદજી લેસાણીઆ રૂ૧૦૧, મરહુમ બાઈ પીરોજબાઈ નવરોજી શાહેરની પુંજીમાંથી રૂ૧૫૧, શેઠ દાદાભાઇ નશરવાનજી કોલમબોવાળા રૂ૫૦, શેઠ કેખશરૂ દાદાભાઇ ચોકસી રૂ૫૧, શેઠ પીરોજશાહ સોરાબજી ગઝદર રૂ૫૧, અને મરહુમ ડા૦ દાદાભાઇ પેસતનજી બનાજીના કુટુંબે રૂ૫૧, ઉપલી વીગતે કુલે રૂ૭૮૦૧૬, બેહેસ્તનશીન શેઠ નશરવા-

જીનાં પુનને સારૂ ધરમ ખાતે આપવા માટે પાછલા પોહોરના ઉઠમણામાં જાહેર કરવામાં આવયા છે એમાંથી રૂ૭૪૦૦૦ બેહેસ્તનશીનની યાદગીરી હંમેશ તુલીક કાયમ રહે એવું એક ધરમ ખાતું બરપા કરી હવે પછી જણાવવામાં આવશે. ઉપર જણાવેલી રકમો ઉપરાંત કોલંબો ખાતે તયાંની જરથોસ્તી અનજુમને બેહેસતનશીન શેઠ નશરવાનજીના માનમાં ઉઠમણાની કીયા કરાવી હતી તે વેળાએ તયાંની શેઠો ફરામજી ભીખાજીની કુંપની તરફથી બેહેસતનશીનના સસરા તથા મામા ભીખાજી ફરામજી ખાને રૂ૨૦૦૦ બેહેસતનશીનનાં પુણ માટે કોલંબો ખાતેના મોબેદોને નીભાવવાના ફંડમાં વયાજ આપવા માટે અલાહેદા કાઢેલા છે.

[૬૪) મરહુમ શેઠ ફરદુનજી કાવશાજી પટેલના ઉઠમણામાં મરહુમના પુણ માટે ભરયલા રૂ૨૦૬૫ ભરૂચની પારસી પંચાયત ફંડો વગેરેમાં આપવામાં આવયા હતા.

[૬૫] મરહુમ શેઠ હોરમસજી સોરાબજી ભરૂચાના પુણ માટે રૂ૨૧૬૭ ધરમખાતે આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૫૦૧, માતાજી પીરોજબાઈ રૂ૩૦૧, બાવા બેહસ્તનશીન સોરાબજી રૂ૩૦૧, શેઠ અરદેશર હો. ભરૂચા રૂ૧૫૧, શેઠ નશરવાનજી હો. ભરૂચા રૂ૧૦૧, શેઠ શાપુરજી સોરાબજી ભરૂચા રૂ૧૦૧ અને બાકીના રૂપયા ખેસીઓ વગેરે તરફથી ભરાયા હતા. એ રૂ૨૧૬૭ નીચલાં ફંડોમાં આપયા:—ખેતવાડીના ગરીબ પારસીઓને અનાજ આપવાના ફંડમાં રૂ૧૦૦૦, ભરૂચની અંજુમનને રૂ૫૦૦, અહમદનગરની અગીયારીમાં રૂ૨૦૦, ડા૦ માસીના હોસ્પીટલમાં રૂ૨૦૧, પારસી જનરલ હોસ્પીટલમાં રૂ૧૦૦, અવલમંજલ પોંચાડવાના ફંડમાં રૂ૧૦૦ અને બાકીના રૂપયા બીજા ફંડોમાં આપયા હતા.

[૬૬] મરહુમ શેઠ સોરાબજી મનચેરજી ભરૂચાના પુણ માટે રૂ૧૧૫૬ ધરમખાતે આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૫૦૧ અને બાકીના રૂપયા ખેશીઓ વગેરે તરફથી ભરાયા હતા; એ રૂ૧૧૫૬ રાનજીની અગીયારીમાં હોલ બાંધવાના ફંડમાં આપયા છે.

[૬૭] મરહુમ શેઠ પાલનજી પેસતનજી વાધલા કુપરના પુણ માટે રૂ૩૭૮૯ ધરમખાતે આપયા તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૧૦૦૦, એમાંથી ખેતવાડીના સસતા અનાજના ફંડમાં રૂ૫૦૦ અને ડા૦ માસીનાની હોસપીટલમાં રૂ૫૦૦, મરહુમના ધણીઆણી ધનબાઈજીએ રૂ૫૦૦ ખેતવાડીની અગીયારીમાં વયાજમાંથી વરસ દહાડાની બાજ કરવા, મરહુમના છોકરાઓ હીરજીભાઈ તથા કેખશરૂ તથા છોકરીઓ તરફથી રૂ૫૦૦ દેવલાલી બહાદુરજીની સેનેટરીયમમાં, મરહુમના ભાઈ નશરવાનજી પે. કુપરે રૂ૧૦૦૦, એમાંથી ડા૦ માસીનાની હાસપીટલમાં રૂ૩૦૦, પારસી જનરલ હાસપીટાલમાં રૂ૧૦૦, સુવાલીના દવાદારના ફંડમાં રૂ૧૦૦ અને નવસારીની દાબુ હાસપીટલમાં રૂ૫૦૦ ની લોન, બાઈ નાલીબાઈ નશરવાનજી કુપરે રૂ૧૦૦ ડા૦ ટેમુલજીના સુવાવડખાનામાં, બાઈ દીનબાઈ હીરજીભાઈ કુપરે રૂ૧૦૦ ફીવર હોસપીટલમાં, શેઠ રતનજી જમશેદજી કુમાસ તથા ધણીયાણીએ રૂ૧૫૧ પરચુટન ફંડોમાં અને બાકીના રૂપયા ખેશીઓ વગેરે તરફથી ફંડોમાં ભરાયા હતા.

[૬૮] મરહુમ શેઠ નવરોજી દોરાબજી કરંજીયાના પુણ માટે રૂ૧૧૧૬ ધરમખાતે આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૧૫૧, મરહુમના ધણીઆણી શીરીનબાઈ રૂ૧૫૧ અને બાકીના રૂપયા ખેશીઓ વગેરે તરફથી ભરાયા હતા.

[૬૯] મરહુમ શેઠ કાવસજી રૂતમસજી વરીઆવા બોરનમથ ખાતે મરણ પામયા હતા તેવણ પોતાની પુંજીમાંથી સારી જેવી રકમ જરથોસ્તીઓના લાભ અરથે પોતાના ત્રસ્તીઓના હાથમાં સોંપી ગયા છે જેનો વહીવટ હવે પછી વખતના સંજોગો પ્રમાણે કરવામાં આવશે; એ ઉપરાંત શેઠ કાવશજીના પુણ માટે રૂ૫૫૦૧ ધરમખાતે આપયા, તેમાં બેહેશતનશીનની પુંજીમાંથી રૂ૧૫૦૦, મરહુમના દીકરા ફકીરજી તથા ધણીઆણી આઈમાય અને બચ્ચાંઓ રૂ૧૫૦૦, મરહુમના દીકરા મીનોચહેર તથા ધણીઆણી ધનમાય અને બચ્ચાંઓ રૂ૧૫૦૦ મલી રૂ૪૫૦૦ કરાંચી પારસી અંજુમનના ત્રસ્તીઓ હસ્તકના પારસી એપીડેમીક રીલીફ ફંડમાં વ્યાજ વાપરવા આપયા, જરથોસતીએ રૂ૧૦૦ સુવાવડખાનામાં, શેઠ અરદેશર હોરમજી મામાએ રૂ૫૦૧ કયા આપવા તે હવે પછી જણાવશે જ્યારે બાકીના રૂપયા ખેશીઓ વગેરે તરફથી ભરાયા હતા.

[૭૦] મરહુમ બાઈ આલાંમાય માણેકશા શેઠનાના પુણ માટે રૂ૧૫૦૩ ધરમખાતે આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૨૫૧, મરહુમના ખાવીંદ માણેકશા રૂ૨૦૧, મરહુમના પીતાજી બાપુજી હો. દુબાશ રૂ૨૦૧, માતાજી હીરાંબાઈ રૂ૧૦૧, મમાઈ ભીખાઈજી રૂ. જાલનેવાલા રૂ૧૦૧, શેઠ નશરવાનજી રતનજી નાજર તથા ધણીઆણી નવાજબાઈ રૂ૧૦૧, શેઠ માણેકશા કાવશાજી પટેલ તથા ધણીઆણી બાનુબાઇ રૂ૧૪૯ અને બાકીના રૂપયા ખેશીઓ વગેરે તરફથી ભરાયા હતા; એ રૂ૧૫૦૩ નીચલા ફંડોમાં આપયા હતા:—આંધલા પાંગલાંઓને પરવશી કરવાના ફંડમાં રૂ૫૦૧, અવલમંજલ પોહોંચાડવાના ફંડમાં રૂ૫૦૧ અને ડુંગર ઉપરના ભણતર ફંડમાં રૂ૫૦૧.

[૭૧] મરહુમ શેઠ દીનશાહ હોરમજી ગાંધીના પુણ માટે રૂ૧૩૦૩ ધરમખાતે આપયા તેમાં મરહુમના કુટુંબ તરફથી ભાઇ માણેકશા હોરમશાજી ગાંધીએ રૂ૧૦૦૦ અને ખેશીઓ વગેરે તરફથી ભરાયલા રૂ૯૦; એ રૂ૧૦૯૦ નીચલા ફંડોમાં આપયા:—ડા૦ માસીનાની હાસપીટાલમાં રૂ૧૫૦૦ ની લોન ટકા ૩॥ ની આપી કે મરહુમના નામનું ખાતું પાડી તેનું વીયાજ ખરચમાં વાપરવું અને વાંદરાના બાઈ શીરીનબાઇ કામાના કોનવેલેશન હોમમાં રૂ૧૦૦; ઉપર મુજબની વયવશથા કરતાં રૂ૫૦ વધુ થયા તે મરહુમના ભાઈ તરફથી આપવામાં આવયા હતા. એ ઉપરાંત મરહુમ શેઠ દીનશાહજીનાં ભરૂચ ખાતે થયલાં ઉઠમણામાં ભરાયલા રૂ૧૬૩ ભરૂચની પંચાયત હસ્તકનાં ફંડોમાં આપયા હતા.

[૭૨] મરહુમ શેઠ બેજન શેહેરીઆર કેખશરૂ મોરીયાબાદી ઇરાનીના પુણ માટે રૂ૨૭૬૯ આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૧૦૦૧, મરહુમના માતાજી ખરશેદબાઈ રૂ૫૦૧, મરહુમના ભાઈ જમશેદજી તથા ભાભી દીનબાઈ રૂ૫૦૧, મરહુમના ભાઈ ગુશતાસ્પ તથા ભાભી હોમાયુન રૂ૫૦૧, મરહુમના ધણીઆણી પીરોજબાઇ રૂ૨૦૧, મરહુમના બેહેન મનબાઈ ખરશેદજી રૂ૨૦૧, બનેવી ખરશેદજી અસ્પંદીઆર રૂ૫૦૧, શેઠ કેખશરૂ અસપંદીઆર તથા ધણીઆણી ગુલબાઈ રૂ૫૫૧, શેઠ રૂસતમ અસપંદીઆર તથા ધણીઆણી તેહેમીના રૂ૫૫૧, શેઠ જાહાંગીર એસપંદીઆર તથા ધણીઆણી ખોરશેદ રૂ૫૫૧, શેઠ રૂસતમ આદર રૂ૧૦૧, શેઠ બેરામજી રૂસતમજી તથા કુઇ જરબાનુ રૂ૧૦૧, શેઠ પીરોજશાહ બેરામજી રૂ૧૫૧, મરહુમ શેઠ ખોદાદાદ રૂસ્તમના બેટાઓ રૂ૨૦૧, મરહુમ શેઠ ખોદાદાદ રૂસતમના બેટા જમશેદજી રૂ૧૦૧, શેઠ

કેખશરૂ ખોદાબક્ષ રૂ૧૦૧, શેઠ ફેરામજી રૂસતમજી વાનોરીવાલા રૂ૧૦૧, શેઠ જાંગીરજી ડા. કરાકા રૂ૧૦૧, શેઠ હોરમસજી રૂસતમજી પટેલ રૂ૧૦૧, શેઠ ફ્રામરોજ પીરોજશાહ બાલાપોરયા રૂ૧૦૧ અને બાકીના રૂપયા ખેશીઓ વગેરે તરફથી ભરાયા હતા.

[૭૩] મરહુમ બાઈ મોતીબાઈ કાવશજી દેશાઈના પુન માટે રૂ૧૬૫૯ ધરમ ખાતે આપયા તેમાં નવસારીના અવલમંજલ પોહચાડવાના ફંડમાં વીયાજ વાપરવા રૂ૫૦૦, નવસારીની સર કાવસજી જાંહગીર હાઇ સકુલમાં વ્યાજમાંથી છોકરાઓને ઈનામ આપવા રૂ૫૦૦, રાજકોતની દરેમહેરમાં વ્યાજ વાપરવા રૂ૨૫૦, નવસારીની વડી દરેમહેરમાં મુકતાદ વીગેરેનાં ફંડમાં રૂ૧૦૧ અને બાકીના રૂપયા પરચુટણ ફંડોમાં આપયા હતા.

[૭૪] મરહુમ બાઈ ધનબાઇ પેસતનજી શુખાજી લકકાના પુણ માટે રૂ૧૪૯૪ ધરમ ખાતે આપયા, તેમા મરનારના ભાઈ માણેકજી પાલનજી તલાટીએ રૂ૫૦૦ ની લોન, શેઠ માણેકજી પાલનજીની કંપનીએ રૂ૫૦૦ ની લોન, બાઈ ડોશીબાઈ માણેકજી તલાટી અને છોકરાંઓ રૂ૧૦૦ અને બાકીના રૂપયા ખેશીઓ વગેરે તરફથી ભરાયા હતા; એ રૂ૧૪૯૪ નીચલા ફંડોમાં આપયા હતા:— નવસારીની મીનોચેહર હોમજીની દરેમેહરના જુદાં જુદાં ફંડોમાં રૂ૧૬૨, મીનોચેહર હોમજી દરેમેહરના વસ્તીઓને મરનારની બાજ દર વરસ કરવા રૂ૫૦૦, મીનોચેહર હોમજી બેહતરી ફંડમાં વયાજ વાપરવા રૂ૧૦૦, મીનોચેહર હોમજી દરેમેહરના વસ્તીઓને એ સાયના મુળ પુરૂષોની બાજ કરવાના ફંડની શરૂઆત કરવા રૂ૫૦૦ અને બાકીના રૂપયા પરચુટણ ફંડોમાં આપયા હતા.

[૭૫] મરહુન બાઈ નવાજબાઈ નાનાભાઇ બેહરામજી ડાકટરના પુણ માટે રૂ૨૨૬૮ આપયા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૧૦૦૦, મરહુમની દીકરીઓ રૂ૫૦૦, મરહુમના જેઠ ડા૦ બરજોરજી બેહરામજી રૂ૧૦૦, ડા૦ મંચેરજી જામાસજી મીસતરી રૂ૧૦૦ અને બાકીના રૂપયા ખેશીઓ વગેરે તરફથી ભરાયા હતા; એ રૂ૨૨૬૮ કયાં આપવા તે હવે પછી જાહેર થશે.

[૭૬] મરહુમ બાઈ નવાજબાઈ કુંવરજી મોદીના પુણ માટે રૂ૨૦૮૪ ધરમખાતે આપયા તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૧૫૦ પરચુટણ ફંડોમાં, શેઠ હોરમજી કુંવરજી મોદી તથા કટુંબ રૂ૫૦૦, શેઠ નાનાભાઈ કુંવરજી મોદીએ રૂ૨૦૦ એમાંથી વાછાગાંધીની અગીયારીનાં ફંડમાં રૂ૧૦૦ અને રૂ૧૦૦ બે ફંડોમાં, શેઠ અરદેશર કુંવરજી મોદી તથા ધણીઆણી રૂ૧૦૦, શેઠ મેરવાનજી કુ. મોદી તથા ધણીઆણીએ રૂ૧૦૦ પરચુટણ ફંડોમાં, બાઈ બાનુબાઈ રૂસતમજી મોદીએ મરહુમ પીતા રૂસતમજી કુંવરજી મોદી તરફથી રૂ૧૨૫, બાઈ હીરાબાઇ તથા શેઠ બરજોરજી ખરશેદજી વાછાગાંધીની પુંજીમાંથી રૂ૧૦૦, શેઠ સોરાબજી બરજોરજી વાછાગાંધીએ મરહુમ મમાઈનાં પુણ માટે રૂ૧૦૦, અને બાકીના રૂપયા ખેશીઓ વગેરે તરફથી ભરાયલા તે ફંડોમાં આપયા હતા.

[૭૭] મરહુમ શેઠ રૂસતમજી ન. વાડયાના પુણ માટે રૂ૨૧૯૩૬૯ આપ્યા, તેમાં મરહુમની પુંજીમાંથી રૂ૧૦૦૦૦૦, મરહુમના પીતાજી નવરોજી ન. વાડીયા સી. આઈ. ઈ.ની પુંજીમાંથી રૂ૨૫૦૦૦, મરહુમના માતાજી જરબાઈ ન. વાડીયા રૂ૨૫૦૦૦, મરહુમના ભાઈ ખરશેદજી ન. વાડયા સી. આઈ. ઈ. રૂ૧૦૦૦૦, મરહુમના ભાઈ નશરવાનજી ન. વાડયા સી. આઈ. ઈ. રૂ૧૦૦૦૦, મરહુમના મમાવા રૂસતમજી અરદેશર વાડીયા તથા ધણીઆણી નવાજબાઈની પુંજીમાંથી રૂ૫૦૦૦, મરહુમના માસીજી દીનબાઈ ફ્રામજી વાડયા રૂ૨૦૦૧, મરહુમના માસીજી લેડી ગુલબાઈ જમશેદજી જીજીભાઈ રૂ૨૦૦૧, મરહુમના કાકી મેહેરબાઈ સો. વાડયા રૂ૧૦૦૧, મરહુમના મામા ખરશેદજી રૂ. વાડયા રૂ૧૦૦૦, મામા ધ. રૂ. વાડયા રૂ૧૦૦૧, મામા ફ્રામજી રૂ. વાડયા, ધણીઆણી જીજુબાઈ તથા છોકરાંઓ રૂ૧૦૦૧, મરહુમના માસીના દીકરા સર જમશેદજી જીજીભાઇ, ધણીઆણી લેડી શીરીનબાઈ તથા છોકરાંઓ રૂ૧૦૦૦, મરહુમના માસીનાં દીકરી વીરબાઇજી જહાંગીરજી દાવર રૂ૨૫૧, મરહુમના માસીના દીકરા ધનજીભાઈ ફ્રામજી બાતલીવાલા તથા ધણીઆણી જરબાઈ તથા છોકરાંઓ રૂ૭૦૧, મરહુમના માસીના દીકરા રૂશતમજી ફ્રામજી બાટલીવાલા તથા ધણીઆણી પીરોજબાઈ રૂ૫૦૧, બાઈ ધનબાઈ ખરશેદજી તારાચંદ રૂ૩૦૧, બાઈ કુવરબાઈ જહાંગીરજી ડાકતર રૂ૧૦૧, બાઈ પીરોજબાઈ સોરાબજી મેહેતા રૂ૧૦૧, શેઠ શાપુરજી જીવાજી વાછા તથા ધણીઆણી ખરશેદબાઈની પુંજીમાંથી એઓની છોકરીએ રૂ૫૦૧, શેઠ સોરાબજી ખરશેદજી તારાચંદ તથા છોકરાંઓ રૂ૫૦૧, શેઠ માણેકજી ખરશેદજી તારાચંદ રૂ૧૦૧, બાઈ બાઈકુંઈ સોરાબજી તારાચંદ રૂ૧૦૦૧, શેઠ જીજીભાઈ મેરવાનજી વાડીઆ રૂ૫૦૧, બાઈ સુનાબાઈ માણેકજી વાછા રૂ૧૦૧, અને શેઠ મનચેરશા કાવસજી મેહતા રૂ૫૦૧ મળી રૂ૧૮૯૧૬૮ પાછલા પોહરના ઉઠમણામા ભરાયા હતા; એ ઉપરાંત મરહુમની પુંજીમાંથી રૂ૧૦૦૦૦, મરહુમના માતાજી જરબાઈ રૂ૧૦૦૦૦, મરહુમના ભાઈ ખરશેદજી રૂ૫૦૦૦, મરહુમના ભાઇ નસરવાનજી રૂ૫૦૦૦, અને શેઠ મેરવાનજી પેસતનજી ખરેગાટે રૂ૨૦૧ મળી રૂ૩૦૨૦૧ પાછલી રાતના ઉઠમણામાં ભરાયા હતા. ઉપલા રૂ૨૧૯૩૬૯ કયા ધરમખાતાંમાં આપવા તે હવે પછી નકકી કરવામાં આવશે.

[૭૮] મરહુમ શેઠ ફ્રામજી હોરમજજી બમનજી શેઠના રોજ ૨૪–૧૨–૧૨૮૮ યઝદેજરદી અને તા૦ ૩૦ મી આગસટ ૧૯૧૯ ને દીને હક થયા તેવણના થયલા ઉઠમણામાં જાહેર કરવામા આવયું હતું કે મરહુમે પોતાની હયાતીમા બોંબે બરમા ટરેડીંગ કોરપોરેશન લીમીટેડના જુના શેરો ૧૦૦, એક ત્રસટડીડ કરીને સખાવતમાં આપયા હતા કે વયાજમાંથી ગરીબ પારસી જરથોસતી છોકરાઓને ટેકનીકલ ઉદયોગીક કેળવણી અને સકોલરશીપ આપવી અથવા નાણાંની મદદ કરવી. આ શેરોની કીમત હમણા રૂપીઆ એક લાખથી વધુ થવા જાય છે.

ધરમનાં મકાનો.

અમદાવાદની આરામગાહમાં બંધાયલો હોલ—અમદાવાદ ખાતે દુખમાં આગળ રવાનોની સાથે આવનારાઓ માટે એક હોલ બાંધવામાં આવ્યો હતો, તે ખુલ્લો મેલવાની ક્રીયા રોજ ૧૯ મો માહા ૧ લો સને ૧૨૮૭ શેહેનશાહીને દીને કરવામાં આવી હતી. આ હોલ ૧૮ ફુટ પોહલો અને ૩૬ ફુટ લાંબો ફાયર પ્રુફ બાંધ્યો છે. એ ઉપરાંત દોખમાને ફરતી બેહજાર ફુટની કાંતાવાળી ટારની વાડ તથા દરવાજો કરી કુવામાં એક પંપ મેલ્યો છે. આ માટે રૂ૫૩૭૩ નો ખરચ એક ફંડ એકઠું કરી કરવામાં આવ્યો હતો.

ડા૦ માસીના હાસપીટલમાં ખુલ્લો મુકાયલો સેપટીક વોરડ—આપણા શેહરના પ્રખાયત ડાકટર માસીનાની હાસપીટલને લગતી ઉડતા રોગોના દરદીઓ માટેની નવી બીલડીંગ (સેપટીક વોરડ) ખુલ્લી મુકવાની ક્રીયા રોજ ૨૨ મો માહા ૩ જો યાને તા૦ ૧ લી દીસેમબરે એ હાસપીટલના મકાનમાં સર શાપુરજી બરજોરજી ભરૂચાના પ્રમુખપણા હેઠળ એક મેલાવડા સનમુખ કરવામાં આવી હતી. શરૂઆતમાં જશનની ક્રીયા કરવા બાદ દસ્તુરજી મીનોચેરજી જામાસપજી જામાસ્પ આશાનાએ તથા દસ્તુરજી દીનશાહજી ગારડાએ આ નવા મકાન માટે તેમજ ડાકટર માસીનાની બીનસ્વારથી સેવાઓ માટે સ્તુતી કરી ભલી દુવાઓ ચાહી હતી. શેઠ જાહાંગીર બેરામજી મરઝબાને નવું મકાન ખુલ્લુ મેલવાને સર શાપુરજી ભરૂચાને એલતેમાસ કરતાં જણાવ્યું કે પંદર વરસ ઉપર ડા૦ માસીનાએ હાસપીટલની શરૂઆત કરી હતી, તે પછી આ મોટા આલીસાન મકાનમાં લાવવામાં આવી છે. આ નવા મકાન માટે રૂ૫૭૦૦૦ ની રકમ મલી છે અને હમણા આજે લગભગ રૂ૧૮૦૦૦ જેટલા મલ્યા છે. આ નવી બીલડીંગમાં ઉડતા રોગો, જેવા કે ટાઇફોઇડ, ખરી, દીવાના, મરકી કોલેરા વગેરેના દરદીઓ માટે ગોઠવણ રાખવામાં આવશે. ઇનફલુએનઝાના હુમલા વખતે ૧૦૭ બીમારોની સારવાર થઇ હતી, જેઓમાં ૭૨ દરદીઓની તદન મુફત સારવાર કરી હતી. સેવટે શરવે મદદ કરનારાઓનો શેઠ મરઝબાને ઉપકાર માન્યા બાદ સર શાપુરજીએ મકાન ખુલ્લુ મેલાયલું જાહેર કરી ડા૦ માસીનાએ પારસી કોમની બજાવેલી ઉત્તમ સેવાઓ માટે સ્તુતી કરવા પછી મેલાવડો વીસરજન થયો હતો. આ નવી બીલડીંગ છેલ્લી ૯૫ ઉપર બાંધવામાં આવેલું બે મજલાનુ મકાન છે તેમાં ૨૮ ઓરડાઓ બીમારો માટે છે, અને તે પાછળ લગભગ રૂપયા પોણા લાખ જેટલો ખરચ થયો છે. સેપટીક બલોક દરેક રીતે સામગીરીઓથી રચવામાં આવયો છે અને એક ઓરડો દીવાના દરદીઓ માટે અલાયદો રાખેલો છે.

બેલગામની પારસી કલબનું ખુલ્લું મુકાયલું મકાન—બેલગામ ખાતે બાવીસ વરસ થયા પારસી કલબ સથાપવામાં આવી હતી. એ કલબ ભાડાના મકાનમાં હોવાથી શેઠો રૂશતમજી તથા નશરવાનજી નાનાભાઇ બોઇસે રૂ૪૦૦૦ માં મકાન ખરીદી એ પાછલ સુધારા વધારા માટે રૂ૩૫૦૦ નો વધુ ખરચ કરી ચોકસ સરતોથી એ કલબને મુફત વાપરવા આપ્યું છે. આ મકાન ખુલ્લુ મુકવાની ક્રીયા રોજ ૩૦ મો માહા ૩ જાને દીને શેઠ બરજોરજી એદલજી વાચ્છાના પ્રમુખ પણા હેઠળ કરવામાં આવી હતી. જે વખતે શેઠો બોઇસ બીરાડરોની સખાવત માટે ઉપકાર માનીયા બાદ શેઠો બોઇસ બીરાડરોને કલબના મેમબરો તરફથી શીયાલો એનાયત કરવામાં આવ્યા પછી મરહુમ શેઠ નાનાભાઇ ફ. બોઇસની સબી ખુલી મુકવામાં આવી હતી.

સીકંદરાબાદ ખાતે ખુલ્લી મુકાયલી સ્કુલ—સીકંદરાબાદ ખાતે કેનટોનમેંટમાં એક જરથોસ્તી સ્કુલ ત્યાના જાણીતા શેહેરી શેઠ જાહાંગીરજી જમશેદજી ચીનાઇએ પોતાના બેહેસ્તનશીન ધણીયાણી બાઇ રતનબાઇના પુણ માટે સ્થાપીને તેનું નામ "બાઇ રતનબાઇ જાહાંગીર ચીનાઇ એંગલો વરનાકયુલર સ્કુલ" રાખ્યુ છે. મરહુમ બાઇની બાજને દીને એટલે રોજ ૧૪ મો માહા ૫ મો સને ૧૨૮૮ ને દીને દસ્તુરજી ખુરશેદજી બેહરામજીની આગેવાની હેઠળ જશન કરી એ સ્કુલ ખુલ્લી મુકી ચાલુ કરવામાં આવી છે. શરૂઆતમાં દસ્તુરજીએ ટુંક વાયજ કરી સ્કુલને ફતેહ ઇચ્છીયા બાદ શેઠ જાહાગીરજી તરફથી એવણના ભાઇ શેઠ રૂશતમજીએ અંજુમન સનમુખ પત્ર વાંચ્યો હતો, તેમાં જણાવ્યું હતું કે હમારા મરહુમ પીતાજી ઇ. સ. ૧૯૧૩ ના મે મહીનામાં ગુજરી ગયા છે અને એવણનું નામ પારસી ખાતા સાથે જાળવી રાખવા એક કુસાદે હોલ બાંધવામાં આવે છે. પારસી છોકરાંઓને ગુજરાતી તથા ઇંગ્રેજી કેળવણી સાથે આપણા પાક મજહબનું શીક્ષણ આપવાનું કાંઇ સાંધન નહી હોવાથી એક સારી સ્કુલ સ્થાપવા માટે આજે મકાન જેમાં તમો હાજર થયલાં છેઓ તેના માલેક પાસેથી રૂ૧૫૦૦૦ ની કીમતે વેચાતું લીધાં પછી સને ૧૯૧૮ ની તા૦ ૨૦ મી સપટેમબરે શેઠ જાહાંગીરજીના ધણીયાણી બાઇ રતનબાઇ બેહેસતનશીન થવાથી

એવણનું નામ સ્કુલ સાથે જાળવી રાખવા માટે મકાન ઉપરાંત રૂ૬૦૦૦૦ નીભાવ માટે આપ્યા છે, એમાં રૂ૪૪૦૦૦ ની નીઝામ સરકારની છ ટકાની નોટ છે જેનું વ્યાજ મહીને હાલી સીકકા રૂ૨૨૦ નું આવશે અને બ્રીટીશ સરકારના સાડાપાંચ ટકાના રૂ૧૬૦૦૦ ના વોર બોંડનું વ્યાજ રૂ૩૦૫ આવશે જેથી સ્કુલ સારા પાયા ઉપર ચલાવી શકાશે. આ મકાનની મરામત તથા ફરનીચર વગેરે પાછલ રૂ૩૦૦૦ નો ખરચ થયો છે તેથી એ સ્કુલ પાછલ રૂ૭૮૦૦૦ થયા છે. આ નાદર રકમ સીકંદરાબાદ તથા હેદરાબાદના જરથોસ્તીઓના ભલા માટે આપી છે જેથી અંજુમન તેની કદર બુજશે. શેઠ જાહાંગીરજીએ એ દીને બીજા વધુ રૂ૧૫૦૦ ની લોન આપી હતી જેથી તેના વ્યાજ-જમાંથી ચાર પ્રાઇઝો આપવામાં આવશે. એ પછી શેઠ બેજનજી આદરજી વકીલે શેઠ જાહાંગીરજી ચીનાઇએ અંજુમન ઉપર કીધેલા આ હેશાંન માટે ઉપકાર માન્યા બાદ મેલાવડો વીસરજન થયો હતો.

સીકંદરાબાદ ખાતે ખુલ્લો મેલાયલો હોલ—સીકંદરાબાદ ખાતે ત્યાના જાણીતા સખાવતી ગ્રહસ્થ શેઠ જાહાંગીર જમશેદજી ચીનાઇએ સર અવસરે વાપરવા માટે બંધાવી આપેલો હોલ ખુલ્લો મેલવાની ક્રીયા રોજ ૧૪ મો માહા ૧૨ મો યાને તા૦ ૨૦ મી આગસ્ટે એક મોટા મેલાવડા સનમુખ કરવામાં આવી હતી. દસ્તુરજી ખુરશેદજી બેરામજીએ જશનની ક્રીયા કરવા પછી શેઠ જાહાંગીરજી જમશેદજી ચીનાઇ તરફથી એવણના ભાઇ શેઠ રૂશતમજીએ અંજુમન પત્ર વાંચતાં જણાવ્યું કે છવીસ વરસ ઉપર એકપણ હોલ નહી હોવાથી હમારા બપાવા મરહુમ ખા૦ બા૦ એદલજી સોરાબજી ચીનાઇએ હમારા બેહેસતનશીન બપાઇજીના પુણ માટે એક હોલ બંધાવી ૧૮૯૩ ના જુન માસમાં ખોલ્લો મુકયો હતો, જે હોલ "બાઇ પીરોજબાઇ હોલ" ને નામે આજ સુધી જાણીતો છે. એ હોલ નાધલો પડવાથી મારા મરહુમ પીતાજી શેઠ જમશેદજી એદલજી ચીનાઇની યાદમાં આ નવો હોલ બંધાવી આપ્યો છે. આ મકાન બંધાઇને તઇયાર થાય ત્યાં સુધી શેઠ મનચેરજી બે. કોટવાલે કાલજી ભરેલી દેખરેખ રાખી કીમતી સલાહ આપી હતી તે માટે ઉપકાર માનું છું. આ હોલ "જમશેદજી ચીનાઇ હોલ" ને નામે ઓલખાશે. એ બાંધવા પાછલ હાલી રૂ૨૨૦૦૦ નો ખરચ થયો છે અને લગભગ રૂ૨૦૦૦ ઇલેકટ્રીક લાઇટ પંખા લગાડવા પાછલ બેઠા છે, જે મારા મરહુમ પીતાજીના ઉઠમણામાં હમારા કાકાજી ખા૦ બા૦ શાપુરજી એ. ચીનાઇએ રૂપ્યા ભરીયા હતા તેમાંથી ખરચ્યા છે. રૂ૩૦૦૦ ની કીમતનું ફરનીચર તઇયાર કરાવ્યું છે અને નીભાવ માટે અંગ્રેજ સરકારની સાડાત્રણ ટકાની રૂ૫૦૦૦ ની લોનો એલાહેદી કાહાડીને મારા ધરમખાતાના ટ્રસ્ટીઓને સંપુરદ કરવામાં આવશે, સીકંદરાબાદ અને હેદરાબાદની જરથોસ્તી અંજુમનનાં વપરાસ માટે આ હોલ ખુલ્લો મુકુ છું. મારા મરહુમ ધણીયાણી બાઇ રતનબાઇની પેહલી વરસીનો દીવસ આજે હોવાથી એવણની પવીત્ર યાદમાં મેં "રતનબાઇ ચીનાઇ એંગલો વરનાકયુલર સ્કુલ" થોડા મહીના થયા સ્થાપી છે તેને વધારે મુસ્તહકમ પાયા ઉપર લાવવાને માટે મજકુર સ્કુલના ટ્રસ્ટીઓને બીજા રૂ૧૦૦૦૦ ની ત્રણ ટકાની લોન અને રૂ૫૦૦૦ ની પાંચ ટકાની લોનો સવાધીન કરૂં છું. મારા બેહસતનશીન ધણીયાણીની દર વરસે બાજને દીને એક જશન કરવા સીકંદરાબાદની જરથોસ્તી કલબને રૂ૧૦૦૦ ની લોન અને હેદરાબાદની પારસી કલબને રૂ૧૦૦૦ ની લોન વ્યાજ વાપરવા આપુ છુ. વળી મરહુમનુ રોજનું ક્રીયા કામ હાલ દેવલાલીની અગયારીમાં કરાઉં છુ તેને જાવેદાન ચાલુ રાખવા રૂ૧૫૦૦ ની સાડા ત્રણ ટકાની લોનો દેવલાલીની અંજુમનને સંપુરદ કરૂં છુ. આજ દીને રૂ૨૭૦૦૦ નું "જેહાંગીરજી જમશેદજી ચીનાઇ ચેરી ટેબલ ફંડ" સ્થાપુ છું અને એ ફંડના ટ્રસ્ટીઓ મારા ત્રણ ભાઇઓ રૂશતમજી, હોરમજી અને રતનજી તથા બે ભત્રીજાઓ બેરચશાહ અને નોશીરવાન રહેશે. એની આવકમાંથી એક હીસ્સો મારા નયાગાનોની ધરમ કીયા કરવામાં અને બે હીસ્સા ગરીબ જરથોસ્તીઓને નવજોત લગન વગેરે ટાંકણે મદદ કરવામાં વાપરવામાં આવશે. ચંદરગાટમાં અથવા હેદરાબાદ સ્ટેશનની પાસે એક ધરમશાળાનું મકાન બાંધવા રૂ૨૫૦૦૦ આપુ છુ અને નીભાવ સારૂ મારા માતાજી રતનબાઇની પરવાનગીથી મારા મરહુમ ભાઇ દોરાબજીની પુંજીમાંથી રૂ૧૦૦૦૦ તથા મારી તરફથી રૂ૫૦૦૦ ઉમેરી રૂ૧૫૦૦૦ આપવામાં આવશે. મારા માતાજીએ રૂ૩૦૦૦૦ ને ખરચે ગરીબ પારસીઓ માટે ચાલી બંધાવી આપવા કબુલ કીધુ છે. એજ મેલાવડામાં નવાબ સોરાબ નવાઝ જંગબહાદુરે ખાનસાહેબ રાગયાર ઇચ્છાપોરયાને એક સોનાનું ઘડીયાલ તથા છેડો ભેટ આપ્યા હતા. નામદાર વાઇસરાય દવલતાબાદ વગેરે ઠેકાણે મુલાકાતે પધારયા હતા તે વખતે શેઠ ઇચ્છાપોરીયાએ મોટર વગેરેનો બંદોબસ્ત કરવાથી નામદાર નીઝામે ભેટ આપવા આપ્યું હતું.

ખુલ્લુ મુકાયલુ નસાખાનુ—લાનોલી ખાતે એક નસાખાનાની અગત હોવાથી લાનોલીના એક ઇરાની ગ્રહસ્થ શેઠ જમશેદ બેહરામે તે બંધાવી આપ્યું છે. એ નસાખાનું રોજ ૧૬ મો માહા ૫ મો યાને તા૦ ૨૪ મી જાનેવારીએ લાનોલીની અંજુમનનાં મેળાવડા સમક્ષ જશનની ક્રીયા કરી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. સેક્રેટરી શેઠ સોરાબ હોરમજી માદને શેઠ જમશેદ બેહરામનો આવું નેક કામ પાર પાડવા માટે આભાર માનયો હતો.

ઝોરાસ્ત્રીયન બીલડીંગ સોસાયટી હસ્તક ખુલ્લી મેલાયલી બીલડીંગ—ઝોરાસ્ત્રીયન એસોસીએશનના આગલા જોડયા સેક્રેટરી મરહુમ શેઠ શોરાબજી બમનજી પેસ્તનજી માસ્તરરોજ ૨૪ મો માહા ૫ મો ય. ૧૨૮૭ ને દીને બેહેસતનશીન થયા હતા, તેવણની યાદગીરી કાયમ રાખવા માટે મરહુમના ઉઠમણામાં મરહુમની પુંજીમાંથી રૂ૬૫૦૦ તથા મરહુમના ધણીઆણી બાઇ મહેરબાઇ તરફથી રૂ૬૦૦૦, તથા મરહુમના બેટા શેઠ પેસતનજી તરફથી રૂ૧૦૦૦૦, મલી એકંદર રૂ૨૨૫૦૦ ભરવામાં આવ્યા હતા. એ આખી રકમ ઝોરાસ્ત્રીઅન બીલડીંગ સોસાયટીને આપી ત્રણ મજલાની એક નવી બીલડીંગ વચલા વરગના જરથોસ્તીઓના વપરાસ માટે બાંધીને મરહુમ ગ્રહસ્થની પહેલા વરસની બાજને દીને ખુલ્લી મુકવામાં આવી છે. આ મકાનનું ભાડું ખરચ બાદ જવે નકકી ૪ ટકા ઉપજે એમ ગોઠવવામાં આવયું છે, એ ઉપરાંત મરહુમના ખેશીઓ તરફથી મરહુમના ઉઠમણામાં ભરાયલા રૂપીઆમાંથી રૂ૧૦૦૦ની ૩ાા ટકાની નોટ ઝોરાસ્ત્રીઅન એસોસીએશનને બક્ષેશ આપી છે કે તેનું વ્યાજ ગરીબ પારસી જરથોસ્તી છોકરાંઓને કેળવણી આપવા વાપરવું.

ખેરગામમાં રવાનની ગાડી માટેનું મકાન—શેઠ પેસતનજી દાદાભાઇ વાહાડયાએ વલસાડ નજદીકના ખેરગામ ખાતે રવાનોને લઇ જવાના ગાડી ખેરગામની જરથોસ્તી અંજુમનને ભેટ આપી હતી. એ ગાડી રાખવાનું મકાન, તેમજ જુનુ નસાખાનું બીસમાર થવાથી નસાખાનાનું નવું મકાન તથા એક કુવો શેઠ પેસતનજીએ બંધાવી આપ્યાં હતાં તે તા૦ ૫ મી મારચે રોજ ૨૬ મો માહા ૬ દાને દીને ખુલ્લું મુકવાની ક્રીયા શેઠ રૂશતમજી ભીખાજી બીખામેહરજીના પ્રમુખપણા હેઠળ કરવામાં આવી હતી. જશન ક્રીયા કરવા પછી શેઠ વાહાડયાની સખાવતની સ્તુતી કરી રૂપાના કાસકીટમાં માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. એ પાછળ શેઠ પેસતનજીને રૂ૩૫૦૦ નો ખરચ થયો છે અને મરામત માટે એવણે બીજા વધુ રૂ૫૦૦ આપીયા છે. વળી ખેરગામની સમસ્ત માહાજન તરફથી એક માનપત્ર શેઠ પેસતનજીને આપવામાં આવ્યું હતું.

ખુલ્લુ મુકાયલુ નસાખાનુ—સુરત નજદીકના ઉમરા ગામના દુખમાને લગતું નસાખાનાનું નવું મકાન શેઠ પાલણજી શાપુરજી મીસતરીએ બંધાવી આપ્યું હતું તે ખુલ્લુ મુકવાની ક્રીયા શેઠ બેજનજી માણેકજી વકીલના પ્રમુખપણા હેઠળ રોજ ૨૩ મો માહા ૭ માને દીને કરવામાં આવી હતી. સુરતના દસ્તુરજી કાવશાહ રૂશતમજીએ જશનની ક્રીયા કરવા પછી શેઠ બેજનજીએ નશાખાનું ખોલ્લું મુકી પ્રસંગને અનુસરતુ ભાવચન કરીયું હતું. શેઠ મનચેરશાહ પાલનજી કેકોબાદે રીપોરટ વાંચતાં જણાવ્યું કે આ દખમું વેસુ, ખજોત, ડુમસ તથા ઉમરાગામના પારસીઓ વાપરે છે ને સો વરસનું પુરાણુ છે. એ દખમાનો વહીવટ ૧૯૦૯ થી સુરતની પારસી પંચાયત હસ્તક છે. જુનુ નશાખાનું શેઠ પાલણજી શા. મીસતરીએ બંધાવેલું તે બીસમાર થવાથી એવો સાહેબે નસાખાનાનું નવું મકાન બંધાવી આપ્યું છે અને એની મરામત માટે ચોકસ રકમ આપનાર છે. પ્રમુખે અંજુમન તરફથી શેઠ પાલણજીને એક શીયાલ ઓઢાડી હતી જ્યારે શેઠ પાલનજીએ શેઠ બેજનજીને, મકાન બાંધનાર શેઠ પેસતનજી વાહાડયાને અને શેઠ હોરમજી શાપુરજી પટેલને એકેક શીયાલ ઓઢાડી હતી. જુના નસાખાના ઉપર પસ્ચીમની તખ્તી હતી તેની નકલ—શ્રી પાકદાદાર હોરમજદના મદદ હોજો—શ્રી વેસુ ગામના રહેવાશી પારશી સાપુરજી જીવણજી મરોલીયા રોજ ૬ થો ખોરદાદ માહા ૬ થો સરેવર સને ૧૨૫૮ યજદેજરદી તા૦ ૨૦ ફેબરવારી સને ૧૮૮૯ ઇસવીસને દીને રવી મુમ્બાઇ મધે બહેસ્તનસીન થઆ તેવણના પુનને માટે તેવણની નઇએતે તેવણના દીકરા પાલણજી સાપુરજી મીસતરીએ સુરત જીલ્લાના ગામ શ્રી ડુમસ, વેસુ, ખજોત, ઉમરા વગેરેના પારસી રહેવાશીઓના ફાએદાને માટે તથા એ બાહારગામના રવાનોને સારૂં એ મુકામ તથા નસાખાનું તથા નસેસાલારોના નાહવાને સારૂં તથા નસાને લગતા કપરાં નાખવાનું મુકામ મળી બંધાવી આપ્યું છે અને એ મુકામો સરવે જરથોસ્તીઓના વપરાસ માટે પારસી અનજુમનને સ્વાધીન કીધું છે. સઇ—જુના નસાખાનાની પુર્વે અને પસ્ચીમ વચેની બીજી તખ્તી—આ નસાખાનનું મકાન બીસમાર હાલતમાં આવી જવાથી ઉપલાજ ધણી શેઠ પાલણજી સાપુરજી મીસતરીએ પાકું પોતાના ખરચે નવેસરથી નવું બંધાવી ઉપલી અનજુમનને સ્વાધીન કીધું છે. રોજ દેપદીન

દાદાર માહ મહેર ૧૨૮૮ તા૦ ૧ લી એપ્રેલ ૧૯૧૯—નવા નસાખાના ઉપરની પુરવ તરફની તખ્તીની નકલ—આ મકાન શેઠ પાલણજી સાપુરજી મીસતરીએ પોતાના બેહેસ્તનશીન દીકરા સાવકસાહ જેવણ રોજ દેપદીન દાદાર માહા મહેર યજદ યજદેજરદીને ૧૨૮૬ તા૦ ૧ લી એપ્રેલ સને ૧૯૧૭ અને વાર રવીને દીને હક થઆ તેવણનાં પુનને માટે બંધાવી ઉમરા, વેસુ, ખજોત, તથા ડુમસ ગામની અનજુમનને રોજે દેપદીન દાદાર માહા મહેર યજદ યજદેજરદી ૧૨૮૮ તા૦ ૧ લી એપ્રેલ સને ૧૯૧૯ ને વાર મંગલને દીને ખુલ્લુ મુકી સ્વાધીન કીધું છે.

ભરૂચની જનાના હાસપીટલમાં ખુલ્લી મેલાયલી મેટરનીટી હાસપીટલ અને ઓપરેશન બલોક—ભરૂચ ખાતે દોઢ દાયકો થયા મીશન ખાતાં તરફથી સ્થાપાયલી જનાના હાસપીટલમાં બઇરાઓના દરદોની સારી સારવાર થાય છે. એમાં જગાની તંગી પડવાથી લેડી પીરોજબાઇ શા૦ ભરૂચા મેટરનીટી હાસપીટલનું અને દીનશાહ ફરદુનજી ઓપરેશન બલોક બાંધવામાં આવ્યા છે. તે ખુલ્લાં મુકવાની ક્રીયા રોજ ૨૬ મો માહા ૯ મો યાને તા૦ ૩ જી જુને ઉતર પ્રાંતના રેવેન્યુ કમીશનર મો૦ મી૦ એફ. જી. પ્રાટના પ્રમુખપણા હેઠલ કરવામાં આવી હતી. શરૂઆતમાં મી૦ અડવાનીએ જણાવ્યું કે ૧૯૧૭ માં ડીસ્ત્રીકટ જડજ તરીકે આ જીલ્લામાં આવ્યા પછી આ હોસપીટલમાં જગાની તંગી જણાવાથી એક ફંડ ઉભુ કરવામાં આવ્યું હતું, તેમાં લેડી પીરોજબાઇ શાપુરજી ભરૂચાએ ૩૨૦૦૦ અને સર શાપુરજી ભરૂચાએ ૩૭૦૦૦ આપ્યા છે તે માટે ઉપકાર માનવામાં આવે છે અને લેડી પીરોજબાઇનું નામ મેટરનીટી હાસપીટલને આપ્યું છે, એ મકાન માટે લગભગ ૨૩૩૦૦૦ નો ખરચ થશે જશે. શેઠ રતનજી ફરદુનજીએ ૨૫૦૦૦ ઓપરેશન બલોક માટે આપ્યાથી એ બલોકને એવણના ભાઇ દીનશાહ ફરદુનજીનું નામ આપ્યું છે. એ બલોક પાછળ લગભગ બાર હજાર ખરચાયા છે. શેઠ પીરોજશાહ વખારીઆએ ૩૨૦૦૦ અને વખારીયા કુટુંબે ૨૩૦૦૦ કરતાં વધુ રકમ આપવાથી શેઠ પીરોશાહના ગુજરી ગયલા બાળક બેટા અરદેશરનું નામ ગાએનોલોજીકલ વોરડ સાથે જોડવામાં આવ્યું છે. એ પછી મેલાવડો વીસરજન થયો હતો.

ઇગતપુરાની દરેહમેહરમાં થયલો ફેરફાર—ઇગતપુરાની અંજુમનના પ્રેસીડંટ શેઠ મંચેરશાહ દાદાભાઇ ભાવનગરીએ પોતાના ધણીયાણી બાઇ કુંવરબાઇનાં પુણ માટે તેવણની પોતાની પુંજીમાંથી ત્યાંની દરેહમેહરના મકાનમાં શાહબાદી લાદીઓ તથા તાઇલસો જડાવી બીજો ઘટતો ફેરફાર કરવા પછી એ મકાનને જશનની ક્રીયા કરી રોજ ૪ થો માહા ૧૦ માને દીને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. શેઠ મંચેરશાહની સખાવત માટે અંજુમન તરફથી એક માનપત્ર તથા શીયાલ શેઠ દોરાબશાહ શાપુરજી ઇચ્છાપોરીયાના પ્રમુખપણા હેઠળ એનાયત કરવામાંઆવી હતી.

સીકંદરાબાદ ખાતે ખુલ્લુ મેલાયલુ મકાન—સીકંદરાબાદના જાણીતા શેહેરી શેઠ ડોસાભાઇ નશરવાનજી ચીનાઇએ સીકંદરાબાદના "હોમ ફોર ધી એજેડ પુઅર" ને લગતો રૂપીયા પચીસ હજારની કીમતનો એક બલોક બંધાવી આપયો હતો, તે ખુલ્લો મેલવાની ક્રીયા રોજ ૧૮ મો માહા ૧૧ મો યાને તા૦ ૨૪ મી જુલાઇએ નામદાર રેસીડંટ સર સ્ટુઅરટ ફરેઝરે એક દબદબા ભરયા મેળાવડા સનમુખ કીધી હતી. સર સ્ટુઅરટ ફરેઝરે પારસી કોમની સખાવતી ગુણ તથા શેઠ ડોસાભાઇની સખાવત માટે તારીફ કરી એવા ધરમ અને દયાના કામો કરવા જુસ્સાભર અપીલ કરવા બાદ એ બલોક ખુલ્લો મેલાયલો જાહેર કરવામાં આવ્યો હતો. એ પછી 'હોમ' માં તથા દરેક ઓરડા અને બલોકની સફાઇ સુઘડાઇ જોઇ સરવે ખુશી થયાં હતાં અને શેઠ ડોસાભાઇ ચીનાઇ અને એવણના ધણીયાણીને મુબારકબાદી આપતાં વીદાય થયાં હતાં.

આગરા ખાતે ખુલ્લી મેલાયલી ધરમશાળા—આગરા ખાતે કારટન હોટલના માલેક શેઠ રૂસ્તમજી નશરવાનજી રૂસ્તમફરામનાએ કેનટોમેંટ પ્રતાપપુરામાં આવેલું પચીસથી વધુ માણસની સગવડ થાય તેવું જુદા જુદા આંઠ રૂમો સાથનું એક પોતાનું મકાન પારસી ધરમશાળાના વપરાસને માટે આગરાની અનજુમનને ધરમ ખાતે સ્વાધીન કરયું છે. એ ધરમશાલા ખુલ્લી મેલવાની ક્રીયા રોજ ૨૦ મો માહા ૧૧ માને દીને કરવામાં આવી હતી. જશનની ક્રીયા પંથકી માણેકજી દોરાબજી દસ્તુરે કરયા પછી ધરમશાળાનું મકાન ભેટ આપનાર શેઠ રૂશતમજીને અંજુમન તરફથી એક માનપત્ર તથા શેયાલ અને એવણના ધણીયાણી બાઇ પુતલીબાઇને બીજી શીયાલ ઓઢાડવામાં આવી હતી. તેમજ ધરમશાળામાં એઓ બંનેની ઓઇલ પેટીંગ સબી ખુલ્લી મુકવામાં આવી હતી. લગન–નવજોત અને જશણ વગેરે સરઅવસરના ક્રીયા કામો કરવા માટે આગ્રાની અંજુમને મોબેદ માણેકજી દોરાબજી દસ્તુરની પોતાના પંથકી તરીકે નેમણુંક કરી છે. તે ક્રીયા કામો કરવા સારૂ એ ધરમશાળાના મકાનમાં અલાહેદો હોલ કાહડવામાં આવ્યો છે.

ખેતાબ.

આપણી રાજકરતી બ્રીટીશ કોમનાં નવાં સાલની ખુશાલીમાં અપાયલા ખેતાબોમાં નીચલા જરથોસ્તીઓનેબી એનાયત થયા હતા :—

ઓ. બી. ઇ. યાને હાનીસર ઓફ ધી ઓરડર ઓફ ધી બ્રીટીશ એમપાયરનો ખેતાબ બલુચીસ્તાનવાલા ખા૦ બા૦ અરદેશર ડોસાભાઇ મારકરને જ્યારે એમ. બી. ઇ. યાને મેમબર ઓફ ધી ઓરડર ઓફ ધી બ્રીટીશ એમપાયરનો ખેતાબ મુંબઈવાલા શેઠ શાપુરજી બમનજી બીલીમોરીયાને, પુણાની વીમેનસ બ્રાંચ ડીપોવાલા બાઇ સુનાબાઇ કેકોબાદ દસ્તુરને, મુંબઈના ડેપ્યુટી પોલીસ સુપરીંટેનડંટ શેઠ એચ. આર. કોથાવાળાને, મુંબઇની વીમેનસ બ્રાંચ ડીપોવાલા બાઇ હીરાંબાઈ લાલકાકાને, બંગાલના લેડી કારમાઇકલસ વોર ફંડવાલા મીસીસ હોમાય મેહતાને અને પુણાની વીમેનસ બ્રાંચ ડીપોવાલા મીસીસ હીરાંબાઈ પદમજીને એનાયત થયો હતો.

કયસરે હીંદનો રૂપાનો ચાંદ મુંબઇના રીટાયરડ એસીસ્ટંટ સરજ્યન ખા૦ બા૦ ડોસાભાઇ પેસ્તનજી કુપરને અને કરાંચી ખાતેની લડાઇના ફંડને લગતી બાનુઓની સાખાવાળા મીસીસ દીનબાનું માણેકજી વજીફદારને મલયો હતો. ખાન બહાદુરનો ખેતાબ કારવારના કંત્રાકટર ખાનસાહેબ દાદાભાઇ રતનજી વલસાડવાલાને, માઉંટ આબુના સીનીયર સબ એસીસ્ટંટ સરજ્યન ખાન સાહેબ અરદેશર કાવસજીને અને ખાનસાહેબ બરજોરજી કાવસજી લીચમોરને જ્યારે ખાન-સાહેબનો ખેતાબ પુણાવાલા શેઠ અસપંદયાર રૂસ્તમ ઈરાનીને, ધારવાડના વેપારી શેઠ માણેકજી મેરવાનજી કરાકાને, કવેતાના વેપારી શેઠ શાવકશાહ પીરોશાહને, રતલામ સ્ટેટ કાઉનસીલના મેમબર શેઠ દોરાબજી ફરદુનજી વકીલને અને રજપુતાણા એજનસી આફીસના સુપરીંટેનડંટ શેઠ મેરવાન માણેકજી ખંબાતાને એનાયત થયો હતો.

નામદાર બખતાવર શેહનશાહ જયોરજ પાંચમાની પપમી સાલગરેહનો મુબારક દીવસ તા૦ ૩જી જુને પડવાથી તેની ખુશાલીમાં નીચલા જરથોસ્તીઓને ખેતાબો એનાયત થયા હતા:—

મુંબઇનાં જાણીતા મીલ માલેક ને શેઠયા શેઠ ખરશેદજી નવરોજી વાહાડયાને સી. આઇ. ઇ. યાને કંપેનીયન ઓફ ધી ઇંડીયન એમપાયરનો નામીચો ખેતાબ એનાયત થયો હતો.

મઉવાલા ખાનબહાદુર ડી. સી. પેસ્તનજીને કયસરેહીંદનો સોનાનો ચાંદ એનાયત થયો હતો.

ખાનબાહાદુરનો ખેતાબ શેઠ નશરવાનજી રૂસ્તમજી વાછા, તે અમદાવાદની સેંત્રલ જેલના સુપરીનટેનડંટને અને મદરાસવાલા શેઠ જમશેદજી એદલજી બાટલીવાલા તે મદરાસ એંડ સધરન મરાઠા રેલવેના મદદનીશ ઓડીટરને મલ્યો હતો, જયારે ખાનસાહેબનો ખેતાબ શેઠ ખરશેદજી હો. મીસ્ત્રી તે મુંબઇના રીટાયરડ સબ એનજીનીયર, શેઠ સોરાબજી કાવસજી ડોટીવાલા તે અલીરાજપુર સ્ટેટના દીવાન, શેઠ અરદેશર રતનજી મહેતા તે હોસપીટલ સ્ટોરકીપર, સપલાઈ એંડ ત્રાંસપોરટ કોર, શેઠ હોરમસજી પેસતનજી તે આગરા કેનટોનમેંટ કમીટીના મેમબર. શેઠ કેખશરૂ સોરાબજી સુરતી, તે હીંદી ટપાલ ખાતાવાલા, શેઠ હોરમસજી પી. તલાટી, તે દેહરાદુનની ૭મી ગુરખા રાઇફલસના કલારક, શેઠ ફીરોઝશા પાલનજી તે મોટર મેલ કોનત્રેકટર માઇસોર, શેઠ જેહાંગીરજી ગુસતાદજી મોદી, એદીસઆબા એબીસીનીયા અને શેઠ મેરામશાહ કેરબાદજી ઇલાવીયા તે એકસાઇઝ કોનત્રેકટર, મધ્ય હીંદુસ્તાનવાલાને એનાયત થયો હતો.

એમ. બી. ઇ. યાને મેમબર ઓફ ધી ઓરડર ઓફ ધી બ્રીટીશ એમપાયરનો ખેતાબ મીસ બીખાઇજી અરદેશર એનજીનીયર, તે મુંબઇના સેવાસદનના સેકરેટરી, શેઠ દીનશાહ એદલજી માહવા, તે મુંબઇના સેંટ જોન એમબયુલંસ બ્રીગેડના પારસી ડીવીઝનના સુપરીનટેનડંટ, શેઠ દારાબશાહ નશરવાનજી મારકર તે મુંબઇના સેંટ જોન એમબ્યુલંસ બ્રીગેડના કોસમોપોલીટન ડીવીઝનના સુપરીનટેનડંટ અને શેઠ અરદેશર ડોસાભાઇ વાહાડયાને મલયો હતો.

શેઠ હોરમજી નશરવાનજી વકીલ સોલીસીટરને સપટેમબર ૧૯૧૮માં બ્રીટીશ સરકારની થયલી જીતની ખુશાલીમાં નામદાર નીઝામે નવાબ બહાદુરનો ઉંચો ખેતાબ એનાયત કરવાથી શેઠ હોરમજી "નવાબ હોરમઝદ જંગ બહાદુર"ના નામથી ઓલખાતા હતા.

વડોદરાની કોલેજના પ્રીનસીપલ શેઠ એ. એમ. મસાનીને રાજ રતનનો સોનાનો ચાંદ નામદાર માહારાજા ગાયકવાડની તા૦ ૨૨મી મારચે પડેલી સાલગ્રહની ખુશાલીમાં એનાયત કીધો હતો.

પતીયાલાવાલા મેજર કેકી મીસતરીને પતીયાલાના નામદાર માહારાજાની તા૦ ૧૪મી અકટોબર ૧૯૧૮ ને દીવસે પડેલી સાલગ્રહની ખુશાલીમાં કરનલની ચઢીઆતી લશકરી પદ્દી આપી "તાઝીમી સરદાર"નો ખેતાબ એનાયત કરવામાં આવ્યો હતો.

ઓધા—નેમણુંક—વગેરે.

આપણા શહેરના જાણીતા તબીબ ડા૦ સર તેમુલજી ભીખાજી નરીમાનને નામદાર હીંદી સરકારે આઇ. એમ. એસ. તથા બીજી તબીબી નોકરીના પગારમાં વધારો કરવાના સવાલ ઉપર વીચાર ચલાવવાના સંબંધમાં મોટા તબીબી અમલદારોનું એક કમીશન નેમયું હતું તેમાં મુંબઇ ઇલાકા તરફથી એક કમીશનર તરીકે નેમયા હતા. તેવણ આ કમીશન ઉપર બેસવા માટે કલકતા જવા મુંબઇથી તા૦ ૨૮ મી ફેબરવારીએ ઉપડી ગયા હતા. મુંબઇની યુનીવરસીટીની ચાલુ સાલની એમ. ડી. ની પરીક્ષામાં મીડલીફરીના વીશયના પરીક્ષક તરીકે ડા૦ સર તેમુલજી નરીમાનની નેમણુંક કરવામાં આવી હતી પણ-એવણે પોતે કમીશનપર હોવાથી પરીક્ષક તરીકે રાજીનામું આપવાથી એવણની જગાએ ડા૦ રતનશાહ તેમુલજી નરીમાનને નેમયા હતા.

શેઠ દીનશાહ રતનજી દારુને વડોદરા સ્ટેટના ધારાસભા માટે નવસારી પ્રાંતના વીઆરા વીભાગ તરફના પ્રજા તરફના પ્રતીનીધી તરીકે ચુંટી કાઢયા હતા.

શેઠ દોરાબ એન. બહાદુરજી બેરીસ્ટરને મુંબઇના કામચલાઉ એડવોકેટ જનરલ અને નામદાર ગવરનરની ધારા બાંધનારી કાઉનસીલના વધારાના સભાસદ નેમ્યા હતા.

તેહરાનની જરથોસ્તી કોમના આગેવાન કેરમાનવાળા અરબાબ કેખશરો શાહરૂખને યઝદ, કેરમાન અને તેહરાનના જરથોસ્તી ઇરાનીઓના પ્રતીનીધી તરીકે ઇરાનની પારલામેંટના મેમબર તરીકે ત્રીજીવાર ચુંટી કાઢયા હતા.

ડા૦ હોમી અરદેશર દાદરેવાલાને દમણના ગવરનરની કાઉનસીલના વધારાના મેમ્બર નેમ્યા હતા.

સર કાવશજી જહાંગીર બારોનેટને મુંબઇના સને ૧૯૧૯ ના સાલના શેરીફ નેમ્યા હતા.

શેઠ અરદેશર પેસતનજી સબાવાળા બેરીસ્ટરને કામચલાઉ ડેપ્યુટી શેરીફ નેમ્યા હતા.

શેઠ મંચેરશાહ કાવશજી ગજ્જરને સરકારના રેવન્યુ અને ફીનાનશીયલ ખાતાંઓના સીનીયર મદદનીશ સેક્રેટરી નેમ્યા હતા.

શેઠ જમશેદજી અરદેશર વાડયાને એકસેસ પ્રોફીટસ ટેકસ માટે આવેલી અરજીઓપર વીચાર ચલાવવાની બોરડના મેમબર નેમ્યા હતા.

મુંબઇની જાણીતી શેઠો કાવશજી દીનશાહની કંપનીને જરમન ઇસટ આફ્રીકાના જીતી લીધેલા વીસતારોના હીંદ મધેના કારોબારી એજંટો નેમ્યા હતા.

તબીબી કરનલ હોરમજી એદલજી બનાતવાળા સી. એસ. આઇ. ને ઇનસપેકટર-જનરલ ઓફ પ્રીઝનરસ તરીકે નેમયા હતા.

મુંબઇની છુપી પોલીસના અમલદાર ખાનબહાદુર કાવશજી જમશેદજી પેતીગરાને છુપી પોલીસના સુપ્રીંટેનડન્ટ નેમયા હતા.

શેઠ દીનશાહ ફરદુનજી મુલ્લાંને સીટી ઇમપ્રુવમેંટ ત્રસ્ટની ત્રાઇબ્યુનલ ઓફ અપીલના પ્રમુખ નેમયા હતા.

શેઠ દાદીબા એમ. દલાલને હીંદી ચલણ અને હુંડીયામણ કમીટીના સભાસદ નેમયાથી એવણ ગયા જુન માસમાં વેલાત ગયા હતા.

શેઠ ફરામરોજ ધનજીભાઇ બક્ષીને ડેપ્યુટી કંત્રોલર ઓફ ઈંડયા ત્રેઝરીના ઓધા ઉપર બંગાલ ઇલાકામાં નેમયા હતા.

શેઠ નાનાભાઇ હો. મુસ બેરીસટરને મુંબઇની હાઇકોરટના ઓફીસીયલ રીસીવર નેમયા હતા.

શેઠ શાપુરજી બમનજી બીલીમોરીયાને મુંબઇની ઓડીટરસ કાઉનસીલના મેમબર નેમયા હતા.

ખાનસાહેબ સોરાબજી કુવરજીને કરાંચીનાં ઈંડો યુરોપીયન ટેલીગ્રાફ ખાતાનાં ત્રાફીક સુપ્રીંટેનડંટ અને એકાઉનટંટ આફીસરના ઓધા ઉપર નેમયા હતા.

શેઠ ડોસાભાઇ ધનજીભાઇ બીલીમોરીયાને અમદાવાદના ઇનકમટેક્ષના સ્પેશીયલ કલેકટર, અને ખા૦ બા૦ જમશેદજી બેજનજી વાચ્છાને મુંબઇના ઇનકમટેક્ષના કલેકટર નેમયા હતા.

શેઠ સોરાબજી ફરામજી બીલીમોરીયાની બીજા જડજ, અને શેઠ રતનશાહ સોરાબજી દાદાચાનજીની ચોથા જડજ તરીકે મુંબઇની સમોલ કોઝીઝ કોરટમાં કામચલાઉ નેમણુક થઇ હતી.

શેઠ દાદીબા ખરશેદજી મેહતાને અમદાવાદના સેશનસ જડજ, શેઠ ધનજીશાહ ડોશાભાઇ કુપરને ખાનદેશના મદદનીશ સેશનસ જડજ અને શેઠ નાદીરશાહ એન. માસતરને ગોધરાના સબ જડજ નેમયા હતા.

શેઠ હોરમજદીયાર ફીરોઝ દસ્તુરને મુંબઇના વધારાના કામચલાઉ મેજીસ્ટરેટ, શેઠ અરદેસર ફરદુનનજી દલાલને પુણાના સીટી મેજીસ્ટરેટ ને ઇનકમટેક્ષ કલેકટર અને શેઠ શીયાવક્ષ માણેકજી તલાતીને કરાંચીના મેજીસ્ટરેટ નેમયા હતા.

શેઠ પીરોશાહ બેરામજી મલબારી બેરીસટરને હાઇકોરટના પ્રોથોનોટરી, શેઠ દોરાબ એન. ડી. ખંડાલાવાળાને પેહલા ડેપ્યુટી રેજીસ્ટરાર અને કમીશનર તથા શેઠ એદલજી જાહાંગીર દાવરને ત્રીજા ડેપ્યુટી રેજીસ્ટરાર, અને શેઠ નવરોજી પાલનજી પાવરીને મુંબઇની સમાલકોઝ કોરટના વડા રેજીસ્ટરાર નેમયા હતા.

નવા જે. પી. યાને સુલેહના અમલદારો તરીકે નીચલા પારસીઓને નેમયા હતા:—શેઠ બહમનજી ધનજીભાઈ, શેઠ બેહરામ નવરોજી કરંજીઆ, શેઠ જહાંગીર ભીખાજી, શેઠ જહાંગીર. હોરમસજી સોરાબજી અને શેઠ જમશેદજી પી. મીસ્ત્રી.

શેઠ નવરોઝ અ. પોસ્ટવાળાને નાની દમણના કામચલાઉ સીવીલ રેજીસ્ટરાર નેમયા હતા

શેઠ એ. આર. બનાજી માઇસોરના કામચલાઉ દીવાન નેમાયા હતા.

શેઠ જાલ એ. ડી. નવરોજીને વડોદરા વીભાગના નાયબ સુબા નેમયા હતા.

શેઠ બાપુજી ન. ખંબાતાને અલવારના મહારાજાએ પોતાના મેહલોના કંત્રોલર નેમ્યા હતા.

શેઠ નશરવાનજી બેજનજી ડમરીને જસદણ સ્ટેટના એડમીનીસ્ટરેટર નેમયા હતા.

શેઠ ફકીરજી એદલજી ભરૂચાને ઉદ્યોગ ખાતામાં ૭ મહીના માટે મીકેનીકલ એનજીનીયર નેમયા હતા.

શેઠ હોરમજી ભીખાજી મીનોચેહરને સીંધના સરકારી વીજળીક ઇનસપેકટર નેમયા હતા.

શેઠ ડોશાભાઇ માણેકજી કોઠાવાળાને અમદાવાદના હજુર એકાઉન્ટંટ હાફીસર નેમયા હતા.

શેઠ વીકાજી પીરોશાહ ભીલાડવાલાને મહાલક્ષ્મીના ઘાસની મારકીટ અને ગોડાઉનના સુપરવાઇઝર અને ચેકર નેમયા હતા.

શેઠ એરચશાહ હોરમજી આશાવઇદને લંડનની ઇનકોરપોરેટેડ સોસાયટી ઓફ સાયનસ લેતરસ એંડ આરટે પોતાના ફેલો ચુંટી કાઢયા હતા.

ડા૦ એદલજી માણેકજી મોદીને મુંબઇની પારસી મેત્રીમોનીયલ કોરટના ડેલીગેટ નેમયા હતા.

શેઠો બમનજી જમશેદજી વાચ્છાને ગવરમેંટ લૉ સ્કુલના પ્રીનસીપલ તથા હોરમજી ફીરોશાહ મોદીને લૉના, શેઠો દીનશાહ દોરાબજી કાપડીઆને એલફીનસ્ટન કોલેજના મેથેમેટીકસના તથા ફીરોઝ કાવશજી દાવરને ઇંગલીશના, શેઠ જાહાંગીર સોરાબશાહ કોમીસરીયટને અમદાવાદની ગુજરાત કોલેજના લોજીકને ઇંગલીશના પ્રોફેસર અને શેઠ બહાદુરજી મેરવાનજી બહાદુરજીને. લારખાનાની ન્યુ હાઇસ્કુલના હેડ માસતર નેમયા હતા.

હીંદી વેપારી ચેમબરના ઉપ પ્રમુખ તરીકે શેઠ જાહાંગીર બ. પીટીટ અને સભાસદો તરીકે ઓ. સર દીનશાહ એ. વાચ્છા, સર શાપુરજી બી. ભરૂચા, શેઠ સોરાબજી એ. વારડન અને શેઠ ફીરોઝ જે. બીલીમોરીયાને નેમયા હતા.

શેઠ જાહાંગીર બમનજી પીટીટને દીહલી ખાતે ગયા દીસેમબરમાં ક્રીસટમસ ટાંકણે મલેલી ૧૪ મી ઈંડીયન ઇનડસત્રીયલ કોનફરંસના પ્રમુખ નેમયા હતા.

ખા૦ બા૦ આદરજી મનચેરજી દલાલને મુંબઇમાં તા૦ ૧૧ મી ને ૧૨ મી જાનેવારીએ મલેલી જરથોસ્તી કોનફરંસના પ્રમુખ નેમયા હતા.

શેઠ હોરમજી કાવશજી દીનશાહ એમ. બી. ઓ, ઓ. બી. ઇ. ને એડનના બારોના ત્રસ્ટી, ડા૦ કાવસજી એદલજી દાદાચાનજી, ઓ૦ શેઠ ફીરોઝ સી. શેઠના અને શેઠ કાવસજી જેહાંગીરને મુંબઈના સીટી ત્રસ્ટના ત્રસ્ટીઓ તરીકે મ્યુનીસીપાલ કોરપોરેશન તરફથી નેમવામાં આવ્યા હતા.

શેઠ કાવશજી જાહાંગીરને મુંબઇની મ્યુનીસીપાલ કોરપોરેશનના પ્રમુખ અને શેઠો હોરમજી પી. મોદી તથા બેરામજી આર. બી. જીજીભાઇને સટેનડીંગ કમીતીના મેમબર, શેઠ પી. ડી. પટેલ, બેરીસ્ટરને રંગુન મ્યુનીસીપાલીટીના પ્રમુખ તથા શેઠ પદમજી પેસતનજી જીનવાલા બેરીસ્ટરને વાઇસ પ્રેસીડંન્ટ, પ્રોફેસર અરદેશર સોરાબજી પોરતવાલાને દમણની મ્યુનીસીપલ કોરપોરેશનના પ્રમુખ તેમજ ઓફીસીએટીંગ સીવીલ રેજીસ્ટરાર તથા શેઠ સોરાબજી ફરામજી ખબરદારને વાઇસ પ્રેસીડન્ટ નેમયા હતા.

મુંબઇની મયુનીસીપાલીટીના તંદરોસ્તી ખાતાના વડા અમલદાર તરીકે ડા૦ સોરાબ સી૦ હોરમજીને, પાણીખાતાના સુપ્રીંટેનડંટ તરીકે શેઠ ફરામરોજ પેસતનજી મસાણીને અને ઇમારતોના મદદનીશ એનજીનીયર તરીકે શેઠ એ. જે. બીલીયાને નેમયા હતા.

કરંસી હાફીસના સુપ્રીટેંડન્ટ શેઠ કે. ઇ. કુમાનાની એસીસટંટ એકાઉટંસ હાફીસર અને ઇસ્યુ હાફીશર તરીકે કામચલાઉ નેમણુંક થઈ હતી.

શેઠ જાહાંગીર રૂશતમજી સુખીયાને સીંધના ડેપ્યુટી પોલીસ સુપ્રીટેનડન્ટ નેમયા હતા.

શેઠ રૂશતમજી મા. શેઠનાને બીકાનેરના ઇલેક્ત્રીકલ તથા મીકેનીકલ એનજીનીયર નેમ્યા હતા.

શેઠ ફીરોઝશાહ જાહાંગીર મરઝબાનને સર જમશેદજી જીજીભાઇ પારસી બીનેવોલંટ ઇનસ્ટીટયુશનના ત્રસ્ટી નેમવામાં આવ્યા હતા.

શેઠ સોરાબજી મ. દેશાઇને નવસારીની બઝમે બેહરામની કમીટીના વાઇસ પ્રેસીડંટ નેમ્યા હતા.

પારસી પંચાયતના ત્રસ્ટીઓની ચુંટણી કરનારી અંજુમન કમીટીના ૧૦૦ ના મંડળમાં રેજીસ્ટર "એ" તરફથી શેઠો કેખશરૂ અરદેશર મોદી તથા ઉકરજી કાવશજી ઉમરીગરને અને "સી" તરફથી શેઠ નવરોજી સોરાબજી બનશાને; કરાંચીની પારસી અંજુમનની મીલકતોના ઓ. સેકરેટરી તરીકે શેઠ ફકીરજી કાવશજી દુબાશને તથા ઓ. ત્રેઝરર તરીકે શેઠ એરચશાહ નાનાભાઇ ખરેગાટને હાંગકાંગની જરથોસ્તી અંજુમનના ધરમ ફંડના સરનશીન તરીકે શેઠ હોરમઝ કેખશરૂ ઇરાની, ત્રસ્ટી તરીકે શેઠ જાહાંગીર એચ. રતનજી અને સેકરેટરી તરીકે શેઠ રૂશતમ અરદેશર દસ્તુરને નેમયા હતા; શેઠ દારાબશાહ રતનજી હોમાવાલાને ભરૂચની પારસી પંચાયતના ઓડીટર; એરવદ કાવશજી હો. રાત્રને સુરતની ભગર સાથ અંજુમનના સેકરેટરી અને શેઠ જાહાંગીર બરજોરજી સંજાનાને સુરતની પારસીપંચાયતના સેકરેટરી નેમયા હતા.

ખા૦ બા૦ એરચજી શેરીયારજી ભરૂચાને નામદાર વાઇસરોયના ઓનરરી આસીસટંટ સરજયન, કેપટન બેરામજી પેસતનજી સબાવાલાને સુરતના પારસી સુવાવડખાનાના અને જનરલ હાસપીટલના ઓ. કંસલટીંગ સરજયન, ડા૦ ફરામરોજ આર. પારખને સુરતના ગુલબાઇ સુવાવડખાનાના ઓબત્રેત્રીકલ સરજયન, ડા૦ કે. સી. અંકલેસરીયાને મુંબઇના એ. ડીવીઝનના પોલીસ તબીબ, ડા૦ બેરામ બી. ભરૂચાને ખેતવાડીની માણેકજી પીટીટ ચેરીટેબલ ડીસ્પેનશરીના આંખના ડાકટર, ડા૦ આર. ડી. ચીનાઇને સર જમશેદજીની હાસપીટલના ઓ. એસીસટંટ ફીઝીશીયન, ડા૦ રતનજી દીનશાહ દલાલને બેલગામની વેકસીન ઇનસટીટયુટના ડીરેકટર, ડા૦ ધનજીશાહ મેહતાને વડોદરાની હાસપીટલના બીજા મેડીકલ હાફીસર, ડા૦ મીસ જાલીબાઇ બી. એનજીનીયરને મુંબઇના પોરટ હેલથ સટાફ ઉપરના લેડી ડાકટર અને ડા૦ ગુલબાઇ પીરોશાહ પટેલને સુરતના ભાગાતલાવની છોકરાંઓની હાસપીટલના હાઉસ સરજયન નેમયા હતા.

કેળવણી—પરીક્ષા—સ્કોલરશીપો—વગેરે.

ડા૦ જમશેદજી માણેકજી ઉનવાલા બી. એ. એ જરમની ખાતેની હીડનબરગ યુનીવરસીટીમાંથી પી. એચ. ડી. ની ડીગ્રી ૧૯૧૭ના જુલાઇમાં મેળવી હતી અને એવણને સંસકરત લખાણો ઉપર શોધખોલ કરવા પાઉંડ ૨૦૦) ની સ્કોલરશીપ એક વરસ માટે મલી હતી.

મી૦ રૂશતમ ફીરોશાહ દમરી એમ. એ.એ એમેરીકાના વોશીંગટનની ફીલોસોફીકલ સ્કુલની માસતર ઓફ પેડેગોજીની ડીગ્રી મેળવી છે અને એવણને મુંબઇની સેકંડરી ત્રેનીંગકોલેજમાં નેમ્યા છે.

ડા૦ જાહાંગીર માણેકજી તલાતીએ ઓકસફરડ યુનીવરસીટીની આંખને લગતી પરીક્ષા આપી, સોના, રૂપાના ચાંદો મેલવ્યા છે. એવણને રોયલ લંડન ઓફ ઓફ્થલમીક મુરફીલ હાસપીટલના સીનીયર કલીનીકલ નેમ્યા છે.

બેરીસ્ટરની પરીક્ષામાં નીચલા પસાર થયા હતાઃ—મેસરસ અદી જમશેદજી પુનાવાળા, હોમી જાહાંગીર રૂશતમજી, નશરવાનજી ફરામજી ગહેતા, નઉશીર સોરાબજી ચીનાઇ અને ફીરોઝ જીજીભાઇ; સોલીસીટરની પરીક્ષામાં મી૦ એફ. એ. દોટીવાળા અને હાઇ કોરટ પલીડરની પરીક્ષામાં મી૦ હોમી જહાંગીર કુપર પસાર થયા હતા.

એલ. એલ. બી. ની પરીક્ષામાં હાજર થયલા ૨૨૩ ઉમેદવારોમાંથી ૯૯ ગયા દીસેમ્બરમાં પસાર થયા હતા, તેમાં નીચલા પારસીઓ છેઃ—મેસરસ સોરાબજી જમશેદજી બીલીમોરીયા, જહાંગીર અરદેશર કામા, દોરાબજી પેસતનજી દારૂવાલા, જમશેદ રતનજી ખંબાતા, ફીરોઝ એદલજી કુમાના, નોશીરવાન બેરામજી મોતીવાલા, જાલેજર કાવશજી મુલ્લા, મીનોચેહર મેરવાનજી પાવરી, મીનોચેહર અરદેશર રબાદી અને શાપુરજી મંચેરજી રાજા; એજ પરીક્ષામાં હાજર થયલા ૨૬૩ માંથી ૧૨૮ ગયા મે મહીનામાં પસાર થયલા તેમાં નીચલા પારસીઓ છેઃ—મેસરસ જમશેદજી સો. લામ, શયાવક્ષ સોરાબજી ખંબાતા, મીનોચેહર દોરાબજી લાલકાકા, નશરવાનજી ખરશેદજી સહીયાર, અને ખરશેદજી ફરામજી વાડયા, આમાં પસાર થયલા મી૦ જમશેદજી સોરાબજી લામને જાજ સપેનસર પ્રાઇઝ અરધે ભાગે અને શેઠ મનચેરજી નવરોજી બનાજી સ્કોલરશીપ મલી હતી.

એમ. બી. બી. એસ. ની પરીક્ષામાં હાજર થયલા ૧૨૩ માંથી ૫૦ ગયા દીસેમબરમાં પસાર થયલા તેમાં નીચલા પારસીઓ છેઃ—બાઇઓ પુતલીબાઇ હોરમસજી પેસીકાકા, તેહેમીના હોરમસજી પેસીકાકા, ગુલબાઇ અરદેશર પોસતવાલા, મેહેરબાઇ અરદેશર પોસતવાલા, અને ગુલચેહર ખરશેદજી સરવેયર તથા મેસરસ કેખશરૂ માણેકજી ભરૂચા, એદલજી ફીરોશાહ એનજીનીયર, બરજોર પીરોશાહ વકીલ, અને જાહાંગીર મેહરજીભાઇ પટેલ, આમાં પસાર થયલાં બાઇ ગુલબાઇ અ. પોસ્ટવાલાને ચારલસ મોહર પ્રાઇઝ અરધે ભાગે અને બાઇ મેહેરબાઇ અરદેશર પોસ્ટવાળાને બાળક્રીશણા સુદરાજી પ્રાઇઝ, ક્વીન એમપ્રેસ શીલવર મેડલ, મેડીકલ વીમેન ફોર ઇંડીયા ફંડની સ્કોલરશીપ, લેડી રે શીલવર મેડલ, અને બાઇ હીરાંબાઇ પેસતનજી હોરમસજી કામા ગોલ્ડ મેડલ મલ્યો હતો, એજ પરીક્ષામાં હાજર થયલાં ૧૦૭ માંથી ગયા મેમાં ૬૭ પસાર થયલા, તેમાં નીચલા પારસીઓ છેઃ—બાઇ નાજા રૂશતમજી ગુઝદર તથા મેસરસ પીરોશાહ એરચશાહ હાથવાય, અરદેશર રતનજી વાડયા, એદલજી શાપુરજી મોદી, સોરાબજી નવરોજી દેણુ, રૂસતમ ખરશેદજી લામ અને બમન રતનશાહ માસતર.

મુંબઇ યુનીવરસીટીની માસતર ઓફ સરજરીની પરીક્ષામાં મી૦ નવરોજજી જમશેદજી એંડારાવાળા અને કોલેજ ઓફ ફીઝીશીયનસ એંડ સરજયનશની એલ. સી. પી. એસ.ની પરીક્ષામાં મી૦ ફરેદુન પેસતનજી ભમગરા પસાર થયા છે.

બી. ઇ. (સીવીલ) ની ડીગ્રી માટેની પરીક્ષામાં હાજર થયલા ૫૯ ઉમેદવારોમાંથી ૪૨ પસાર થયલા, તેમાં નીચલા પારસીઓ છેઃ—બીજા વરગમાં મેસરસ એરચ મે. ભકકા, મનચેરશાહ રૂસતમજી બીલીમોરીયા, ફરામજી ખરશેદજી છાપગર, અરદેશર ધનજીભાઇ ગીલડર, જાલભાઇ જમશેદજી કાંડાવાળા, એરચ અરદેશર નાદીરશાહ, બેહરામ જમશેદજી પંથકી, સોરાબજી દાદાભાઇ પટેલ, અને નશરવાન હોરમસજી પુનેગર.

એનજીનીયરીંગની પેહેલી પરીક્ષામાં મી૦ નદીર કાવસજી બલસારાને કરનલ પેત્રીક ફ્રેંચ સ્કોલરશીપ અને એનજીનીયરીંગની બીજી પરીક્ષા (સીવીલ) માં મી૦ પેસતનજી એદલજી ગોલવાલાને શેઠ નસરવાનજી જહાંગીરજી વાડીયા સ્કોલરશીપ મળી છે.

બી. એ. જી. યાને બેચેલર ઓફ એગ્રીકલચરની પરીક્ષામાં હાજર થયલા ૩૦ ઉમેદવારો માંથી ૨૭ બીજા વરગમાં પસાર થયલા, તેમાં નીચલા પારસીઓ છેઃ—મેસરસ બરજોરજી કાવશજી ભાટલીવાલા અને જમશેદ અરદેશર દાજી.

બી. એસ. સી. યાને બેચેલર ઓફ્ સાયનસની ડીગ્રી માટેની પરીક્ષામાં હાજર થયલા ૧૦૨ ઉમેદવારોમાંથી ૫૮ પસાર થયલા, તેમાં નીચલા પારસીઓ છેઃ—પહેલા વરગમાં મેસરસ કુંવરજી ભીમજીભાઇ તારાપોરવાલા અને શાપુરજી શેરીયારજી ટાઉનહોલવાળા, બીજા વરગમાં મેસરસ કેખશરૂ જહાંગીર કાબરાજી, બરજોરજી પીરોજશાહ ભરૂચા, નરીમાન કાવસજી આયના, સોરાબજી ખરશેદજી છાપગર, મહેરજી ધનજીશાહ શેઠના, જાલેજર હીરજી વાહડીયા, કેખશરૂ સોરાબજી ધાભર, નરીમાન દાદાભાઇ દોટીવાલા, નવલ બેજનજી ભાઠાવાલા, ફરામરોજ રતનજી દાબુ, અને જહાંગીર ધનજીશાહ મુસ; પાસ વરગમાં મેસરસ મીનોચેહર જાહાંગીર કાવસજી, હીરજી રૂશતમજી ડોકટર, દીનશાહ બરજોરજી બલસારા અને જમશેદજી આદરજી દુબાશ, આમાં પસાર થયલા મી૦ કુંવરજી બી. તારાપોરવાળાને સર જેમસ ફરગયુસન આરટની સ્કોલરશીપ મળી છે.

બેચેલર ઓફ્ કોમરસની ડીગ્રી માટેની પરીક્ષામાં હાજર થયલા ૧૦૬ ઉમેદવારોમાંથી ૫૬ પસાર થયલા તેમાં નીચલા પારસીઓ છેઃ—બીજા વરગમાં મેસરસ દીનશાહ નસરવાનજી દારૂવાળા, ભીખાજી એદલજી કુમાના, બેરામજી માણેકજી મોદી, જાહાંગીર ખરશેદજી સંતોક; પાસ વરગમાં મેસરસ નરીમાન બરજોરજી બજા, જાહાંગીર નવરોજી નરસંગ, નરીમાન રતનજી પેમાસતર, હોરમઝદીયાર ધનજીશાહ કરાકા અને માણેકજી હો. મેહતા.

સીડનહેમ કોલેજના એકાઉનટંસીના સરકારી ડીપલોમાંની પરીક્ષામાં નીચલા પારસીઓ પસાર થયા છેઃ—મેસરસ મીનોચેહેર શાપુરજી જોશી, હોશંગ નવરોજી, એરચ જમશેદજી દસતુર, ફીરોઝશાહ માણેકજી મોદી, અને નરીમાન રતનજી પેમાસતર.

એમ. એ. ની પરીક્ષામાં બધા મલી હાજર થયલા ૫૧ માંથી ૨૭ પસાર થયા હતા, તેમાં નીચલા પારસીઓ હતાઃ—બાઇ આઇમાઇ બેરામજી રૂશતમજી અને મી૦ કેખશરૂ પેસતનજી પટેલ.

બી. એ. યાને બેચેલર ઓફ્ આરટસની પરીક્ષામાં હાજર થયલા ૧૩૯૯ માંથી ૮૫૯ પસાર થયલા તેમાં નીચલા પારસીઓ હતાઃ—પેહલો વરગ ઓનરસ સાથ, બાઇ મીઠા અરદેશર તાતા તથા મેસરસ રૂશતમ સોરાબ ખંબાતા, મરઝબાન દી. બીલીમોરીયા અને જાહાંગીર અરદેશર દાવર, બીજા વરગમાં (ઓનરસ) બાઇઓ ગુલેસ્તાન જ. બહાદુરજી, ગુલબાઇ નશરવાનજી વકીલ, અને નવાજબાનું રૂશતમજી પંથકી, તથા મેસરસ ફરામરોઝ શાપુરજી સુખીયા, બહમનશાહ ખરશેદજી અમીન, સોરાબ પેસતનજી ગજડર, સોરાબ મંચેરશાહ વાડયા, કેરસાસ્પ માણેકજી દસ્તુર, સોરાબ ફી. ખરાસ, સોરાબ જ. બનાજી, નરીઓસંગ હોરમઝદીયાર કોયાજી, નરીમાન ખ. સંતોક અને મનચેરજી સો. રતનાગર, પાસ વરગમાં બાઇઓ તેહમીના પેસતનજી સીનોર, મેહરા નવરોજી પટેલ, શેહરબાનુ જાહાંગીર દોધી, શીરીન મેહરજીભાઇ એનજીનીયર અને પોરૂચીસતી જમશેદજી નાદરશાહ તથા મેસરસ જાહાંગીર પેસતનજી ચાહેવાળા, રતનશાહ દીનશાહ મુનસી, બમન જમશેદજી શેઠના, જાલ જાહાંગીર ખંબાતા, ફરામરોઝ ધનજીશાહ ધનબુરા, ફીરોઝ રૂશતમજી ભરૂચા, જમશેદ કાવશજી કાતરક, ફકીરજી ભીખાજી દારૂવાળા, બરજોર ખરશેદજી મોવડાવાળા, કેખશરૂ મનચેરજી ભરૂચા, શાવકશાહ હોરમજી ચીખલીવાળા. સોરાબ કેખશરૂ ધામટ, દોરાબ ફરામજી કાપડયા, જીજીભાઇ નાનાભાઇ મારશલ, બમન રૂશતમજી મુલ્લાફીરોઝ, ધનજીશાહ ફરામજી સુનાવાળા, અરદેશર બમનજી ઉમરીગર, નવલ નાદીરશાહ ફોટોગ્રાફર, જાહાંગીર જમશેદજી ડોકટર, નરીમાન ધનજીશાહ શેઠના, બમન દોરાબજી ડોકટર, મીનોચેહર ફરામજી હવેવાળા, દાદાભાઇ પેસતનજી કાતરક, હોરમજી રૂ. કેરાંવાળા, એરચશાહ ડોશાભાઇ મેહતા, જાહાંગીર રતનજી મેહતા,ફીરોઝ માણેકજી રાંડેલીઆ અને હોમી ફ. તારાપોરવાળા, આમાં પસાર થયલા બાઇ મીઠાં અ. તાતાને કોબડન કલબ મેડલ અને મી૦ જમશેદજી કા. કાતરકને શેઠ ફીરોઝશાહ મે. જીજીભાઈ સ્કોલરશીપ મલી હતી.

સ્કુલ લીવીંગ સરટીફીકેટ, (અગાઉની મેટ્રીક તથા સ્કુલ ફાઇલની) પરીક્ષામાં હાજર થયલા ૫૬૦૯ ઉમેદવારોમાંથી ૨૨૯ પારસીઓ પસાર થયા હતા તેમાં નીચલા બાનુઓ હતીઃ—બાઇઓ આલુ આલપાઈવાલા, રતી ખુરશેદચેહર અંકલેસરયા, આલુ પેસતનજી અવારીયા, મમઈ અરદેશર કોનટ્રેકટર, શેહરા નશરવાનજી કુપર, પેરીન ફકીરજી ડોકટર, શેહરા પેસતનજી કાંગા, બચુબાઇ મેરવાનજી ફ્યોક, જરબાઇ જીજીભાઇ ખરેઘાટ, દીનબાઇ શેરાબજી મેહતા, પીરોજા નશરવાનજી મોદી, સારાહ નવરોજી નાયગામવાળા, મેહરાં પે. પથાન, મહેરા માણેકશાહ શરાફ, મેહરા નશરવાનજી તાડીવાળા, રતી મીનોચેહર વકીલ, પરીન જી. ત્રેઝરીવાળા, શીરીન કાવશજી પોસ્ટવાલા અને બાનુ અરદેશર પટેલ, એમાં પસાર થયલા મી૦ બમનજી ફી. શેઠનાને શેઠ ડોસાભાઇ ફ. હામા સ્કોલરશીપ અને મી૦ મા. જ. મેહતાને સર દી. મા. પીટીટ સ્કોલરશીપ મળી છે.

ગયે વરસે બનેલા પરચુટણ જાણવાજોગ બનાવો.

સમસઉલ ઓલમાં એરવદ ડા૦ જીવણજી જમશેદજી મોદી, બી. એ., પી એચ. ડી., સી. આઇ' ઇ. ને સને ૧૯૧૭ના સાલ માટેનો " કેમપબેલ મેમોરીયલ મેડલ " એક મોટા મેલાવડા સનમુખ તા૦ ૧૩મી નવેમબરે સાંજે મુંબઇના નામદાર ગવરનર લોરડ વીલીંગડને ટાઉન હોલમાં રોયલ એશીયાટીક સોસાયટીની મુંબઇની શાખાની ખાસ સભામાં એનાયત કીધો હતો. સોસાયટીના પ્રમુખ રેવરંડ ડા૦ સ્કોટે નામદાર ગવરનરને કેમપબેલ મેડલ ડા૦ જીવણજીને એનાયત કરવાની અરજ કરતાં જણાવ્યું કે એ મેડલ ઓરીએનટલ રીસરચ માટે સ્થાપેલો છે. સોસાયટીને ડા૦ મોદી જેવા બાહોશ સકોલર કદાચજ મલશે. એ પછી નામદાર ગવરનરે ડા૦ જીવણજીને મેડલ એનાયત કરી જણાવયું કે ડા૦ મોદી જેવા બાહોશ સ્કોલરને આ ચાંદ એનાયત કરતા સંતોષ ઉપજે છે અને એ માટે સોસાયટીને મુબારક બાદી આપું છું. તેવણે પોતાના પુસતકો મારી આગળ રજુ કરયાં હતાં તે પરથી જણાય છે કે ડા૦ મોદી બોહલું જ્ઞાન ધરાવે છે. એ પુસતકો બહાર પાડી તેવણે આ દેશનીજ નહી પણ દુનયાની સેવા બજાવી છે. એ પુસ્તકો કેટલાંક ઇરાનની તવારીખનાં હતાં તે ઘણા ઉપયોગી છે. સેવટે ડા૦ મોદી હું તમોને લાંબી જીંદગી ઇચછુંછું કે તમો આવા વધુ કીમતી પુસ્તકો બહાર પાડતા રહો. એ પછી ડા૦ જીવણજીએ પોતાને આપેલા માન માટે ઉપકાર માનતાં જણાવયું કે ૧૯૦૫માં આ સોસાયટીએ પોતાની સેનટીનરી પસાર કરી તેની ઇંધાણી તરીકે બહાર પાડેલાં મારાં એશીઆટીક પેપરોના પહેલા ભાગના દીબાચામાં મેં કહયું હતું કે આ સોસાયટીનો તેમાં ખાસ કરી તેની ઉતમ લાઇબરેરી કે જેમાં જુના પુસ્તકોનો ખજાનો પડેલો છે તેનો હું મોટો આભારી છું, ઉપલું પુસ્તક પરગટ કરવા પછી ૧૩ વરસ પસાર થઇ ગયાં છે કે જે દરમયાન મેં મારા એશીઆટીક પેપરોનું બીજું વોલયુમ બહાર પાડયું છે. ૧૮૮૯માં મેં પહેલું પેપર આ સોસાયટી સનમુખ વાંચ્યું હતું અને તે પછીના એ સોસાયટી સાથના ૩૦ વરસના લાંબા સંબંધ દરમયાન મેં કુલ્લે ૪૦ પેપરો વાંચયાં હતાં. મને સંતોષ ઉપજે છે કે કમીટીના વીદવાન મેમબરોએ મારા કમીના કામ તરફ પસંદગી દેખાડી છે. એક આસામીના કામને તેના ગોઠયાઓ પસંદ કરે તે માન હું બહુ મોટું સમજું છું. મારા પુસ્તકોનો એક સેટ તમો નામદારને એનાયત કરૂં છું જે નામદાર ગવરનરે ઉપકાર સહીત સવીકારીયો હતો. તે પછી મેલાવડો વીસરજન થયો હતો.

મેશરસ ગ્રાહમ કંપનીના નીકાશ ખાતાના વડા શેઠ ફરામજી દાદાભાઇ લાલકાકા ૪૮ વરસની નોકરી બજાવી રીટાયર થવાથી એવણના માનમાં તા૦ ૬ઠી આગસટે ગ્રાહમ કંપનીની હાફીશમાં મી૦ એન. એફ. પેટનના પ્રમુખપણા હેઠળ મેલાવડો કરી એ ખાતાના ગેરંટી બરોકરસો તરફથી રૂપાંની એક મોટી વઇતર તથા એક રૂપાનો ખડયો કલમદાનનો બોક્ષ ભેટ આપયા હતા. તેમજ એ કંપનીના વડા માલેક વીલાતવાલા મી૦ જેમ્સ ગ્રાહમે મોટી રકમનો ચેક ભેટ આપ્યો હતો.

સર નવરોજી પેસતનજી વકીલ સી. આઇ. ઈ. ને મલેલા નાઇટ હુડના ખેતાબ માટે એવણને મુબારકબાદી આપવા એમના માનમાં અમદાવાદની ગુજરાત લેડીઝ કલબે ગયા ફેબરવારી મહીનામાં પારટીનો મેલાવડો કરી માન પત્ર એનાયત કરવામાં આવયું હતું.

ડા૦ એદલજી રૂસતમજી દાદાચાનજીએ નવસારી ખાતે ઇનફલુએનઝાના ઉપદરવ દરમયાન ઉગાડેલા ધરમના દવાખાનાના ઓનરરી તબીબ તરીકે બીન સ્વારથે બજાવેલી સેવા માટે ભેટ આપવાનો એક મેલાવડો તા૦ ૧૨મી જાનેવારીએ મલેસરની અંજુમને જમશેદ બાગમાં શેઠ મેરવાનજી માણેકજી મુનસીના પરમુખપણા હેઠળ કરી ડા૦ એદલજીને એક ચાદીનું ફલાવર વાઝ, તથા કંપાઉનડરો મેસરસ પીરોશાહ હોરમજી મેહતા, નવરોજી બરજોરજી કડવા અને ફરામરોજ અરદેશર બાજીવાલાને તેમજ હાફીસને લગતા કામમાં મદદ આપવા માટે મેસરસ અરદેશર કેકોબાદજી બાટલીવાલા, જમશેદજી ફરામજી દીગરીયા અને પાલનજી ફરામજી દીગરયાને દરેકને એકેક ઘડીયાળ ભેટ આપયા હતા.

ખાનબહાદુર ડા૦ પાલણજી હો. દાદાચાનજી હંમેસના નવસારી જઇ રહેવાથી વલસાડખાતે એમને બજાવેલી કીમતી સેવાઓની પીછાનમાં ગયા ડીસેમબરમાં દાદાચાંનજી કલબે ખાનાનો મેલાવડો કરી શેઠ દાદાચાનજીને સીલવર રાઇટીંગ સટ તથા શેઠો અરદેશર અને જાલભાઈ ધનજી-શાએ ઘડીયાલો ભેટ આપયા હતા.

કલકતાના વેપારી શેઠ જમશેદજી ફરામજી માદનને ઓ. બી. ઇ. ના મલેલા ખેતાબ માટે મુબારકબાદી આપવાનો એક મેલાવડો કલકતાની જરથોસતી અંજુમને તા૦ ૩૦મી મારચે શેઠ

એદલજી પેસતનજી ગજદરના પરમુખપણા હેઠળ કરી શેઠ જમશેદજીને ચાંદીનાં કાસકેટમાં માનપત્ર તેમજ જામેનું અવસતાનું પુશતક, ચાંદીનું અફરગાનયુ અને જરથોસતની સબી ભેટ આપ્યા હતા. વળી તા૰ ૮મી ડીસેંબરે કલકતા એંગલો ગુજરાતી સકુલમાં બોમ્બે મરકનટાઇલ કોમયુનીટીની તરફથી એક મેલાવડો સર કફલીસ ચંદર બોઝના પરમુખપણા હેઠળ કરી ચાંદીના કાસકેટમ માનપત્ર શેઠ જમશેદજીને એનાયત કરયું હતું.

ડા૰ બરજોરજી સોરાબશાહ મુનસફને મલેલા ખાનબહાદુરના ખેતાબ માટે એવણુને મુબારક બાદી આપવાનો એક મેલાવડો તા૰ ૯મી મેને દીને બરૂચ ખાતેનાં ભરૂચા હોલમાં કલેકટર મી૰ બલેથ વેઇટના પરમુખપણા હેઠળ કરી કાસકેટના દાબરા સાથે માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

વલસાડના માજી સટેશન માસતર શેઠ ફકીરજી ફરામજી માસતર ગુજરાત રેલવેમાં એસીસટંટ ત્રાફીક સુપરીંટેનડંટના ઓધાફપર જવાથી ગયા બે મહીનામા ડા૰ દાદાચાદજીની કલબે ખાણાનો મેલાવડો કરી સુનાનો છેડો ભેટ આપયો હતો. તેમજ તા૰ ૯મી મેને દીને જશને હોરમઝદ કલબે ખાણાનો મેલાવડો કરી શેઠ ફકીરજીને મોટી તીજોરી ભેટ આપી હતી વલસાડથી બદલી થયલા રેલવે અમલદારો શેઠ ફરામરોઝ ડોસાભાઇ મોટાફરામને સોનાનો છેડો અને શેઠ અરદેશર દલાલને સોનાનું ઘડીયાળ ભેટ આપયું હતું.

બંગાલી કનયાશાળાના વડા શીક્ષક બાઇ શીરીનબાઇ બેરામજી મેહતા ચાલીસ વરસ સુધી ઉપયોગી સેવાઓ બજાવી રીટાયરડ થવાથી તા૰ ૩જી એપરીલે બંગાલીની કનયાશાળમાં થયલા મેલાવડા વખતે બાઇ શીરીનબાઇને ચાંદીના કાસકેટ સાથે માનપત્ર આપવામાં આવયું હતું.

કલીકટની અંજુમનના પરેસીડંટ શેઠ ધનજીભાઇ માણેકજી મુગાશેઠે વરસો સુધી અંજુમનની સેવા બજાવી ફારેગ થવાથી તા૰ ૧૭મી મેને દીને એક મેલાવડો કરી અંજુમને માનપત્ર શીયાલ તથા પરસ ભેટ આપી હતી. એ પરસની રકમમાં બીજી રકમ પોતા તરફથી ઉમેરી શેઠ ધનજીભાઇએ અંજુમનના ફંડમાં આપવા જણાવયું હતું.

પારસી કોમની છોકરીઓ જુદદીનો સાથ પરણી જવાથી તેઓને સદા માટે પારસી કોમથી અલગ રાખવા વગેરેના ઠરાવો જાહેર કરવા માટે પારસી સમસત અંજુમનની એક જાહેર સભા તા૰ ૨જી ફેબરવારીને દીને સાંજે સાડાચાર વાગે આલબલેસ બાગમાં પારસી પંચાયતના માનવંત ત્રસટી સાહેબોએ બોલાવી હતી, એ વખતે નામદાર સર જમશેદજી જીજીભાઇના પરમુખપણા હેઠળ પારસી છોકરીઓના પર કોમવાલાં સાથના લગનો તરફ સખત નાપસંદગી જાહેર કરવાનો તથા પારસી કોમ માટે સથાપાયલાં ધરમના ફંડો ખાતાઓનો લાભ નહીં આપવાનો, લગન કીધા પછી પારસી કોમમાં પાછી દાખલ ન કરવાનો વગેરેના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.

નામદાર વાઇસરાયએ તા૰ ૨ જી જાનેવારીને દીને સાકચી ખાતેના તાતા આયરન એંડ સટીલ વરકસના કારખાનાઓની મુલાકાત લીધી હતી. એ વખતે નામદાર વાઇસરાયે તાતા આયરન એંડ સટીલ કંપનીના પ્રખ્યાત સથાપક મરહુમ નામાકીત નર શેઠ જમશેદજી નશરવાનજી તાતાની યાદમાં સાકચી શહેરને "જમશેદ પુર"નું નામ આપવાનું જાહેર કરી જણાવ્યું હતું કે હીંદી ઉધ્યોગનો નમુનો તપાસવા અતરે આવ્યો છું અને લડાઇના ચાર વરસ દરમ્યાન એ કંપનીએ બજાવેલા મહાન કામની સ્તુતી કરી હતી. આ મહાન સાહાસ શેઠ જમશેદજીની મન બુધી, કલપના અને મનો વરતીને આભારી છે અને આ ખાતાં સાથ તેમનું નામ હંમેસગીને માટે યાદ રહી જશે. વળી બંગાલ નાગપુર રેલવેના કાલીમતી સટેશનનું નામ બદલી "તાતા નગર" રાખવામાં આવ્યું છે.

રાજદવારી, શેહેરી, આરથીક અને કેળવણીને લગતા સવાલોના સંબંધમાં પારસી સેનત્રલ એસોસીએશન ઉભી કરવામાં આવી છે, તેમજ જુદા જુદા પારસી ધરમખાતાંઓ તરફની સખાવતનો લાભ બરાબર સચવાય તે માટે પારસી ચેરીટી ઓરગેનાઇઝેશન સોસાયટી સથાપવામાં આવીછે.

શેઠ ડોશાભાઇ રૂસતમજી ઉમરીગરની સખી જાહાંસીની છોકરાંઓની સકુલમાં તા૰ ૨૧મી સપટેમબરે, શેઠ ફરદુનજી માણેકજી કાંગાની સખી નવસારીની સર કાવસજી જાહાંગીર મદરેસામાં તા૰ ૧લી જાનેવારીએ અને શેઠ રૂસતમજી પેસતનજી રબાદીનાની સખી કરાંચીની આર. પી. રબાડી સકુલમાં તા૰ ૩૦મી આગસટે ખુલ્લી મુકવામાં આવી હતી.

મરહુમ ઓનરેબલ શેઠ મેરવાનજી કાવશજી કેપટનની સબી રંગુનની દરેહમેહરમાં તા૰ ૮ મી દીસેમબરે, મરહુમ ડા૰ બરજોરજી હોરમજી દાંતરાની સબી એલફીનસ્ટન ક્રીકેટ કલબમાં તા૰ ૧૧ મી જાનેવારીએ, મરહુમ શેઠ દાદાભાઇ નવરોજીની ઓઇલ પેંટ સબી મુંબઇ યુનીવરસીટીના સર કાવશજી જાહાંગીર હોલમાં તા૰ ૨૬ મી જાનેવારીએ, મરહુમ શેઠ ધનજીશાહ બરજોરજી વકીલની સબી સુરતના પારસી સુવાવડ ખાનામાં તેમજ પારસી જનરલ હાસપીટલમાં તા૰ ૧૦ મી મારચે, મરહુમ ડા૰ ખરશેદજી નવરોજી સહીયારની સબી માહીમની સુનાવાલાની દરેહમેહરમાં તા૰ ૨૫ મી મેને દીને, મરહુમ શેઠ જમશેદજી એમ. ફરામજી પટેલની સબી પારસી જીમખાનામાં તા૰ ૧૫ મી જુને, દસ્તુર ખુરશેદજી ડોશાભાઇ ભપપુની સબી પુનાની દરેહમેહરમાં તા૰ ૨૩ મી જુને, શેઠ બેજનજી ખરશેદજી દેશાઇની સબી નવસારીની સર કાવશજી જાહાંગીર હાઇ સ્કુલમાં ગયા જુલાઇ માહીનામાં ખુલ્લી મુકવામાં આવી હતી.

વલસાડના રહીશ શેઠ દીનશાજી જીનાભાઇ આપુ અને પુણાના રહીશ શેઠ પી. એમ મેહતાએ સાથે મલી ટોરપીડો લાગયા છતા વાહાણો ડુબી નહી શકે તેવી શોધ કરી હતી, એ માટે ગ્રેટબ્રીટન, અમેરીકા, ઇટાલી વગેરે ઠેકાણેથી પેટંટ મેલવયા છે.

જાણીતા જરથોસ્તીઓના મરણો.

બાઇ શીરીનબાઈ તે આપણા શહેરના જાણીતા શેહેરી શેઠ પેસતનજી નસરવાનજી વાડીઆના ધણીઆણી ૬૬ વરસની વયે રોજ ૯ મો માહા ૧ લા ને દીને મરણ પામ્યા હતા. મરહુમ ઘણા રાંક ને મલતાવડા સ્વભાવના હતાં. એવણને વાચણનો સારો શોખ હોવાથી પારસીઓને લગતા સવાલોમાં સારી ઉલટ લઈ વારનવાર ન્યુસ પેપરોમા લખાણ કરતાં હતાં. બાઈ શીરીનબાઈ પોતાના ધણી શેઠ પેસ્તનજીને વેપારી કેળવણીને આગળ વધારવામા કીમતી મદદ આપતાં હતાં અને બેરામજી જીજીભાઈ સ્કુલના કામમાં ઘણી દીલસોજી ધરાવતાં હતાં તેમજ શીક્ષકો માટે પ્રોવીડંટ ફંડ ઉભુ કરવામાં ઉલટ લેવાથી ગયે વરસથી ત્રસ્ટીઓએ એક ફંડ સ્થાપી તેને શેઠ પેસ્તનજીનું અને મરહુમ બાઈનું નામ આપ્યું છે. બાઇ શીરીનબાઇના લગન શેઠ પેસતનજી સાથે તા. ૨૮ મી અકટોબર ૧૮૬૭ ને દીને થયા હતા અને એવણ મરહુમ શેઠ મનચેરજી ખરશેદજી મુસના દીકરી થતાં હતાં.

શેઠ જમશેદજી માણેકજી ફરામજી પટેલ જે. પી. ૬૨ વરસની વયે રોજ ૧ લો માહ ૨ જાને દીને મરણ પામયા હતા. એવણનો જનમ ૧૮૫૭ માં થયો હતો. એવણ પોતાના બપાવાની ફરામજી સનસ એંડ કંપનીમાં જોડાયા હતા અને એ પછી એક વેપારી તરીકે સારી નામના મેળવી હતી અને એજંસીઓનું કામ પોતે ચલાવતા હતા. શેઠ જમશેદજીએ પારસી જીમખાનાની સ્થાપના કરવામાં આગેવાની ભરયો ભાગ લીધો હતો તેમજ શારીરીક કેળવણીના ઘણા ખાતાંઓમાં ઉમગથી ભાગ લેતા હતા. ૧૮૮૬ ને ૧૮૮૮ માં પારસી ક્રીકેટ ટીમો ઇંગલાંડ રમવા ગઇ હતી તેને સારી મદદ કરી હતી અને દર વરસ રમાતી મેચોમાં તેમજ ક્રીકેટની રમતમાં ઉલટ ભરયો ભાગ લેતા હતા.

શેઠ ડોશાભાઈ હોરમજી વાડીયા ૩૭ વરસની વયે રોજ ૯ મો માહ ૨ જાને દીને નાગપોર ખાતે મરણ પામયા હતા. મરહુમનો જનમ તા. ૧૨ મી જુન ૧૮૮૧ ને દીને થયો હતો. એવણે ૧૯૦૨ માં બી. એ. ની અને બીજેજ વરસે એમ. એ. ની પરીક્ષા પસાર કરવા પછી એવણને એલફીંસ્ટન કોલેજના ફેલો નેમયા હતા. એક ડાયકાની ઉપર એવણ નાગપોરની એમપ્રેસ મીલની હફીસમાં જોડાઇ પોતાની મન શકતી અને ફીસાબી જ્ઞાનની બાહોશીને લીધે ટુંક વખતમાં મદદનીશ મેનેજરના ઓધા ઉપર આવ્યા હતા. વળી એવણે નાગપોરની જરથોસતી અંજુમનના ઓનરરી ઓડીટર તરીકે સારી મદદ આપી હતી.

શેઠ મનચેરશાહ નશરવાનજી રૂશતમફરામના ૭૧ વરસની વયે રોજ ૨૩ મો માહ ૪ થાને દીને મરણ પામયા હતા. એવણનો જનમ તા. ૭ મી સપટેમબર ૧૮૪૭ ને દીને થયો હતો. ૧૮૬૮–૬૯ માં એબીસીનીઆની અને ૧૮૭૮ માં અફઘાન લડાઇ ઉપર ગયા હતા. મીલીટરી તથા સીવીલ ખાતાના મોટા અમલદારોએ એવણની ઇમાનદારી ભરેલી નોકરી માટે સારી સરટીફીકેટો આપી છે. અજમેરમાં એવણે ધરમશાળા તથા એક હોલ ૧૯૦૧ માં બંધાવી આપવાથી અંજુમને એક માનપત્ર ચાંદીના કાસકીટ સાથે આપ્યું હતું.

શેઠ ડોશાભાઇ ફરામજી વાહાડીયા સોલીસીટર ૫૨ વરસની વયે રોજ ૨૬ મો માહ ૪થા ને દીને મરણ પામયા હતા. એવણે સોલીસીટરની પરીક્ષા પસાર કરવા પછી મેસરસ મેકફારલેન અને એડજલોની પેહેડીમાં જોડાઈ મરણ વખતે એ પેહેડીના વડા ભાગયા થયા હતા. એવણ એક ચુસ્ત ફરીમેસન હતા અને રાઇઝીંગ સ્ટાર ઓફ વેસટરન ઈંડયાનો ઇતીહાસ લખવા માટે લોડજે એવણને તવારીખનવેશનું જુવેલ ભેટ આપ્યું હતું. અવસ્તા ભાષાના સ્કોલર હતા અને યુનીવરસીટી તરફથી એ ભાષાના કેટલીકવાર પરીક્ષક નેમાયા હતા.

શેઠ નસરવાનજી મનચેરજી હોરમસજી કામા સોલીસીટર ૫૦ વરસની વયે રોજ ૨૨ મો માહ ૬ ઠા ને દીને મરણ પામયા હતા. શેઠ નશરવાનજી મરહુમશેઠ બેરામજી હો. કામાના દીકરા થતા હતા અને એવણના કાકા શેઠ મનચેરજી હો. કામાએ શેઠ નશરવાનજીો દતક કરી લીધા હતા. એવણે ૧૮૮૫ માં મેત્રીકયુલેશનની અને ૧૮૯૧ માં બી. એ. ની અને ૧૮૯૭ માં સોલીસીટરની પરીક્ષા પસાર કરી સોલીસીટરના ધંધા સાથે વેપારબી કરવા માડયો હતો. મરહુમ નમાના તથા સાહલેસ સ્વભાવના હતા અને ઘણા ધરમખાતાઓના ત્રસતી હતા.

શેઠ રૂશતમજી પેસતનજી કરકરીયા ૫૦ વરસની વયે રોજ ૨૬ મો માહા ૮ માને દીને મરણ પામયા હતા. એવણે પારસી સકોલર અને જરનાલીસટ તરીકે સારી નામના મેલવી હતી અને એવણના મરણથી ઈંગ્રેજી અને ગુજરાતી સહીતયે એક ઉધ્યોગી સકોલર ગુમાવ્યો છે. એવણનો જનમ તા૦ ૧૬ મી મે ૧૮૬૯ ને દીને થયો હતો. એવણે ૧૮૮૮ માં બી. એ. થયા પછી ૧૮૯૧ માં સેંટઝેવીયર કોલેજના ફેલો અને પ્રોફેસરની પદવી મેળવી હતી. એવણને યુનીવરસીટીના તવારીખ તથા ફીલસુફીના પરીક્ષક અને ૧૮૮૮ માં મુંબઇની રોયલ એશીયાટીક સોસાયટીના મેમબર અને ૧૮૯૮માં એવણને રોયલ હીસટોરીકલ સોસાયટીના ફેલો નેમયા હતા. એવણે હીંદુસતાનમાંજ નહી પણ વેલાત અને અમેરીકાના વરતમાન પત્રો અને ચોપાનયાઓમાં લખાણો કીધા હતા અને ઘણા પુસતકો પ્રગટ કીધાં હતા તેમજ રેસાલાઓ વાંચયા હતા.

કયસરે હીંદના માજી માલેક અને અધીપતી શેઠ ફરામજી કાવસજી મહેતા ૬૮ વરસની વયે રોજ ૨ જો માહા ૯ માને દીને મરણ પામયા હતા. એવણે ૧૮૮૨ થી દર રવીવારે કયસરે હીંદ નામનું પત્ર પ્રગટ કરવા માંડયું હતું અને તે થોડા વખતમાં સારી લોકપ્રીયતા મેળવી શકયું હતું. પાછળથી એવણની તબીયત લથડતી જવાથી એ પત્ર શેઠ હીરજી બેહેદીનને વેચી રીટાયર થયા હતા. ૧૮૯૨ થી માથેરાન જોટીંગસ પત્ર તથા ૧૮૮૯ થી સ્ત્રીમીત્ર નામનું ચોપાનયું પ્રગટ કીધું હતું. ૧૮૮૭ માં માહારાની વીકટોરીયા જુબીલી કમીટીના મેમબર તથા ૧૮૮૮ થી મેસરસ સાઉનડી કંપનીના ડીરેકટર તેમજ બીજી કેટલીક કમીટીમાં મેંબર તરીકે મરહુમની નેમણુક થઇ હતી એવણ ફીરીમેસન હતા અને જુદા જુદા ફંડોમાં નાણાની મદદ કરી હતી તથા એવણની આગેવાની હેઠળ ધરમાદા ફંડો ઉગાડવામાં આવ્યાં હતાં.

શેઠ ફરદુનજી કાવસજી મુલા ૭૨ વરસની વયે રોજ ૬ ઠો માહ ૯ માને દીને મરણ પામયા હતા. મરહુમનો જનમ રોજ ૨૮ મો માહા ૧૦ મો ૧૨૩૫ ને દીને થયો હતો. એવણ ૧૮૬૬ માં મેત્રીકની અને ૧૮૬૮ માં એફ. ઈ. એ. ની પરીક્ષા પસાર કરવા પછી સર જમશેદજી જીજીભાઇની સ્કુલમાં એક શીક્ષક દાખલ જોડાઇ છેલે હેડ માસતરના ઓધા સુધી વધી ૪૫ વરસની લાંબી વફાદારી ભરેલી નોકરી બજાવી છ વરસ થયા રીટાયરડ થયા હતા. મરહુમ રીટાયરડ થયા ત્યારે એવણની યાદગારી જાળવવા એક ફંડ ઉગાડી તેના વ્યાજમાંથી દર માસે રૂપયા ૧૦ ની મારસીક સકોલરશીપ એજ સ્કુલના વીદયારથીને આપવાનું નકી થયું છે. એવણ ઘણા ધરમી ભણનાર ગણનાર અને સાદી નીયમીત જીંદગી ગુજારતા હતા.

શેઠ હોરમસજી નશરવાનજી વકીલ સોલીસીટર રોજ ૧૬ મો માહા ૯ માને દીને સીકંદરાબાદ ખાતે મરણ પામ્યા હતા. મરહુમે ૧૮૮૦માં સોલીસીટરની પરીક્ષા પસાર કરવા પછી મરહુમ નીઝામના અમલ દરમયાન મોટા ઓધા ભોગવી સેવટે પરદેશ ખાતાના વજીરના ઓધા ઉપર આવયા હતા. તે બાદ મરહુમ નામદાર હજુર સાથ મતફેર પડતાં શેઠ હોરમસજી હૈદરાબાદ છોડીને મુંબઇ આવી સોલીસીટરનો ધંધો ચલાવ્યો હતો, હાલના નામદાર નીઝામે શેઠ હોરમસજીને પાછા બોલાવી રૂ૬૦૦૦ ના પગારે પોલીટીકલ ડીપારટમેંટમાં આસીસટંટ મીનીસટરનો મોટો નયાધીકારી ઓધો તા. ૭ મી એપ્રીલ ૧૯૧૮ ને દીને બક્ષયો હતો અને નામદાર નીજામે નવાબના ઉચા ખેતાબની નવાજેસ સપટેમબર ૧૯૧૮ માં કરવાથી એવણ "નવાબ હોરમજદ જંગ બહાદુર" તરીકે ઓલખતા હતા.

શેઠ કાવસજી રૂશતમજી વરીયાવા ઇંગલાંડના બોરનમથમાં રોજ ૩ જો માહ ૧૧ માને દીને મરણ પામવાથી એવણુને લંડનની જરથોસતી આરામગાહમાં અવલમંજલ પોચાડવામાં આવ્યા હતા, જે વખતે ઘણા જરથોસતીઓ ઉપરાંત યુરોપયને હાજર હતા. એવણુનો જનમ મુંબઈમાં રોજ ૨૨ મો માહા ૧૧ મો ૧૨૧૮ ને દીને થયો હતો. મરહુમે કરાંચી ખાતે દુબાશનો ધંધો કરવાનો શરૂ કરી સારી નામના મેળવી હતી. ૧૯૦૮ માં ધંધામાંથી ફારેગ થઇ લંડન ખાતે રહેતા હતા. જયાં મરહુમના માનમાં ફીરીમેશન બીરાદરોએ "વરીઆવા કોનકલેવ" સ્થાપયું છે.

શેઠ જહાંગીર એદલજી દાવર ૬૯ વરસની વયે રોજ ૨૧ મો માહા ૧૧ માને દીને મરણ પામયા હતા. મરહુમને ફ્રેંચ ભાષા ઉપર અચ્છો કાબુ હોવાથી સેંટઝેવીયર કાલેજના ફ્રેંચના પ્રોફેસર નેમયા હતા તેમજ યુનીવરસીટીની પરીક્ષાઓમા ફ્રેંચ પત્રકના પરીક્ષક તરીકે વારંવાર કામ બજાવ્યું હતું. સરકલ લીટરેર નામની મંડલીના સેકરેટરી તેમજ બીજી મંડલીઓની કમીટીમાં જોડાઇ પોતાની કીમતી સહલા આપતા હતા. ૧૮૯૪ માં જે. પી., ૧૮૯૬ માં યુનીવરસીટીના ફેલો અને ૧૯૦૬માં ઓનરરી માજીસ્ટરેટ તરીકે એવણુની નેમનુંક થઇ હતી. ૧૮૮૯ માં એવણુને ફરાનસની એકેડેમી તરફથી "લી ફરાંસ ડી આફીસર એકેડેમી" નો એલકાબ, ૧૯૦૬ માં ફરાનસના જાહેર કેળવણી ખાતાના પ્રધાને Officer de l' Instruction Publique નેમી માન આપયું હતું.

શેઠ લીમજી નવરોજી બનાજી ૭૦ વરસની વએ રોજ ૪ ર્થો માહા ૧૨ માને દીને મરણ પામયા હતા. મરહુમનો જનમ શેહનશાહી ૧૨૧૮ ના પાંચમા ગાથાને દીવસે થયો હતો. ૧૮૬૯ માં બેરીસટરની પરીક્ષા પસાર કરવા પછી ૧૮૭૩ માં હાઇકોરટના પ્રોથોનોટરીના વડા મદદનીશ, ૧૮૮૪ માં કામ ચલાઉ પ્રોથોનટરી, ૧૮૯૦ માં સમોલકોઝ કોરટના જડજ, અને ૧૮૯૮ માં પ્રોથોનોટરી તથા વસીયતનામાંના રેજીસટારના ઓહ્દા ઉપર મરહુમની કાયમની નેમણુક થઇ હતી, એ ઓધા ઉપરથી ૧૯૧૦ માં રીટાયરડ થયા હતા. મરહુમને ઘણા કેશમાં રીસીવર તથા લીકવીડેટર તરીકે અને ૧૮૮૬ માં સુલેહના અમલદાર નેમયા હતા.

શેઠ ફરામજી હોરમજી બમનજી શેઠના ૮૪ વરસની વયે રોજ ૨૪ મો માહા ૧૨ માને દીને મરણ પામયા હતા. શેઠ ફરામજીનું કુટંબ અસલ નવસારીવાળા ચાંદા ફરેદુનની પોલથી ઉતરી આવેલું છે અને એ કુટંબના પેહલા સ્થાપક શેઠ રૂશતમ માણેક કરીને હતા. એવણુનું શેઠ ખાનદાનનું કુટંબ ઘણું જાણીતું ને વીખીયાતી પામેલું છે. એવણુના પીતાજી તેમજ બપાવા મોટા વેપારી હતા અને સારી નામના મેલવી ગયા છે. એવી રીતે મરહુમ શેઠ ફરામજીએ ચીન વગેરે ઠેકાણે મોટા પાયા ઉપર વેપાર કરી સારી કીરતી તેમજ આબરૂ મેલવી હતી. એવણુનો જનમ રોજ ૨૮ મો માહા ૪ થો સને ૧૨૦૪ ને વાર સોમને દીને થયો હતો. અને તે વખતને અનુસરતી સારી કેળવણી લીધી હતી. એવણે મહાન પુરૂષોની જીંદગીના હેવાલ નામના પુસતકનો ગુજરાતીમાં તરજુમો કરી તેની ચોપડી ૧૮૫૭ માં છપાવીને મુફત વેહેચી હતી. શેઠ ફરામજી અતરેના વાહાજીના આતશબેહરામના બાજ રોજગાર તથા બહારકોટની શેઠનાની દરેહમેહરના ત્રસટી તેમજ ઘણી મંડલીના મેમબર હતા. શેઠ ફરામજી બોહોલી ઇસટેટોના માલેક હતા અને તેનો વહીવટ કરવામાં એવણુના મરહુમ બેટા શેઠ માણેકજીએ એવણુને ઘણી સારી મદદ આપી હતી. મરહુમે પોતાની હૈયાતીમાં લગભગ ત્રણ લાખ રૂપયાની સખાવત કીધી હતી અને બીજી વધુ એક લાખ રૂપયાની સખાવત એવણુના ઉઠમણા વખતે જાહેર કરવામાં આવી હતી. એવણે પારસી પંચાયતને જરથોસતી છોકરીઓને પરણાવવા માટે આસરો આપવા રૂ૧૫૦૦૦ અને પોતાના નબીરા ભાઈ કેખશરૂની નવજોતની ખુશાલીમાં ધરમખાતે રૂ૧૫૦૦૦ આપયા હતા, શેઠ ફરામજીએ પોતાની ભતરીજી બાઇ બચુબાઈ ડો. શેઠના સાથે મલી રૂપયા ૭ હજારની કીમતનુ રૂપાનું અફરગાનયુ બહારકોટની શેઠનાની દરેહમેહરના આતશના કેબલા માટે ભેટ આપયું હતું, એવણુના પીતાજી શેઠ હોરમજીની યાદમાં રૂપયા પચાસ હજારને ખરચે ગરીબ જરથોસતીઓના રહેઠાણ ફંડમાં એક મકાન બંધાવી આપયુ હતું અને એવણુના મરહુમ બેટા શેઠ માણેકજીના ઉઠમણામાં એવણે રૂપયા તીસ હજાર આપયા ઉપરાંત મરહુમની પુંજીમાંથી તથા કુટુંબીઓએ રૂપયા ચઉડ હજારની રકમ જુદી આપી હતી. એ ઉપરાંત બીજા ઘણા ફંડો તથા ધરમખાતાઓમાં નાણાની સારી મદદ કરી હતી. શેઠ ફરામજીને બ બેટાઓ ને ચાર બેટીઓ હતી, તેમાં એવણુના એક બેટા શેઠ માણેકજી બેહેસતનશીન થયા છે તેવણુના બેટા શેઠ કેખશરૂ સારી આશા આપનારા અને કેલવાયલા જવાન છે.

મુંબઇની એરીસ્ટોક્રેટીક સોસાયટીનું પનોતું મંદીર.

રેશમી કાપડની આ સહુથી મોટી આગેવાન પરખ્યાત દુકાનમાં જ્યારે પણ દાખલ થશો
તયારે હમેશાં દરેક માલનો ગંજાવર સ્ટોક તમો જોશો

એમપાયર બીલડીંગ

આહમદ ઈ. હસાઅલી

હોરનબી રોડ, કોટ, મુંબઇ.

પઇસા થોડા કમાવા, પણ ઘરાકોને રાજી રાખી ઘરે મોકલવા એ અમારો
નીયમ છે. અમારી દુકાંને જુનો માલ બીલકુલ રાખતાજ નથી.
જયારે પણ જોશો તો બસ બધો તાજેજ સ્ટોક—

છેલ્લામાં છેલ્લી વેરાયટીઝ, લેટેસ્ટ ફેશનની સડીઆનો સ્ટોક હમેશાં
દર મેલે આવતોજ જાય છે—

લગનસરા માટે તમોને તમારી ગુંજાસ માફકનો માલ અમારે ત્યાથી મળશે.

કસબી સાડીઓ, કોરો, ઝબલાં વીગેરે અમારા હુશીયાર કારીગરો પાસે
વાયદાસર ભરાવી આપશું. અમારે ત્યાંનું ફાકડું ભરતકાંમ
ભલા ધનેતરને છક કરી નાખે છે—ભલે પધારો.

માહા ૧ લો ફરવરદીન શેહેનશાહી સને ૧૨૮૯ યજદેજરદી.

પારસીઓના તીસે રોજ–તેના નામ સાથે.	વાર.	અંગ્રેજી તારીખ	હીંદુ તીથ	કદમી જરથોસ્તીઓનો રોજ ૧ થી ૩૦ સુધી, માહ ૨ જો અરદીબેશત સને ૧૨૮૯ યજદેજરદી. ઇ૦ તા૦ ૧૧ મી સપટેમબરથી તા૦ ૧૦ મી અકટોબર ૧૯૧૯ સુધી. હીંદુઓના સંવત ૧૯૭૫ ના ભાદરવા વદ ૧ ને વાર ગુરૂથી તે આશો વદ ૧ ને વાર શુકર સુધી.
૧–અહુરમજદ.	ગુરૂ..	૧૧	૧	શેહેનશાહી "નોરોજ" (પતેતી) જરથોસ્તીઓનું યજદેજરદી
૨–બેહમન....	સુકર	૧૨	૩	[સને ૧૨૮૯ નું નવું વરસ. માહા ૨ જો કદમી
૩–અરદીબેશત.	શની.	૧૩	૪	હમકારો, શે૦ રપીથવન ઇજવાનો દીવસ–કદમી અરદીબેસ્ત
૪–શેહરેવર....	રવી..	૧૪	૫	[અમસાસફંદનું જશન.
૫–સફંદારમદ..	સોમ.	૧૫	૬	શેઠ નવરોજી ફરદુનજી શી. આઈ. ઈ. ગુજર્યા ૧૨૫૫.
૬–ખુરદાદ....	ભોમ	૧૬	७	શેનશાહીઓનો ખોરદાદસાલ (ખાશ લોકોનો નોરોજ,) પેગંબર
७–અમરદાદ...	બુધ..	૧७	૮	શેહનશાહી અમરદાદસાલ (વરાવો) [જરથોસ્તનો જન્મ દીવસ.
૮–દેપાદર....	ગુરૂ..	૧૮	૯	
૯–આદર.....	સુકર	૧૯	૧૦	હમકારો.
૧૦–આવાં......	શની	૨૦	૧૧	
૧૧–ખુરશીદ ...	રવી.	૨૧	૧૨	કદમીઓનાં 'મેદીઓજરેમ' ધંમબાર. [ય૦ ૧૨૬૮.
૧૨–મોહર......	સોમ	૨૨	૧૩	દસ્તુર ડાકટર જામાસ્પજી મીનોચેરજી જામાસ્પ આશાના ગુજરયા
૧૩–તીર	ભોમ	૨૩	૧૪	૧૮७૫ માં અમદાવાદમાં મોટી રેલ આવી. ઈસ્ટ ઈંડીયા કંપની
૧૪–ગોસ... ...	બુધ.	૨૪	૩૦	[સ્થાપી, ૧૬૦૦.
૧૫–દેપમેહર....	ગુરૂ..	૨૫	૧	ચાંદરાત. **આશો માસ.** નોરતાં બેઠાં.
૧૬–મેહર......	શુકર.	૨૬	૨	મોહરમ માસ નવું વરસ ૧૩૩૮ હીજરી.
૧७–શરોશ.. ...	શની.	૨७	૩	હમકારો.
૧૮–રશને......	રવી.	૨૮	૪	
૧૯–ફરવરદીન...	સોમ	૨૯	૫	શેહેનશાહી ફરવરદીઆંનનું જશન. પુણામાં શેઠ હો૦ શે૦ તાડીવાલાની ધરમશાલાને વરશ ૫૧ મું. મુંબઇમાંનાં મોદી હીરજી વાંછાગાંધીનાં દુખમાંને ૨૫૧ મું, માં૦ ન૦ શેઠનાવાલાં દખમાને ૧૬૫ મું, ગંદેવીમાંનાં અન૦ દખમાંને ૧૯૬ મું. નવશારીની મલેશેરની અનજુમનની દરેમેહરને ૧૧૩ મું. મુંબઇની શેઠ જ૦ દા૦ શોડાવાટરવાલાની અસલ દાદગાંની દરેમેહરમાં આદરીઆંન પરઠેઆં ય૦ સને ૧૨૫૫.
૨૦–બેહરાંમ....	ભોમ	૩૦	૬	હમકારો. એડનવાલી શેઠ કા૦ દી૦ની દરેમેહરને વરસ ૩७. [સુરતવાલા ખાનશાહેબ બેજનજી પાલનજી કોટવાલ ગુજર્યા યજ- [દેજરદી ૧૨૨૦.
૨૧–રાંમ	બુધ.	૧	७	**અકટોબર માસ.** લંડનની યુનીવરસીટી ઉઘડી ૧૮૨૮.
૨૨–ગુવાદ......	ગુરૂ..	૨	૮	
૨૩–દેપદીન.....	સુકર.	૩	૯	
૨૪–દીન.... ...	શની.	૪	૧૦	દસેરા.
૨૫–અરશેરવંગ.	રવી.	૫	૧૧	તાબુત થંડા કરવાનો દીવસ.
૨૬–આસતાદ...	સોમ.	૬	૧૨	
૨७–આસમાન ..	ભોમ.	७	૧૩	ફસલી આજુર માસ. ફસલી નવું વર્ષ શને ૧૩૨૯ નું.
૨૮–જમીઆદ..	બુધ.	૮	૧૪	માણેકથારી પુનમ.
૨૯–મારેસફંદ...	ગુરૂ..	૯	૧૫	
૩૦–અનેરાં.. ...	સુકર.	૧૦	૧	

માહા ૨ જો અરદીબેહેસ્ત શેહેનશાહી સને ૧૨૮૯ યજદેજરદી.

પારશીઓના તીસે રોજ—તેના નામ સાથે.	વાર	ઈંગ્રેજી તારીખ	હીંદુ તીથી	કદમી જરથોશતીઓનો રોજ ૧ થી ૩૦ સુધી, માહા ૩ જો ખુરદાદ શને ૧૨૮૯ યજદેજરદી. ઇં૦ તા૦ ૧૧ મી અક્ટોબરથી તા૦ ૯ મી નવેમબર ૧૯૧૯ સુધી. હીંદુઓના સંવત ૧૯૭૫ ના આશો વદ ૨ ને વાર સનીથી તે સંવત ૧૯૭૬ ના કારતક વદ ૨ ને વાર રવી સુધી.
૧—અહુરમજદ	શની.	૧૧	૨	માહા ૩ જો ખુરદાદ કદમી.
૨—બેહમન....	રવી.	૧૨	૩	
૩—અરદીબેશત	શોમ.	૧૩	૪	હમકારો. પુણાની ક૦ શેહેનશાહી દરેમેહરને વરસ ૨૭. શેહેનશાહી અરદીબેસતનું જશન. મુંબઇનાં જરથોશતી અંજુમનનાં આતશબેહેરાંમને ૨૩ મું. ધીજમશેદજી ન૦ પીટીટ આરફ્નેજ ઉઘડી ય. ૧૨૫૮. દીલીના શેહેનશાહ અકબરનું મરણ, ૧૬૦૫
૪—શેહરેવર...	બોમ.	૧૪	૫	
૫—સફંદારમંદ	બુધ.	૧૫	૭	દીલ્હીના પા૦ અકબરનો જ૦ ૧૫૪૨.
૬—ખુરદાદ.....	ગુરૂ.	૧૬	૮	ક૦ પારસીઓનું ખોરદાદ આમસાસફંદનું જશન.
૭—અમરદાદ...	શુકર.	૧૭	૯	
૮—દેપાદર.....	શની.	૧૮	૧૦	
૯—આદર......	રવી.	૧૯	૧૧	હમકારો. વેપારીઓને ચોપડા લાવવાનું મુરત. [ય૦ ૧૨૫૪.
૧૦—આવાં......	શોમ.	૨૦	૧૨	વાઘબારસ. પુણેવાલા દસ્તુર ખા૦ બા૦ સરદાર નો૦ જા૦ ગુજર્યા
૧૧—ખુરશીદ...	બોમ.	૨૧	૧૩	ધનતેરસ. શેન૦ 'મેદીઓજરેમ' ધંબાર. શેઠ ફ૦ ન૦ પટેલના
૧૨—મોહોર.....	બુધ.	૨૨	૧૪	કાલીચઉદશ. [મજગાંમનાં આદ્રાનને ૭૫.
૧૩—તીર	ગુરૂ.	૨૩	૩૦	ડા૦ કેખશરૂ ન૦ બાહાદુરજીનો જન્મ, ય૦ ૧૨૩૦. વહી પુજાનો
૧૪—ગોસ.......	શુકર.	૨૪	૧	**કાર્તક માસ.** હીંદુઓનું નવું વરસ ૧૯૭૬ [દીવસ તથા દીવાલી.
૧૫—દેપમેહર....	શની.	૨૫	૨	**ચાંદરાત.**
૧૬—મેહેર......	રવી.	૨૬	૩	
૧૭—સરોશ......	શોમ.	૨૭	૩	હમકારો. શેહેનશાહી જરથોસ્તીઓના ૩ આતશબેહેરાંમો તથા આદરાંનોની સાલગરેહ, તેમાં નવસારીના આતશબેહરાંમને ૧૫૫મું. શુરતના શેહેનશાહી આ૦ ને ૯૭ મું. મું૦ ના વાડીઆ-જીના આ૦ ને ૮૬ મું. મુંબઇમાંના મ૦ બ૦ શેઠના આદરાંનને ૯૮ મું. શા૦શો૦કપાવાલાના આદરાંનને ૬૨ મું. સર જ૦જી૦ ના શુરતનાં રૂશતમપુરાનાં આદરાંનને ૬૬ મું. ઝાહાંગીર પાદશાંહનું મરણ પ્ર૦સ૦ ૧૬૨૭.
૧૮—રશને......	બોમ.	૨૮	૪	
૧૯—ફરવરદીન...	બુધ.	૨૯	૫	હો૦ બ૦ વા૦ના ચરનીવાડીમાંનાં આદ્રાંનને ૧૧૫. બાઈ હી૦ ન૦
૨૦—બેહરામ....	ગુરૂ.	૩૦	૬	હમકારો. [મા૦ મુલાંવાલી દરેહમરને ૨૫.
૨૧—રાંમ.......	શુકર.	૩૧	૭	
				[માહારાંણીની સરકારે હીંદુસ્થાન પોતાને સ્વાધીન લીધું ૧૮૫૮
૨૨—ગુવાદ......	શની.	૧	૮	**નવેમબર માસ.** ઇસ્ટ ઈંડીયા કુંપની શોડેથી નામદાર
૨૩—દેપદીન.....	રવી.	૨	૯	
૨૪—દીન.........	શોમ.	૩	૧૦	આકોલા મધે ખા. બા. દસ્તુરજી નો૦ ની દરેમેહરને ૫૦ મું.
૨૫—અરશેસવંગ.	બોમ.	૪	૧૧	આ૦ સર દી. મા. પીટીટ કલકતાની કાંઉનશીલના મેમબર નેમાયા [૧૮૮૮.
૨૬—આસતાદ...	બુધ.	૫	૧૨	દેવદીવાલી. સર ફીરોઝશાહ મે૦ મેહતા ગુ. ય. ૧૨૮૫. શેઠ ખ૦ [માં૦ સરાફના કોટમાનાં આદ્રાંનને ૨૦૪.
૨૭—આશમાન...	ગુરૂ.	૬	૧૩	વેલાતમાં પેહેલ વેહેલું ન્યુસ લંડન ગેઝેટ નીકલ્યું ૧૮૬૫.
૨૮—જમીઆદ...	શુકર.	૭	૧૪	ચંદ્ર ગ્રેહણ. મરીનલાઇનની શેઠ જ૦ દા૦ આમરીયાની દરેમેહેરમાં [પેહલા દાદગાં સ્થાપવાને ૪૬ મુ. [માટે મુંબઇ આવ્યા ૧૮૭૫.
૨૯—મારેસફંદ...	શની.	૮	૧	પ્રી. આફ વે. તે મરહુમ શેનશાહ એડવરડ હીંદુસ્થાનની મુસાફરી
૩૦—અનેરાં......	રવી.	૯	૨	શેનશાહ એડવરડ ૭ માનો જન્મ, ૧૮૪૧.

માહ ૩ જો ખુરદાદ શેહેનશાહી શને ૧૨૮૯ યજદેજરદી.

પારસીઓના તીશે રોજ—તેના નાંમ સાથે.	વાર.	ઇંગ્રેજી તારીખ	હીંદુ તારીખ	કદમી જરથોશતીઓનો રોજ ૧ થી ૩૦ સુધી માહ ૪ થો તેશતર તીર શને ૧૨૮૯ યજદેજરદી. ઈ૦ તા ૧૦ મી નવેમબરથી તે તા૦ ૯ મી ડીશેમબર ૧૯૧૯ સુધી. હીંદુઓના સંવત ૧૯૭૬ ના કારતક વદ ૩ ને વાર સોમ થી તે માગસર વદ ૨ ને વાર મંગલ સુધી.
૧—અહુરમજદ.	શોમ.	૧૦	૩	માહ ૪ થો કદમી. શુરતના કાંકરાખાડી આગલના દુખમાંને ૧૫૬ મુ.
૨—બેહમન....	ભોમ.	૧૧	૪	
૩—અરદીબેશત	બુધ.	૧૨	૫	હમકારો. શુરતમાંના પે. કાલાભાઈ વકીલ ક૦ આતશબેરાંમને [૯૭મું, પુનાના સર જ૦ જીજીભાઈના આદરાંનને ૭૬મું.
૪—શેહરેવર...	ગુરૂ..	૧૩	૬	રાસત ગોફતાર પત્ર ૧૮૫૧ માં નીકલ્યું.
૫—શફંદારમદ.	સુકર.	૧૪	૭	
૬—ખુરદાદ....	શની.	૧૫	૮	શે. ખુરદાદ અમશાસપંદનું જશન. શેઠ નશરવાનજી માંણેકજી [પીટીટ ગુજરયા ય૦ ૧૨૬૧
૭—અમરદાદ..	રવી.	૧૬	૯	શેઠ બે૦ ન૦ સીરવાઇએ નવસારીના આતશબેરાંમમાં રૂ. દશ- [હજારનું રૂપાનું અફરગાન્યું ભેટ આપ્યું ઇ. સ. ૧૮૬૮.
૮—દેપાદર.....	સોમ.	૧૭	૧૦	શેઠ ખરશેદજી કાવશજી બનાજી ગુજર્યા, ય૦ સને ૧૨૧૬.
૯—આદર.....	ભોમ.	૧૮	૧૧	હમકારો.
૧૦—આવાં......	બુધ.	૧૯	૧૨	
૧૧—ખુરશીદ....	ગુરૂ.	૨૦	૧૩	કદમી તીર મહીનાંના 'મેદીઓશહમ' ધંબાર.
૧૨—મોહર......	શુકર.	૨૧	૧૪	
૧૩—તીર.......	શની.	૨૨	૩૦	કદમી તીરીઆંનનું જશન. નાવસે ઝોલાબેના મેહેરવાન બાગને
૧૪—ગોશ......	રવી.	૨૩	૧	**માગસર માસ.** (પાંદે શેનીટેરીયમને) ૫૪ મું.
૧૫—દેપમેહર...	શોમ.	૨૪	૨	ચાંદરાત.
૧૬—મેહર......	ભોમ.	૨૫	૩	
૧૭—શરોસ.....	બુધ.	૨૬	૪	હમકારો—શા. બે. બનાજીના મુંબઇમાંનાં ક૦ આતશબેરાંમને વ. [૭૫. મુંબઇથી વલસાડ શુધી વડોદરા રેલવે ચાલુ થઇ ૧૮૬૪.
૧૮—રશનેશ....	ગુરૂ.	૨૭	૫	
૧૯—ફરવરદીન..	સુકર.	૨૮	૬	ભરૂચના અંનજુમનનાં દોખમાને વરશ ૮૭.
૨૦—બેહરાંમ....	શની.	૨૯	૭	હમકારો.
૨૧—રાંમ......	રવી.	૩૦	૮	[કલકત્તાનું ઇનિટરનેશનલ એકઝીબીશન ઉઘડયું ૧૮૮૩.
૨૨—ગુવાદ......	શોમ.	૧	૯	**ડીશેમ્બર માસ.** શેનશાહબાનું એલેક્જાનડરાનો જનમ,૧૮૪૪.
૨૩—દેપદીન.....	ભોમ.	૨	૧૦	નામદાર શહેનશાહ જ્યોર્જ પાંચમાની મુંબઇમાં પધરામની. ૧૯૧૧.
૨૪—દીન.......	બુધ.	૩	૧૧	હીંદુસ્થાનમાં સતીની ચાલ બ્રીટીશોએ નાબુદ કીધી. ૧૮૨૯. બેલ- [ગામની શેઠ પેશતનજી ખરશેદજી બાઇસની દરેહમેહરને ૨૮.
૨૫—અરશેસંવગ	ગુરૂ.	૪	૧૨	
૨૬—આસતાદ..	સુકર.	૫	૧૩	
				(પેહેલવેહલા (દેશી) શેરીફ થયા ૧૮૫૬.
૨૭—આસમાંન..	શની.	૬	૧૪	(ઇ૦ સ૦ ૧૯૧૧. શેઠ માંણેકજી ખરશેદજી મુંબઇમાં
૨૮—જમીઆદ..	રવી.	૭	૧૫	નામદાર શહેનશાહ જોર્જ ૫) માં ની દીલ્હીમાં પધરામણી
૨૯—મારેસફંદ...	સોમ.	૮	૧	[મોટો ધબરાત થયો.
૩૦—અનેરાં.....	ભોમ.	૯	૨	૧૮૫૬ માં બુશાએરપર વેરો નાંખેઓ. ૧૮૨૫ માં વેપારને

માહા ૪ થો તીર શેહેનશાહી શને ૧૨૮૯ યજદેજરદી.

પારશીઓના તીશ રોજ–તેના નામ શાથે.	વાર.	અંગ્રેજી તારીખ	હીંદુ તીથ	કદમી જરથોશતીઓનો રોજ ૧ થી ૩૦ સુધી માહા ૫ મો અમરદાદ સને ૧૨૮૯ યજદેજરદી. ઇ.તા૦ ૧૦મી ડીસેમ્બર ૧૯૧૯થી તા૦૮મી જાનેવારી ૧૯૨૦સુધી. હીંદુઓનાં સંવત ૧૯૭૬ ના માગસર વડ ૩ ને વાર બુધથી તે પોષ વડ ૩ ને વાર ગુરૂ સુધી.
૧–અહુરમજદ	બુધ.	૧૦	૩	માહા ૫ મો કદમી.
૨ બેહમન...	ગુરૂ..	૧૧	૪	૫૦શને ૮૫ માં જરથોસ્તીઓ ઇરાંનથી શનજાનમાં આવી વસ્યા.
૩-અરદીબેશત	શુકર	૧૨	૬	હમકારો. મરહુમ સર જમશેદજી જીજીભાઈ (પેહલા) બારોનેટને નામદાર શેહેનશાજાદીએ હીરામાં જડેલો શુનાનો ચાંદ બક્ષેયો, ૧૮૪૩. નામદાર શેહનશાહ જોર્જ પાંચમાંએ દીલ્લીમાં પાદશાહી દરબાર ભરી કલકતાને બદલે દીલ્લીને પાયતખ્ત તરીકે
૪–શેહરેવર...	શની	૧૩	૭	[જાહેર કરયું, ઇ.સ.૧૯૧૧.
૫–સપંદારમદ	રવી.	૧૪	૮	[શા૦ ૫ માં જોર્જે નાખ્યો, ૧૯૧૧.
૬–ખુરદાદ....	શોમ	૧૫	૯	બદનેગાની દરેમેહરને ૨૮ મું. નવાં બાદશાહી દીલ્લીનો પાયો
૭–અમરદાદ..	ભોમ	૧૬	૧૦	કદમીનું અમરદાદનું જશન. એલાવના જ૦ બ૦ મોસ-
૮–દેપાદર....	બુધ.	૧૭	૧૧	તરીનાં આદ્રાંનને ૫૧મું. કલકત્તાવાલા શેઠ માંણે-
૯–આદર.....	ગુરૂ.	૧૮	૧૧	હમકારો. કજી રૂસ્તમજી બનાજી ગુજર્યા ૫. ૧૨૬૨.નાં૦શહે૦
૧૦–આવાં... ..	શુકર	૧૯	૧૨	૫માં જોર્જની દીલ્લીથી થયલી રવાંનગી ઇ.સ.૧૯૧૧
૧૧–ખુરશીદ...	શની.	૨૦	૧૩	શ૦ 'મેદીઓશેમ' ધંબાર.
૧૨–મોહર......	રવી.	૨૧	૧૪	નવસારીમાં આ. માંણેકજી નવરોજી શેઠના દખમાંને ૧૭૪.
૧૩–તીર... ...	શોમ.	૨૨	૩૦	શેહેનશાહી તીરઈજદનું જશન.
૧૪–ગોસ......	ભોમ	૨૩	૧	**પોષ માસ.** નવાં પાયતખ્ત દીલીમાં ના૦ વાઇસરાયનો જાહેર પ્રવેસ અને તે ના૦ [illegible]ર
૧૫–દેપમેહર ...	બુધ.	૨૪	૨	ચાંદરાત. ઓરંગાબાદનાં વીકાજી અને [પે૦ મેહરજીનાં દુખ૦૭૭ બૅામ ફુટવાંનો બનેલો બનાવ ઇ. સ. ૧૯૧૨
૧૬–મેહર... ...	ગુરૂ..	૨૫	૩	ક્રીસ્ટમસ ડે. નાતાલના તેહવારો.
૧૭–શરોશ	શુકર.	૨૬	૪	હમકારો. સુરતના બીસ્નીના આદ્રાંનને ૮૩. મું.
૧૮–રશને......	શની.	૨૭	૫	
૧૯–ફરવરદીન.	રવી.	૨૮	૬	[ક્ષમીના આદરાંનને ૫૫ મું.
૨૦–બેહરાંમ...	સોમ.	૨૯	૭	હમકારો. બેરાંમજી કાવસજી બાટલીવાલાના મુંબઇના માહાલ
૨૧–રાંમ......	ભોમ	૩૦	૮	નાં૦ શાહનશાહ પાંચમાં જોર્જની કલકતામાં પધરામણી, ઈ.સ.૧૯૧૧.
૨૨–ગુવાદ.....	બુધ.	૩૧	૯	
૨૩–દેપદીન...	ગુરૂ.	૧	૧૦	ઇંગ્રેજી **નવું વરસ ૧૯૨૦—જાનેવારી.** ૧૮૭૭ માં નામદાર રાંણીનો કેશરેહીંદનો ખેતાબ દીલીમાં જાહેર થયો. ઇ.સ.૧૮૮૦માં મુંબઇની પ્રીન્સીસડાક ઉઘડી. પંજાબને જુદી પ્રેશીડેનશી બનાવી ૧૮૫૯. નવું બોરીબંદરનું સ્ટેશન ચાલુ થયું ૧૮૮૨. ૧૯૦૩ નામદાર શે૦ એડવર્ડ ૭ માના રાજભીષેકનાં સંબંધમાં દીલીમાં દરબાર. શેઠ રૂશતમજી જમશેદજી જીજીભાઇનો જનમ ય૦ ૧૧૩૯.
૨૪–દીન......	સુકર	૨	૧૧	
૨૫–અરશેસવંગ	શની.	૩	૧૨	
૨૬–આસતાદ..	રવી..	૪	૧૪	કલકતામાં ત્રાંમવે ચાલું થઇ, ૧૮૮૨.
૨૭–આશમાન..	સોમ	૫	૧૫	ન૦ શે૦ ઉમરીગરના કલકતાના દખમાને ૯૯મું. કરંજગામની [દરેમેહેરને ૭૫મું. સીવાજીએ સુરત લુટયું–૧૬૬૪.
૨૮–જમીઆદ.	ભોમ.	૬	૧	શુરતમાં મોટી આગ લાગી ય૦ ૧૧૯૧.
૨૯–મારેસપંદ..	બુધ..	૭	૨	
૩૦–અનેરાં.. ...	ગુરૂ..	૮	૩	નાં૦ શાહનશાહ ૫માં જોર્જની કલકતામાંથી રવાંનગી થઇ, ૧૯૧૨.

માહ ૫ મો અમરદાદ શેહેનશાહી શને ૧૨૮૯ યજદેજરદી.

પારસીઓના તીશે રોજ—તેના નામ સાથે.	વાર.	ઈંગ્રેજી તારીખ	હીંદુ તીથી	કદમી જરથોસતીઓનો રોજ ૧ થી ૩૦ સુધી, માહા ૬ ઠો શેહેરેવર સને ૧૨૮૯ યજદેજરદી, ઈ૦ તા૦ ૯ મી જાનેવારીથી તા૦ ૭ મી ફેબરવારી ૧૯૨૦ સુધી હીંદુઓના સંવત ૧૯૭૬ ના પોષ વદ ૪ ને વાર શુકરથી તે માહા વદ ૩ ને વાર શની સુધી.
૧—અહુરમજદ.	શુકર.	૯	૪	માહા ૬ ઠો શેહેરેવર ક૦—શુરતનાં ભરઠાણાના દુખમાંને ૧૯૪.
				[નવસારીની દેશાઇ મનચેરજી ખુ૦ ની દરેમેરને વરસ ૧૨૬.
૨—બેહમન.....	શની.	૧૦	૫	નામદાર શાહનશાહ પાંચમાં જોર્જ હીંદનો પ્રવાસ પુરો કરી ઈંગ્લંડ
				[જવા મુંબઇથી રવાના થયા, ઇ. સ. ૧૯૧૨.
૩—અરદીબેશત	રવી.	૧૧	૬	મુંબઈ કોટના ગોદાવરા મોબેદોનાં આદ્રાંનને ૯૫. ભરૂચની હો. મા.
૪—શેહરેવર ...	સોમ.	૧૨	૭	ક૦ શેહેરેવર અમ૦નું જશન. [દારાબની દ૦ ૧૭૧. હમકારો.
૫—સફંદારમદ..	ભોમ.	૧૩	૮	યજ૦સને ૧૨૩૯માં ડાવેજર લેડીઆવાંબાઇ ગુજરયાં. શુરતનાં
૬—ખુરદાદ....	બુધ.	૧૪	૯	[કાંકરાખાડી આગલના એદલજી શેઠવાલાં અંજુમનનાં
				[દોખમાને વરસ ૯૩મું.
૭—અમરદાદ...	ગુરૂ.	૧૫	૧૦	શે૦ અમરદાદ અમશાસપંદનું જશન, વડોદરાની ઉમરીગરની દરે-
૮—દેપાદર.....	શુકર.	૧૬	૧૧	[મેહેરને ૭૫ મું.
૯—આદર......	શની.	૧૭	૧૨	હમકારો. શેઠ ખ૦ નશરવાનજી કાંમાજી ગુજરયા, ય૦ ૧૨૫૪.
૧૦—આવાં......	રવી.	૧૮	૧૩	[જરથોસ્તી અંજુમનની મજગાંમની અગ્યારીને વરસ ૧૪મું
૧૧—ખુરશીદ....	સોમ.	૧૯	૧૩	બેશાંનની દા૦ તથા મનચેરજી વાડયાની દરેમેહેરને ૭૫ મું.
૧૨—મોહર.......	ભોમ.	૨૦	૧૪	નવશારીના વડા દેશાઇ ખ. ટે. ય. ૧૧૪૯માં ગુ૦ [આદ્રાંનને ૯૧.
૧૩—તીર.......	બુધ.	૨૧	૩૦	ક૦ શેહરેવર મહીનાના ઘંબાર. દીવના શેઠ જા૦ ન૦ વાહાડયાના
૧૪—ગોશ.......	ગુરૂ..	૨૨	૧	**માહા માસ.** ચાંદરાત. કા૦ શે૦ બેદવારની નવશારીની ધરમ-
				[શાલાને ૫૨ મું. ના૦ માહારાણી વિ૦ ૮૨ વરશની ઉમરે મરણ
૧૫—દેપમેહર....	શુકર.	૨૩	૨	કલકતાની યુનીવરસીટી સ્થાપી ૧૮૫૭. [પામ્યાં ૧૯૦૧.
				શુનધડ વેઆરા ગાંમમાના અ૦ દખમાંને ૫૮.
૧૬—મેહેર......	શની.	૨૪	૩	
૧૭—સરોશ......	રવી..	૨૫	૪	હમકારો. મુંબઇના ધનાંપટેલ ડંકન રોડપરના આદ્રાંનને ૮૭ મું.
૧૮—રશને......	સોમ.	૨૬	૫	ચોપાટી વાછાગાંધીના કદમી આદરાંનને ૬૩ મું. ઉદવારાની
				રૂશતમજી જ૦ની ધરમશાલાને ૫૧ મું. મું૦ નવી હાઇકોરટ
				વપડાઇ, ૧૮૭૯.
૧૯—ફરવરદીન..	ભોમ.	૨૭	૬	વેલાતની તારની લાઈન સરકારે લીધી ૧૮૭૦. કલકતા, મદરાસ,
				અને મુંબઇમાં ટેલીફોન ચાલુ થયો ૧૮૮૨. બાજીરાવ પેસવા
				મરણ પામયો ૧૮૫૧. ય. ૧૨૨૦માં શેઠ ક. કાવશજી બનાજી ગુ.
૨૦—બેહરાંમ....	બુધ..	૨૮	૮	હમકારો. કલકતે ૧ લું અંગ્રેજી પત્ર "હીકીજ કલકતા જરનલ"
૨૧—રાંમ.......	ગુરૂ..	૨૯	૯	[નીકલ્યું ૧૭૮૦.
૨૨—ગુવાદ......	શુકર.	૩૦	૧૦	શીંવ રેલવે ચાલુ થઈ ૧૮૫૯.
૨૩—દેપદીન.....	શની.	૩૧	૧૧	
૨૪—દીન........	રવી..	૧	૧૨	**ફેબરવારી માસ.** યજદેજરદી સને ૧૨૦૮માં "અલાહીબાગ"
૨૫—અરશેસવંગ	શોમ.	૨	૧૩	બંધાયો.
૨૬—આશતાદ....	ભોમ.	૩	૧૪	કદમી શેહેરેવર મહીનાના ઘંબાર. દીવના જા૦ ન૦ વાડયાની
૨૭—આશમાન...	બુધ..	૪	૧૫	[દરેહમહેરને ૯૧ મું.
૨૮—જમીઆદ...	ગુરૂ..	૫	૧	અંગ્રેજો પેહેલવેહેલા હીંદુસ્થાનમાં આવ્યા, ૧૬૧૩.
૨૯—મારેશફંદ...	સુકર.	૬	૨	[૧૮૭૨. સર શાલારજંગનું મ૦, ૧૮૮૩,
૩૦—અનેરાં......	શની.	૭	૩	ગવરનર જેનરલ અરલ મેઓને આનડામાંનમાં મારી નાખ્યો

માહા ૬ ઠો શેહેરેવર શેહેનશાહી શને ૧૨૮૯ યજદેજરદી.

પારસીઓના તીશે રોજ—તેના નાંમ સાથે.	વાર.	અંગ્રેજી તારીખ	હીંદુ તીથી	કદમી જરથોશતીઓનો રોજ ૧ થી ૩૦ શુધી, માહા ૭ મો મેહેર શને ૧૨૮૯ યજદેજરદી. ઈ૦ તા૦ ૮ મી ફેબરવારીથી તા૦ ૮ મી મારચ ૧૯૨૦ શુધી. હીંદુઓના સંવત ૧૯૭૬ ના માહા વદ ૪ ને વાર રવીથી તે ફાગણ વદ ૪ ને વાર સોમ સુધી.
૧—અહુરમજદ	રવી..	૮	૪	માહા ૭ મો કદમી.
૨—બેહમન....	સોમ.	૯	૫	
૩—અરદીબેશત	ભોમ.	૧૦	૬	હમકારો. સતારા લીધું ૧૮૪૮ માં.
૪—શેહરેવર....	બુધ..	૧૧	૭	મુંબઈની વસતીની ગણત્રી સને ૧૨૭૫માં મ્યુનીશીપાલીટીએ કીધી તે કુલે વરણની—૯૭૭૮૨૨ ની થઇ, તેમાં પારશીઓની વસ્તી ૪૮૮૨૪ ની હતી. ૧૮૭૪ માં પારસી સાથે મુસલમાનોએ મું૦માં હુલડ કર્યું. શે૦નું શેહેરેવર અ૦નું જશન. નવશારી
૫—સફંદારમદ.	ગુરૂ..	૧૨	૮	હો૦મં૦ કરાંવાલાના દખમાંને ૯૭ મું.
૬—ખુરદાદ......	શુકર.	૧૩	૯	અમદાવાદ લીધું ૧૭૮૦ માં.
૭—અમરદાદ ...	સની.	૧૪	૧૦	[ઠને 'સર નાઈટ'નો ખેતાબ મલ્યો. ૧૮૮૭.
૮—દેપાદર......	રવી..	૧૫	૧૧	દમણની મે૦ ન૦ માણેકજીની દરેમેરને ૮૩. શેઠ દી૦ મા૦ પીટી-
૯—આદર......	સોમ.	૧૬	૧૨	હમકારો. ના૦ શે૦બાનું વીકટોર્યાની જુબીલી હીંદમાં થઇ ૧૮૮૭.
૧૦—આવાં......	ભોમ	૧૭	૧૩	વાંદરાની માણેકજી જીણાની ધરમશાળા તથા દરેમેહેરને ૭૨.
				[દુખમાંને ૪૭ મું.
૧૧—ખુરશીદ....	બુધ..	૧૮	૧૪	૨૩૧૧૧ ને ઓરતો ૨૦૯૮૦. ચીકલીના અનજુમનના
૧૨—મોહર......	ગુરૂ..	૧૯	૩૦	માણસોની થઇ, તેમાં પારસી વસ્તી ૪૪૦૯૧ થઇ, જેમાં મરદો
૧૩—તીર......	શુકર.	૨૦	૧	**ફાગણ માસ.** ૧૮૭૨માં મું૦ કુલે વસ્તીની ગણત્રી ૬૪૫૫૭૬
૧૪—ગોસ......	શની.	૨૧	૨	ચાંદરાત.
૧૫—દેપમેહર....	રવી..	૨૨	૩	[શાળાને ૫૫મું.
૧૬—મેહેર......	સોમ	૨૩	૪	ક૦ મેહેરંગાનનું જશન. મે૦ ફ૦ પાંડેની કરેલવાડીની ધરમ-
૧૭—શરોશ......	ભોમ	૨૪	૫	હમકારો. શેઠ જીજીભાઈ દા૦ નાં કોલાબેના આદ્રાંનને ૮૫, શેઠ
૧૮—રશને......	બુધ.	૨૫	૬	હો૦ દા૦ શાહેરની માલક્ષમીની દરેમેહેરને ૩૦. ભાઠાં ગામમાંના શે૦ ફ૦ ન૦ મીસ્ત્રીના આદ્રાંનને ૫૯.
૧૯—ફરવરદીન..	ગુરૂ..	૨૬	૭	યજદેજરદી ૧૨૪૫ માં શેઠ મે૦ ફ૦ પાંડે ગુજર્યા.
૨૦—બેહરામ..	શુકર.	૨૭	૮	હમકારો. શેઠ નશરવાનજી ર. તાતાના નવસારીના દુખમાંને ૪૩ મું. શેઠ ન૦ હી૦ કરાણીના મુંબઇ કાંદાવાડા મોલામાંના આદ્રાંનને ૭૪ મું, તથા સર જ૦ના નવસારીના આદ્રાંનને ૬૮. વાંદરાની શેઠ ન૦ ર૦ તાતાની દરેમેહેરને ૩૭. ૧૮૯૧ માં મું૦ની કુલે વરણની વસ્તી ૮,૨૧,૭૬૪ માંણસોની થઈ, જેમાં પારસી
૨૧—રાંમ......	શની.	૨૮	૯	૪૭,૪૫૮—તેમાં ૨૪,૭૦૫ મરદો ને ૨૨,૭૫ ઓરતો હતી.
૨૨—ગુવાદ......	રવી..	૨૯	૧૦	
૨૩—દેપદીન.....	સોમ.	૧	૧૧	**માર્ચ માસ.**
૨૪—દીન......	ભોમ.	૨	૧૩	પેહેલા સર જમશેદજી જીજીભાઇને 'નાઇટ'નો ખેતાબ મલ્યો ૧૮૪૨ મું૦ વસ્તીની ગંત્રીમાં ૧૯૦૧ માં૭૭૦૮૪૩ માણસ થયાં પા. વસ્તી ૪૬૨૩૧ની તેમાં ૨૪૨૭૭ મરદ અને ૨૧૯૫૪ ઓ૦ હતી. શેઠ ફ૦ કાવશજી બનાજીનો જન્મ ય૦ ૧૧૩૭.
૨૫—અરશીસંવગ	બુધ.	૩	૧૪	
૨૬—આસતાદ...	ગુરૂ..	૪	૧૫	હોલી શેહેનસાહી શેરેવર મહીનાંના "પેતેશહમ" તથા કદમી મેહેર મહીનાના "યાથરેમ" ઘંબાર. દુંમશની દરેમેરને ૮૩ મું. સુરતનાં પદાનયાં મોબેદોનાં નવાં દુખમાંને ૩૭ મું. અજમેરના અંજુમનના દુખમાને ૩૧ મું.
૨૭—આશમાંન..	શુકર	૫	૧	તારાપોરના અ૦ દુખમાંને ૫૫ મું.
૨૮—જમીઆદ...	શની.	૬	૨	
૨૯—મારેસફંદ..	રવી..	૭	૩	મુંબઇ ને કલકતા વચે રેલવે ચાલુ થઇ ૧૮૭૦. રાંદેરના અ૦
૩૦—અનેરાં.....	સોમ.	૮	૪	દુખમાંને ૬૮. વલસાડનાં અ૦ દો૦ [illegible]

માહા ૭ મો મેહેર શેહેનશાહી શને ૧૨૮૯ યજદેજરદી.

પારસીઓના તીશે રોજ–તના નામ સાથે.	વાર.	ઈંગ્રેજી તારીખ	હીંદુ તીથી	કદમી જરથોશતીઓનો રોજ ૧ થી ૩૦ સુધી માહા ૮ મો આવાં શને ૧૨૮૯ યજદેજરદી. ઈ૦ તા૦ ૯ મી મારચથી તા૦ ૭ મી એપરેલ ૧૯૨૦ સુધી. હીંદુઓનાં સંવત ૧૯૭૬ ના ફાગણ વદ ૫ ને વાર ભોમથી તે ચૈતર વદ ૪ ને વાર બુધ સુધી.
૧–અહુરમજદ.	ભોમ.	૯	૫	માહા ૮ મો કદમી આવાં. [સને ૧૧૬૮.
૨–બેહમન....	બુધ.	૧૦	૬	૧૮૭૦ માં પ્રીન્સ આલફ્રેડ મુંબઇ આવ્યો. [માલાજી ગુજર્યાં ય૦
૩–અરદીબેશત.	ગુરૂ..	૧૧	૬	હમકારો. બાઇ જીવીબાઇ તે સર જ૦ જી૦ પેહલા બારોનેટના
૪–શેહરેવર....	શુકર.	૧૨	૭	નામદાર સાહજાદો પ્રીન્શ આફ વેલ્શ ૧૮૭૬ માં મુંબઇ થી પોતાને
				વતન સીધારયો. ૧૮૩૨ માં જામે જ૦ પેહલે અઠવાડયાંમાં ૧
				વાર નીકલ્યું, તે પાછલથી ૧૮૫૩માં રોજીંદું થયું.
૫–સફંદારમદ..	શની.	૧૩	૮	સુરતનાં ઉમરાગાંમ આગલનાં અ. (મેહે. પટેલવાલાં) દુ. ૮૯
૬–ખુરદાદ.....	રવી.	૧૪	૯	
૭–અમરદાદ...	સોમ.	૧૫	૧૦	
૮–દેપાદર.....	ભોમ.	૧૬	૧૧	
૯–આદર......	બુધ.	૧૭	૧૨	હમકારો. થાંણાંના કા૦ રૂ૦ પટેલના આ૦ ૧૪૬ મું.
૧૦–આવાં......	ગુરૂ..	૧૮	૧૩	કદમી આવાં અર્દુ ઇશુરનું જશન. આ૦ શેઠ બે૦ રૂ૦ના ધણીયાંણી
				માણેકબાઇ ગુજર્યાં ય૦ ૧૨૩૮. સને ૧૮૮૧ માં મુંબઈની કુલે
				વસ્તીની ગણત્રી ૭૭૩૧૯૬ માંણસોની થઈ, તેમાં પારસીઓની
૧૧–ખુરશીદ....	શુકર.	૧૯	૧૪	સંખ્યા ૪૮૫૯૭ ની જેમાં ૨૫૩૧૫ મર્દો, ને ૨૩૨૮૨ ઓરતો હતી
૧૨–મોહર.......	શની.	૨૦	૩૦	ય૦ ૧૧૧૭માં શેઠ માંણેકજી નવરોજી શેઠના ગુજર્યાં.
૧૩–તીર.......	રવી.	૨૧	૧	**ચૈતર માસ.** જમશેદી નવરોઝ. કલકતાની ટાંઉન હાલ બંધાઇ ૧૮૧૪
૧૪–ગોશ.......	સોમ.	૨૨	૨	ચાંદરાત [ગોલવાડમાંનાં મ૦ ખ૦ લંગડાના આદરાંનને ૭૨મું.
૧૫–દેપમેહર....	ભોમ.	૨૩	૩	કદીયાંણીના શેઠ ન૦ બાલાભાઇનાં દુખમાંને ૩૩ મું મુંબઇનાં
૧૬–મેહેર......	બુધ.	૨૪	૪	શેહેનશાહી મેહેર ઇદનું જશન. યજ૦ ૧૨૪૨ માં દુખમાં
૧૭–શરેશ	ગુરૂ..	૨૫	૫	હમકારો. [રાગોટ કેશ ઉભો થયો.
૧૮–રશને.......	શુકર.	૨૬	૭	માને ૧૦૪, હો૦ બ૦ કપતાને બાંધેલી નવી સઘડીને વ. ૫૧
				પેટાની સઘડીને ૬૬. ગનદેવીના જ૦ ના૦ ગજદરનાં દુખ-
૧૯–ફરવરદીન.	શની.	૨૭	૮	થાંણાંનાં કાલાભજી કાવશજી પટેલના દુખમાંને ૭૮. દા૦ ૩૦
૨૦–બેહરાંમ....	રવી.	૨૮	૯	હમકારો. ગંદેવીના અ. દુ૦ ૫૨ [બંધાણી ૧૮૪૫માં ખુલ્લો મો
૨૧–રાંમ........	સોમ.	૨૯	૧૦	બાંદરા માહેમનો પુલ સર જ૦ જી૦ ની દાવેજર લેડી આંવાબાઇને નામે
૨૨–ગુવાદ......	ભોમ.	૩૦	૧૧	૧૨૨૮ ય૦ માં સર જ૦ જી૦ (પહેલા) બારોનેટ હક થયા.
૨૩–દેપદીન.....	બુધ.	૩૧	૧૨	કલકતાવાલા શેઠ રૂ૦ કા૦ બનાજી ગુજર્યા, ૧૨૨૧.
૨૪–દીન.......	ગુરૂ.	૧	૧૩	**એપ્રીલ.** પોસ્ટખાતાંની સેવીંગ બેંક ઉઘડી ૧૮૮૨.
				બેજાંનપારનાં અ. ખ. વાડયાના ધણીઆંણીના આ૦ ૫૮.
૨૫–અરશીસવંગ.	શુકર.	૨	૧૪	ય૦ ૧૨૪૦ માં શેઠ રૂ૦ જ૦ જીજીભાઇ ગુજરયા.
૨૬–આસતાદ...	શની.	૩	૧૫	શેહેનશાહી મેહેર મહીનાનાં "યાથરેમ" ધંમબાર.
૨૭–આસમાંન...	રવી.	૪	૧	
૨૮–જમીઆદ...	સોમ.	૫	૨	૧૮૭૬ માં શેઠ બે૦ જી૦ ને સ્ટાર ઓફ ઇં૦ નો ખેતાબ મલ્યો.
				બાલાપુરના વીકાજી તથા પે૦ મેહરજીનાં દુખમાંને ૮૨મું. શુરતમાં
				મોટી આગ લાગી યજદેજરદી ૧૨૦૬.
૨૯–મારેસફંદ...	ભોમ.	૬	૩	૧૮૭૪ માં મુસલમાંનોના હુલડ વીશે ૮૦૦૦ પારસીઓએ સભા
				ભરીને નેશાત અરજી કીધી તેથી મુંબઇ સરકારને ઠપકો મલ્યો.
				તવરી ગામનાં અનજુમનના દુખમાંને ૫૭ મું. ખંભાતના
				પેશતનજી ખ૦ મોદીનાં દુખમાંને ૯૫ મું વરસ.
૩૦–અનેરાં	બુધ..	૭	૪	પુણામાં અનજુમને બંધાવેલા દુખમાંને ૮૬ મું વરસ.

માહા ૮ મે આવાં શેહેનશાહી શને ૧૨૮૯ યજદેજરદી.

પારશીઓના તીશ રોજ–તેના નામ સાથે.	વાર.	ક્રીસ્તી તારીખ	હીંદુ તીથી	કદમી જરથોશતીઓનો રોજ ૧ થી ૩૦ સુધી, માહા ૯ મો આદર સને ૧૨૮૯ યજદેજરદી. ઇ૦ તા૦ ૮ મી એપરેલથી તા૦ ૭ મી મેએ ૧૯૨૦ શુધી. હીંદુઓનાં સંવત ૧૯૭૬ નાં ચઇતર વડ ૫ ને વાર ગુરથી તે વઈશાખ વડ ૪ ને વાર સુકર સુધી.
૧–અહુરમજદ	ગુર..	૮	૫	માહા ૯ મે. ક૦. શુમારીનાં કુ૦ માં૦ મુકાદમવાલાં આગ
૨–બેહમન. ..	શુકર.	૯	૬	[લનાં હો૦પા૦નાં બાંધેલાં આદ્રાંનને ૨૫૦ મું.
૩–અરદીબેહેસ્ત	શની.	૧૦	૭	હમકારો. મું૦ નાં ગ્રાંટરોડપરના એ૦ શો૦ હો૦ રાનજીના
				[ઘેરનો નાશ-૧૮૮૩. [આદ્રાનને ૫૩ મુ.
				[શીનીઆ લીધું. દીલીમાં સદરબજારમાં મોટી આગથીર૦૦
૪–શેહરેવર. .	રવી.	૧૧	૮	જનલણાં મધે અંજુમનનાં દુખમાને ૫૦ મું. ૧૮૬૮માં એબી-
૫–સપંદારમદ	શોમ.	૧૨	૯	મુંબઇનાં ફરામજી કાવશજી બનાજીના દુખમાને ૮૯ મું.
૬–ખુરદાદ. ...	ભોમ	૧૩	૧૦	
૭–અમરદાદ..	બુધ.	૧૪	૧૦	
૮–દેપાદર. ...	ગુર..	૧૫	૧૧	મુંબઇની જી. આઇ. પી. રેલવે ચાલુ થઇ ૧૮૫૩.
				માંના હીરજીભાઇ જ૦બેરાના આ૦આદ્રાનને ૭૨. હમકારો.
				મુંબઇ, બેત૦કા૦ મા૦હાસબરનના આદરાંનને ૮૯. કરાંચી-
				પેશતનજી પલાનતીનના આદ્રાંનને વરસ ૭૪ મું,
૯–આદર.	શુકર.	૧૬	૧૨	કદમી આદર ઇજદનું જશન. અમદનગરના જમશેદજી
૧૦–આવાં. . ..	શની.	૧૭	૧૪	શેહેનશાહી આવાં અરદુઇશુરનું જશન.
૧૧–ખુરશીદ....	રવી.	૧૮	૩૦	[શેઠ ખ૦ માં૦ સરાફ ગુજર્યા,ય. ૧૨૧૯
૧૨–મોહર......	શોમ	૧૯	૧	**વૈશાખ માસ.** મુંબઇના કા૦એ૦ બીશ્તીના દુખમાને ૭૭.
૧૩–તીર.......	ભોમ	૨૦	૨	ચાંદરાત.
૧૪–ગોશ......	બુધ.	૨૧	૩	મુંબઇ મજગાંમમાના ના૦ જ૦ શપલાના આદરાંનને ૫૪.
૧૫–દેપમેહર....	ગુર..	૨૨	૪	
૧૬–મેહેર. . ..	સુકર.	૨૩	૫	શુરતમાં મોટી આગ ૧૮૩૭. શેક્ષપીયર જનમ્યો, ૧૫૬૪.
૧૭–સરોશ. ...	શની.	૨૪	૬	હમકારો. શેક્ષપીયરનું મરણ ૧૬૧૬
૧૮–રશને.. ..	રવી.	૨૫	૭	યજદેઝરદી ૧૨૧૮માં શેઠ જીજીભાઇ દાદાભાઇ ગુજરયા. સુરતનાં
				[કેટલાક પારશીઓએ કદમી તરીકો અખત્યાર કીધો, ય૦૧૧૧૪.
૧૯–ફરવરદીન..	શોમ.	૨૬	૮	કદમી અશોફરોહરનું જશન, દુખમાં નજદીક બંદગીનો દીવસ.
૨૦–બેહેરામ ...	ભોમ	૨૭	૯	હમકારો.
૨૧–રામ..	બુધ.	૨૮	૧૦	શેનશાહબાનુનું પુતલું મુંબઇમાં ખુલ્લું મેલ્યું, ૧૮૭૨.
૨૨–ગુવાદ. . ..	ગુર..	૨૯	૧૨	[પેરીસ એકઝીબીશન, ૧૮૬૭ બીજું. ગુ૦ ય૦ સને ૧૨૭૦.
૨૩–દેપદીન....	શુકર.	૩૦	૧૩	સર દીનશાહજી માણેકજી પીટીટ પેહેલા બેરોનેટ ૭૯ વરશની વયે
				[માં, ચીકાગોનું એકઝીબીશન૧૮૯૩માં ઊઘડયું. ૧૮૪૫
૨૪–દીન.......	શની.	૧	૧૪	**મેએ.** મું૦ની જમશેદજી જીજીભાઇ હાસ્પીટાલ વપડાઇ ૧૮૮૯
૨૫–અરશીશવંગ.	રવી..	૨	૧૫	ઇસ્ટ ઇનડીયા કુંપનીના લશકરમાં બેદીલી ફેલાયાથી ૧૦૦૦૦
				માણશોને બરતરફ કીધાં ૧૮૫૭. વીકટોર્યા ને
				આલબર્ટ મ્યુઝીયમ મુંબઇમાં ઊગડયું ૧૮૭૨.
				અમદાવાદનાં અંજુમનનાં દુખમાંને ૭૮મું. મુંબઈના શેહેનશાહી
				[પેહેલા દસ્તુર. ખુરશેદજી જ૦ જામાસ્પ આ૦ગુ. ય. ૧૧૯૮.
૨૬–આસતાદ..	શોમ.	૩	૧૫	ટીપુ શુલતાન મારયો ગયો, ૧૭૯૯.
				[કલકતાવાલા શેઠ હી૦ મા૦ બનાજી, ગુજયા, ય૦ ૧૨૭૩
૨૭–આસમાન..	ભોમ.	૪	૧	
૨૮–જમીઆદ..	બુધ.	૫	૨	શુરતનાં કાકરાખાડીનાં મનચેરજી શેઠનાં અંજુમનનાં
૨૯–મારેશપંદ..	ગુર..	૬	૩	દુખમાંને ૧૫૦. ભાવનગરની મરહુમ શેઠ દોરા
૩૦–અનેરાં.. ...	શુકર.	૭	૪	બજી શાપુરજી ઉમરીગરની દરેમેહરને ૨૯.

માહા ૯ મો આદર શેહેનશાહી શને ૧૨૮૯ યજદેજરદી.

પારસીઓના તીશે રોજ–તેના નાંમ સાથે.	વાર.	અંગ્રેજી તારીખ.	હીંદુની તારીખ.	કદમી જરથોશતીઓના રોજ ૧ થી ૩૦ સુધી, માહા ૧૦ મો દેએ શને ૧૨૮૯ યજદેજરદી. ઇંગ્રેજી તા૦ ૮ મી મેએથી તા૦ ૬ મી જુન ૧૯૨૦ શુધી. હીંદુ સંવત ૧૯૭૬ ના વઇશાખ વદ ૫ ને વાર સનીથી તે જેઠ વદ ૫ ને વાર રવી સુધી.
૧–અહુરમજદ	શની	૮	૫	માહા ૧૦ મો ક૦; ક૦ જશન મહીનો-દાદાર અહુરમજદનું ૧લું જશન
				મીરતમાં ઘોડેસ્વાર રીજમાંટે બલવો કીધો. ૧૮૫૭
				દેશી જડજ તરીકે મી૦ નાનાભાઇ હરીદાશ નેમાયા ૧૮૮૪
૨–બેહમન ...	રવી.	૯	૬	વેશુની શેઠ માં. ર. પટેલની દરેમેહરને ૩૧મું. હાઇ કોર્ટમાં પેહલવેલા
૩–અરદીબેસ્ત	શોમ.	૧૦	૭	હમકારો. ન૦ કા૦ નાલીએરવાલાના દાદરપરનાં આદરાંનને ૧૦૦
૪–શેહરેવર ...	ભોમ	૧૧	૮	કોટેકોટની બાઇ પીરોજબાઇ તે દા૦ મા૦
૫–સફંદારમદ..	બુધ.	૧૨	૯	વાછાની વીધવાની દરેમેહરને ૩૯ મું૦
૬–ખુરદાદ.....	ગુરૂ.	૧૩	૧૦	સુરત ઇંગ્રેજોને તાબે થયું ૧૮૦૦.
૭–અમરદાદ..	શુકર.	૧૪	૧૧	વાલકેશવરનાં શે. હુંડીના આદ્રાંનને ૬૨.
૮–દેપાદર....	શની.	૧૫	૧૨	કદમીનું દાદાર અહુરમજદનું બીજું જસન.
૯–આદર......	રવી.	૧૬	૧૩	કલકતા ને મુંબઈ વચ્ચે તાર ચાલુ થયો સને ૧૮૫૪
				શેહેનશાહી આ૦ ઈ૦ જશન. ય૦ ૯૩ માં શંજાણમધે દસ્તુર
				નેરીઓશંગધવલે તખ્તનશીન કીધેલાં આતશબેરાંમ જે ઉદવા
				રામાં છે તેને ૧૨૦૮મું, મુંબઇ બનાજી લી૦ વાલાં આદ્રાંનને ૨૧૨
				મું, કોટમાના માણેકજી શેઠના આદરાંનને ૧૮૮ મુ. વીકાજીની
				તારાપોરનીને ૧૦૧, કરાંચીની શેઠ ડો૦ મે૦ વાડીઆની
				ઇઆદગારી વાળી દરેમેરને ૫૧ મું. ભરૂચની બાઇ હીરાંબાઇ
				નારીએલવાલાની દરેમેરને ૯૦ મું. બીલીમોરાની શેઠો દાદા
				ભાઇ વનજીભાઇ તથા સોરાબજી શાપુરજીએ બંધાવેલા આદરી
૧૦–આવાં	શોમ.	૧૭	૧૪	[યાનને વ૦ ૨૨. હમકારો.
૧૧–ખુરશીદ....	ભોમ.	૧૮	૩૦	કદમી પેગમબરનો દીશો. ય૦ સને ૧૨૪૪ માં નવસારીનાં દુખ-
૧૨–મોહોર	બુધ.	૧૯	૧	**જેઠ માસ.** ચાંદરાત. માંનો રશતો હો૦ બ૦કપટાને બંધાવ્યો.
૧૩–તીર	ગુરૂ.	૨૦	૨	લાર્ડ રીપને સ્વરાજ બક્ષયું, ૧૮૮૨.
૧૪–ગોશ	શુકર	૨૧	૪	શેઠ મે૦ ફ૦ પાંડેનો જનમ, ય૦ ૧૧૮૧.
૧૫–દેપમેહેર....	શની	૨૨	૫	ક૦ નું દાદાર અહુરમજદનું ત્રીજું જ૦.
				[શા૦ વાલી અગીઆરો તથા ધરમશાહરાને ૭૧.
૧૬–મેહેર......	રવી.	૨૩	૬	કદમી દેહ મહીનાના 'મેદીયારેમ' ઘંબાર. વલશાડની મોતાબાઇ
૧૭–સરોશ.....	શોમ.	૨૪	૭	હમકારો. ખેતવાડીમાંના શેઠ પા૦ ખ૦ કામાના આદરાનને **૫૨.**
૧૮–રશને......	ભોમ	૨૫	૮	[ગાયકવાડ શીયાજીરાવ ગાદીએ બેઠા, ૧૮૭૫.
૧૯–ફરવરદીન .	બુધ.	૨૬	૯	શે૦ ફરવરદીયાન જવાનું અશોફ્રોહરનું જશન. કરાંચીની
				[જ૦ અંજુમને બાંધેલાં દુખમાં તથા શગરીને ૪૬ મું
૨૦–બેહરાંમ....	ગુરૂ.	૨૭	૧૦	હમકારો. મું૦ કોટમાં બાઇ મોટલાંબાઇ તે જાં૦ ન૦ વાડયાના આ
				દ્રાંનને ૫૮ મું, ઉદવાડાના આતશબેરામને લગતાં સર દીન
૨૧–રાંમ	શુકર	૨૮	૧૧	શાહજી માં૦ પીટીટ બેરોનેટે બાંધેલાં નવાં મકાંનને ૩૦ મું.
૨૨–ગુવાદ	શની	૨૯	૧૨	કાશમીરમાં ધરતીકંપ થયો, તેથી ૧૫૦૦ માંણુશોનાં જીવની, ઇમા-
				[રતો તથા જાનવરોની મોટી નુકશાંની ૧૮૮૫.
૨૩–દેપદીન.....	રવી.	૩૦	૧૩	ભરૂચની મર૦શેઠ સા૦ શે૦ નાળિએરવાલાની દ૦૨૫મું ક૦ દાદાર
૨૪–દીન	શોમ	૩૧	૧૪	લાર્ડ રીપન હીંદુસ્થાનમાં આવ્યા ૧૮૮૦. [હોરમજદનું ચોથું જશન.
૨૫–અરશીસ્વંગ	ભોમ	૧	૧૫	**જુન માસ.**
૨૬–આસતાદ ...	બુધ.	૨	૧	
૨૭–આશમાંન..	ગુરૂ	૩	૨	
૨૮–જમીઆદ ...	શુકર	૪	૩	
૨૯–મારેસફંદ..	શની	૫	૪	
૩૦–અનેરાં ...	રવી.	૬	૫	સર દીનશાજી માં૦ પીટીટ બેરોનેટનો જનમ–ય૦ સને **૧૧૯૨.**

માહા ૧૦ મો દએ શેહેનશાહી શને ૧૨૮૯ યજદેજરદી.

પારસીઓના તીરો રોજ–તેના નાંમ સાથે.	વાર	ઈંગ્રેજી તારીખ	હીંદુ તીથ	કદમી જરથોશતીઓનો રોજ ૧ થી ૩૦ સુધી, માહા ૧૧ મો બેહમન કદમી શને ૧૨૮૯ યજદેજરદી. ઈ૦ તા૦ ૭ મી જુનથી તે તા૦ ૬ ઠી જુલાઈ ૧૯૨૦ સુધી. હીંદુઓના સંવત ૧૯૭૬ ના જેઠ વદ ૫ ને વાર સોમ થી તે અશાડ વદ ૫ ને વાર ભોમ સુધી.
૧–અહુરમજદ	સોમ	૭	૫	માહા ૧૧ મો કદમી. શેહેનશાહી જશનનો મહીનો. દાદાર અહુરમજદનુ પેહેલું જશન. મુંબઇમાં સાસુન ડાક ઊઘડી, ૧૮૭૫. [જશન શુરતની દા૦ને પે૦વાડયાની દ. ૭૭.
૨–બેહમન....	ભોમ	૮	૬	જંગબારના સુલતાનની ઈંગ્લડની મુસાફરી ૧૮૭૫ ક૦બેહમનનું
૩–અરદીબેશત	બુધ	૯	૭	દમકારોબેતારાશોધીકાડનારખગોલવેતાચીંતામણીરઘુનાથનુ મ. ૧૮૮૦
૪–શેહેરેવર....	ગુરૂ..	૧૦	૮	એલેકઝાંડરામાં બલવામાં ૧૦૦ યુરોપીયન મારયા ગયા ૧૮૮૨.
૫–સફંદારમદ.	સુકર	૧૧	૯	ય૦ ૧૧૫૫ માં શેઠ છ૦દા૦નો જન્મ.
૬–ખુરદાદ....	શની.	૧૨	૧૧	૧૮૫૭ માં હીંદુસ્થાનમાં આલેલા બલવાનાં દીગાંગમાં સરકારે હીંદુસથાંનનાં છાપાનાં છુટાપણાંના અટકાવનોધારો કાડયો તે પછવાડેથી બંધ પડયો. ય૦૧૧૫૨મા શર જ૦ છજીભાઇ (૧લા) બારોનેટ જનમ્યા. મરહુમ આ રૂ જ૦.છને 'ફ્રીડમઓફ ધીસીટી ઓફ લંડન'નું માન મળયું, ૨૩ ૬-૧૮૬૪
૭–અરદાદ....	રવી..	૧૩	૧૨	[રો૦ દેહ મહીનાનું બીજુ જશન.
૮–દેપાદર......	સોમ	૧૪	૧૩	મુંબઇમાંવાવીઝોર તું મોટું તોફાન થયું ૧૮૩૭માં. સર જમશેદજી [જી૦ ચોથા બારોનેટ હક થયા, ય૦ ૧૨૭૭.
૯–આદર......	ભોમ	૧૫	૧૪	દમકારો. શોદાગર સાથે જોડાયું. ચાબુક નીકલ્યું, તે ૧૮૭૨મ અખબારે
૧૦–આવાં......	બુધ	૧૬	૩૦	ગુજરવાનો દીવસ. શને ૧૮૩૩ માં મુંબઇ
૧૧–ખુરસીદ....	ગુરૂ..	૧૭	૧	અશાડ માસ. પા૦ પેગમબર સપેંતમાન "જરથોશત"ના
૧૨–મોહોર......	શુકર	૧૮	૨	ચાંદરાત. ય૦ ૧૧૩૨ માં શેઠ ખરશેદજી માણેકજી શરાફનો જનમ.
૧૩–તીર........	શની	૧૯	૩	શેનશાબાંનુ વી તખતે બેઠાં. ૧૮૩૭. તેની જુબીલી થઇ ૧૮૮૭. [તે પછે ૧૮૯૭માં ૬૧ માં વરસની "ડાયમંડ જુબીલી" થઈ
૧૪–ગોશ......	રવી	૨૦	૪	નવસારીના દસ્તુર જામાસપ આશાના ગુજર્યા ય૦ ૧૧૨૨.
૧૫–દેપમેહેર....	સોમ	૨૧	૫	શેન્દાદાર અહુનું ત્રીજું જસન. શેહેનશાહ બાંનુનો ઢંઢેરો નીકલ્યો.
૧૬–મેહેર........	ભોમ	૨૨	૬	શેનશાહીઓના "મેદીઆરેમ" ગંબાર. [૧૮૩૭.
૧૭ સરોશ....	બુધ	૨૩	૮	દમકારો. નામદાર શેનશાહ એડવરડનો જનમ, ૧૮૪૧.
૧૮–રશને	ગુરૂ..	૨૪	૯	
૧૯–ફ્રવરદીન....	શુકર	૨૫	૧૦	[કાંહાંનપોરમાં નાના શાહેબે કતલ ચલાવી, ૧૮૫૭.
૨૦–બેહરાંમ....	શની.	૨૬	૧૧	દમકારો. શેઠ બનાજી લી. ૮૨ વ. ય. શને ૧૧૦૩ માં ગુજર્યા.
૨૧–રાંમ......	રવી.	૨૭	૧૧	
૨૨–ગુવાદ......	સોમ	૨૮	૧૨	શેહનશાબાનુ વીકટોરીઆએ તાજ પેહેર્યું, ૧૮૩૮
૨૩–દેપદીન	ભોમ	૨૯	૧૩	શેહેનશાહી દાદાર અહુરમજદનું ચોથું જશન. ય૦૧૨૪૬ માં શરજ૦. જી. બીજાબા.શી. એશ. આઈ.ગુજર્યા.
૨૪–દીન.......	બુધ	૩૦	૧૪	કાર્ડ નીકલ્યા, ૧૮૭૯. ૧૮૨૨માં મુંબઇ સમાચાર પત્ર નીકલ્યું પરણી, ૧૮૬૨. હીંદુસ્થાનમાં એક દોહડીયાંવાલા પોસ્ટ
૨૫–અરશેસવંગ	ગુરૂ.	૧	૧૫	જુલાઇ માસ. માહારાંણી વી૦ ની બેટી પરીનશેસ એલીસ
૨૬–આશતાદ....	શુકર	૨	૧	૧૮૮૩ માં શુરતમાં મોટી રેલ આવ્યાથી ૨ થી ૩ લાખ રૂપયાનું [નુકશાન–દોહડ હજાર ઘેરો અને ૧૨ માંણુશોનો નાશ થયો.
૨૭–આશમાંન..	શની	૩	૨	
૨૮–જમીઆદ..	રવી.	૪	૩	
૨૯–મારેશફંદ...	સોમ	૫	૪	
૩૦–અનેરા......	ભોમ	૬	૫	ય૦ ૧૨૪૨ માં દુખમા કેશના પારસી છુટયા.

માહા ૧૧ મો બેહેમન શેહેનશાહી શને ૧૨૮૯ યજદેજરદી.

પારસીઓના ત્રીશ રોજ—તેના નામ શાથે.	વાર.	ઈંગ્રેજી તારીખ	હીંદુ તારીખ	કદમી જરથોશતીઓના રોજ ૧ થી ૩૦ સુધી માહા ૧૨ મો. અસ્ફંદારમદ શને ૧૨૮૯ યજદેજરદી. ઈ૦ તા૦ ૭ મી જુલાઈ થી તે તા૦ ૫ મી આગશટ ૧૯૨૦ સુધી. હીંદુ સંવત ૧૯૭૬ ના આષાડ વદ ૬ ને વાર બુધથી તે શ્રાવણ અધીક વદ ૬ ને વાર ગુરૂ સુધી.
૧—અહુરમજદ	બુધ.	૭	૬	માહા ૧૨ મો અસ્ફંદારમદ કદમી. બઝમે જશને રૂઝે અહુરમઝદની મંડલીની સ્થાપના ૧૨૬૭. પ્રોફેસર દા૦ ન૦ને પારલામેંટના એક મેમબર દાખલ લંડનનાં ફીનશબરી ખાતેના રેહવાસીઓએ ચુંટી કાહાડયા, ૧૮૯૨. [ય૦ ૧૨૪૧.
૨—બેહમન	ગુરૂ..	૮	૭	શે૦ બહમન અમ૦ જશન. દ૦ દારા૦ શે૦ કુમાના ગુજરયા
૩—અરદીબેહશત	શુકર.	૯	૮	હમકારો. શરકા૦ જાં૦ રેડીમણી નાઈટ શી. એશ. આઈ ગુ., ય૦
૪—શેહેરેવર	શની.	૧૦	૯	મુંબઈમાં શને ૧૮૭૨માં પાંચ રૂપીઆની નોટ નીકલી [૧૨૪૭.
૫—અસ્પંદારમદ.	રવી.	૧૧	૧૦	ક૦ અસ્ફંદારમદ અમશાસ્પંદનું જશન. સર જમશેદજી [જીજીભાઈ ત્રીજા બારોનેટહક થયા, ય૦૧૨૬૭.
૬—ખુરદાદ	સોમ.	૧૨	૧૧	કલકતાનાં ધરતીકંપથી ડારજીલીંગ ને શીરાજગંજમાં મોટી [ખરાબી, ૧૮૮૫.—બીજી વાર ૧૮૯૭.
૭—અમરદાદ	બોમ	૧૩	૧૨	
૮—દેપાદર	બુધ.	૧૪	૧૩	નાના સાહેબે કાહાંનપોરમાં ઇંગ્રેજ ઓરત, મરદો, તથા છોકરાંઓની કતલ ચલાવી ૧૮૫૭. ૧૮૭૦મા ફ્રાંન્સ ને જર૦લડાઈ. પુણાની શે૦ર૦પટેલવાલી દરે૦૯૭મું. અજમેરની શેઠનવ૦
૯—આદર	ગુરૂ..	૧૫	૩૦	હમકારો. — રૂ૦ કલ્યાણીવાલાની દરે૦ ૨૩ મું.
૧૦—આવાં	શુકર.	૧૬	૧	અધીક **શ્રાવણ માસ.** — સરદાર ખા૦ બા૦ પદમજી
૧૧—ખોરશેદ	શની.	૧૭	૨	ચાંદરાત. — પેસતનજી ગુજરયા—ય૦ ૧૨૬૩.
૧૨—મોહોર	રવી.	૧૮	૩	શેઠ શોરાબજી વાછાગાંધી યઝદેજરદી ૧૨૨૬ માં ગુજરયા.
૧૩—તીર	સોમ.	૧૯	૪	
૧૪—ગોશ	બોમ	૨૦	૫	
૧૫—દેપમેહેર	બુધ.	૨૧	૬	હીંદુસથાનમાં ઇનકમટેક્સ થયો, ૧૮૬૦.
૧૬—મેહેર	ગુરૂ..	૨૨	૭	
૧૭—સરોશ	શુકર.	૨૩	૮	હમકારો.
૧૮—રશને	શની	૨૪	૯	હીંદુસથાંનના દેશીઓમાં પેહેલા પીટીટ જુરીમાં બેઠા, ૧૮૨૮.
૧૯—ફરવરદીન.	રવી..	૨૫	૧૦	બંગાલના દખણ ભાગપર ધરતીકંપ થયો, ૧૮૫૪. મલારરાવ મદરાસમાં નજરકેદ હતોતે મરણ પામ્યો, ૧૮૮૨. કદમી અશોફરોહરનું જસન.
૨૦—બેહેરામ	સોમ.	૨૬	૧૧	હમકારો. પરેલમાના દા૦ પે૦ વાડયાનાં આદરાનને ૮૭ મું.
૨૧—રામ	બોમ.	૨૭	૧૨	વંશપરંપરાનો એતાબ ગલેઓ ૧૮૫૭.
૨૨—ગુવાદ	બુધ.	૨૮	૧૨	થયો ૧૯૦૭. શરજ૦ જી૦ નાઈટ "બારોનેટ" નો
૨૩—દેપદીન	ગુરૂ..	૨૯	૧૩	હીંદમાં નીકલનો એક આનાનોનો શીકકો ચાલુ
૨૪—દીન	શુકર	૩૦	૧૪	[શરૂ થયાં. — ૧૮૬૮માંઆખબારે શોદાગર શાથ જોડાયું.
૨૫—અરશીશવંગ	શની.	૩૧	૧૫	કદમી મુકતાદ — ગુજરાતીવરતમાન પેહેલ વેહલું પ્રગટ થયું હતું તે
૨૬—આશતાદ	રવી.	૧	૧	**આગશટ માસ.** ૧૮૪૯માં સમાચાર દરપણ નામનું શેજીંદુ
૨૭—આશમાંન	સોમ.	૨	૨	શેઠ ફ૦ દીનશાજી પીટીટ ગુજર્યા, યઝદેજ૦ ૧૨૬૪.
૨૮—જમીઆદ	બે.મ.	૩	૩	
૨૯—મારેશપંદ	બુધ.	૪	૪	કદમી મીનો મારેસફંદનું જશન.
૩૦—અનેરાં	ગુરૂ..	૫	૬	મુંબઈમાં પેહેલવેહલી પારસી મેટરીમોનીયલ કોરટ બેઠી ૧૮૬૬ [પ્રી૦આલબરટ ૧૮૪૪ માં જ૦

માહા ૧૨ મો સફંદારમદ શેહેનશાહી શને ૧૨૮૯ યજદેજરદી.

શે० પારસીઓના તીશે રોજ—તેના નાંમ સાથે	કદમીઓના રોજ	વાર.	ઈંગ્રેજી તારીખ	હીંદુ તીથી	કદમી જરથોશતીઓના ગાથા ૧ લો માહ ૧૨ મો સને ૧૨૮૯ થી રોજ ૩૦ મો માહા ૧ લો ફ્રરવરદીન સને ૧૨૯૦ યજદેજરદી. ઈંગ્રેજી તા० ૬ થી આગશટથી તા० ૫ મી સપ્ટેમ્બર ૧૯૨૦ સુધી. હીંદુઓનાં સંવત ૧૯૭૬ નાં શ્રાવણ અધીક વદ ૭ ને વાર સુકર તે બીજા શ્રાવણ વદ ૧૨ ને વાર ગુરૂ સુધી.
૧—અહુરમજદ.	ગા.	સુકર	૬	૭	ગાથા ૧ લો કદમી, હમસપથમદેમ ઘંબાર કદમી.
૨—બહમન....	ગા.	શની.	૭	૮	ગાથા ૨ જો ઓસતુઅદ. કદમી.
૩—અરદીબેશત.	ગા.	રવી.	૮	૯	ગાથા ૩ જો સપેનતોમદ. શે. હમકારો.
૪—શેહેરેવર...	ગા.	સોમં	૯	૧૦	ગાથા ૪ થો વાહુક્ષથર, કદમી. ઈંગ્લાંડમાં નામદાર શેહનશાહ [એડવર્ડની ૧૯૦૨ માંરાજ્યભીસેક થયો }
૫—સફંદારમદ.	ગા.	ભોમ	૧૦	૧૧	મું०માંમુસ० હીંદુ વચેમોટું હુલડ, ૧૮૯૩ ગાથાપમોઃવહસતોઈસત કદમી. શે० સપં०નું જશન. દશતુરજી એ०દા० શનજાંણ ગુ० ય०, ૧૨૧૬. શેઠ ડો० શો० મુનશી ગુ०, ૧૨૩૯ ડા કે. નસ. બાહાદુરજી ગુજરયા ય० ૧૨૬૭.
૬—ખુરદાદ....	૧	બુધ.	૧૧	૧૨	કદમી સને૧૨૯०ય० નું નવું વરસ. [તુરમેરજીરાણાં ગુ० ય० ૯૬
૭—અમરદાદ..	૨	ગુરૂ.	૧૨	૧૩	એનેસ્ટીનું મરણ ૧૮૭૩ [હમકારો નોશારીનાંવડા દશ • }
૮—દેપાદર.....	૩	શુકર.	૧૩	૧૪	કદમી રમીથવન ઈજવાનો દીવસ, તથા કદમી અરદીબેરત રોજનો]
૯—આદર	૪	શની.	૧૪	૩०	શેહનશાહી હમકારો. કલકતાની ઈ० ઈ० રેલવે ચાલી, ૧૮૫૪.
૧૦—આવાં.....	૫	રવી.	૧૫	૧	બીજો **શ્રાવણ** ચાંદરાત
૧૧—ખુરશીદ...	૬	સોમ.	૧૬	૩	કદમી ખુરદાદ શાલ.
૧૨—મોહોર	૭	ભોમ.	૧૭	૪	કદમીઓનો અમરદાદ શાલ-(વરાવો)
૧૩—તીર....	૮	બુધ.	૧૮	૫	નાગ પાંચમી
૧૪—ગોશ......	૯	ગુરૂ	૧૯	૬	કદમી આદર રોજનો હમકારો.
૧૫—દેપમેહેર...	૧૦	શુકર.	૨०	૭	
૧૬—મેહેર.....	૧૧	શની.	૨૧	૮	
૧૭—સરોશ. ...	૧૨	રવી.	૨૨	૮	શે० હમકારો
૧૮—રશને.....	૧૩	સોમ.	૨૩	૯	તુલશીતલાવ વેઆર સાથે જોડી નાખ્યો ૧૮૭૨.
૧૯—ફ્રરવરદીન.	૧૪	ભોમ.	૨૪	૧०	શે० અસોફ્રરોહરનું જશન. અંગ્રેજો લખનોરમાં દાખલ થયા, ૧૮૫૭.
૨૦—બેહેરાંમ...	૧૫	બુધ.	૨૫	૧૧	પ્રીનશ આલબરટ જન્મયો ૧૮૧૯. શે० હમકારો. શુનાબાઇ]
૨૧—રાંમ......	૧૬	ગુરૂ..	૨૬	૧૨	{ હીરજી રેડીમણીનાં ગોવાલ્યા તલાવના આદ્રાંનને }
					{ ૧૦૭. શુરત બેરાંમપોરીભાગલ પાસેની દરે० ને ૮૧.]
૨૨—ગુવાદ.....	૧૭	શુકર.	૨૭	૧૩	ક० સરોશ રો० હમકારો. બાંદુરકોટ દાદીશેઠના આતશબે. ૧૩૮]
					(એવેનાજ કોટેકોટના ક० આદરાંનને ૧૧૭. કલકતામાના ફ્ર०
					) કા० બનાજીના આદરાંનને ૮૧ મું. ભીડીબજારના મે० માં० }
					) પટેલના આદરાંનને ૧૧૩. યઝ० ૧૧૫૨માં મુંબઈમાં કેટલાક]
૨૩—દેપદીન. ..	૧૮	શની.	૨૮	૧૪	([પારસીઓએ કદમી તરીકો અખત્યાર કાધો.]
૨૪—દીન......	૧૯	રવી	૨૯	૧૫	નારીયેલી પુનમ ક० ફ્રરવરદીનનું જશન.
૨૫—અરશેસવંગ	૨૦	સોમ.	૩०	૧	ક० બેરાંમ રોજનો હમકારો. શેનશાહીઓના મુકતાદ શરૂ થયાં.
૨૬—આસતાદ..	૨૧	ભોમ.	૩૧	૨	[શીડંથી શે० બાંતુને સ્વાધીન થયું. પા०ધારો પસાર થયો ૧૮૬૫.]
૨૭—આસમાંન.	૨૨	બુધ.	૧	૩	**સપ્ટેમ્બર માસ.** ૧૮૫૮ માં હીંદુસ્થાંનનું રાજ ઈ० ઈ० કું० }
૨૮—જમીઆદ..	૨૩	ગુરૂ.	૨	૪	
૨૯—મારેસફંદ.	૨૪	શુકર.	૩	૫	શે० મીનો મારેશપંદનું જશન.
૩૦—અનેરાં....	૨૫	શની.	૪	૬	
૧—અહુનુઅદ..	૨૬	રવી.	૫	૭	ગોકુલ આઠમ. શે० ગાથા ૧ લો. ઘંબાર શરૂ થયા. શેઠ બેરામજી)
૨—ઓશતુઅદ	૨૭	સોમ.	૬	૮	ગાથા ૨ જો. { જીજીભાઈ સી. એસ આઈ. ગુજર્યાં ય. ૧૨૫૯ {
૩—સપેનતોમદ	૨૮	ભોમ.	૭	૯	ગાથા ૩ જો. { સર જ० જી. એ. ગહમબારો કરવા. {
૪—વોહુખશથર	૨૯	બુધ.	૮	૧૧	ગાથા ૪ થો. { માંડયા—યજદે ૧૧૯૭. }
૫—વહીસ્તોયસ્ત	૩०	ગુરૂ..	૯	૧૨	ગાથા ૫ મો.

જાહેર ખબરો.

ફીલીમોરની કું.

હાઈ કલાસ, કેમીસ્ટ, ડ્રગીસ્ત, તથા વાઇન મરચંટસ.

ખંબાલા હીલ—મુંબઇ.

હમારે ત્યાં

સરવે પ્રકારનો ઉંચો દારૂકામ, બીર, વાઇન, લીકયોર,

વીગેરે કીફાયત ભાવથી મલશે.

જાણીતા મેકરોની બીસકીટસ, તથા પ્રોવીઝન, જામ, જેલી વીગેરે

ચીજો ખાત્રી પુરવક તાજો માલ મલશે.

સ્વીટસ, ચોકોલેટ, કરેકરસ, બોનબોન્સ, અને બીજી ભેટ
આપવા લાયક ચીજોની વેરાયટીઝ તઇયાર છે.

સાબુ, લવંડર, ઉંચા સેંટો જાનીતા મેકરનાં હમેશ મલી શકશે.

હમારી નીચલી ખાસ બનાવેલી દવાઓ દરદીને તુરત આરામ આપી હુશીયાર બનાવે છે. સ્પેશ્યલ ફીવર અને એગયુકયુર, ઈનફલુચેનસ કયુર, કોલેરા ડ્રોપ્સ, કફની સ્પેશ્યલ લોંકટસ, ડીલ વોટર, લાઇમ વોટર વીગેરે, અજમાવી ખાત્રી કરો.

જરથોશતીઓએ સ્થાપેલાં આતશબેહરામો.

મુંબઇ મધેના આતશબેહરામો.

ઠેકાણાં. કોણે પરઠેલાં યાને બંધાવેલાં.	રોજ.	માહ.	ય સને શે.	કે દ.
ફરેલવાડી–કાવશજી બેરામજી બનાજીની નઇયતે	૧૭	૪	૧૨૧૫	કદમી
ચરનીવાડી–હોરમજજી બમનજી વાડીઆજી	૧૭	૨	૧૨૮૦	શેનશાહી
,, જરથોસતી અંજુમને સ્થાપેલાં	૩	૨	૧૨૬૭	,,
બહારકોટ–દાદીભાઇ નશરવાનજી દાદીશેઠ	૧૭	૧	૧૧૫૩	કદમી

દેશાવરો ખાતેના આતશબેહરામો.

ઉદવાડા–અવલ જરથોસ્તી અનજુમને શંજાણમાં સ્થાપેલાં ને હાલ ઉદવાડામાં છે (૧)*	૯	૯	૯૦	શેનશાહી
નવસારી–ખુરશેદજી ટેમુલજી દેશાઇજી (૨)	૧૭	૧	૧૧૩૫	,,
સુરત–દાદાભાઇ નશરવાનજી મોદી	૧૭	૨	૧૧૯૩	,,
,, પેશતનજી કાલાભાઇ વકીલ	૩	૪	૧૧૯૩	કદમી

જરથોસ્તીઓએ સ્થાપેલી દરેહમેહેરો તથા આતશ દાદગાંઓ.

મુંબઇ મધેની દરેહમેહેરો તથા આતશ દાદગાંઓ.

ફરેલવાડી–કાવશજી બેરામજી બનાજી (આતશ બેહરામમાં)	૨૦	૧	૧૨૧૪	કદમી
કાંદાવારો મોહલો–નશરવાનજી હીરજીભાઇ કરાંની	૨૦	૬	૧૨૧૬	શેનશાહી
કોટમાં–ખરશેદજી માણેકજી સરાફ (૩)	૨૬	૨	૧૧૮૬	,,
,, બનાજી લીમજી (૪)	૯	૯	૧૦૭૮	,,
,, માણેકજી નવરોજી શેઠનાં (૫)	૯	૯	૧૧૦૨	,,
,, મોટલાંબાઇ જેહાંગીર નશરવાનજી વાડીયા ...	૨૦	૯	૧૨૩૨	,,
,, ગોડાવરા મોબેદો માટે પંચાયતે બાંધેલી	૩	૫	૧૧૯૫	,,
,, મનચેરજી ખરશેદજી લંગડાનાં (૬)	૧૫	૭	૧૨૧૭	,,
કોટેકોટ– અરદેશર દાદીભાઇ દાદીશેઠ	૧૭	૧	૧૧૭૩	કદમી
,, પીરોજબાઇ તે દાદાભાઇ માણેકજી વાછાના વીધવા ...	૩	૯	૧૨૫૦	શેનશાહી
કોલાબે–જીજીભાઇ દાદાભાઇ	૧૭	૬	૧૨૦૫	,,
ખેતવાડી–કાવશજી માણેકજી હાશબરનર	૯	૯	૧૨૦૧	કદમી
,, પાલનજી ખરશેદજી કામા (કામા બાગમાં) ...	૧૭	૯	૧૨૩૮	શેનશાહી
ગ્રાંટરોડ–સોરાબજી હોરમજી રાંનજી	૩	૮	૧૨૩૭	,,
,, દોરાબજી એ. જમસીના અથવા મીઠાઇવાલા ...	૯	૯	૧૨૮૦	,,
ગોવાલ્યાતલાવ–સુનાબાઇ હીરજી જીવણજી રેડીમની (૭) ...	૨૦	૧૨	૧૨૧૧	,,

* આં લખેલા નંબરોવાલી દરેહમેહેરને લગતી બીગતો દરેહમેહેરોના ઓસટની સેવરે જણાવેલી છે.

ઠેકાણાં.	દરેહમેહેરો કોણે બંધાવેલી.	રોજ.	માહા.	ય. સને.	શે કે ક.
ચરનીવાડી–	હોરમજી બમનજી વાહાડયા (આતશબેહેરામમાં)	૨૦	૨	૧૧૭૫	શેનશાહી
ચોપાટી–	મોદી સોરાબજી વાછાગાંધીના વારેસો	૧૭	૬	૧૨૨૭	કદમી
ડનકનરોડ–	હોરમજી ધનજીભાઇ પટેલ	૧૭	૫	૧૨૦૩	શેનશાહી
ધોબીતલાવ–	આવાંબાઇ તે અ૦ ખ૦ વાડીઆજીના ધ૦ (૮)	૨૪	૭	૧૨૩૨	„
પરેલ–	દાદાભાઇ તથા મનચેરજી પેશતનજી વાડીઆ (૯) ...	૨૦	૧૧	૧૨૦૩	„
„	દીનબાઈ ન. પીટીટે જ.ન. પીટીટ આરફનેજમાં પરદાવેલી	૩	૭	૧૨૬૬	„
બહારકોટ–	મનચેરજી બમનજી શેઠના(૧૦)	૧૭	૨	૧૧૬૬	„
„	શાપુરજી સોરાબજી કપાવાલા	૧૭	૨	૧૨૨૮	„
ભાયખલા–	બમનજી મેરવાનજી મેવાવાલા (૧૧)	૧૭	૪	૧૨૨૦	„
ભીંડીબજાર–	મેરવાનજી માણેકજી પટેલ (૧૨)	૧૭	૧૨	૧૧૭૭	„
મજગામ–	ફરામજી નશરવાનજી પટેલ(૧૩)	૧૧	૩	૧૨૧૫	કદમી
„	નાનાભાઇ જમશેદજી સપલાની નઇઅતે(૧૪) ...	૧૪	૮	૧૨૩૬	શેનશાહી
„	અનજુમનને ખરચે	૯	૫	૧૨૭૬	„
મરીનલાઇન–	જમશેદજી દાદા. આમરીઆ (સોડાવાટરવાલા)(૧૫)	૨૮	૨	૧૨૪૪	„
મહાલક્ષમી–	બેરામજી કાવસજી બાટલીવાલા	૨૦	૪	૧૨૩૪	„
„	હોરમજી દાદાભાઇ શાએર	૧૭	૭	૧૨૧૪	કદમી
માહીમ–	મનચેરજી બમનજી કુપરે સ્થાપેલી અને પાછળથી શાપુરજી જ૦ દાજીએ બંધાવેલી (દાદગાં)(૧૬)...	૪	૨	૧૨૩૬	શેનશાહી
„	એદલજી રૂશતમજી સુનાવાલાએ ધણીઆણી સુનાબાઇની નઇયતે (દાદગાં)	૧૭	૯	૧૨૮૨	„
વાલકેશ્વર–	શીરાબજી ખરશેદજી શુંઠીનાની નઇએતે ...	૭	૯	૧૨૨૮	કદમી
દાદર–	નવરોજી કાવસજી નાલીએરવાલા (૧૭)	૩	૧૦	૧૧૯૧	શેનશાહી
વાંદરે–	નશરવાનજી રતનજી તાતા	૨૦	૬	૧૨૫૩	„

☞ મુંબઈની ઉપલી જાહેર દરેહમેહરો, આતશ આદરાંનોની ઉપરાંત બીજી કેટલાંક દાદગાંઓની દરેહમેહરો છે જેવીકે [૧] બાહારકોટની અસાઈબાગની, (૨) કોલાબેની પાંડે ક્રેનીઠરીઅમની, (૩) ગીરગામની આલબલેસ બાગમાંની, [૪] ગીરગાંમ બેકરોડપરની અશલાજીની અને (૫) વાલકેશવરમાં રેડીમનીની.

દેશાવરો ખાતેની દરેહમેહેરો તથા આતશ દાદગાંઓ.

ઠેકાણાં.	દરેહમેહેરો કોણે બંધાવેલી.	રોજ.	માહા.	ય. સને.	શે કે ક.
અંકલેશર–	નરશંગ ધમપાલ (૧૮)			૯૧૯	શેનશાહી
અજમેર–	નવરોજી રૂસતમજી કલીઆણીવાલાના પુણ માટે ...	૮	૧૧	૧૨૬૭	„
અંદેરી–	અરદેશર ભીખાજી પટેલ	૯	૯	૧૨૭૭	„
અમદનગર–	જમશેદજી પેશતનજી પલાનટી	૯	૮	૧૨૧૬	„
અમદાવાદ–	ખરશેદજી બેરામજી નાણાવતી (૧૯)	૨૩	૧૦	૧૨૧૫	„
અમરોલી–	હોરમજી બમનજી વાહડયા (૨૦)	૧૭	૨	૧૧૭૩	„
„	કાનજીભાઇ દોરાબજી મીઠાઇવાલા(૨૦)	૯	૪	૧૨૬૩	„
અડાજણ–	સર જમશેદજી જીજીભાઇ પેહલા બારોનેટ ...	૨૦	૯	૧૧૯૬	„
આલપાઇ–	નવરોજી કાવસજી નાલીએરવાલા	...		...	„
ઇગતપુરા–	અંજુમનને ખરચે	૫	૧૦	૧૨૫૬	„
ઇછાપોર–	કાવસજી ધનજીભાઈ પાઉવાલા તથા ભત્રીજા ...	૫	૮	૧૨૧૬	„

ઠેકાણા. કોણે પરદેલાં યાને બંધાવેલાં.	રોજ.	માહ.	ય. સને	શે. કે ક.
ઇનડોર–હોરમજી માણેકજી ભમગરા (૨૧) … …	૧૦	૮	૧૨૪૮	શેનશાહી
ઉદવાડા–સર દીનશાજી માણેકજી પીટીટ બારોનેટે બંધાવેલું આતશબેરામને લગતું મકાન … … …	૨૦	૯	૧૨૬૦	,,
ઉરન–કુવરજી તથા બેરામજી એદલજી ઉમરીગર … …	૨૩	૨	૧૨૭૪	,,
એડન–કાવશજી દીનશાજી એડનવાલા … … …	૨૦	૧	૧૨૫૩	,,
એબાવ–આ૦ કાઉશ ખુરશેદજી કામદીન (૨૨) … …	૨૦	૧૨	૧૦૭૧	,,
આંકોલા–દ૦ નશરવાનજી જામાસ્પજી જામાસ્પઆશા (૨૩) …	૨૪	૨	૧૨૩૯	,,
કચ્છ-ભુજ–પેશતનજી સોરાબજી ભુજવાલા (૨૪) … …	૨૩	૯	૧૨૭૪	,,
કરંજ–પેસ્તનજી, હીરજીભાઇ, પીરોશા હોરમજી પસ્તાકયા …	૨૭	૪	૧૨૧૫	,,
કરાંચી–ડોશાભાઈ મેરવાનજી બાહડયાની યાદગારી માટે(૨૫)	૯	૯	૧૨૩૯	,,
,, હીરજીભાઈ જમશેદજી બેહરાનાં (૨૬) … …	૯	૮	૧૨૧૮	,,
કલકતા–ધનજીભાઇ બે. મેહતાનાં અંજુમનનાં આતશઆદરાન(૨૭)	૯	૯	૧૨૫૯	,,
,, રૂશતમજી કાવસજી બનાજી … … …	૧૭	૧	૧૨૦૯	કદમી
કલ્યાણી–એદલજી બેરાંમજી મોદી (૨૮) … …	૧૭	૨	૧૧૫૮	શેનશાહી
કવેતા–અનજુમનના ઉધરાટથી (૨૯) … … …	૧૭	૯	૧૧૫૨	,,
કુદીઆના–મનચેરજી કુવરજી ભાઠેના, હોરમજી માણેકજી કુદીઆનાવાલા … … … …	૭	૭	૧૨૧૯	,,
ખમ્ભેત–એહરાંમજી હીરાજી કોહલા … … …	૧૮	૯	૧૨૧૫	,,
ખંબાત–પેસતનજી ખરશેદજી મોદી, ખંબાતવાલા… …	૧૭	૪	૧૨૧૩	,,
ખેરગામ–મોતીબાઇ તે બમનજી જ૦ મુલ્લાંના વીધવા …	૫	૯	૧૨૫૧	,,
ગનદેવી–હોરમજી ભીખાજી ચીનાઇ, વલસાડવાલા … …	૭	૯	૧૨૦૩	,,
ચીકલી–દોરાબજી તથા ફરામજી હોરમજી ગજદર (૩૦) …	૧૭	૬	૧૨૪૨	,,
જંગબાર–દોરાબજી દીનશાહ એદનવાલા (દાદગાં) … …	૧૩	૯	૧૨૬૪	,,
જામનગર–ટેમુલજી માહીઆરજી મીરજાં … …	૧	૭	૧૨૬૪	,,
જાહાંબોરડી–અંજુમનના ખરચે … … …	૨૦	૯	૧૨૮૫	,,
તવરી–એદલજી બ્યાજબોરા (૩૧) … … …	૧૪	૬	૧૨૩૮	,,
,, અનજુમન … … … …	૩	૮	૧૨૩૮	,,
તારાપોર–વીકાજી મેહેરજીભાઇ તારાપોરવાલા(૩૨) … …	૯	૯	૧૧૮૯	,,
તેહરાન–(ઇરાનમા)–અંનજુમનને ખરચે … …	૨૬	૪	૧૨૮૬	કદમી
થાણા–કાવસજી તથા દોરાબજી રૂશતમજી પટેલ (૩૩) …	૯	૭	૧૧૫૦	શેનશાહી
દમણ–મેરવાનજી નવરોજી માણેકજી … … …	૮	૬	૧૨૦૭	,,
,, રતનબાઇ હોરમજી મનચેરજી કામા (૩૪) … …	……		૧૨૧૫	,,
દવીહેર–નવાજબાઇ તે જાંગીરજી નવરોજી ઘાસીઆના ધણીયાણી	૩	૯	૧૨૨૪	,,
દીવ–જેહાંગીર નશરવાનજી વાડીઆજી … …	૨૬	૫	૧૧૯૯	,,
ડુમસ–સુરતની અનજુમને (૩૫) … … …	૨૬	૬	૧૨૦૭	,,
દેવલાલી–રતનબાઈ જમશેદજી ચીનાઇ … … …	૧૭	૨	૧૨૮૬	,,
નવસારી–નવસારીની વડી દરેહમેહર (૩૬) … …	…		૫૫૧	,,
,, સર જમશેદજી જીજીભાઇ પેહલા બારોનેટ … …	૨૦	૬	૧૨૨૨	,,
,, મલેશરની અંજુમને … … …	૧૯	૧	૧૧૬૭	,,
,, મીનોચેર હોમજીવાલાઓએ બાંધેલી (૩૭) …	…		૧૧૫૮	,,
નાગપોર–હીરાબાઇ નશરવાનજી માણેકજી મુલ્લાં … …	૨૦	૨	૧૨૬૫	,,
નારગોલ–માણેકજી રૂ. નારગોલવાલા તથા ભાઇઓ (૩૮) …	૧૧	૧૦	૧૨૫૧	,,

[એનું અસલ મકાન દાદા, નરા, માટીનું બંધાવેલું હતું]

ઠેકાણું કોણે પરહેઝાં યાને બંધાંવેલાં.	રોજ.	માહા.	ય. સને	શે. કે ક.
નીમચ–કાવસજી જીવણજી મેવાવાલાની નઇએતે	૫	૫	૧૨૬૭	શેનશાહી
પારડી–હોરમજી ગાંડાભાઇ (દાદગાં)	૧૭	૯	૧૨૫૦	,,
પુણાં–નાનાપેટ–સોરાબજી રતનજી પટેલ (૩૯)	૮	૧૧	૧૧૯૩	,,
,, કાંપ–સર જમશેદજી જીજીભાઈ પેહલા બારોનેટ ...	૩	૩	૧૨૧૪	,,
,, કદમી અને શેનશાહી અંજુમનને ખરચે	૩	૩	૧૨૬૩	કદમી
બદનેરા–અંજુમનને ખરચે	૬	૪	૧૨૫૮	શેનશાહી
બારડોલી–નવસારીવાલા એદલજી નવરોજી મેહેતા	૯	૪	૧૨૫૫	,,
બાલાપુર–હૈદ્રાબાદ–દખણ–વીકાજી તથા પેશતનજી મેહેરજી (૪૦)	૨૦	૬	૧૨૦૮	,,
બીલીમોરા–દાદાભાઇ ધનજીભાઇ અને સોરાબજી શાપુરજીએ બાંધેલી–અનજુમનને ખરચે ચાલતી (૪૧) ...	૯	૯	૧૨૬૮	,,
,, નવરોજી જમશેદજી વાહાડીઆ (દાદગાં) (૪૧) ...	૨૦	૧૦	૧૧૬૭	,,
એદ્દગામ–પેસતનજી ખુરશેદજી બાઈસે ભાઇઓ એદલજી તથા નાનાભાઇના પુન માટે (દાદગાં) (૪૨)	૨૪	૩	૧૨૬૧	,,
ભગવાગાંમ–જમશેદજી શોરાબજી ભગવાગર	૩	૯	૧૨૨૮	,,
ભરૂચ–જુની અગીઆરી	...		...	,,
,, હોરમજી બેરાંમજી વખારીઆની નઇએતે	૨૭	૬	૧૨૫૨	,,
,, કોટ–હોમાજી દારાબજી (હોમાવારાની દરેમેહેર) (૪૩)...	૩	૫	૧૧૨૯	,,
,, પ્રાસવાર–હીરાંબાઈ તે નવરોજી કાવસજી નારયલવાલાના વીધવા (૪૪)	૯	૯	૧૨૦૦	,,
,, કોટ–સોરાબજી ધનજીભાઇ ખંબાતા	૨૪	૧	૧૨૨૭	,,
,, બાહારકોટ–દસ્તુર કાંમદીનજી ફરદુનજી	...		૧૧૪૭	,,
,, ,, રૂસતમજી માણે૦ હીરાવરાના, સુરતવાલા (૪૫)	...		૧૦૯૬	,,
ભાઠાગામ–વીરજીબાઈ બમનજી સુરતવાલા (૪૬)	૧૭	૬	૧૧૭૩	,,
ભાવનગર–દોરાબજી શાપુરજી ઉમરીગરના વારસો	૨૮	૮	૧૨૬૦	,,
બેશાન–દાદાભાઇ તથા મનચેરજી પેસ્તનજી વાડીઆ (૪૭) ...	૧૧	૫	૧૨૧૫	,,
મઉ–અંજુમનને ખરચે (૪૮)	૯	૬	૧૨૧૫	,,
મંદરોઇ–અંજુમનના ઉપરાટથી–નશરવાનજી મા. પીટીટે ...	૧૨	૪	૧૨૨૯	,,
મધરાસ–ફીરોઝ મનચેરજી કલબવાલાએ પોતાના બેટા જાલના પુન માટે	૨૯	૧૧	૧૨૭૯	,,
મહુવા–અંનજુમનના ખરચે (૪૯)	૯	૪	૧૨૨૭	,,
મેથેરભાત–(ગંનદેવીની પાસે) અંજુમનનાં ખરચે	૫	૪	૧૨૫૩	,,
માંડવી–અંજુમનને ખરચે	૩	૯	૧૨૪૩	,,
રાજકોટ–અંજુમનના ખરચે	૩	૯	૧૨૪૪	,,
રંગુન–બેજનજી કાવશજી ખંબાતા(૫૦)			૧૨૩૬	,,
રાંદેર–દારાશાહ દોરાબજી રાંદેલીઆ(૫૧)...	૧૭	૯	૧૨૦૩	,,
બાનોલી–કાવશજી દીનશાહ એડનવાલા	૨૨	૯	૧૨૬૮	,,
લાહોર–અરદેશર બેહેરામજી લીંબુવાલા–કુપર (૫૨) ...	૧૭	૧૧	૧૨૬૨	,,
વ્યારાગામ–દીનબાઈ નશરવાનજી પીટીટ...	૬	૩	૧૨૬૫	,,
વડોદરા–ધનબઇ તે દાદાભાઇ બીમજી ઉમરીગરના ધ૦ (૫૩)...	૭	૫	૧૨૧૫	,,
,, બેરાંમજી નસરવાનજી શીરવાઇ (દાદગાં) (૫૪) ...	૨૦	૨	૧૨૩૮	,,
વલસાડ–નવરોજી પેશતનજી કાપડીઆ (દાદગાં)	૨૬	૪	૧૨૪૯	,,
,, મોટાભાઇ શાપુરજી	૧૬	૯	૧૨૧૯	,,
,, હોરમજી બીખાજી ચીનાઇ (દાદગાં) (૫૫)... ...	...		૧૧૮૯	,,
વેશુ–એડનવાલા માણેકજી રતનજી પટેલ	૩	૯	૧૨૫૮	,,
સકર-સીંધ–અંજુમનને ખરચે (દાદગાં)	૧૨	૭	૧૨૮૬	,,

ઠેકાણું. કોણે પરઠેલાં યાને બંધાવેલાં.	રોજ.	માહા.	ય. સને	શે. કે ક.
[illegible]રોડા–ખ. ૪. પારખ તથા ત્યાંનાં એક વખતની મલીને (૫૬)	…		૧૨૩૩	શેનશાહી
સીકંદરાબાદ–દખણુ–વીકાજી તથા પેસતનજી મેહેરજી (૫૭) …	૯	૧૨	૧૨૦૮	,,
સીમનપોર–નવરોજી જમશેદજી વાડીઆ (૫૮) …	૧૭	૨	૧૨૧૯	,,
સોનગર-વ્યારા–અનજુમનને ખરચે … … …	…		૧૨૩૧	,,
સુમારી–હોમીયાર પહાલણ (૫૯) … … …	…		૧૦૪૦	,,
,, દાદાભાઇ તથા કાવસજી પાલનજી ચીના … …	૨૭	૭	૧૨૫૬	,,
સુરત–કેલાંની વખાર–અનજુમનને ખરચે … …	૩	૮	૧૨૦૮	,,
,, ગોપીપરે–જાંગીર નશરવાનજી વાડીઆ (દાહગાં) …	૧	૭	૧૨૧૦	,,
,, ,, દોરાબજી નસરવાનજી મીસતરી (દાહગાં) (૬૦)	૨૯	૧૦	૧૨૩૫	,,
,, નાનપરે–એદલજી તથા રતનજી બેરાંમજી બીશની (૬૧)	૧૭	૪	૧૨૦૭	,,
,, ,, આ૦ જમશેદજી માંણેકજી ઉનવાલા (દાહગાં)	૧	૧૨	૧૨૩૮	,,
,, ,, કાવશજી જમશેદજી માકીદલાલ … …	૧૭	૯	૧૨૧૪	કદમી
,, ,, માણેકજી નારોજી વાડીઆ (૬૨) …	૧૫	૯	૧૨૦૬	શેનશાહી
,, માછલીપીટ–"બાગે પારશા"–અનજુમનને ખરચે …	૧૭	૬	૧૨૬૫	,,
,, રૂસતમપરે–પેશતનજી નશરવાનજી બાટલીવાલા (૬૩)	૨૨	૧૨	૧૨૧૯	,,
,, ,, સર જમશેદજી જીજીભાઇ પેહલા બારોનેટ …	૧૭	૨	૧૨૨૪	,,
,, ,, દેશાઇ મનચેરજી ખુરશેદજી (૬૪) …	૨૦	૧૨	૧૧૭૫	,,
,, ,, રૂશ૦ અસપંદીઆરજી આરીટનવાલા (૬૫)…	૧૭	૪	૧૧૯૨	,,
,, લકરકોટ–ગોટીનાં ખાનદાંનવાલાઓએ બાંધેલું (૬૬) ..	૧	૭	૧૧૬૫	,,
,, શાઇયંદપુરે–દાદા. અને મનચેરજી પેસતનજી વાડીઆ(૬૭)	૨	૧૦	૧૨૧૩	,,
,, ,, મુંબઇના વાડીઆજીવાલાઓએ સ્થાપેલી (૬૮)	૫	૪	૧૨૫૮	,,
,, બીબીનીવાડી–અનજુમનને ખરચે (૬૯) … … …				
,, શાહાપોર–ફરાંમજી હો. કોમીસરીએટવાળાના પુનમાટે ધણીયાણી બાનુબાઇએ કુકાવાળી પારસી આરફનેજમાં (દાહગાં)	૯	૫	૧૨૮૫	,,
સતારા–અનજુમનને ખરચે (૭૦) … … …	…		…	
સોલાપુર–વીકાજી તથા પેસતનજી મેહેરજી (૭૧) … …	૯	૫	૧૨૧૪	,,
[illegible]સોત–ભીખાઇજી તે સર દીનશાહ માણેકજી પીટીટ બારોનેટનાં બેટીનાં પુનને માટે … … … …	૨૬	૧૧	૧૨૬૮	,,
હેદ્રાબાદ–દખણુ––ચંદરઘાટમાં–માણેકબાઈ ન. ચીનાઇ …	૩	૨	૧૨૭૪	,,

(૧) આ ઉદવાડેના ઇરાનસાહ આતશબેહેરામ સાહેબને પેહલવેહલા સંજાણમાં શેહેનશાહી ય. સને ૯૦ માં સ્થાપ્યા પછી નવસારી, સુરત વગેરે ઠેકાણે એ આતશબેહેરામને લઇ જવા પછી ઉડવાડા ખાતે તા૦ ૨૮ મી અકટોબર ૧૪૭૨ ને દીને લાવવામા આવ્યા હતા, જે આજદીન સુધી છે. ઉડવાડા ખાતે આતશબેહેરામનું પેહલવેહલું નાનું મકાન નરગોશના બેહેદીન મીનોચેહર બહમને ય. સને ૧૧૧૨ માં બંધાવ્યા પછી સુરતવાલા શેઠ ભીખાજી એદલજીએ મોટું મકાન ય૦ સને ૧૨૨૧ માં બંધાવ્યા બાદ મુંબઇવાલા શેઠો દાદાભાઇ અને મનચેરજી પેસતનજી વાહાડયાએ મોટું મકાન ૧૧૬૦૦૭ ના ખરચે બંધાવી રોજ ૨૭ મો માહા ૬ ઠો સને ૧૧૯૮ ય. ને દીને પરઠાવ્યું હતું. તે પછી ઘણું મોટું ને રૂસાડ મકાન બાઈ મોટલાબાઈ જાહાંગીર વાડયાની રૂ૮૦૦૦૦ ની સખાવતથી બંધાઈ તેમાં રોજ ૧૬ મો માહા ૨ જો ૧૨૬૪ યઝદેજરદીને દીને આતશબેહેરામમા વુરી કેબલાને તખતનશીન કરવામાં આવ્યા હતા. એ મકાનમાં કેટલુંક રીપેર કરાવી તેમાં ઘટતો ફેરફાર મરહુમ શેઠ નવરોજી માણેકજી વાહાડયાના ટરસ્ટીઓએ કરાવી તેને ઇજી [illegible] [illegible] દીધા રોજ ૧૨ મો માહા ૧૧ મો ય. સને ૧૨૮૨ ને દીને થઇ હતી.

(૨) આ આતશબેહેરામનું મકાન પુરાણું થવાથી દેશાઇ કાવશજી એરચજી તે ગોંડલના માજી કારભારીએ ફરીથી રોજ ૧ લો માહ ૧૦ મો શેહેનશાહી સને ૧૨૬૦ યજદેઝરદીને દીને સમરાવી આપયું છે.

(૩) આ દરેમેહેર પેહલી યઝદેઝરદી સને ૧૧૬૦ માં શેઠ માણેકજી હેરાબજી સરાફે ચોપાટી મધે પોતાની વાડીમાં બંધાવેલી હતી, તાંહાંથી યઝદેઝરદી સને ૧૧૮૬ માં તેમના બેટાએ કોટમાં લાવી પરહેલી છે. તે મકાનબી પુરાણું થવાથી એ દરેમેહેરનાં મુતવલીઓ શેઠ સરાફનાં વારેશીએ રોજ ૨૬ મો માહ ૨ જો સને ૧૨૬૪ ને દીને યાને એ દરેમેહેરની ૭૮ માં વરશની શાલગરેહને દીને ફરીથી નવેસરથી મકાન બંધાવી ખુલ્લું મેલ્યું છે.

(૪) આ પુરાતમ દરેમેહરનું મકાન જુનું થવાથી શેઠ હોરમજજી રતનજી માણેકજી બનાજીની આગેવાની હેઠલ બનાજી કુટુંબના કેટલાક સાહેબોએ પોત પોતામાં ફંડ ઉભું કરી નવેસરથી બંધાવીને તેમાં રોજ ૨૦ મો માહા ૭ મો શેહેનશાહી સને ૧૨૧૪ યઝદેઝરદીને દીને જુના આદરાન સાહેબને પાછા તખ્તનશીન કીધા હતા.

(૫) આ દરેમેહેર પુરાણી થવાથી મરહુમ શેઠ માણેકજી નવરોજી શેઠનાના મુતવલી શેઠ જાલભાઈ અરદેશર શેઠનાએ રૂપીઆ એક લાખ ખરચી ઇરાનની અસલી ઢપપર રોજ ૧૦ મો માહા ૨ જો યઝદેઝરદી ૧૨૬૧ ને દીને નવેસરથી બાંધી હતી.

(૬) આ દરેમેહેરનું મકાન પુરાણું થવાથી રોજ ૧૦ મો માહા ૮ મો સને ૧૨૬૪ ને દીને શેઠ પેસતનજી મેરવાનજી ગોદીવાલાએ પોતાની મરહુમ બેટી પીરોજબાઇનાં પુણ માટે નવેશરથી બાંધી આપીયું છે.

(૭) આ દરેમેહેર આગળ યઝદેજરદી સને ૧૧૮૨ માં એરવદ હોરાબજી હોરમજી રાંનજીએ બંધાવી હતી.

(૮) એ દરેમેહેરની પાસે આવેલી મરહુમ શેઠ રૂસતમજી સોરાબજી ભરૂચા તથા ઈંડાવાલાની જુની દરેમેહેરનું મકાન તેના વારેશોએ એ વાહાડયાજીવાલી દરેમેહેરની સાથે જોડી નાખીને વાપરવા માટે ધરમ ખાતે આપી દીધાથી એ પુરાણું મકાન મરહુમ ઓનરેબલ શેઠ નવરોજી નશરવાનજી વાહાડયા સી. આઇ. ઈ. એ નવેસરથી બંધાવીને રોજ ૮ મો માહા ૮ મો શેહેનશાહી સને ૧૨૬૮ ને દીને ઇજાવ્યું હતું.

(૯) આ વાહાડયાજીવાલા આતશ આદરાનનાં કેબલાને પેહલવેહલા લાલબાગના મકાનમાં રોજ ૨૦ મો માહા ૧૧ મો ૧૨૦૩ ને દીને પરહેલા હતા, તે પછી આ આદરાનના કેબલાને શેઠ વાહાડયાજીના આતશબેહેરામમાં થોડો વખત લઇ જઈ રાખયા હતા. એ પછી લાલબાગની પાસે આવેલી પોતાની જગામાં શેઠ મનચેરજી જમશેદજી વાહાડયાએ નવું મકાન બાંધવા માંડેલું તેટલા એવણ મરણ પામવાથી એવોના બેટાઓ શેઠો નશરવાનજી અને બરજોરજી મ. વાહાડયાએ રોજ ૨૦ મો માહા ૧૧ મો ય. સને ૧૨૩૨ ને દીને આ નવા બંધાયલા મકાનમાં જુના આતશ આદરાનના કેબલાને પરથાવી તખતનસીન કીધા હતા.

(૧૦) એ મકાન એકસો વરસનું પુરાણું થવાથી, યઝદેજરદી સને ૧૨૬૬ ના રોજ ૧૭ મો માહા ૨ જો શેનશાહી ને દીને યાને એ અસલ આદરીયાન પરઠીયાને બરોબર ૧૦૧ મું વરસ ઉગયું હતું તે દીને એ મકાનનાં વારસોએ તે ફરીથી નવું બંધાવીને તેમાં આતશ આદરીયાન પરઠયા હતા. આ મકાન બંધાતાં સુધી તેમાનો કેબલો શેઠ હોરમજી વાહાડયાજીવાળાં આતશબેહરામમાં એક વરસ વેર લઈ જઇ રાખયો હતો.

(૧૧) આ દરેહમેહર પેહલા મુંબઇના ભીંડીબજારના રસ્તા ઉપર શેઠ બમનજી મે. મેવાવાળાએ પોતાના મરહુમ બેટા સોરાબજીના પુણ માટે રોજ ૧૭ મો માહા ૪ થો ય. સને ૧૨૨૦ ને દીને પરથાવી હતી. પણ એ દરેહમેહર બીસનાર હાલતમાં આવવાથી અને એ મકાનની આજુબાજુથી જરથોસ્તીઓની વસ્તી કમી થવાથી એ દરેહમેહરનું મકાન તથા એના નીભાવવાલું મકાન કોરટની પરવાનગીથી વેચી, તેના અવેજમાંથી ભાયખલા વીકટોરીયા ગારડનસ પાસે બાંધવામાં આવેલા નવા મકાનમાં જુના આતશ આદરાનને શેહેનશાહી રોજ ૧૭ મો માહા ૪ થો ય. સને ૧૨૮૪ ને દીને પાછા તખતનશીન કરી એ દરેહમેહર જાહેર વપડાસ માટે ખુલ્લી મુકવામાં આવી હતી.

(૧૨) આ ભીંડીબજાર મધેની મરહુમ શેઠ મેરવાંનજી માણેકજી પટેલની દરેમેહરનું મકાન પુરાણું થઈ જવાથી યઝદેજરદી સને ૧૨૪૭ માં રોજ ૧૭ મો માહા ૯ મો શેનશાહીને દીને શેઠ નશરવાંનજી માણેકજી પીટીટે પોતાના ધણીઆણી બાઇ દીનબાઈ તે આ દરેમેહરના અસલ બંધાવનાર મરહુમ શેઠ મેરવાંનજી પટેલના બેટીના બેટીને નામે રૂ ૨૫૦૦૦) ખરચીને નવા પાયાથી વધુ કુશાદે બાંધી આપીયું હતું અને રૂ ૩૦૦૦) એ મકાનની મરાંમતને સારૂ અનામત રાખયા છે.

(૧૩) મરહુમ શેઠ શેહેરીઆરજી કેખશરૂ ઇરાનીએ પોતાના મરહુમ બેની બાઇ બાનુબાઇના પુણ માટે પાણા ખાતે કદમી રોજ ૬ ઠો માહા ૯ મો સને ૧૨૭૫ ને દીને આતશ દાદગાં પરઠાવ્યા હતા. પાણા ખાતે કદમી જરથોસ્તીઓની ઝાજી વસ્તી નહી હોવાથી એ આતશ દાદગાંને મજગામની મરહુમ શેઠ ફ. ન. પટેલની દરેમેહેરમાં લાવી પરઠાવવા એવું શુકરગુજારીનું જશન રોજ ૨૬ મો માહા ૯ મો કદમી ય. સને ૧૨૮૧ ને દીને કરવામાં આવ્યું હતું.

(૧૪) આ દરેહમેહર મજગામમાં નવાબના તલાવ આગલ મરહુમ શેઠ નાનાભાઇ જમશેદજી સપલાની નઇચતે તા૦ ૪ થી મે ૧૮૬૭ યાને યઝદેજરદી સને ૧૨૩૬ ના રોજ ૧૪ મો માહા ૮ માને દીને મરહુમ શેઠ નાનાભાઈની બેહન મરહુમ બાઈ રતનબાઇ તે સર કાવશજી જાહાંગીર રેડીમનીનાં ધણીઆણીની પુંજીમાંથી બાંધવામાં આવી હતી. પાછલથી એનો સરબે વહીવત ઇ૦ સ૦ ૧૮૭૭ માં સર કાવસજી જાહાંગીરજી રેડીમની નાઇટ, સી. એસ. આઇ. એ પોતાને સવાધીન લઈ તેના નીભાવ માટે બંદોબસ્ત કરનાર હતા, તેટલા મરણ પામવાથી એ દરેહમેહરના જાબુક ખરચ માટે સર કાવસજીના એકઝીક્યુટરોએ મરહુમની પુંજીમાંથી રૂ. ૨૩૦૦૦ નું તા૦ ૯ મી અકતોબર ૧૮૮૦ ને દીને તરસટડીડ કરી તે મરહુમના બેટા સર જાહાંગીર કાવસજી જાહાંગીરને તરસટી તરીકે સોંપ્યું હતું. આ દરેહમેહરનું મકાન મુંબઇના પોરટ ટ્રસટે સરવાજનીક કામ સારૂ સને ૧૨૭૫ માં ખરીદી લીધું તેમજ એ લતાના બીજા મકાનોબી લઈ લેવાથી

ત્યાંથી થોડે દુર મજગામમાંજ મતારપાંખડી તરફ શેઠ પેસતનજી નશારવાનજી ગોદીવાળાએ ભેટ આપેલી જગાપર સર જાહાંગીર કાવસજી જાહાંગીર રેડીમની બારોનેટે બંધાવી આપેલાં નવા મકાનમાં બેહસતનશીન સર કાવસજી જાહાંગીરની ૭૦ મા વરસની બાજને દીવસે યાને રોજ ૩ જે માહા ૧૧ મો સને ૧૨૭૭ યઝદેજરદીને દીને જુના આદરીઆન સાહેબના તુરી કેબલાને પાછા તખતનસીન કરવામાં આવ્યા હતા. આ નવું મકાન બંધાયું તેટલા બે વરસ સુધી રેડીમનીવાલા આતશઆદરીઆનના કેબલાને મજગામની શેઠ ફરામજી ન૦ પટેલની દરેહમેહરમાં રાખવામાં આવ્યા હતા.

(૧૫) આ સોડાવાટરવાલાની દરેમેહરની સાલગરેહ એક વરસમાં બે વાર પડે છે. તેનો ખુલાશો એમ છે કે પ્રથમમાં એ દરેહમેહેર અરદીબેહસત મહીનો ને જમીયાદ રોજે દાદગાહના કેબલા સાથે યઝદેજરદી સને ૧૨૪૪ માં સથાપેલી હતી. તે પછી યજદેજરદી સને ૧૨૫૪ નાં ફરવરદીન મહીનો ને ફરવરદીન રોજે એ દરેહમેહેરમાં દાદગાહનાં કેબલા સાથે આતશ આદરાન સાહેબને સથાપવામાં આવયા હતા.

(૧૬) આ માહીમની દરેહમેહેર શેઠ મનચેરજી બમનજી કુપરે ઈસવી સને ૧૮૬૬ માં રોજ ૪ થો માહા ૨ જે ય. સને ૧૨૩૬ ને દીને બાઇ મોટલાંબાઈનાં ભાડેના બંગલામાં સથાપી હતી. સુમારે ત્રણ વરસ બાદ શેઠ એદલજી ફરામજી સુનાવાલાએ દરેમેહેરને પોતાનાં બંગલામાં લઈ જઈ તેનો બધો ખરચ કીધો હતો. ઈસવી સને ૧૮૮૮ માં રોજ ૧૧ મો માહા ૪ થો ય. સને ૧૨૫૮ ને દીને એરવદ શાપુરજી જમશેદજી દાજી જેઓ ૧૮૬૬ થી એ દરેમેહેરના પંથકી હતા તેઓએ નવું મકાન બંધાવી તેમાં એ દાદગાંને રાખેલા છે અને એવોએ ૧૮૮૬ થી એ દરેમેહેરનો ચાલુ ખરચ પોતાના મરણ સુધી કીધો હતો. એવો રોજ ૨૧ મો માહા ૪ થો સને ૧૨૮૦ ને દીને ગુજરી જવાથી અને એવણે પોતાની હઈયાતીમાં એ અગીઆરીના ચાલુ નીભાવ માટે દાદરના સટેશન આગળની ઇસટેટ ત્રસટ કરી આપી ગયા છે.

(૧૭) એ દરેમેહેર પેહેલી યજદેજરદી સને ૧૧૯૧ માં મોટા આગળ માકેટરોડ ઉપર બાંધેલી હતી પણ તયાંથી ખસેડી દાદર ઉપર રોજ ૧૭ મો માહા ૭ મો શેનશાહી ૧૨૭૦ને દીને એના મુતવલીઓએ ફરીથી નવેસરથી બંધાવી છે.

(૧૮) આ અંકલેશરની અગીઆરીનું અસલ મકાન યઝદેજરદી સને ૯૧૯ માં શેઠ નરશંગ ધમપાલે બંધાવયું હતું જે પછી યઝદેજરદી સને ૧૨૧૭ માં શેઠ મેહેરવાનજી હોરમજી ફરેજરે તે ફરીથી બંધાવી આપયું હતું. તે પાછુ બીસમાર થવાથી તે તોડી પડાવી બીજું નવું મકાન, મરહુમ બાઈ સાહેબ દીનબાઇ નશારવાનજી પીટીટે પોતાની હઇયાતીમાં પોતાના બેહેસતનશીન જમાઈ શેઠ ફરામજી દીનશાજી પીટીટના પુણ્ય માટે બંધાવવાનું શરૂ કીધું હતું પણ તેટલાં બાઈ દીનબાઈનું મરણ નીપજવાથી તેવણના બેટી બાઈ આવાંબાઈ ફરામજી પીટીટે પુરૂં કરી આપાને રોજ ૨૭ મો માહ ૨ જે યજદેજરદી સને ૧૨૬૯ માં જાહેર વપડાશ માટે ખુલ્લું મેલયું છે. આ દરેહમેહરની ચાલુ નીભાવણી માટે વારશીક રૂ. ૨૦૦ બાઇ આવાંબાઈ પીટીટ આપતા હતા. પણ બાઈ આવાંબાઇના મરણ પછે તે માટેની કશી જોગવાઈ અંકલેશર અંજુમન ધરાવતી નહી હોવાથી એ આદરાનના ખરચ માટે સને ૧૨૭૯ થી ભરૂચના શેઠો ડુંગાજી ફડુંબોઓ તરફથી રૂ ૧૨૫ અને શેઠો મેરવાનજી અને હોરમસજી મંચેરજી કામાએ સથાપેલા ફંડમાંથી રૂ ૭૫ દર સાલ આપવાનો બંદોબસત થયો છે.

(૧૯) એ દરેમેહર સને ૧૨૪૬ થી અમદાવાદની અનજુમનને હસતકથી ચાલતી હતી પણ તે પુરાંણી થઇ ગયાથી અમદાવાદવાળા શેઠો નવરોજી અને જાંગીરજી પેરાતનજી વકીલે નવેશરથી રૂ ૨૦૯૭૫) ને ખરચે કુશાદે બાંધીને રોજ ૨૭ મો માહા ૭ મો શેનશાહી સને ૧૨૫૨ ને દીને ફરીથી ઈજાવી હતી.

(૨૦) આ અમરોલીની દરેહમેહેર પહેલવહેલી ઘણા વરસો અગાઉ મોબેદ દાદા હીરજી વરીઆવાએ દાદગાંની સથાપેલી હતી. તે પછી એજ દાદગાવાલા ઘરમાં ઈસવી સને ૧૮૦૩ ની તા૦ ૨૪ મી નવેમબરે યાને યઝદેજરદી ૧૧૭૩ ના રોજ ૧૭ મો માહ ૨ જાને દીને મુંબઈવાલા શેઠ હોરમસજી બમનજી વાડીઆએ આદરીયાનની પરયાવી હતી, એ પછી એ આદરીયાન સુરતના આતશબેહરામમાં લઈ જવામાં આવયા હતા. તયાર બાદ ઇ. શ. ૧૮૩૪ યાને યઝદેજરદી ૧૨૦૪ માં એ જુના મકાનની પેહેલીવાર મરામત કરો ફરીથી દાદગાં એજ વાહાડયાજીએ સથાપ્યા હતા. એ મકાન પુરાણું થવાથી શેઠ વાહાડીઆજીના સાહેબજાદાઓએ તા. ૩૦ મી અકટોબર ૧૮૩૭ યાને રોજ ૧ લો માહ ૨ જો ય. સને ૧૨૦૭ ને દીને બીજીવારની મરામત કરાવી અસલના દાદગાં પરયાવયા હતા તે છેક ઈ. સ. ૧૮૯૩ યાને ય. સને ૧૨૬૩ સુધી દરેહમેહેર તરીકે ચાલુ વપરાસમાં હતી. એ જુની દરેહમેહેરના મકાન સામે બીજી જગા ઉપર અમરોલીવાલા શેઠ કાનજીભાઈ દોરાબજી મીઠાઈવાલાએ દરેહમેહેર માટે એક નવું મકાન બંધાવી તે ઈજાવી તેમા રોજ ૯ મો માહ ૪ થો ય. સને ૧૨૬૩ માં આદરયાન પરયાવી ખુલ્લું મુકયું હતું. એ દીનથી જુની દરેમેહેરના દાદગાહ આ નવી દરેહમેહેરમાં લાવવામાં આવ્યા હતા. એ વખતથી એ જુની દરેહમેહરનું મકાન પડત પડી રહયું હતું. તે પછી શેઠ નવરોજી કાવસજી વાડીવાલાએ એ જુની દરેહમેહરના મકાનને સમરાવી આપવાથી એ જુની દરેહમેહરનું મકાન રોજ ૨૧ મો માહ ૧૧ મો સને ૧૨૮૦ ને દીને પારસીઓના ઉતારા માટે ધરમશાલા તરીકે ખુલ્લું મુકવામાં આવયું છે.

(૨૧) આ ઇનદોરની શેઠ ભમગરાવાલી દરેહમેહરનું મકાન પેહલા ફકત ધરમક્રીયા કરવા સારૂ શેઠ હોરમજી માણેકજી ભમગરાએ પોતાના ધણીઆણી મરહુમ બાઈ નવાજબાઈનાં પુણ્ય માટે રોજ ૧૦ મો માહા ૮ મો સને ૧૨૪૮ ને દીને બાંધી આપી ખુલ્લું મેલયું હતું. પાછલથી શેઠ હોરમજીએ પોતાના બાવા મરહુમ શેઠ માકાશાહ રૂસતમજી ભમગરાની નઈયતે એ મકાનમાં સને ૧૨૫૧ ના રોજ ૨૬ મો માહા ૬ મા ને દીને આતશદાદગાંને પરઠીને તખતનશીન કરવામાં આવયા હતા. એ દરેહમેહેર જયારથી બાંધવાનાં આવી છે તયારથી એનો ચાલુ ખરચ ઇનદોરની જરથોસતી અનજુમન તરફથી કરવામાં આવે છે.

(૨૨) એ દરેહમેહેર પેહલાં સને ૧૦૯૧ માં આગ કાવશજી ખરશેદજી કામદીન એરાવવાળાએ બંધાવેલી હતી, ને બીજી વાર સને ૧૨૧૦ માં સુરતવાલા શેઠ મેરવાનજી હોરમસજી ફરેજરે બંધાવેલી હતી. તે પાછી તીજી વાર મુંબઈવાલા શેઠ જમશેદજી બરજોરજી મીસતરીએ રોજ ૭ મો માહા ૪ થો શેનશાહી સને ૧૨૩૯ યઝદેજરદીને દીને ફરીથી કુશાદેથી બંધાવી છે.

(૨૩) આ દરેમેહેર પુરાંણી થવાથી મરહુમ દસતુરજી નોશરવાંનજી જાં૦ જામાસપઆસાનાના મુતવલી દસતુર બહુમનજી જામાસપજી જામાસપઆસાનાએ રોજ ૨૪ મો માહ બીજો સને ૧૨૬૧ ને દીને નવેશરથી બાંધી છે.

(૨૪) એ દરેહમેહેર ખા. બા. પેસતનજી સોરાબજી ભુજવાલાએ પોતાના મરહુમ પીતાજીના પુણ માટે લગભગ અગીઆર હજાર રૂપીયા ખરચીને બંધાવી આપી હતી. એ દરેહમેહેર ઈજાયા આગમજ તયાંના માહારાજા રાવ શ્રી ખેંગારજી શવઈ બાહાદુરને દેખાડવામાં આવી હતી. તે પછી પારસી રીત મુજબ ઈજીને પરઠવામાં આવનાર હતી —તેટલાં એ દરેહમેહેરના બંધાવનાર ખા. બા. પેસતનજી ગુજરી જવાથી મરહુમના માસીસાને દીને પહેલાં પરઠવાં ધારયું હતું તેથી એ અગીયારીની તખતી ઉપર રોજ ૨૩ મો માહા ૧૦ મો યઝદેજરદી સને ૧૨૭૩ લખેલા છે, પણ કાંઈક ઢીલ થવાથી એ દીને દરેહમેહેર પરથવામાં નહી આવી હતી તે પાછલથી મરહુમની વરસીને દીને યાને રોજ ૨૩ મો માહા ૯ મો સને ૧૨૭૪ ને દીને પરથીને ખુલ્લી મેલવામાં આવી હતી.

(૨૫) આ દરેહમેહેર અસલ મરહુમ શેઠ ડોશાભાઈ મેરવાનજી વાહાડયાની યાદગારી માટે એવોના ખેશીઓએ બાંધી હતી. તેમાં એક નવો ગુમબજ બાંધવા તથા તેમાં સુધારો વધારો કરવા અને મોબેદોના રહેવાના મકાનમાં રીપેર કરવા માટે યઝદેજરદી સને ૧૨૭૩ માં નજદીક રૂ ૬૦૦૦ નું એક ફંડ ભેગુ કરી તેમાંથી એ દરેહમેહરનો સઘલો રીપેર ખરચ કરવામાં આવયો હતો. મજકુર દરેહમેહેરમાં જયાં અસલ આતશ દાદગાં હતા તયાં કરાંચીવાલા શેઠ કાવસજી હોરમસજી કાતરકે પોતાના મરહુમ ધણીઆણી બાઈ સુનાબાઈની નઈયતે, પોતા તરફથી મોટો ખરચ કરી, રોજ ૯ મો માહા ૯ મો યઝદેજરદી સને ૧૨૭૨ ને દીને, યાને એ આદરીયાન સાહેબની ૩૫માં વરસની સાલગરેહને દીવસે, આતશ આદરીયાન સાહેબ પરઠાવેઆં છે. એ આદરયાન પરઠયા પછીનો કાઠી સુખડ, તેલ વગેરેનો જે વધુ ખરચ થાય તેને માટે એજ શેઠે બીજા વધુ રૂ ૩૦૦૦ એવી શરતે આપીયા છે કે એ રકમના બ્યાજમાંથી એ ખરચ કરવો. એ અગીઆરીને બીજો ચાલુ ખરચ તો જયારથી એ અગીયારી પરથાઈ છે તયારથી અંજુમન તરફથી કરવામાં આવે છે.

(૨૬) આ દરેમેહેર અસલ રોજ ૯ મો માહા ૮ મો શેનશાહી સને ૧૨૧૮ માં શેઠ હીરજીભાઈ જમસેદજી બેહેરાનાએ પહેલવેહેલી પોતાના રહેવાના મકાનવાલી જગાના અરધા ભાગપર પરથાવી હતી. એ પછી શેઠ હીરજીભાઈના વસીયત પરમાણે એવણના વીધવા બાઈ મેરબાઈએ રૂ ૨૨૨૫૦ આપયા હતા, એમાંથી બીજી જગાપર રૂ ૩૦૦૦ની જમીન ખરીદી રૂ ૧૩૦૯૦ને ખરચે નવું મકાન બંધાવી આપી રૂ ૪૬૮૩ જુના મકાનના રીપેર માટે આપયા હતા. નવું મકાન રોજ ૯ મો માહા ૮ મો શેહેનશાહી સને ૧૨૪૪ યઝદેજરદીને દીને પરથાવી તેમાં આતશઆદરાનને પાછા તખતનશીન કીધા હતા. કરાંચીના રહીશ શેઠ ફરામજી બેરામજી કલેકટરે લગભગ રૂપ્યા પાંચ હજાર ખરચી કેટલુક સમારકામ કરી આપી રોજ ૯ મો માહા ૮ મો સને ૧૨૭૮ ને દીને આતશ આદરાનને તખતનશીન કીધા હતા. એ દરેહમેહેરનું મકાન બીસમાર થવાથી લગભગ રૂપ્યા અરધા લાખને ખરચે નવેસરથી સુધારી વધારીને બાંધવામાં આવ્યું છે. એમાં શેઠ અરદેસર હોરમજી મામાએ મરહુમ પીતાજી ખા. સા. હોરમસજીના પુણ માટે રૂ ૨૦૦૦૦ ને ખરચે હોલ બંધાવી આપ્યો છે જેને "હોરમસજી મામા હોલ" એવું નામ આપયું છે. તેમજ મરહુમ શેઠ જમશેદજી અરદેસર હોરજીભાઈની યાદમાં માતાજી બાઈ ડોસીબાઈએ તથા મરહુમના ભાઈઓએ રૂ ૫૫૦૦ ને ખરચે એક ઓરડો પુસતકશાળા માટે બંધાવ્યો છે જેને "જમશેદજી અરદેશર હીરજીભાઈ બહેરાના લાયબરેરી તથા રીડીંગ રૂમ" એવું નામ આપ્યું છે. આ નવું મકાન તથા હોલ ને પુસતકશાળા રોજ ૯ મો માહા ૧૨ મો શેહેનશાહી સને ૧૨૮૭ યજદેજરદીને દીને ખુલ્લા મુકયા હતા.

(૨૭) કલકતા ખાતે શેઠ ધ. બે. મેહતાએ પોતાના ખાનગી ઘેરમાં દાદગાહની દરેહમેહર ય. સને ૧૨૫૯ માં સથાપી હતી. તે પછી મરહુમના વીધવા બાઈ ખરશેદબાઈ તથા બેટા શેઠ રૂશતમજી ધ. મેહેતા સી. આઈ. ઈ. અને કુટુંબે મલી આપેલા રૂ ૧૧૦૦૦૦ તેમજ કલકતાની અંજુમને તથા બીજા સાહેબોએ ભરેલા રૂ ૬૭૦૦૦ મલી રૂ ૧૭૭૦૦૦ માંથી જુનું મકાન રૂ ૪૩૦૦૦ ની કીમતે ખરીદી તે ફરીથી નવેસરથી રૂ ૪૨૦૦૦ ના ખરચે બાંધવામાં આવયું હતું. આ નવું મકાન ઈજી તેમાં આતશ આદરાન સાહેબના કેબલાને તખતનશીન કરી ખુલ્લું મેલવાની કીરીયા શેનશાહી રોજ ૧૭ મો માહા ૨ જો સને ૧૨૮૨ ને દીને થઇ હતી. આ નવી દરેહમેહરમાં અસલના દાદગાહ લાવીને પરથવામાં આવ્યા છે.

(૨૮) કલીઆણી મધે અસલ એક ઘણી પુરાંણી દરેહમેહર હતી, પણ તે બીશમાર હાલતમાં આવવાથી મુંબઈવાલા શેઠ એદલજી બેરાંમજી મોદીએ યઝદેજરદી સને ૧૧૫૮ માં તે ફરીથી બંધાવી હતી. તે દરેમેહરમાં આતશઆદરાન નહી હોવાથી કલીઆણીવાલા શેઠો ભીખાજી જીજીભાઈ શેઠના, ડોસાભાઈ હોરમજી ભીમડીવાલા, ફરદુનજી મેરવાંનજી શરાફ અને હોરમજી માણેકજી ભીમડીવાલાએ પોતાને ખરચે એ જુની દરેહમેહરમાં ઘટતો ફેરફાર કરી રોજ ૧૭ મો માહ ૨ જો સને ૧૨૫૦ ને દીને આદરીઆન સાહેબ પરઠાવયા છે, અને તેના ચાલુ ખરચ સારૂ રૂ ૭૦૦૦ હલાયદા કહાડયા છે.

(૨૯) આ કવેતાવાલી પુરાંણી અગીઆરીને માટે હેવું છે કે એ માતર દરેહમેહેરનું મકાનજ હતું પણ તે દરેહ-મેહર ઈજાવામાં આવેલી નહી હોવાથી છેક યઝદેજરદી સને ૧૨૭૫ માં રોજ ૨૭ મો માહા ૩ જાને દીને કવેતાવાલા જાણીતા શેઠયા ખા૦ બા૦ બરજોરજી દોરાબજી પટેલ સી. આઇ. ઈ.ને ખરચે ઈજાવીને ખુલ્લી મેલવામાં આવી છે.

(૩૦) આ ચીખલીની દરેહમેહરનું મકાન બીસમાર હાલતમાં આવવાથી શેઠ સોરાબજી ફરામજી ગજદર તથા એવણના બેટા શેઠ નશરવાનજીએ ફરીથી બંધાવી આપેલું નવું મકાન ઈજાવી ખુલ્લું મુકવાની કીરીયા શેનશાહી રોજ ૨૦ મો માહા ૨ જો ય. સને ૧૨૮૪ ને દીવસે કરવામાં આવી હતી.

(૩૧) એ દરેમેહરનું અસલ મકાન ઘણા વરસપર કોઈ સખી જરથોશતીએ બંધાવેલું કહેવાય છે તે પછી સને ૧૨૩૮માં શેઠ એદલજી રતનજી બ્યાજખોરાએ મકાન પાછું બંધાવી આપયું હતું. તે મકાન બીસમાર હાલતમાં આવવાથી જરથો-શતી અનજુમનમાં જાહેર ઉઘરાણું કરી આશરે રૂ ૯૦૦૦ માંથી એ મકાન રોજ ૩ જો માહા ૮મો શેનશાહી સને ૧૨૬૯ ને દીને આતશ દાદગાહ સથાપીને નવેસરથી બાંધવામાં આવ્યું હતું. પણ પાછલથી આદરીઆન સથાપવા માટે શેઠ કુવરજી

કાવસજી તવરીઆએ પોતાના મરહુમ પુત્ર ડાકટર હોરમજીના પુણ માટે રૂ૧૦૦૦૦) દશ હજારની રકમ આપીને ફરીથી નવેસરથી એ મકાનમાં આદરીયાન સથાપીને રોજ ૯ મો માહ ૧૦ મો ૧૨૭૦ ને દીને ઈજાવીને ખુલ્લું મેલ્યું હતું.

(૩૨) એ મકાન પુરાંણું થવાથી મુંબઈવાલા શખીવજુદ બાઈ દીનબાઈ નસરવાંનજી પીટીટે પોતાના મરહુમ બેટા શેઠ જમશેદજી નશરવાનજી પીટીટના પુણને માટે રોજ ૩ જો માહા ૧૦ મો શેનશાહી ૧૨૬૪ ને દીને ફરીથી બંધાવી આપયું છે.

(૩૩) આ દરેમેહેર અશલ ય૦ સને ૧૧૫૦ ની આગમચ દાદગાંની બનાવેલી હતી. ત્યાં નવેસરથી આતશ આદરાંનની દરેમેહેર શેઠ રૂશતમજી કાવશજી પટેલે પોતાના બાવા મરહુમ શેઠ કાવશજી રૂશતમજી પટેલની નઈઅતે બંધાવીને રોજ ૯ મો માહા ૭ મો શેહનશાહી સને ૧૧૯૮ યઝદેજરદીને દીને પરઠાવી છે.

(૩૪) આ દમણની બાઈ રતનબાઈ કામાવાળી દરેમેહરનું મકાંન ઘણું બીસમાર થઈ જવાથી તે દરેમેહર યઝદેજરદી સને ૧૨૭૬ માં ત્યાંથી સદનતર કાઢી નાખવાનાં આવેલી જણાયછે. એ વીષેની લંબાન વીગત યઝદેજરદી સને ૧૨૭૭ ના કેલેનડરમાં દમણની વીગતમાં પાણે ૧૪૯ માં છાપેલી છે.

(૩૫) આ ફુમસની દરેહમેહરનું જુનું મકાન ઘણું બીસમાર હાલતમાં આવવાથી મરહુમ શેઠ પાલનજી રતનજી કંત્રાકટરના પુણ માટે મરહુમના દીકરા શેઠ મનચેરજી પાલનજી કંત્રાકટરે તથા મરહુમના ધણીઆણી બાઇ બાઈઆઈ પાલનજીએ લગભગ રૂ૧૨૦૦૦ના ખરચે ફરીથી નવું મકાન બંધાવી આપ્યું હતું. નવું મકાન ઈજી ખુલ્લું મેલવાની ક્રીયા રોજ ૧૯ મો માહા ૧૨ મો ય૦ સને ૧૨૭૮ને દીને કરી તેમાં આતશ દાદગાહને પાછા તખતનશીન કીધા હતા.

(૩૬) આ દરેહમેહેરનું પેહલવેહેલું મકાન ફકત અમધ ક્રીયા કામ માટે યજદેઝરદી સને ૫૫૧ માં નવસારી ખાતે જરથોસ્તીઓએ જઈ રહયા પછી પરથવામાં આવ્યું હતું. તયાર બાદ મરહુમ બાઈ સાહેબ માહલણબાઈ બેહેદીન બેહરામજીએ પોતાનું એક ઘર આપી તેમાં વધારો કરયો હતો. પણ વસતીના વધવાથી બંને મકાનો નાનાં પડવાને લીધે મરહુમ દેશાઇજી મીનોચેહરજી ખુરશેદજીએ તેમાં મોટો વધારો કરી એ જુનાં મકાનોની સાથે પોતાનાં ખરચથી નવું મકાન રોજ ૧ લો માહા ૫ મો સને ૧૧૬૪ ને દીને બંધાવી અમધ ક્રીયા કામ માટે ખુલ્લું મેલ્યું હતું. એ પછી બાઇ મોટલાંબાઈ જાહાંગીર વાડીઆએ પોતાના મરહુમ બાવા શેઠ જાહાંગીરજી નોશરવાનજી વાહાડયાના પુણ માટે લગભગ રૂપયા વીસ હજારને ખરચે એ જુની દરેહમેહરને લગતું બાજુમાં બીજુ નવું મકાન બંધાવી રોજ ૨૬ મો માહા ૮ મો સને ૧૨૨૦ યઝદેજરદી તા૦ ૨૫ મી મે ૧૮૫૧ ને દીને પરઠાવ્યું હતું. વળી એ દરેહમેહરને લગતું બીજુ જુનું મકાન પાછુ નબલી હાલતમાં આવવાથી દેશાઈ કાવશજી એરચજી ગોંડલવાલાએ લગભગ રૂપયા સાત હજારનો ખરચ કરી નવેસરથી એ મકાન બંધાવી આપ્યું હતું તથા એમાં એવણનાં ધણીઆણી બાઈ મોતીબાઈએ આતશ દાદગાહ પરઠાવી આતશ રોશન રાખવા સારૂ રૂ. ૪૦૦૦ આપ્યા હતા. આ દેશાઈ કાવસજીવાલુ નવું બંધાયલું મકાન તથા એમાં પરહેલો આતશ દાદગાહનો કેબલો ખુલ્લો મેલવાની ક્રીયા યઝદેજરદી સને ૧૨૭૬ ના રોજ ૧૭ મો માહા ૧૨ માને દીને કરવામાં આવી હતી. મરહુમ બાઈ મોટલાબાઈ વાહાડયાજીએ બંધાવેલા મકાનનો કેટલોક ભાગ બીસમાર થવાથી તેમાં કેટલોક ફેરફાર અને મરામત મરહુમ બાઈના દીકરા મરહુમ શેઠ નવરોજી માણેકજી વાહડયા સી. આઈ. ઈ. એ લગભગ રૂપયા ૧૫૦૦ ને ખરચે કરાવ્યો હતો, તેને ઈજીને રોજ ૧૨ મો માહા ૧૨ મો ય૦ સને ૧૨૭૮ યાને મરહુમ શેઠ નવરોજીના પહેલા મહીનાની બાજને દીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

(૩૭) આ મીનોચેહર હોમજીવાલી દરેમેહેર જે નવસારીના આતશબેહરામની સામે આવેલી છે તેમાં પેહેલે આતશ દાદગાં હતા પણ એ પછી રોજ ૨૦ મો માહા ૨ જો શેહેનશાહી સને ૧૨૬૮ યજદેજરદીને દીને જરથોસ્તી અનજુમનના ઉમરાતથી રૂ૩૪૦૦૦ને આશરેનું ફંડ કરીને એ મકાન નવેસરથી બાંધીને તેમાં આતશ આદરાન તખતનશીન કીધા છે.

(૩૮) આ નારગોલની દરેમેહરનું અશલ મકાન મુંબઈવાલા શેઠ દાદાભાઈ નશરવાનજી મોદીનું એકસો વરસ અગાઉ બંધાવેલું હતું, પણ તેનો રોજ માહા શને મલતો નથી. એમાં આતશનો કેબલો નહી હતો, પણ અમથાં ધરમના મકાનમાં મોબેદો રહીને કીરીયા કામ કરતા, તેઓનો મુશારો શેઠ દાદાભાઈનાં બેટી બાઈ શુનાબાઇ દાદાભાઈ વાડીઆએ ઇસ્વી સને ૧૯૧૪ સુધી આપ્યો હતો. તેજ મકાનમાં પાછલથી રોજ ૧૧ મો માહા ૧૦ મો સને ૧૨૫૧ યજદેજરદીમાં શેઠ માણેકજી રૂશતમજી અને ભાઈઓએ પોતાનાં મરહુમ માતાજી બાઈ માણેકબાઈનાં પુણને માટે દાદગાં પરઠયાં છે અને તેની બોય દેવાનો, કાઠો તેલ વીગરેનો ખરચ એજ ભાઇઓ ફંડ ઉભું કરીને તેમાંથી પુરો પાડે છે.

(૩૯) આ દરેમેહરમાં પેહલે આતશદાદગાં હતાં, તે પછી રોજ ૨૦ મો માહા ૯ મો શને ૧૨૧૨ ને દીને આતશ આદરાન પરઠેયા હતા, પણ તે દરેમેહર બીસમાર હાલતમાં આવવાથી મુંબઈવાલા મરહુમ દસ્તુરજી જામાસપજી એદલજી જામાસપઆશાનાના શાહેબજાદાઓએ રોજ ૨૦ મો માહા ૬ મો શને ૧૨૪૬ ને દીને ફરીથી નવેસરથી બાંધીને સ્થાપી છે.

(૪૦) દખણ હેદરાબાદ તરફ શેઠો બીકાજી તથા પેશતનજી મેહેરજીની કેટલીક દરેમેહેરો બાંધેલી છે, તેમાંની એક આએ બાબાપેરનીબી દરેમેહેર બંધાવેલી હતી, પણ હાલ તે મોજુદ નથી એમ કેહવાય છે.

(૪૧) બીલીમોરામાં રોજ ૨૦ મો માહા ૧૦ મો યજદેજરદી સને ૧૧૯૭ યાને તા૦ ૧૮ મી જુલાઇ ૧૮૨૮ ને દીને મુંબઇવાલા શેઠ નવરોજી જમશેદજી વાહાડયાજીએ આતશ દાદગાંની એક દરેમેહેર બંધાવેલી છે. પણ બીલીમોરામાં એક આતશ આદરીયાનની જરૂર જણાવાથી બીલીમોરાવાલા શેઠો દાદાભાઈ ધનજીભાઇ અને સોરાબજી શાપુરજીએ રૂ.૧૯૭૯૦નો ખરચ કરી એ જુની દરેમેહરની પાસે બીજું એક નવું મકાન બંધાવી તેમાં આતશ આદરીયાન રોજ ૯ મો માહ ૯ મો સને ૧૨૬૮ ને દીને પરઠ્યાં છે. એનો ચાલુ ખરચ અનજુમનને હસ્તકથી થાય છે પણ તેનાં નીભાવ ખરચ સારૂ ૧૭૦૦૦) મજકુર શેઠો દાદાભાઈ ધનજીભાઈ તથા સોરાબજી શાપુરજીએ આપ્યા છે; તેનાં વેઆજમાંથી આદરીઆન શાહે-બને બોય દેવાનું, શુખડ તથા બતી તથા સમારકામ તથા સાલગરેહને દીવશે જશન બાજ એવોની તરફથી કરવા જણાવ્યું છે. એ મુજબ મકાન બાંધવાનો, અનામત મેલેલી રકમનો તથા બીજો પરચુરણ ખરચ મલીને એ નવી દરેમેહરપર

રૂ. ૩૦૦૦૦) તીશ હજારનો ખરચ કીધેલો જણાય છે. વળી અશલની પેલી દાદગાંવાલી શેઠ નવરોજી જમશેદજી વાહાડયાજીની દરેમેહરનું મકાનબી પુરાણું થવાથી તે એકવાર આગલ અનજુમને સમારયું હતું તે પાછું એજ શેઠ દાદાભાઈ ધનજીભાઈ તથા શોરાબજી શાપુરજી ગબાએ ફરીથી સમારી આપીને રોજ ૨૨ મો માહા ૧૨ મો યજદેજરદી સને ૧૨૭૪ ને દીને જશન કરી ખુલ્લું મેલ્યું છે.

(૪૨) બેલગામની શેઠ બાઇસવાલી દરેહમેહેર તેમજ તેમાં મુસાફરખાનું બાંધી બંને રોજ ૨૪-૩-૧૨૬૧ ય. ને દીને ખુલ્લાં મુકયાં હતાં અને એ મુસાફરખાનું હજી ચાલુ છે. એ દરેહમેહેરનું મકાન બીસમાર થવાથી બેલગામની જરથોસતી અનજુમનના ફંડમાંથી તથા શેઠ બાઇસ કુટુંબીઓએ મલી રૂ ૬૦૦૦ ના ખરચે નવેસરથી મોટો ફેરફાર કરીને તેમાં આતશ દાદગાંને રોજ ૨૪ મો માહા ૬ ઠો ૧૨૮૫ ય. ને દીને તખતનશીન કીધા છે. એ દરેહમેહેરના અસલ હોલમાં શેઠ રૂસતમજી તથા નસરવાનજી નાનાભાઈ ખુરશેદજી બાઇસે મરહુમ ભાઈ રતનજીની યાદમાં સુધારો વધારો રૂ૪૫૦૦ ને ખરચે કરી એ હોલને "રતન હોલ" નું નામ આપી રોજ ૨૩ મો માહા ૬ ઠો ૧૨૮૫ ને દીને ખુલ્લો મેલ્યો છે. એ દરેહમેહેરના મોબેદોને રહેવા માટેનું મકાન મરહુમ શેઠ પેસતનજી એદલજી બાઇસના પુણ્ય માટે એવણના વીધવા શીરીનબાઈ તથા બેટા અદલ અને કુટુંબે દરેહમેહરના કમપાઉંડમાં બંધાવી રોજ ૨૨ મો માહા ૪ મો ય. સને ૧૨૭૬ ને દીને ખુલ્લું મુકી બેલગામની જરથોસતી અનજુમનને સ્વાધીન કીધું છે.

(૪૩) એ દરેમેહર પુરાણી થવાથી નવેસરથી બંધાવીને એ દરેમેહરના મુતવલીઓ શેઠ દીનશાહ ફરદુનજી અને ભાઈઓએ રોજ ૨૬ મો માહા ૨ જો સને ૧૨૬૭ યઝદેજરદીને દીને ખુલી મેલી છે.

(૪૪) આ ભરૂચની શેઠ નારીયલવાલાની દરેમેહર રોજ ૨૩ મો માહા ૯ મો શેહેનશાહી સને ૧૨૬૫ ને દીને ફરીથી એજ શેઠ શાપુરજી સોરાબજી નારીએલવાલાનાં વારશોએ મોટા ખરચે નવેસરથી બંધાવી છે. આ દરેહમહેરનું મકાન નાધલું પડવાથી તેની આઠમણી બાજુએ શેઠ હોરમજી બાનાના વારસો શેઠ રૂશતમજી, ડોશાભાઈ અને હીરાજીએ ભેટ આપેલી જગા ઉપર બાઈ વીરબાઇજી શાપુરજી નારીએલવાલાના પુણ્ય માટે કુટુંબીઓએ આપેલા રૂપયામાંથી બાંધવામાં આવેલો બાઇ વારબાઈજી શા. નારીયલવાલા હોલ રોજ ૨૫ મો માહા ૨ જો શેહેનસાહી સને ૧૨૮૬ ય. ને દીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

(૪૫) એ દરેમેહરનું મકાન પુરાણું થવાથી ભરૂચના જાણીતાં ડુંગાજીના ખાનદાનવાલાઓએ શેઠ પેસતનજી અસલાજી ડુંગાજીને નામે રોજ ૧૦ મો માહા ૮ મો સને ૧૨૭૨ ને દીને રૂ૧૫૦૦૦) ના ખરચે ફરીથી બંધાવ્યું છે અને તેના નીભાવ ફંડને માટે બીજા રૂ૧૫૦૦૦) અલાયેદા કાઢી તરશટી નેમેઆ છે. એજ ડુંગાજી ખાનદાનવાલા આ દરેહમેહરનો ચાલુ ખરચ યઝદેજરદી સને ૧૨૪૨ થી કરતા આવયા છે. બાઇ આવાંબાઈ ખરશેદજી મં. કામાજી કાપડયાએ એ દરેહમેહરના ત્રસ્ટીઓને દરેહમેહરની સામેનું પોતાનું મકાન બાળવાની કાઠી ભરવા માટે ય. સને ૧૨૭૯ ના ફરવરદીન મહીનામાં ભેટ આપ્યું હતું.

(૪૬) એ દરેમેહર અસલ ૧૧૭૩ નાં રોજ ૧૭ મો માહા ૬ ઠાને દીને શુરતવાલા શેઠ વીરજીભાઈ બમનજીએ દાદગાહની બાંધેલી હતી. એ દરેમેહેરનું મકાન પુરાણું થવાથી નવેસરથી ફરીને શેઠ શોરાબજી તથા નવરોજી ફરામજી ધામત તથા બીજાએ બંધાવી આપ્યું હતું અને તેમાં આતશ આદરાન સાહેબને પરઠાવી તખતનશીન કરી એ આદરીઆનની શાલગરેહને દીને ય૦ સને ૧૨૩૧ માં પાછી ખુલ્લી મેલી હતી.

(૪૭) આ બેસાણુની દરેહમેહર શેઠ દાદાભાઈ તથા મનચેરજી પેસતનજી વાહાડયાએ પોતાના બંધેવી મરહુમ શેઠ સોરાબજી ફરામજી વાહાડયાની નઈઅતે પહેલવેહલી પરથાવી હતી. એ દરેમેહર જુની થવાથી તથા વસતીથી દુર હોવાથી પારસી વસતીની નજદીકમાં બીજી જગા ઉપર બીજા લોકોના ઉગરાણાથી અને એજ વાહાડયા સાહેબોની મદદથી મરહુમ શેઠ સોરાબજી ફરામજી વાહાડયાના વીધવા બાઈ બચુબાઇએ પોતાની મરહુમ દીકરી બાઈ ગુલબાઈની યાદગારીમાં નવેસરથી બંધાવી પોતાના ખાવંદ શેઠ સોરાબજી ફરામજી વાહાડયાની નઈઅતે રોજ ૨૦ મો માહા ૯ મો શેહેનશાહી સને ૧૨૪૬ યઝદેજરદીને દીને પરઠાવી હતી.

(૪૮) આ મઉની દરેમેહર ફરીથી રોજ ૯ મો માહા ૬ ઠો સને ૧૨૨૮ ને દીને અનજુમનનાં ઉધરાટથી સમારી હતી પણ તે પાછો સમારીને તેનું જશન રોજ ૧૯ મો માહા ૧૨ મો સને ૧૨૫૨ યઝદેજરદીને દીને કરવામાં આવયું હતું. આ મકાનમાં રૂ ૨૦૦૦ ના ખરચે બંધાયલો મુકતાદનો હોલ રોજ ૯ મો માહા ૬ ઠો સને ૧૨૮૩ ને દીને ખુલ્લો મુકાઓ હતો. તે પછી અનજુમનનાં ઉધરાટથી રૂ૧૦૦૦૦ને ખરચે દસતુરજી નોશીરવાન કેકોબાદની આગેવાની હેઠલ જુના મકાનમાં મોટો ફેરફાર કરી એ દરેહમેહેર રોજ ૯ મો માહા ૧૧ મો સને ૧૨૮૫ને દીને ખુલ્લી મુકી હતી.

(૪૯) આ મહુવાની દરેહમેહરનું મકાન બીસમાર હાલતમાં આવવાથી અંદેરીવાલા શેઠ અરદેશર ભીખાજી પટેલે પોતાના ધણીયાણી મરહુમ બાઈ રતનબાઈના પુણ્ય માટે જુના મકાનની પાસેજ એક નવું મકાન બંધાવી આપી તેમાં જુના આતશ દાદગાહના કેબલાને પરઠાવી ખુલ્લું મુકવાની કીરીયા રોજ ૧૭ મો માહ ૨ જો સને ૧૨૮૦ને દીને કરી હતી. એ દરેહમેહરનો નીભાવ તથા મરામતનો ખરચ ત્યાંની અનજુમન કરે છે. જ્યારે જુના મકાનને શેઠ અરદેશરે દુરસ્ત કરાવી આપવાથી એ જુનું મકાન મોબેદોના રહેવા માટે વાપરવામાં આવે છે.

(૫૦) રંગુનની શેઠ બેજનજી કાવશજી ખંબાતાની અસલ બાંધેલી દરેમેહરનું મકાન પુરાણું થવાથી તથા નાહાનું પડવાથી શેઠ શાપુરજી અને બમનજી કાવશજી કપતાંને રૂ૩૫૦૦૦) ને ખરચે નવેસરથી બાંધી આપીને રોજ ૧૧ મો માહ ૧૨ મો સને ૧૨૭૩ યજદેજરદી એટલે કદમી રોજ ખોરદાદશાલ સને ૧૨૭૪ ને દીને પરથાવેલ છે.

(૫૧) આ દરેમેહરને ફરીથી રોજ ૨૯ મો માહા ૨ જો શેહેનશાહી સને ૧૨૬૫ ને દીને એજ શેઠ દારાશાહના ધણીઆણી બાઇ પીરોજબાઈએ સમારીને ઇજાવા છે, અને તેના ચાલુ ખરચ માટે પણ ગોઠવણ કરી છે.

(૫૨) લાહોરની શેઠ કુપરવાલી દરેમેહેરની પાસે એક ફંડ ઉભું કરી કામચલાઉ બીજી નવી દરેમેહેર ઉભી કરી તેમાં આતશ દાદગાહ સ્થાપીને રોજ ૯ મો માહ ૯ મો ય. સને ૧૨૮૨ ને દીને ખુલી મુકી હતી પણ શેઠ અરદેશર બે. ભીખુવાલાએ પોતાની દરેહમેહરનો બધો વહીવટ અંજુમન હસ્તક સોંપવાથી નવી દરેહુમેહર રોજ ૩૦ મો માહા ૧૨ મો ય. સને ૧૨૮૩ થી બંધ થઇ હતી.

(૫૩) આ ઉમરીગરવાલી દરેહમેહર તથા તેની પાસેનું મોબેદોના રહેથાનનું અનજુમનનું મકાન ઘણી બીસમાર હાલતમાં આવવાથી વડોદરાના રહીસ શેઠ મનચેરજી પેસતનજી પટેલે પોતાને ખરચે નવું મકાન બંધાવી રોજ ૨૦ મો માહ ૯ મો સને ૧૨૭૭ ને દીને ખુલ્લું મેલ્યું હતું.

(૫૪) વડોદરામાં શેઠ સીરવાઇવાળી ધરમશાલામાં એક ઓરડામાં જુદી દરેહમેહર કરવામાં આવી છે. એ બેઉ જગો રોજ ૯ મો માહા ૯ મો સને ૧૨૩૭ યઝદેજરદીને દીને તઇયાર થયાં હતાં પણ એ બંનને રોજ ૨૦ મો માહા ૨ જો સને ૧૨૩૮ ને દીને ઇજાદ ખુલ્લાં મેલાયાં હતાં. એની મરામત માટે રૂ ૨૦૦૦ શેઠ બેરામજીએ કાઢયા હતા, તેમાં એવણે રોજ ૧૫ મો માહા ૫ મો સને ૧૨૩૯ યઝદેજરદીને દીને મુંબઇ મધે મજગામમાં પોતાના બંગલામાં દરેહમેહેર પરથાવી તે દીને બીજા રૂ. ૩૦૦૦ ઉમેરી રૂપયા પાંચ હજાર કરી તેનું વ્યાજ કેટલાક વરસો સુધી વડોદરા ખાતે ખરચ કરવા મોકલાવ્યું હતું, પણ તે પછી શેઠ બેરામજી તથા એ દરેહમેહર અને ધરમશાલાના વહીવટ કરનારાઓ વચ્ચે વાંધો પડવાથી તેનો મુકદમો ચાર પાંચ વરશ ત્યાંની કોરટમાં ચાલ્યા બાદ કોરટે તેને લગતો વહીવટ કરનારા ત્યાંના ગ્રહસથોને નેમી તેઓને રૂપયા વગેરે સવાધીન કરવાનો હુકમ કીધો હતો. પણ એ મકાનોના નીભાવના રૂપયા વહીવટ કરનારાઓ પાસે નહીં હોવાથી તેઓમાંના શેઠ દાદાભાઇ શાપુરજીએ સને ૧૮૯૨ થી ૧૯૦૬ સુધી પોતાની ગીરોથી ખરચ કરી એ મકાનોનો નીભાવ કીધો હતો. એ પછી બધું સમાધાન થવાથી શેઠ બેરામજીએ તા૦ ૩૦ મી ડીશેમબર ૧૯૦૬ ને દીને એ બેઉ મકાનોના નીભાવ માટે રૂ. ૮૦૦૦ મુંબઇની પારસી પંચાએતના તરશટીઓને આપયા હતા કે તેનું વ્યાજ વડોદરાની કારોબારી કમીટી ઉપર મોકલવું અને તેમાંથી એને લગતો યોગ્ય ખરચ કરવો. ઉપર મુજબ નકકી થવા પછી એ અગીઆરી તથા ધરમશાલાની સાલગ્રહ રોજ ૨૦ મો માહા ૨ જો સને ૧૨૭૭ ય૦ ને દીને પડી તે વખતે શેઠ બેરામજી તરફથી જશનની કીરીયા કરાવ્યા પછી એ બેઉ મકાનો જાહેર વપડાશ માટે પાછા ખુલ્લાં મેલવામાં આવ્યાં છે. મુંબઇની મજગામવાલી દરેહમેહર ત્યાંથી કાઢી નાખવામાં આવી છે. એ ધરમશાલા બીશમાર થવાથી તેને શેઠ બેરામજી તરફથી સમરાવીને રોજ ૧૭ મો માહા ૧ લો ય. ૧૨૮૫ ને દીને ખુલ્લી મુકવામાં આવી હતી.

(૫૫) આ વલસાડની દરેહમેહરનાં મકાનમાં અસલ ફકત યોજદાથરેગરીના કામ માટે હીંથોડા દસ્તુર જામાસપ ભાઈજીના વખતમાં હતા, તે પછી શેઠ હોરમસજી ભી. ચીનાઇએ નવું મકાન ઈ. સ. ૧૮૧૯ માં બંધાવી આપયું હતું. શેઠો ખરશેદજી તથા જાહાંગીરજી હોરમજી ચીનાઇએ એ દરેહમેહરમા આતશ દાદગાહ તા૦ ૧૩ મી મારચ ૧૮૪૭ ને દીને પરઠાવ્યા હતા. એ મકાન જુનું થવાથી શેઠ નવરોજી જાહાંગીર ગામડયાએ બીજી વધુ આજુબાજુની જગા ખરીદી તેપર નવું મકાન બંધાવી તેમાં જુના દાદગાંને રોજ ૩ જો માહા બીજો ય. સને ૧૨૮૨ ને દીને ખુલ્લા મુકયા હતા.

(૫૬) સરોડા ગામમાં યજદેજરદી સને ૧૨૩૩ ની સાલમાં મુંબઈવાલા શેઠ ખરશેદજી ફરદુનજી પારખે દરેહમેહરનું એક મકાન બંધાવી આપયું હતું અને તયાં માત્ર ધરમનું કીરીયા કામ થતું હતું પણ દાદગાં કે આદરીયાન પરથાવેલાં નહીં હતા તે પછી એમ બન્યું કે—ઉમરા ગામમાં રોજ ૨૩ મો માહ ૯ મો યજદેજરદી સને ૧૧૮૫ માં શેઠ બમનજી સોરાબજી કપાવાલાને નામની અને તેમના ખેશી શેઠ ફરામજી નાનાભાઈ ઉમરીગરે મરહુમ શેઠ જીજીભાઈ દાદાભાઇના ધરમખાતાના તરશટીઓને પાછલથી આપેલી એક રકમના ઉપજતાં વ્યાજનાં ખરચમાંથી ચાલતી એક આદરીયાનની દરેહમેહર હતી. પણ ત્યાં જરથોશતી વસતી ઘટી જવાથી તે ઉપયોગમાં આવતી નહી હતી તેથી તે આદરીયાન તયાંથી ઉઠાવી લઇને સુરતમાં માછલીપીઠની વાહડયા ફલ્યાવાલી અગયારીમાં લાવી રાખવામાં આવયા હતા, જેનો ચાલુ ખરચ ઉપર કહયું તેમ મરહુમ શેઠ જીજીભાઈ દાદાભાઈનો ધરમખાતાના તરસતીઓ તરફથી કરવામાં આવતો હતો. એ જગોપરબી આદરીયાનની જરૂર નહી જણાવાથી તરસતીઓએ આદરીઆંનને કોઈ લાયક જગા ઉપર ગોથવવાની તજવીજમાં હતાં. તેવોને ઉપલાં સરોડાં ગામવાલા દરેહમેહરની અમથાં મકાનની ખબર પડી કે તયા એક આદરીયાનની જરૂર છે તે ઉપરથી અથોરનાનોના ગામે ગામના હદની હક ઉપરથી ઉડવાડેના અંધ્યારૂની એક જોદ શરોડાની અગીયારીમાં બોલાવીને તેવોનો મારફતે રોજ ૪ થો માહા ૧૦ માને દીને જશન કરયું હતું તે પછે રોજ ૩૦ મો માહા ૩ જો સને ૧૨૭૬ યજદેજરદીને દીને પેલાં અસલ ઉમરા ગામનાં આદરાનનાં કેબલાને નવેશરથી પરઠીને શરોડાની દરેમેહર ખુલી મેલી છે.

(૫૭) આ શીકંદરાબાદની દરેહમેહેર ય. સને ૧૨૦૮ માં શેઠો વીકાજી તથા પેસતનજી મેહેરજીએ દાદગાંહની બનાવી હતી પણ એ નાધલી પડવાથી એજ કંપાઉંડમાં મોટી કુસાડે દરેહમેહેર શેઠો વીકાજી તથા પેસતનજી મેહેરજીએ બાંધી રોજ ૨૦ મો માહા ૧૨ મો ય. સને ૧૨૯૬ ને દીને તેમાં આતશ આદરાનને પરઠીને ખુલ્લી મુકી છે.

(૫૮) આ સીગનપોરની દરેહમેહર અસલ મુંબઇવાલા શેઠ લવજી નશરવાનજી વાહાડયાએ બંધાવી હતી, તે પછી શેઠ નવરોજી જમશેદજી વાહાડયાએ રોજ ૧૭ મો માહા ૨ જો ૧૨૧૯ ને દીને બંધાવી હતી, એ દરેહમેહરની પાસે રૂ ૬૦૦૦ ની કીમતે મોબેદોને રહેવા માટેનું ઘર શેઠ એદલજી કુવરજી પટેલે ખેસી બાઇ પીરોજબાઈ માણેકજી પટેલના પુણ્ય માટે બંધાવી રોજ ૧૩ મો માહ ૧૦ મો ય. સને ૧૨૮૦ ને દીને ખુલ્લું મુકયું હતું.

(૫૯) આ સુમારીની દરેહમેહર જુની થયાથી કેટલીક મુદતે ફરીથી સુરતવાલા શેઠ જમશેદજી સોરાબજી હોડીવાલાએ બંધાવી હતી. તે પછી વળી મુંબઇવાલા શેઠ કુવરજી માણેકજી મુકાદમે રોજ ૧ લો માહા ૮ મો સને ૧૨૯૧ માં આદરાન પરઠીને બંધાવી હતી. તે રેતીમાં પુરાઇ જવાથી તેવણના વારેસ શેઠ રૂશતમજી શાપુરજી મુકાદમે રોજ ૨૦ મો માહા ૪ થો સને ૧૨૩૮ માં પાછી બીજી જગાપર બાંધીને આતશ આદરાન પરઠેઆં છે.

(૬૦) મુંબઈવાલા મરહુમ શેઠ દોરાબજી નશરવાનજી મીશાતરીએ પેહલાં માત્ર ધરમ કીરીયા માટે એક મકાન બંધાવ્યું હતું—તે વખતે ઇંધારા મુકાવેલા નહી તથા દાદગાહ પરઠાવેલા નહી હોવાથી અને એ મકાન બીસમાર હાલતમાં આવવાથી મરહુમના બેટા શેઠ દીનશાહજીએ રૂપયા દશ હજારનો ખરચ કરી નવેસરથી એક નવું મકાન બંધાવી તેને ઇજી તેમાં આતશ દાદગાહ પરઠવાની કીરીયા તથા ઉપરના અરધા ભાગમાં સથાપવામાં આવેલી ધી દીનશાહ દોરાબજી મીસતરી લાઇબરેરી અને રીડીંગ રૂમ ખુલ્લો મેલવાની કીરીયા રોજ ૨૧ મો માહા ૨ જો ૫૦ સને ૧૨૭૯ ને દીને થઇ હતી.

(૬૧) આ શુરતની શેઠ બીશનીવાલી દરેહમેહર બીશમાર હાલતમાં આવવાથી એ મકાનની ઉપજનાં વધારામાંથી તથા તેના એક મુતલવી શેઠ ફ્રામરોજ બેહરામજી બીશનીએ પોતાની તરફના વધુ નાણા ઉમેરી લગભગ રૂપીઆ પંદર હજારના ખરચે નવું મકાન બંધાવી આપયું હતું. તે તઇયાર થવાથી તેમાં એ દરેહમેહરની ૭૦ મા વરસની સાલગરેને દીને યાને રોજ ૧૭ મો માહા ૪ થો સ.૧૨૭૭ ને દીને આતશ આદરીયાનેં પાછા તખતનશીન કરવામાં આવ્યા હતા.

(૬૨) એ દરેહમેહર અસલમાં જમશેદજી જાઇઆ નામના એક શુરતના પારસીએ પાલીઆ ફલીઆમાં બાંધેલી હતી જેને માટે તેવણે પોતાને તાહાં ફરજંદ આવે તો તે બાંધવાની માનતા કરેલી હતી તેથી તે બંધાઇ હતી. તે બીશમાર થવાથી મુંબઈવાલા શેઠ માણેકજી નવરોજી વાડીઆજીએ તથા ભાઈએ પોતાના બાવાજીના પુનને સારૂં બાંધી છે.

(૬૩) એ દરેહમેહર અસલ પાલનજી હોમાજી શેઠની બાંધેલી હતી તે શુરતની શને ૧૧૯૧ યજદેજરદીની મોટી આગમાં બલી જવાથી ઉમરેવાલા શેઠો મેહેરજીભાઇ પટેલ તથા રતનજી છીબરજી શુરતવાળાએ રોજ ૨૨ મો માહા ૧૨ મો સને ૧૧૯૨ માં બાંધી હતી અને તેબી પુરાણી થવાથી મુંબઈવાલા શેઠ પેસતનજી નશરવાનજી બાટલીવાલાએ બંધાવી છે.

(૬૪) નવશારી ખાતે અસલ કોઈ કોઈવાર બહારથી પીંડારાવો નીકલી આવી દરોડો પાડતા હતા, ત્યારે તાંહાની વશાતી શુરત તરફ નીકલી જતી હતી તેવી વખતે જરથોશતી ધરમ કીરીઆ કરવા ખાતર શુરતના રૂશતમપુરામાં નવસારીના મરહુમ દેસાઇ ખુરશેદજી ટેમુલજીએ ઈ. સ. ૧૭૭૬ માં એ જગોએ પેહલાં તો અમથા ધરમનાં કામ માટે બે તરણ હીંપોલા મુકાવ્યા હતા પણ તે પછી એ દેશાઈ ખુરશેદજીના બેટા દેસાઈ મનચેરજી ખુરશેદજીએ આ દરેમેહેર બાંધી હતી. તે પુરાણી થવાથી મુંબઈવાલા મરહુમ શેઠ એદલજી દાદાભાઇ શુખીઆના છોકરાઓએ રોજ ૭ મો માહા ૨ જો સને ૧૨૩૩ ને દીને નવેશરથી બંધાવી હતી. એની સાથે વળી તેઓએ એક ધરમશાલા પણ બાંધી હતી. એ મકાનમાં પાછલા ભાગપર એક ઓટલો અને તેની ઉંચી દેવાલ તયાંનાં દશતુર દારાબજી ખરશેદજી દારાબજી પાલણનાએ બાંધી છે. એ દરેહમેહેરનું મકાન બીશમાર હાલતમાં આવવાથી શેઠ કેકોબાદ હોરમજી રાવે પોતાના મરહુમ બાવા હોરમજી તથા મરહુમ માતાજી બાઇ માણેકબાઈનાં પુણ માટે લગભગ રૂપયા ૧૫૦૦૦ ને ખરચે બંધાવી આપેલું નવું મકાન ઇજાવી ખુલ્લું મેલવાની કીરીયા રોજ ૨૧ મો માહા ૯ મો સને ૧૨૬૭ ને દીને કરવા પછી વળી શેઠ કેકોબાદ રાવે પોતાના મરહુમ માતાજી બાઇ માણેકબાઇના પુણ માટે મરહુમની બાજને દીને યાને રોજ ૩ જો માહા ૧૨ મો સને ૧૨૭૭ ને દીને એ દરેહમેહેરમાં આતશ દાદગાહ તખતનશીન કરાવી પાંચે ગેહમાં બોય દેવાનું શરૂ કરાવ્યું હતું.

(૬૫) એ દરેમેહર આગલ શેઠ શાપુરજી ખચાભાઇ દોટીવાલાની બાંધેલી હતી પણ તે યજદેજરદી શને ૧૧૯૧ માં શુરત ખાતે લાગેલી મોટી આગમાં બલી ગયાથી તેમના આ બેશોએ પાછી બાંધી છે. આ દરેહમેહેર પાછી બીસમાર હાલતમાં આવી પડવાથી બાઈ દીનબાઇ નશરવાનજી માણેકજી પીટીટે મરહુમ બેટા શેઠ જમશેદજીના પુણ માટે તે નવેસરથી બંધાવી તેને ઇજવાની કીરીયા રોજ ૩ જે માહ ૭ મો શેનશાહી સને ૧૨૬૨ને દીને કરવામાં આવી હતી.

(૬૬) આ આદરીઆન ઘણું પુરાણું છે, તેના અસલ બાંધનારનું નામ જણાતું નથી પણ તે ગોતીના આદરીઆનને નામે ઓળખાય છે. હાલ શુધી તેના મકાનની મરામત જુદા જુદા સખી ગરસાયોએ કેટલીકવાર કીધી છે.

(૬૭) એ દરેહમેહેરને ફરીથી શેઠ જીવણજી જામાશજી મીશાતરી—શુમારીવાલાએ યજદેજરદી સને ૧૨૭૭ માં રોજ ૯ મો માહા ૯ મા ને દીને રૂ૧૫૦૦૦) ખરચીને નવેશરથી બંધાવી વધારી આપી છે.

(૬૮) મુંબઇના શેઠ હોરમજી વાહાડીઆજીવાલાં આતશબેહેરામના મુતવલીઓને નવશારીના ભગર સાથના મોબેદો વચે મીનાકેશો થવાથી વાહાડીઆજીવાલાઓએ પોતાને લગતા નવસારીના મોબેદોની સગવડ કાજે એક નવી દરેહમેહેર નવસારીમાં બાંધી હતી પણ નવસારીના ભગરીઆ મોબેદોએ ગાયકવાડીમાં ફરીઆદ માંડીને તે દરેહમેહેર તાહાંથી ઉઠાવી જવાનો હોકમ મેલવવાથી—વાહડીઆજીવાલાઓએ તે દરેમેહેરનાં આતશને શુરત ખાતે બરશનુંમ વાલા મોબેદો સાથે પવીતરાઈથી લઇ જઇને તયાંના શેઠ દાદાભાઈ મોદીવાલા આતશબેહેરામનાં મકાનમાં બાંધેલી એક હલાયદી દરેમેહેરના ગુંબજમાં યજદેજરદી સને ૧૨૬૯ નાં જમશેદી નોરોજને દીને પરઠયા છે.

(૬૯) શુરતમાં બીબીની વાડી આગલ એટલે શેનશાહી આતશબેરામની નજદીક શુમારે દોઢસો વરસની પુરાણી દરેમેહેર અનજુમનની બાંધેલી છે, તેનો ચોકસ દાહાડો વાર મલતો નથી. એ દરેમેહેર અસલ એક મોબેદ ખુરશેદ કાવશાને હશતક હોવાથી માતર ખશીની અગીઆરી તરીકે ઓળખાય છે. કેટલાક જરથોસતીઓની મદદથી એક ફંડ ઉભું કરી તેમાં રૂ. ૨૨૦૦) ભરાયા છે, તેમાંથી જેમ તેમ એનો વહીવટ મોબેદ દાદાભાઈ રૂશતમજી ખશીના બીજા ટરસટીઓની સાથે ચલાવે છે.

(૭૦) આ સતારાની દાદગાહની દરેહમેહેરનું મકાન ઘણુંજ પુરાણુ થવાથી ઇ. સ. ૧૮૯૨ માં સરકાર તરફથી જમીનનો કટકો મુફત મેલવી તયાં નવું મકાન સતારાની અનજુમને બાંધવાનો ઠરાવ કીધો હતો પણ ફંડ પુરતું નહી હોવાથી તેમ થઇ શકયુ નહી, તેટલા સખી વજીદ બાઈ નવાજબાઇ દીનસાહજી ખાને પોતાને ખરચે એક નવું મકાન બંધાવી આપી તેના નીભાવ વગેરે માટે સારી રકમ આપી છે. એ મકાન ઇજાવી રોજ ૨૩ મો માહા ૧૦ મો સને ૧૨૮૦ ને દીને ખુલ્લું મુકી તેમાં આતશ દાદગાહ પરથવામાં આવયા છે.

(૭૧) આ દરેમેહેર અસલમાં યજદેજરદી શને ૧૨૧૪ ના રોજ ૯ મો માહા ૫ મો શેનશાહીને દીને શેઠો બીકાજી તથા પેશતનજી મેહેરજી તથા અનજુમન મલીને બંધાવેલી હતી. તે બીશમાર હાલતમાં આવવાથી યજદેજરદી સને ૧૨૪૮ માં રોજ ૯ મો માહા ૧૨ મો શેનશાહીને દીને અનજુમનને ખરચે નવેસરથી બાંધી છે.

જરથોસ્તીઓએ બંધાવેલા દુખમાંઓ.

મુંબઇ મધેનાં દુખમાંઓ.

કોણે પરઠેલાં યાને બંધાવેલાં	રોજ.	માહા.	ય. સને	શે. કે ક.
કાવસજી એદલજી બીશની	૧૨	૮	૧૨૧૩	શેનશાહી
દાદાભાઇ નોશેરવાન (પોતાની વાડીમાં)	૧૬	૮	૧૧૬૭	કદમી

[આ દોખમું ફક્ત દાદીશેઠના કુટુંબીઓને માટે છે.]

ફરાંમજી કાવસજી બનાજી	૫	૯	૧૨૦૧	,,
મનચેરજી જીવણજી રેડીમની	૩	૧૨	૧૧૫૫	શેનશાહી

[આ દોખમું પોતાનાંજ ઉપયોગ સારૂ એવોએ બાંધ્યું હતું]

માણેકજી નવરોજી શેઠના	૧૯	૧	૧૧૨૫	,,
મુંબઈની પારસી પંચાયતે બંધાવેલું	૨૬	૭	૧૧૪૮	,,
મોદી હીરજીભાઈ વાછાગાંધી	૧૯	૧	૧૦૩૯	,,

દેશાવરો ખાતેનાં દુખમાંઓ.

ઠેકાણા.	કોણે પરઠેલાં યાને બંધાવેલાં.	રોજ.	માહા.	ય. સને	શે. કે. ક.
અંકલેશર	નરસંગ ધનપાલ (હાંસોટવાલા)	...			શેનશાહી
,,	પેશતનજી બમનજી વાડીઆ	૧૯	૬	૧૧૭૯	,,
અજમેર	અનજુમને બંધાવેલું	૨૬	૬	૧૨૫૭	,,
આબુરોડ	મોટાભાઈ બી. કંટરાકટર ને અંજુમન મલીને ...	૧	૭	૧૨૫૮	,,
અમદનગર	અમદનગરની અનજુમને બંધાવેલું	૧૮	૬	૧૧૯૬	,,
,,	જરથોસ્તી અંજુમને બંધાવેલું	૧૫	૪	૧૨૧૧	,,
અમદાવાદ	અમદાવાદની અનજુમને બંધાવેલું	૨૫	૮	૧૨૧૨	,,
,,	સર જમશેદજી જીજીભાઇ નાઇટ	૨૩	૮	૧૨૧૯	,,
,,	અનજુમને બાંધેલું	૧૮	૬	૧૨૩૫	,,
અમરેલી	અનજુમને બાંધેલું	૩૦	૬	૧૨૨૭	,,
આલપાઇ	નવરોજી કાવસજી નારીએલવાલા	...		...	,,
આકોલાં	અંજુમને બાંધેલું	૩	૬	૧૨૬૪	,,
ઇગતપુરા	અંજુમને બાંધેલું	૧૬	૯	૧૨૫૪	,,
ઇદોર	અનજુમને બાંધેલું	૧૫	૬	૧૨૬૭	,,
ઉદવારા	ઉદવારાની અનજુમને બંધાવેલું...	૨૪	૭	૧૦૬૬	,,
,,	પેશતનજી ખરશેદજી મોદી	૨૯	૭	૧૨૦૦	,,
ઉરન	અનજુમને બંધાવેલું	૨૩	૪	૧૨૭૧	,,
એદન	અનજુમને બાંધેલું	૧૩	૧૨	૧૨૩૫	,,
,,	મેરવાનજી સોરાબજી ખરેઘાત	૭	૭	૧૨૧૬	,,
એલાવ	અનજુમનના ઉગરાતથી	૨૭	૭	૧૨૬૮	,,
ઔરંગાબાદ	વીકાજી અને પેશતનજી મેરજીભાઇ ...	૧૫	૪	૧૨૧૨	,,
કરંજ	હીનબાઇ તે પુંજીઆજી મનાજીના વીધવા	૨૪	૩	૧૧૯૮	,,

ઠેકાણું. કોણે પરણેલાં યાને બંધાવેલાં.	રોજ.	માહ.	ય. સને	કે. કે. ક.
કરાંચી–હોરમજી દાદાભાઇ ઘડીઆલી	૩૦	૪	૧૨૧૭	શેનશાહી
,, કરાંચીની અંજુમનને ખરચે	૧૯	૯	૧૨૪૪	,,
કલકતા–નવરોજી શોરાબજી ઉમરીગર	૨૭	૪	૧૧૯૧	,,
,, કલકતાની જરથોસ્તી અંજુમન...	૨૧	૭	૧૨૮૧	,,
કલીઆણી–નવાજબાઇ તે નશરવાનજી મોદીના વીધવા ...	...		૧૧૬૦	,,
,, નવરોજી બાલાભાઈ કલીઆણીવાલા	૧૫	૭	૧૨૫૫	,,
કુડીઆણું–અનજુમનને ખરચે...	૬	૩	૧૨૬૫	,,
ખંભાત–હીરજી આસા	...		...	,,
,, પેશતનજી ખરશેદજી મોદી	૨૯	૭	૧૧૯૫	,,
ખેરગામ–મોતીબાઇ તે આ૦ બ૦ જ૦ મુલાંના વીધવા ...	૫	૯	૧૨૫૧	,,
ગંનદેવી–ગંનદેવીની અનજુમને બંધાવેલું	૧૯	૧	૧૦૯૪	,,
,, અનજુમનનાં ઉઘરાણાંથી બાંધેલું	૪	૭	૧૧૫૯	,,
,, જમશેદજી નાનાભાઇ ગજદર–સપલાના	૧૯	૭	૧૧૮૬	,,
,, ગંદેવીની અનજુમને બંધાવેલું	૨૦	૭	૧૨૩૯	,,
ચીકલી–અનજુમનનાં ઉઘરાણાંથી બાંધેલું	૧૩	૬	૧૨૪૨	,,
જાલના–અનજુમનનાં ઉઘરાણાંથી બાંધેલું	૪	૮	૧૨૪૦	,,
તવરી–અનજુમનનાં ઉઘરાણાંથી બાંધેલું	૨૯	૭	૧૨૩૩	,,
તારાપોર–દોરાબજી ફરદુનજી લશકરી...	...		...	,,
[આ લેખનું ફાટી જવાથી પડતું પડ્યું છે.]				
,, અનજુમનનાં ઉઘરાણાંથી બાંધેલું	૨૭	૬	૧૨૩૫	,,
થાંણા–કાવશજી તથા દોરાબજી રૂશતમજી પટેલ	...		૧૧૪૯	,,
,, રૂશતમજી કાવસજી પટેલ	૧૯	૭	૧૨૧૨	,,
દમણ–માણેકબાઇ તે જમશેદજી બેરાંમજી લસ્કરીના વીધવા ...	૧૩	૮	૧૨૦૦	,,
દવીએર–અનજુમનનાં ઉઘરાણાંથી બાંધેલું	૧૩	૪	૧૨૦૮	,,
દીવ–જાહાંગીરજી નશરવાનજી વાડીઆજી...	૧૧	૬	૧૨૦૨	,,
દીશા–અનજુમનનું બાંધેલું	...		...	,,
દેવલાલી–બેરાંમજી નાનાભાઇ મીસતરી	...		૧૨૪૯	,,
,, અનજુમનનાં ઉઘરાણાંથી બાંધેલું	૧૯	૩	૧૨૭૭	,,
નવસારી–માંણેક ચાંગા આશા	...		૯૦૦	,,
,, માંણેકજી નવરોજી શેઠના	૧૧	૪	૧૧૧૬	,,
,, હોરમજી મનચેરજી કેરાવાલા (બાબા)	૪	૬	૧૧૯૨	,,
,, નશરવાનજી રતનજી તાતા	૨૦	૬	૧૨૪૭	,,
નારગોળ–માણેકજી નવરોજી શેઠના	...		૧૧૧૫	,,
,, મનચેરજી ખરશેદજી શેઠના	...		૧૧૩૬	,,
,, અનજુમનનાં ઉઘરાણાંથી બાંધેલું	૧૫	૯	૧૨૫૭	,,
પુણાં–સોરાબજી રતનજી પટેલ...	૨૯	૭	૧૧૯૪	,,
,, પુણાંની અનજુમનનાં ઉઘરાણાંથી બાંધેલું... ...	૩૦	૭	૧૨૦૪	,,
પારડી–અનજુમનનાં ઉઘરાણાંથી બાંધેલું...	૨૦	૯	૧૨૫૦	,,

ઠેકાણું.	કોણે પરઠેલાં યાને બંધાવેલાં.	રોજ.	માહ.	ય. સને	શે. કે ક.
બદનેરા	અનજુમનનાં ઉઘરાણાંથી બાંધેલું	૬	૭	૧૨૬૨	શેનશાહી
બાલાપુર	વીકાજી તથા પેસતનજી મેરજીભાઇ(હાલમાં મોજુદ નથી)	૨૮	૭	૧૨૦૮	,,
બીલીમોરા	રૂસતમજી બમનજી બાટલીવાલાનાં ધણીઆણી	૬	૩	૧૧૭૧	,,
,,	અનજુમને બંધાવેલું	૯	૭	૧૨૪૯	,,
ભરૂચ	પેસતનજી ભરૂચવાલા	...		૬૭૮	,,
,,	અનજુમને બંધાવેલું	...		૧૦૨૩	,,
,,	અનજુમનનાં ઉઘરાણાથી બાંધેલું	૧૯	૩	૧૨૦૩	,,
ભુસાવલ	અનજુમને બંધાવેલું	૨૯	૪	૧૨૫૮	,,
મહુવા	માંણેકજી જીજીનાં	૭	૮	૧૨૦૨	,,
,,	અનજુમને બંધાવેલું	૧૫	૪	૧૨૫૯	,,
મઉ	અનજુમનનાં ઉઘરાણાંથી બાંધેલું	૨૧	૮	૧૨૦૯	,,
માંડવી	અનજુમનને ખરચે	૪	૪	૧૧૯૯	,,
રાજકોટ	કાવસજી દીનશાહ એડનવાલા અને અનજુમન મળીને	૧૨	૯	૧૨૭૦	,,
રાંદેર	શા. મં. રેડીમની, હી. જી. રેડીમની, રૂ. દા. નાદરશા મલીને	૨૨	૮	૧૧૫૬	,,
,,	અનજુમનનાં ઉઘરાંણાથી બાંધેલું	૨૯	૬	૧૨૨૧	,,
વાનોલી	અનજુમનનાં ઉઘરાંણાથી બાંધેલું	૨૦	૫	૧૨૭૨	,,
વડોદરા	અનજુમનનાં ઉઘરાંણાથી બાંધેલું	૭	૯	૧૨૧૧	,,
વલસાડ	વઇઆરવાલાનાં ખાનદાંનીઓએ	...		૧૦૧૨	,,
,,	અનજુમનનાં ઉઘરાંણાથી બાંધેલું	૧૭	૪	૧૧૪૬	,,
,,	અનજુમનનાં ઉઘરાંણાથી બાંધેલું	૨૯	૬	૧૨૧૬	,,
,,	ધનજીભાઇ જુરાભાઇના કુટુંબીઓ	૪	૭	૧૨૭૭	,,
સીકંદરાબાદ	દખણ—વીકાજી અને પેશતનજી મેરજીભાઇ	૨૦	૧	૧૨૦૯	,,
સુનધડ બારા	અનજુમને બંધાવેલું	૧૫	૫	૧૨૩૨	,,
સુમારી	રતનજી માણેકજી શેટી તથા હાટરીઆ	૧૬	૨	૧૧૭૩	,,
સુરત	ઉદના—બાગરીઆ મોબેદોને સારૂ અનજુમને બાંધેલું	૨૬	૬	૧૨૫૩	,,
,,	ઉમરવાડા—નાનાભાઇ પુંજીઆજી	...		૧૦૩૬	,,
,, ,,	અનજુમનનાં ઉઘરાણાથી બાંધેલું	...		૧૧૦૩	,,
,, ,,	અનજુમનનાં ઉઘરાણાથી બાંધેલું	૨૮	૮	૧૧૪૦	,,
,, ,,	અનજુમનનાં ઉઘરાણાથી બાંધેલું	૫	૫	૧૧૯૭	,,
,,	ઉમરા—અનજુમનનાં ઉઘરાંણાથી બાંધેલું	૫	૭	૧૨૦૧	,,
,,	ભરથાણા—અનજુમનનાં ઉઘરાંણાથી બાંધેલું	...		૧૦૯૫	,,
,, ,,	અનજુમનનાં ઉઘરાંણાથી બાંધેલું	૮	૩	૧૧૩૪	,,
,, ,,	અનજુમનનાં ઉઘરાંણાથી બાંધેલું	૫	૫	૧૧૯૬	,,
સતારા	અનજુમનનાં ઉઘરાંણાથી બાંધેલું	૨૦	૭	૧૨૧૬	,,
સોલાપુર	વીકાજી અને પેશતનજી મેરજીભાઇ	૭	૫	૧૨૧૨	,,
હૈદરાબાદ	દખણ—(જમીસતાપુરની ટેકડીપર) દસ્તુર એરામજી જામાસ્પઆશાનાની નઇયતે અંજુમનનાં ઉઘરાણાથી	૧૯	૪	૧૨૮૫	,,

જરથોસ્તીઓએ બંધાવેલી ધરમશાળાઓ.

મુંબઇ મધેની ધરમશાળાઓ.

ઠેકાણું. કોણે બંધાવેલી	રોજ	માહ	ય. સને
કરેલવાડી—મેરવાંનજી ફરાંમજી પાંડે	૧૬	૬	૧૨૩૫
ગરાંટરોડ—રૂસ્તમજી જમશેદજી જીજીભાઇ	...		...
ચોપાટી—(ઇરાંણીઓ સારૂ) ખરશેદજી અરદેશર દાદીશેઠનાં બેશીઓ	૧૨	૨	૧૨૨૨
,, ,, સર કાવસજી જહાંગીર સી. એસ. આઇ.	૨૮	૯	૧૨૪૧
,,[આંધળા, લુલા જરથોસ્તી સારૂ] ફરદુનજી શોરાબજી પારખના સાહેબજાદાઓ(૧)	૧૫	૭	૧૨૧૪
,, ,, ખરશેદજી કાવસજી બનાજી	...		૧૨૦૪
ભાયખલા—સર જમશેદજી જીજીભાઇ બારોનેટ	૧૬	૮	૧૨૧૬
વાંદરે— માંણેકજી જીનાભાઇ	૧૦	૬	૧૨૧૮

દેશાવરો ખાતેની ધરમશાળાઓ.

અંકલેશ્વર—મેરવાનજી હોરમજી ફરેજર (૨)	...		૧૨૧૮
અજમેર—મનચેરશાહ નસરવાનજી રૂસ્તમફરામના(૩)	૧૭	૪	૧૨૭૧
અમદનગર—પેશતનજી સોરાબજી...	૧૩	૪	૧૨૨૮
અમદાવાદ—મનચેરજી સોરાબજી કરંજવાલા (૪)	૨૩	૪	૧૨૧૮
,, સોરાબજી જમશેદજી જીજીભાઇ (૫)	૧૩	૫	૧૨૩૩
અગાજણુ—પેશતનજી સોરાબજી પુણેવાલા	૨૦	૮	૧૨૨૯
અલીબાગ—હીરાજી હોરમજી બારીઆ	૨૦	૧૧	૧૨૪૨
ઓંકોલા—વીકાજી પેશતનજી મેહરજી (૬)	...		૧૨૦૮
આમોદ—કાવસજી માણેકજી મોદી	...		૧૨૪૧
એડન—મેરવાનજી સોરાબજી ખરેઘાટ	૭	૭	૧૨૧૬
ઈચ્છાપોર—પાલણજી, કાવસજી ધનજીભાઇ પાલિવાલા	...		૧૨૧૭
,, પીરોજબાઇ તે દાદાભાઈ માણેકજી વાછાના વીધવા	૮	૭	૧૨૪૫
ઉદવાડા—રૂસ્તમજી જમશેદજી જીજીભાઈ	૧૭	૫	૧૨૩૯
,, દીનશાહ દોરાબજી મીસતરી	૨૭	૪	૧૨૭૦
,, સ્ટેશન આગલ—જમશેદજી સોરાબજી એંટી ...	૮	૯	૧૨૭૦
,, ,, નવરોજી માણેકજી વાહાડયાની ઇસ્ટેટના ટરટીઓ	૧૨	૧૧	૧૨૮૧
ઓરપાડ—ખરશેદબાઇ તે એ. માણેકજી પાલનજી હોમજી કરંજીઆના વીધવા	૨૫	૧૦	૧૨૬૪
કચ્છ ભુજ—પેસતનજી શોરાબજીએ પોતાના પુત્ર કુવરજીની યાદગારી માટે...	૨૬	૧	૧૨૭૩
કલકતા—માણેકજી રૂસ્તમજી બનાજીની યાદગીરીમાં અંજુમનના ઉઘરાણાંથી બાંધેલી	૧૦	૭	૧૨૭૮
કલીકટ—હોરમસજી બમનજી વાહડીઆ	...		૧૧૯૩
કુંડીઆના—સર દીનશાજી માણેકજી પીટીટ ...	૨૭	૧૧	૧૨૬૫
ખંડાલા—સર જમશેદજી જીજીભાઇ બારોનેટ	...		૧૨૦૮
ખેરગાંમ—અનજુમનના ઉઘરાણાથી	૧૧	૨	૧૨૫૫
ગંદેવી—નવરોજી જમશેદજી વાહડીઆ	૭	૯	૧૨૧૮
જાંહાંબોરડી—પેશતનજી ખરશેદજી કામા	૧	૧૨	૧૨૦૦

ઠેકાણું.	કોણે બંધાવેલી.	રોજ	માહ	ય. સને
દમણ	રતનબાઇ તે હોરમજી મનચેરજી કામાના વીધવા	...		૧૨૧૫
દંતોરા	વસાઇ—અરદેશર દાદાભાઇ દાદીશેઠ	...		૧૧૭૪
દેહણું	મનચેરજી તથા બમનજી માણેકજી ભંડારા	...		૧૧૯૮
નવસારી	નોસરવાન બાગ—આ૦ નશરવાનજી ખરશેદજી કાંગા	૧૯	૮	૧૨૩૭
,,	નવાજબાઇ તે કુંવરજી હોરમજી ભાભાના ધણીઆણી	૧	૯	૧૨૨૫
નાગપોર	બીલીમોરીયા બ્રધરસ	૨૫	૪	૧૨૭૬
પારડી	પેસતનજી બમનજી વાહડીઆજી	...		૧૧૫૮
,,	હોરમશજી ગાંડાભાઇ	૧૭	૯	૧૨૫૦
પાહારી	ફરાંમજી નશરવાનજી પટેલ	...		૧૨૧૯
પુણાં	ભવાંનીપેંટ—પેશતનજી શેરાબજી	૨૮	૭	૧૨૨૭
,,	સ્ટેશન આગળ—હોરમજી સોરાબજી તાડીવાલા	૧૯	૧	૧૨૨૪
,,	કાપ—મુંબઇવાલા નવરોજી ગીશતા તથા શાપુરજી શુબેદાર	...		૧૧૫૪
પોરબંદર	જુના બોખીરાગામ—હીરજીભાઈ નવરોજી વાડયાંએ પોતાના ધણીઆણી રતનબાઈની નઇયતે	૧૬	૯	૧૨૭૭
બીલીમોરા	રુસતમજી મેરવાનજી બીલીમોરયા	૧૬	૧૦	૧૨૧૪
ભગવા ગાંમ	એદલજી ફરાંમજી આલબલેશના શાહેબજાદા	...		..
ભરૂચ	જમશેદ બાગ—જમશેદજી હોરમજી વખારીયાના બેશીઓ	૨૭	૬	૧૨૫૨
,,	કોટમાં—મેરવાન બાગ—મેરવાંનજી હોરમજી ફરેજર	૧૯	૧	૧૨૧૩
,,	કાંહાપર—રૂશતમજી જમશેદજી જીજીભાઇ	...		૧૨૩૫
,,	બહારકોટ—મેરવાંનજી હોરમજી ફરેઝર	...		૧૧૯૨
ભાહાંગાંમ	માણેકજી દોરાબજી બુચર	...		૧૨૪૯
ભેશાંણુ	આવાંબાઇ તે કાવસજી બેજનજી આલબલેસનાં ધણીયાણી	૨૮	૬	૧૨૫૩
મઉ	ભીખાઇજી નવરોજી બોરીની નઇએતે...	૧૭	૨	૧૨૫૮
મહાબલેસ્વર	ફરાંમજી નશરવાંનજી પટેલ	...		૧૨૨૯
,,	મેહેરા ગાંમ—ફરાંમજી નશરવાંનજી પટેલ	...		૧૨૨૮
મહુવા	માણેકવાડી—અરદેશર ભીખાજી પટેલ	૧૭	૨	૧૨૮૦
માંડવી	જીલ્લા સુરત—અરદેશર ભીખાજી પટેલે ધણીયાણી રતનબાઇના પુણ્ય માટે	૮	૫	૧૨૮૦
રાંદેર	હોરમજજી માણેકજી માન્જુ...	...		૧૨૦૮
વડોદરા	કાંપ—બેરાંમજી નશરવાનજી શીરવાઇ તથા બીજાઓ	૨૦	૨	૧૨૩૮
વલસાડ	નવરોજી પેશુતનજી કાપડીઆ	૨૬	૪	૧૨૪૯
,,	મોટાભાઇ શાપુરજી	૧૬	૯	૧૨૧૯
વસઇ	દાદાભાઇ તથા મનચેરજી પેશતનજી વાહડીઆ	...		૧૧૦૫
,,	લવજી સોરાબજી લાકડાંવાલા	૧	૩	૧૧૫૮
વસાઈ	ગોરબંદર—નવરોજી જમશેદજી વાહડીઆ	...		૧૧૯૮
સંજાણુ	વીકાજી મેહેરજી	...		...
શીકંદરાબાદ	એદલજી સોરાબજી ચીનાઇ	૧૬	૫	૧૨૫૮
શીગનપોર	માંણેકજી રતનજી શીગનપોરીઆ	૧	૧૨	૧૨૪૧
સુમારી	કરારી બંદર—ફરદુનજી સોરાબજી પારખ	...		૧૨૦૮

ઠેકાણું	કોણે બંધાવેલી	રોજ	માહા	ય. સને
સુરત–શાહએન	ખરશેદજી ફરદુનજી પારખ...	...		...
,, સ્ટેશન આગળ	ખરશેદજી ફરદુનજી પારખ	૧૩	૩	૧૨૩૪
,, ગોપીપુરે	જાંગીરજી નશરવાંનજી વાહડીઆ	૧	૭	૧૨૧૦
,, નાનપરે	કાવશજી રૂસતમજી તમનાની નઇએતે (૮)	૨૫	૧૦	૧૧૮૮
,, રૂસતમપરે	એદલજી દાદાભાઇ સુખઆના વારેશો(૯)	૭	૨	૧૨૩૩
,, શયદપરે	ભીમજીભાઇ રતનજી એંટીની નઇએતે	...		૧૧૬૮
,, શીંધીવાડ	આ૦ મનચેરજી ખુરશેદજી શેઠના...	૬	૧	૧૧૩૧
,, આમોદ	કાવશજી માંણેકજી મોદી	...		૧૨૪૦
,, મુગલીસરાહ	પેસતનજી ઉકરજી શેઠનાના પુણ માટે એકઝીક્યુટરોએ	૭	૯	૧૨૮૫
સોલાપુર–કામા હાલ	હોરમજી દોરાબજી કામા–અનજુમન મલીને ...	૩૦	૭	૧૨૫૮
હજીરા–જીલ્લા સુરત	ફરદુનજી શેરાબજી પારખ	...		૧૨૦૮

[૧] આ ધરમશાળા પહેલવહેલી યઝદેજરદી સને ૧૨૧૪ માં મરહુમ શેઠ ફરદુનજી સોરાબજી પારખના સાહેબજાદા–આએ બેહસતનશીન બાઈ પારોજાબાઈ તે શેઠ જમશેદજી ફરદુનજી પારખના ધણીઆણીના પુનને માટે બંધાવી પારસી પંચાએતના ટ્રસ્ટીઓના સ્વાધીનમાં આપી હતી. તે પછી સને ૧૨૩૩ માં શેઠ ખરશેદજી ફરદુનજી પારખે પોતાને ખરચે એ ધરમશાલાની ઉપર માલ બંધાવી કેટલોક ફેરફાર કરાવી આપ્યો હતો.

[૨] આ ધરમશાળા અંકલેસરવાલા શેઠ પેશતનજી નશરવાનજીની કંપનીએ સને ૧૨૪૩ માં ફરીથી બંધાવા છે.

[૩] આ અજમેરની ધરમશાળા શેઠ મનચેરશાહ ન૦ રૂશતમફરામનાએ નવેસરથી બંધાવીને એવણના મરહુમ બેટા ફરામરોજની બારમાં વરશની બાજ રોજ ૧૮ મો માહા ૧૨ મો સને ૧૨૮૦ ને દીને પડી તે દીવસે ખુલ્લી મેલી હતી.

[૪] અમદાવાદની શેઠ મ. સો. કરંજવાલાની ધરમશાલા જે અગાઉ ત્યાંની દરેહમહેરની સાથે એક ઓરડામાં હતી તે સને ૧૮૭૫ ના સાલમાં રેલ આવવાથી પડી જવા પછી હસ્તીમાં રહી નથી.

[૫] અમદાવાદની સો. જ. જીજીભાઈની નાથલી ધરમશાલા બીશમાર હાલતમાં આવવાથી તે તોડાવીને તેની જમા ઉપર સર નવરોજી પેશતનજી વકીલ સી. આઇ. ઇ. એ મોહટી ફુસાડે ધરમશાલા રોજ ૮ મો માહા ૪ થો સને ૧૨૬૩ યઝદેજરદીને દીને બંધાવી ખુલ્લી મેલી છે.

[૬] આ ધરમશાલા પુરાણી થવાથી અને વશતીની જગોથી દુર પડવાથી આંકોલાના માજી આસીસટંટ કમીશનર દરાવુરજી બમનજી જામાશપજી જામાશપઆશાનાએ આગેવાની લઈ લોકોનાં ઉધરાતથી ફંડ એકઠું કરીને જુની ધરમશાલાનો કાત ઉખેડી લાવી વશતીની નજદીકની જગોપર રોજ ૨૫ મો માહા ૧ લો સને ૧૨૫૦ યઝદેજરદીને દીને એ ધરમશાળા નવેશરથી બાંધી છે.

[૭] ભરૂચની કોટન શેઠ ફરેઝરવાલી મેરવાન બાગની ધરમશાલા બીસમાર થવાથી દરૂસ્ત કરાવી આ ધરમશાળા અસલ બંધાવનાર મરહુમ શેઠ મેરવાનજીના પુત્ર ખા. બા. બરજોરજી મેરવાનજીએ રોજ ૧ લો માહા ૮ મો સને ૧૨૫૦ ય. ને દીને ખુલ્લી મુકી હતી. એ ધરમશાલામાં સર અવસરે થતાં જમણ વખતે જગાની તંગાસ પડતી હોવાથી એ ધરમશાલાના આગમણા એ ટસા ઉપર શેઠ રૂશતમજી હોરમજી વખારીઆએ એક હોલ બંધાવી આપયો છે તેને "રૂશતમજી વખારીઆ હોલ" નામ આપયું છે અને તે રોજ ૧૦ મો માહા ૮ મો ય. ૧૨૮૫ ને દીને ખુલ્લો મુકયો છે.

[૮] સુરતમાં શેઠ કાવસજી તમનાએ ઇ. સને ૧૮૧૮ માં ધરમશાલા બાંધવાનું શરૂ કીધેલું પણ એવણનું મરણ નીપજવાથી ભાણેજ શેઠ પાલનજી કા. અહુંગરે કામ પુરૂ કરી શેઠ કાવસજીની છમસીને દાને રોજ ૨૫–૧૦–૧૧૮૮ યાને તા૦ ૨૬–૭–૧૮૧૯ ને દીને ધરમશાલા ખુલ્લી મુકી હતી, પાછલથી શેઠ મેરવાનજી હોરમજી ફરેજરે પોતાને ખરચે એ ધરમશાલા દુરૂશત કરાવી ઉતર દીશાનો મોટા ઓટલાનો ગાલો વધારી ધરમશાલા રોજ ૧૪–૧૧–૧૨૧૪ યાને તા૦ ૭–૮–૧૮૪૫ ને દીને ખુલ્લી મુકી હતી. એ પછી ઇ. સ. ૧૮૮૨ માં નાનપરાની અંજુમને દુરૂસતી કરાવી હતી. આ ધરમશાલા બીસમાર થવાથી નવેસરથી એક માલવું બાંધ્યું છે. માલનો ઉતર ભાગ "આદરજી ડેપ્યુટી હોલ" તરીકે શેઠ આદરજી જી. ડેપ્યુટીના છોકરાઓએ અને દક્ષીણનો ભાગ "લાલકાકા હોલ" તરીકે શેઠ એદલજી પા. લાલકાકાના કુટુંબે શરઅવસરે વાપરવા બાંધ્યાં છે, એ ધરમશાલા તથા હોલો રોજ ૧૩ મો માહા ૨ જો શેહેનશાહી ૧૨૮૬ ને દીને ખુલ્લા મુકયા હતા.

[૯] આ સુરતની સુખ્યાવાલી ધરમશાલાનું મકાન બીસમાર હાલતમાં આવવાથી બાઈ જરબાઈ નવરોજી અમારબગવાલાએ પોતાના ખાવીંદ શેઠ રૂશતમજી બેરામજી દારૂવાલાના પુણ માટે વધતી મરામત કરાવીને એ ધરમશાલા રોજ ૧૯ મો માહા ૬ મો શે. સને ૧૨૮૫ ય. ને દીને ખુલ્લી મુકવામાં આવી હતી.

જરથોસ્તીઓએ બંધાવેલાં જાહેર વપડાસનાં મકાનો.

મુંબઇ મધેનાં જાહેર વપડાસનાં મકાનો.

	રોજ	માહ	ય. સ.
ફરેલવાડી–હમાબાઇ માણેકજી નશરવાનજી પીટીટ વીધવા આશરમ–દીનબાઇ નશરવાનજી પીટીટે સ્થાપેલું	૨૭	૪	૧૨૬૮
કોટમાં–જાહેર હોલ–સર કાવસજી જાહાંગીર બારોનેટ	૬	૧૦	૧૨૮૭
,, માણેકજી શેઠની વાડી–માણેકજી નવરોજી શેઠના	...		૧૧૯૧
કોલાબા–મેરવાન બાગ–(પારસી સેનેટરીયમ) મેરવાનજી ફરામજી પાંડે	૧૩	૩	૧૨૩૫
ખંબાલા હીલ–ફરામજી દીનશાહ પીટીટ પારસી સેનેટરીયમ–ફરામજી દીનશાહ પીટીટની પોતાની પુંજીમાંથી	૧૨	૫	૧૨૭૧
ખેતવાડી–ગરીબ જરથોસ્તીઓ માટે સસ્તાં ભાડાંની ચાલી–નવરોજી ધનજીભાઇ ગોલવાલાની પુંજીમાંથી	૧૧	૭	૧૨૮૩
,, બાટલીવાલાની વાડી–શાપુરજી મનચેરજી બાટલીવાલા ...			
,, હોરમજ બાગ–કાવસજી હોરમજી સરાફ	૨૬	૧૦	૧૨૪૧
,, હોરમજી પેસતનજી બાટલીવાલાની વાડી	૧૯	૧૧	૧૨૩૩
ગીરગામ–ઓલબલેસ બાગ–એદલજી ફરામજી આલબલેસનાં વારેસો ...	૨૨	૧	૧૨૩૮
તારદેવ–વાડીયા સ્ટ્રીટમાં–ગરીબ જરથોસ્તીઓ માટેની સસતાં ભાડાંની ચાલી–સોરાબજી મનચેરજી નીકલસનના બેટાઓ	૧૨	૭	૧૨૮૫
,, વાડીયા સ્ટ્રીટમાં–ગરીબ જરથોસતીઓ માટેની ચાલી–દોરાબજી ડોશાભાઈ બીમડીવાલાએ માત પીતાના પુણ્ય માટે			૧૨૮૫
,, ગરીબ જરથોશતીઓના રેહેઠાણોના ફંડ હસ્તકના જુદાં જુદાં મકાનો			...
ગીલડર સ્ટ્રીટ–ઉપલા ગરીબ જરથોસતીઓના રહેઠાણોનાં ફંડ હસ્તકના જુદાં જુદાં મકાનો			...
,, ઝોરાસ્ટ્રીયન બીલડીંગ સોસાયટી તરફથી જુદી જુદી બંધાયલી સસતાં ભાડાંની ચાલીઓ	૧૬	૯	૧૨૭૭
પરેલ–ગોલનજી હીલ–ઉપલી ઝોરાસ્ટ્રીયન બીલડીંગ સોસાયટી હસ્તકની બમનજી હોરમજી જનરલનાની જગાપર બંધાયલી ચાલીઓ	૧૯	૮	૧૨૮૧
ધોબીતલાવ–ફરામજી કાવસજી ઇનશટીટયુટ–ફં.કા ના. કે. ખેશી ને મીત્રો મલીને	૨	૬	૧૨૩૧
ન્યુ ચરનીરોડ–કામા બાગ–પાલણજી ખરશેદજી કામા	૧૭	૯	૧૨૩૮
પાયધોની–એલાહી બાગ–સર જમશેદજી જીજીભાઇ પેહેલા બારોનેટ ...	૨૪	૫	૧૨૦૮
બાહારકોટ–પાલણજી દોરાબજી મેહેરજીનું મકાન	૧૧	૯	૧૨૧૪
મોદીખાના–નસરવાનજી માણેકજી પીટીટ વીધવા આશરમ–દીનબાઇ નશરવાનજી પીટીટે સ્થાપેલું	૬	૮	૧૨૬૧

દેશાવરો ખાતેનાં જાહેર વપડાસનાં મકાનો.

અંદેરી–અરદેશર બીખાજી પટેલે પોતાના ધણીયાણી રતનબાઇના પુણ્ય માટે દરેહમેહરને લગતું સર અવસરે વાપરવા બંધાવેલું મકાન ...	૨૩	૧૧	૧૨૮૦
અમદાવાદ–સેનેટરીયમ–રુસતમજી જેહાંગીરજી વકીલે પોતાના બાવાના પુનને માટે	૨	૧૨	૧૨૭૫
,, જાહેર હોલ–સર નવરોજી પેસતનજી વકીલ સી. આઇ. ઇ. ...	૯	૫	૧૨૭૭
આકોલા–કુવર હોલ–જમશેદજી પેશતનજી દસ્તુરે માતાજી કુંવરબાઇના પુન માટે	૨૬	૩	૧૨૬૮
અહમદનગર–ધનાપટેલ હોલ–દીનબાઇ બમનજી ધનાપટેલે પોતાના ધણી બમનજીના પુન માટે	૨૫	૭	૧૨૮૪
[illegible]–કુંવર હોલ–હોરમજી માણેકજી ભમગરા	૨૭	૧૧	૧૨૫૬

રોજ માહ ય. સને

ઉતાકામન્ડ–જાલ ફીરોજ હોલ–ફીરોઝ મનચેરજી કલબવાલાએ દીકરાના પુન માટે ૧ ૬ ૧૨૭૬
ઉરન–સેનેટરીયમ-હોરમજી માણેકજી ભીમડીવાલાએ પોતાના માતાપીતાના પુન માટે ૫ ૩ ૧૨૭૧
કરાંચી–જાહાંગીર બાગ–જાહાંગીરજી જમશેદજી રાજકોટવાળાનાં વારેસો ... ૨૬ ૧૧ ૧૨૫૭
,, સોરાબ ક્વારટર્સ–સોરાબજી બેરામજી કંત્રાકટરની યાદમાં કરાંચીની
ઝોરાસ્ટ્રીયન કલબના કમપાઉંડમાં બંધાયલો બંગલો ૨૭ ૧૧ ૧૨૭૮
,, ખરશેદબાઇ કાતરક પારસી હોમ–કાવશજી હોરમજી કાતરકે પોતાના
ધણીયાણીની યાદમાં બંધાવેલી સસતાં ભાડાંની ચાલી (એ ઉપરાંત
કરાંચીની પારશી પંચાયતની વાડીમાં ગુલબાઇ ન. મેહતા ચાલ તથા
બીજા સખી જરથોસ્તીઓએ બંધાવેલી ચાલો છે ... ૯ ૯ ૧૨૮૦
,, જાહાંગીર કોઠારી હોલ–પારસી ઇનસ્ટીટયુટના કંપાઉંડમાં–જાહાંગીર
હોરમજી કોઠારીએ બંધાવેલો ૨૪ ૧૦ ૧૨૮૫
,, સીઝદે ગાહે રૂવાન-રૂશતમ બેરામ ઇરાનીએ માતાજી જરબાનુની યાદમાં
નસાખાનાનાં કંપાઉંડમાં સરઅવસરે વાપરવા બંધાવેલું મકાન ૨૩ ૭ ૧૨૮૬
,, હોરમજી મામા હોલ–બેહરાનાની દરેહમેહરમાં–અરદેશર હોરમજી
મામાએ બાવા હોરમજીના પુણ્ય માટે બંધાવેલો ૯ ૧૨ ૧૨૮૭
કવેતા–બાનુ થીઓસોફીકલ હોલ ઓફ કવેટા–બરજોરજી દોરાબજી પટેલ સી.
આઇ. ઇ. એ પોતાના બેટી બાનુ ગોશસ્પની યાદગારી માટે ૧૨૮૧
ખંડાલા–ગરીબ જરથોસ્તીઓને હવા ખાવા માટેના બંગલા–જાહાંગીર રૂસતમજી
મોદીએ પોતાના માતાજી રતનબાઇનાં પુણ્ય માટે બંધાવેલા તથા બીજા
સખી જરથોસ્તીઓનાં ઉગરાટથી જાંગીર બેરામજી મરજબાને બાંધેલા ૧૨૬૫
ખેરગામ–મોટીબાઇ હોલ–મોટીબાઇ તે બમનજી જમશેદજી મુલ્લાના વીધવા ૨૦ ૧૨ ૧૨૬૧
જાંહબોરડી–જમશેદજી નશરવાનજી પીટીટ પારસી સેનેટરીઅમ ... ૩ ૭ ૧૨૬૫
તારાપોર–મેરજી૦ કુ૦ તારાપોરવાલાની યાદગારી માટે બંધાવેલું મકાન ... ૧૯ ૧ ૧૨૭૨
તીથલ–(વલસાડ નજદીક)–સેનેટરીયમ–સર દીનશાહ માણેકજી પીટીટ ...
બારોનેટના બેટીઓએ (એ ઉપરાંત બીજા જુદાં જુદાં સખી
જરથોસ્તીઓએ બંધાવેલા બલોકો છે.) ૮ ૮ ૧૨૭૮
દેવલાલી–ડા. કેખશરૂ નશરવાનજી બાહાદુરજીની યાદગારી માટે બંધાયલી શેનેટરીયમ ૫ ૧૨ ૧૨૭૧
,, નશરવાનજી જમશેદજી કુપર કોનવેલેસંટ હોમ–રતનજી જમશેદજી
દુબાશે પોતાના ભાઇ નશરવાનજીના પુન માટે ૧૦ ૯ ૧૨૭૩
,, સેનેટરીયમ–બાપુજી દોરાબજી દારૂવાલાએ પોતાના માતપીતાની નઇયતે ૧૯ ૧ ૧૨૭૯
,, શીરીનબાઇ રૂશતમજી કે. ઇરાનીએ પોતાના ભરથારની યાદમાં દખમાં
આગળ બંધાવેલું સરઅવસરે વાપરવાનું મકાન ૧ ૮ ૧૨૮૧
,, સોડાવાટરવાલા કોનવેલેશંટ હોમ–આઇમાય સોરાબજી સોડાવાટર-
વાલાએ પોતાના ધણી સોરાબજીના પુન માટે ૧૪ ૪ ૧૨૮૩
ધરમપોર–એ. મે. મલબારીએ ૧૯૦૯ માં ખઇના દરદીઓનું સ્થાપેલું
સેનેટરીયમ—૧૯૧૨ થી કીંગ એડવરડ સેવનથ સેનેટરીયમ,
એમાં જુદા જુદા જરથોશતીઓના બાંધેલા કોટેજો ૧૨ ૭ ૧૨૮૬
નવસારી–સોરાબ બાગ–એરવદ કાવસજી સોરાબજી ભેદવાર ૧૪ ૫ ૧૨૩૮
,, ખરશેદવારી–ખરશેદજી ટેમુલજી દેસાઇ ... ...
,, તેની પાસેની જમનશાળા–સર જમશેદજી જીજીભાઇ પેહેલા બારોનેટ ૨૦ ૬ ૧૨૨૨
,, કાઉસ બાગ–કાવસજી માણેકજી તાતાના છોકરાઓ ૮ ૬ ૧૨૪૬
,, જમશેદ બાગ–સર જમશેદજી જીજીભાઇ પેહેલા બારોનેટ ... ૨૦ ૬ ૧૨૧૯
,, નવાજબાગ-મેરવાનજી નાનાભાઇ મેહતાએ પોતાના માતપીતાના પુન માટે ૧૩ ૮ ૧૨૬૯
,, બેરામજી નશરવાનજી સીરવાઇ હોલ–બેરામજી નશરવાનજી સીરવાઇ ૧૫ ૨ ૧૨[illegible]

	રોજ	માહ	ય. સને
નવસારી—બેરામજી નસરવાનજી સીરવાઇ પારક—બેરામજી નસરવાનજી સીરવાઇએ લુનશી કુઇના મેદાનમાં ફરવાં હરવા માટે બંધાવેલી જગા ...	૨૧	૪	૧૨૭૮
,, મોદીબાગ—બઝમે રૂઝે બેહરામ માટે રૂશતમજી અને નશરવાનજી ના. બાઇસે બેન હીરાબાઇ તથા બનેવી માણેકજી સોરાબજી મોદીની યાદમાં બંધાવેલું	૨	૫	૧૨૮૭
,, મીનારો ઘડીયાલ સાથ—કાવશજી ખરશેદજી મોદીના કુટુંબે ...	૧૬	૫	૧૨૮૭
પુણા—નશરવાનજી માણેકજી પીટીટ હોલ	૬	૪	૧૨૬૧
,, ગરીબ જરથોસ્તીઓ માટે સસતા ભાડાની ચાલી—બરજોરજી માણેકજી તાલુકદાર	૩	૬	૧૨૮૭
,, બેરામજી મેરવાનજી મલબારી મેમોરીયલ બલોક—પુણા હીંદુ વીડોઝ હોમ એસોસીએશન હસ્તક વીધવા આશ્રમ માટે ધનબાઇ બે. મે. મલબારી તથા છોકરાંઓએ બંધાવેલો બલોક		...	૧૨૮૬
,, જે. એન. તાતા રીસરચ હોલ—૧૯૧૭માં સ્થાપેલાં ભંડારકર ઓરીયેંટલ રીસરચ ઇનસ્ટીટયુટમાં—શેઠો તાતા બીરાદરોએ બાંધેલો ...		...	૧૨૮૭
,, ફરવરદેગાન હોલ—દોરાબજી દીનશાહ એદનવાલાએ પોતાના ધણીયાણી ડોશીબાઇના પુણ માટે	૪	૧૨	૧૨૭૧
બદનેરા—શેરાબજી નશરવાનજી કામાએ પોતાના ધણીયાણી ગુલબાઇના પુણ માટે બાંધેલું ધરમનું મકાન	૧૯	૧૧	૧૨૭૩
બીના—બેરામજી નવરોજી ઝવેરીના પુન માટે એવણના વીધવા નવાજબાઇએ તથા બેટા નાનાભાઇએ બાંધેલો હોલ	૪	૬	૧૨૮૦
બીલીમોરા—તાતા બાગ—મનચેરજી શાપુરજી તાતાએ પોતાના બાવા શાપુરજી કુ. તાતાના પુણ માટે	૨૫	૬	૧૨૮૧
બેલગામ—મુલ્લાંરીરોઝ મુસાફરખાનું—રૂશતમજી દીનશાહજી મુલ્લાંરીરોજના પુણ માટે એવણના વીધવા નવાજબાઇએ બાંધેલું ઉતારાનું ધરમનું મકાન	૧૩	૭	૧૨૭૨
,, મુસાફરખાનું—બાઇસવાલી દરેહમહેરમાં પેસતનજી ખુરશેદજી બોઇસે મરહુમ ભાઇઓ એદલજી તથા નાનાભાઇના પુણ માટે ...	૨૪	૩	૧૨૬૧
,, રતન હોલ—બાઇસવાલી દરેહમહેરના અસલ જુના હોલમાં સુધારો વધારો કરી રૂશતમજી તથા નશરવાનજી નાનાભાઇ ખુ. બોઇસે મરહુમ ભાઇ રતનજીની યાદમાં સરઅવસરે વાપરવા બંધાવેલો ...	૨૩	૬	૧૨૮૫
,, ખોરશેદ હોલ—ખુરશેદજી પેસતનજી ખુરશેદજી બોઇસની યાદમાં એવણના ખેશીઓ, દોસ્ત આશનાઓ અને બેલગામની જરથોસ્તી અંજુમને મલી સરઅવસરે વાપરવા માટે બંધાવેલો—(એમાં લાઇબરેરી પણ સ્થાપેલી છે.)	૨૩	૬	૧૨૮૫
ભરૂચ—સર શાપુરજી ભરૂચા હોલ અને રાયચંદ દીપચંદ લાયબ્રેરી—સર શાપુરજી બરજોરજી ભરૂચા	૧	૪	૧૨૮૧
,, રતનબાઇ ધનજીશાહ મેરવાનજી ડાકટરનું સેનેટરીયમ	૨૫	૬	૧૨૬૫
,, ધનજીશાહ રૂશતમજી ઉમરીગરે પોતાના માતપીતાના પુન માટે સરઅવસરે વાપરવા આપેલું મકાન...	૧૧	૯	૧૨૭૮
,, વીરબાઈ શાપુરજી નારીયલવાલા હોલ—નારીયલવાલા દરેહમેહેરમાં વીરબાઈ શાપુરજી નારીએલવાલાના પુન માટે કુટુંબીઓએ ...	૨૫	૨	૧૨૮૬
,, રૂશતમજી વખારીઆ હોલ—ફરેઝરવાલી મેરવાન બાગની ધરમશાલામાં રૂશતમજી હોરમજી વખારીયાએ બંધાવેલો	૧૦	૮	૧૨૮૫

બીમપોર—નશરવાનજી માણેકજી પીટીટ સેનેટરીયમ	૬	૩	૧૨૬૪
,, મનચેરજી પાલનજી કંટરાકટરે પોતાની વાડીમાં બંધાવેલું હવા ખાવાનું મકાન			૧૨૯૦
ભોપાલ—ડોશીબાઇ પેશતનજી દાદાભાઇએ ખાવીંદ પેશતનજીની યાદમાં આરામ-ગાહની જગામાં સરઅવસરે વાપરવાનું બંધાવેલું મકાન ...	૧૦	૯	૧૨૯૫
ભુસાવલ—નાયગામવાળા હોલ—નવરોજી પેસતનજી નાયગામવાલા તથા કંતરાકટરે પોતાની બેટી આલાંમાયના પુન માટે	૪	૧૦	૧૨૯૦
મકાઉ—ચીનમાં—સર હોરમજી નવરોજી મોદીના પુન માટે ધણીયાણી લેડી માણેકબાઇ તથા બેટા નવરોજીએ સરઅવસરે વાપરવા બંધાવેલું મકાન	૭	૧	૧૨૯૫
મદરાસ—ફ્રામજી હોલ—અરદેશર ફ્રામજી ભમગરા તથા ભાઇઓએ પોતાના પીતાના પુન માટે	૬	૧૨	૧૨૭૫
,, ફરદુનજી નશરવાનજી મજગામવાલાની યાદગારી માટે મદરાસની અનજુમને સરઅવસરે વાપરવા બંધાવેલું મકાન... ...	...		...
,, જાલ ફીરોઝ મેમોરીયલ બીલડીંગ—ફીરોજ મનચેરજી કલબવાલાએ પોતાના દીકરાના પુન માટે...	૨૯	૫	૧૨૭૭
માથેરાન—ચેરાગનો મીનારો—(આરામગાહની જગામાં)—પેસતનજી નવરોજી કાપડયાએ ધણીયાણી રતનબાઇની યાદમાં બંધાવેલો ...	૧૯	૯	૧૨૮૭
મોરા ગામમાં—દાદાભાઇ તથા કાવસજી પાલનજી ચવનાનું મકાન ...	...		૧૨૫૬
રાવલપીંડી—નવાબ ધનજીભાઇ ફકીરજી કામાડોરની યાદમાં ધણીયાણી બેગમ આવાબાઇ તથા બેટા શોરાબજીએ સરઅવસરે વાપરવા બંધાવેલું મકાન	૧૦	૮	૧૨૮૧
દેનોલી—બીખાઇજી જાહાંગીર હોરમજી મોદીનું સેનેટરીયમ	૧૪	૮	૧૨૬૬
,, ડાઇનીંગ હોલ—કાવસજી દીનશાહ એદનવાલાના સાહેબજાદાઓ	૨૨	૯	૧૨૭૧
લંડન—ઇંગ્લંડના ઇમપીરીયલ ઇનસટીટયુટમાં બંધાવેલો "ઇંડીઅન કોનફરન્સ હોલ"—સર જહાંગીર કાવસજી જહાંગીર રેડીમની બારોનેટ	૧૯	૯	૧૨૬૪
લંડનના વોકીંગ ખાતે—વાહાડયા મેઝોલીયમ-નવરોજી ન. વાહાડયાના વારસો	૧૫	૧૦	૧૨૭૦
વલસાડ—સુનાબાઇ જાહાંગીર ફ્રામજી ભમગરાએ પોતાના બેટા કેખશરૂના પુન માટે ક્રીરીયાકામ કરવા બંધાવેલું મકાન	૧૫	૧	૧૨૮૧
શાંતાક્રૂઝ—ધનબાઇ બેરામજી મે. મલબારીએ બંધાવેલા હવા ખાવાના મકાનો	...		૧૨૮૦
સક્કર—આરામગાહની જગામાં સરઅસસરે વાપરવા માટે એબાદતગાહનું મકાન	૧૧	૭	૧૨૮૩
સીકંદરાબાદ—પીપલસ હોલ—૧૮૯૦—પાછલથી "જમશેદ હોલ" જમશેદજી એદલજી ચીનાઇએ રૂ૧૫૦૦૦ માં વેચાતો લઇ ભેટ આપેલો	૨૦	૧	૧૨૮૨
હજીરા—જીલ્લા સુરત—સેનેટરીયમ— પાલનજી શેરીઆરજી માદનના છોકરાઓ રૂસતમજી, ડોશાભાઇ અને માણેકજીએ બંધાવેલું	૧	૭	૧૨૮૦
હુબલી—હોરમજબાગ—અરજોરજી માણેકજી પટેલ, બીખાજી અર. બારીયા, સો. હો. ભરૂચા અને બીરાદરો, તથા દોરાબજી માણેકજી પનવેલીવાલા મલી	૬	૨	૧૨૭૮
હૈદરાબાદ-દખન-(જમીસતાપુરમાં દખમાં નજદીક)-દસ્તુર ખુરશેદજી જમશેદજી જામાસ્પઆશાના અને ધણીઆણી કુવરબાઇના પુન માટે એમના ફરજંદો બીખાઇજી અને અરદેશર તથા જાહાંગીરજીએ બંધાવેલું શરઅવસરે વાપરવાનું મકાન	૧૯	૪	૧૨૮૫

જરથોસ્તીઓએ સ્થાપેલાં ધરમના દવાખાના.

મુંબઇ મધેનાં ધરમનાં દવાખાનાં.

કોટમાં–કોટનું ધરમનું લોકોના ઉધરાટનું દવાખાનું—કાવશજી ધ. પાંઉવાલાનું.
,, દીનબાઇ પેસતનજી શાપુરજી ગઝદરનું અરધ ધરમનું દવાખાનું—૧૯૦૭
,, પારસી સુવાવડખાનું—અનજુમનને ખરચે—૧૮૯૫.
કોટ, મેહાનમાં-પેસતનજી હો. કામાવાલી ઓરત અને બચાંઓ માટેની "કામા હાસપીટાલ"–૧૮૮૬.
ખેતવાડી–નશરવાનજી માણેકજી પીટીટનું ધરમનું દવાખાનું—૧૮૬૫.
,, ડા૦ ફ્રામરોજ રતનશાહ પારખની હાસપીટાલ અને સુવાવડખાનું—૧૯૦૯-એનું બંધાયલું મકાન—૧૯૧૭.
,, ડા૦ માણેકજી પી. કેરાવાલાની સ્ત્રીઓની હાસપીટાલ અને સુવાવડખાનું—૧૯૧૦
ગ્રાંટરોડ–સર દીનશાજી તથા નશરવાનજી માણેકજી પીટીટવાલું દવાખાનું (અગાઉ માંડવી ચકલા સ્ટ્રીટમાં હતું)
ચોપાટી–જરબાઈ નવરોજી નશરવાનજી વાહડયાનું પ્લેગ હાસપીટાલનું મકાન—૧૯૦૬.
તારદેવ–ગરીબ જરથોસતીઓનાં રેહેઠાણવાલી જગોપરનું ધનજીભાઇ એદલજી આલબલેશને નામનું ધરમનું દવાખાનું—૧૮૯૯.
,, હીરાંબાઇ બેરામજી જીજીભાઇનું ધરમનું દવાખાનું—૧૮૯૧.
,, એડમસ વાઇલી હાસપીટાલમાં ખર્ચના દરદીઓ માટેનો "નશરવાનજી મા. પીટીટવાર્ડ"–૧૯૦૮
,, એડમસ વાઇલી હાસપીટાલમાં "મોટલાબાઇ વાહાડયા ડીસપેનસરી"—૧૯૧૦.
તુરંબે–એદલજી ફ્રામજી આલબલેશ "લેપરસ હોમ"—રગતપીત હાસપીટાલ.
ધોબીતલાવ—ડા૦ ખરશેદજી નશરવાજી કરંજીઆવાલી આંખની હાસપીટાલ—૧૯૧૨ (એની અગાઉ અ. હો. વાહાડયાવાલી આંખની હાસપીટાલ હતી જે બ. દી. પીટીટ પારસી જનરલ હાસપીટાલ સાથ જોડાઈ ગઇ છે.)
પરેલ—સાકરબાઇ દીનશાહ માણેકજી પીટીટવાળી જાનવરોની હાસપીટાલ—૧૮૮૪.
,, સર દીનશાહ માણેકજી પીટીટ પેથોબેક્ટ્રીઓલોજીકલ લેબોરેટરી.
,, લવજી વાહડયા ડીસપેનસરી—૧૮૬૫.
ભાયખલા–ડા૦ હોરમજી માણેકજી માસીનાની હાસપીટાલ—૧૯૦૨.
,, ઉપલી હાસ્પીટલમાં–સેપટીક વોરડ–ઉડતા રોગના દરદીઓ માટે—૧૯૧૮.
,, ડા૦ જે. એન. બહાદુરજીવાલી પુવર મેન્સ આઇ કલીનીંગ યાને આંખની હાસ્પીતાલ–૧૯૦૮
ભીંડીબજાર–સર જમશેદજી જીજીભાઇ હાસપીટાલ—૧૮૪૫.
,, ઉપલી હાસપીટલમાં–સર કાવસજી જાહાંગીરવાલી આંખની હાસપીટાલ—૧૮૬૬.
,, ,, ઉપલી આંખ હાસપીટાલ સર કાવસજી જા. બારોનેટે ફરીથી બંધાવી–૧૯૧૦
,, ,, રૂશતમજી જમશેદજી જીજીભાઇવાલી ફેફ્રાડાં દરદની હાસપીટાલ.
,, ,, સુવાવડની મોટલાંબાઇ હાસપીટલ—૧૮૯૨.
,, ,, સર દી. મા. પીટીટની બચાંઓ અને ઓરતો માટેની હાસપીટાલ—૧૮૯૨.
,, ,, ફ્રામજી દીનશાહ પીટીટ લેબોરેટરી—૧૮૯૧.
,, ,, આવાંબાઈ ભાવનગરી નરસીસ હોમ—૧૮૯૧.
માટુંગા–રગતપીતીઆઓ માટે જમશેદજી નસરવાનજી પીટીટ હાસપીટાલ વારડ—૧૮૯૪.
માંડવી–જમનજી આલબલેશ ઓબસતેત્રીક હાસપીટાલ–સુવાવડખાનું—૧૮૯૦.
મેહેમ–મોટલાંબાઇ જાહાંગીર વાડીયાનું દવાખાનું.

વાલકેશ્વર-બમનજી દીનશાહ પીટીટ પારસી જનરલ હાસપીટાલ—૧૯૧૨.
,, ઉપલી હાસપીટલમાં-ફરામજી હોરમસજી વારડનવાલો ઓપરેશન બ્લોક—૧૯૧૨.
,, ,, મોટલાબાઇ જાહાંગીર વાહાડયાવાલો સ્ત્રીઓ માટેનો મુખ્ય બલોક—૧૯૧૨.
,, ,, પીરોજબાઇ નશરવાનજી જે. વાહાડયાવાલો સ્ત્રીઓ માટેનો મુખ્ય બલોક—૧૯૧૨.
,, ,, આવાંબાઇ ફરામજી દીનશાહ પીટીટવાલું સુવાવડખાતું—૧૯૧૨.
,, ,, અરદેશર હોરમજી વાડયાવાલી આંખની હાસપીટાલ-૧૯૧૨.
,, ,, નવાજબાઇ પીરોજશાહ મેરવાનજી જીજીભાઈની યાદમાં બાંધેલો બાહેરના દરદીઓ માટેનો બલોક-૧૯૧૨.
વેસાવા ખાતે-ઉપલી હાસપીટલ માટે કોનવેલેસંટ હોમ તરીકે કાવશજી સોરાબજી બાટલીવાલાએ ભેટ આપેલા બે બંગલાઓ. [બંધાવેલી-૧૯૧૪.
વાંદરા-ખરશેદજી બેરામજી ભાભા હાસપીટલ—જાઇજી ખ. ભાભાએ પોતાના ધણીના પુણ્ય માટે
,, સર કાવસજી જાહાંગીરજી રેડીમનીનું દવાખાતું—૧૮૭૬ (આ દવાખાતું વાંદરામાં બીજે ઠેકાણે હતું તે ૧૯૧૪ માં ભાભા હાસપીટલ બંધાયા પછી ત્યાં લઇ જવામાં આવ્યું છે.)
,, શીરીનબાઇ મનચેરજી કામાવાલું પારસી કોનવેલેસંટ હોમ.

દેશાવરો ખાતેના ધરમનાં દવાખાનાં.

અમદાવાદ-નવરોજી ડીસપેનસરી-સર નવરોજી પેસતનજી વકીલ—૧૯૦૦.
,, નવરોજી મેટરનીટી હાસપીટલ એંડ જનરલ હાસપીટલ ફોર પારસીસ એંડ યુરોપીયન-(સીવીલ હાસપીટલમાં) સર નવરોજી પેસતનજી વકીલે બંધાવેલી—૧૯૧૨.
,, આંખની હાસપીટલ-સર નવરોજી પેશતનજી વકીલ—૧૯૦૦.
અંધેરી-નશરવાનજી જાહાંગીરજી વહાડયાવાલું ધરમનું દવાખાતું—૧૮૯૯.
આકોલા-ખાં૦ સાં૦ દાદાભાઇ રતનજી બલસારા ડીસપેનસરી-દાદાભાઇ રતનજી બલસારાએ
ઉડવાડા-જરથોસ્તીઓના ઉપરાતથી ચાલતું દવાખાતું [બંધાવેલી—૧૯૧૪
ઉમરગામ-નારગોલ-સર દીનશાજી માણેકજી પીટીટ બારોનેટનું ધરમનું દવાખાતું
એડન—કાવશજી દીનશાહજીની "જરબાઈ ચેરીટેબલ ડીસપેનસરી"—૧૮૯૫
એરાવ-અરદેશર હોરમજી વાહડયાજીનું દવાખાતું
કંરજ-મોટલાંબાઇ જાહાંગીર વહાડયાવાલું ધરમનું દવાખાતું—૧૯૦૦.
કરાંચી-લેડી ડફરીન હાસપીટલ-એદલજી દીનશાહે બંધાવેલી—૧૮૯૮
,, લેડી ડફરીન હાસપીટલમાં-કાવશજી હોરમજી કાતરકવાલા સુવાવડખાનાનું નામ "વીરબાઇજી કાતરક મેટરનીટી વીંગ" રાખ્યું છે, એમાં પારશીઓ માટે રાખેલા જુદા વારડને "વીરબાઇજી કાતરક પારસી વારડ" નામ આપ્યું છે—૧૯૧૬
,, કાંપ-એદલજી દીનશાહ શરાફવાલી એદલજી દી. ચેરીટેબલ ડીસપેનસરી—૧૮૮૨
,, કેમારી-બચુબાઇ એદલજી દીનશાહ હાસપીટાલ—૧૮૮૭
,, ડાં૦ કેખશરૂ ડી. કંટરાકટરવાલું પારસી મેટરનીટી હોમ-સુવાવડખાનું—૧૯૧૦
કવેટા-બરજોરજી દોરાબજી પટેલની ઓરતો માટેની હાસપીટાલ—૧૮૮૮
કુડયાણા-મનચેરજી જમશેદજી પટેલવાલી 'કુંડયાણા ચેરીટેબલ ડીસપેનસરી'—૧૯૧૪
કાનપોર-જમશેદજી લાલાએ પોતાના ધણીયાણીની યાદમાં પ્રીન્સ ઓફ વેલ્સ હાસ્પીટલમાં બંધાવેલો 'મીસીસ નવાજબાઇ જમશેદજી લાલા આઉટ પેશંટ વોરડ'—૧૯૧૫
કુરલા-બમનજી હોરમજી વાહડીઆએ ય. સ. ૧૨૨૫ માં સ્થાપેલું દવાખાતું.
કોલંબો-જમશેદજી રૂશતમજી બીલીમોરીયાના ધણીઆણીએ લેડી રીજવે મેમોરીયલ હાસ્પીટલમાં બંધાવેલો 'મીસીસ રૂશતમજી વોરડ'—૧૯૦૯
ખંડાલા-નવરોજી નશરવાનજી વાહડીઆનું ધરમનું દવાખાતું—૧૮૯૬
ખેરગામ-નશરવાનજી માણેકજી પીટીટનું દવાખાતું
ગનદેવી-સર કાવસજી જાહાંગીર નાઇટવાલું દવાખાતું
ચીખલી-સર દીનશાજી માણેકજી પીટીટનું દવાખાતું.
તવડી-ન. મા. વાહડયાની ઇસ્ટેટના તરસ્ટીઓએ સ્થાપેલું ધરમનું દવાખાતું-૧૯૧૧

તારાપોર—સર દીનશાહજી માણેકજી પીટીટની 'સાકરબાઇ ડીસપેનસરી'.
થાણા—ખરશેદજી રૂસતમજી વાહાડયાને નામનું દવાખાનું—૧૮૬૫
દીહલી—એસ. પી. શરાફે ઉઘાડેલી આંખની હાસપીટલ—૧૯૧૪
દેવલાલી—નવરોજી એન. વાહાડયા ડીસપેનશરી—બહાદુરજી સેનેટરીયમમાં—જરબાઇ નવરોજી નશરવાનજી વાહાડયાએ પોતાના ધણીના પુણ્ય માટે—૧૯૧૦.
નવસારી—સર જમશેદજી જીજીભાઇ પેહેલા બારોનેટની "વીકટોરીયા ડીસપેનસરી"
„ મેરવાનજી નાનાભાઇ મેહેતાનું "ડોરાબજી નાનાભાઇ મેહતા પારસી સુવાવડખાનું"—૧૯૧૨
„ એનું મકાન—મેરવાનજી નાનાભાઇ મેહતાએ બાંધેલું—૧૯૧૫
„ રતનજી ફરાંમજી દાબુ નવસારી પારસી જનરલ હાસ્પીટલ—૧૯૧૩
„ એનું મકાન—રતનબાઇ બરજોરજી પાલનજી મુલ્લાં બીલ્ડીંગ—૧૯૧૩
„ બમનજી અસપંડયારજી દસ્તુરની કુંપનીએ મરકીના દરદીઓને માટે સ્થાપેલું ધરમનુ દવાખાનું—૧૯૦૦
નાગપોર—સર બેજનજી દાદાભાઇ મેહેતાએ ધણીઆણી પીરોજબાઇની યાદમાં મ્યુર મેમોરીયલ હાસપીટલમાં બંધાવેલું મેટરનીટી વોરડ—સુવાવડખાનું—૧૯૧૨
નારગોલ—નશરવાનજી રતનજી તાતા નારગોલ ચેરીતેબલ ડીસપેનસરી—રતનજી જમશેદજી તાતાએ બપાવાની યાદમાં સ્થાપેલી—૧૯૧૩. એનું મકાન ઉમરાનાથી બંધાયું—૧૯૧૮.
નાશક—સર દીનશાહ માણેકજી પીટીટ જાનવરોની હાસપીટાલ—૧૮૯૫.
નીમચ—ફ્રાવસજી જીવણજી કંતરાકટરનું દવાખાનું—૧૮૮૮
પંચગણી—બેલ—એર સેનેટરીયમ—ડા૰ રૂશતમજી બમનજી બીલીમોરીયાવાલું—૧૯૧૪ (પુણામાં ૧૯૧૨ માં પહેલાં સ્થાપેલું.
પુણા—મેહેરબાઇ સોરાબજી પદમજીવાલો પુણાની સાસુન હાસપીટાલમાં સુવાવડનો વારડ—૧૯૦૨.
„ સ્કોટલેંડ મીશનના યુનાઇટેડ ફ્રી ચરચ હસ્તકના એન. એમ. વાહડયા હાસ્પીટાલ—૧૯૧૨
„ સર દીનશાહ માણેકજી પીટીટ પુણા કેનટોનમેન્ટ ચેરીટેબલ ડીસપેનસરીનું મકાન—૧૮૯૪
„ રગતપીટયાઓના આશરમ—સ્થાનમાં અરદેશર હોરમસજી વાહાડયા લેપર એસાયલમનો [વારડ—૧૯૦૯.
„ શુકરવાર પેંટમાં—પેસતનજી સોરાબજીનું દવાખાનું
બદનેરા—જાહાંગીર હોરમજી મોદીનું દવાખાનું—૧૮૯૬
બેંગલોર—લેડી કરઝન હાસપીટલને લગતું મુંબઇવાલા ડા૰ બેહેરામજી નવરોજી દારાબશેઠના ધણીઆણી આવાંબાઇના નામનું ઔરતો અને બાળકો માટેનું દવાખાનું—૧૯૦૫.
બરૂચ—સોરાબજી જમશેદજી જીજીભાઇવાલી મોટી સીવીલ હાસપીટાલ—૧૮૭૨ [વારડ—૧૯૧૩
„ મનચેરશાહ સોરાબજી વખારીયાએ બાવા સોરાબજીની નઇયતે પારસીઓ માટે બંધાવેલો
„ સુનાબાઈ ખરશેદજી દલાલ પારસી મેટરનીટી હોમ—સુવાવડખાનું—ખરશેદજી અરદેશર દલાલે બેટી સુનાબાઈની યાદમાં સ્થાપેલું—૧૯૧૭
„ લેડી પીરોજબાઇ શા. ભરૂચા મેટરનીટી હાસ્પીટલ અને દીનશાહ ફરદુનજી ઓપરેશન બલોક—ઝનાના મીસન હાસપીટલમાં—૧૯૧૯.
બામરડી—ગુલબાઇ દીનશાહજી માણેકજી પીટીટ ડીસપેનસરી.
માથેરાન—બેરામજી જીજીભાઇ હાસપીટાલ —૧૯૦૨
મુરબાદ—જીલ્લા થાણા—સર દીનશાજી માણેકજી પીટીટ બેરોનેટનું ધરમનું દવાખાનું
મઉ—દોરાબજી પેશતનજી પુણેવાલનું દવાખાનું—૧૮૭૦
મેહમદાબાદ—બેરામજી જીજીભાઇવાલી માણેકબાઇ ડીસપેનસરી.
યરોડા—દીવાનશાળામાં—દીનબાઇ નશરવાનજી પીટીટવાલો પારસી દીવાનાઓ માટેનો વારડ—૧૯૧૩
રતનાગીરી—સર દીનશાજી માણેકજી પીટીટવાલી રગતપીતની હાસપીટલ—૧૮૭૫
રૂસ્તમપુરા—પંચમહાલ જીલ્લા—અરદેશર રૂશતમજી દલાલનું ધરમાદા દવાખાનું—સરદાર બમનજી અરદેશર દલાલે પોતાના પીતાના પુણ્ય માટે—૧૯૧૨

વડોદરા—ડાકટર રૂસતમજી નાણાવટી ડીસપેનસરી—૧૮૮૫
વલસાડ—સર દીનશાજી માણેકજી પીટીટનું દવાખાનું—૧૮૭૨
,, મેટરનીટી ઇનશટીટયુટ-સુવાવડખાનું સ્થાપયું-૧૯૦૭-એનું મકાન કાવશજી ધનજીભાઈ ધનભુરાએ બંધાવેલું—૧૯૧૬
,, માણેકજી ધ. ધનભુરા વેટરીનરી હાસપીટલ સ્થાપી—૧૯૦૯-એનું મકાન મા. ધ. ધનભુરાએ બંધાવેલું—૧૯૧૫
વસાઇ—સર દીનશાજી માણેકજી પીટીટનું દવાખાનું—૧૮૮૬
વાડા—જીલ્લા થાણા—જમશેદજી નશરવાનજી પીટીટનું ધરમનું દવાખાનું.
સા. રા—જમશેદજી નશરવાનજી પીટીટવાલો સાદરા હાસપીટાલનો ઓરતો માટેનો વારડ
શાનટાક્રૂજ—આવાંબાઇ નાનાભાઇ જમુજીનું ડીશપેનશરીનું મકાન—૧૯૦૬
સીકંદરાબાદ—પીરોજબાઈ ચેરીટેબલ ડીશપેનસરી—૧૮૯૨
,, મીઠીબાઇ શાપુરજી ચીનાઇ ચેરીટેબલ ડીસપેનસરી [બે વારડો—૧૯૦૪
,, દસ્તુર એદલજી બમનજી ડેપ્યુટી કલેકટરની યાદગીરીમાં શીવીલ હાસપીટાલમાં બાંધેલા
,, બમનજી ચીનાઇ ચેરીતેબલ ડીસપેનશરી—બમનજી ન. ચીનાઈની ઇસ્ટેટમાંથી દેશાભાઈ નશરવાનજી ચીનાઇએ બંધાવેલું મકાન—૧૯૧૪
સુરત—વાંકી બોરડી—ડાકટર બેરામજી પેસતનજી ચેરીટેબલ ડીસપેનસરી—૧૯૦૮
,, ખરશેદજી ફરદુનજી પારખવાળી પારખ ચેરીટેબલ ડીસપેનસરી—૧૮૬૫
,, સર કાવશજી જહાંગીર નાઇટ. સી. એસ. આઈ. વાલી મોટી હાસપીટાલ—૧૮૬૪
,, એજ ઠેકાણે—આલીબાઇ જાહાંગીર પટેલવાલી પટેલ ઓપરેશન થીએટર—૧૯૦૮
,, ડા૦ કેખશરૂ કુવરજી બાલીવાલાની આંખની ખાનગી હાસપીટાલ—૧૯૧૪
શેહેંગાહી—શાનતુગ રોડના ચીનાઓની હાસપીટાલમાં ડા૦ કાવસ લાલકાકાની યાદગારી માટે ઉધાડેલા ફંડમાંથી બંધાયલા વારડો—૧૯૧૧
હેદરાબાદ—સીંધ—સર કાવશજી જાહાંગીર લુનાટીકસ એસાયલમ—૧૮૭૧

જરથોસ્તીઓએ સ્થાપેલાં ધરમનાં કેલવણી ખાતાં.

મુંબઇ મધેનાં ધરમનાં કેલવણી ખાતાં.

કાંદાવાલા મોહલ્લો—મેરવાનજી માણેકજી શેઠનાની જરથોશતી છોકરીઓના નીશાળ—૧૮૭૧
કોટમાં—એલેકઝાનદ્રા નેટીવ ગરલસ ઇંગલીશ ઈનસ્ટીટયુશન—૧૮૬૩
,, સર કાવસજી જાહાંગીર એલફીનશટન કોલેજ બીલડીંગ—૧૮૭૯
,, સર કાવસજી જાહાંગીર "બોંબે યુનીવરસીટી હોલ"
,, સર જમશેદજી જીજીભાઇ પારસી બેનીવોલંટ ઇનસ્ટીટયુશન—૧૮૪૯
,, જરથોશતી છોકરીઓની નીશાળ—ભીખાઈજી સોરાબજી બંગાલીવાલી બીલડીંગમાં—૧૮૮૫
,, એજ મંડલીની ચંદનવાડી પ્રીન્સેસ સ્ટ્રીટની બીજી નાશાળનું મકાન—બાઇ માણેકબાઇ નવરોજી ગામડયા ગરલસ સ્કુલ—નવરોજી જાહાંગીર ગામડયાએ ધણીઆણી માણેકબાઇની યાદમાં—૧૯૧૭
,, નશરવાનજી મનચેરજી કામાજીવાલી સ્કુલ—૧૮૫૦
,, જીજીભાઇ દાદાભાઈવાલી જંદ અવશતા મદરેસા
,, મુલ્લાં ફીરોજ મદરેશા—દાદીશેઠના આતશ આદરાનમાં—૧૮૫૪
કોલાબા—દાદી અને ફરામરોજ ગોલવાલા તરફથી બાંધવામાં આવેલું સ્વીમીંગ બાથનું મકાન
ખેતવાડી—સર કાવસજી જાહાંગીરની છોકરીઓની નીશાળ
,, જમસેદજી નશરવાનજી પીટીટ કશરતશાળા—૧૮૭૪
,, જીજીભાઇ દાદાભાઇવાલી અંગરેજી તથા ગુજરાતી જંદ શાળાઓ
,, ફરામજી નશરવાનજીવાલી અંગરેજી તથા ગુજરાતી સ્કુલ—૧૮૫૯
ચંદનવાડી—સર જમશેદજી જીજીભાઇ પેહેલા બારોનેટની યાદગારીને સારૂ ઉભી થયલી જંદ પેહેલવી મદરેસા—૧૮૬૩.

ચંદનવાડી-જરથોશતી કોમના લાભ સાચવનારી મંડળી હસતકના ઇંડસટ્રીયલ ઇનસટીટયુટ કલાસો—૧૯૧૫.
ચરનીરોડના સ્ટેશન સામે-બેરામજી જીજીભાઇ ચેરીટેબલ ઇનસ્ટીટયુશન-૧૮૯૧.
તારદેવ-રતનબાઇ ફરામજી પાંડેવાલી ગરીબ જરથોશતીઓના રેહેઠાણો તરફની સ્કુલ.
પરેલ-જમશેદજી નશરવાનજી પીટીટ પારસી ઓરફનેજ-૧૮૮૮
મેદાન-સર જમશેદજી જીજીભાઇ સ્કુલ ઓફ આરટસ એંડ ઇનડસટ્રી-૧૮૫૭.
,, સર દીનશાહ માણેકજી પીટીટનું ધાતુકામને લગતી કેલવણી આપવાનું ખાતું.
,, સર દીનશાહ માણેકજી પીટીટ જીમનેસટીક ઇનસટીટયુશન-કશરેતશાળા-૧૮૯૧
વાંદરા—આવાંબાઇ ફરામજી પીટીટ પારસી ગરલસ ઓરફનેજ-૧૯૧૩.

દેશાવરો ખાતેનાં ધરમના કેળવણીખાતાં.

અંદેરી-અંદેરીની નીશાળનું મકાન-દોરાબજી હોશંગજી અને તેમના ચીરંજીવી.
અમદાવાદ-પારસી જીમખાનાનું મકાન—૧૯૦૬
,, બેરામજી જીજીભાઇ અમદાવાદ મેડીકલ સ્કુલ.
ઇગતપુરે-માણેકબાઇ ડોસાભાઇ ઉમરીગર પારસી બોયઝ એંડ ગરલસ સ્કુલ-ડોસાભાઇ રૂશતમજી ઉમરીગરે પોતાના ધણીઆણી માણેકબાઇના પુન માટે બંધાવેલું સ્કુલનું મકાન-૧૯૧૦
,, રતનબાઇ રૂશતમજી ઉમરીગરે એંગલો વરનાકયુલર મરાઠી બોયઝ એન્ડ ગરલશ સ્કુલ-ડોસાભાઇ રૂશતમજી ઉમરીગરે પોતાના માતાજી રતનબાઇના પુણ માટે સ્થાપેલી—૧૯૧૭.
ઇંદોર-જમશેદજી નશરવાનજી પીટીટ ઝોરાસ્ત્રીયન એલીમેનટરી સ્કુલ-૧૮૯૪.
ઉડવાડા-જીજીભાઈ દાદાભાઇના ધરમખાતામાંથી સ્થાપેલી એંગલો વર્નાકયુલર સ્કુલ-૧૯૦૬ પાછળથી એ ધરમખાતામાંથી હાઇસ્કુલ બનાવી અને નવું મકાન ૧૯૧૭ માં બાંધ્યું છે.
,, બેરામસાહ પેસતનજી જીણાભાઇ કુમાના નીશાળ-પેસતનજી જીણાભાઇ કુમાનાએ સરકારી સ્કુલનુ બંધાવેલું મકાન—૧૯૧૮.
ઉમરા-જીલ્લા સુરત-ધનજીશાહ રૂસતમજી ઉમરીગરે પોતાના પીતા રૂશતમજીના નામથી ગુજરાતી નીશાળ માટે બંધાવેલું મકાન—૧૯૧૨
એડીનબરો-શાપુરજી બરજોરજી ભરૂચાએ પારસી યુનીયન માટે બંધાવેલું ભરૂચા હાઉસ—૧૯૦૯
કચ્છ-ભુજ-પેશતનજી સોરાબજી ભુજવાલાએ બંધાવેલુ કોરોનેશન સ્કુલનું મકાન—૧૯૦૩
કરાંચી-કાવશજી હોરમશજી કાતરક સીમીંગ બાથ—૧૯૦૫
,, વીરબાઈજી એંગલો વરનાકયુલર સ્કુલ.
,, મામા પારસી ગરલસ સ્કુલ—૧૯૧૮.
,, મ્યુનીસીપાલીટીની સ્કુલની બજાવેલી સેવાની યાદમાં તેનું નામ "પેસતનજી બેરામજી કોટવાલ સ્કુલ" રાખ્યું—૧૯૦૮.
કવેતા—બરજોરજી દોરાબજી પટેલવાલી સાનડીમેન ગરલસ સ્કુલ.
,, અરદેસર ડોસાભાઇ મારકર પારસી સ્કુલ—૧૯૦૪
,, બરજોરજી દોરાબજી પટેલે યંગમેનસ ઝોરાસ્ત્રીયન એસોશીએશનને લગતી બંધાવેલી 'ટેનીસ કોરટ"—૧૯૧૩
કારવાર—કુવરબાઇ દાદાભાઇ વલસાડવાલા કન્યાશાળા-દાદાભાઇ રતનજી વલસાડાએ પોતાના ધણીયાણીના નામથી બંધાવેલું મ્યુનીસીપાલીટીની શાળાનું મકાન—૧૯૧૧
કોલંબો-મનચેરજી ફરામજી ખાને કોલંબો કોલટરસ ક્રીકેટ કલબ માટે બંધાવેલો "ફરામજી ભીખાજી ખાન પેવીલીયન"—૧૯૦૮
,, મનચેરજી ફરામજી ખાને જાનવરો માટે બંધાવેલું "ફરામજી ભીખાજી ખાન આશરમ સ્થાન"-૧૯૦૯.
ખેરગામ—રતનબાઇ કન્યાશાળા—જાહાંગીર શાપુરજી ગઝદરે પોતાના માતાજીના નામથી બંધાવેલી સરકારી શાળાનું મકાન—૧૯૧૦.

ગણદેવી—સર કાવસજી રેડીમની ગણદેવી હાઈ સ્કુલ—૧૮૬૪.
,, સર જમશેદજી જીજીભાઇ પારસી છોકરા છોકરીઓની ગુજરાતી નીશાળો માટેનું બીખાઇજી કાવસજી છાપખાનાવાળાનું મકાન—૧૯૧૨
જહાંસી—જરથોસ્તી છોકરા છોકરીઓની સ્કુલ—૧૯૧૭.
તેહરાન—ઇરાનમાં—કન્યાશાળાનું મકાન—જરબાઇ સોરાબજી ખંભાતા અને સુનાબાઈ જાહાંગીર કટેલીએ પોતાના ભાઇ એરચશા રતનજી દુબાશના પુણ્ય માટે બંધાવેલું—૧૯૧૪
થાણા—બેરામજી જીજીભાઇ થાના હાઈ સ્કુલ—૧૮૮૦
દેવલાલી—એદલજી દોરાબજી તનાટીવાલી દેવલાલી જરથોશતી બોરડીંગ સ્કુલ—૧૯૦૭
નવસારી—સર કાવસજી જહાંગીર નવસારી જરથોશતી મદરેસા—૧૮૫૫.
,, એનું મકાન—બેરામજી નશરવાનજી શીરવઈ બીલડીંગ—૧૮૯૭
,, ઉપલી મદરેસાને લગતું રતનજી ફરામજી દાબુ સ્ટુડંટસ કવાટરસ—રતનજી ફ. દાબુના સાહેબજાદાઓએ બંધાવેલું—૧૯૧૧
,, જમશેદજી નશરવાનજી તાતા ઈંડસ્ત્રીયલ સ્કુલ—હુનરશાળા—૧૯૦૮
,, એનું મકાન ખુશરૂ એદલજી બામજી ખુશરૂ બીલડીંગ—૧૯૦૮.
,, એજ ઠેકાણે—એનજીનીયરીંગ વર્ક શોપ—સર દોરાબજી અને રતનજી જમશેદજી તાતા—૧૯૧૦
,, ,, ખોરમસતા હોરમજી શીરવઈ કેબીનેટ કલાસ—હોરમજી શાપુરજી શીરવાઇએ પોતાના બેટા ખોરમસ્તાની યાદમાં બંધાવેલો—૧૯૧૦.
,, દાદાભાઈ કાવસજી તાતા એંગલો વરનાકયુલર સ્કુલ.
,, નવાજબાઇ તાતાવાલી જરથોશતી છોકરીઓની નીશાળ—૧૮૮૩.
,, નસરવાનજી રતનજી તાતાવાલી જંદ પેહેલવી અને ફારસી મદરેસા
,, રૂસતમજી જમશેદજી જીજીભાઇ એંગ્લો વરનાકયુલર સ્કુલ.
,, એનું મકાન—મેરવાનજી નાનાભાઇ મેહેતા બીલડીંગ—૧૯૦૫.
,, મલેસર ગરલસ ઇંગલીશ સ્કુલ—૧૯૧૪.
નાંદોદ—ધનજીશાહ એદલજી એંગલો વરનાકયુલર સ્કુલ—રાજપીપલા સ્ટેટના દીવાન ધનજીશાહ એદલજીની યાદમાં સ્થાપેલી—૧૯૧૪
નારગોલ—નારગોલ પારસી સ્કુલ—૧૯૦૮—પાછળથી નવરોજી માણેકજી વાડીઆ નારગોલ પારસી સ્કુલ—૧૯૧૨.
,, હીરાંબાઇ જમશેદજી નશરવાનજી તાતા નારગોલ ઇંગલીશ ગરલસ સ્કુલ—રતનજી જમશેદજી તાતાએ માતાજીની યાદમાં સ્થાપેલી—૧૯૧૩. એનું મકાન સર રતન તાતાએ બંધાવ્યું—૧૯૧૮.
નીમચ—કુવરજી કાવશજી કેનટોનમેનટ સ્કુલ—૧૯૦૮.
પારડી—કન્યાશાળાનું મકાન—રૂશતમજી સોરાબજી પંચરાઇવાલા—૧૯૧૩.
પુના—સર દીનશાહ માણેકજી પીટીટ બેરોનેટનું પારસી જીમખાનાનું મકાન—૧૮૯૪.
,, સર કાવસજી જાહાંગીરવાલી પુણા શીવીલ એનજીનીઅરીંગ કોલેજ બીલડીંગ, જે હવડાં કોલેજ ઓફ સાયન્સને નામે ઓળખાય છે.
,, સર જમશેદજી જીજીભાઇ પુણા કોલેજ બીલડીંગ.
,, સરદાર દસ્તુર નોશરવાનની યાદગારીવાલી જરથોશતી છોકરીઓની નીશાળ—૧૮૯૩.
,, એનું મકાન—બહમનબાઇ બીલડીંગ—સરદાર દસ્તુર નોશીરવાનના બહેન બહમનબાઇની યાદગારી માટે બંધાવેલું—૧૯૧૧
,, બેરામજી જીજીભાઇ મેડીકલ સ્કુલ—૧૮૭૮.
,, ફરગ્યુસન કોલેજને લગતું એન. એમ. વાડીઆ એમફી થીએટર—૧૯૧૨.
બાલાગાટ—નાગપોર નજદીક—ડીવોર સ્કુલનું મકાન—બેરામજી પેશતનજી કંટરાકટર—૧૯૧૩.
બીલીમોરા—ર. પે. બીલીમોરા એ. વ. સ્કુલ—૧૮૯૩—પાછળથી મનચેરજી અને રતનજી તાતા હાઇ-સ્કુલ થઇ અને એનું મકાન મનચેરજી અને રતનજી શા. તાતાએ બંધાવ્યું—૧૯૧૬
,, મનચેરજી શાપુરજી તાતા ગરલસ ઇંગલીશ સ્કુલ—રતનજી શા. તાતા અને મનચેરજી શા. તાતાના છોકરાઓએ સ્થાપેલી—૧૯૧૮

બેંગલોર-જમશેદજી નશરવાનજી તાતાવાલું ઇંડીયન ઇનિસટીટયુટ ઓફ સાએનસ-તાતા રીચર ઇનસટીટયુટ-૧૯૦૯.
ભરૂચ-જરથોશતી છોકરીઓની નીશાળ-૧૮૬૩-પાછલથી જમશેદજી નશરવાનજી પીટ જરથોશતી કન્યાશાળા-૧૮૮૫
,, એ સ્કુલના નીચલા ધોરણો માટેનું મકાન-રતનબાઇ ધનજીશાહ ડાકટરે બાંધેલું—૧૮૮
,, એ સ્કુલના ઉપલા ધોરણો માટેનું મકાન-દીનબાઇ નશરવાનજી પીટીટ અને દીકરી આવાંબાઇ ફ. પીટીટે બાંધેલું—૧૯૦૩
,, ઉપલી કન્યાશાળાને લગતી—પારસી એંગ્લો વરનાકયુલર ગરલસ સ્કુલ-પાછલથી મોટલબાઈ વાડયા યંગ લેડીઝ સ્કુલ-૧૯૧૨
,, રૂસતમજી સોરાબજી દલાલ હાઇ સ્કુલ—૧૮૮૬.
,, મ્યુનીસીપાલીટી સ્કુલ માટે બાંધેલું મકાન—"જીવીબાઈ પેશતનજી અસલાજી ડુંગા મ્યુનીસીપાલ કન્યાશાળા"-૧૯૧૭
બીમડી-નસરવાનજી માણેકજી પીટીટનું બીમડી સ્કુલનું મકાન.
બીવંડી-બેરામજી જીજીભાઇ બીવંડી સ્કુલ-૧૮૯૦
મઉ-જરથોશતી છોકરીઓનું સ્કુલનું મકાન—ભીખાજી નવરોજી માણેકજી ખોરીના પુણ મા
,, એદલજી પેસતનજી ઝોરાસ્ત્રીયન હાઈ સ્કુલ—૧૮૬૩
,, એદલજી પેશતનજી એંગલો વરનાકયુલર સ્કુલ.
માથેરાન-જાલભાઇ અરદેશર શેઠ માથેરાન પારસી જીમખાના—૧૯૧૨
રૂસતમપુરા-પંચમહાલ જીલ્લા—આઉન વરનાકયુલર સ્કુલ—સરદાર બમનજી અરદેશર દલ પોતાના માતાજી ગુલબાઇના પુન માટે બાંધેલું મકાન—૧૯૦૭
વટારગામ-ઉડવાડા પાસે-શાવકશાહ સોરાબજી ઉમરીગર સ્કુલ-એનું મકાન ઉકરજી કાવસ ઉમરીગરે બંધાવેલું—૧૯૧૪.
વડોદરા-સોરાબજી જમશેદજી જીજીભાઇ વરનેકયુલર સ્કુલ.
વેસુ-જીલ્લા સુરત-પેસતનજી ડોસાભાઇ મારકરવાલુ સરકારી શાળાનું મકાન—૧૯૧૦.
વલસાડ-વલસાડ હાઈ સ્કુલ—૧૮૯૨, પાછલથી ૧૮૯૬ માં આવાંબાઇ હાઇ સ્કુલ થઇ જે બમન શાપુરજી ચોઠયાએ દીકરી આવાંબાઇને નામે સ્થાપેલી અને ૧૯૦૪ માં એનું મકા બંધાવી આપયું. સ્કુલને લગતું વધારાનું મકાન અને સાયનસ હોલ બ. શા. ચોઠયા ધણીયાણી જીવણાઇએ ૧૯૧૬ માં બંધાવ્યો.
,, મ્યુનીસીપાલીટી સ્કુલનું "કાવસજી ધનભુરા કન્યાશાળાનું મકાન"-કાવસજી ધનજીમ ધનભુરાએ બાંધેલું ૧૯૧૦-એની જોડે કા. ધ. ધનભુરાએ માતાજીને નામે બંધાવેલું બી મકાન "હીરાબાઇ ધનભુરા કન્યાશાળા"—૧૯૧૭
,, દીનબાઇ રતનજી બીલડીંગ-દાદાભાઈ ર. બલસારાએ માતાજી દીનબાઇના પુણ માટે ૧૮ માં સર જમસેદજીની છોકરા તથા છોકરીઓની સ્થાપેલી સ્કુલનું બંધાવેલું મકાન-૧૯
સીકંદરાબાદ-મીઠીબાઇ શાપુરજી એદલજી ચીનાઇ સ્કુલ—૧૮૯૫
,, રતનબાઇ જેહાંગીરજી ચીનાઇ એંગલો વરનાકયુલર સ્કુલ-જહાંગીર જમશેદજી ચી ઇએ મરહુમ ધણીયાણી રતનબાઇના પુણ માટે સ્થાપેલી—૧૯૧૯.
સુરત-રૂસતમજી મનચેરજી કુકાવાળી સુરત પારસી ઓરફનેજ—૧૯૧૨
,, એજ ઠેકાણે—સોરાબજી જમશેદજી જીજીભાઈ હાઇસ્કુલ—૧૮૯૫
,, પીરોજબાઈ માણેકજી પટેલવાલી છોકરીઓની અંગરેજી સકુલ—૧૯૧૨
,, એનું મકાન—શીગનપોરવાલા એદલજી કુવરજી પટેલે ભેટ આપેલું—૧૯૧૨
,, ફરેદુનજી સોરાબજી પારખ ટેકનીકલ ઇનસટીટયુટ.
,, એજ ઠેકાણે-નવરોજી માણેકજી વહાડયાનું મોટલાબાઇ વરકશોપનુ મકાન—૧૯૦૬
હોંગકોંગ-યુનીવરસીટીનું મકાન-સર હોરમજી નવરોજી મોદી—૧૯૧૨.
,, સી મેનસ ઇનસટીટયુટ—સર હોરમજી નવરોજી મોદીએ સેલરો માટે બંધાવી આપે રહેવાનું મકાન—૧૯૧૦.
હેદરાબાદ-દખણ-થીઓસોફીક સોસાઇટીનું મકાન-૧૯૦૬.

જરથોસ્તીઓએ સ્થાપેલાં પુસ્તકખાંના.

મુંબઇ મધેના પુસ્તકખાંના.

કોટમાં—સર દીનશાહ પીટીટ મેડીકલ યુનીયન લાઇબરેરી—૧૮૮૩.
,, સર દીનશાહ પીટીટ ફ્રેંચ કલબનું પુસ્તકખાનું—૧૮૮૭.
,, જમશેદજી નશરવાનજી પીટીટ (ફોરટ રીડીંગ રૂમ એંડ લાઇબરેરીવાલું) ઇનસ્ટીટયુટ
,, મા. ખ. મેમોરીયલ લાઇબરેરી—એલેકઝાંનદ્રા નેટીવ ગરલ્સ ઈંગલીશ ઇનસ્ટીટયુશનમાં.
ખેતવાડી—ધનજીભાઇ ફરામજી રીડીંગ રૂમ એંડ લાઇબરેરી—૧૮૬૦.
ગીરગામ—જમશેદજી નશરવાનજી પીટીટ લાઇબરેરી—૧૮૬૩.
,, રતનજી જમશેદજી તાતાવાલો સ્ટુડંટસ બ્રધરહુડનો રીડીંગ રૂમ અને લાઇબરેરી—૧૯૧૧.
ધોબીતલાવ—માણેકજી લીમજીભાઈ હાતરીઆનું પુસ્તકખાનું—અનજુમનનાં આતશબેહરામમાં.
,, બમનજી દીનશાહ પીટીટ સેંટ ઝેવીયર લાઇબરેરી—સેંટ ઝેવીયર કોલેજમાં—૧૯૧૫.
,, જમશેદજી નશરવાનજી પીટીટ બાહારકોટ ઇમપરૂવમેંટ લાઇબરેરી—૧૮૬૯. (આ લાઇબરેરી જુલાઇ ૧૯૧૩ માં જરથોસ્તી કોમના લાભ સાચવનારી મંડલી હસ્તક સોંપવામાં આવી છે.)
બાહારકોટ—સર દીનશાહ પીટીટ કાંદા મોહલા તથા ભરૂચા મોહલા લાઇબરેરી—૧૮૭૦.
,, મુલ્લાંફીરોજ કેતાબખાનું—દાદીશેઠના આતસબેહેરામમાં—૧૮૫૩.
ભાયખલા—જમશેદજી નશરવાનજી પીટીટ રીડીંગ રૂમ એંડ લાઇબરેરી—કોલાબે ૧૮૮૬ માં સ્થાપેલી તે પાછલથી ૧૯૧૬ માં ભાયખલા વીકટોરીયા ગારડન આગલ લઇ ગયા.

દેશાવર ખાતેના પુસ્તકખાંના.

અંકલેશ્વર—જમશેદજી નશરવાનજી પીટીટ અંકલેશ્વર લાઇબરેરી—૧૮૮૬.
અમદાવાદ—નશરવાનજી માણેકજી પીટીટ ગુજરાત કોલેજ લાઇબરેરી—૧૮૯૦.
એડન—એડન પારસી લાઇબરેરી—૧૮૭૦.
કરાંચી—જમશેદજી અરદેશર હીરજીભાઇ બહેરાના લાઇબરેરી તથા રીડીંગ રૂમ—બહેરાનાની દરેહમહેરમાં જમશેદજી અ. બહેરાનાની યાદમાં માતાજી ડોશીબાઈ તથા ભાઇઓએ બંધાવેલો રૂમ—૧૯૧૮.
કલકતા—ઓનરેબલ સર દીનશાજી મા. પીટીટ નાઇટ ઝોરાસ્ટ્રીઅન લાઇબરેરી—૧૮૮૯.
કાનાનોર—હીરજીભાઇ મનચેરજી માલેગામવાલાને નામનું લાઇબરેરીનું મકાન—૧૮૯૫.
કોતાહી—કોલંબો નજદીક— મનચેરજી ફરામજી ખાનનું બાઇબરેરીનું મકાન—૧૯૦૭.
દેવલાલી—લાઇબરેરી—બાહાદુરજી સેનેટરીયમમાં—બરજોરજી બેરામજીએ દીકરા નોશીરવાનની યાદમાં બંધાવેલું મકાન—૧૯૧૦.
નવસારી—પેહલા દસ્તુર મેહરજીરાણા કેતાબખાનું—૧૮૭૨.
,, એનું મકાન—માણેકબાઈ માણેકજી દસ્તુર બીલડીંગ—૧૯૦૬.
પુણા—કાવસજી દીનશાહ લાઇબરેરી—પુણાની એલબરત એડવરડ ઇનસ્ટીટયુટ સાથ સને ૧૯૦૧ માં જોડી નાંખવામાં આવી છે.
,, ઉપલી લાઇબરેરી માટે કાવસજી દીનશાહ હોલ—૧૯૦૬.
બીલીમોરા—બીલીમોરા રીડીંગ રૂમ અને લાઇબરેરી—૧૮૮૨ પાછલથી જાહાંગીર બમનજી પીટીટ નેટીવ જનરલ લાઇબરેરી એંડ પબલીક હોલ—૧૯૦૫—જા. બ. પીટીટ ફ્રી લાઇબરેરી એંડ પબલીક હોલ—૧૯૧૬—એનું મકાન જાહાંગીર બ. પીટીટે બંધાવ્યું—૧૯૦૮.
મહાબલેશ્વર—ઓનરેબલ બમનજી પીટીટ નેટીવ જનરલ લાઇબરેરી—૧૯૦૨.
મઉ—પીરોજબાઇ એ. દાદાભાઇ લાઇબરેરી—અરદેશર આદરજી દાદાભાઇએ માતાજી પીરોજબાઇની યાદમાં સ્થાપી બંધાવેલું મકાન—૧૯૧૮.
રાયપુર—બેરામજી પેસતનજી કંત્રાકટરવાલું બેરામજી આનંદ સમાજ લાઇબરેરીનું મકાન—૧૯૦૯.
વલસાડ—આવાંબાઈ લાઇબરેરી—બમનજી શાપુરજી ચોડયાએ સ્થાપેલી—૧૮૯૬.
વડોદરા—નશરવાનજી માણેકજી પીટીટ વડોદરા કેંપ રીડીંગ રૂમ એંડ લાઇબરેરી—૧૮૯૦.
સુરત—રૂસતમપરા રીડીંગ રૂમ અને દસ્તુર ખોરશેદ લાઇબરેરી ૧૮૬૮.
,, નાનપુરા નેટીવ રીડીંગ રૂમ—૧૮૬૮.
,, ગોપીપુરા—દીનશાહ દોરાબજી માસ્તરી લાઇબરેરી અને રીડીંગ રૂમ—૧૯૦૯.

"સર નાઇટ, બારોનેટનો" માનવંત ખેતાબ મલેલા જરથોસ્તીઓ.

શેઠ જમશેદજી જીજીભાઇને તેમની મોટી સખાવતને માટે પેહેલ વેહેલાં ઇસવી સને ૧૮૪૨ની તા૦ ૨ જી મારચે એટલે પારસીઓનો રોજ ૫ મો માહ ૬ ઠો સને ૧૨૧૧ યઝદેજરદીને વાર બુધને દીને "સર નાઇટ" નો નામીચો ખેતાબ મલ્યો હતો. એ ખેતાબની પાદશાહી મોહોર સાથની શનદ ઇંગલંડથી તે વેળાના મુંબઇના ગવરનર ઓનરેબલ જોરજ વીલયમ એનડરશન ઉપર આવી હતી તે સર જમશેદજીને આપવા માટે રોજ ૨૯ મો માહ ૮ મો સને ૧૨૧૧ યઝદેજરદી, તા૦ ૨૫ મી મે ૧૮૪૨ ને દીને મુંબઇના પરેલના સરકારી મેહેલમા રાતે એક મેલાવડો કરવામાં આવ્યો હતો. નામદાર અંગરેજ સરકારથી જેવોને "સર નાઇટ"નો ખેતાબ બક્ષવામાં આવે છે, તે ગ્રહસ્થની હઇઆતી શુધીજ હોય છે; પણ તે પછી જનાબેઆલી માહારાણી વીકટોરીયાએ સર જમશેદજીની મોટી લાખો રૂપયાની સખાવત વીગેરેની બીજી માહાભારત ખુબીની યાદગારી વંશપરંપરા ચાલુ રાખવાના શુભ હેતુથી તેમને રોજ ૨જો માહ ૯ મો સને ૧૨૨૬ યઝદેજરદી, તા૦ ૨૪ મી મે ૧૮૫૭ની નામદાર માહારાણી વીકટોરીઆની શાલગરેહને દીને "બારોનેટ"નો માનવંત ખેતાબ બખશયો હતો, તેની શદન એજ વરસના રોજ ૧૬ મો માહ ૧૧ મો સને ૧૨૨૬ યઝદેજરદી, તા૦ ૬ ઠી આગસ્ટ સને ૧૮૫૭ ને વાર ગરેડીને દીને વેલાતની વેસત મીનીસટરમાંથી બાહાર પડી હતી તેમાં જણાવ્યું હતું કે એ ખેતાબ વંશપરંપરા ચાલુ રેહશે, એટલે કે દરેક બારોનેટના વડા બેટાને "સર જમશેદજી જીજીભાઇ બારોનેટ"ના નામથી એ ખેતાબ વાપરવામાં આવશે. એ મુબારક ખેતાબના મોભાની જાળવણી કીજે મરહુમ સર જમશેદજી જીજીભાઇ પેહેલા બારોનેટે ૩૨૨૫૪૪૦ની હીંદી સરકારની પ્રોમીસરી નોટો સરકારમાં અનામત મુકી હતી કે જેનું દર સાલનું બ્યાજ સદરહુ ખેતાબ ધરાવનારને મલે છે. એવો સાહેબને "ફ્રીડમ ઓફ ધી સીટી ઓફ લંડનનું" માન રોજ ૨૧ મો માહ ૭ મો સને ૧૨૨૪ યઝદેજરદી તા૦ ૧૪ મી એપ્રીલ સને ૧૮૫૫ ઇસવીને દીને મલ્યું હતું. સર જમશેદજી જીજીભાઇ પેહેલા બારોનેટ જેમનો જન્મ નવસારીમાં રોજ ૬ ઠો માહા ૧૦ મો સને ૧૧૫૨ યઝદેજરદી, તા૦ ૧૫ મી જુલાઇ સને ૧૭૮૩ ઇસવી ને વાર મંગલને દીને થયો હતો, તેઓ સાહેબ ૭૬ વરશની ઉમરે, રોજ ૨૨ મો માહ ૭ મો સને ૧૨૨૮ યઝદેજરદી, તા૦ ૧૪ મી એપ્રીલ સને ૧૮૫૯ ઇસવી ને વાર ગુરૂને દીને હક થવાથી, એ ખેતાબ તેઓના પેહેલા પુત્ર શેઠ ખરશેદજી જમશેદજીને મલ્યો હતો, જેઓ "સર જમશેદજી જીજીભાઇ બીજા બારોનેટ" તરીકે ઓલખાતા હતા. વળી એવો સાહેબને ઇસવી સને ૧૮૭૧ માં યાને ૧૨૪૦ યઝદેજરદીના સાલમા "કમ્પેનીયન ઓફ ધી સ્ટાર ઓફ ઇંડીયા"નો ખેતાબ નામદાર માહારાણીએ આપ્યો હતો. સર જમશેદજી જીજીભાઇ બીજા બારોનેટ સી. એસ. આઇ. નો જન્મ રોજ ૩ જો માહ ૧ લો સને ૧૧૮૧ યઝદેજરદી, તા૦ ૯ મી અકટોબર ૧૮૧૧ ઇસવીને દીને થયો હતો. તેઓ ૬૬ વરસની ઉમરે રોજ ૨૫ મો માહા ૧૦ મો સને ૧૨૪૬ યઝદેજરદી, તા૦ ૧૧મી જુલાઇ સને ૧૮૭૭ ને દીને પુણા ખાતે ગુજરયાથી તેઓના વડા પુત્ર શેઠ માણેકજી ખરશેદજી, "સર જમશેદજી જીજીભાઇ ત્રીજા બારોનેટ" તરીકે ગણાયા હતા. વળી એવણને નામદાર માહાણીની સાલગરેહની ખુશાલીમાં, સી. એસ. આઇ. યાને "કમ્પેનીયન ઓફ ધી સ્ટાર ઓફ ઇંડીયા"નો ખેતાબ રોજ ૧૯ મો માહ ૮ મો સને ૧૨૫૩ યઝદેજરદી, તા૦ ૪ થી મે સને ૧૮૮૪ ને દીને મલ્યો હતો. એવણનો જન્મ રોજ ૮ મો માહ ૬ ઠો સને ૧૨૨૦ યઝદેજરદી, તા૦ ૩ જી મારચ સને ૧૮૫૧ ઇસવીને દીને થયો હતો, તેઓ ૪૭II વરશની ઉમરે રોજ ૬ ઠો માહ ૧૧ મો શેહેનશાહી સને ૧૨૬૭ યઝદેજરદી, તા૦ ૧૭ મી જુલાઈ સને ૧૮૯૮ ને દીને ગુજરવાથી અને તેવણના એક પુરા બેટા શેઠ ખરશેદજી ૧૫ વરશની ભર જવાન

વયે સને ૧૮૯૩ ના જુલાઈ માસની ૨૮ મી તારીખે ગુજરી ગયલા હોવાથી અને ત્રીજા બારોનેટ સર જમશેદજીને પેટે બીજો કોઇ હઈઆત વારસ ન હોવાથી તેવણના ભાઈ શેઠ કાવસજી ખરશેદજી જમશેદજી, જેઓનો જન્મ રોજ ૫ મો માહ ૩ જો શેહેનશાહી સને ૧૨૨૨ યઝદેજરદી, તા૦ ૨૯ મી નવેમબર ૧૮૫૨ ઇસવીને વાર સોમને દીને થયો હતો, તેવણ "સર જમશેદજી જીજીભાઇ ચોથા બારોનેટ" તરીકે ગણાયા હતા. એવણને નામદાર સરકાર તરફથી સને ૧૯૦૦ ના સાલમાં મુંબઇના શેરીફ નેમવામાં આવ્યા હતા અને એવણ ૧૦ વરસ સુધી બારોનેટશીપ ભોગવી ૫૫ા વરશની વયે મુંબઇમાં રોજ ૮ મો માહ ૧૦મો શેહેનશાહી સને ૧૨૭૭ યઝદેજરદી, તા૦ ૧૭ મી જુન સને ૧૯૦૮ ઇસવીને વાર બુધને દીને બેહેશતનશીન થવાથી, એવણના એકપુરા વડા બેટા શેઠ રૂશતમજી જમશેદજી જીજીભાઇ જેવણનો જનમ રોજ ૧૮ મો માહ ૬ ઠો શેહેનશાહી શને ૧૨૪૭ યઝદેજરદી, તા૦ ૬ ઠી મારચ શને ૧૮૭૮ ઇસવીને વાર બુધને દીને થયો હતો. તેવણ પોતાની ત્રીસ વરશની ઉમરે "સર જમશેદજી જીજીભાઇ પાંચમાં બેરોનેટ" તરીકે હમણા ગણાય છે. એવણને નામદાર સરકાર તરફથી ઇશવી સને ૧૯૧૫ ના સાલમાં મુંબઇના શેરીફ નેમવામાં આવ્યા હતા.

શેઠ દીનશાહજી માણેકજી પીટીટને તેમની મોટી લખો રૂપીઆની સખાવત તથા બીજાં ખુબીવંતા કામોને લીધે રોજ ૨ જો માહા ૬ ઠો સને ૧૨૫૬ યઝદેજરદી, તા૦ ૧૬ મી ફેબરવારી સને ૧૮૮૭ ને દીને "સર નાઇટનો" નામીચો ખેતાબ આપણી અંગરેજ સરકાર તરફથી મલ્યો હતો. નામદાર શેહેનશાહબાનું વીકટોરીઆએ પોતાના તખતપર બીરાજવાને પચાશ વરશ પુરાં કીધાં તેની ખુશાલીમાં જુબીલીને નામનો એક તેહેવાર આખા હીંદુસ્થાનમાં ઉપલી તા૦ ૧૬ મી ફેબરવારી ૧૮૮૭ ને દીને મોટી ધામધુમથી પાલવામાં આવ્યો હતો, તે દીને નામદાર શેહેનશાહબાનુએ આપેલા ખેતાબોનું લીસ્ટ જે કલકતાની વડી સરકારના ગેઝેટમાં છાપી પ્રગટ કરવામાં આવ્યું હતું, તેમાં શેઠ દીનશાહજી માણેકજી પીટીટને આ સર નાઇટનો નામીચો ખેતાબ બક્ષવાનું જાહેરનામું પ્રગટ થયું હતું. આ બનાવથી આખી પારશી કોમમાં અને મુંબઇની તમામ વસતીમાં મોટી ખુશાલી પથરાઇ હતી અને ચોમેરથી સર દીનશાજીને માન-પાન-ખાનાં-પીના અને એદરેસો આપવામાં આવ્યા હતાં. એ પછી સને ૧૮૯૦ ના સાલમાં નામદાર કયસરે હીંદની તરફથી એવણ સાહેબને "બારોનેટનો" માનવંત ખેતાબ બક્ષવામાં આવ્યો હતો જેની પેહેલવેહેલી ખબર મુંબઇનાં નામદાર ગવરનર લોરડ રેએ શાકરબાઇવાલી જનાવરોની હારપીટલમાં જાનવરોનાં વઇદાંને લગતી શોધખોલ કરવાને માટેની લેબોરેટરી ખુલ્લી મેલતી વેળાએ તા૦ ૧૮ મી મારચ સને ૧૮૯૦ ને દીને પોતાનાં ભાશણમાં જાહેર કરી હતી. તે પછી ઇંગલંડથી આવેલા આ ખેતાબના "લેટરશ પેટંટ" મુંબઈ સરકારના જુડીસીયલ તથા ધારાખાતાના માજી મદદનીશ સેક્રેટરી મરહુમ શેઠ મેહેરવાનજી નશરવાનજી વાહાડયાં રોજ ૨૮ મો માહા ૨ જો શને ૧૨૬૦ યઝદેજરદી, તા૦ ૧૩ મી નવેમબર શને ૧૮૯૦ ઇસવીને દીને સર દીનશાહજીના વાલકેશ્વર ખાતેના પીટીટ હાલમાં જઇને એવો શાહેબને પોહોચાડી આવ્યા હતા. એ ખેતાબની જાલવણીને માટે એવો શાહેબે બી રૂપયા પચીશ લાખની મોટી રકમનાં પાંચ ટકાનાં મ્યુનીસીપલ બોન્ડો શરકારમાં અનામત મેલ્યા છે કે જેનું વ્યાજ દર બારોનેટ વારશને મલ્યું જશે. નામદાર સર દીનશાહજી જેમનો જનમ રોજ ૩૦ મો માહા ૯ મો શને ૧૧૯૨ યઝદેજરદી, તા૦ ૩૦ મી જુન સને ૧૮૨૩ ઇસવીને દીને થયો હતો, એવો શાહેબ ૭૭ વરશ ને ૧૧ માશની ઉમર ભોગવીને રોજ ૨૩ મો દેપદીન માહા ૮ મો આવાં શને ૧૨૭૦ યઝદેજરદી, તા૦ ૫ મી મે ૧૯૦૧ ને રવીવારે બેહશતનશીન થયા હતા. એવણની જગોપર એવણની પાછળ બારોનેટશીટપર આવનારનું એવોનાં માંગવાથી નામદાર શરકારે (એમના પેહેલા. વડા બેટા શેઠ કાવસજી આગલથી

ગુજરી ગયલા હેવાથી) એમના બીજા બેટા શેઠ ફરામજી દીનશાજી પીટીટને અને તેમના મરદ વારેશોને માટે કાયદામાં નકી કરી આપ્યું હતું, પણ શેઠ ફરામજી નામદાર સર દીનશાહજીની હઈ-યાતીમાંજ ગુજરી જવાથી તેમના એક પુરા બેટા શેઠ જીજીભાઇ ફરામજી પીટીટ જેનો જનમ રોજ ૨૦ મો માહ ૯ મો શેહેનશાહી સને ૧૨૪૨ યઝદેજરદી તા૦ ૭ મી જુન સને ૧૮૭૩ ઇસ્વીને દીને થયો હતો, તેવો હાલમાં "સર દીનશાજી માણેકજી પીટીટ બીજા બેરોનેટ" તરીકે ગાદીએ આવ્યા છે.

શેઠ જાહાંગીરજી કાવસજી જાહાંગીરજી રેડીમની તે આપણી ટાપુના એક મોટા મરહુમ સખી શેઠયા સર કાવસજી જાહાંગીરનાં દત પુતરે લંડન ખાતે ઇંગલંડના ઇમપીરીયલ ઈનસ્ટીટયુટમાં 'ઇંડયન કોનફરંસ હોલ' બંધાવી આપ્યો તે માટે બે લાખ રૂપયાની મોટી મદદ કરી હતી તથા બીજી કેટલીક સખાવતો કરી હતી. એવો સાહેબને સને ૧૮૯૫ ની તા૦ ૩૦ મી જુન યાને રોજ ૧૮ મો માહા ૧૦ મો સને ૧૨૬૪ યઝદેજરદી ને વાર રવીને દીને વેલાતની નામદાર સરકાર તરફથી સર નાઇટના નામીચા ખેતાબની એનાયત થઇ હતી. એ ખેતાબ ઇંગલાંડમાં ખુદ મરહુમ માહારાણી વિકટોરીયાના બખતાવર હાથેજ એવો સાહેબને અરપન કરવામાં આવ્યો હતો. એ પછી એવો શેઠની ચાલુ રહેલી મોટી બોહોલી સખાવતો માટે નામદાર બખતાવર શેહેનશાહ એડવર્ડ સાતમાની ૬૮ માં વરશની સાલગ્રહના શુભ દીને યાને તા૦ ૨૬ મી જુન સને ૧૯૦૮ ઈસવી, રોજ ૧૭ મો માહા ૧૦ મો સને ૧૨૭૭ યઝદેજરદી, ને વાર શુકરને દીને સાલગ્રહની ખુશાલીમાં વેલાત ખાતે ઉમરાવો અને બીજાઓના ખેતાબોનું લીસ્ટ જે વેલાતના ગવરમેન્ટ ગેઝેટમાં છાપી પ્રગટ કરવામાં આવે છે (જેનો ટેલીગ્રામ અતરે તેજ દીવસે આવ્યો હતો) તેમાં સર જાહાંગીર કાવસજીને બારોનેટનો માનવંત ખેતાબ એનાયત કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું. એની સનદ મુંબઈના નામદાર ગવરનર સર જ્યોરજ સીડન હેમ કલારકે મુંબઈના સેકરેટરીયટના કાઉનશીલ હાલમાં રોજ ૩૦ મો માહા ૫ મો સને ૧૨૭૮, તા૦ ૯ મી ફેબરવારી સને ૧૯૦૯ને દીને ભરેલી લેવીમાં સર જાહાંગીર કાવસજીને એનાયત કીધી હતી. આ બારોનેટના બખતાવર ખેતાબની જાલવાની સારૂ એવો શેઠેબી રૂપીયા ૨૫,૦૦,૦૦૦ ની નાદર રકમ સરકારમાં અનામત મેલી છે કે જેનું બ્યાજ દર બારોનેટ વારસને હમેશાં મલ્યું જશે. તે એવી રીતે કે રૂપીયા પંદર લાખની મીલકતો જે નામદાર સરકારને આપેલી છે કે જેની ઉપજ રૂપીયા ૫૦૦૦૦ થશે તે રકમ નામદાર હીન્દી વજીર તરફથી કાયમને માટે સાલયાણા દાખલ દર વરસે મલતી રહે એવી ગોઠવણ કરવામાં આવી છે. એ ઉપરાંત રૂપ્યા દશ લાખના હીન્દી સરકારની પ્રોમીસરી લોનો, મુંબઈની મ્યુનીસીપાલ કારપોરેશનના તથા મુંબઈ પોરટ ટ્રસ્ટના અને મુંબઇના સીટી ટ્રસ્ટના બોન્ડો આપવામાં આવ્યા છે, જેની રૂપ્યા ૪૦૦૦૦ ની વધુ વારશીક ઉપજ થશે. વલી મુંબઇમાં આવેલા રેડીમની હાઉસના બે બંગલા ૨૦૦૦૦ વાર જગા સાથે આપ્યા છે જેમાનું ફોરટ મેનશન હાઉસ જે ચરચગેટ સ્ત્રીટમાં આવેલું છે, જે આજે એક સદી ઉપર પેહેલવેહેલું ચરચગેટ સ્ત્રીટમાં બંધાયું હતું અને તેનું ભાડું ઉપજે છે અને તે રેડીમની ખાનદાનમાં આજે આંક નવ પેહડીથી ઉતરી આવેલું છે. એનું બધું મલીને રૂપીયા એક લાખની આવકનું જાકુકનું ટ્રસ્ટ છે. હવે પછી જે સર કાવશજી જાહાંગીરનું નામ ધારણ કરે તેનેજ આ આવક મલી શકે એવો બંદોબસત કીધો છે. હાલ તરત રૂપીયા પચીસ લાખ ટ્રસ્ટમાં મુકીઆ છે પણ કોઇબી વારસ હવે પછી રૂપીયા પચાસ લાખ વેરનો ટ્રસ્ટમાં વધારો કરી શકશે. સર જાહાંગીર કાવસજી જાહાંગીરે પોતાનો બારોનેટનો ખેતાબ મલ્યા પછી પોતાનું નામ ફેરવી કાવસજી જાહાંગીર રાખ્યું છે. એવો સાહેબનો જનમ રોજ ૧૬ મો માહ ૯ મો શેહેનશાહી સને ૧૨૨૨ યઝદેજરદી, તા૦ ૮ મી જુન સને ૧૮૫૩ ઇસવી ને વાર બુધને દીને થયો હતો.

"સર નાઈટનો" નામીચો ખેતાબ મલેલા જરથોસ્તીઓ.

મુંબઈના સખાવતી શેઠ કાવશજી જાહાંગીરજી રેડીમની, જેવોનો જનમ રોજ ૨૧ મો માહા ૮ મો સને ૧૧૮૧ યઝદેજરદી, તા૦ ૨૪ મી મે સને ૧૮૧૨ ઇસ્વીને દીને થયો હતો, તેઓ સાહેબ ૬૬ વરશની ઉમરે રોજ ૩ જે માહા ૧૧ મો શેહેનશાહી સને ૧૨૪૭ યઝદેજરદી, તા૦ ૧૯ મી જુલાઇ સને ૧૮૭૮ ઇસવીને દીને હક થયા હતા. તેવોએ પોતાનો ધરમી દશત ચોમેર લંબાવી સઘલી કોમમાં વીખીઆતી મેલવી હતી. તેવણુને ઈસવી સને ૧૮૬૯ નાં જુન માસમાં સી. એસ. આઈ. યાને "કમ્પેનીયન ઓફ ધી સ્ટાર ઓફ ઇનડીઆ" નો ખેતાબ બક્ષવામાં આવ્યો હતો. એ પછી એ શેઠની એવી કોશેશો વધારે જારી રેહવાથી શેઠ કાવસજીને "સર નાઇટ" નો નામીચો ખેતાબ સને ૧૮૭૨ ના સાલમાં નામદાર સરકાર તરફથી આપવામાં આવ્યો હતો.

શેઠ મનચેરજી મેરવાનજી ભાવનગરી સી. આઇ. ઇ. ને નામદાર શેહેનશાહ બાનુ માહારાણી વિકટોરીયાની ડાયમંડ જુબીલીને ટાંકણે યાને તા૦ ૨૨ મી જુન ૧૮૯૭ ને દીને "નાઇટ કમાંડર ઓફ ધી ઇંડીયન એમ્પાયર" નો નામીચો ખેતાબ બક્ષવામાં આવ્યો હતો.

મુંબઇના જાણીતા શેહેરી શેઠ ફીરોજશાહ મેરવાનજી મેહેતા બારીસ્ટર, એમ. એ., સી. આઇ. ઇ.—જેવો મુંબઇમાં પ્રજાનાં એક અચ્છા આગેવાનનો હરહમેશા ભાગ બજાવતા હતા—તેઓને નામદાર બ્રીટીશ સરકારે તા૦ ૨૪ મી જુન ૧૯૦૪ ને દીને નામવર શેહેનશાહ એડવરડ સાતમાંની શાલગરેહને દીને અપાયલા ખેતાબોમાં કે. સી. આઇ. ઇ. યાને "નાઇટ કમાંડર ઓફ ધી ઇંડીયન એમ્પાયર" નો નામીચો ખેતાબ બખશ્યો હતો, એની સનદ તા૦ ૭ મી દીસેમબર ૧૯૦૪ ને દીને આપવામાં આવી હતી. એવણુનો જનમ મુંબઇમાં રોજ ૧૧ મો માહા ૧૧ મો શેહેનશાહી સને ૧૨૧૪ ય૦, તા૦ ૪ થી આગસ્ટ ૧૮૪૫ને સોમને દીવસે થયો હતો. એવો સાહેબ ૭૦ વરસની ઉમરે રોજ ૨૫ મો માહા ૨ જો શેહેનશાહી સને ૧૨૮૫ ય૦, તા૦ ૫ મી નવેમબર ૧૯૧૫ ને સુકરવારે બેહેસતનશીન થયા હતા.

મુંબઇના જાણીતા શેહેરી અને સખાવતે મશહુર નામીચા શેઠીયા શેઠ દોરાબજી જમશેદજી તાતાને તા૦ ૧ લી જાનેવારી સને ૧૯૧૦ ઇસવી યાને આપણી રાજ કરતી કોમના નવા વરશની ખુશાલીમાં સર નાઇટનો નામીચો ખેતાબ નામદાર સરકાર તરફથી એનાયત કરવામાં આવ્યો હતો.

હોંગકોંગના જાણીતા શેહેરી અને વેપારી શેઠ હોરમજી નવરોજી મોદીને આપણી ઈંગ્લંડની બ્રીટીશ સરકાર તરફથી સર નાઇટનો ખેતાબ તા૦ ૧૬ મી મારચ સને ૧૯૧૦ ને દીને યાને રોજ ૫ મો માહા ૭ મો શેહેનશાહી સને ૧૨૭૯ યઝદેજરદી ને વાર બુધને દીવસે એનાયત કરવામાં આવ્યો હતો. શેઠ હોરમસજીએ નામદાર પ્રીન્સેસ ઓફ વેલ્સનું બાવલું હોંગકોંગમાં ૧૯૦૯ ના નવેમબર માસમાં ભેટ કીધું હતું. તેમજ એવો સાહેબે ચીનમાં નાતજાતના તફાવત વગર લખો રૂપયાની સખાવત કીધી છે જેમાં હોંગકોંગમાં એવણુની સઉથી મોટી સખાવતોમાં હોંગકોંગ યુનીવરસીટી અને સેલરસ હોમ છે. એ યુનીવરસીટી બાંધવા માટે લગભગ ૩ લાખ ડાલર સર હોરમજીએ આપ્યા હતા. આ યુનીવરસીટીની બીલડીંગનો પાયો નાખવાની ક્રીયા તા૦ ૧૬ મી મારચ ૧૯૧૦ ને દીને હોંગકોંગના નામદાર ગવરનર સર ફરેડરીક લુગાડે કીધી હતી. એ વખતે નામદાર ગવરનરે જાહેર કીધું હતું કે નામદાર શેહેનશાહ સાતમાં એડવરડે યુનીવરસીટી તરફ પોતાની પસંદગી દેખાડી એ નામદારે એજ દીને તારનો સંદેશો મોકલીને શેઠ મોદીને સર નાઈટનો નામીચો ખેતાબ એનાયત કીધો છે. સર હોરમજી મોદી જેવોનો જનમ રોજ ૧૩ મો માહા ૧ લો શેહેનસાહી સને

૧૨૦૮ ય૦, તા૦ ૧૨ મી અકટોબર સને ૧૮૩૮ ઇસવીને વાર સુક્રને દીને થયો હતો. એવો સાહેબ ૭૨ વરસની ઉમરે રોજ ૭ મો માહ ૧૦ મો સને ૧૨૮૦ યઝદેજરદી, તા૦ ૧૬ મી જુન ૧૯૧૧ ને શુક્રવારે બેહસતનશીન થયા હતા.

મુંબઇના જાણીતા શેહેરી તથા મોટા શેર દલાલ શેઠ શાપુરજી બરજોરજી ભરૂચાની ઓહલી સખાવતો અને ગરીબોના એક બેરખા તરીકે એવો શેઠે આપેલી કીમતી મદદ તેમજ સરકારના આબરૂ ઇજત પામેલા સાચ્ચા સલાહકાર અને પ્રજામાં તથા વેપારી વરગોમાં પ્રખ્યાત નાણા શાસ્ત્રી તરીકે એવણે સારી કીરતી મેળવી હતી. શેઠ શાપુરજીને સને ૧૯૧૧ ના સાલના મુંબઇના માનવંત શેરીફ્ફ્ની નેમયા પછી એવો શેઠને સર નાઇટનો નામીચો ખેતાબ નામદાર શેહેનશાહ જયોરજ પાંચમાંની તા૦ ૧૨ મી ડીસેમબર સને ૧૯૧૧ યાને રોજ ૧ લો માહ ૪ થો સને ૧૨૮૧ યઝદેજરદીને દીને દીલ્હી ખાતે થયલી યાદગાર રાજ્યભીશેક યાને કોરોનેશનની ક્રીયા વખતે ભરાયલી દરબારમાં નામદાર શેહેનશાહ જ્યોરજ પાંચમાં તરફથી બક્ષવામાં આવ્યો હતો.

મુંબઇની હાઇ કોરટના માનવંત માજી જડજ શેઠ દીનશાહ ધનજીભાઇ દાવરની કાબેલ્યત તથા એક ફતેહમંદ જડજ તરીકેની તેમની ઝળકતી કારકીરદી જાણીતી છે. એવો સાહેબે પારસી કોમને લગતા અગતના સવાલોમાં ભાગ લઇ કીમતી સલાહ આપવા ઉપરાંત પોતાના ઓધાની ફરજ નામદાર સરકાર અને પ્રજાના સંતોષ વચ્ચે બજાવી હતી. એવો શેઠને સર નાઇટનો નામીચો ખેતાબ નામદાર શેહેનશાહ જ્યોરજ પાંચમાંની તા૦ ૧૨ મી ડીસેમબર સને ૧૯૧૧ યાને રોજ ૧ લો માહ ૪થો સને ૧૨૮૧ યઝદેજરદીને દીને દીલ્હી ખાતે થએલી યાદગાર રાજ્યભીષેક યાને કોરોનેશનની ક્રીયા વખતે ભરાયલી દરબારમાં નામદાર શેહેનશાહ જ્યોરજ પાંચમાં તરફથી બક્ષવામાં આવ્યો હતો. એવો સાહેબ ૬૦ વરસની ઉમરે રોજ ૨૨ મો માહ ૧૧ મો શેહેનશાહી સને ૧૨૮૫ ય૦, તા૦ ૨૯ મી જુલાઇ ૧૯૧૬ ને સનીવારે બેહેસતનશીન થયા હતા.

નાગપુરવાલા ખા૦ બા૦ બેજનજી દાદાભાઇ મેહેતાએ નાગપોર, બીરાર અને મધ્ય પ્રાંતોમાં મીલ ઉદ્યોગ તથા હુનરની ખીળવણીના જાહેર કામોમાં આગેવાન ભાગ ભજવી તેમજ દુકાળ તથા મરકીના વખતમાં સરકારની તથા જાહેર પ્રજાની સેવા બજાવી હતી. એવો શેઠને સર નાઇટનો નામીચો ખેતાબ નામદાર શેહેનશાહ જ્યોરજ પાંચમાંની તા૦ ૧૨ મી ડીસેમબર સને ૧૯૧૧ યાને રોજ ૧ લો માહ ૪થો સને ૧૨૮૧ યઝદેજરદીને દીને દીલ્હી ખાતે થયલી યાદગાર રાજ્યભીષેક યાને કોરોનેશનની ક્રીયા વખતે ભરાયલી દરબારમાં નામદાર શેહેનશાહ જ્યોરજ પાંચમાં તરફથી બક્ષવામાં આવ્યો હતો.

મુંબઇના જાણીતા શેહેરી અને કોટના પારસી સુવાવડખાનાના વડા તબીબ ડા૦ ટેમુલજી ભીખાજી નરીમાનને નામદાર સરકારની તેમજ જાહેર પ્રજાની બજાવેલી કીમતી સેવાની પીછાનમાં તા૦ ૧ લી જાનેવારી ૧૯૧૪ ઇસવીને દીને યાને આપણી રાજકરતી કોમના નવા વરસની ખુશાલીમાં સર નાઇટનો નામીચો ખેતાબ નામદાર સરકાર તરફથી એનાયત કરવામાં આવ્યો હતો. તા૦ ૨૦ મી જુન ૧૯૧૪ ને દીને પુણા ખાતે ભરાયલી લેવીના મેલાવડામાં નામદાર ગવરનર લોરડ વીલીંગડને ડા૦ ટેમુલજીને સર નાઇટના ખેતાબની સનદ એનાયત કીધી હતી.

દખન હેદરાબાદના જાણીતા શેહેરી શેઠ ફરદુનજી જમશેદજી વાચ્છા સી. એસ. આઇ., સી. આઇ. ઇ. એવણુને નામદાર નીઝામ સરકાર તરફથી નવાબનો ખેતાબ મળવાથી "નવાબ ફરેદુન

જંગ બાહાદુર" ને નામે ઓળખાય છે અને એવણુ નામદાર નીઝામ સરકારના પોલીટીકલ સેક્રેટરી અને હૈદરાબાદના વડા વઝીરના ખાનગી સેક્રેટરીનો મોટો માનવંત ઓહ્દો ભોગવે છે. એવણુને નામદાર બ્રીટીશ સરકાર તરફથી નામદાર શેહેનશાહ જ્યોરજ પાંચમાંની તા૦ ૩ જી જુન ૧૯૧૫ને દીને પહેલી ૫૧ માં વરસની સાલગ્રેહની ખુશાલીમાં કે. સી. આઈ. ઇ. યાને "નાઇટ કમાંડર ઓફ ધી ઇંડીયન એમપાયરનો" નામીચો ખેતાબ એનાયત કરવામા આવ્યો હતો.

મુંબઈના જાણીતા સખી શેઠયા અને વેપારી શેઠ રતનજી જમશેદજી તાતા જેવણુ એક સાહસીક વેપારી હતા અને પોતાની ઓહોલી સખાવત માટે મશહુર હતા. એવણુને નામદાર શેહેનશાહ જ્યોરજ પાંચમાંની તા૦ ૩ જી જુન ૧૯૧૬ ને દીને પડેલી ૫૨ મા વરસની સાલગ્રેહની ખુશાલીમાં સર નાઇટનો નામીચો ખેતાબ એનાયત કરવામાં આવ્યો હતો. એવો સાહેબ ૪૭ વરસની ઉમરે રોજ ૩૦ મો માહા ૧૨ મો શેહેનશાહી સને ૧૨૮૭ યઝદેજરદી, તા૦ ૫ મી સપટેમબર ૧૯૧૮ ને ગુરૂવારે લંડન ખાતે બેહેશતનશીન થયા હતા.

અમદાવાદના જાણીતા શેહેરી ખાનબાહાદુર નવરોજી પેસતનજી વકીલ સી. આઈ. ઇ. એ કરેલી મોટી સખાવતો અને સરકાર તેમજ પ્રજાની બજાવેલી અમુલ્ય સેવાઓની પીછાનમાં તા૦ ૧૨ મી ફેબ્રુઅરવારી ૧૯૧૭ ને દીને નામદાર બ્રિટીશ સરકાર તરફથી એવો શેઠને સર નાઇટનો નામીચો ખેતાબ એનાયત કરવામાં આવ્યો હતો અને એની સનદ તા૦ ૨૯ મી જુન ૧૯૧૭ને દીને આપવામાં આવી હતી.

મુંબઈના જાણીતા શેહેરી ઓનરેબલ શેઠ દીનશાહ એદલજી વાચ્છા જેવણુની કાબેલીયત અંતઃકરણપુરવક કામ બજાવવાની મનોવૃતી તેમજ પ્રજા તથા નામદાર સરકારની સેવા બજાવવાની ઉલ્ટ જાણીતી છે. એવણુને નામદાર શેહેનશાહ જ્યોરજ પાંચમાંની તા૦ ૪ ઠી જુન ૧૯૧૭ને દીને પડેલી ૫૩માં વરસની સાલગ્રેહની ખુશાલીમાં સર નાઇટનો નામીચો ખેતાબ એનાયત કરવામાં આવ્યો હતો. વળી એવો શેઠને ૧૯૧૬ મા નામદાર ગવરનરની કાઉનસીલના મેમબર નેમ્યા હતા અને એજ શાલમાં મુંબઈની ધારા સભાના મેમબરોએ એવણુને નામદાર વાઇસરાયની કલકતાની ધારા સભાના મુંબઇના પ્રતીનીધી તરીકે ચુંટી કાઢી માન આપ્યું હતું.

મુંબઈના જાણીતા શ્રીમંત શેઠયા શેઠ હોરમજી અરદેશર વાહાડયા બેરીસટરે કરેલી ઓહોલી સખાવતો તેમજ દેશહીતકારી નર તરીકે પ્રજાની બજાવેલી અછી સેવાઓ માટે એવણુને નામદાર શેહેનશાહ જ્યોરજ પાંચમાંની તા૦ ૩ જી જુન ૧૯૧૮ને દીને પડેલી ૫૪ મી સાલગરેની ખુશાલીમાં સર નાઇટનો નામીચો ખેતાબ એનાયત કરવામાં આવ્યો હતો.

સી. એસ. આઇ. યાને કમ્પેનીઅન ઓફ ધી સ્ટાર ઓફ ઇંડીઆ.

સર કાવસજી જહાંગીરજી રેડીમની—(મરહુમ)૧૮૬૯.
સર જમશેદજી જીજીભાઇ બીજા બારોનેટ—(મરહુમ)૧૮૭૧.
બેરામજી જીજીભાઇ—(મરહુમ)૧૮૭૬.
ડોસાભાઈ ફ્રામજી કરાકા—(મરહુમ)૧૮૭૭.
સર જમશેદજી જીજીભાઇ ત્રીજા બારોનેટ—(મરહુમ)૧૮૮૪.
નવાબ સર ફ્રેદુન જંગબાહાદુર—૧૯૧૧.
કરનલ હોરમસજી એદલજી બનાતવાલા—આશામવાલા—૧૯૧૭.

સી. આઇ. ઈ. યાને કમ્પેનીઅન ઓફ ધી ઇંડીયન એમપાયર.

દસ્તુર બમનજી જામાસ્પજી પુણેવાલા—બીરારના માજી આ૦ કમીશનર—(મરહુમ)૧૮૭૯.
સોરાબજી શાપુરજી બંગાલી—(મરહુમ)૧૮૮૧.
પેસ્તનજી જાંહગીર તાલીયારખાન—(મરહુમ)૧૮૮૩.
નવરોજી ફ્રરદુનજી—(મરહુમ) ૧૮૮૪.
સર મનચેરજી મેરવાનજી ભાવનગરી—૧૮૮૬.
પેશતનજી હોરમજી કામાજી—(મરહુમ) ૧૮૮૭.
મેહેરજી કુંવરજી તારાપોરવાલા—કોલાપોરના માજી દીવાન—(મરહુમ) ૧૮૮૮.
નવરોજી નશરવાનજી વાહાડીયા—(મરહુમ) ૧૮૮૯.
મનચેરજી કાવસજી મરઝબાન—(મરહુમ) ૧૮૯૧.
નવરોજી માણેકજી વાહાડીયા—(મરહુમ) ૧૮૯૩.
સર પીરોજશાહ મેહેરવાનજી મેહેતા—(મરહુમ) ૧૮૯૪.
કાવસજી દીનશાહ એડનવાલા—(મરહુમ) ૧૮૯૪.
સર નવરોજી પેસતનજી વકીલ—અમદાવાદવાલા—૧૮૯૭.
રૂસતમજી ધનજીભાઇ મેહેતા—કલકતાવાલા—૧૮૯૭.
મનચેરજી રૂસતમજી ઘેલું—એડનના માજી રેજીસ્ત્રાર—(મરહુમ) ૧૮૯૭.
ખરશેદજી રૂસતમજી થાણેવાલા—રતલામના દીવાન—(મરહુમ) ૧૮૯૯.
નવાબ ધનજીભાઇ ફકીરજી કામાદીર—રાવલપીંડીવાલા—(મરહુમ) ૧૮૯૯;
એદલજી દીનશાહ—કરાંચીવાલા—(મરહુમ) ૧૮૯૯.
ફ્રરદુનજી કુંવરજી તારાપોરવાલા—અમદાવાદના માજી એકઝીકયુટીવ એનજીનીયર–૧૯૦૧
હીરજીભાઇ માણેકજી રૂસતમજી બનાજી—કલકતાના માજી શેરીફ—(મરહુમ) ૧૯૦૩
નવાબ સર ફ્રેદુન જંગ બાહાદુર—૧૯૦૩
બરજોરજી દોરાબજી પટેલ—કવેતાવાલા—૧૯૦૪
સરદાર શમશુલ ઓલમા દસ્તુર હોશંગજી જા. જામાસ્પઆશાના–પુણાવાલા–(મરહુમ) ૧૯૦૬
માણેકશાહ બેરાંમજી દાદાભાઇ રેજીસ્ત્રાર—નાગપુરવાલા—૧૯૧૧
લેફ્ટનંટ કરનલ એદલજી પાલનજી ફ્રેંચમેન—(મરહુમ)૧૯૧૧.
સરદાર નવરોજી પદમજી–પુણાવાલા—૧૯૧૧.
સમસુલ ઓલમા ડા૦ જીવણજી જમશેદજી મોદી—૧૯૧૭.
નશરવાનજી નવરોજી વાહાડીયા—૧૯૧૮.
ખરશેદજી નવરોજી વાહાડીયા—૧૯૧૯.

નામદાર બ્રીટીશ સરકાર તરફથી જરથોસ્તીઓને મલેલા ખેતાબો.

એમ. વી. ઓ. યાને મેમ્બર ઓફ ધી રોયલ વીકટોરીયન ઓરડર.

હોરમજી કાવશજી દીનશાહ એદનવાલા—૧૯૧૧.

ઓ. બી. ઇ. યાને ઓફીસરસ ઓફ ધી ઓરડર ઓફ ધી બ્રીટીશ એમપાયર.

જમશેદજી ફરામજી માદન—કલકતાવાલા—૧૯૧૮
જાહાંગીર હોરમજી કોઠારી—કરાંચીવાલા—૧૯૧૮
હોરમજી કાવશજી દીનશાહ એદનવાલા—૧૯૧૮
જરબાનું માણેકશા બેરામજી દાદાભાઇ—નાગપોરવાલા—૧૯૧૮
કાવશજી જાહાંગીર રેડીમની—૧૯૧૮.
ફીરોઝ ખરશેદજી શેઠના—૧૯૧૮.
અરદેશર ડોશાભાઇ મારકર—કવેતાવાળા—૧૯૧૯.

એમ. બી. ઇ. યાને મેમબરસ ઓફ ધી ઓરડર ઓફ ધી બ્રીટીશ એમપાયર.

મીસીસ શીરીન કાવસજી—બરમાવાલા—૧૯૧૮
પેસતનજી નશરવાનજી વકીલ—અમદાવાદવાલા—૧૯૧૮
જમશેદજી દીનશાહ આંટીયા—વડોદરાવાલા—૧૯૧૮
ડોકટર રતનજી કોઠાવાલા—૧૯૧૯.
શાપુરજી બમનજી બીલીમોરીયા—૧૯૧૯.
દીનશાહ એદલજી માલ્વા—૧૯૧૯.
દારાશાહ નશરવાનજી મારકર—૧૯૧૯.
અરદેશર ડોશાભાઇ વાહાડયા—૧૯૧૯.
સુનાબાઇ કેકોબાદ દસ્તુર—પુણાવાલા—૧૯૧૯
હીરાબાઇ લાલકાકા—૧૯૧૯.
હોમાય મેહતા—બંગાલવાલા—૧૯૧૯.
હીરાબાઇ પદમજી—પુણાવાલા—૧૯૧૯.
બીખાઇજી અરદેશર એનજીનીયર—૧૯૧૯.

આઇ. એસ. ઓ. યાને ઇમપીરીયલ સરવીશ ઓરડર.

જેહાંગીર ડોશાભાઇ ફરામજી કરાકા—૧૯૧૧. [૧૯૧૬
મનચેરશા ફરામજી ઉનવાલા, બંગાલની સરકારના નાણાંખાતાંના માજી રેજીસ્ટ્રાર-(મરહુમ)
બમનજી નવરોજી ખંબાતા, પુણાવાલા—૧૯૧૫.
રૂશતમજી બી. વકીલ—૧૯૧૬

ઇમપીરીયલ સરવીસ ઓરડર-બી.

ગોદરેજ દોરાબજી પદમજી—૧૯૧૨

રોયલ વીકટોરીયન ઓરડર.

કાવસજી જમશેદજી પેટીગરા—૧૯૧૧

નામદાર બ્રીટીશ સરકાર તરફથી મલેલો "નવાબ"નો ખેતાબ.

ધનજીભાઇ ફકીરજી કામાદોર, રાવલપીંડીવાલા—(મરહુમ)-૧૯૧૦

ઓરડર ઓફ સેંટ જોનના ડોનાતનો રૂપાંનો ચાંદ.

ધનજીભાઇ હોરમજી મેહતા—૧૯૧૭

આરડર ઓફ સેંટ જોનનો ખેતાબ.

ધનજીભાઇ એદ. મુલ્લાફીરોજ—૧૯૧૪

ડી. એસ. ઓ. યાને કમપેનયન ઓફ ધી ડીસટીંગવીશડ સરવીસ ઓરડર.

(લડાઇમાં બહાદુરીભરી સેવા બજાવવા માટે)
કેપટન ફીરોઝશાહ બેરામજી ભરૂચા—૧૯૧૭.
કેપટન એચ. જે. ખરશેદજી—૧૯૧૯.

બ્રીટીશ મીલીટરી ક્રોસનો ચાંદ મેલવનારાઓ.

(લડાઈમાં બહાદુરીભરી સેવા બજાવવા માટે)

લેફટનંટ એરચ રતનજી ફરામજી દાણુ—૧૯૧૭.

લેફટનંટ રતનશાહ નરીમાન કાપડયા—૧૯૧૯.

લેફટનંટ બી. એચ. કામાકાકા—૧૯૧૯.

લેફટનંટ કે. એ. માસતર—૧૯૧૮.

કયસરે હિંદનો સોનાનો ચાંદ મેલવનારાઓ.

બેરામજી મેરવાનજી મલબારી—(મરહુમ) ૧૯૦૦
નવાબ ધનજીભાઇ ફકીરજી કામાદીર, રાવલપીંડીવાલા—(મરહુમ) ૧૯૦૧.
મેરવાનજી કાવસજી કેપટન—રંગુનવાલા—(મરહુમ) ૧૯૦૩
એદલજી દોરાબજી તલાતી—૧૯૦૪
સર તેમુલજી ભીખાજી નરીમાન—૧૯૦૯
અરદેશર દીનશાજી ચીનાઇ—મધ્ય પ્રાંતવાલા—૧૯૧૧
જાહાંગીર હોરમજી કોઠારી—કરાંચીવાલા—૧૯૧૧
સર હોરમજી અરદેશર વાહડયા, બેરીસ્ટર—૧૯૧૭.
ડી. સી. પેસતનજી—મઊવાલા—૧૯૧૯.

કયસરે હીંદનો રૂપાંનો ચાંદ મેલવનારાઓ.

લેપ્ટનંટ કરનલ કેખશરૂ સોરાબજી નરીમાન-સુરતના માજી સીવીલ સરજન-(મ) ૧૯૦૦
ડોશાભાઇ અરદેશર ચોકશી—બેંગલોરના મરકી ખાતાંના માજી વડા તબીબ અમલદાર—(મરહુમ) ૧૯૦૦.
ફરદુનજી કુવરજી તારાપોરવાલા-અમદાવાદના માજી એકજીક્યુતીવ એનજીનીઅર—૧૯૦૦
બહમનજી મનચેરજી એદલબેહરામ—(મરહુમ) ૧૯૦૦
બરજોરજી દોરાબજી પટેલ—કવેતાવાલા—૧૯૦૧.
રૂસતમજી ફરદુનજી—આંકોલાના ડેપ્યુટી કમીશનર—૧૯૦૧.
માણેકજી ખરશેદજી નરીમાન—મુંબઇની સેક્રેટરીયટના મદદનીસ સેક્રેટરી—૧૯૦૨
નાદીરશાહ નવરોજી ખગુરી—પંજાબની કાંગ્રાવેલીવાલા—૧૯૦૬.
ડા૦ મોટીબાઇ રૂસતમજી કાપડયા—અમદાવાદવાળા—૧૯૧૧.
આર. એન. માદન—મુંબઇના જંગલખાતાના અમલદાર—૧૯૧૩.
એમ. સી. તાલીઆરખાન—મુંબઇની મ્યુનીસીપાલીટીના ડેપ્યુટી એકાઉન્ટંટ—૧૯૧૩.
જાઇજી જાહાંગીરજી બમનજી પીટીટ—૧૯૧૫
રૂસતમજી પેસતનજી મસાની—મુંબઇ મ્યુનીસીપાલીટીના સેક્રેટરી—૧૯૧૬.
જે. એમ. આંટીયા—૧૯૧૬.
મીસીસ એચ. આર. ફરદુનજી, તે સેંટ્રલ પ્રોવીનસીસના ડેપ્યુટી કમીશનર રૂસતમજી ફરદુનજીના ધણીયાણી—૧૯૧૬.
જરબાઇ માણેકજી બેરાંમજી દાદાભાઇ—નાગપોરવાલા—૧૯૧૭.
ડોશાભાઇ પેસતનજી કુપર—૧૯૧૯.
મીસીસ હોરમજી માણેકજી વજીફદાર—૧૯૧૯.

કીંગસ પોલીસ મેડલ મેલવનારાઓ.

રતનજી રૂશતમજી મીરઝા—૧૯૧૪.
હોકટર રતનજી કોહાવાળા—૧૯૧૫

શમશુલ ઓલમાઓ.

દસ્તુર પેશોતનજી બેહેરામજી સંજાણા—(મરહુમ) ૧૮૮૯.
દસ્તુર હોશંગજી જામાસ્પજી જામાસપઆશાના—(મરહુમ) ૧૮૯૦.
એરવદ ડા૦ જીવણજી જમશેદજી મોદી—૧૮૯૩.
દસ્તુર દારાબ પેશોતનજી સંજાણા—૧૮૯૯.
સરદાર દસ્તુર કેકોબાદ આદરબાદ નોશેરવાન—પુણાવાલા, ૧૯૧૧.

જુદા જુદા રાજ્યો તરફથી જરથોસ્તીઓને મલેલા ખેતાબ.

નાઇટ ઓફ ધી ઓરડર ઓફ ટોરીશ એન્ડ એશપાડા.

(પોરચુગલ સરકાર તરફથી.)
રૂસતમજી જમશેદજી જીજીભાઇ-(મરહુમ) ૧૮૬૪.

ધી કમાનડર ઓફ ધી રોયલ મીલીટરી ઓરડર ઓફ આવર લેડી ઓફ કનસેપશન ઓફ વીલા વીકોઝા.

(પોરચુગલ સરકાર તરફથી.)
દોરાબજી દીનશાહ એડનવાલા—(મરહુમ) ૧૮૯૨.
હોરમજી કાવસજી એડનવાલા—૧૮૯૨.

ધી નાઇટ ઓફ ધી મીલીટરી ઓરડર ઓફ આવર લેડી ઓફ કનશેપશન ઓફ વીલા વીકોઝા.

(પોરચુગલ સરકાર તરફથી.)
સોરાબજી માણેકજી દમણવાલા—(મરહુમ) ૧૮૯૮.

શીવેલીઅર ડી આનામ નામનો ફરેંચ નાઇટનો ખેતાબ.

(ફરેંચ સરકાર તરફથી.)
સર હોરમજી નવરોજી મોદી—ચીનના વેપારી—(મરહુમ) ૧૮૯૨.

સવાલીએ ડ લોરડ રવાયાલ ડ કામેબાજ નામનો ફરેંચ નાઇટનો ખેતાબ.

(ફરેંચ સરકાર તરફથી.)
જમશેદજી સોરાબજી શેઠના—૧૮૯૮.

ઓફીસીએ ડ લે અકશીઓ પયુબલીકનો ખેતાબ.

(ફરેંચ સરકાર તરફથી.)
જમશેદજી સોરાબજી શેઠના—૧૯૧૮.

ફરેંચ વોર કરોસનો ચાંદ.

લેફટનંટ રતનશાહ નરીમાન કાપડયા—૧૯૧૮.

ઓફીસર ડી એકેડમીનો ફરેંચ સરકારનો ખેતાબ (ડીપલોમાં)

મસુલ ઓલમા ડા૦ જીવણજી જમશેદજી મોદી
રજખાન મનચેરજી કાવસજી મરજખાન.
મશેદજી સોરાબજી શેઠના.
હાંગીર નવરોજી શોપકીપર.
ખરશેદજી માણેકજી સરાફ.
એરચજી રૂસતમજી શંહીયાર.
મેરવાનજી રતનશાહ પારખ

કેવેલીયર ઓફ ધી ઓરડર ઓફ ધી ક્રાઉન ઓફ ઇટાલી.

(ઇટાલીની સરકાર તરફથી)
નશરવાનજી હોરમજી ચોકસી—૧૮૯૯.

સેકરેટ ત્રેજર તથા કીનકેસોનો ખેતાબ.

(જેપાનની સરકાર તરફથી)
જમશેદજી નશરવાનજી તાતા—(મરહુમ)
રતનજી દાદાભાઇ તાતા.

શીરો ખુરશેદ યાને સીંહ અને ખોરશેદ નામનો ફારસી ખેતાબ.

(ઇરાનના નામદાર શાહ તરફથી)

સર દીનશાહજી માણેકજી પીટીટ, પેહલા બારોનેટ—(મરહુમ)

સર મનચેરજી મેરવાનજી ભાવનગરી—૧૯૦૦

ઓરડર ઓફ ધી બ્રીલયંટ સ્ટાર ઓફ જંજીબાર અથવા હામોડીઆનો ખેતાબ.

(જંગબારના નામદાર સુલતાન તરફથી.)

બમનજી માણેકજી દારૂખાનાવાલા–જંગબારના જાહેર બાંધકામખાતાના માજી ડીરેકટર—૧૮૮૧

ખરશેદજી કાવસજી રેજીસ્ટ્રાર—૧૮૯૧.

પેસતનજી ભીખાજી નરીમાન—જંગબારના માજી સરકારી તબીબ—૧૮૯૨.

સોરાબજી માણેકજી દારૂખાનાવાલા—શેનીતરી ખાતાના માજી ઉપરી તથા સુપરીનટેનડીંગ એનજીનીઅર—૧૮૯૨

સઈયદીયાનો ખેતાબ.

(જંગબારના નામદાર સુલતાન તરફથી.)

પેસતનજી ભીખાજી નરીમાન—૧૯૦૫.

નવાબ બાહાદુરનો ખેતાબ.

(નામદાર નીઝામ સરકાર તરફથી)

ફરામજી જમશેદજી મુનશીને નવાબ ફરામરઝ જંગ બાહાદુર—(મરહુમ) ૧૮૯૦.

વડા વજીરના ખાનગી સેક્રેટરી તેમજ પોલીટીકલ સેક્રેટરી સર ફરદુનજી જમશેદજી વાચ્છાને નવાબ ફરેદુન જંગ બાહાદુર—૧૯૦૬.

ઇનદુર ડીસટ્રીકટના અવલ તાલુકદાર બરજોરજી જમશેદજી વાચ્છાને નવાબ બરજોર જંગ બાહાદુર—૧૯૦૬.

મેદક ડીસટ્રીકટના અવલ તાલુકદાર સોરાબજી જમશેદજી ચીનાઇને નવાબ સોરાબ જંગ બાહાદુર—૧૯૦૬.

હોરમજી નશરવાનજી વકીલ સોલીસીટરને નવાબ હોરમઝ જંગ બાહાદુર—૧૯૧૮.

દવલાનો ખેતાબ.

(નામદાર નીઝામ સરકાર તરફથી)

નવાબ સર ફરેદુન જંગ બાહાદુર—૧૯૧૭

તાઝીમી સરદારનો ખેતાબ.

(બીકાનેરના નામદાર માહારાજા તરફથી)

આર. ડી. કુપર— માહારાજાના પ્રાઇવેટ સેક્રેટરી—૧૯૦૬.

તાઝીમી સરદારનો ખેતાબ.

(પતીયાલાના નામદાર માહારાજા તરફથી.)

કરનલ કેકી મીસતરી—૧૯૧૮.

તાઝીમી સરદારનો ખેતાબ.

(જામનગરના નામદાર માહારાજા તરફથી.)

મેરવાનજી પેસતનજી—જામનગરના દીવાન—૧૯૧૮.

એન. કે. કલ્યાણીવાળા—૧૯૧૮.

ફરસ્ત કલાસ ઓરડર ઓફ મેરીટનો ખેતાબ.

(જામનગરના નામદાર માહારાજા તરફથી)
મેરવાનજી પેસતનજી—જામનગરના દીવાન—૧૯૧૨.

દાતાર મંડળનો સોનાનો ચાંદ.

(વડોદરાના નામદાર માહારાજા ગાયકવાડ સરકાર તરફથી)
રતનજી દાદાભાઇ તાતા—૧૯૦૭.
રતનબાઇ એદલજી બામજી—૧૯૧૦.
બેહરામજી નશરવાનજી શીરવાઇ—૧૯૧૪.
પેશતનજી રતનજી ડાબુ—૧૯૧૫.
મેહેરવાનજી નાનાભાઇ મેહેતા—૧૯૧૬.
રતનજી શાપુરજી ટાટા—૧૯૧૮.

રાજ રતન મંડળનો સોનાનો ચાંદ.

(વડોદરાના નામદાર માહારાજા ગાયકવાડ સરકાર તરફથી.)
ધનજીભાઇ હોરમજી મેહતા—૧૯૧૬.
એ. એમ. મસાણી—૧૯૧૯.

રાજ રતન મંડળનો બરોંઝનો ચાંદ.

(વડોદરાના નામદાર માહારાજા ગાયકવાડ સરકાર તરફથી.)
શાપુરજી બેજનજી લાકડાંવાલા—૧૯૧૬.

"ખાન બાહાદુર"નો ખેતાબ મલેલા જરથોસ્તીઓ.

અરદેશર કાવશજી-(માઉંટ આબુ)
અરદેશર કાવશજી ટરનર
અરદેશર ડોસાભાઈ મારકર-(કવેતા)
અરદેશર દીનશાહ ચીનાઈ
અરદેશર દોરાબજી, રજપુતાનાની સુપરીનટેનડીંગ એનજીનીઅરીંગ હારીસવાલા
અરદેશર દોરાબજી દલીયરવાલા-(દેહનુ ઉમરગામ)
અરદેશર નવરોજી-(બેલગામ)
આદરજી મનચેરજી દલાલ-(ભરૂચ)
એરચજી શેહેરીયારજી ભરૂચા-(પુણા)
એદલજી ભીખાજી કુમાના
કાવશજી જમશેદજી પેટીગરા
કાવસજી જમશેદજી લાલકાકા
કાવસજી હોરમજી કાતરક-(કરાંચી)
કેખશરૂ મનચેરજી કલબવાલા
ખરશેદજી નશરવાનજી કંત્રાકટર
ગુસતાદજી ધનજીશાહ કાપડયા
જમશેદજી અરદેશર દલાલ
જમશેદજી એદલજી બાટલીવાલા-(મદરાસ)
જમશેદજી બમનજી વકીલ-(અલીબાગ)
જમશેદજી બેજનજી વાચ્છા
જાહાંગીર ખરશેદજી કામા-(વરધા)
જાહાંગીર ખરશેદજી દાજી
જાહાંગીર એદલજી મોદી-(સુરત)
ટેમુલજી કાવસજી બજા-(મુરવાડા મારવાડ)
ટેમુરસ નવરોજી સંજાના
ડોશાભાઇ પેસતનજી-(સુરત)
દાદાભાઇ દીનશાહ-(ખેડા)
દાદાભાઇ નશરવાનજી નાણાવટી
દારાશાહ નવરોજી મોદી-(રજપુતાના)
દાદાભાઇ રતનજી વલસાડા (કારવાર)
દીનશાહ દોશાભાઇ ખંબાતા
દીનશાહ માણેકજી કાલાપેસી
દોરાબજી સોરાબજી કેપટન
નવરોજી કાવસજી કલીયાણીવાલા
સર નવરોજી પેસતનજી વકીલ-(અમદાવાદ)
નશરવાનજી જાહાંગીર બોગા-(રાવલપીંડી)
નશરવાનજી રૂસતમજી મેહતા-(કરાંચી)
નશરવાનજી રૂશતમજી વાચ્છા (અમદાવાદ)
નશરવાનજી શેહેરીઆરજી જીનવાલા-(ભરૂચ)
નશરવાનજી હોરમસજી ચોકસી
નાનાભાઈ કુંવરજી મોદી
પાલનજી નવરોજી દાવર
પાલનજી હોરમજી દાદાચાનજી
પાલનજી આદરજી મીસતરી-(કરાંચી)
પેસતનજી દીનશાહ દસ્તુર-(કરાંચી)
પેસતનજી રૂસતમજી મહેતા
ફરદુનજી મનચેરજી દસ્તુર
ફરામજી અરદેશર અહમદનગરવાલા
ફરામજી કાવશજી-આબકારી ઇનશપેકટર
ફરામજી દીનશા કામદીન
ફરામરોજ અરદેશર ફરામજી મુસ
ફરામજી નશરવાનજી સંતોક-(માઉન્ટ આબુ)
ફીરોઝશાહ એદલજી ધામટ
બરજોરજી કાવશજી લીચમોર
બરજોરજી દોરાબજી પટેલ-(કવેતા)
બરજોરજી નશરવાનજી વકીલ-(સુરત)
બરજોરજી સોરાબશાહ મુનશફ
બમનજી દોરાબજી પટેલ
સર બેજનજી દાદાભાઇ-(નાગપોર)
બેજનજી મેરવાનજી-(રાજકોટ)
બેરામજી દોરાબજી બનાજી
બેરામજી પેસતનજી-(નાગપોર)
બેરામજી હોરમજી નાણાવટી
બી. કે. અંકલેસરીયા
માણેકજી ખરસેદજી નરીમાન
માણેકજી નાનાભાઇ-(ડીસા)
માણેકજી પાલનજી પોહ-(સુરત)
માણેકજી મેરવાનજી મુલ્લાં (બાલાઘાટ)
માણેકશાહ રતનજી દસ્તુર-(ભંડારા)
મેરવાનજી પેશતનજી-જામનગરના દીવાન
મેહેર હોશંગ દસ્તુર-(પુણા)
રતનજી બેજનજી કેમીશરીએટવાલા
રૂશતમજી જમશેદજી કાપડયા
રૂશતમજી જમશેદજી પેટીગરા
રૂશતમજી જાહાંગીરજી વકીલ-(અમદાવાદ)
રૂશતમજી દોરાબજી કુપર-(બીકાનેર)
રૂશતમજી બમનશાહ વકીલ
શાપુરજી માણેકજી મેહતા-(દખન હેદરાબાદ)
શાપુરજી એદલજી ચીનાઇ
સોરાબજી શાપુરજી-(આકોલા)
સોરાબશાહ હોરમજી-(ભરૂચ)
હોરમસજી આદરજી પટેલ
હોરમસજી ખરશેદજી ભાભા
હોરમસજી માણેકજી બીમડીવાલા

જરથોસ્તી "જસ્તીસ ઓફ ધી પીસ" યાને સુલેહના અમલદારો.

અરદેશર કાવશજી ટરનર
અરદેશર જમશેદજી બીલીમોરીયા
અરદેશર દાદાભાઇ મોદી
અરદેશર પેશતનજી કામા
અરદેશર ફરામજી વકીલ
ઉકરજી કાવસજી ઉમરીગર
એદલજી જમશેદજી ઉનવાલા
એદલજી માણેકજી મોદી
કાવસજી એદલજી દાદાચાનજી
કાવસજી જાલભાઇ શેઠ
સર કાવસજી જેહાંગીર રેડીમની બારોનેટ
કાવશજી જાહાંગીર (જુનીઅર)
કાવસજી દાદાભાઇ દુબાશ
કાવસજી પેસતનજી ડાકટર
કાવશજી બેજનજી શેઠના
કાવશજી હોરમજી ડાકટર
કેખશરૂ ડોશાભાઇ કુપર
કેખશરૂ માણેકજી બરજોરજી મીનોચેર હોમજી
લેફટનંટ કરનલ કે. એ. દલાલ
લેફટનંટ કરનલ કે. એચ. મીસતરી
ખરશેદજી નવરોજી વાહડયા
ખરશેદજી માણેકજી ખરશેદજી
જમશેદજી અરદેશર હો. વાહડયા
સર જમશેદજી જીજીભાઇ પાંચમા બારોનેટ
જમશેદજી જીવણજી ગજદર
જમશેદજી નશરવાનજી ડગન
જમશેદજી નશરવાનજી બાહાદુરજી
*જમશેદજી પી. મીસતરી
જાહાંગીર ડોસાભાઇ ફરામજી
જાહાંગીર બમનજી પીટીટ
જાહાંગીર બેરામજી મરઝબાન
*જાહાંગીરજી ભીખાજી
જાહાંગીર રતનજી દુબાશ
જાહાંગીર રૂસતમજી પટેલ
*જાહાંગીર હોરમજી સોરાબજી
જીવણજી જમશેદજી મોદી
જીજીભાઇ પેશતનજી નીકલશન
સર ટેમુલજી ભીખાજી નરીમાન
ડોસાભાઇ કે. પટેલ
ડોસાભાઇ નશરવાનજી વાહડયા
દાદી નશરવાનજી દાદી
દાદીબા મેરવાનજી દલાલ
દસ્તુર દારાબ પેશુતન સંજાણા
સર દીનશાહ એદલજી વાછા
દીનશાહ ફરામજી કેમીસરીએટવાલા
દીનશાહ બમનજી માસ્તર
સર દીનશાહ મા. પીટીટ, બીજા બારોનેટ
દીનશાહ હોરમજી વાણીઆ
સર દોરાબ જમશેદજી તાતા
ધનજીભાઇ બમનજી પીટીટ
નવરોજી બાપુજી સકલાટવાલા
નવરોજી માણેકજી કુમસીઆ
નવરોજી સોરાબજી બંગાલી
નવરોજી હોરમજી કંત્રાકટર
નશરવાનજી નવરોજી વાહડયા
નશરવાનજી ફકીરજી સરવેઅર
નશરવાનજી મેરવાનજી પટેલ
નશરવાનજી સોરાબજી જમશેદજી જીજીભાઇ
નશરવાનજી હોરમજી ચોકસી
નાદીરશાહ હોરમજી એ. સુખીયા
નાનાભાઇ અરદેશર ફરામજી મુસ
નાનાભાઇ નશરવાનજી સાહેર
નાનાભાઇ નવરોજી કાતરક
નાનાભાઇ હોરમજી મુસ
પાલનજી નવરોજી દાવર
પેશતનજી નશરવાનજી વાડીયા
ફરદુનજી એ. ખરશેદજી ફરદુનજી
ફરદુનજી જમશેદજી પારખ
ફરદુનજી નશરવાનજી બીલાની

ફરદુનજી મનચેરજી દસ્તુર
ફરદુનજી સોરાબજી તાલીયારખાન
ફરામજી એદલજી દાવર
ફરામજી દોરાબજી ફરામજી પાંડે
ફરામરોજ રૂસતમજી જોશી
ફીરોઝ ખરશેદજી શેઠના
ફીરોઝ નશરવાનજી દારૂવાલા
ફીરોઝ બમનજી પીટીટ
ફીરોઝ બેહરામજી મલબારી
ફીરોઝશાહ બી. આર. મોદી
* બમનજી ધનજીભાઇ
બરજોરજી સોરાબજી શરાફ
બરજોરજી સોરાબજી કુપર
બેજનજી માણેકજી હોડીવાલા
બેરામજી દોરાબજી બનાજી
* બેરામ નવરોજી કંરજીયા
બેરામજી નવરોજી ગામડીયા
બેરામજી રૂસતમજી બેરામજી જીજીભાઇ
ભીખાજી એદલજી ઘાસવાલા
મનચેરશાહ કાવસજી ગઝદર
મનચેરજી બેરામજી કોલાહ
માણેકજી ખરશેદજી નરીમાન
મેરવાનજી પેશતનજી ખરેઘાટ
મેરવાનજી મનચેરજી કામા
રતનશાહ એરચશાહ કોહીઆર
રતનશાહ ટેમુલજી નરીમાન
રૂશતમજી અરદેશર સપેનસર
રૂસતમજી એદલજી મોદી
રૂસતમ ડી. એન. વાડીયા
રૂસતમજી ધનજીભાઇ શેઠના
રૂસતમજી નાનાભાઇ રાણીના
રૂસતમજી બેરામજી જીજીભાઇ
રૂસતમ પેસતનજી મસાની
રૂસતમ બમનશાહ વકીલ
રૂસતમ મનચેરજી ચીચગર
રૂસતમજી સોરાબજી પાંડેવાલા
શાપુરજી બમનજી બીલીમોરીઆ
સર શાપુરજી બરજોરજી ભરૂચા
શાવકશાહ રતનજી બમનજી દુબાશ
શાવકશા સોરાબજી બાતલીવાલા
સોરાબજી એદલજી વારડન
સોરાબજી કાવશજી હોરમજી ડાકટર
સોરાબજી ખરશેદજી નરીમાન
સોરાબજી દાદાભાઇ દુબાશ
સોરાબજી ફરામજી બીલીમોરીઆ
સોરાબજી ફરામજી બેંકર
સોરાબજી એમ. રતનાગર
સોરાબજી ભીમજી પાંડે
સર હોરમજી અરદેશર વાહડીયા
હોરમસજી એદલજી આલબલેસ
હોરમસજી જાહાંગીર ભાભા
હોરમસજી દાદાભાઇ વકીલ
હોરમસજી દોરાબજી પદમજી
હોરમસજી માણેકજી ભીમરડીવાલા
હોરમસજી માણેકજી માસીના
હોરમસજી સોરાબજી કમુના

*આવી નીશાનીવાલા ગયે વરસે નવા સુલેહના અમલદાર ઠરેલા સમજવા.

જરથોસતી શેરીફો.

મુંબઇના આગળ થઇ ગયલા શેરીફો.

સર કાવસજી જાહાંગીર બારોનેટ ૧૯૧૯.

કાવસજી હોરમસજી ડાકટર, ૧૮૫૪.
ખરશેદજી ફરદુનજી પારેખ, ૧૮૭૭ (મ.)
સર જમશેદજી જીજી. ચોથા બારોનેટ,૧૯૦૦(મ.)
સર જમશેદજી જીજી. પાંચમાં બારોનેટ, ૧૯૧૫
ડોસાભાઈ ફરામજી કરાકા, ૧૮૭૨ (મ.)
સર દીનશાહ માણેકજી પીટીટ, ૧૮૮૭ (મ.)
બમનજી હોરમસજી વાડીઆ, ૧૮૫૯ (મ.)
મનચેરજી કાવસજી મરજબાન,૧૯૦૬ (મ.)
માણેકજી ખરશેદજી, ૧૮૫૬ તથા ૧૮૬૩ (મ.)
શેરાબજી શાપુરજી બંગાલી, ૧૮૮૧ (મ.)
સર શાપુરજી બરજોરજી ભરૂચા, ૧૯૧૧

માણેકજી રૂસતમજી બનાજી –કલકતાના શેરીફ–૧૮૭૩ (મ.)

રૂશતમજી ધનજીભાઈ મેહેતા–કલકતાના શેરીફ–૧૮૯૩.

હીરજીભાઇ માણેકજી રૂશતમજી બનાજી–કલકતાના શેરીફ–૧૯૦૨. (મ.)

કાવસજી એદલજી પાંડે–મધરાસના શેરીફ–૧૮૯૪.

મુંબઈની યુનીવરસીટીના જરથોસ્તી "ફેલો."

નામદાર સરકારે સને ૧૯૦૪ ના વરસથી નવા યુનીવરસીટી એકટ મુજબ બધી જાતના ૮૦) ફેલો પોતાની તરફથી નેમેલા તેમાંના પારસી ફેલોના નામઃ–

ડોશીબાઇ જાહાંગીર રતનશાહ દાદાભાઇ
આદરજી મેરનોશજી મસાની
એદલજી દોરાજી તલાટી
જમશેદજી નસરવાનજી ડગન
જાલભાઇ દોરાબજી ભરડા
જીવનજી જમશેદજી મોદી
સર ટેમુલજી ભીખાજી નરીમાન
દીનશાહ દોરાબજી કાપડયા
દીનશાહ ફરદુનજી મુલાં
નશરવાનજી ફકીરજી સરવેયર
નાનાભાઈ અરદેશર મુસ
નાદીરશાહ દોરાબજી મીનોચેહેર હોમજી
ફરદુનજી મનચેરજી દસ્તુર
રૂસતમજી ધનજીભાઇ શેઠના
સોરાબ ખરશેદજી નરીમાન
હોરમજી જાહાંગીર ભાભા
હોરમજી માણેકજી માસીના

ગ્રેજયુએટો તથા ફેકલટીઓએ મળીને ચુંટી કાઢેલા બીજા ૨૦) ફેલોમાંના પારસી ફેલોઃ–

કે. એસ. ફરામજી
પેસતનજી અરદેશર વાહડયા.
ભીખાજી એદલજી ધાસવાલા
માણેકજી શેરીઆરજી ભરૂચા
રૂસતમજી ના. રૂ. રાનીનાં

ફરદુનજી એમ. દસ્તુર–યુનીવરસીટીના રેજીસ્ટરાર

*આવી નીશાનીવાળા ગયે વરસે નવા ઠરેલા સમજવા

જરથોસ્તી કાઉનસીલરો.

નામદાર ગવરનરની મુંબઇની લેજીસલેટીવ કાઉનસીલના સભાસદો.

ઓનરેબલ સર દીનશાહ માણેકજી પીટીટ, બીજા બારોનેટ, ૧૯૧૬–૧૯.
,, ફીરોઝ ખરશેદજી શેઠના, ૧૯૧૬–૧૯
,, દોરાબ એન. બહાદુરજી–૧૯૧૯.

નામદાર વાઇસરાયની કલકતાની ઇમપીરીયલ લેજીસલેટીવ કાઉનસીલના સભાસદો

ઓનરેબલ સર દીનશાહ એદલજી વાચ્છા, ૧૯૧૬–૧૯.

બરમાની લેજીસલેટીવ કાઉનસીલના સભાસદો.

ઓનરેબલ નશરવાનજી નવરોજી પારખ, રંગુનવાલા. ૧૯૧૮–૧૯.

નામદાર ગવરનરની મુંબઇની લેજીસલેટીવ કાઉનસીલના આગલ થઇ ગયલા સભાસદો.

ઓનરેબલ સરદાર દાવર કેખશરૂ એદલજી મોદી, શુરતવાલા, ૧૯૧૦.
,, સર જમશેદજી જીજીભાઇ બીજા બારોનેટ, ૧૮૭૦–૧૮૭૪. (મ.)
,, સર જમશેદજી જીજીભાઇ ત્રીજા બારોનેટ, ૧૮૭૯–૧૮૮૫. (મ.)
,, સર જમશેદજી જીજીભાઇ પાંચમાં બારોનેટ, ૧૯૧૩.
,, જાહાંગીર હોરમશજી કોઠારી, કરાંચીવાલા, ૧૯૧૩.
,, ડોશાભાઇ ફરામજી, ૧૮૭૦ (મ.)
,, સર ટેમુલજી ભીખાજી નરીમાન, ૧૯૧૦.
,, દાદાભાઇ નવરોજી, ૧૮૮૫ (મ.)
,, સર દીનશાહ એદલજી વાચ્છા ૧૯૧૬ (એજ સાલમાં મુંબઇની ધારાસભામાંથી કલકતાની વડી ધારાસભામાં મેમબર ચુંટાયા હતા.)
,, હોરાબજી પદમજી પેસતનજી,૧૮૯૩–૯૮. (મ.)
,, દારાશાહ રતનજી ચીનગર, ૧૯૦૪ (મ.)
,, નવરોજી દોરાબજી ખંડાલેવાલા, ૧૯૦૩–૧૯૦૭ અને ૧૯૧૩–૧૯૧૫.
,, નવરોજી નસરવાનજી વાહાડયા, ૧૮૮૩–૧૮૯૯ (મ.)
,, સરદાર નવરોજી પદમજી, ૧૯૦૬.
,, સર નવરોજી પેસતનજી વકીલ, ૧૯૦૮–૧૯૧૨.
,, પદમજી પેસતનજી, ૧૮૮૪. (મ.)
,, સર પીરોજશાહ મેરવાનજી મેહેતા, ૧૮૮૭ અને ૧૮૯૩–૧૯૧૫ (મ.)
,, ફરામજી નશરવાનજી પટેલ,૧૮૬૬ (મ.)
,, બમનજી દીનશાહ પીટીટ, ૧૮૯૯ (મ.)
,, બેરામજી જીજીભાઇ, ૧૮૬૮–૧૮૭૨ (મ.)
,, રૂસતમજી જમશેદજી જીજીભાઇ, ૧૮૬૨–૧૮૬૬ (મ.)
,, સોરાબજી શાપુરજી બંગાલી, ૧૮૭૮ (મ.)

નામદાર વાઇસરાયની કલકતાની ઇમપીરીયલ કાઉનસીલના આગલ થઇ ગયલા સભાસદો.

ઓનરેબલ સર દીનશાહજી માણેકજી પીટીટ બેરોનેટ, ૧૮૮૭ (મ.)
,, સર પીરોજશાહ મેરવાનજી મેહેતા ૧૮૯૫, બીજીવાર ૧૮૯૮ (મ.)
,, સરદાર રૂસતમજી જાહાંગીર વકીલ, ૧૯૧૩
,, માણેકજી બેરામજી દાદાભાઇ, નાગપુરવાલા, ૧૯૦૮–૧૭.

બરમાની લેજીસલેટીવ કાઉનસીલના આગલ થઇ ગયલા સભાસદો.

ઓનરેબલ મેરવાનજી કાવસજી કેપતન, રંગુનવાલા, ૧૯૧૦–૧૭ (મ.)

☞ સર ટેમુલજી ભી. નરીમાનને બોંબે મેડીકલ રેજીસ્ટરેશન એકટમાં વધુ સુધારો કરનારૂ બીલ ૧૯૧૭ની તા૦ ૧૦ અને ૧૧ મી ઓકટોબરે રજુ થયુ હતુ એ બે દીવસો માટે મુંબઇની કાઉનસીલના વધારાના સભાસદ નેમ્યા હતા.

મુંબઇની પારસી ચીફ મેત્રીમોનીયલ કોરટના ડેલીગેટોના નામ.

એદલજી માણેકજી મોદી
સર કાવસજી જાહાંગીર બારોનેટ
કાવસજી દાદાભાઇ દુબાસ
કાવસજી બેરામજી દીવેચા
સર જમશેદજી જીજીભાઈ પાંચમાં બારોનેટ
જાહાંગીર બમનજી પીટીટ
જીવનજી જમશેદજી મોદી
દાદાભાઇ મેરવાનજી જીજીભાઇ
દારાબશા બમનજી દુબાશ

સર દીનશાહ માણેકજી પીટીટ બીજા બારોનેટ
ધનજીભાઇ બમનજી પીટીટ
પીરોશાહ બમનજી પીટીટ
ફીરોશાહ ખરશેદજી શેઠના
ફીરોશાહ બરજોરજી આર. મોદી
ફરદુનજી જમશેદજી પારખ
ફરામજી દોરાબજી પાંડે
ફરામરોજ રૂશતમજી જોશી
બેરામજી નવરોજી ગામડયા

બેરામજી રૂશતમજી બેરામજી જીજીભાઇ
મનચેરશાહ માણેકજી કારભારી
મેરવાનજી મનચેરજી કામા
રૂશતમજી એન. વાચ્છાગાંધી
રૂશતમજી બેરામજી જીજીભાઇ
વીકાજી અરદેશર
શાપુરજી બમનજી બીલીમોરીયા
સોરાબજી ખરશેદજી ઘોંડી
હીરજી અરદેશર દાદીશેઠ
હોરમજી દોરાબજી પદમજી

પુણાની અને અહમદનગરની પારસી મેત્રીમોનીયલ કોરટના ડેલીગેટોના નામ.

અરદેશર બમનજી શેઠના
સરદાર દસ્તુર કેકોબાદ આદરબાદ
કેખશરૂ આદરજી ઘાસવાલા
રુસ્તાદજી ધનજીશાહ અંકલેસર્યા
દીનશાહ ડોસાભાઈ ખંબાતા

ડોસાભાઇ માણેકજી સતારાવાલા
દોરાબ એદલજી નગરવાલા
નવરોજી દોરાબજી ખંડાલાવાલા
સરદાર નવરોજી પદમજી
નવરોજી ફરામજી અરદેશર

પેસતનજી બમનજી સુનાવાલા
ફરામરોઝ સોરાબજી ચીનાઇ
બરજોરજી પીરોજશા ભરૂચા
બેજનજી નશરવાનજી નગરવાલા
સોરાબજી હોરમજી મોદી

કરાંચીની પારસી મેત્રીમોનીયલ કોરટના ડેલીગેટોના નામ.

અરદેશર ફરામજી કલ્યાણીવાલા
બેરચશાહ નાનાભાઇ ખરેગાટ
કાવસજી હોરમસજી કાતરક
ખરશેદજી બમનજી શેઠના
ખરશેદજી શાપુરજી સોપારીવાલા
જમશેદજી શાપુરજી સોપારીવાલા

જાહાંગીર હોરમજી કોઠારી
નશરવાનજી ખરશેદજી મજાથના
નશરવાનજી રૂસતમજી મેહેતા
નાદરશા એદલજી દીનશાહ
પેશતનજી બેરામજી કોટવાલ
પેસતનજી રૂસતમજી મેહેતા
પેસતનજી હોરમજી ઘડીયાલી

ફરાંમરોજ એદલજી પંથકી
બમનજી ફરાંમજી શેઠના
બરજોરજી કાવસજી દુબાશ
માણેકજી ખરશેદજી માદન
સોરાબજી કુંવરજી પસતાકીઆ
સોરાબજી મનચેરજી બીલીમોરીયા
હોરમસજી માણેકજી ખજુરીના

*સુરતની પારસી મેત્રીમોનીયલ કોરટના ડેલીગેટોના નામ.

સુરત ખાતેના.

કાવશજી ધનજીભાઇ ધનભુરા
કાવસજી રૂસતમજી દસ્તુર
કેખશરૂ પાલનજી પટેલ
તેહમુરસપ કાવસજી મોદી
દીનશાહ જીવાજી એદલબેહરામ
દોરાબજી બીખાજી રબાડી
નવરોજી બમનજી વકીલ
ફરામજી દીનશાહ કામદીન
બેજનજી માણેકજી જંબુસરયા
સ્યાવકશા હોરમજી ખશુખાન
હોશંગજી બરજોરજી વાણીઆ

અમદાવાદ ખાતેના.

અરદેશર કાવસજી કરંજાવાલા
અરદેશર રૂશતમજી દલાલ
એદલજી બેરામશાહ હોડીવાળા
ફીરોઝશાહ કાવસજી કરંજાવાળા

ભરૂચ ખાતેના.

જામાશજી હોરમજી જંબુસરયા
પીરોશાહ રૂશતમજી વખારીયા
બમનજી અરદેશર દલાલ
મંચેરશાહ સોરાબજી વખારીયા
રતનજી ફરદુનજી જીનવાલા

* આ ડેલીગેટોમાં ૧૦ સુરતના, ૫ અમદાવાદના અને ૫ ભરૂચના મલી ૨૦ ડેલીગેટોની સુરત, અમદાવાદ તથા ભરૂચની એકજ કોરટ ગણાય છે, અને કામ પડે તયારે અવારનવાર બાર ગ્રહસ્થોને સુરત ખાતે બોલાવવામાં આવે છે.

મુંબઈ મ્યુનીસીપાલ કારપોરેશનના જરથોસ્તી મેમબરો.

કાવસજી એદલજી દાદાચાનજી-ગીરગામ (કર. ભર)
કાવસજી જહાંગીર રેડીમણી-(સુ. અ.) પરેસીડંટ
જમશેદજી અરદેશર વાડીઆ-(સુ. અ.)
સર જમશેદજી જીજીભાઈ બારોનેટ-(સુ. અ.)
જહાંગીર જમશેદજી ખરશેદજી-ખુલેશ્વર (કર. ભર)
જહાંગીર બમનજી પીટીટ-ગીરગામ (કર. ભર.)
સર ફેરોઝશાહ ભીખાજી નરીમાન-(યુનીવરસીટી.)
દીનશાહ બમનજી પેસતનજી માસ્તર-ખુલેશ્વર (કર. ભર.)
સર દીનશાહ માણેકજી પીટીટ બારોનેટ-(સુ. અ.)
નવરોજી મ. કુમસીઆ-(સુ. અ.)
નાદરશાહ હોરમજી સુખીયા-કોટ (કર. ભર.)
ફીરોજ ખરશેદજી શેઠના-(સુ. અ.)
ફીરોજશા જહાંગીર મરઝબાન-કોટ-(કર. ભર.)
બેરામજી નવરોજી ગાંમડીયા-કોટ (કર. ભર.)
બેરામજી રૂસતમજી બેરામજી જીજીભાઈ-(સુ. અ.)
રતનશાહ ફેમુલજી નરીમાન-(સુ. અ.)
રૂસતમ ડો. એન. વાડીયા-(સુ. અ)
શાવકશાહ સોરાબજી બાટલીવાલા-પરેલ (કર. ભર.)
સોરાબજી ખરશેદજી ઘોંડી-ભાયખલા-(કર ભર.)
હોરમજી પીરોજશાહ મોદી-ગીરગામ-(કર. ભર.)

(કર. ભર.)-કર ભરનારાઓ તરફથી ચુંટી કઢાયલા; (સુ. અ.) સુબેહના અમલદારો તરફથી; (યુનીવરસીટી)-યુનીવરસીટી તરફથી; (સરકાર)-નામદાર સરકારે નેમેલા.

સ્ટેનડીંગ કમીટીના જરથોસ્તી મેમબરો.

બેરામજી રૂશતમજી બેરામજી જીજીભાઇ | હોરમજજી પીરોશાહ મોદી

મ્યુનીસીપાલીટીના સેક્રેટરી—રૂશતમજી પેસતનજી મસાની.

મુંબઇની સીટી ઇમપરૂવમેન્ટ ટ્રસ્ટ બોરડના જરથોસ્તી મેમબરો.

કાવશજી એદલજી દાદાચાનજી | કાવસજી જહાગીર રેડીમની
ફીરોઝ ખરશેદજી શેઠના | રૂશતમજી બમનશાહ વકીલ—સપેસીયલ કલેકટર.

જરથોસ્તી સોલીસીતરો.

અરદેશર જમશેદજી પોચા, ૧૯૦૯
અરદેશર ફ. વકીલ
અરદેશર ફરામજી સુનાવાલા, ૧૯૧૨
અરદેશર બરજોરજી લીંબુવાલા (લંડનના)૧૯૧૧
અરદેશર મેરવાનજી માદન, ૧૮૯૯
એરચશાહ એમ. બહાદુરજી, ૧૯૧૮
કાવસજી જમશેદજી બીલીમોરીયા, ૧૯૦૩
કેખશરૂ એ. વકીલ,૧૯૧૮
કેખુશરૂ જમશેદજી દુબાશ, ૧૯૦૪
કેખુશરો ફરદુનજી શીરવાઈ, ૧૮૯૬
કેખુશરો બી. મેહેતા, ૧૮૯૭
કેખશરૂ માણેકજી સરવેઅર, ૧૯૧૧
કેખુશરો હોરમજી વકીલ, ૧૮૯૬
ખરશેદજી ધનજીભાઇ શરાફ, ૧૮૯૨
જમશેદજી એમ. દસ્તુર, ૧૯૧૬
જામાસ્પ ફીરોજ હોશંગ દસ્તુર, ૧૯૦૨
જહાંગીર કેરસાશપજી રૂ. દાદાચાનજી, ૧૯૦૦
જેહાંગીર જમશેદજી વીમાદલાલ, ૧૮૯૮
જેહાંગીર દોરાબજી નીમચવાલા, ૧૮૯૧
જેહાંગીર ડી. કાંગા, ૧૯૦૯

જેહાંગીર પીરોજશાહ મેહેતા, ૧૯૦૫
જેહાંગીર બહમનજી બહમન-બેહેરામ, ૧૮૯૬
જેહાંગીર રૂસતમજી મેરવાનજી પટેલ, ૧૯૦૦
જેહાંગીર સોરાબજી કાંગા, ૧૯૧૨
જેહાંગીર એચ. મોદી, ૧૯૧૬
જે. હોરમસજી,૧૮૯૯
જીજીભાઇ ડોસાભાઇ ખંબાતા,૧૯૦૬
જીવાજી દીનશાહજી ગાંધી,૧૮૮૪
દારાશાહ જીવાજી વકીલ, ૧૯૧૦
દારાશાહ બેજનજી મહેતા, ૧૮૯૨
દીનશાહ ખરશેદજી દાજી, ૧૮૯૧
દીનશાહ જીજીભાઈ ઇરાની, ૧૯૦૬
દીનશાહ જીજીભાઇ ડાકટર, ૧૮૮૬
દીનશાહ દોરાબજી રોમર, ૧૮૯૯
દીનશાહ ફરદુનજી મુલ્લાં, ૧૮૯૫
દોરાબ નશરવાનજી ફારબસ, ૧૯૧૫
દોરાબ પેસતનજી શેઠના, ૧૯૧૫
ધનજીશાહ એસ. કેપટન. (લંડનના)
ધનજીશા એચ. નાનાવટી,૧૯૧૪
નોશીરવાન જે. કોહીયાર ૧૯૧૪
નોશીરવાન પી. એનજીનીયર, ૧૯૦૯
નશરવાનજી પીરોજશાહ દુબાશ (લંડન)
નશરવાનજી હોરમસજી શેઠના, ૧૯૧૨
નાદરશાહ બમનજી વકીલ, ૧૯૦૨
નાનાભાઇ હોરમસજી મુસ, ૧૮૯૧
પાલી મનચેરજી કલબવાલા, ૧૯૧૪
પીરોજશાહ નશરવાનજી બીલીમોરીયા, ૧૯૦૦
પેસતનજી બાપુજી ખરાસ, ૧૯૧૩
પેસતનજી માણેકજી કાંગા, ૧૮૯૦
પેસતનજી લીમજી પારખ,૧૯૧૨
પેસ્તનજી સોરાબજી બાટલીવાલા(લંડનના)૧૯૦૭
પોચાજી જે. પોચા, ૧૯૧૬
ફરદુનજી કેરસાસ્પજી દાદાચાનજી, ૧૯૦૫
ફરદુનજી પાલનજી પાવરી,૧૮૯૨
ફરદુનજી માણેકજી કાંગા,૧૮૮૯
ફરામજી અરદેશર વકીલ, ૧૮૯૬
ફરામજી માણેકજી વાગ્છા, ૧૯૦૩
ફરામજી રૂસતમજી વાહડયા, ૧૮૭૪
ફરામજી શાપુરજી મેહેતા, ૧૯૦૨
ફરામરોજ એદલજી દીનશાહ, ૧૮૯૬
ફરામરોજ જમશેદજી જીનવાલા, ૧૯૧૪
ફરામરોજ મેરવાનજી મેહેતા,૧૯૦૯
ફરામરોજ હોરમસજી એન. વકીલ, ૧૯૦૬
ફીરોજશાહ નશરવાનજી પ્લીડર, ૧૮૯૧
બમનજી એન. મુલ્લાં, ૧૯૧૮
બરજોરજી ડોસાભાઇ ડાકટર, ૧૯૦૬
બરજોર બેરામશાહ આઇબારા, ૧૯૧૫
બેરામજી નશરવાનજી ફારબશ, ૧૯૧૦
બાપુજી દાદાભાઇ લામ, ૧૯૦૮
મનચેરજી જે. ગાંધી, ૧૯૧૭
મનચેરશાહ બમનજી ચોકસી, ૧૯૦૨
મનચેરશાહ રૂસતમજી વકીલ, ૧૯૦૧
માણેકજી નશરવાનજી દસ્તુર, ૧૯૧૫
માણેકજી એન. પોચખાનાવાલા, ૧૮૯૯
માણેકજી રૂસતમજી બીલીમોરીયા, ૧૯૦૨
માણેકજી સોરાબજી કેપટન, ૧૮૯૬
મીનોચેહર અરદેશર વકીલ, ૧૮૯૭
મીનોચેહર પી. દાદાચાનજી, ૧૯૦૯
મેરવાનજી કેખશરો આગપાઇવાલા, ૧૮૮૯
રૂસતમજી એદલજી પાપા, ૧૯૧૨
રૂસતમજી ખરશેદજી કામાજી, ૧૮૮૪
રૂસતમજી ધનજીશાહ દલાલ, ૧૯૧૦
રૂસતમજી નવરોજી મોટાભાઇ,
રૂસતમજી પીરોજશાહ મેહેતા, ૧૮૯૭
રૂસતમ પીરોજશાહ બરૂચા, ૧૮૯૬
રૂસતમજી ફરદુનજી મુલ્લાં,૧૮૯૫
રૂસતમ એફ. દીવેચા, ૧૯૧૬
રૂસતમજી બી. મઝગામવાલા,૧૯૧૮
રૂસતમજી સોરાબજી કેપટન, ૧૯૦૦
શાવકશાહ બેરામજી નરીમાન, ૧૯૦૨
સોરાબજી દાદાભાઇ બાસતાવાલા, ૧૮૯૫
સોરાબજી ફરદુનજી મુલ્લાં, ૧૯૦૩
સોરાબજી માણેકજી કાંગા. ૧૮૮૫
હીરજી કાવસજી કોલાહ, ૧૮૯૧
હોરમસજી સી. કેપટન, ૧૯૧૭
હોરમસજી ડી. વાડીયા, ૧૯૧૮
હોરમસજી એફ. મુલ્લાં, ૧૯૧૭
હોરમસજી બેજનજી બામજી, ૧૯૦૮

જરથોસ્તી બારીસ્ટરો.

અદી જમશેદજી પુનાવાલા ૧૯૧૯
અરદેશર કાવસજી શેઠના, ૧૮૮૫
અરદેશર ધનજીભાઇ કા. પટેલ, ૧૮૯૩
અરદેશર પેશતનજી સણાવાલા, ૧૯૧૪
અરદેશર ફીરોઝ મેહેતા, ૧૯૧૦
અરદેશર બરજોરજી લીંબુવાલા, ૧૯૧૧
અરદેશર બેગમજી કાપડયા, ૧૮૭૨
અરદેશર માણેકજી મસાની, ૧૯૧૦
અરદેશર રતનજી વાડયા, ૧૯૧૨
અરદેશર હોરમસજી વાડીયા, ૧૯૧૦
એરચ જહાંગીર સોરાબજી તારાપોરવાલા, ૧૯૦૯
એ. અરદેશર એનજીનીયર, ૧૯૧૨
કાવસજી જમશેદજી પેટીગરા, ૧૯૦૦
કાવસજી બરજોરજી જરાવાલા, ૧૯૦૯
કાવસજી મેરવાનજી દોતીવાળા, ૧૯૧૨
કેકોબાદ એદલજી જમશેદજી સંજાના, ૧૯૦૭
કેકોબાદ ભીખાજી દસ્તુર, ૧૯૦૩
કેકી માણેકજી કારભારી, ૧૯૧૨
કેખશરો આદરજી ઘાસવાળા, ૧૮૯૫
કેખશરૂ ખરશેદજી દલાલ, ૧૯૦૫
કેખશરૂ જહાંગીર રૂસતમજી દાજી, ૧૯૧૦
કેખશરૂ પેસતનજી પાદશાહ, ૧૯૧૭
કેખશરો ફરામજી પટેલ, ૧૯૧૫
કેખશરૂ બેરામજી પદમજી, ૧૯૦૯
કેખશરૂ માણેકશાહ તાલ્યારખાન, ૧૯૧૩
કેખશરો સોરાબજી, ૧૮૯૬
ખરશેદજી દીનશા ઘાસવાળા,(એડવોકેટ)૧૯૧૩
ખરશેદજી માણેકજી ખરશેદજી શરાફ, ૧૮૬૯
ખુરદાદ રૂશતમજી ૫. કન્ટ્રેકશનર, ૧૯૧૪
જમશેદજી ખરશેદજી તારાચંદ, ૧૯૦૨
જમશેદજી જીવનજી ગજદર, ૧૮૭૧
જમશેદજી બેરામજી ભીખાજી કાંગા, ૧૯૦૩
જમશેદજી મેરવાનજી બોહસ, ૧૯૧૨
જાલ અરદેશર દાદાભાઈ નવરોજી, ૧૯૧૦
જાલ ખરશેદજી રતનજી બમનજી, ૧૯૦૯
જાલ જેહાંગીર સુગાશેઠ, ૧૯૧૪
જેહાંગીર કાવસજી બીલીમોરીયા, ૧૯૦૩
જેહાંગીર કુંવરજી કાયાજી, ૧૯૧૦
જેહાંગીર કેખશરૂ મુનસી, ૧૯૧૪

જેહાંગીર ખરશેદજી કામા, ૧૮૮૯
જેહાંગીર ડોસાભાઇ ફરામજી કરાકા
જેહાંગીર દીનશાહ દાવર, ૧૯૦૦
જેહાંગીર પીરોજશાહ દુબાશ, ૧૮૯૧
જેહાંગીર પેસતનજી, ૧૮૯૬
જેહાંગીર બરજોરજી પટેલ, ૧૯૧૨
જેહાંગીર રૂશતમજી વખારીયા, ૧૮૯૬
જેહાંગીર સોરાબજી બેરગામવાળા, ૧૯૧૧
જેહાંગીર હોરમસજી જેહાંગીર બાબા
જેહાંગીર હોરમસજી નશરવાનજી વકીલ, ૧૯૦૫
ટેમુરસ કાવસજી મોદી, ૧૯૧૨
ટેમુરસ દાદાભાઇ જાલ, ૧૯૦૪
ડોસાભાઇ કાવસજી રાલી, ૧૯૧૧
ડોસાભાઇ મેરવાનજી કરાકા, ૧૮૮૯
દાદાભાઇ મનચેરજી કોહલા, ૧૮૯૨
દારાશાહ શાપુરજી શેઠના, ૧૯૦૦
દાદી હોરમશજી દાદાભાઈ જજ, ૧૮૯૩
દીનશાહ ફરેદુનજી મુલ્લાં, (એડવેકેટ) ૧૯૦૮
દોરાબ આદરજી ઘાસવાલા, ૧૯૧૪
દારબ ખરશેદજી ડરાઇવર, ૧૯૧૨
દારબ ખુરશેદજી પેટીગરા, ૧૯૧૬
દોરાબજી નવરોજી ખંડાલેવાલા, ૧૯૦૬
દોરાબજી નશરવાનજી બહાદુરજી, ૧૮૯૫
ધનજીશાહ અરદેશર અંકલેશરીઆ, ૧૯૦૬
ધનજીશાહ દોરાબજી, ૧૮૯૬
ધનજીશાહ મેહેરજી માદન,(એડવોકેટ) ૧૯૧૨
ધનજીશાહ સોરાબજી કેપટન, ૧૯૧૨
નવરોજ જહાંગીર વહાડયા, ૧૯૦૯
નવરોજી દાદાભાઇ આલબલેસ, ૧૮૮૮
નવરોજી ભીખાજી દલાલ, ૧૯૧૬
નવરોજી મેરવાનજી તારાચંદ, ૧૯૦૫
નવરોજી હોરમસજી નવરોજી મોદી, ૧૮૯૯
નસરવાનજી જમશેદજી દાદી, ૧૮૯૨
નસરવાનજી નવરોજી અંકલેસરીઆ, ૧૯૦૬
નસરવાનજી ફરામજી મેહતા, ૧૯૧૯
નસરવાનજી બેરામજી ગઝદર, ૧૯૦૨
નસરવાનજી રૂસતમજી ધનજીભાઈ મેહેતા, ૧૯૦૫
નસરવાનજી સોરાબજી પદમજી, ૧૯૧૩
નોશીર ફરદુનજી શીરવાઇ, ૧૯૦૯
નોશીર સોરાબજી ચીનાઇ, ૧૯૧૮
નાનાભાઈ નશરવાનજી સાહેર, ૧૮૯૫

નાનાભાઇ મેરવાનજી કાવસજી કપટાન, ૧૮૯૪
નાનાભાઇ હોરમજી મુસ, ૧૯૧૨
પદમ પેસતનજી જીનવાલા, ૧૮૯૯
પેશતનજી ખરશેદજી તારાપોરવાલા, ૧૯૦૯
પેશોતન ધનજીશાહ પટેલ, ૧૯૦૭
પેશતનજી પીરોજશાહ ડાકટર, ૧૯૧૨
પેશતનજી સોરાબજી કેટવાલ, ૧૮૯૯
પેસતનજી એચ. જે. રૂસતમજી, ૧૮૯૬
પીરોજશાહ નશરવાનજી દારૂવાળા, ૧૯૧૧
પીરોજશાહ બેરામજી મલબારી, ૧૮૯૯
ફરદુનજી દાદાભાઇ મુલ્સાં, ૧૯૧૫
ફરેદુનજી પેસતનજી જા. તાલયારખાન, ૧૮૯૪
ફરેદુન પીરોજ તારાપોર, ૧૯૧૩
ફરેદુનજી બરજોરજી મોતીવાલા, ૧૯૦૬
ફરેદુનજી સોરાબજી જા. તાલયારખાન, ૧૮૯૪
ફરામજી પેસતનજી ડાકટર, ૧૮૯૧
ફરામરોજ મનચેરજી દાદીના, ૧૮૯૪
ફરામરોજ રતનજી બમનજી, ૧૯૦૩
ફરામરોજ એમ. શેઠના, ૧૮૯૩
ફીરોઝ જીજીભાઇ, ૧૯૧૮
ફીરોઝ દોરાબજી ગોળવાળા, ૧૯૧૨
ફીરોઝશાહ બેજનજી વાચ્છા, (એડવોકેટ)૧૯૧૩
ફીરોજશાહ રતનજી ભીણવાલા, ૧૮૯૫
ફીરોજશાહ હોરમજી જડજ, ૧૯૧૨
બમનજી કાવસજી કેપટન, ૧૮૯૧
બમનજી જમશેદજી વાહડયા, ૧૯૦૬
બમનજી ડોસાભાઇ આલઅલેસ, ૧૯૧૪
બમનજી રતનજી બમનજી દુબાશ, ૧૮૯૪
બરજોરજી જમશેદજી અરદેશર દલાલ, ૧૮૯૪
બાપુજી દોરાબજી વાછા, ૧૯૦૫
બેરામજી રૂસતમજી મેહતા, ૧૮૯૯
બીખાજી બેરામજી કાંગા, ૧૯૦૮
મનચેરજી ખરશેદજી લાલકાકા, ૧૮૯૨
મનચેરજી દાદાભાઇ દાદીશેઠ, ૧૮૮૩
સર મનચેરજી મે. ભાવનગરી, ૧૮૮૫
મરઝબાન મનચેરજી મરઝબાન, ૧૮૯૪
માણેકજી પેસતનજી મોદી, ૧૮૯૨
માણેકજી પેસતનજી અ.શાવઇદ, ૧૮૯૫
માણેકજી બે. દા. રેજીસ્ત્રાર, ૧૮૮૭
માણેકજી રૂસતમજી મેહેતા, ૧૮૯૫
મીનોચેહર જમશેદજી દસ્તુર, ૧૯૧૨
મેરવાનજી કાવસજી શેઠ, ૧૯૧૧
મેરવાનજી જમશેદજી આંટીયા, ૧૯૧૪
મેરવાનજી રૂસતમજી બાઇલા, ૧૮૯૯
મેરવાનજી હોરમસજી હકીમ, ૧૯૧૦
રતનજી સોરાબજી દાદાચાનજી, ૧૯૧૨
રૂસતમજી ખરશેદજી તારાચંદ, ૧૯૦૦
રૂસતમજી જીવણજી જમશેદજી મોદી, ૧૯૦૮
રૂસતમજી ડોસાભાઈ ન. વહાડયા, ૧૮૯૯
રૂસતમજી દીનશાહ બાટલીવાલા, ૧૯૧૦
રૂસતમજી ધનજીભાઇ શેઠના, ૧૮૮૪
રૂસતમજી પેસતનજી ભાનેવાલા, ૧૯૧૫
રૂસતમજી પેસતનજી વોલેસ, ૧૯૧૭
રૂસતમજી ફરામજી બહાદુરજી, ૧૮૯૫
રૂસતમજી બે. સોનાવાલા, ૧૮૯૦
રૂસતમજી બેરામજી કોલાબાવાલા, ૧૮૮૮
રૂસતમજી મેરવાનજી આલપાઇવાલા, ૧૯૧૨
રૂસતમજી સોરાબજી દાંતરા, ૧૮૯૬
રૂસતમજી સોરાબજી બીલીમોરીયા, ૧૯૧૧
વીકાજી ફરદુનજી તારાપોરવાલા, ૧૯૦૧
વીકાજી એફ. વીકાજી, ૧૯૧૭
શપલ મનચેરશાહ ચોઠયા, ૧૯૧૪
શીયાવક્ષ આદરજી ધોબાવાલા, ૧૯૦૭
શીયાવક્ષ કેખશરૂ એનજીનીયર, ૧૯૧૬
શીયાવક્ષ રૂસતમજી માસ્તર, ૧૮૯૧
સોરાબજી આદરજી દલાલ, ૧૯૦૮
સોરાબજી ખુરશેદજી દસ્તુર, ૧૯૧૨
સોરાબજી દાદાભાઇ બેદવાર, ૧૯૦૯
સોરાબજી બેહરામજી બનાજી, ૧૯૧૦
સોરાબજી માણેકજી, ૧૯૧૨
સોરાબજી રૂસતમજી દાવર, ૧૯૧૦
સોરાબજી લીમજીભાઈ દાવર, ૧૯૦૯
શાપુરજી જમશેદજી શાપુરજી, ૧૯૧૧
સર હોરમજી અરદેશર વહાડયા, ૧૮૭૦
હોરમજી અરદેશર વકીલ, ૧૯૧૦
હોમી જાહાંગીર રૂસતમજી, ૧૯૧૯
હોરમજી પી. મોદી, (એડવોકેટ) ૧૯૧૦
હોમી બમનજી મોટાફરામ, ૧૯૧૫
હોરમજી મનચેરશાહ મહેતા, ૧૯૦૯
હોરમજી સોરાબજી કેપટન, ૧૯૧૦
હોરમજી લશકરી, ૧૮૯૨
હોરમઝદીઆર કુંવરજી કોહયાજી, ૧૯૦૮(એડવોકેટ)
હોરમઝદીઆર ફીરોઝ હોશંગ દસ્તુર, ૧૯૧૧
હીરજીભાઇ હોરમજી ડી. વાહડયા, ૧૮૯૯

પારસી પંચાયતના ધરમખાતાંને લગતી જાણવાજોગ વીગતો.

મુંબઇની પારસી પંચાયતના ધરમખાતાંઓના ફંડ તથા મીલકતોના ટ્રસ્ટી સાહેબોના નામો.

સર જમશેદજી જીજીભાઇ પાંચમાં બેરોનેટ, સર કાવસજી જહાંગીર બેરોનેટ, શેઠ મનચેરજી પેસ્તનજી ખરેગાત, સર હોરમજી અરદેશર વાડીઆ, શેઠ જહાંગીર બમનજી પીટીટ, શેઠ કાવસજી જામભાઇ શેઠ અને સર દીનશાહ માણેકજી પીટીટ બીજા બેરોનેટ.

સને ૧૯૧૭ ના સાલનો પંચાયતના હીસાબનો ટુંક ઇનતેખાબ.

આ સાલની શરૂઆતમા પુંજી રૂ.૬૮,૬૮,૯૩૫-૨-૨ ની હતી તે આ સાલની સેવટે રૂ. ૭૬,૬૬,૫૮૯-૧૨-૧૧ ની થઇ હતી એટલે આગો સાલમાં વધારો રૂ. ૭,૯૭,૬૫૪-૧૦-૯ નો થયો છે.

જુદા જુદા ધણીઓએ જામીનગીરી અને શેરો અને જામીનગીરી ખરીદવાને રોકડ મલી ૩૭,૧૭,૨૭૬ આપ્યા છે, તેની સામટી ટીપ હેઠળ આપી છે તેપરથી માલમ પડશે કે ૩૩,૩૦,૫૦૧ પારસી જનરલ હોસપીટલ માટે, ૩૨,૪૨,૭૬૦ મુંબઈ શેહેરને લગતાં બીજા ખાતાંઓ માટે, ૩૮૪,૩૧૫ સુરતની અંજુમન માટે અને ૨૫૯,૭૦૦ બાહેરગામનાં બીજા ખાતાંઓ માટે મલ્યા છે. આ સાલ ૭ નવાં ખાતાં પડયા છે.

૧૦૦૦	ખા૦ બા૦ નશરવાનજી જાગાસપજી બેગાએ જરથોસ્તી રવાનોને અવલમંજલ પોહોચાડવાના ફંડમાં.
૫૦૦	બાઇ ડોસીબાઇ દીનશાજી જશુભાઇએ ઉપલાજ ફંડમાં.
૧૫૦૦	શેઠ હોરમજી શાપુરજી કાતરકે ઉપલાજ ફંડમાં.
૫૦૦	શેઠ ડોશાભાઇ પાલનજી માદને નવસારીના જરથોસ્તી રવાનોને અવલમંજલ પોહોચાડવાના ફંડમાં.
૩૦૦૦	શેઠ રૂ. મ. ભાભાના વશીયતનામાંનાં એકજીક્યુટરોએ ચોપાટીની ધરમશાળામાં આંધલાં પાંગલાં તથા લાચાર જરથોસ્તીઓને રાખીને પરવરસી કરવાના ફંડમાં.
૫૦૦	બાઇ નવાજબાઇ નશરવાનજી નારીએલવાલાએ મુંબઇના આંધલાં પાંગલાં તથા લાચાર જરથોસ્તીઓની પરવરસી કરવા પગાર આપવાના ફંડમાં.
૫૦૦	મરહુમ શેઠ ન. જા. ગામડીયાના એકજીક્યુટરોએ ઉપલાંજ ફંડમાં.
૫૦૦	શેઠ પીરોજશાહ મેરવાનજી મરઝબાને ઉપલાંજ ફંડમાં.
૭૦૦	શેઠ સોરાબજી દીનશાહ હીરજીએ ઉપલાંજ ફંડમાં.
૧૦૦૦	શેઠ બરજોરજી જીવનજી મીસ્ત્રીએ ઉપલાંજ ફંડમાં.
૨૦૦૦	શેઠ ડોશાભાઇ બેજનજી મોતીવાલાએ ગરીબ લાચાર જરથોસ્તી વીધવાઓને આશરો આપવાના ફંડમાં.
૫૦૦	બાઇ શીરીનબાઇ હોરાબજી અરીણવાલાએ ઉપલાંજ ફંડમાં.
૨૦૦૦	શેઠ ખરશેદજી ડોશાભાઇ મોતીવાલાએ ઉપલાંજ ફંડમાં.
૫૦૦	શેઠ પીરોજશાહ મેરવાનજી મરજબાને મુંબઈના ગરીબ લાચાર જરથોસ્તીઓ ગુજરે તેઓના રવાનોને અવલમંજલ પોહચાડવા તથા ધરગની ક્રીયા વગેરેનો દીન ૪ નો ખરચ કરવા આશરો આપવાના ફંડમાં.
૫૦૦	બાઇ દીનબાઇ તે શેઠ એદલજી અરદેશર મોદીના વીધવાએ ઉપલાંજ ફંડમાં.
૫૦૦	બાઇ મોટીબાઇ ફરદુનજી આલબલેસે ઉપલાંજ ફંડમાં.
૫૦૦	બાઇ ભીખાઇજી જમશેદજી ચીનાઇએ ઉપલાંજ ફંડમાં.

૫૦૦ શેઠ પીરોજશાહ મેરવાનજી મરજબાને જરથોસ્તી માએ બાપોને પેટે જનમેલાં બાલકોને સુદરો પેહેરાવવા આશરો આપવાના ફંડમાં.

૧૦૦૦ શેઠ પીરોજશાહ મેરવાનજી મરજબાને લાચાર જરથોસ્તીઓની છોકરીઓને પરણાવી આપવા આશરો આપવાના ફંડમાં.

૫૦૦ શેઠ નવરોજી પેસતનજી કંટરાકટરે ઉપલાંજ ફંડમાં.

૫૦૦ બાઇ ભીખાઇજી જમશેદજી ચીનાઇએ ઉપલાંજ ફંડમાં.

૫૦૦ શેઠ ડોશાભાઇ પાલનજી માડને નવશારીનાં આંધલાં પાંગલાં જરથોસ્તીઓને આશરો આપવાના ફંડમાં.

૧૦૦૦ ખા૦ બા૦ નસરવાનજી જામાસજી બોગાએ દીવાનશાળાના ગરીબ લાચાર જરથોસ્તીઓની પરવરશીના ખરચના ફંડમાં.

૫૦૦ શેઠ પીરોજશાહ મેરવાનજી મરજબાને બાપ વીનાનાં બચ્ચાં તથા વીધવાના ખાતામાં.

૫૦૦ બાઇ ખરશેદબાઇ હોરમસજી ઓલબલેસે ઉપલાંજ ફંડમાં.

૨૦૮૦૦૦ ઓનરરી સેક્રેટરીએ બમનજી દીનશાહ પીટીટ પારસી જનરલ હાસપીટલમાં.

૧૦૦૧ શેઠો કુપર એન્ડ કુંપનીએ ઉપલાંજ ફંડમાં.

૧૦૦૦ શેઠ કુંવરજી દોરાબજી કરંજીઆ અને ધણીયાણીએ ઉપલાંજ ફંડમાં.

૮૦૦ શેઠ રૂસતમજી ફરીરજી દમનીઆએ ઉપલાંજ ફંડમાં.

૨૫૦૦ મરહુમ શેઠ અરદેશર દો. તારાપોરવાલાની યાદમાં બેશીઓએ ઉપલાંજ ફંડમાં.

૫૦૦ શેઠ હોરમસજી એદલજી આલબલેસે ઉપલાંજ ફંડમાં.

૫૦૦ બાઇ પીરોજા એદલજી મોદીએ ઉપલાંજ ફંડમાં.

૫૦૦ બાઇ મોટીબાઇ ફરેદુનજી ઓલબલેસે ઉપલાંજ ફંડમાં.

૮૦૦ મરહુમ શેઠ માણેકજી મેરવાનજી મેહેતાની યાદમાં બેશીઓ વીગેરે ઉપલાંજ ફંડમાં.

૧૪૦૦ મરહુમ શેઠ એમ. પી કાકાના ચેરીટીમાંથી તથા શેઠ રૂસતમજી પી. ભરૂચા તરફથી મલી ઉપલાંજ ફંડમાં.

૫૦૦ શેઠ બરજોરજી જીવનજી મીસ્ત્રીએ ઉપલાંજ ફંડમાં.

૫૧૦ શેઠો ડોસાભાઇ તથા માણેકજી મેરવાનજી બીલીમોરીયાએ ઉપલાંજ ફંડમાં.

૫૦૦ શેઠ નવરોજી પેસતનજી કંત્રાકટર તથા નારગામવાળાએ ઉપલાંજ ફંડમાં.

૨૬૦૦ રાંદેલની અંજુમનનાં કારોબારીઓએ રાંદેલને મલતાં સાત ગામ ગોદાવરાના રવાનોને અવલમંજલ પોહચાડવાના ફંડમાં.

૪૨૦૦ વડોદરાની અંજુમનના કારોબારીઓએ વડોદરાના રવાનોને અવલમંજલ પોહચાડવાના ફંડમાં.

૬૬૦૦ વલસાડની અંજુમનના કારોબારીઓએ વલસાડ અંજુમન ફંડમાં.

૧૦૦૦ સુરાલી અંજુમનના કારોબારીઓએ સુવાલી અંજુમન ફંડમાં.

૪૫૦૦ તારાપોર અંજુમનના કારોબારીઓએ તારાપોર અંજુમન ફંડમાં.

૫૦૦ શેઠ કેખશરૂ મનચેરજી લાલીએ સોલાપોર અંજુમન ફંડમાં.

૨૦૦૦ સોલાપુર અંજુમનના કારોબારીઓએ ઉપલાંજ ફંડમાં.

૨૨૦૦ ખેરગામ અંજુમનના કારોબારીઓએ ખેરગામ અંજુમન ફંડમાં.

૨૦૦૦ બદનેરા તથા ઉમરાવટી અંજુમનના કારોબારીઓએ બદનેરા તથા ઉમરાવટી અંજુમન ફંડમાં.

૨૫૦૦ સારોંડા અંજુમનના કારોબારીઓએ સારોંડા અંજુમન ફંડમાં.

૨૩૦૦ મદરાસ અંજુમનના કારોબારીઓએ મદરાસ અંજુમન ફંડમાં.

૨૦૦૦ છગતપોરા અંજુમનના કારોબારીઓએ છગતપોરા અંજુમન ફંડમાં.

૫૦૦ નાગપોર તથા કામટીની અનજુમનના કારોબારીઓએ નાગપોર તથા કામટીની અનજુમન ફંડમાં.

૫૦૦ શેઠો માણેકજી તથા કાવસજી ધનજીભાઇ ધનભુરા તથા અરદેશર અને જમશેદજી પેસતનજી ધનભુરાએ ચીખલી અનજુમન ફંડમાં.

૭૦૦ દવીયેર અનજુમનના કારોબારીઓએ દવીયેર અનજુમન ફંડમાં.

૫૦૦ માંડવી અનજુમનના કારોબારીઓએ માંડવી અનજુમન ફંડમાં.

૧૨૦૦ બાઇ આઇમાય નવરોજી નાદરશાએ સુરત અનજુમન ફંડમાં.

૩૫૦૦ બાઇ ધનબાઈ બેરામજી મલબારીએ ઉપલાજ ફંડમાં.

૧૨૦૦ શેઠ પાલનજી કાનજીભાઇ લકડાવાલાએ ઉપલાજ ફંડમાં.

૧૦૦૦ શેઠ બરજોરજી નશરવાનજી વકીલે ઉપલાજ ફંડમાં.

૨૦૦૦ એક જરથોસતી તરફથી ઉપલાજ ફંડમાં.

૨૦૦૦ શેઠ અરદેશર દોસાભાઇ હકીમે ઉપલાજ ફંડમાં.

૫૦૦ શેઠ રૂસતમજી બેરામજી જીજીભાઇએ ઉપલાજ ફંડમાં.

૧૦૦૦ શેઠ રતનશાહ નશરવાનજી ગેયારાએ ઉપલાજ ફંડમાં.

૧૩૦૦ બાઇ ધનબાઇ સોરાબજી બારીયાએ ઉપલાજ ફંડમાં.

૧૦૦૦ શેઠ દાદાભાઇ ધનજીભાઇ બારીયાએ ઉપલાજ ફંડમાં.

૫૦૦૦ શેઠ દોરાબજી ખરશેદજી શરાફે ઉપલાજ ફંડમાં.

૧૦૦૦ ખા૦ બા૦ બેરામજી પેસતનજી નાગપોરવાલાએ ઉપલાજ ફંડમાં.

૪૦૦૦ શેઠ રૂસતમજી મનચેરજી કુકાએ ઉપલાજ ફંડમાં.

૨૦૦૦ એક જરથોસતીએ ઉપલાજ ફંડમાં.

૨૦૦૦ શેઠો હોરમજી, ફેરોઝાબાદ, સોરાબજી અને સાવકશાહ કાવસજી દીનશાહે ઉપલાજ ફંડમાં.

૧૧૦૦ બાઇ બાનુબાઇ ફ. કેમેસરીએટવાલાએ ઉપલાજ ફંડમાં.

૧૦૦૦ શેઠ પેસતનજી ન. બાવાઆદમે ઉપલાજ ફંડમાં.

૨૫૦૦ શેઠ એદલજી રૂસતમજી ઘડીઆલીએ ઉપલાજ ફંડમાં.

૧૫૦૦ શેઠ હોરમસજી પેસતનજી કાપડીયાએ ઉપલાજ ફંડમાં.

૧૫૦૦ શેઠ ફરદુનજી હોરમસજી બનાજીએ ઉપલાજ ફંડમાં.

૧૦૦૦ શેઠ રતનજી જમશેદજી દુબાશે ઉપલાજ ફંડમાં.

૧૫૦૦ શેઠ જાહાંગીર રતનજી દુબાશે ઉપલાજ ફંડમાં.

૧૨૦૦ બાઇ આવાંબાઇ મે. સા. પોંચાએ ઉપલાજ ફંડમાં.

૧૨૦૦ બાઇ ધનબાઇ બેરામજી મલબારીએ ઉપલાજ ફંડમાં.

૨૦૦૦ શેઠો રતનજી શાપુરજી, તથા નાદીરશાહ મં. શા. તાતાએ ઉપલાજ ફંડમાં.

૨૦૦૦ શેઠ ધનજીશાહ ફરામજી કંત્રાકટરે ઉપલાજ ફંડમાં.

૯૫૦ બાઇ ડોસીબાઇ અરદેસર ખ. દારૂવાલાએ ઉપલાજ ફંડમાં.

૫૦૦ શેઠ બીખાજી ફરામજી ખાને ઉપલાજ ફંડમાં.

૧૪૦૦ શેઠ નસરવાનજી જાં. બોગાએ ઉપલાજ ફંડમાં.

૨૦૪૬૫ સુરત અનજુમનના કારોબારીઓએ ઉપલાજ ફંડમાં.

૫૦૦ શેઠ અરદેશર ફરદુનજી દલાલે ઉપલાજ ફંડમાં.

૧૦૦૦	શેઠ કુંવરજી દાદાભાઇ તાડીવાલાએ ઉપલાજ ફંડમાં.
૫૦૦	શેઠો છોઇ કુક્રાની કુંપનીએ ઉપલાજ ફંડમાં.
૫૦૦	એક જરથોસ્તી (દો. હો. મી.)એ ઉપલાજ ફંડમાં.
૮૫૦૦	શેઠ મેરવાનજી પેસતનજી હકીમે ઉપલાજ ફંડમાં.
૧૦૦૦	શેઠ કુંવરજી દાદાભાઇ તાડીવાલાએ ઉપલાજ ફંડમાં.
૧૨૦૦	શેઠ પીરોશાહ સોરાબજી મેહેનતીએ ઉપલાજ ફંડમાં.
૧૦૦૦	શેઠ ઉકરજી કાવસજી ઉમરીગરે ઉપલાજ ફંડમાં.
૧૫૦૦	શેઠ રૂસતમજી ફીરોજશાહ દમરીએ ઉપલાજ ફંડમાં.
૨૫૦૦	શેઠ ફીરોજ મ. કલગવાલાએ મદ્રાસની બજલ ફીરોઝ દરેહમેહેર ફંડમાં.
૨૦૦૦	ઝહાંગીરડી અનજુમનના કારોબારીઓએ ઝહાંગીરડી અનજુમન ફંડમાં.
૩૩૦૦	વેસુ અનજુમનના કારોબારીઓએ વેસુ અનજુમન ફંડમાં.
૨૦૦૦	સીમલા અનજુમનના કારોબારીઓએ સીમલા અનજુમન ફંડમાં.
૨૦૦૦	આબુરોડ તથા માઉંટ આબુની અનજુમનના કારોબારીઓએ આબુરોડ તથા માઉંટ આબુ અનજુમન ફંડમાં.
૨૦૦૦	સંજાણ મેમોરીયલ ફંડના કારોબારીઓએ સંજાણ મેમોરીયલ ફંડમાં.
૧૦૦૦	બાઇ રતનબાઇ મે. ખરેગાટે શેઠ શા. જી. વ.છાના ખાતામાં.
૫૦૦૦	બાઇ ધનબાઇજી પેસતનજી હકીમે બાઇ ધનબાઇજી પે. હકીમે માતાજીની નઇયતે કરેલા ખાતામાં.
૬૦૦૦	બાઇ ગુલબાઇ બમનજી પીટીટે શેઠ બમનજી દી. પીટીટ અને બાઇ ગુલબાઇ બમનજી પીટીટનાં ખાતામાં.
૫૦૦૦	ખા૦ બા૦ ડાકટર હોરમસજી લીમજીભાઇ બાટલીવાલાનાં વશીયતનામાંના એકજી-ક્યુટરોએ મરહુમ ખા૦ બા૦ ડા૦ હોરમસજી લી. બાટલીવાલાનાં ખાતામાં.
૬૦૦૦	શેઠ બેજનજી હોરમસજી ઓલપલેશે બાઇ મેહેરબાઇ તે શેઠ હોરમસજી એ. ઓલપલેશનાં ધણીયાણીનાં એકજીક્યુટરોએ પડાવેલાં ખાતામાં.
૨૧૦૯૬૦	શેઠ દોરાબજી ખરશેદજી શરાફ શેઠ દોરાબજી ખરશેદજી શરાફ કેલવણી માટે કરેલાં ખાતામાં.

૭૧૭૨૭૬

ધરમને લગતું ખાતું.

પારસી પંચાએતનાં શેહેનશાહી ધહમબાર ફંડ ખાતેથી આએ સાલમાં નીચલાં બાનુ અને ગ્રહસ્થોનો ધહમબાર કરવાનો વારો હતો અને તેઓએ અંજુમનના ધહમબારનાં ૬ જાહેર જમણો કરયા હતા:—બાઇ હમાબાઇ ફરામજી પીટીટ, બાઇ ગુલબાઇ બમનજી પીટીટ, શેઠ અરદેશર મેહેરજીભાઇ વીઃ જી. બાઇ જ… બાઇ નવરોજી વાડીઆ, શેઠ રતનજી ખરશેદજી વાડીઆ, અને શેઠ ફરદુનજી એ. ખરશેદજી ફરદુનજી. આ જમણો કાજે આગલ દરેક જમણ માટે રૂ૭૫૦ આપવામાં આવતા હતા પણ ગયા સાલથી જમવા આવનારાઓની સગવડ કાજે ખુરસી ટેબલ દાખલ કરયાથી રૂ૭૮૦ આપતા કરયા છે.

સ્વાનોને લગતું ખાતું.

કુલ જરથોસ્તી સ્વાંનોને અવલમંજલ પોહોચાડવાનાં ફંડમાંથી નજરેશાલાર અને ખાંધીઆઓ મલી ૫૦ થી ૫૬ જણને રોકવામા આવ્યા હતા, જેઓના અને એ ખાતાંના મેહેતાજી, માણસો,

રામોસીઓ અને માલીઓ વીગેરેના પગારના રૂ. ૭૦૦૧૫-૮-૨ થયા હતા. એ ખાતાંમાંથી વફાદારીથી લાંબી નોકરી બજાવનાર તશેગાલાર ખાંધીઆઓને પેનશન તરીકે તથા તેઓનાં મરણ બાદ તેઓની વીધવાઓને પગાર તરીકે મલી જણ ૨૨ ને દરેકને રૂ. ૪ થી ૧૮-૮-૦ સુધીની માસીક રકમ આપવામાં આવી હતી. આ ખાતાનાં જુદાજુદા લતાના માણસોની સારવાર નીચલા તબીબ સાહેબોએ કીધી હતી અને દવા આપી હતી તે માટે એ સાહેબોને જે આપવામાં આવ્યું હતું તે તેઓએ ધરમ ખાતે પાછું આપયું છે. એ મેહેરબાની માટે એ સાહેબોનો મોટો આભાર માનવામાં આવે છે. (૧) ડા૦ દાદાભાઇ નવરોજી સાહેર, (૨) ડાકટર નવરોજી બેજનજી દા૦ કાપડીઆ, (૩) ડાકટર ફ્રામજી એ. માદન.

લાચારીમા મદદને લગતાં ખાતાંઓ.

ચોપાટીની શેઠ ફરદુનજી સોરાબજી પારખની ધરમશાલામાં આ સાલની સેવટે ૫૦ મરદો અને ૫ બાઇઓ મલી ૫૫ જણ આશરો લેતા હતા. ડા૦ અરદેશર હોરમસજી ધાસવાલાએ એઓની સારવાર કીધી હતી. જરથોસ્તીઓ તરફથી આ સાલ સર અવસરે આખા દીવસના ૨૨૬, અને અરધા દીવસનાં ૨૪ ખાણા થયાં હતાં. આ સાલમાં દરેક રહીસોને નીચે પ્રમાણે કપડાં અને રોકડની ભેટ મલી હતીઃ-દરેક મરદને સદરા ૧૬, સેંગા ૬, કુસ્તી ૨, તોપી ૭, સલીપરની જોડી ૧, ચારસા ૩, બંદુશ ૧, દીલતુછનું ૧, અને દરેક સ્ત્રીને સદરા ૧૭, ઇજાર ૮, કુસ્તી ૩, બદીયાંન ૭, માથાંબાના ૮, મોજાની જોડી ૧, ચારસા ૩, બંદુશ ૧, સપાત જોડી ૧. દરેક મરદને આખાં વરસમાં રૂ. ૩૬-૧૫-૩, દરેક સ્ત્રીને રૂ. ૩૯-૧-૩.

મુંબઇનાં આંધલા પાંગલાં તથા લાચાર જરથોસ્તીઓની પરવરશી કરવા માટે પગાર આપવાના ફંડ ખાતેથી આશરો લેનારા તા૦ ૩૧ મી ડીસેમબર ૧૯૧૭ ને દીને બધાં મલી ૫૫૦ હતાં, તે આસામીઓને મોટે ભાગે રૂ ૩ થી રૂ ૫ સુધી પગાર આપવામાં આવ્યો હતો. ખાસ કેસોમાં કોઇકને રૂ. ૫ થી વધુ આપવામાં આવ્યો છે. એ ૫૫૦ જણમાં ૪૭૨ બાઇઓ અને ૭૮ મરદો હતા. આ ખાતેથી પગારની ફરે માસી રકમ ૨૨૯,૧૭૨ થઇ હતી. એ પગાર ઉપરાંત મોંઘવારીનાં ફંડમાંથી દરેક આસામીને નવેમબર માસથી રૂ૨, વધુ આપવામાં આવ્યા હતા. આ સાલમાં જુના પગારદારોમાંથી ગુજરી જવાથી તથા બીજા સબબોને લીધે જણ ૪૮ કમી થયાં હતા અને ૫૧ ના નવા પગાર કીધા હતા.

મુંબઈના તંગદસ્ત હાલતમાં આવેલા જરથોસ્તીઓને આશરો આપવાના ફંડ ખાતેથી આબરૂદાર જરથોસ્તીઓ જેઓ જમાનાની ગીરદેશીથી તંગદસ્ત હાલતમાં આવ્યા હોય, તેઓને આશરો આપવામાં આવે છે. તા૦ ૩૧ મી ડીસેમબરે એઓની સંખ્યા મરદ ૧૬, અને સ્ત્રીઓ ૭૨ મલી ૮૮ ની હતી. એ ખાતેથી મદદનાં ૩૫૬૦૮ આપવામાં આવ્યા હતા. એ પગાર ઉપરાંત મોંઘવારીના ફંડમાથી દરેક આસામીને નવેમબર માસથી રૂ ૨ વધુ આપવામાં આવ્યા હતા.

ગરીબ લાચાર જરથોસ્તી વીધવાઓને આશરો આપવાના ફંડ ખાતેથી આશરો લેનાર વીધવાઓની તા૦ ૩૧ મી ડીસેમબર ૧૯૧૭ ના દીને સંખ્યા ૧૫૯ ની હતી. તેઓને મોટે ભાગે રૂ ૩ થી રૂ. ૫ નો માસીક પગાર આપવામાં આવ્યો હતો, તેની રકમ ૩૮૨૬૩ ની થઇ હતી, એ પગાર ઉપરાંત મોંઘવારીના ફંડમાથી દરેક આસામીને નવેમબર માસથી રૂ ૨ વધુ આપવામાં આવ્યા હતા. એ સાલમાં જુના પગારદારોમાંથી ગુજરી જવાથી તથા બીજા સબબોને લીધે જણ ૧૮ કમી થયાં હતાં અને જણ ૪ ના નવા પગાર કીધા હતા.

મુંબઇનાં ગરીબ લાચાર જરથોસ્તીઓ ગુજરે તેઓના રવાનોને અવલમંજલ પોંહોંચાડવા તથા ધરમની કીયા વીગેરેનો દી ૪ નો ખરચ કરવા માટે આશરો આપવાના ફંડ ખાતેથી ૪૦ રવાનો માટે ૨૧૩૮૫ નો ખરચ કરવામાં આવ્યો હતો. શરૂઆતમા દરેક મોટા રવાંન

માટે રૂ૩૦ ની અને નાના માટે રૂ૧૦ થી રૂ૧૫ ની મદદ આપવામાં આવી હતી. પાછળથી મોંઘવારીને સબબે દર રવાન દીઠ રૂ૫, વધુ આપતા કરયા છે.

જરથોશતી માએ બાપોને પેટે જનમેલાં બાલકોને સુદરેહ પેહરાવવાનાં કારણુસર આશરો આપવાનાં ફંડ ખાતેથી આ સાલ ૧૪ બચાંઓને સુદરેહ પેહરાવવા માટે તેઓના ગરીબ માએ બાપોને રૂ૩૪૦ આપવામાં આવયા હતા દરેક બાલકની નવજોત માટે રૂ૨૫, અને જો એકી વખતે બે બાલકની નવજોત હોય તો રૂ૪૦ આપવામાં આવે છે.

ગરીબ લાચાર જરથોસ્તી છોકરીઓને પરણાવી આપવા માટે આશરો આપવાના ફંડ ખાતેથી આ સાલમાં ૪૩ છોકરીઓને પરણાવી આપવા માટે દરેક છોકરી દીઠ રૂ૭૫ પ્રમાણે રૂ૨૭૭૫ ની મદદ આપી હતી.

મુકતાદ ટાંકણે દેશાવરો ખાતેનાં આંધલાં પાંગલાં તથા લાચાર જરથોસ્તીઓને વેંહેચી આપવા સારૂં રૂપીયા વાલવાના ફંડમાંથી એ સાલ દેશાવરોનાં ૬૫૭ ગરીબ જરથોસ્તીઓને રૂ૮૯૧૪-૧૦-૦, તથા મુકતાદને ટાંકણે કોઈ પણ ઠેકાણેનાં આંધલાં પાંગલાં તથા ગરીબ જરથોસ્તીઓને વેંહેચી આપવા સારૂં રૂપીયા વાલવાના બીજા ફંડ ખાતેથી જણ ૪ ને રૂ૨૧૧ આપયા હતા. એ ગામોનાં નામ નીચે પ્રમાણે છે.–સુરત શેહેર તથા સુરતનાં પરાંઓ, સુરતને લગતાં ગામો (વેસુ, સુમાલી, અમરોલી, ઉધના), ઉદવાડા, દમણ (નાની તથા મોટી) તારાપોર, વલસાડ, ગણદેવી, સાદરવેલ, બીલીમોરા, ચીખલી, મેધોર, દેહેણું, દેવીએર, નારગોલ, તડગામ, મરોલી, નવસારી, નવસારીને લગતાં ગાંમડાંઓ (તવડી, બારડોલી, મહુવા, વીઆરા, શીઓડપુની, કાલા વરોલી), ભરૂચ, ભરૂચને, લગતું ગામ (અંકલેશર), ખેરગામ, વડોદરા, ખંભાત, પારડી, પ્રતાપનગર, દેવગઘ, બારીઆ, સોલાપોર, પુના, બેલગામ. ઉપલા કારણુસર ફરતી કરેલી ટીપમાં રૂ૫૫૮ ભરાયા હતા.

મુંબઇનાં લાચાર જરથોસ્તીઓને મુફત અનાજ આપવાનાં ફંડમાંથી આએ સાલ ગરીબ જરથોસ્તી જણ ૫૦ ને મુફત અનાજ અપાવયો તેના રૂ૫૩૨-૨-૦ થયા હતા.

ગરીબ જરથોસ્તીઓને ધંધે લગાડવાનાં કામમા મદદ આપવાનાં ફંડમાંથી જણ એકને ધંધો કરવા માટે રૂ૫૦૦ આપ્યા હતા.

ગરીબ જરથોસ્તીઓ માટે મોંઘવારીનું ફંડ–પંચાએતના ધરમખાતાંનાં ફંડોમાંથી આપણા ટોલાના ગરીબોને આશરો આપવા પગાર આપવામાં આવે છે તેઓને અનાજની મોંગ વારી થવાથી ગુજરાણ કરવું ભારી પડતું હોવાથી ત્રસ્ટી સાહેબોએ એ ફંડમાં નાણું ભરવા તા૦ ૯-૧૧-૧૯૧૭ ને દીને અરજ કરી હતી તેમાં આ સાલની સેવટ સુધીમાં રૂ૧૯૦૧૯ ભરાયા હતા, તેમાંથી ખાતાં નં૦ ૧૫, ૧૬, ૧૭, અને ૪૪ નાં સરવે ગરીબ પગારદારોને તેઓના પગાર ઉપરાંત નવેમબર માસથી દર માસે રૂ૨ દરેકને વધુ આપવામાં આવયા હતા. ઉપલો આશરો બીજાં વરસમાં પણ આપવા બાદ જે રકમ બાકી રહેશે તે લાચાર ગરીબોને પગાર આપવાનાં ફંડમાં ભવીશયમાં જમે કરવાની છે.

તનની દુરસ્તીને લગતાં ખાતાંઓ.

દીવાનશાલા મધેના ગરીબ લાચાર જરથોસ્તીઓની પરવરશીને લગતા ખરચને માટે મદદ આપવાનાં ફંડ ખાતેથી શેઠ નશરવાનજી માણેકજી પીટીટના ધરમખાતાંને આ સાલમાં રૂ૧૫૪૩ આપયા હતા.

ગરીબ પારસી બીમારોને હવાના ફેરફાર માટે જવા કાજે અને હડખા અથવા બીજા દરદોના ઇલાજ વીગેરે સબબો માટે મદદ કરવાના ફંડમાંથી જણ ૨૬ ને રૂ૮૦૫ ની મદદ આપી હતી એમાંથી જણ ૨૦ દેવલાલી ખાતે, જણ ૨ સીમલા તરફ ધરમપોર ખાતે, અને જણ ૪ બીજા ગામો ખાતે ગયાં હતાં

વીદયા અને કેલવણીને લગતાં ખાતાઓ.

મુંબઇ તથા દેશાવરો ખાતેની જરથોશતી જંદ અવસ્તાની નીશાળોનાં ફંડ ખાતેથી મુંબઇ અને દેશાવરો મલી ૩૨ નીશાળોમાં જંદ અવસ્તા અને જરથોસ્તી ધર્મને લગતાં મુળ તતવોનું ગ્નાન આપવામાં આવયું હતુ. ઉપરી એરવદ બમનજી–નશરવાનજી ધાભર એમ. એ.

સાથે એ ખાતાંમાં ૫૦ શીક્ષકોને રોકયા હતા. જેઓના પગારો વીગેરેની વાર્ષિક રકમ રૂ૫૧૧૧-૨-૮ ની થઇ હતી, એ રકમમાંથી રૂ૧૯૯૧ ની રકમ મુંબઇમાં સર જમશેદજી જીજીભાઇ પારસી બેનીવોલનટ ઇનસ્ટીટયુશનના છોકરાંઓને ધર્મ કેળવણી આપવા કાજે અને બાકીની બાહારગામોની એ ખાતાંની અને બીજી સ્કુલોના બાળકો માટે છે. એ નીશાળો નીચે પ્રમાણે જુદા જુદા ગામો ખાતે હતીઃ-૫ મુંબઇ, ૧ મહુવા, ૧ ભરૂચ, ૧ દેવીએર, ૧ રાજકોટ, ૧ વલસાડ, ૩ નવસારી, ૧ બારડોલી, ૧ નારગોળ, ૧ ભાઠા, ૧ વીયારા, ૧ સરોડા, ૧ ઉદવાડા, ૧ કુદીઆણા, ૧ ધ્રગતપુરી, ૧ સોલાપોર, ૧ ખંભાત, ૧ બદનેરા, ૧ તારાપોર, ૧ ગણદેવી, ૧ બીલીમોરા, ૧ ખેરગામ, ૧ ઓરપાડ, ૧ તડગામ, ૧ કરંજ, ૧ ભગવા.

નામદાર સર જમશેદજી જીજીભાઇ પેહેલા બેરોનેટની યાદગારીને સારૂ ઉભી કરેલી જરથોસ્તી મદરેસા ફંડ ખાતેથી એ મદરેસાના પેહેલવી અવસ્તા અને સંસકૃત ભાષાઓના શીક્ષકો વીગેરેના આ સાલ રૂ૫૭૨૦ થયા હતા અને વીદયાર્થીઓના સ્કોલરશીપના રૂ૨૧૯૬ થયા હતા. આ સાલની છેવટે મદરેસામાં ૪૫ વીદયારથીઓ હતા. સંસકૃત વગરનો લાભ એ સાલમાં ૧ જણે લીધો હતો.

નામદાર સર જમશેદજી જીજીભાઇ ત્રાનસલેશન ફંડ ખાતેથી ૨૫ પુસ્તકોને નાનો મોટો આશરો આપવામાં આવ્યો હતો. જુદાં જુદાં પુસ્તકોને આશરો આપવા વીગેરે પાછળ એ સાલ કુલે ખરચ રૂ૩૩૦૫-૮-૦ નો થયો હતો, એઓમાં નીચલાં પુસ્તકો જરથોસ્તી ધરમ, તવારીખ, સંસાર અને સાહીતયને લગતાં હતાંઃ-ગુજરાતી ફીરદોસી- શાહનામું (બએતોમાં) ભાગ ૨ જો અને ૩ જો, અશો જરથોસ્ત, સંક્ષેપ શાહનામું, કીસસે-સંજાણ, Knights of Bihstoon, ઇરાનનું કેઆનીયન વંશ, Step to Prophet Zoroaster, યજશને બા નીરંગ, (કદમી) પાજંદ આફરીન બા માએની તથા ૧૦૧ નામો, રેસાલહે ખુરશેદ, ઇરાની શહેનશાહતનો ઇતીહાસ વો. ૧ લું, શાહાનામું વો. ૮ અને ૯, પેહેલવી ટેક્ષ્ટ ભાગ ૧ લો, દીનકરદ વો. ૧૬ મું, ચેરાગ, ઇજસને બા નીરંગ (શહેનશાહી), The Avesta Selections prescribed by the Bombay University for the first year's course in Arts for the year 1917-18, રીસ્ટીરટાન યાને ગુજરેલાં જરથોસતીઓની ક્રીયાઓનું વરણન, Lessons in Pahalavi Pazend Pt. I (Second Edition), પારસી પ્રકાશ દફતર ૩ જું ભાગ ૮ મો, પારસી પ્રજાકીય ઝુંડો, અશો જરથોસ્તની જીંદગીનો ટુંક અહેવાલ, ઝોરાસ્ત્રીયન કેલેનડર સને ૧૨૮૭ ય. જ.

બાપ વીનાના બચયાં તથા વીધવાના ખાતેથી મુંબઈની શેઠ જમશેદજી નશરવાનજી પીટીટ ઓરફ્નેજમાં ૬ છોકરાઓને તથા સુરતની ઓરફ્નેજમાં ૪ છોકરાઓને રખાવયા હતા. એ ઉપરાંત સર જમશેદજી ઇનસટીટયુશનના ઓરફ્ન છોકરાઓને ટાઇપરાઇટીંગ, બુક કીપીંગ વગેરે શીખાડવાનો ખરચ કીધો હતો. ઓરફ્ન વીદયારથીઓને કોલેજની ફી વીગેરેની મદદ આપી હતી તથા વીધવાઓને અને ઓરફ્નોને માસીક મદદ આપી હતી, તેનો કુલે ખરચ રૂ૫૯૧૦-૧-૭ નો થયો હતો. વીધવાઓ તથા ઓરફનને માસીક મદદ ઉપરાંત મોગવારીના ફંડમાંથી દરેક આસમાને નવેમબર માસથી રૂ૨ વધારે આપવામાં આવયા હતા.

જરથોસ્તી વીદયારથીઓને વીદયાઅભયાસ માટે મદદ કરવાના ફંડ ખાતેથી ચોપડીઓ ખરીદવા માટે વીદયારથીઓ જણ ૪ ને મદદ આપી હતી, તેનો રૂ૨૫૪-૬-૦ નો ખરચ થયો હતો.

શેઠ દોરાબજી ખરશેદજી શરાફે રૂ૨૧૦૯૬૦ ના બજાર ભાવના જુદી જુદી કું. ના શેરો ત્રસ્તી સાહેબોને આપયા છે ને તેનું એક જુદું ખાતું. (નં. ૪૫૧) પંચાએતને દફતરે આ સાલમાં પડાવયું છે અને તેની આવક આપણી કોમમાં કેળવણી કાજે વાપડવાની છે.

સ્થાવર મીલકત.

ત્રસ્ટી સાહેબોએ હયુઝ રોડ અને ગીબસરોડ વચેની પોતા હસ્તકની કેટલીક જગયા ઉપર વસવાટના મકાનો ધરમ ખાતે બંધાવવા કાજે શરૂઆતમાં ૧૨ પલોટો કરયા હતા તયાર પછી

૧૯૧૬ માં બીજા વધુ નાના ૫ પ્લોટો કરયા છે. કુલે ૧૭ પ્લોટો હાલ સુધીમાં થયા છે. મુખડા ઉપરના એક પ્લોટ નં૦ ૫ ઉપર અને પછવાડેના ના પ્લોટો નં. ૬ થી ૧૪ ઉપર મકાનો બંધાઇ ચુકયાં છે.

મીટીંગ અને બનાવ.

ટ્રસ્ટીઓની મીટીંગ—આ સાલમાં ટ્રસ્ટી સાહેબોની કુલે ૨૫ મીટીંગ ઓફીસ ખાતે મળી હતી.

ઇનામનો મેલાવડો—તા૦ ૧૭ મી અકટોબર સને ૧૯૧૭ ને દીને સર જમશેદજી ઇનસ્ટીટયુશનના મકાનમાં શેઠ મેરવાનજી મનચેરજી કામાના પ્રમુખપદ હેઠલનો એક મેલાવડો જે જરથોસ્તી ધર્મ સંબંધી કેલવણી આપનારી અને જ્ઞાન ફેલાવનારો મંડળી હરતકના વરગોના બાળકોને ઇનામો આપવા કાજે ભેગો મળગો હતો તેમાં મુંબઇની જંદ અવસ્તાની નીશાળોના બાળકોને ઇનામો આપવામાં આવયાં હતાં.

અનજુમનની મીટીંગો—યુરોપમાં ચાલતી લડાઇમાં નામદાર બ્રીટીશ રાજય તથા મીત્ર રાજયોને ફતેહ મળે તે સારૂ પારસી કોમ તરફથી મરહુમ શેઠ હોરમશજી બમનજી વાડયાના આતશબેહેરામનાં દીવાનખાનામાં તા૦ ૪ થી ઓગસ્ટ સને ૧૯૧૭ ને દીને બંદગી કરવામાં આવી હતી.

મરહુમ શેઠ દાદાભાઇ નવરોજી, એલ. એલ. ડી. ના માનમાં અનજુમનની સભા બોલાવવા માટે ટ્રસ્ટી સાહેબોને મલેલાં રેકવીઝીશનની રૂએ અનજુમનની એક સભા ઓલબલેસ બાગમાં તા૦ ૨૭ મી સપટેમબર સને ૧૯૧૭ ને દીને મળી હતી.

નીચલાં ખાતાંઓ તરફ મદદ કાજે જરથોસ્તી સાહેબોનું ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે.

૧—પારસી પંચાયતના વખતો વખતના ટ્રસ્ટીઓએ પોતાની નજરમાં આવે એવા જરથોશતીઓના ફાયદાને માટે ચુંટી કાઢેલા સખાવતી કામ યા કામોમા વાપરવા માટેનું ફંડ. ૨—ગરીબ જરથોસ્તી બાપ વીનાના બચાં તથા વીધવાઓને મદદ કરવાનું ફંડ–આ ફંડની મકસદ આ છે કે ગરીબ જરથોશતી બાપ વીનાના બચાં તથા વીધવાઓને કોઇ પણ રીતે મદદ આપવી અથવા તેઓના લાભને માટે કોઇ પણ રીતે ખરચ કરવો, જેમકે બચાંઓને ઓરફનેજમા મોકલવાનો, અથવા મા યા વાલી સાથે રહેતા હોય તો ભરણ પોશણ અને કેળવણીનો ખરચ આપવો, અથવા વીધવાઓના વરક કલાસમા જવા અથવા નરસીંગ શીખવા અથવા એવો બીજો ધંધો શીખવા અથવા ધંધાના ઓજારો વીગેરે લેવા માસીક અથવા ઉચક મદદ આપવી, અથવા જે ખાતાઓ એવા બચાંઓને અથવા વીધવાઓને મદદ આપતા હોય તેઓને ઉચક અથવા માસીક મદદ આપવી. ૩—પારસી સંકટ નીવારણ ફંડ જેમાંથી પારસી ઉડતા રોગની હોસ્પીટલનો ખરચ પણ થાય છે. ૪—ચોપાટીની ધરમશાળા મધે આંધલાં પાગલાં તથા લાચાર જરથોસ્તીઓને રાખીને પરવરશી કરવાનું ફંડ. ૫—મુંબઇના આંધલાં પાગલાં તથા લાચાર જરથોસ્તીઓની પરવરશી કરવા માટે પગાર આપવાનું ફંડ. ૬—મુંબઇ તથા દેશાવરો ખાતેની જરથોશતી જંદ અવસ્તાની નીશાલોનું ફંડ. ૭—ગરીબ પારસી બીમારોને હવાનો ફેરફાર માટે જવા કાજે અને હડખાં અથવા બીજા દરદોના ઇલાજ વીગેરે સબબો માટે મદદ કરવાનું ફંડ. ૮—કુલ જરથોસ્તી રવાનોને અવલમંજલ પોંચાડવાનું ફંડ. ૯—ગરીબ લાચાર જરથોસ્તી વીધવાઓને આશરો આપવાનું ફંડ. ૧૦—ગરીબ જરથોસ્તીઓને સસ્તો અનાજ આપવાનું ફંડ.

કલકત્તાના જરથોસ્તી અંજુમનના ધરમનાં ફંડોની વીગત.

ટ્રસ્ટીઓ—શેઠ નવરોજી જામાસપજી અરજાની, શેઠ ખરશેદજી હી. મા. રૂસ્તમજી અને શેઠ એદલજી પેસતનજી ગજદર— એવોને હસ્તક નીચલાં ફંડો ચાલે છે અને તેની બાકી રકમ સને ૧૯૧૮ ના સાલવી નીચે મુજબ છે:—

૨૩૭૬૧	૧૪	૩	કલકતાની જરથોસ્તી અનજુમનના ધરમનું ફંડ.
૧૫૫૬૩	૧૩	૧	કલકતાના દોખમાની આસપાસની તથા તેની બહારના બગીચાવાલી અંજુમનની આખી જગાપર પુરણી કરવા તથા દોખમાં તથા દીવાલ વીગેરેની મરામત કરવાનું ફંડ.
૨૧૦૬૫	૯	૮	મરહુમ શેઠ રૂશતમજી કાવસજી બનાજીના ગહમબારનું ફંડ.
૧૬૬૦૦	૧૩	૨	શેઠ બેહરામજી જીજીભાઇ કલકતાના જરથોસ્તી રવાનોને અવલમંજલ પહોંચાડવાનું ફંડ.
૮૫૦૦	૦	૦	સર દીનશાહ માણેકજી પીટીટ બારોનેટના ધરમખાતે.
૧૦૦૦	૦	૦	બેહેસતનશીન શેઠ કાવશજી દીનશાજી પીટીટના પુણને સારૂ તેવણના છોકરાઓ શેઠો હોરમશજી, ખરશેદજી, અરદેશર તથા સોરાબજીને નામે તેઓના બપાવા સર દીનસાજી માણેકજી પીટીટ બારોનેટે આપેલી નોટ.
૫૦૦	૦	૦	બેહેસતનશીન શેઠ મેરવાનજી કાવશજી દીનશાજી પીટીટના પુન સાર તેવણના બપાવા સર દીનશાજી માણેકજી પીટીટ બારોનેટે આપેલી નોટ.
૧૦૦૦	૦	૦	શેઠ બેરામજી જીજીભાઈ સી. એસ. આઈ. ના ધરમખાતે.
૧૦૦૦	૦	૦	શેઠ ફરામજી મનચેરજી બુમલાએ પોતાની દીકરી બેહેશતનશીન બાઇ ગુલબાનુના પુણ સારૂ આપેલી નોટ.
૧૦૦૦	૦	૦	મુંબઈવાલા શેઠ કાવશજી બેજનજી કરાણીએ મરહુમ દીકરી બાઇ જીરનાઇજી તથા તેવણના દીકરા મરહુમ શેઠ બમનજી અરદેશર મોદીના પુણ સાર આપેલી નોટ.
૧૦૦૦	૦	૦	મરહુમ શેઠ કાવશજી ધનજીભાઇ પાઉંવાલાના પુણ સાર દીકરા શેઠ સોરાબજીએ આપેલી નોટ.
૨૧૦૪૯	૯	૦	શેઠ બેરામજી જીજીભાઇ સી. એસ. આઇ. એ આપેલી નોટ.
૧૦૦૦	૦	૦	શેઠો અરદેશરજી તથા જાંગીરજી નસરવાનજી મોદીએ પોતાના બેહેસતનશીન મુરબીજી નસરવાનજી બમનજી મોદીના પુણ સારૂ આપેલી નોટ.
૧૦૦૦	૦	૦	શેઠ કાવસજી બેજનજી દસતુરે આપેલી નોટ.
૧૦૦૦	૦	૦	સર દીનશાજી માણેકજી પીટીટ બારોનેટે પોતાના નબીરા બેહેસતનશીન શેઠ અરદેશર કાવસજી પીટીટના પુણ સારૂ કીધેલાં ધરમખાતે.
૨૫૦૦	૦	૦	હાંગકાંગ કનતાંન તથા મકાઉના જરથોસ્તી અનજુમનના ધરમખાતે.
૧૦૦૦	૦	૦	સર દીનશાજી માણેકજી પીટીટ બારોનેટે પોતાના ધણીઆણી લેડી સાકરબાઈ તે મરહુમ શેઠ ફરામજી ભીખાજી પાંડેના પુણ સારૂ કીધેલાં ધરમખાતે.
૧૫૦૦	૦	૦	શેઠ ફરામજી મ. બુમલાએ માતાજી બાઇ રતનબાઇ તે મરહુમ શેઠ મનચેરજી બુમલાખાકના વીધવાની યાદગારી કાયમ રાખવા સારૂ કીધેલાં ધરમખાતે.
૨૭૭૪	૫	૧	ઓનરેબલ સર દીનશાજી મા. પીટીટ બારોનેટ ઝોરાસ્ત્રીયન લાઇબ્રેરીનું ફંડ.
૧૨૬૦૦	૦	૦	સર દીનશાજી માણેકજી પીટીટ બારોનેટે લાઇબ્રેરીના આશ્રા માટે આપેલી નોટ.
૩૫૦૦	૦	૦	મરહુમ લેડી સાકરબાઈ દી. પીટીટ તે શેઠ ફરામજી ભીખાજી પાંડેના બેટીના પુણ સારૂ ધણી સર દી. મા. પીટીટ બારોનેટે તથા છોકરાંઓએ કીધેલાં ધરમખાતે.

૧૦૦૦	૦	૦	કલકતાના જરથોસ્તી અનજુમન તરફથી લાઇબ્રેરીના ફંડમાં ભરાયેલા નાણાં મધેથી લીધેલી નોટ ખાતે.
૫૦૦	૦	૦	મરહુમ શેઠ નશરવાનજી માણેકજી પીટીટના પુણ સારૂ તેવણુની પુંજીમાંથી એવણુના વીધવા બાઇ દીનબાઇ તે મરહુમ શેઠ મેરવાનજી જીજીભાઈ મુંગાના બેટીએ આપેલી નોટ.
૧૦૨૬	૦	૦	બેહેસતનશીન બાઇ નવાજબાઈ તે શેઠ રતનજી પાલનજી મીસતરીના બેટીના પુણ સારૂ કીધેલાં ધરમ ખાતે.
૧૬૦૨૧	૧૫	૬	કલકતાના જરથોસ્તી રવાનોને અવલમંજલ પહોંચાડવા વધુ માણસો બોલાવી રાખવાના અતરેની અનજુમને ઉભું કીધેલું ફંડ.
૧૦૦૦	૦	૦	સર દીનશાજી માણેકજી પીટીટ બારોનેટે કલકતાના રવાનોને અવલમંજલ પહોં-ચાડવા વધુ માણસો રાખવાના અંજુમને ઉભા કીધેલાં ફંડમાં આપેલી નોટ.
૫૦૯	૦	૦	બાઇ પીરોજબાઇ જમશેદજી માદને પોતાના મરહુમ માતાજી બાઇ દીનબાઈ તે ગુ૦ શેઠ નવરોજી કાવશજી મીનવાલાના ધણીઆણીના પુણ સારૂ આપેલી નોટ.
૧૦૦૦	૦	૦	શેઠ મેરવાનજી નાનાભાઇ મેહેતાએ પોતાના બેહેસતનશીન ધણીઆણી બાઇ નાલીબાઇના પુણ સારૂ આપેલી નોટ.
૫૦૦	૦	૦	મરહુમ શેઠ રતનજી પા. મીસતરીના પુણ સારૂ તેવણુની પુંજીમાંથી તેવણુના વીધવા બાઇ ગુલબાઈ તે મરહુમ શેઠ જી. ઉ. દારૂવાલાના બેટીએ આપેલી નોટ.
૫૦૦	૦	૦	મરહુમ શેઠ રૂસતમજી નવરોજી પટેલની યાદગારી કાયમ રાખવા સારૂ એવ-ણુના વીધવા બાઇ ડોશીબાઇએ આપેલી નોટ.
૫૦૯	૦	૦	શેઠ જમશેદજી ફરામજી માદને પોતાના મીત્ર મરહુમ શેઠ કુંવરજી બમનજી ગજદરના પુણ માટે આપેલી નોટ.
૨૩૭	૧	૯	કલકતાના જરથોસ્તી રવાનોને અવલમંજલ પહોંચાડવા સારૂ ગાડી મંગાવીતેનું ફંડ.
૨૦૦૦	૦	૦	બેહેશતનશીન બાઇ શીરીનબાઇ તે શેઠ રૂસતમજી ધનજીભાઇ મહેતા સી. આઈ. ઇ. ના ધણીઆણીના પુણ સારૂ આપેલી નોટ.
૫૦૦	૦	૦	શેઠો ફરામજી મનચેરજી તથા હીરજીભાઇ મનચેરજીએ મરહુમ માતાજી બાઇ રતન-બાઇ તે ગુ૦ શેઠ મનચેરજી બુમલાખાઉના ધણીઆણીના પુણ સારૂ આપેલી નોટ.
૭૦૦	૦	૦	મરહુમ શેઠ માણેકજી રૂસતમજી તથા તેવણુના ધણીઆણી બાઇ સાકરબાઇ માણેકજી રૂસતમજીના પુણ સારૂ કીધેલાં ધરમ ખાતે.
૮૧૫	૦	૦	મરહુમ શેઠ કેખશરૂ દાદાભાઇ ર. બનાજીના પુણ માટે તેવણુની પુંજીમાંથી ભાઇ શેઠ ફરામજી દાદાભાઇ બનાજી તથા બેહનો બાઇ શીરીનબાઇ શોરાબજી શાતી તથા બાઇ જરબાઇ કાવશજી માણેકજી રૂસતમજીએ આપેલી નોટ.
૫૦૦	૦	૦	શેઠ ફરામજી મનચેરજી બુમલાખાઉએ પોતાના વહુ મરહુમ બાઇ શીરીનબાઇ તે શેઠ રૂસતમજી ફરામજી બુમલાખાઉના ધણીઆણીના પુણ સારૂ કીધેલાં ધરમખાતે.
૮૮૮૦	૪	૪	મરહુમ શેઠ માણેકજી રૂસતમજી બનાજીની યાદગારી કાયમ રાખવા કલકતાની ધરમશાળાનું ખાતું.
૨૬૧૫	૦	૦	શેઠ જમશેદજી ફરામજી માદને, ખેશીઓએ તથા દોસતોએ પોતાના સગા તથા મીત્ર મરહુમ શેઠ રતનજી નવરોજી મીનવાલાના પુણ માટે આપેલી નોટ.
૫૦૦	૦	૦	મરહુમ શેઠ અરદેશરજી નશરવાનજી મોદીના પુણ સારૂ કીધેલાં ધરમખાતે.
૫૦૦	૦	૦	મરહુમ શેઠ અરદેશરજી નશરવાનજી મોદીના પુણ સારૂ ધરમશાળાને માટે કીધેલાં ધરમખાતે.

૬૯૩	૮	૩	બાઇ પીરોજબાઈ જમશેદજી માદને પોતાનાં મરહુમ બાઇ રતનજી નવરોજી મીનવાલાની યાદમાં આપેલી નોટ.
૧૦૦૦	૦	૦	મરહુમ શેઠ દીનશાહ ભીખાજી બામજીના પુણ માટે આપેલી નોટ.
૬૫૧૦	૭	૧	શેઠ ફરામજી મનચેરજી બુમલાખાઉ અસલ નવસારી મલેસરવાડી મોહલ્લાના વતની તે હાલ કલકતાના રહીશે મરહુમ સખીવજુદ પરદુખભંજન મુરંબીજી રુસતમજી જમશેદજી જીજીભાઇની યાદગારી કાયમ રાખવા કીધેલાં ધરમખાતે.
૪૪૩૦	૧૫	૦	શેઠ જમશેદજી ફરામજી માદને દારજીલીંગની આરામગાહની જગાના ખરચ યાને નીભાવ ફંડ માટે આપેલા રૂ૩૦૦૦ ના ધરમખાતે.
૧૦૨૫	૦	૦	શેઠ કાવસજી માણેકજી રુશતમજી તથા એવણની દીકરીઓ બાઇઓ ભીખાઇજી, ખરશેદબાઇ તથા મેહેરબાઇએ મરહુમ બાઇ જરબાઇ તે શેઠ કાવશજી માણેકજી રુશતમજીના ધણીઆણીના પુણ સારુ આપેલી નોટ.
૫૦૦	૦	૦	મરહુમ શેઠ હોરમશજી નશરવાનજી કુપરના પુણ સારુ આપેલા રૂ૫૦૦ના ખાતે.
૩૨૯૪	૭	૧	બાલીઆગતાની આરામગાહની જગાપર અશો ફરોહરની આરાધના કરવાનું ફંડ.
૨૦૦૦	૦	૦	મરહુમ શેઠ કાવશજી ધનજીભાઈ ગજદરના પુણ સારુ આપેલા રૂ૨૦૦૦ના ખાતે.
૩૦૦૦	૦	૦	મરહુમ શેઠ પેશતનજી એદલજી ગજદરના પુણ સારુ આપેલી રૂ૩૦૦૦ની નોટ.
૨૦૦૦	૦	૦	મરહુમ શેઠ પેશતનજી એદલજી ગજદરના પુણ સારુ આપેલી રૂ૨૦૦૦ની નોટ.
૫૦૦	૦	૦	શેઠ માણેકજી દીનશા માન્જુ તથા કુટુંબે મરહુમ શેઠ સોરાબજી દોરાબજી માન્જુના પુણ સારુ કીધેલા ધરમખાતે.
૫૦૦૦	૦	૦	મરહુમ શેઠ સોરાબજી દોરાબજી માન્જુના પુણ સારુ કીધેલાં ધરમખાતે.
૧૦૦૦	૦	૦	મરહુમ શેઠ કુવરજી દો. માન્જુ તથા સોરાબજી દો. માંન્જુના પુણ સારુ કીધેલા ધરમ ખાતે.
૫૦૦	૦	૦	મરહુમ શેઠ સોરાબજી દોરાબજી માન્જુની યાદગારી કાયમ રાખવા એઓના બેશીઓએ કીધેલાં ધરમખાતે.
૧૨૨૪	૦	૦	મરહુમ શેઠ ફરામજી પેશતનજી નાલાદાર તથા શેઠ બેરામજી ફરામજી નાલાદારના પુણ સાર કીધેલાં ધરમખાતે.
૬૦૦	૦	૦	શેઠ કાવશજી પાલનજી ખટાઉએ પોતાની યાદગારી રાખવા કીધેલાં ધરમખાતે.
૩૦૦૦	૦	૦	મરહુમ શેઠ કુવરજી એદલજી ગજદરના પુણ સારુ કીધેલાં ધરમખાતે.
૬૧૨	૦	૦	શેઠ જમશેદજી ફરામજી માડને પોતાના મીત્ર ડા૦ નશરવાનજી નવરોજી પારખના ધણીઆણી બાઇ આવાંબાઈ તે મરહુમ શેઠ સોરાબજી જીવાજી નાજરના બેટીના પુણ સારુ કીધેલાં ધરમખાતે.
૩૩૩૭૩	૧૧	૨	મરહુમ શેઠ પેસતનજી એદલજી ગજ્દરની યાદગારી કાયમ રાખવાના ધરમખાતે.
૬૧૨	૦	૦	મરહુમ શેઠ ફરામરોજ કાવશજી પાઉવાલાના પુણ સારુ કીધેલાં ધરમ ખાતે.
૧૨૨૪	૦	૦	મરહુમ બાઇ પીરોજબાઇ ફરામજી નાલાદાર તથા મરહુમ બાઇ મેરબાઇ બેરામજી નાલાદારના પુણ સારુ કીધેલાં ધરમખાતે.
૫૦૦	૦	૦	મરહુમ શેઠ બેરામજી જીજીભાઇ સી. એસ. આઇ. નાં પુણ સારુ તેઓના નબીરા શેઠ રુશતમજી બેરામજી જીજીભાઇએ પડાવેલાં ધરમ ખાતે.
૨૫૮૭	૮	૦	મરહુમ બાઇ નવાજબાઇ શોરાબજી માંન્જુનાં ધરમખાતે.
૮૧૨	૦	૦	મરહુમ બાઇ આવાંબાઈ દારાશા ઇનશપેકતરના પુણ સારુ કીધેલાં ધરમખાતે.
૧૦૧૨	૦	૦	મરહુમ શેઠ ફરામજી હોરમજજી અરજાનીના પુણ સાર કીધેલાં ધરમખાતે.
૨૫૫૭૩૪	૧૪	૦	

ચીનના જરથોસ્તી અંજુમનનાં ધરમનાં ફંડોની વીગત.

ત્રસ્ટીઓ—શેઠ નવરોજી હોરમજી મોદી, શેઠ દીનશાહ કાવસજી શેડના, શેઠ ફરામરોજ પેસતનજી શરાફ, શેઠ બરજોરજી પેશતનજી મેહતા અને શેઠ હોરમસજી કેખશરૂ ઇરાની.

ઉપલા ત્રસ્ટી સાહેબો હસતક સને ૧૯૧૮ ના સાલની ચીનની જરથોસ્તી અનજુમનનાં નીચલાં જુદાં જુદાં ધરમખાતાંના ફંડોની કુલે પુંજી ડા. ૧૨૧૫૩૩)૩૧ ની છે, તેમાંથી હાંગકાંગ કનટાન અને વાંમપુની રવાનની જગાનો તેમજ અનજુમનનાં મકાંનનો સરવે ચાલુ ખરચ કરવામાં આવે છે. કોઇ ગરીબ જરથોસ્તી નાચારી હાલતમાં આવ્યો હોય તો તેને આશરો આપવામાં આવે છે અને કોઇ લાચાર જરથોસ્તીનું મરણ નીપજ્યું હોય તો તેનો ઘટતો ખરચ કરવામાં આવે છે. લાચાર ચીનાઓને આશરો આપવા ઉભાં કીધેલાં ફંડમાંથી દર સાલ તેવા લાચાર ચીનાઓને મદદ આપવામાં આવે છે, અને ધહમબાર ફંડમાંથી દર સાલ ધહમબારનું જશન તથા ખાનું કરવામાં આવે છે.

૨૫૫૭૨)૪૭	હાંગકાંગ, કનટાન અને મકાઉનાં જરથોસ્તીઓનાં ધરમનાં ફંડ ખાતે.
૧૫૮૧૩)૨૨	લાચાર આંધલાં પાંગલાં ચીનાઓને આશરો આપવાનાં ફંડ ખાતે.
૧૨૫૪૩)૪૭	વીકટોરીયા જુબીલી પારસી ચેરીટી ફંડ ખાતે.
૪૭૮૩)૫૦	હાંગકાંગની જરથોસ્તી અનજુમનનાં ધમબારનાં ફંડ ખાતે.
૧૩૮૯૦)૯૭	શેહેનગાહીની રૂવાનની જગા બદલ મળેલી રકમ ખાતે.
૧૦૦૫)૪૦	એમોયની રૂવાનની જગા ખાતે.
૫૦૦)	મરહુમ શેઠ નશરવાનજી નાનાભાઇ પટેલના પુણ સારૂ કીધેલાં ધરમ ખાતે.
૫૦૦)	મરહુમ શેઠ રતનજી બેહેરામજી બીસનીનાં પુણ સારૂ કીધેલાં ધરમ ખાતે.
૫૦૦)	મરહુમ શેઠ એદલજી ફરામજી કરાંણીના પુણ સારૂ કીધેલાં ધરમ ખાતે.
૫૦૦)	મરહુમ શેઠ નશરવાનજી બમનજી મોદીનાં પુણ સારૂ કીધેલાં ધરમ ખાતે.
૫૦૦)	મરહુમ શેઠ દાદાભાઇ કાવશજી તાતાનાં પુણ સારૂ કીધેલાં ધરમ ખાતે.
૧૦૦૦)	મરહુમ શેઠ ધનજીભાઇ રતનજી બીસનીની યાદગારી કાયમ રાખવા સારૂ હાંગકાંગ, કનટાનનાં જરથોસ્તીઓએ કીધેલાં ધરમ ખાતે.
૫૦૦)	મરહુમ શેઠ ખરશેદજી બમનજી શેડનાનાં પુણ સારૂ કીધેલાં ધરમ ખાતે.
૫૦૦)	મરહુમ શેઠ એદલજી નવરોજી મહેતાનાં પુણ સારૂ કીધેલાં ધરમ ખાતે.
૨૨૭૨)૭૩	મરહુમ સર દીનશાહજી માણેકજી પીટીટ બારોનેટે પોતાના ધણીયાંણી લેડી શાકરબાઇ તે મરહુમ શેઠ ફરામજી ભીખાજી પાંડેનાં બેટીનાં પુણ સારૂ કીધેલાં ધરમ ખાતે.
૯૦૯)૦૯	મરહુમ શેઠ ફરામજી દીનશાજી પીટીટ, શેહેનશાહબાનુ વીકટોરીયાની જુબીલીનાં ટાંકણાંસર યુરોપ, અમેરીકા તથા જાપાનની મુસાફરી કરી હાંગકાંગ સને ૧૮૮૭ નાં સાલમાં આવયા હતા તેની યાદગારી રાખવા સારૂ આપેલી નોટને ખાતે.
૨૦૫૭)૨૮	કનટાનના જરથોસ્તીઓના ધહમબારના ફંડ ખાતે.
૫૦૦)	શેઠ અરદેશર હોરમસજી ચીનાઇએ પોતાના બાવાજી, માતાજી તથા ભાઇ કાવશજીના પુણ સારૂ કીધેલાં ધરમ ખાતે.
૯૦૫)૦૯	મરહુમ શેઠ નશરવાનજી માણેકજી પીટીટનાં પુણ સારૂ તેવણની પુંજીમાંથી એવણના વીધવા બાઈ દીનબાઈ તે મરહુમ શેઠ મેરવાનજી જીજીભાઇ મુંગાનાં બેટીએ આપેલા રૂ૨૦૦૦ નાં બોમબે પોરટ ટરસટ બોંડને ખાતે.
૨૯૭૨)૭૩	મરહુમ સર દીનશાજી મા. પીટીટ બારોનેટે પોતાની યાદગારી સારૂ કીધેલાં ધરમ ખાતે.
૫૦૦)	મરહુમ શેઠ નશરવાનજી દાદાભાઈ ઓલીયાએ કીધેલાં ધરમ ખાતે.
૫૦૦)	મરહુમ શેઠ મેહેરવાનજી બેહેરામજી પાલીસવાલાએ પોતાના બાવાજી શેઠ બેરામજી તથા માતાજી બાઇ કુંવરબાઇનાં પુણ સારૂ કીધેલાં ધરમ ખાતે.
૫૦૦)	મરહુમ શેઠ એદલજી માણેકજી કાપડીયાએ પોતાના બેહેસતનશીન દીકરા શેઠ અરદેશરજીનાં પુણ સારૂ કીધેલાં ધરમ ખાતે.
૧૦૦૦)	શેઠ બમનજી પાલનજી કરંજીયા ૧૮૯૮ ની ૩ જી ડીસેમબરે મુંબઇમાં ફૈક થયા તેવણના પુણ માટે તેવણની પુંજીમાંથી તથા તેવણનાં ખેશીઓએ ભરેલી રકમને ખાતે.

૫૦૦) મરહુમ શેઠ જમશેદજી જામાસપજી ઉનવાલા તે હાંગકાંગના રૂ તથા સુતરના દલાલે પોતાના બાવાજી આ૦ જામાસપજીનાં પુણ સાર કીધેલાં ધરમ ખાતે.

૫૦૦) મરહુમ શેઠ જમશેદજી જામાસપજી ઉનવાલાએ પોતાના માતાજી માણેકબાઇ તે આ૦ એદલજી દોરાબજી કોટવાલના બેટીનાં પુણ સાર કીધેલાં ધરમ ખાતે.

૩૪૩૨)૩૬ મરહુમ શેઠ દોરાબજી નવરોજીએ પોતાની યાદગારી સારૂ કીધેલાં ધરમ ખાતે.

૧૦૦૦) શેઠ માણેકજી પેસતનજી તલાટીએ પોતાનાં મરહુમ માતાજી બાઇ મોતીબાઇ તથા મરહુમ પીતાજી પેસતનજી મેરવાનજી તલાટી તથા કાકાના દીકરા મરહુમ શેઠ સોરાબજી નશરવાનજી તલાટીનાં પુણ સારૂ કીધેલાં ધરમ ખાતે.

૫૦૦) મરહુમ શેઠ બમનજી બેરામજી ધનાપટેલે પોતાની દીકરી બેહેસતનશીન બાઇ આઇ-માય તે શેઠ અરદેશર કાવશજી કામાનાં ધણીયાણીનાં પુણ સારૂ કીધેલાં ધરમ ખાતે.

૨૫૦૦) મરહુમ શેઠ દોરાબજી નવરોજીએ પોતાના ધણીઆણી બાઇ મોતીબાઇની યાદગારી સારૂ કીધેલાં ધરમ ખાતે.

૭૦૦) મરહુમ શેઠ બમનજી બેહરામજી ધનાપટેલનાં પુણ સારૂ તેવણના વીધવા બાઇ દીનબાઇએ કીધેલાં ધરમ ખાતે.

૧૦૦૦) શેઠ પેસતનજી ફરામજી તલાટીએ પોતાના મરહુમ બાવાજી શેઠ ફરામજી મેરવા-નજી તલાટી અને ભાઇઓ બેજનજી તથા પાલનજીના પુણ સારૂ કીધેલાં ધરમખાતે.

૫૦૦) મરહુમ શેઠ જમશેદજી જામાસજી ઉનવાલા તે હાંગકાંગના રૂ, સુતરના દલાલનાં પુણ સારૂ તેવણના ભાણેજ મરહુમ ભાઇ જાહાંગીર નવરોજી કાતરકે કીધેલાં ધરમખાતે.

૫૦૦) મરહુમ શેઠ એદલજી શાપુરજી લાહેરના પુણ સારૂ તેવણનાં વીધવા બાઇ શીરીન-બાઇએ કીધેલાં ધરમ ખાતે.

૫૦૦) મરહુમ શેઠ જાહાંગીરજી પેસતનજી ખરાસનાં પુણ સારૂ તેવણની પુંજીમાંથી કીધેલાં ધરમ ખાતે.

૨૫૦૦) મરહુમ શેઠ બેરાંમ આદર ઇરાની કંડારીએ પોતાનાં તા૦ ૧ લી જુલાઇ ૧૯૦૧ ની તેરીખના વીલમાં ફરમાવ્યા મુજબ તેવણનાં અને તેવણનાં ખેશીઓનાં પુણ સારૂ તેવણનાં એકઝીકયુટર શેઠ ફરામજી હોરમજજી અરજાનીએ ઉઘાડેલાં ધરમ ખાતે.

૫૦૦) શેઠ ધનજીભાઇ દોરાબજીએ પોતાના મરહુમ બાવાજી શેઠ દોરાબજી નવરોજીની યાદગારી કાયમ રાખવા કીધેલાં ધરમ ખાતે.

૧૦૦૦) મરહુમ શેઠ દોરાબજી નવરોજીના પુણ સારૂ તેવણનાં ખેશીઓએ કીધેલાં ધરમખાતે.

૧૫૦૦) મરહુમ શેઠ દોરાબજી નવરોજીની યાદગારી કાયમ રાખવા સારૂ હાંગકાંગ, કંટાનનાં જરથોસતીઓએ કીધેલાં ધરમ ખાતે.

૫૦૦) મરહુમ શેઠ હોરમજજી નવરોજી કરંજીઆના પુણ સારૂ તેવણની પુંજીમાંથી તથા તેવણના ખેશીઓએ કીધેલાં ધરમ ખાતે.

૫૦૦) મરહુમ શેઠ હોરમજી મેરવાનજી મહેતાના પુણ સારૂ તેવણના વીધવા બાઇ કુંવરબાઇએ કીધેલાં ધરમ ખાતે.

૫૦૦) મરહુમ શેઠ દોરાબજી નવરોજીની યાદમાં એવણના દીકરા શેઠ ધનજીભાઇએ પોતાની અને પોતાના માતાજી અને ખેશીઓ તરફથી કીધેલાં ધરમ ખાતે.

૫૦૦) મરહુમ શેઠ નવરોજી પાલનજી કાતરકના પુણ સારૂ તેવણના દીકરા મરહુમ શેઠ જાહાંગીરજી નવરોજી કાતરકે કીધેલાં ધરમ ખાતે.

૫૦૦) મરહુમ શેઠ જાહાંગીર નવરોજી કાતરકના પુણ સારૂ એવણની પુંજીમાંથી એવણના માતાજી બાઇ પીરોજબાઇ નવરોજી કાતરકે કીધેલાં ધરમ ખાતે.

૩૦૦૦) શેઠ ધનજીભાઇ દોરાબજીએ પોતાનાં ધણીઆણી બાઇ ગુલબાઇની યાદગારી સારૂ કીધેલાં ધરમખાતે.

૫૦૦) મરહુમ શેઠ અરદેશર નશરવાનજી મોદીના પુણ સારૂ કીધેલાં ધરમ ખાતે.

૫૦૦) મરહુમ શેઠ બમનજી ભીમજીભાઇ બાટલીવાલાના પુણ સારૂ તેવણના દીકરાઓ રૂશ-તમજી, કેખશરૂ, શીયાવક્ષ તથા દીકરી બાઇ ખરશેદબાઇએ કીધેલાં ધરમખાતે.

૭૦૦) મરહુમ શેઠ સોરાબજી બેરામજી ભાભાએ પોતાના મરહુમ બપાવા કુંવરજી હોરમજી ભાભાના પુણ સારૂ કીધેલાં ધરમખાતે.

૭૦૦) મરહુમ શેઠ અરદેશર હો. ચીનાઇનાં પુણ સારૂ તેવણુની પુંજીમાંથી કીધેલાં ધરમખાતે.
૫૦૦) મરહુમ શેઠ હોરમજી ન. કુપરના પુણ સારૂ તેવણુની પુંજીમાંથી કીધેલાં ધરમખાતે.
૫૦૦) શેઠ પેસતનજી એ. ખંબાતાનાં પુણ સારૂ તેવણુની પુંજીમાંથી કીધેલાં ધરમખાતે.
૭૦૦) શેઠ કેખશરૂ અ. ચીનાઇના પુણ સારૂ તેવણુની પુંજીમાંથી કીધેલાં ધરમખાતે.
૫૦૦) મરહુમ શેઠ ધનજીભાઇ દોરાબજીના પુણ સારૂ તેવણુના ધણીયાણી બાઇ ગુલબાઇએ કીધેલાં ધરમખાતે.
૭૦૦) મરહુમ શેઠ ભીમજીભાઇ ફ. કાવરાનાં તથા બાઇ જીવણબાઇ બી. કાવારાનાનાં પુણ સારૂ તેવણુના દીકરાઓ ધનજીભાઇ તથા ફરામજી બી. કાવરાનાએ કીધેલાં ધરમખાતે.
૫૦૦) મરહુમ બાઇ દીનબાઇ વીકાજી સોલીનાના પુણ સારૂ તેવણુના દીકરાઓ ફરામજી, રૂસતમજી અને રતનશાહે કીધેલાં ધરમખાતે.
૫૦૦) મરહુમ શેઠ સોરાબજી નવરોજી કરંજયાનાં પુણ સારૂ તેવણુની પુંજીમાંથી તેમજ તેવણનાં ખેશીઓએ કીધેલાં ધરમખાતે.
૫૦૦) મરહુમ શેઠ દોરાબજી નાનાભાઇ મહેતાના પુણ સારૂ કીધેલાં ધરમખાતે.
૫૦૧) શેઠ નોશીરવાન બમનજી કરંજયાએ પોતાનાં મરહુમ બાવા બમનજી પાલનજી કરંજીયાને નામની કનટાનમાં નવી ઇમારત નામે " બમનજીબીલડીંગ " બંધાવી તેની ખુશાલીમાં કીધેલાં ધરમખાતે.
૭૦૦) મરહુમ શેઠ બેહેરામજી કેખશરૂ મહેતાના પુણ સારૂ મરહુમના દોશતઆસનાઓએ કીધેલાં ધરમખાતે.
૫૦૦) મરહુમ શેઠ ફરામજી હોરમજી અરજાનીના પુણ માટે ધણીયાણી બાઇ ધનમાયે કીધેલાં ધરમખાતે.
૫૦૦) મરહુમ શેઠ ફરામજી હોરમજી અરજાનીની યાદગારી રાખવા માટે હોંગકોંગ, કનતાનના જરથોસ્તીઓએ કીધેલાં ધરમખાતે.

૧૨૧૫૩૩)૩૧)

ધરમના મકાનો.

હાંગકાંગ મધે જરથોસ્તી અનજુમનનાં ખરચે એક જાહેર મકાન બાંધવામાં આવેલું છે જેમાં સર અવસરે બેઠકો તથા ધરમને લગતી ક્રીયા કામો વીગેરે કરવામાં આવે છે તેમજ એ મકાનમાં એક લાયબરેરી જરથોસ્તીઓના વપરાસ સારૂ છે.

મરહુમ શેઠ દોરાબજી નશરવાનજી કામાજીએ પોતાને ખરચે વામપુ મધેની જરથોસ્તી અંજુમન હસ્તકની રવાંનની જગો ઉપર એક બંગલો બંધાવી અંજુમનના વપરાસ સારૂ બક્ષેશ કીધો છે.

મરહુમ શેઠ ખરશેદજી શાપુરજી બનાજીની યાદગારી કાયમ રાખવા તેવણુના કેટલાક દોસ્તોએ કીધેલાં ફંડમાંથી વાડી ૧ મકાઉ મધે જરથોસ્તી અંજુમનને એનાયત કીધેલી તે કામમાં નહી આવવાથી તે વેચી તેને બદલે મકાઉ મધે વેચાતું લીધેલું પરાયા ગરાનડી ઉપરનું ઘેર ૧ હતું. એ મકાન ખીસમાર થવાથી તોડી પાડી નવુ મકાન અસલ જગા ઉપર બાંધવામાં આવ્યુ છે. એ સંબંધી થયલા ખરચમાં ડાલર ૧૦૨૦૦ ની રકમ મરહુમ સર હોરમજી નવરોજી મોદીના પુણ માટે એવણુના વીધવા લેડી માણેકબાઇએ તથા દીકરા શેઠ નવરોજીએ મલી સરખે ભાગે અંજુમનને તા૦ ૧૦ મી સપટેમબર ૧૯૧૪ ને દીને એવી સરતે સવાધીન કીધુ છે કે ભવીષમાં એ મકાન વેચવું પડે તો તે વેલા જમીન તથા તે ઉપરનાં અમલાની આકણી જુદી જુદી કરાવી અમલાની કીંમત જે અંકાયે તેટલી રકમનું " મરહુમ સર હોરમજી નવરોજી મોદીના પુણ માટે એવણુના વીધવા લેડી માણેકબાઇ તથા દીકરા શેઠ નવરોજીએ કીધેલુ ધરમ ખાતુ " એ મુજબનું જુદુ ખાતું પાડી તે રકમનું બ્યાજ દરશાલ ધરમ સંબંધી કામોમાં વાપરવું

લેડી માણેકબાઇ હોરમસજી ન. મોદી હાંગકાંગ મધે લાંબો વખત રહી સને ૧૮૮૬માં મુંબઇ સીધારયાં તેની યાદગારી જાલની રાખવા હાંગકાંગની રવાનની જગા ઉપર સફેદ મારબલનો ફુવારો ૧ તથા તેને લગતું પાણીનું બાંધકામ, લોઢાંની બેઠકો તથા પથરની પાકી બાંધણીનો મેહેરાબ સાથનો લોખંડનો દરવાજો ૧ મલી સરવે પોતાના ખરચે બાંધી અંજુમનને ભેટ આપયું છે.

જરથોસ્તીઓએ સ્થાપેલાં ધરમનાં ફંડો.

ઇરાનના ગરીબ જરથોસ્તીઓની હાલત સુધારનારૂં ફંડ.

ખેતવાડીના જરથોસ્તીઓનું ફંડ

જરથોસતી ધરમ અને કીરીઆ ઉપર એતેકાદ વધરાવનારી મંડળિનું ફંડ.

દીનબાઇ ન. મા. પીટીટે મરહુમ બેટા જમશેદજીના પુણ્ય માટે સ્થાપેલું ઘંબારનું ફંડ.

બહારકોટ દરેમેહેરનું બાજ જશનનું ફંડ.

બહારકોટનું બચાવ ફંડ.

મેરબાઇ તે ૫. મા. કોહલાની વીધવાનું ધરમખાતું

ખરશેદજી નશરવાનજી કામાની યાદગારીનું જરથોસ્તી વીદયારથીઓને ઉત્તેજન આપવાનું ફંડ.

જીજીભાઇ દાદાભાઇનું ધરમખાતું.

મુંબઇમાં નાવારેસ ઇરાની જરથોસ્તીઓનું ફંડ.

મુંબઈનાં કદમી જરથોસ્તીઓનું ઘંબારનું ફંડ.

રાહાનુમાએ માજદીઅસનાન સભાની મારફતે ઉભું થયલું જ. ધરમનો ફેલાવો કરવાનું ફંડ.

રાહાનુમાએ માજદીઅશનાન સભાનું ફંડ.

મુંબઇના જ. રૂવાનોના મુકતાદનું ફંડ.

ખરશેદજી અને મ. બ. પંથકીએ પોતાના બાવા બ. મા. પંથકીના પુણ્યને સારૂ ગરીબ જરથોસ્તીઓને આશરો આપવા ઉભું કીધેલું ફંડ

જેહાંગીર બ. પીટીટ હસતકનું બમનજી દીનશાહ પીટીટ પારસી જનરલ હાશપીટલ ફંડ

નશરવાનજી મ. કામાજીનું ધરમખાતું.

નશરવાનજી માણેકજી પીટીટ ચેરીટી ફંડ—જેમા ન. મા પીટીટનું દીવાનાં જરથોસ્તીઓને મદદ આપવાનું ફંડ, જ. ન. પીટીટ આરફનેજ, ન. મા. પીટીટ વીધવા આશ્રમ, ન. મા. પીટીટ ભીમપોર સેનેટોરીયમ, હમાબાઇ મા. પીટીટ વીધવા આશ્રમ, જ. ન. પીટીટ જાંહબે રડી સેનેટોરીયમ, દીનબાઇ ન. પીટીટ ગરીબ પારસીઓ માટેની ચેહલીઓ, આવાંબાઇ ફ. પીટીટ ગરીબ પારસીઓ માટેની ચેહલીઓ, ન. મા પીટીટ પુના હોલ તથા દરહમેર, વગેરે.

પારસીઓનું સંકટ નીવારણ ફંડ.

પેશતનજી બમનજી વાડીઆજીનું ધરમખાતું.

બેરામજી હોરમજી કામાનું ધરમખાતું.

મેરવાનજી ફ. પાંડેનું નબલી હાલતમાં આવેલા પારસી કુટુંબને આશરો આપવાનું ફંડ.

રૂસતમજી ધનજીશાહ કપટાનનું ધરમખાતું.

બેરામજી જીજીભાઇએ સ્થાપેલું ત્રસ્ત

નવરોજી માણેકજી વાહાડયા સી. આઇ. ઇ. એ સ્થાપેલું ત્રસ્ત.

ગરીબ જરથોસતીઓનાં રહેઠાણોનું ફંડ.

પારસી પસતાગીઆ અંજુમન સંકટનીવારણ ફંડ.

અથોરનાન મંડળ હસ્તકનું બોરડીંગ સ્કુલ ફંડ,

અથોરનાન મંડળ ફંડ અને મરહુમ જસતીસ સર દાવરની બાજનું ફંડ

નવસારીના મોબેદોનું ગહંબારનું ફંડ.

નવસારીની અનજુમનનું જનરલ ફંડ.

નવસારીની ભગર સાથની અંજુમનનું મુદતાદ બાજ તથા જશનનું ફંડ

નવસારીના મલેસર ફલીઆનાં બેહદીનોએ સવાબના કામો સારૂ ઉભું કીધેલું ફંડ.

સર જ. જી. નું સુરત તથા નવસારીનું ધરમનું ફંડ

સુરતનું ફરદુનજી સોરાબજી પારખ ટેકનીકલ ઇનસ્ટીટયુટ ફંડ

પુણાની જરથોસ્તી અંજુમને જ. રૂવાંનોને અવલમંજલ પોહચાડવા માટે સ્થાપેલું ફંડ.

લંડનમાં ધી પારસી અસોસીએશન ઓફ યુરોપ.

કરાંચીનું નાદરશાહ એદલજી દીનશાહે સ્થાપેલુ એદલજી દીનશાહ ચેરીટેબલ ફંડ.

પોસ્ટ ખાતાંને લગતી જાણવાજોગ વીગતો.

હીંદુસ્તાનમાં કાગલો, પોસ્ટ કારડો, રજીસ્ટર કાગલો, સેમપલો, પારસલો, વરતમાનપત્રો, બુક પોસ્ટપર ભરાતાં સ્ટાંપનો દર નીચે પ્રમાણે છે:—

પોસ્ટ કારડ, * કીંમત,

એકવડો	૧ દોહોડયું.
જવાબ સાથનો	૨ દોહોડયાં.

કાગલો.

એક તોલા સુધી વજનના...	૨ દોહોડયાં.
એકથી વધુ અને અઢી તોલા સુધી	૧ આનો.
અઢી તોલા ઉપરાંત બીજા દરેક અઢી તોલા અથવા તેની અંદરના વજન માટે વધુ ...	૧ આનો.

બુક પોસ્ટથી, ચોપડી ચોપાન્યાં અને નમુના મોકલવા માટે.

દશ તોલા સુધી	૨ દોહોડયાં.
દશ તોલા ઉપરાંત બીજા દરેક દશ તોલા અથવા તેની અંદરના વજન માટે વધુ	૨ દોહોડયાં.

રજીસ્ટર કરેલા વરતમાનપત્રો.

આઠ તોલા સુધી	૧ દોહોડયું.
આઠથી વધુ અને ચાલીસ તોલા સુધી	૨ દોહોડયાં
તે ઉપરાંત દર ચાલીસ તોલા દીઠ...	૨ દોહોડયાં.

પારસલો.

	કીંમત.
વીસ તોલા સુધી	૨ આના.
વીસ તોલાથી વધુ અને ચાલીસ તોલા સુધી	૩ આના.

તે ઉપરાંતના દર ચાલીસ તોલા માટે ૩ આના વધુ તે ૪૪૦ તોલા સુધી.

૪૪૦ તોલા અથવા તેથી ઓછા વજનના કોઇપણ પારસલને રજીસ્ટર કરાવવાની ફી ... ... ૨ આના.

૪૪૦ થી ૪૮૦ તોલા સુધીના વજનના પારસલના ... રૂ. ૩.

તે પછીના દર ચાલીશ તોલા દીઠ ૪ આના વધુ તે ૮૦૦ તોલા સુધી પણ ૪૪૦ તોલાથી વધુ વજનનું દરેક પારસલ ફરજયાત રજીસ્ટર કરાવવુંજ જોઈશે અને તે માટે બે આના વધુ થશે. પારસલો માટે લવાજમ આંગ ઉપરજ ભરવો જોઇશે.

કાગલો, બુક પોસ્ટ વગેરે રજીસ્ટર કરવાની ફી ૨ આના.

રજીસ્ટર કરેલી ચીજ હીંદુસ્તાનમાં જે ધણી ઉપર મોકલવી હોય, અને તેના હાથની સહી પોંહોચ તરીકે મોકલનાર ધણીને જોઈતી હોય તો એક આનો વધારે પડે છે.

જે કાગલ, પેકેટ યા ખાનગી બનાવટના પોસ્ટ કારડ ઉપર લવાજમ આગલથી મુદ્દલજ ભરયો નહી હશે તો તે માટે બેવડો લવાજમ લેવામાં આવશે, તથા અધુરો ભરયો હશે તો અધુરી રકમ બેવડી માંગવામાં આવશે.

ખાનગી બનાવટના ટપાલના પોસ્ટ કારડો.

* ખાનગી બનાવટનાં પોસ્ટ કારડની સરનામાવાળી બાજુએ જે કાંઇ લખાણ, જાહેર ખબર વગેરે મુકવું હોય તે સરનામાવાળી બાજુના ફકત ડાબા હાથપરના અરધા ભાગપરજ હોવું જોઇએ અને માલેકના નામ અને સરનામાં શીવાય જમણા હાથ પરના અરધા ભાગપર કંઇપણ લખેલું છાપેલું અથવા બીજી રીતે દરશાવેલું હોવું જોઇએ નહી. એવા કારડની સરનામાવાળી બાજુનો જો લખાણ વગેરે માટે ઉપયોગ કરવો હોય તો તે બાજુનો એક ઉભી લીટી દોરી એવી રીતે વીભાગ કરવો કે લીટીની જમણી બાજુએ આખી જગાનો ઓછામાં ઓછો અરધો ભાગ રહે. ખાનગી બનાવટના પોસ્ટ કારડો વધુમાં વધુ સાડાપાંચ ઈંચ લાંબા અને સડાત્રણ ઈંચ પોહલા અને કમીમાં કમી પોણા પાંચ ઈંચ લાંબા અને ત્રણ ઈંચ પોહલા સાઇઝમાં હોવા જોઇએ અને તે ટીકીટવાલા કારડો જેટલાજ જાડા હોવા જોઇએ.

ટપાલની ટીકીટો, પરબીડાંઓ તથા રેપરો નીચલા ભાવે વેચવામાં આવે છે:—

ટીકીટો.

૦ા આનો, ૦ાા આનો, ૧ આનો, ૨ આના, ૨ાા આના, ૩ આના, ૪ આના, ૬ આના, ૮ આના, ૧૨ આના તથા રૂ૧, રૂ૨, રૂ૩, રૂ૫, રૂ૧૦, રૂ૧૫, અને રૂ૨૫.

ઉપલી બધી જાતની છુટી ટીકીટો ઉપર જણાવવામાં આવેલા ભાવેજ વેચવામાં આવે છે.

અરધા આનાવાળાં ઓબલોંગ કમરસીયલ સાઈઝના પરબીડાં

૧	પરબીડાંના	...	આ.	૦	પાઇ	૮
૨	,,	...	,,	૧	,,	૩
૩	,,	...	,,	૨	,,	૦
૪	,,	...	,,	૨	,,	૬
૫	,,	...	,,	૩	,,	૦
૨૦	,,	...	,,	૧૨	,,	૦

અરધાં આનાવાલાં જાડાં ચોરસ પરબીડાં.

૧	પરબીડાંના	...	આ.	૦	પાઈ	૯
૨	,,	...	,,	૧	,,	૬
૩	,,	...	,,	૨	,,	૩
૪	,,	...	,,	૩	,,	૦
૫	,,	...	,,	૩	,,	૬
૨૦	,,	...	,,	૧૪	,,	૦

અરધા આનાવાલાં લંબ ચોરસ પરબીડાંઓ અરધા આનાને ભાવેજ મલશે.

એક આનાવાલાં ચોરસ પરબીડાં.

	આ.	પાઇ.
૮ થી ઓછી સંખ્યા માટે દર પરબીડાં દીઠ	૧	૨
૮ પરબીડાંના દર પેકેટ દીઠ...	૯	૩

રેજીસ્ટર ટીકીટવાલાં નાના પરબીડાં

	આ.	પાઈ.
૧૬ થી ઓછી સંખ્યા માટે દર પરબીડાં દીઠ	૩	૦
૧૬ પરબીડાંના દર પેકેટ દીઠ. રૂ૩	૦	૦

રેજીસ્ટર ટીકીટવાળાં મોટાં પરબીડાં.

	આ.	પાઇ.
૮ થી ઓછી સંખ્યા માટે દર પરબીડાં દીઠ... ...	૩	૬
૮ પરબીડાંના પેકેટ દીઠ ...રૂ૧	૧૨	૦

અરધા આનાવાળી ટીકીટવાળાં રેપરો.

૬ થી ઓછી સંખ્યા માટે દર રેપર દીઠ આ. ૦ પૈ૭

૬ રેપરના દર પેકેટ દીઠ .... આ. ૩ પઇ ૬

એક આનાવાળી ટીકીટવાળાં રેપરો.

૬ થી ઓછી સંખ્યા માટે દર રેપર દીઠ આ. ૧ પૈ૧

૬ રેપરના દર પેકેટ દીઠ ... આ. ૬ પઇ ૬

ચીજો પોસ્ટ કરયા બદલની સરટીફીકેટ.

પોસ્ટ મારફતે જતી જે ચીજ માટે પોસ્ટ ઓફીસ તરફથી રસીદ આપવામાં આવતી નથી એવી દરેક ચીજ પોસ્ટ કરયા બદલનું સરટીફીકેટ મળી શકે છે. એ સરટીફીકેટ કાગલના કટકાપર યા ચોપડીમાં લખી જે ચીજ પોસ્ટ કરવાની હોય તેની સાથે પોસ્ટ ઓફીસમાં રજુ કરવું. જે ચીજો માટે સરટીફીકેટ જોઇતું હોય તે ઉપરના સરનામાની બરાબર નકલ તેમાં હોવી જોઈએ અને જેટલી ચીજો બદલ સરટીફીકેટ જોઇતું હોય તે ચીજોની સંખ્યા શબ્દોમાં સરટીફીકેટની નીચે લખવી અને તે ઉપર નીચે મુજબ ટીકીટ મારવી:—(૧) સાધારણ અથવા વેલ્યુપેએબલ રજીસ્ટર નહીં કરાવેલી એંગી અને વેલ્યુપેએબલ રજીસ્ટર નહી કરાવેલા બુક પેકેટ માટે એમાની કોઇપણ જાતની દરેક છ અથવા તેથી ઓછી ચીજોને માટે ૦ા આનો, (૨) રજીસ્ટર ન કરાવેલા કાગળ, પોસ્ટ કારડ, બુક પેકેટ, (રજીસ્ટર નયુસ પેપર સુધ્ધાં) અને નમુનાના પેકેટ માટે એમાંની કોઇ પણ જાતની દરેક ત્રણ અથવા તેથી ઓછી ચીજને માટે ૦ા આનો. દરેક જાતની ચીજ માટે જુદાં સરટીફીકેટ ઉપર "એંગી પોસ્ટ કરયા બદલનું સરટીફીકેટ" અથવા "કાગળ પોસ્ટ કરયા બદલનું સરટીફીકેટ" એ પ્રમાણે જે જોઈતું હોય તે મથાળું લખી રજુ કરવાં. પોસ્ટ ઓફીસ ટીકીટ અથવા ટીકીટો રદ કરી સરટીફીકેટ ઉપર તારીખની છાપ મારી જે ધણીએ રજુ કરયું હશે તેને પાછું આપશે.

સાધારણ સ્થાનીક મની ઓરડર તથા વેલ્યુ પેએબલ પોસ્ટથી જણસો મોકલવા માટેની સરકારની હકસાઇ.

હીંદુસ્તાનમાં એક ઠેકાણેથી બીજે ઠેકાણે ટપાલ મારફતે નાણું વાલવા તથા વેલ્યુ પેએબલ પોસ્ટથી જણસો મોકલવા માટે નીચલા ભાવે કમીશન લેવામાં આવે છે.

પાંચ રૂપયા સુધી ... ... ૧ આનો	પંદર રૂપયા સુધી ... ...૩ આના.
દશ રૂપયા સુધી ... ... ૨ આના.	પંદરથી વધુ અને પચીસ રૂપયા સુધી ૪ આના

રૂ. ૨૫ થી વધુ રકમોના ઓરડરો ઉપર કમીશન લેતા દર રૂપયા પચીસની આખી રકમ દીઠ ચાર આના ગણવામાં આવે છે, અને વધારાની રકમ જો પાંચ રૂપયાથી વધુ નથી હોતી તો તે ઉપર માત્ર એક આનો વધુ, દસ રૂપયા વધુ હોય છે તો તે ઉપર બે આના અને ૧૫ રૂપયા વધુ હોય છે તો તે ઉપર ત્રણ આના તથા પંદરથી વધુ માટે ચાર આના વધુ લેવામાં આવે છે. દાખલા તરીકે રૂ. ૫૫ નો મનીઓરડર મોકલવો હોય તો દર પચીસ રૂપયા પાછળ ચાર આના મલી આઠ આના અને બાકી રહેલા પાંચ રૂપયા ઉપર એક આનો વધુ લેવામાં આવે છે. જ્યારે રૂપયા ૬૦ ના મની ઓરડરપર દશ આના અને રૂપયા ૬૫ ના મની આરડરપર અગ્યાર આના પણ રૂપયા ૬૫ થી મધુ અને રૂપયા ૭૫ સુધીના મની ઓરડપર બાર આના લેવામાં આવે છે. એકજ મની ઓરડરમાં ૩૬૦૦ થી વધુ રૂપયા લેવામાં આવતા નથી.

વેલ્યુ પેએબલ પોસ્ટ મારફતથી પારસલો, કાગળો, બુક પેકેટો, પોલીસીઓ, બીલ્ડીગો રેલ્વેની રસીદો, ઇત્યાદી જે ધણીને પોંહોચાડી તેની પાસેથી તેનાં નાણાં મેળવવાં હોય તો તે ઉઘરાવી આપવાનું કામ પોસ્ટ ખાતું બજાવે છે. મોકલવાની વસ્તુ ઉપર તેને જોઇતી ટપાલની ટીકીટ લગાડ્યા પછી અને તેની જેટલી કીંમત વસુલ કરવી હોય તેના આંકડા સાથે ટપાલખાતાંને સ્વાધીન કરયા બાદ, ટપાલ ખાતું તે વસ્તુ તે ધણીને પોંહોચાડી આંકડા પ્રમાણે તેની પાસેથી પઇસા વસુલ કરે છે અને તે પઇસા તે વસતુ મોકલનાર આસામીને લાવી આપે છે, અને તેના ઉપર પોસ્ટ ખાતું કમીશન લે છે. તે કમીશનનો દર ઉપર જણાવવા મુજબ મની ઓરડરના કમીશનના દરની બરાબરજ છે અને એ કમીશનના જેટલા પઇસા થાય તેટલી કીંમતની વધુ પોસ્ટની ટીકીટો મોકલવાની વસ્તુ ઉપરજ મારવી જોઇશે. જો મોકલેલી વસ્તુ લેનાર ધણી નહીં રાખે તો તે મોકલનાર ધણીને પાછી પુગાડવામાં આવે છે, અને તે માટે કશું દામ લેવાતું નથી પણ તેના ઉપર ટપાલનો જે દર ભરયો હોય તે રદ થાય છે. વેલ્યુ પેએબલ માટે કાંઇબી દાવો કરવો હોય તો તે મોકલ્યાની તારીખથી ૬ મહીનાની અંદર કરવો જોઇએ, પોસ્ટ ઓફીસ એ પછી કોઇબી રીતે જોખમદાર રહેતી નથી.

તાર મારફતે મોકલવાના મનીઆરડર માટે તારના સંદેશાનો તથા હકસાઇનો દર.

હીંદુસ્તાનમાં એક ઠેકાણેથી બીજે ઠેકાણે તાર મારફતે મોકલવામાં આવતો મનીઓરડર જેટલી રકમનો હોય તેટલી રકમ ઉપરનું કમીશન એક સાધારણ સ્થાનીક મની ઓરડરનું જે કમીશન હોય (ઉપર જણાવવા મુજબ) તે પરમાણે લેવામાં આવે છે. તે ઉપરાંત તારનો વધુ લવાજમબી લેવામાં આવશે. તે એમ કે તારના સંદેશામાં જેટલા શબ્દો મોકલવા લખ્યા હોય તેટલા શબ્દો ગણીને જો તારનો સંદેશો એક્ષપરેસ હોય તો તેના હીસાબે અને ઓરડીનરી હોય તો તે પરમાણે લવાજમ લેવામાં આવે છે.

ઉપલા તારના સંદેશામાં મની ઓરડર મોકલનાર આસામી પોતા તરફનો ખાનગી સંદેશો પણ તેવા તારમાં ઉમેરી શકશે અને તેવા વધારાના શબ્દો માટે તે એક્ષપરેસ તાર હોય તો શબ્દ દીઠ બે આના અને ઓરડીનરી હોય તો શબ્દ દીઠ એક આનાનો વધારાનો દર લેવામાં આવે છે.

કોઇપણ એક મની ઓરડર ૩૬૦૦ થી વધારેનો સીકારવામાં નથી આવતો અને એક રૂપયાથી ઓછી રકમ સ્વીકારવામાં આવશે નહીં.

વીજળીક તારને લગતી જાણવાજોગ વીગતો.

સરવે તારો "સ્ટાનડર્ડ" વખત પ્રમાણે નોંધી લીધામાં આવશે, જે વખત હીંદમાં ગ્રીનીચના વખત કરતાં સાડ પાંચ કલાક આગળ, તથા મદ્રાસ વખત કરતાં નવ મીનીટ આગળ છે. બરમાહમાં ગ્રીનીચના વખત કરતાં સાડા છ કલાક આગળ, અને હીંદના 'સ્ટાનડરડ' વખત કરતાં એક કલાક આગળ છે.

તાર અંગ્રેજી કે દેશી, કોઇપણ ભાષામાં મોકલી સકાય છે પણ તેનું લખાણ તો અંગ્રેજી અક્ષરોએજ કરવું જોઇએ. તાર બહુજ ખોલા અક્ષરે લખવો જોઇએ, કે જેથી ભુલચુક થવાનો સંભવ રહે નહી. તાર મેલવામાં કાંઇપણ ભુલચુક, ઢીલ વગેરે તાર ખાતું વકીક કરે તો તેનો જોખમ લેનાર તથા મોકલનારનેજ માથે છે. જે મથક ખાતે તાર મુકયો હોય ત્યાંની તાર ઓફીસથી પાંચ માઇલ સુધીની હદમાં સઘળા સંદેશા તારખાતું પોતાના માણસ જોડે પોંહોંચાડી આપે છે પણ તેથી દુરની હદના સંદેશા ટપાલ મારફતે મોકલે છે. તેવી દુરની જગાએ મોકલેલા "એક્ષપ્રેસ" અથવા "ઓરડીનરી" સંદેશા, જો મોકલનાર તેને લગતો ખરચ આપે તો, તાર ખાતું ખાસ ખેપયા કે બીજી ગોઠવણથી પુગાડે છે. મોકલનારની મરજી હોય તો સંદેશા પરબીડામાં બીડયા વીના ખોલા તાર આફીસ પુગાડે છે કે જો લેનાર ધણી તે લેવાને ના પાડે છતાં તેની મતલબથી વાકેફ થાય. જ્યારે એક સંદેશો કોઇ પણ કારણથી ઘટતે ઠેકાણે પુગી શકતો નથી ત્યારે મોકલનાર ધણીને તે બાબેની ખબર આપવામાં આવે છે. તાર ઓફીસમાં એક સંદેશો આપ્યા પછી તે ઘટતે ઠેકાણે મોકલાતો અટકાવી શકાય છે પણ જો સંદેશા ઉપરની તારની ટીકીટ સ્ટાંપ મારયાથી રદ થઇ હોય તો તેના પઇસા પાછા આપવામાં આવતા નથી. તાર ઓફીસમાંથી જો સંદેશો રવાના થઇ ચુકેલો હોય છે, તે રદ કરવા માટે બીજો તારનો સંદેશો મેલવો પડે છે. તાર મુકનાર તથા પોહોંચાડનાર ઓફીસમાં ૭૨ કલાક સુધી તારની નકલ રહે છે. તે પછી એ નકલો કલકતે "ચેક ઓફીસ" માં જાય છે જયાં ચાર માસ સુધી તે રાખવામાં આવે છે. તાર મેલનાર અને લેનાર ધણીને દર ૧૦૦ શબ્દો દીઠ ચાર આના લઇ તેની નકલ આપવામાં આવે છે. વલી તારનો જવાબ મેળવવા માટે બી રીપલાઇ ટેલીગ્રામ મોકલી શકાય છે, તેની સમજણ એવી છે કે, જેવી જાતનાં તારમાં જવાબ મંગાવવો હોય તે પ્રમાણે પઇસા આગલથી તાર આફીસમાં લેવામાં આવે છે અને તે પીશેની ચેતવણી તાર લેનાર ધણીને તારની સાથેજ આપવામાં આવે છે, જો લેનાર ધણી ઉતર નહી મોકલે તો ભરેલા પઇસા તે લેનારનેજ રોકડા પાછા આપવામાં આવે છે.

હીંદુસ્તાનમાં એક શેહેરથી બીજે શેહર મોકલવા માટેના તારના સંદેશાના દરો.

તાકીદના (એક્ષપ્રેસ) સંદેશા—સરનામા સહીત બાર શબ્દો માટે દોઢ રૂપયો અને તે ઉપરના દરેક વધારાના શબ્દ દીઠ બે આના વધુ લેવામાં આવશે.

સાધારણ ઓરડીનરી સંદેશા—સરનામા સહીત બાર શબ્દો માટે બાર આના અને તે ઉપરના દરેક વધારાના શબ્દ માટે એક આનો વધુ લીધામાં આવશે.

ઓરડીનરી કલાસના તારો રવીવાર અને તહેવારના દીવસોએ લેવામાં આવતા નથી.

વરતમાનપત્રો માટેના ખાસ દર નીચે મુજબ છે.

તાકીદના (એક્ષપ્રેસ) સંદેશા—ઉડતાળી શબ્દો માટે એક રૂપયો અને તે ઉપરાંતના દર ૭ શબ્દો દીઠ બે આના વધારે અને સરનામું મુફત લેવામાં આવશે.

સાધારણ (ઓરડીનરી) સંદેશા—ઉડતાળીસ શબ્દો માટે આઠ આના અને તે ઉપરાંતના દર ૭ શબ્દો દીઠ એક આનો વધારે અને સરનામાના શબ્દો મુફત લેવામાં આવશે.

વરતમાનપત્રો માટેનો એક સંદેશો એકજ મથકનાં ગમે તેટલાં વરતમાન પત્રોને પોંહોચાડવામાં આવે તોપણ તે ઉપર એકજ વખતનો દર અને નકલ કરવાનો સો શબ્દો દીઠ ચાર આના લેખે લવાજમ પડે છે.

યુરોપમાં ચાલેલી લડાઇમાં પારસીઓએ આપેલી મદદને લગતી વીગતો.

નામદાર બ્રીટીશ સરકારે તા૦ ૪ થી આગસ્ટ ૧૯૧૪ થી યુરોપમાં ચાલેલી લડાઇમાં મીત્ર રાજ્યો સાથે જોડાઈ ઘણી માનવંતી રીતે ફતેહ ૧૯૧૮ ના સાલમાં મેલવી હતી અને જરમન સરકારને સુલેહ કરવાની ફરજ પાડી હતી. પારસી કોમે હમેશ મુજબ લડાઈના મેદાનમાં સારી સેવાઓ બજાવી આપણી નામદાર બ્રીટીશ સરકાર તરફ પોતાની વફાદારી દેખાડી કીમતી મદદો આપી હતી.

યુરોપમાં ચાલેલી લડાઈમાં નામદાર શેહેનશાહ જયોરજ પાંચમાં અને મીત્ર રાજ્યોની મહાન ફતેહ થઇ તેની શુકર ગુજારીમાં બંદગી કરવાનો દીવસ તા૦ ૧૭ મી નવેમબર ૧૯૧૮ નો ઠરાવેલો હોયાથી એ દીવસે જુદા જુદા દેશાવરો તથા ગામો ખાતે સરવે કોમ તરફથી બંદગી કરવામાં આવી હતી. મુંબઇમાં અંજુમનના આતશબેહરામમાં પારસી પંચાયતના માનવંત ટ્રસ્ટી સાહેબોના ઇજનને માન આપી જરથોસ્તીઓની મોટી સંખ્યાએ હાજર થઇ બંદગી કરી નામદાર શેહેનશાહ ઉપર અંજુમન તરફથી મુબારક બાદીનો સંદેહશો મોકલાવ્યો હતો. એજ મુજબ નવસારી, સુરત, કરાંચી, વગેરે ઠેકાણે બંદગી કરી દુવા ગુજારવામાં આવી હતી.લડાઇ બંધ પડવાની ખુશાલીમાં તા૦ ૨૨ અને ૨૩ મી નવેમબરના દીવસો જાહેર તેહવાર તરીકે પાલી સઘળે ઠેકાણે મેલાવડાઓ કરી ધામધુમથી ઉજવવામાં આવ્યા હતા. મુંબઇમાં એક મોટુ ફંડ કરી સ્કુલના બાલકોને તથા લશકરી સીપાહો અને સોલજરોને મેજબાની આપવામાં આવી હતી.

નામદાર બ્રીટીશ સરકાર તેમજ મીત્ર રાજ્યો અને જરમન સરકાર વચ્ચે સુલેહના કોલકરારો ઉપર વરસાઈ ખાતે તા૦ ૨૮ મી જુન ૧૯૧૯ ને દીવસે સહી થવાથી તેની ખુશાલીમાં નામદાર બ્રીટીશ સરકારની આખી શેહેનશાહતમાં સઘલી કોમો તરફથી તા૦ ૬ ઠી જુલાઇ ને રવીવારે પાક દાદાર હોરમજદની શુક્ર ગુજારી કરી આભાર માનવા નામદાર બ્રીટીશ સરકાર તરફથી નક્કી કરવામાં આવ્યું હતું. એ મુજમ આખા હીંદુસ્તાનમાં પારસી તથા સઘલી કોમો તરફથી બંદગી કરવામાં આવી હતી. મુંબઇમાં શેઠ હોરમજી વાહાડીયાજીના આતશ બેહરામમાં પારસી પંચાયતના ટ્રસ્ટી સાહેબોના ઇજનને માન આપી જરથોસ્તી બાનુઓ તથા ગ્રહસ્થો મોટી સંખ્યામાં હાજર થયા હતા. શરૂઆતમાં નાયબ દસ્તુરજી રૂશતમજી એદલજી સંજાનાની આગેવાની હેઠળ બંદગી કરવા પછી દસ્તુરજી રૂશતમજીએ પ્રસંગને અનુસરતી વાયજ કરવા બાદ સમસુલ ઓલમાં એરવદ ડા૦ જીવણજી જમશેદજી મોદીએ પારસી કોમ તરફથી તારનો સંદેશો નામદાર શેહેનશાહ જ્યોરજ ઉપર મોકલાવી આપવા જણાવ્યું હતું. વલી તા૦ ૧૯ મી જુલાઇને દીવસે ફતેહની ખુશાલીમાં મુંબઇ તેમજ દેશાવરો ખાતે મેલાવડાઓ તથા બંદગી કરી નામદાર શેહેનશાહ ઉપર મુબારકબાદીના સંખ્યાબંદ સંદેહશાઓ મોકલવામાં આવ્યા હતા અને એ દીવસ જાહેર તેહવાર તરીકે ધામધુમથી બધેબધ પાલવામાં આવ્યો હતો .મુંબઈમાં ટાઉન હોલમાં મુંબઇના શેહેરીઓની જાહેર સભા નામદાર ગવરનરના પ્રમુખપણા હેઠલ મલી હતી અને સુલેહની સરતોને લગતો સાર શેરીફ સર કાવશજી જાહાંગીર બારોનેટે વાંચી સંભલાવી નામદાર શેહેનશાહ ઉપર મુબારકબાદીનો સદેહસો મોકલાવ્યો હતો.

નામદાર બ્રીટીશ સરકારની લડાઇમાં બહાદુરી ભરી સેવાઓ બજાવા માટે નીચલા જરથોસ્તીઓને ખેતાબ મલ્યા હતાઃ—મેસોપોટેમીઆની લડાઇમાં બહાદુરી દેખાડવા માટે લેફ્ટનંટ રતનશાહ નરીમાન કાપડયાને મીલીટરી કરોસ એનાયત કીધો છે. લેફ્ટનંટ કાપડયા દુશમનોના તોપના મારા હેઠળ હોવા છતાં વીખરાઇ પડેલા ઘાયલ સીપાહોને ભેગા કરીને તેઓની સારવાર કરી ઘણાક જાને બચાવ્યા હતા. કેપટન એચ. જે. એમ. ખરશેદજીને ડીસટીંગવીસ સરવીસ ઓરડર ડી. એસ.

ઓ. નો ચાંદ એનાયત કીધો હતો. એવણે તા૦ ૨૬-૨૭ અકટોબર ૧૯૧૮ ને દીને સુલક અને શેરકત ખાતે કંઈપણ ભયની દરકાર કીધા વીના જખમી સીપાહીની સારવાર કરી બહાદુરીથી પોતાની ફરજ બજાવી હતી તથા એ આગમજ પણ ઘણી સારી સેવા બજાવી હતી અને એકવાર સખત રીતે ઘાયલ થયા હતા. ઇજીપટ મધે બહાદુરી ભરેલી સેવાઓ બજાવવા માટે લેફ્ટનંટ કે. આર. માદનને ઓ. બી. ઇ. નો અને લેફ્ટનંટ બી. એચ. કામાકાકાને એમ. સી. મીલીટરી ક્રોસનો ચાંદ એનાયત થયો હતો. મેલબોરન અને ઇજીપટ વચે દોડતી હાસપીટલ સ્ટીમરોપર સીનીઅર તબીબ અમલદાર તરીકે કામ કરતા રોયલ આરમી મેડીકલ કોરના લેફ્ટનંટ કરનલ એન. વી. ગણદેવીઆને સારી સેવા માટે નામદાર શેહેનશાહે પાચમેંટપર એક ડીપલોમાં ડીસેમબર ૧૯૧૮ માં એનાયત કીધો છે.

ઈંડીયન મેડીકલ સરવીસવાળા કેપટન જે. કે. નરીમાન અને કેપટન સોરાબ કેખશરૂ એનજીનીયરને મેજરની પદવીએ જ્યારે લેફ્ટેનંટો હોમી રૂશતમજી ખરશેદજી, આર. જે. તાતા, રૂશતમ, મેરવાનજી ખરેગાટ, જાહાંગીર ખરશેદજી ભરૂચા, કેખશરૂ રૂશતમજી દલાલ, જાહાંગીર હોરમજી કલારક જમશેદજી એદલજી ફ્રેંચમેન, માણેક સોરાબજી મોદી અને નવલ માણેકજી દોતીવાલાને કેપટનની પદવીએ ચઢાવ્યા હતા.

સેંટ જોન એમબયુલનસ એસોસીએશનની હીંદી કાઉનસીલની તા૦ ૨૭ મી સપટેમબર ૧૯૧૮ ને દીને મળેલી સભા વેળા હીંદમાં એમબયુલનસના કામમાં કીંમતી સેવા બજાવવા માટે ડા૦ દાદાભાઇ ખુરશેદજી એલીસ, અને ડા૦ ગોદરેજ ખુરશેદજી ઇરાનીની કાઉનસીલના ઓનરરી લાઈફ મેમબરો તરીકે નેમણુંક કરી તે માટેની પારચમેંટ ઉપરની સરટીફીકેટ તેમજ ડા૦ અરદાવીરાફ દીનશાહ જે. એદલબેહરામને સેંટ જોન એમબયુલનસ એસોસીએશનના પરીક્ષક તરીકે બજાવેલી સેવાની પીછાણમાં સરટીફીકેટ એનાયત કીધી છે. શેઠો ગુસ્તાસ્પજી નશરવાનજી ગઝદર અને માણેકશા રૂસતમજી પટેલે એસોસીએશનની બજાવેલી સેવાની પીછાણમાં "વોટ ઓફ થેનકસ"ની સરટીફીકેટ આપી હતી.

મેજર દીનશાહ પેસતનજી ઘડીયાળીને ન્યુ યોરકની પોલીસ રીઝરવ એર ફોરસની પાયોનીયર વીંગના કમાનડરના ઓધા ઉપર નેમયા હતા અને એવણને લડાઇ દરમ્યાન બનાવેલી સેવાની કદરશનાશીમાં લીબરટી મેડલએનાયત કરવામાં આવ્યો હતો. પોલીસના હવાઇ કાફલાના કમાનડર મેજર દીનશાહ ઘડીઆલીએ ન્યુ યોરકથી ઉડી ફીલાડેલફીઆ સુધી હવાઈ સફર કરી હતી.

કેપટન ફીરોઝ બાપુજી એદલજી ચીનાઈ ૩૦ વરસની વયે ટાઇફસ તાવની ટુંક બીમારીથી ઉતર ઇરાનમાં કેસપીઅન સમુદર ઉપર આવેલા ઝીનજાન શેહર જે બસરાથી આસરે હજાર માઇલ દુર છે ત્યાં રોજ ૮ મો માહા ફ્હાને દીને મરણ પામ્યા હતા. મરહુમનો જનમ પુના ખાતે તા૦ ૨૫ મી ડીસેમબર ૧૮૮૮ માં થયો હતો. એવણે ૧૯૦૬ માં મેત્રીકયુલેશનની પરીક્ષા પસાર કરી મેડીકલ કોલેજમાં જોડાઇ ૧૯૧૧ માં એલ. એમ. એંડ એસ. થયા હતા. એ પછી વેલાત જઈ એલ. આર. સી. પી. અને એમ. આર. સી. એસ. ની ડીગ્રીઓ મેલવ્યા બાદ આગસ્ટ ૧૯૧૪ માં ઇંડીયન મેડીકલ સરવીસની પરીક્ષા પસાર કરી હતી. એવણે હીંદુસ્તાનમાં જુદી જુદી પલટણોમાં નોકરી બજાવ્યા પછી ૧૯૧૫ માં એવણને ફલેનડરસમાં લડાઇને મુખડે મોકલાવ્યા હતા. ૧૯૧૭ માં બસરા ખાતે ૨૦ મી કમબાઇન્ડ ફીલ્ડ એમબ્યુલંસનો અખત્યાર આપવામાં આવ્યો જયાથી મેસોપોટેમીયામાં લશકર સાથ આગળ વધતા ગયા હતા. મરહુમ ફારસીના અભીયાસી હોવાથી ઇરાનમાં નવી હોસપીટલો ખોલવામાં આવતી ત્યા એવણને થોડો વખત રાખતા હતા કે જેથી ત્યાના રહીશો દવાખાનાનો સારો લાભ લઇ શકે. મરહુમ દયાળુ અને મલતાવડા સવભાવના હોવાથી સરવેનો ચાહ જીતી લીધો હતો અને પોતાના ઉપરી હાકીમોનો સારો ચાહ મેલવ્યો હતો.

ઝરીના

હેર ઓઇલ જે વરસો થયાં લોક પસંદગી પામતાં રહયાં છે અને તેઓમાં કુદરતી પુશપોને સુવાસ તેની અસલ ખાલિસીમાં એવો પ્રગટી રહેલો છે કે તે એકવાર વાપરતાંજ મોહી પડી જવાય છે. એ તેલોનાં આવાં ખેચાણને લીધે તથા બાલ વધારવાના તથા તેને ચલકતા સુંવાળા અને નરમ રાખવાના ખાસ ગુણોને લીધે શોખીન બાનુઓમાં એક જતની મોહીની ઉતપન કરી છે અને એજ કારણુસર **ઝરીના હેર ઓઇલ** જગ જાહેરાત પામયાં છે. લોકમાં તેનો ખપ વધી ગયો છે તેથીજ કરીને પારકી મીરાસ પોતાની કરી કહેનાર **નકલીયાઓ** તુટાતુટ કરી રહયા છે. ઝરીના હેર ઓઇલની સ્તુતી પ્રજામાં જાણીતાં અને માનીતાં વરતમાનપત્રોમાં વાંચવાથી તે ખરી દવા જતાં ભળતાંજ નકલી તેલો ખરીદી લોક નીરાશી પામતા હોય તેમાં નવાઇ નથી. એ તેલો એક કરતાં વધુ સુગંધનાં બનાવેલાં છે. જેમકે

ઝરીના રેડ રોઝ

ઓઇલ પ્રથમમાં જાહેરમાં લાવનાર **માહન સનસની કુંપની,** અસલ માહનનાં દવાખાના વાળાજ છે. એનો ખુશનુમા ગુલાબી દેખાવ જે આંખને મજાહ આપે છે તેમજ તેના રાતા ગુલાબનો ખાલેસ સુગંધ એવો આબેહુબ છે કે આપણી દેશી અબળા અને પારસી બાનુઓમાં એજ વાપરવાનું ગેનક લાગું છે !

ઝરીના વાહીટ રોઝ

હેર ઓઇલ ઉપલાં જેવુંજ સુગંધી અને ગુણ-વાળું છે. તે યુરોપીયન બાઇઓ હોંસથી વાપરે છે. વળી કેટલીક બાનુઓને રંગદાર કોઇબી તેલ માટે અભાવ હોય છે પણ

ઝરીના જેસમીન

હેર ઓઇલો તો આપણી હીંદી અને મોહોમેદન બાનુઓમા એવો ચાસરો લગાડયો છે કે બોલ-વાની વાત નહી. કારણ કે એમાં બટ મોગરા અને ચંપેલીનો ખુશ સુવાસ એવો તો બેહેકી રહેલો છે કે બાનુઓ કુરબાન રહે એ કુદરતી છે.

ઝરીના વાહીટ વાયોલેટ

શોખીન ઇગ્રેજ અને પારસી બાઇઓ જેઓ, કુદરતી ફુલોનાં પુજારી છે તેઓ વાયોલેટની બ-પટવાળા ઉપલાં તેલનો ઘણીજ મગનહથી ઉપયોગ કરે છે. હવે બાલ વધારવાના ખાસ ગુણોવાળુ

ઝરીના કેનથરેદીન

હેર ટોનીક ઓઇલ તો દરેક ઠેકાણેથી અને સરવે ગ્નાતની પતનીઓ તરફથી વાખવાખીના સરોદથી વધાવી લેવામાં આવ્યું છે, કારણકે ટુંકા, આછા અને હમેશ બાલ વધારવાને અધીરી પડેલી બાઇ-ઓમાં એના પ્રતાપે ધીરજ આવી છે. એ વાપરવા પછી તેઓનાં માથાં સુંદર રૂપાંળાં લાંબા અને પેચદાર બાલની લટોથી શોભા પામી રહયાં છે.

ફલોરલ હેર ડ્રશ

ગુલશી ના માથાં અને તાળવાને ઠંડક વાળવ સાથ ઉપલાં તેલો બેળવાં પડવાથી બાલ છુટા રહે છે અને તેના વધને પુશકલ ટેકો મલે છે. પણ એનો સુગંધ તો એવો છે કે આખા ઓરડો બાગે બેહેસત જેવો પમરી રહે છે. એની તારીફ લાનસેટ જેવાં પત્રે કીધી છે અને તે વાપરવાને ભલામણ કરવા ચુકયું નથી.

ઉપલાં તેલો સરવે ઠેકાણે મળે છે.

નકલ નીકળી છે તેથી ઝરીના નામવાળુંજ લેજો.

માહન સનસની કુંપની.

ક્રાફર્ડ મારકીટ આગળ—મુંબઇ.

વાંચવા લાયક તથા લાયબ્રેરીમાં રાખવા લાયક પુસ્તકો.

	રૂ. આ.
ધર્મોજય અતી રંસીલી વારતા ...	૩–૮
કાકાનો વારસો	૨–૦
ગેલાર્ડ પીયરથી બ્રીટન ...	૩–૦
કોલક બેક ચીત્રો સાથે ...	૩–૦
નસીબનો નાઝ	૨–૦
જીવતું દોજખ	૨–૦
દસાતીર ફકત એકજ નકલ છે ...	૭૫–૦
મોહન મહાન	૨–૮
હાસાહસ ચીત્રો સાથે	૩–૦
કેવત માલા ૨) ભાગમાં ...	૧૪–૦
માહારાણી વિકટોરયાએ હાયલંડમાં ગુજારેલી જીંદગીનો હેવાલ ...	૭–૦
મારી ગર્જેહ	૭–૦
મનસુખી ગંજનામુ	૨૦–૦
શાહનશીલ સુંદરી ૨)ભાગમાં કંપલીટ.	૬–૦
ગુણુ સહાગી	૧–૪
સુખશાંતિ કોપ	૪–૦
ચંચલ ચહુંથ	૦–૧૨
રીતમગર	૨–૦
જગતનો ફાંસો	૨–૦
દાસતાને દસતાર	૦–૪
પતેતીની હમાજોર	૦–૪
દુખ્યારી દુઃખતર	૧–૪
પેટબોલું પંચી ૨) ભાગમાં ...	૧–૦
આર્યબીશાકઅથવાહીંદુસ્તાનનોવૈદરાજ	૫–૦
અરેબીયન નાઇટસ ૨) ભાગમાં ...	૯–૦
જ્ઞાન ગમતના ગોહરો	૨–૦
મુખ્તેશર શાહનામુ	૨–૦
એમના માહાત	૨–૦
જેહાંગીર નામું	૨–૦
નસીબની કીસતી	૧–૮
નાસતીક નવલ...	૨–૦
જેપાની ભાશાનો ભોમ્યો ...	૧–૦
નીલીની કાનત	૧–૪
થણુ થણુ ચરીત્ર	૦–૧૨

	રૂ. આ.
બસો વરસનું પંચાંગ ...	૩–૮
જયોતીષ વિદ્યા	૬–૦
બાનુ યાને સજીવન થયલો આશક	૫–૦
માશુકનો ફ્સારો	૫–૦
કુદરતનો કેહેર	૨–૦
ભીખારનો ખુચ	૨–૦
જાન કે જીગરે	૨–૦
ખુબસુરત ગલકાર	૨–૦
નીતા (એક વારતા)	૧–૦
ગુલબાનુ	૦–૧૨
ભુંડાનો ભેદ	૩–૦
મંચી મકારો	૧–૮
હરીના	૧–૮
સોનારણુ	૩–૦
તડકામા વાદલી (ફકત ૪ નકલો બાકીછે)	૫–૦
કાલા મેંદા ૨)ભાગમાં ગુજ નકલો બાકીછે	૫–૦
ગોધલુ	૪–૦
ચંદ્રમલ	૪–૦
વિશારી વનીતા	૬–૦
લોકપ્રીય ડૉકતર બહાદુરજીની જીંદગીનો હેવાલ	૧–૦
મરહુમ ગાં મનસુખની જીંદગીનો હેવાલ	૨–૦
હોમલીબાઇની વાયજ ...	૩–૦
ગેવ ગોસસ્પ અને ગેમન મનીજેહનો કીસ્સો	૧–૮
ઈંદ્રાવતી	૧–૮
ઝેહેરે કાતીલ	૧–૪
મોતી ગવરી	૨–૮
મેહેરે અલલા	૨–૮
પેરાતુલ અરસ	૩–૦
હોશન આરા	૩–૦
સુરજમાહાલની શોઠાની વધારેલી કીમત	૬–૦
સેતાનનો સાથી	૩–૦
લુપીનની લાહેરી	૧–૧૨
દોલતે દુન્યા	૧–૮

☞ એ ઉપ્રાંત દરેક સ્કુલોમાં ચાલતી ચોપડીઓ, તરેહવાર જાતની ઈંગ્રેજી તથા ગુજરાતી વારતાની ચોપડીઓ, શાર્ટહેંડ કેસીસો, એકસરસાઇઝ બુકો, મીનીંગ બુકો, તેમજ વિદ્યા, હુન્નર, તવારીખ, ગણીત, ગાયન વિગેરે વિગેરે જાતનાં પુસ્તકો અમારે ત્યાંથી કીફાયત ભાવે મલી શકશે.

પીરોજશાહ દીનશાહ મુકાદમ,

ચોપડીઓ વેચનાર તથા પ્રગટ કરનાર, ચરચગેટ સ્ટ્રીટ કોટ—મુંબઈ.

સરવે જરથોસ્તીઓને ખુશ ખબર.

☞ પારસીઓમાં પ્રખ્યાત તેમજ માન પામેલી ખુદ મલબારી સુખડની **અસલ** જુની અને જાણીતી દુકાન.

ન્યુ ચરનીરોડ સટોર્સ.

સ્થાપના સને ૧૯૦૮

કામા બાગની અગીયારીના દરવાજાની બરાબર સાંમેની દુકાન.

માલેક—કેખશરૂ દારબશાહ હીરજીભાઇ શરાફ.

મહેરબાંન

જરથોસ્તી બાનુઓ અને ગ્રહસ્થો.

હમારી દુકાને **ખુદ મલબારી સુખડની** માચી, પેરીયાં, સલી, ગાંથ, તાછો **તેમજ** ખરૂં કોરીનુંજ લોબાન, પેહેલા નંબરનું રશનું લોબાંન, ખરૂંજ ખુશબોદાર **અગર**, ખુદ નવસારીની થોકદારપતીની કસતીઓ, નારાં વગેરે મલશે.

ખાત્રીપૂરવક માલ હમેસા કીફાયત ભાવથીજ મલશેજી.

☞ **મહેરબાંની કરી તમો પોતે એકજ વખત આવીને ખાત્રી કરશોજી.**

માનસ પાશે માલ મંગાવો તો હમારી દુકાનનું બીલ (આંકડો) **જરૂર** મંગાવશોજી.

☞ **બહાર દેશાવર ખાતે વી. પી. થી મોકલવામાં આવશે.**

કેખશરૂ દારાબશાહ હીરજીભાઇ શરાફ,

ન્યુ ચરનીરોડ સ્ટોરસના માલેક,

(પોસ્ટ ગીરગામ) ન્યુ ચરનીરોડ, મુંબઇ. નં° ૪

Printed by Sorabji M[illegible] No. [illegible] Vakils Bung[illegible] and published by Sorabji & Hormasji M[illegible] Bombay.